

Date of Publication 10<sup>th</sup> Posted on Every Month

₹ 160



સમાનો મનો : ૧ (કુદરદ)  
સમાની પ્રણા : (અથવાદ)

# પરબ

તત્ત્વી : વેજેશ જોખી

પરબ



સમાનો મન્ત્ર : (ક્રોનિક)

સમાની પ્રપા (અથર્વવેદ)

# પરબ

સ્થાપના વર્ષ : ૧૯૬૦

વર્ષ : ૧૦

જૂન-જુલાઈ : ૨૦૧૬

અંક : ૧૧

## લાભશંકર ટાકર : કાવ્યાસ્વાદ વિશેષાંક

: પરમર્શનસંસ્થિત :

ચન્દ્રકાન્ત ટોપીવાળા

રત્નલાલ બોરીસાગર

ઉષા ઉપાધ્યાય

પ્રમુખ

મધ્યસ્થ સમિતિના વરિષ્ઠ સભ્ય

પ્રકાશનમંત્રી

: તંત્રી :

યોગેશ જોણી



## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેઘાણી શાનપીઠ .૦૦ ક. લા. સ્વાધ્યાયમંહિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ,  
‘થઈમસ’ પાછળ, નાદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૮

# પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

૧/૧૫૮૦ 'પરબ' દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.

૨/૧૫૮૦ 'પરબ'ના ગ્રાહક તથા પરિષદના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.

૩/૧૫૮૦ 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦ છે.

૪/૧૫૮૦ વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૭૫ છે, પ્રમાણપત્ર સાથે બીડવું.

૫/૧૫૮૦ ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજીવન સભ્યપદના શુદ્ધકમાં 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.

૬/૧૫૮૦ પરિષદના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુદ્ધ રૂ. ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુદ્ધ રૂ. ૩૦૦ છે.

૭/૧૫૮૦ પરિષદના આજીવન સભ્યપદનું શુદ્ધ રૂ. ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સભ્ય ઝી રૂ. ૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)

૮/૧૫૮૦ 'પરબ' લવાજમ તથા પરિષદ સભ્યપદ શુદ્ધકની રકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ ઝર્ફથી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.

વેખકોને :

૯/૧૫૮૦ 'પરબ'માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે વેખકની રહે છે.

૧૦/૧૫૮૦ વેખકોએ પોતાનું લખાણ ફૂલ્સકેપ અથવા A4 સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અક્ષરે લાખી મોકલવું, પોસ્ટકાર્ડ, ઈનલેન્ડ કે ચબરણીઓમાં કૃતિ મોકલવી નહીં. પ્રત્યેક કૃતિ નીચે પૂરું સરનામું લખવા તથા એક નકલ પોતાની પાસે રાખીને જ કૃતિઓ મોકલવા વિનંતી.

૧૧/૧૫૮૦ કૃતિની જાણ કરાશે. ટાપલ-ટિકિટે ચોંટાટેલું કરવ મોકલ્યું હશે તો અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે, અન્યથા કૃતિ રદ ગણવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતિની જાણ કરાશે.

૧૨/૧૫૮૦ મત્રવ્યવહારનું સરનામું : તંત્રી, 'પરબ', ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'ટાઇમ્સ' પાછળ, નાદીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

આ વિશેષાંક માટે શ્રી વલ્લભદાસ મૂળાંદદાસ પરીખ (લાલન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ)નો આર્થિક સહયોગ મળ્યો છે.

E-mail : gspamd@vsnl.net

ફોન અને ફેક્સ : ૨૬૫૮૭૮૪૭

Web-site : [www.gujaratisahityaparishad.org](http://www.gujaratisahityaparishad.org)  
[www.gujaratisahityaparishad.com](http://www.gujaratisahityaparishad.com)

ISSNO250-9747 પરબ

છૂટક ક્રિ. રૂ. ૧૬૦/-

માલિક : ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : ઉખા ઉપાય્ય (પ્રકાશનમંત્રી), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'ટાઇમ્સ' પાછળ, નાદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૮ □ તંત્રી : યોગેશ જોથી □ મુદ્રણસ્થાન : થારણી મુદ્રણલાયુન-કુલીનીતિલાગાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૬  $\Rightarrow$  ૨૬૫૬૪૨૭૯૬

## અનુક્રમ

□ સંપાદકીય : વહી રહી આગળ કાવ્યઘોષા.... ૨૨૧ યોગેશ જોધી • ૭

૧૮ વહી જતી પાછળ રમ્યઘોષા (૧૮૬૫)માંથી

૧. 'ચાંદરણું' વિશે ગુરુ રઘુવીર ચૌધરી ૧૮

૨. સનાતન સખ્ય, પ્રેમ અને દાંપત્યનું કાવ્ય (અંતિમ ઈચ્છા) ૨૨૧ હરિકૃષ્ણ પાઠક ૨૧

૩. આધુનિક પ્રયોગશીલ કવિની છંદોરમ્ય કાવ્યકૃતિ (સ્મૃતિ) ૨૨૧ ભાનુપ્રસાદ પંડ્યા ૨૫

૪. વૃદ્ધચેતનાના મોક્ષનું કાવ્ય (બારી બહાર જોતો વૃદ્ધ) ૨૨૧ હર્ષદ ત્રિવેદી ૨૨૧ ૩૦

૫. અન્યની આંખે પોતે કરેલું દર્શન (વરસાદ પણી) ૨૨૧ વિનોદ જોશી ૨૨૧ ૩૪

૬. ભૂત-વર્તમાનની સાંકળ સમું પર્તિગ્રિયું (પર્તિગ્રિયું) ૨૨૧ ધીરુ પરીખ ૨૨૧ ૩૮

૭. 'સાંજના ઓળા લથડતા જાય' ૨૨૧ નિરંજન ભગત ૨૨૧ ૪૧

૮. 'સૂર્યને શિક્ષા કરો' વિશે ૨૨૧ કુમારપાળ દેસાઈ ૨૨૧ ૪૬

૯. કલ્યાન-પંખીઓનો મુક્ત ગગનવિહાર... (તડકો-૧, તડકો-૨) ૨૨૧ રાધેશયામ શર્મા ૨૨૧ ૪૮

૧૦. નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં... (શાવશી પૂર્ણિમા) ૨૨૧ જ્યેષ્ઠ શુક્લ ૨૨૧ ૫૭

૧૮ માણસની વાત (૧૮૬૮)માંથી

૧૧. માણસની વાત : નિર્ભાન્તિ-ભાન્તિની લીલા ૨૨૧ રઘુવીર ચૌધરી ૨૨૧ ૬ ૧

૧૯ 'મારા નામને દરવાજે' (૧૮૭૨)માંથી

૧૨. મેં કવિતા લખવાની શરૂઆત કરી : રચનાબંધનો ચયત્કાર ૨૨૧ ચંદ્રકાન્ત ટેપીવાળા ૨૨૧ ૮૪

૧૩. અનન્ય કાવ્યત્વ દર્શાવતું કાવ્ય (હું એને જગાનું છું) ૨૨૧ રાજેન્દ્ર પટેલ ૨૨૧ ૮૮

૧૪. આંતરખોજના અંશો દાખવતી એક કબૂલાત (મારા નામને દરવાજે) ૨૨૧ બારીન મહેતા

૨૨૧ ૧૦૨

૧૫. 'અવાજને ખોટી શકતો નથી' તથા 'કવિ લઘરણનું ચિંતન' વિશે ૨૨૧ ચંદ્રકાન્ત શેઠ ૨૨૧ ૧૧૫

૧૬. અને એબ્ઝર્ડ કવિતાને સાર્થક થવા ખપ લાગ્યો વ્યાજરૂત્તિ અલંકાર (અને છિટકરને મેં જન્મતાં જોયો છે.) ૨૨૧ નીરવ પટેલ ૨૨૧ ૧૨૧

૧૭. 'કવિવર નથી થયો તું રે' વિશે ૨૨૧ હરિકૃષ્ણ પાઠક ૨૨૧ ૧૨૭

- १८ ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪)માંથી
૧૯. ‘સ્તવન’ વિશે ૨|૨૧ રમણ સોની ૨|૨૧ ૧૩૧
૧૯. કાળી ડેલથી જળશય ભરવાની વાત (પ્રસ્તાવના) ૨|૨૧ રવીન્દ્ર પારેખ ૨|૨૧ ૧૩૫
૨૦. અમથાને સમજને થતું અમયું મહિમાગાન (સમજયા) ૨|૨૧ સંજુ વાળા ૨|૨૧ ૧૩૮
૨૧. કવિતાની હિશા તાકતી રચના (ક્યારે વૃત્તિ થાય અને....) ૨|૨૧ જ્યદેવ શુક્રલ ૨|૨૧ ૧૪૪
૨૨. ‘હું શોધું છું’ વિશે થોડું ૨|૨૧ શિરીષ પંચાલ ૨|૨૧ ૧૪૬
૨૩. કવિતા વડે ભાષા રચતા કવિની કાવ્યમથામણ (વ્યવસ્થાઓ) ૨|૨૧ મણિલાલ હ. પટેલ  
૨|૨૧ ૧૫૧
૨૪. ‘કવિ’નું મૃત્યુ (કવિનું મૃત્યુ) ૨|૨૧ હર્ષ બ્રહ્મભટ ૨|૨૧ ૧૫૮
૨૫. કવિ લાભશંકરના નિર્ભાત દર્શનથી શુભચેત – ‘પ્રવાહણ’ ૨|૨૧ રાહેશમ શાર્મિ ૨|૨૧ ૧૬૨
૨૬. ‘કાલગ્રાન્થિ’ (૧૯૮૮)માંથી
૨૭. જનમથી જ મૂકેલો છે ગરીમબોંઘ કોણો ? (કાલગ્રાન્થિ) ૨|૨૧ રાહેશ પંડ્યા ૨|૨૧ ૧૮૨
૨૮. ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ (૧૯૯૦)માંથી
૨૯. બહેરાશને સંભળતાં ટોળાં અવાજ ઘોંઘાટ (ટોળાં અવાજ ઘોંઘાટ) ૨|૨૧ કમલ વોરા  
૨|૨૧ ૨૦૫
૩૦. હોવાપણાની નિરથક્તાને ઉકેલવા મથતું કવિકર્મ (જણ જીવો જી) ૨|૨૧ મણિલાલ હ. પટેલ  
૨|૨૧ ૨૧૨
૩૧. ‘આમ ખેંચીએ જરાક જોરથી – ’નું એક અનુ-આધુનિક વાચન ૨|૨૧ સુમન શાહ ૨|૨૧ ૨૧૫
૩૦. ‘હેઈસો હેઈસો’ : એક આસ્વાદ ! ૨|૨૧ યજેશ દવે ૨|૨૧ ૨૩૦
૩૧. ‘કુલ્યાયન’ (૧૯૯૮)માંથી
૩૨. ‘...આવે છે અવાજ અંદરથી, કલ્યો...’ (અમ કલ્યો) ૨|૨૧ તિલાસ પટેલિયા ૨|૨૧ ૨૩૪
૩૩. ‘કિચૂડ કિચૂડ’ (૧૯૯૮)માંથી
૩૪. વીભરાયેલું ધૂવપદ (આપણે પ્રવારી પારાવારના) ૨|૨૧ રમણીક સોમેશ્વર ૨|૨૧ ૨૩૮
૩૫. ‘હથિયાર વગરનો ઘા’ (૨૦૦૦)માંથી
૩૬. ‘સિસિફસની સગી’ : ‘દરજણા’ કવિતા (બટકતી ભાષાના ધાગાથી) ૨|૨૧ પરેશ. નાયક  
૨|૨૧ ૨૪૪

- ૧૮ ‘ટેવ’ (૨૦૦૧)માંથી  
 ત૪. ઊઘની વિમાસણ : મહેતાથી ઠાકર સુધી.... (ઊઘી ગયા છે ટેવભર્યા રે ઊઘણશી)  
     ૨૨૧ સમીર ભંડ ૨૨૧ ૨૪૮
- ત૫. ટેવ : જીવનના એકધારાપણનું કાબ્ય (ટેવ જગડાવે બબડાવે ઝગડાવે) ૨૨૧ કિશોર વ્યાસ  
     ૨૨૧ ૨૫૪
- ૧૯ ‘છે’ (૨૦૦૨)માંથી  
 ત૬. ‘કાચબો ચાલે છે’ : ‘ચાલવું’ એ જ નિયતિ ૨૨૧ દક્ષા વ્યાસ ૨૨૧ ૨૫૭  
 ત૭. ‘છે-ની બારીમાંથી સામે’ વિશે ૨૨૧ સુભાષ શાહ ૨૨૧ ૨૫૮
- ૨૦ ‘આઈ ડોન્ટ નો, સર’ (૨૦૦૨)માંથી  
 ત૮. ‘કોણ ઘડે છે કીડીઓનાં નેપુર ?’ : સાધન આંદું ને સાહેબ દૂર ! ૨૨૧ દલપત પાટિયાર ૨૨૧ ૨૬૩
- ૨૧ ‘રહત ?’ (૨૦૦૩)માંથી  
 ત૯. મૃત્યુના માર્દવનું ગાન (મૃત્યુ મા જેવું મધુર ગાન કરે) ૨૨૧ દર્શના ધોળકિયા ૨૨૧ ૨૭૧
- ૨૨ ‘ભેં કમિટ કર્યું છે શું ?’ (૨૦૦૪)માંથી  
 ૪૦. એ કેવળ સ્વકેન્દ્રી કવિતાના કવિ નથી (ધોર્દું છે) ૨૨૧ પ્રવીણ પંડ્યા ૨૨૧ ૨૭૫  
 ૪૧. ઉત્તરફણની એક ઉત્કળ શોધ (પ્રશ્ન) ૨૨૧ રાજેન્દ્ર પટેલ ૨૨૧ ૨૭૮
- ૨૩ ‘કેમેરા ઓન છે’ (૨૦૦૫)માંથી  
 ૪૨. સેફિનું એડિટિંગ સંભવ છે ? (અંખની ઉઘાડ-વાસમાં...) ૨૨૧ બનુલ ટેલર ૨૨૧ ૨૮૬  
 ૪૩. ‘કેમેરા ઓન છે’ – સર્જકચિત્તનું આધુનિક મિથ (તું આ ક્યારનોય શું ખોઈ રહ્યો છે ?)  
     ૨૨૧ યોસેફ મેકવાન ૨૨૧ ૨૮૮
૪૪. સામે કાંઈ પહોંચવાની રાહ. (ધંડું છું મને પણ હજ ઘડાયો નથી) ૨૨૧ પારુલ કંદર્પ દેસાઈ  
     ૨૨૧ ૩૦૨
૪૫. પંચેન્દ્રિયમાં પ્રસરતો પંખી-સ્વર (શી-ઈ-ઈ-ઈ- !) ૨૨૧ રમણીક સોમેશ્વર ૨૨૧ ૩૦૫
- ૨૪ ‘ઈન અને આઉટ’ (૨૦૧૨)માંથી  
 ૪૬. લીલયા પ્રવૃત્તિની પરિણતિ (ઉપાદાનમાં આળોટીન...) ૨૨૧ ભગવતીકુમાર શર્મા ૨૨૧ ૩૦૮  
 ૪૭. ખરા મધ્યાહ્નને લાંઠાંની કવિતાનો દરજાડો (સવારના આછા આછા આધાપાછા  
     થતા...) ૨૨૧ મહેન્દ્રસિંહ પરમાર ૨૨૧ ૩૧૧
૪૮. લિલકુલ આ ક્ષણનો શાબ્દ : લાંઠાંનાં નણ લઘુકાબ્યો (શાબ્દ; શું થશે ? ‘માણા’માંથી –  
     કાબ્યપુરુષ પકડે છે, ભાષા તાકે) ૨૨૧ ધીરેન્દ્ર મહેતા ૨૨૧ ૩૧૪

- કળારસિક લાભશંકર ઠાકરનું નિર્નિમેષ ગેઝિંગ અને દશ્યકળા : એક કોલાજ  
૨/૨૧ પીયૂષ ઠક્કર ૨/૨૧ ૩૨૦

- આપણી વાત ૨/૨૧ પ્રફુલ્લ રાવત ૨/૨૧ ૩૨૭

#### ૧૮ પરિશીષ્ટ :

૧. લાભશંકર ઠાકર : જીવનવહી અને સાહિત્યસર્જન ૨/૨૧ ઉર્મિલા ઠાકર ૨/૨૧ ૩૩૫
  ૨. અજનબી અગોચર ઓંતારિક ૨/૨૧ લાભશંકર ઠાકર ૨/૨૧ ૩૪૦
  ૩. રહસ્યમય ગૂઢ અંધકારના કાઠે કવિની કેફિયતનો અવાજ ૨/૨૧ લાભશંકર ઠાકર ૨/૨૧ ૩૪૬
  ૪. લાંઠાં - વહાલસોયા વિદોહી ૨/૨૧ સિતાંશુ યશશેંદ્ર ૨/૨૧ ૩૫૮
  ૫. 'મૂલપર્યત જોવાની મથામણ' કરતા સંપ્રક્રાન્તિ ચંદ્રકાન્ત શેઠ ૨/૨૧ ચંદ્રકાન્ત શેઠ ૨/૨૧ ૩૬૫
  ૬. 'તડકો-૧' વિશે ૨/૨૧ ચંદ્રકાન્ત શેઠ ૨/૨૧ ૩૭૧
  ૭. 'તડકો-૨' વિશે ૨/૨૧ ચંદ્રકાન્ત ટોપીવાળા ૨/૨૧ ૩૭૬
  ૮. 'માણસની વાત' વિશે ૨/૨૧ ઉમાશંકર જોશી ૨/૨૧ ૩૭૭
  ૯. 'હું એને જગાનું હું' વિશે ૨/૨૧ ચંદ્રકાન્ત ટોપીવાળા ૨/૨૧ ૩૭૮
  ૧૦. 'કલ્પાયન' વિશે ૨/૨૧ રઘુવીર ચૌધરી ૨/૨૧ ૩૭૯
  ૧૧. કલ્પનાની વિલક્ષણ અરાજકતાનું ચૌંદર્ય ૨/૨૧ રાધીશયામ શર્મા ૨/૨૧ ૩૮૩
  ૧૨. કવિની પ્રતિબદ્ધતા ૨/૨૧ નલિન રાવળ ૨/૨૧ ૩૮૬
  ૧૩. કલ્પો કે લાભશંકર 'લાંઠાં'ને કલ્પે છે ૨/૨૧ પ્રબોધ પરીખ, અનુ. પરેશ નાયક ૨/૨૧ ૩૮૦
  ૧૪. લાભશંકર ઠાકર : ઉત્કર્ત ચેતનાનો કવિ-અવાજ ૨/૨૧ યોગેશ જોધી ૨/૨૧ ૩૮૫
- આવરણ ૨/૨૧ શ્રી અતુલ ડેડિયા

ઉમાશંકર જોશી તથા પ્રહુલાદ પારેખ વિશે શતાબ્દી નિમિત્તે ‘પરબ’ના કાવ્યાસ્વાદ વિશેષાંક કર્યા હતા. લાભશંકર ઠાકરને અંજલિ રૂપે હવે આ કાવ્યાસ્વાદ વિશેષાંક. લાંઠાને અંજલિ.... લખતાં જ જાણે કાને પડે છે લાંઠાનો અવાજ, અરુઢ ગીતની પંક્તિઓ....

‘ઠાકરની આંખમાં ઠળિયા રે જજા જીવો જી.  
હૈયાના ખાલીખમ ઝળિયાં રે જજા જીવો જી.

.... .... ....

ભડભડ ચેહમાં બાળિયા રે જજા જીવો જી,  
અમથાં અલખ અજવાળિયાં રે જજા જીવો જી.’

ઠાકરની આંખમાં ઠળિયા ?! ના, કેમેરા, કવિ-કેમેરા – લાભશંકરીય લય-મુદ્રાવાળા સૂક્ષ્મ લેન્સ ધરાવતો... આ ‘કેમેરા’માં ‘માણસ’ ડિલાય, મનુષ્યની પીડા ડિલાય, જીવનની વિનંગાત્ર ડિલાય, ‘કટ્યનો’ ડિલાય, રમ્ય લયઘોષ ડિલાય, લખારી રૂપે મનોમુદ્રાઓ પણ ડિલાય, અજનબી અગોચર પણ ડિલાય, ‘આઉટ’ની સાથે ‘ઈન’ પણ ડિલાય, થડ તડકાનું ખડબાચું ડિલાય, અંધકારની યોનિમાંથી સરકતો તડકોય ડિલાય, તડકાનું ધોળ્યું-પીળ્યું થરકવુંધ ડિલાય ને ગાંધીજીની યાલ પણ ડિલાય, ઊંચાંનીચાં મકાનોની વાંકીચૂકી શેરીઓમાં ગાયબકરીની સાથે અથડાતા ને પછાતા પડછાય ડિલાય, ચુપકીદીએ લીધેલું ચાંદનીનું રૂપ ડિલાય, દરિયાના જળરાશિમાં હલબલતો વિસ્તાર – ‘હું’ ડિલાય, કાંઠા-ખડક પર જાળ નાખીને ઊંધી ગયેલો ઈશ્વર ડિલાય, તુખારના ટીપામાં બજતી મુરલિયા ડિલાય, એક મનુષ્ય સ્ત્રીના પેટેથી અવતરતો હિટલર ડિલાય તો પંચોતેર હજાર વહુદીઓનું સ્થળાંતર પણ ડિલાય, લઘરાનાં આંસુમાં પલળેલા શબ્દો ડિલાય, લઘરાના કાનમાં મરી ગયેલ મચ્છર પણ ડિલાય, ઉલેચાતો શબ્દ ડિલાય, કવિ લઘરાજીનું ચિંતન ડિલાય – (‘મને આપો અમી-ની ઘાલી, ઓ ઘાર પ્રભુ / હું પી જવાનો ધું નહીં તો પાપને, / પાપના પ્રાસે / શર્કું ખેંચી અનાદિ આપને..), શબ્દની કાણી ડોલમાં છલકાતું ભરચુક પાણી ડિલાય, આંખ સામે સિદ્રુદ્ધીજ કરતી કદલીફલ જેવી ભાષા ડિલાય, કમોડ પર બેસીને થતું પ્રાશ પ્રક્ષાલન – ઉત્સર્જન ડિલાય, ચાબુકની વ્યવસ્થાથી ચાલતો પથરનો ઘોરો ડિલાય, મુતરરીના બ્રલસરોવરમાં તરફહતા વંદાની મૂછોનો ફરકાટ પણ ડિલાય, ગોરી ગાગરીમાં સોપારીના કટક જેવી પોચી પડી જાય એવી પ્રજા ડિલાય, શેરીમાં કૃતરાની જેમ રડતો પવન ડિલાય.... ....

કેટકેટવું ડિલાય ઠાકરની આંખમાંના હજાર હજાર સૂક્ષ્મ સર્જક-કેમેરામાં ? ને જે કઈ ડિલાય એનું એમની ભીતરના પ્રાણ પ્રોસેસરમાં પ્રોસેસિંગ થાય, નિર્મમ નિર્ભાન્ત એડિટિંગ થાય ને પછી પ્રગટે કાવ્યઘોષાનાં કેવાં કેવાં રૂપો ! —

હાથમાંના બરફના ગોળા સાથે અચાનક જમીન પર ગબડી જતો સમય, સમયનાં મેટાફોરિકલ ટ્પકાં, બ્રહ્મના ઈંડામાંથી ઉઘડતા સમયનું ટેંહોક ટેંહોક, નામને દરવાજે ખડો રહેલો બંગલો – રોધી શાસ, અવરોધી નાશ; મારા રામને દરવાજે હરદમ ખડો રહેલો હું – અંધ – ભીતરના ભોગળ બંધ; વાગીશરીના નેત્રસરોવરનું પાણી, સ્વરષ્ટ-સાહન્સાદા-શીધા શબ્દની શોધ, યાંત્રિકતાનો ધ્વનિ – યાન્ન ત્રિઝ તા યાન્ન ત્રિઝ તા યાન્ન ત્રિઝ તા, મનવગડામાં ખણકતી ઘૂધરમાળ, ભૂખરી ચિંતાઓ ને સફેદ હંસ જેવાં સપનાંઓ, બહેરાશના કુવામાં ઊરે ઊરે ઊંડે ઊછળતાં ટોળાં અવાજ ઘોંઘાટ, સફેદ પતાસાં જેવી ઊંઘો, વિશેષણની ચાદર ઓઢીને ઘસઘસાટ ઊંઘતો શબ્દ, ભાષાના કાદવમાં તરવા મૂકેલી કોરા કાગળની હોડી, હંસપક્ષીઓનાં પડખાંથી ચલાયમાન કમળો, સુકાયેલા સમુદ્રને ઊંઘકીને જળાશયની શોધમાં ચાલતો કાચબો, શેરીમાં થરકતી વંધાના ગર્ભશયની રિક્તતા, ખરબચડી કાળી દીવાલો પર એક પતંગિયું, કોણાઈના નારીશિલ્યની ખંડિત થોનિમાં સ્થળનુર્વેની ઉંટતામાં તુંદું તુંદું થતો સમય, સાહેબ અને દાસ વચ્ચેની સરિયામ સહક પર અર્થભેર કચડાતી કીડીઓ, મા જેવું મધુર હાસ્ય કરતું મૃત્યુ, પાણીએ ધરેલાં ઘણાં રૂપો – અન્ન, વન, તન, મન... ધરતીની બેખડ સાથે અથડાતો લાંઠાંનો સમય –

લગા ગાગા ગાગા —  
ચૂરેચૂરા થઈ જતો લલલ લલગા —  
વેરાઈને વિસ્થિન થઈ જતો  
પૃથ્વીના કરોડો કણ કણમાં ગાલ લલગા —

થાય છે, નીરખી રહીએ કાનથી લાંઠાંની વહી જતી આગળ કાવ્યઘોષા....

લાંઠાંનો એકવીસમો કાવ્યસંગ્રહ ‘કેમેરા ઓન છે’ પ્રગટ થયો ઈ. સ. ૨૦૦૮માં અને બાવીસમો કાવ્યસંગ્રહ ‘ઈન અને આઉટ’ ઈ. સ. ૨૦૧૨માં પરંતુ ઈ. સ. ૧૯૬૫માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ પ્રગટ થયો ત્યારથી, પ્રથમ કાવ્ય રચ્યું ત્યારથી, ‘ચા બા પા’થી.... લાંઠાંનો સર્જક-કેમેરા ઓન છે અને zoom in અને zoom out થતો રહ્યો છે – ‘અજનભી અગોચર અંતરિક’ને પામવાની મથામણ કરતો... લાંઠાંમાં છંદ-લય હેમેશાં રમ્યઘોષ કરતા રહ્યા છે. લાંઠાંની મુદ્રાવાળા વસંતિલકમાં કેવાં ગતિશીલ દશ્ય-શ્રાવ ડિલાય છે એનું એક ઉદાહરણ – ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માંના ‘સ્મૃતિ’ કાવ્યમાંથી થોડીક પંક્તિઓ નીરખીએ, સાંભળીએ, સંવેદીએ.... —

‘ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૂષ  
 બેહું કૂડા પર જરા ફિફડાતી પાંખો  
 કૂડા મહીં છલકત્તા જલમાં ઝબોળી  
 ચંચૂ અને કરી જરા નિજ પુષ્ટ ઉંચી  
 છેડી દીધી સહજ કંઈ તણી સત્તાર !

... ...

... ...

### અચાનક

ઉડી ગયું ક્યાંક દૈયડ દશયને લે  
 પાંખો મહીં

નજર વૃદ્ધ ફરી ફરી શી  
 છાપા વિષે દૂલી જવા મથતી, સવારે !’

‘અચાનક’ અગાઉની સ્પેસ, ‘પાંખો મહીં’ પછીની અને ‘નજર વૃદ્ધ ફરી ફરી’ પહેલાંની સ્પેસ અનુભવીએ. ઉત્કટ સંવેદના ભાવકચેતનામાં ઊરે ઉત્તરે એ માટે કવિએ કેવી જગ્યાઓ છોડી છે ! અને એ થકી ભાવકને ઊરો ચાસ લેવાનો અને છોડવાનો સમય પણ આપ્યો છે ! સહદ્ય ભાવકનો ચાસ પણ ઘડીક થંબે ને પછી ‘વસ્તંત્રિલકા’માં આગળ ચાલે ! પ્રથમ કાવ્યસંગ્રહથી જ એમનાં ઘણાં કાબ્યોમાં વૃદ્ધોનાં સંવેદનો ઉત્કટતાથી કાવ્યરૂપ પામતાં રહ્યાં છે.

તારાશંકર બંદોપાધ્યાય આ ક્ષાણે મારી નબળી સ્મૃતિમાં ઊભરાય છે – એમની કોઈ કૃતિમાં વાંચેલું – દરિયા કે નદીકાંઠે બાળક રમતું હોય ત્યારે એના હાથને સુખ ભોગવવાનું મન થાય એટલે પગ પર રેતીનો ઢગલો કરીને ઘર કે મંદિર બનાવે, પછી એના પગને સુખ માણવાનું મન થાય એટલે લાત મારીને તોડી નાખે. લાંઠાય આવી જ લીલા (ખૂજલી કે રમત ભલે તેઓ કહેતા) સતત કરતા રહ્યા – શબ્દ સાથે, લય સાથે, ભાષા સાથે, જાત સાથે... ભાષાનાં વિવિધ રૂપો ઘડે ને જાતે જ તોડે... મનુષ્યને તેમજ જાતનેય સતત જોયા કરે – દૂરથી, નજીકથી, બહારથી, અંદરથી... ને કશો ઘાટ ઘડવા નિર્મભ બનીને તોડશોડ કરતા રહે ને એનો આનંદ લૂંટતા રહે. (ઘડતાં ઘડતાં / હું / મને એ જ પૂછું છું : / રે હું ક્યારે ઘડાઈ રહીશ ? – ‘કેમેરા ઓન છે’, પૃ. ૮૪) સર્જનની જેમ વિ-સર્જનનોય આનંદ માણતા રહે, ઉત્-સર્જનનોય આનંદ માણતા રહે. પોતાના કામને ને નામને સતત સ્વાપતા-ઉથાપતા રહે, ભાષાની સાથે ને જાત સાથે સતત એન્કાઉન્ટર કરતા રહે, લાંઠાની ‘અનેક ઓળખ (અને વારંવાર થતો ઓળખબંગ)’ નિમિત્તે સિતાંશુ લાંઠાને ખૂબ ગમતી વોલ્ટ છિટ્ટમનની એક પંક્તિ નોંધે છે – ‘કુ આઈ કોન્ટ્રાડિક્ટ માયસેલ્ફ ? – વેલ, આઈ કન્ટેઇન મલિટ્યુડ્જઝ.’ અને કહે છે, ‘પોતાની

અંદર મલિટ્યુડોને, ગંજાવર બહુલતાને સમાવી શકે એવી બહોળી અને ઊંડી ખુલ્લાશ ધરાવનાર બીજો હવે ક્યાં ગોતવો ગુજરાતમાં ?

બધા કવિ પોતાના પહેલા કાવ્યસંગ્રહના પ્રેમમાં હોય, જ્યારે પોતાનું સતત એન્કાઉન્ટર કરતો રહેતો આ કવિ, કવિચેતનાનો ઉત્કટ અવાજ પેટાવતા પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ના પ્રાસ્તાવિકમાં શું કહે છે ? -

‘તો મરી ગયેલાં શરીરોની ઉચ્છુલ સુગંધનો સંગ્રહ  
ભવે પ્રકટ થતો.’

પ્રથમ સંગ્રહના કાવ્ય ‘ચાંદરણું’ પર બચુભાઈ રાવત અને કવિગુરુ ઉમાશંકર પણ રજી હતા (સહૃદાનું થાય તેવું કાવ્ય) એ કાવ્ય વિશે લાંઠાં કહે છે - ‘છંદની અને કૃતક પ્રેમની, સર્વથા કલિપત પ્રેમની ચૂસાણી ચૂસતા લાભશંકરની એ કૃતક કાવ્યરચના. એનો અંત કેવો સેન્ટિમેન્ટલ છે ? સર્વથા રૂગણ, સિક્ક.’

છંદોલય બાબતે લાંઠાંના કાન એકદમ સરવા, નરવા. પ્રથમ કાવ્યસંગ્રહના સહજ-સુંદર-રમ્યઘોષા છંદોલય બાબતે પણ સહૃદાનું પ્રસન્ન. છતાં છંદો બાબતે તેઓ કહે છે - ‘છંદોને મેં જાતે શીખી શીખીને આત્મસાત્ર કર્યા. પછી એ અક્ષરમેળ છંદોને અને માત્રામેળ છંદોને મોંદાં લઈને ચૂસવામાં પણ કંઈ ઓછાં વર્ષો ગયાં નથી. એ છંદો ખરેખર સ્તનો હતાં કે ધાવણી હતા ? ચૂસાણી હતા ?’

પ્રથમ કાવ્યસંગ્રહનાં સહૃદ્દને પ્રભાવિત કરનારાં, (‘કુમાર’ ચંદક જેના થડી મણ્યો એ કાવ્યો) કાવ્યો બાબતેય લાંઠાં કહે છે - ‘કૃતક હતી એ રચનાઓ.’

પ્રથમ સંગ્રહનાં ‘તડકો-૧’, ‘તડકો-૨’ કાવ્યથી લાંઠાંની કાવ્યઘોષા એક મોટો રમ્ય, નવ્ય વળાંક લઈને વહેવા લાગ્યો. ‘તડકો’માંના લાભશંકરીય મુદ્રાવાળા ‘કટાવ’થી સહૃદય ભાવકો-વિવેચકો સહૃદ્દને પ્રસન્ન.. તો, આ ‘કટાવ’ બાબતે લાંઠાં પોતે શું કહે છે ? - ‘સર્જકને સંમોહિત કરી, દ્રાન્સમાં ગરક કરતો, એકધારો છંદોલય લાભશંકરની કાવ્યમૂર્છા છે.’

આ કાવ્યમૂર્છામાંથી બહાર આવવા માટે તથા ‘મૂલ્યપરસ્ત સાંસ્કૃતિક શબ્દાર્થોમાં અનુભવાતી તિરાડોના (કૃતિ, સંસ્કૃતિ નહીં) કારણે ‘રમ્યઘોષા’ને પાછળ રાખીને કવિનું સ્થિત્યંતર થયું ‘માણસની વાત’માં. ‘ઓઝ્સર્ટ’ એમણે પચાબું છે. આધુનિકતાનેય પચાવી છે. આથી એમનામાં જીવનની તથા માણસની બાદબાકી નથી. ઈશ્વરના અસ્તિત્વમાં નહીં માનનાર આ કવિને માણસના અસ્તિત્વમાં, એનાં મૂળ-કુળમાં અપાર રસ છે.

લાભશંકર ઠાકરના નિબંધો અંગે ચંદકાન્ત શેર્ટ નોંધ્યું છે -

‘લાભશંકરની સૂક્ષ્મ પ્રકારની ધાર્મિકતા - આધ્યાત્મિકતા; તેમની કરુણા, તટસ્થતા ને સ્વસ્થતા; આ નિબંધોની ક્ષાળોને ચિરંતનતા બક્ષે છે. લાભશંકરમાં એક માનવપ્રેમી આસ્તિક હોવાની પ્રતીતિ આ નિબંધો દફાખે કરાવે છે.’

આવી જ પ્રતીતિ ‘માણસની વાત’ તથા અન્ય કાવ્યોમાંથી પસાર થતાં પણ થાય છે. કવિકર્મ, કવિધર્મ, માનવધર્મ બાબતેની એમની integrity પણ એમના કવન અને સર્જનમાં પમાય છે. તેઓ ઈશ્વરને ભજુ નથી શકતા તો તજ પણ નથી શકતા. રામકૃષ્ણ પરમહંસ કહેતા – ‘ઈશ્વરનો સૌથી વધારે આવિર્ભાવ મનુષ્યમાં છે?’ સિતાંશુએ પણ નોંધ્યું છે –

‘હિટલરને પણ માનવ-સ્ત્રીનાં જગ્ઘનો વર્ચે જન્મ લેતો જોનાર આ કવિ પાસ્કલની જેમ કહેવાના કે ‘નવિગ હેટ ઈજ લુમન ઈજ એવિયન દુ મી.’ – માણસાઈનું એકે પાસું લાંઠાંને મન પણ પરાયું નહોતું.’

‘માણસની વાત’ વિશેના લેખમાં રાધેશયામ શર્માએ નોંધ્યું છે : “...નકારાત્મક ભાવે, અભાવ રૂપે પણ ઈશ્વરનું અસ્તિત્વ કવિતામાં તો સુસ્વીકૃત જગાયું.”

લાંઠાંના શબ્દમાં મેટાફિલ્ઝિકલ રણકાર પમાતો રહે છે.

કવિ-વિવેચક-નિબંધકાર ચંદ્રકાન્ત શેઠે ‘અખડતી ખેંચે કવિતા કોણ ?’ નામે લાભશંકર ઠાકરની ચૂંટેલી કવિતાનું સંપાદન કર્યું છે. તેની પ્રસ્તાવના “ મૂલપર્યત જોવાની મથામજા ” કરતા સંપ્રક્રાન્ત સાહિત્યસર્જક ”માં એમણે નોંધ્યું છે –

“ગુજરાતી સાહિત્યમાં એક તબક્કે કાવ્ય અને ગદ્યક્ષેત્રે જેવું વિલક્ષણ ને સત્ત્વશીલ પ્રદાન બંદ્રકાન્તનું હતું તેવું આજના તબક્કે લાંઠાંનું જગાય છે. ગુજરાતી કાવ્ય-ગદ્યના વળ-વળાંક-વિકાસમાં જેમના સર્જક-વ્યક્તિત્વની દઢ મુદ્રાઓ અંકિત છે તેવા સર્જકોમાં લાભશંકરનું નામ પણ લેવું પડે. ....”

જેમ ‘વિશ્વશાંતિ’, ‘છિન્નબિન્ન છું’, ‘પ્રવાલદ્વીપ’ તેમ ‘માણસની વાત’ ગુજરાતી કવિતાની એક સીમાચિકિત્પુરુષ કૃતિ છે.”

ઉમાશંકર જોશીએ ‘શબ્દની શક્તિ’માં ‘માણસની વાત’ વિશે નોંધ્યું છે –

“...મારે મન એનું મુખ્ય આકર્ષણ એનો લય છે. ....”

કવિ આગળ જતાં છિંદોના ટુકડા, જોડકણાં, લોકગીત આદિના લય પણ લીલયા કૃતિમાં વાળી લેતા ચાલે છે. અપદ્યાગદ્યના અણસાર આવ્યા કરે છે, પણ સમગ્ર લયમાં નહાનાલાલીય નહીં પણ ચોખી લાભશંકરીય મુદ્રા ઉઠે છે, જે પકડવી એ આ કાવ્યના આસ્વાદ માટે આવશ્યક છે.”

આટલું કહીને ઉમાશંકર અટકી ગયા છે ! રઘુવીર ચૌધરીએ ‘માણસની વાત’નો આસ્વાદ કરાવતાં નોંધ્યું છે –

“...ધારાખરા અવલોકનકારોએ આ રચનાને નિર્ભાન્ત થવાની પ્રક્રિયા રૂપે જોઈ છે. ....”

....

ઉમાશંકરભાઈએ ‘માણસની વાત’ને આસ્વાદી રચના કહી છે, પણ એમની સાથે ચર્ચા

કરવાની તક મળી હોત તો ‘નિર્ભાન્તિ’ વિશે શક્ય સ્પષ્ટતા થાય. લાંઠાં પોતે આન્તિ વિશે સ્પષ્ટ થવા જેણે છે ખરા ? કઈ પણ તારવવું આ કવિતામાં રહેલી લયાત્મક સર્જકતાને અન્યાય કરવા જેવું છે. ....”

‘તડકા’થી ‘કોઈ પરંપરિત મૂલ્ય ટકી ન શકે તેવી તળેઉપર દશા’ના સંકેત આપનાર લાંઠાં સાહિત્ય પરિષદ : કોઈમબતુર : ૧૯૯૧માં આપેલા વ્યાખ્યાનમાં ‘માણસની વાત વિશે, (જાણે લાંઠાંની બહાર નીકળીને) શું કહે છે ? —

“લાભશંકરની કાવ્યપ્રક્રિયામાં ‘માણસની વાત’ એક મહત્વની ઘટના છે. હવે અહીં લય છે પણ એના એકધારા સાતત્યનું સંમોહન નથી. અહીં અક્ષરમેળ / માત્રામેળ લયો ઊપરસી આવે છે, વહે છે ને ઓસરી જાય છે. અહીં લોકગીત અને બાળગીતના લયો છે તો એકાધિક / નાનાધિક ગધલયો છે. અહીં Structure of statementsનો ભરચક્ક વિનિયોગ કરવાનું મેં સાહસ કર્યું છે. images પણ સતત દઢકા કરે છે. અહીં સીધાં કથનો (statements) એવાં રચાયાં છે જે પરસ્પરને interpenetrate કરતાં હોય; એટલું જ નહીં, પરસ્પરવિરોધી કથનોના ઇન્ટરપેનિટ્રેશનની પરિણતિ ન્યૂટ્રાઇઝેશનમાં અનુભવાતી હોય એવી મારી કાવ્યદશા છે. આખું કાવ્ય મારે માટે કાવ્યાર્થલયનો મને સાંભળવો ગમે તેવો polyphonic અનુભવ છે. એમાં multiplicity of sounds, tones and meanings છે તેમ કહેવામાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય આ બધાના ધોંઘાટ પછીની નીરવતા એ કાવ્યનું પરિણામ છે એમ કહેવામાં છે. આ નિખાલસ કેફિયતમાં મારે એમ પણ કહેવું છે કે ‘માણસની વાત’માં પહેલી વાર, વ્યાપ-વિસ્તારમાં, પરંપરાને આત્મસાત્ત કરતાં કરતાં માણસ અને માણસના સર્વ સંદર્ભો વિશે રચાયેલો મહેલ લાભશંકરની કાવ્યચેતનામાં તૂંઠી પડે છે.”

‘માણસની વાત’ વિશે રાધીશયામ શર્માએ ‘નિર્ભાન્તિનો બીજનિક્ષેપ’ શીર્ષકથી અભ્યાસપૂર્ણ લેખ કર્યો છે, એમાં એમણે નોંધ્યું છે —

“ ‘સફેદ બકરીની પીઠનો ઘસારો મારી નજરને ગલીપણી કરતો મને ઓળાગે છે’ એ બોંદલેરિયન પંક્તિ પછી આશરે એંશી જેટલી લીટીઓ, મારું ચાલે તો કાપી નાંખું.”

‘માણસની વાત’માં ‘માણસ’ની અને ‘કવિ’ની લાચારી અને કરુણતા સંવેદનાને તળેઉપર કરતી વધ્યા કરે છે.

‘સાંજના ઓળા લથડતા જાય’ કાવ્યના આસ્વાદમાં મુશ્કેલી ભગતસાહેબે વૈયક્તિક કરુણતાને વૈચિક કરુણતા સાથે જોડી આપી છે. તેઓ લાભે છે :

“...પંખીઓની આ કરુણતા વૈયક્તિક કરુણતા છે. પણ આ કરુણતાના કારણારૂપ જે કરુણતા છે તે આ કરુણતાથી વિશેષ એવી કરુણતા છે. એ વૈચિક કરુણતા છે, એ વિશ્વવ્યાપી કરુણતા છે. વિશ્વ જે કરુણતાથી છલોછલ છલકાય છે એ કરુણતા છે.”

આ કાવ્યના આસ્વાદમાં ભગતસાહેબે લાભશંકરની શૈલીની બે લાક્ષણિકતાઓ નોંધી છે, જે લાભશંકરનાં કાવ્યોના સાક્ષાત્કાર માટે ઉપયોગી થશે —

“...ઇન્દ્રિયગમ્ય - ઇન્દ્રિયગ્રાવ અને લાઘવયુક્ત ચિત્રાત્મકતા એ લાભશંકરની શૈલીની એક લાક્ષણિકતા છે. ....”

લાભશંકરની શૈલીની એક અન્ય લાક્ષણિકતા છે. બે શબ્દોના પ્રાસને આધારે અને / અથવા બે શબ્દોના અવાજના થોડાક સામ્યને સહારે તેઓ એક ભાવમાંથી અન્ય ભાવમાં, ભિન્ન અથવા વિરોધી ભાવમાં; એક કાળમાંથી અન્ય કાળમાં સહેલાઈથી સરી જાય છે.”

આ કાવ્યના આસ્વાદમાં ભગતસાહેબે કાવ્યનાયકનો નોંધ્યું છે તે અનુભવ અન્ય કાવ્યો માટે તથા આ કવિ માટેય સારો ઠેરે તેવો છે :

“... કાવ્યનાયકને એકસાથે આત્મવિલોપન અને આત્મોપલબ્ધિનો અનુભવ થાય છે; એકસાથે તાદ્યાત્મ્ય અને તાટસ્થ્યનો અનુભવ થાય છે. એ પથ્થર અને પંખીને નિર્દેષ નેત્રથી નિહાળે છે.”

જાતનું એન્કાઉન્ટર કરતો ‘અવાજને ખોટી શકાતો નથી અને ઊંચી શકાતું નથી મૌન’-ની લાચારી અનુભવતો આ કવિ Self-parody પણ કરતો રહે છે – પ્રસ્તાવના –

‘ડોલ શબ્દની કાણી રે

ઉંડા કૂવાનાં પાણી રે

હરખબેર દામજા ખેંચે છે લઘરો તાણી તાણી રે

આ આવી છલકાતી લઈને

ભરચક પાણી પાણી રે !’



‘કુવિર નથી થયો તું રે

શીદને ગુમાનમાં ધૂમે ?’



‘હેલ જૂની છે ને વાંકી ધૂંસરી

ચુટે બેસો ને વળી ઉિતરે

ખાખડતી ખેંચે કવિતા કોણ રે ?’

સેલ્ફોર્ડી કરતાં કરતાં, સર્જકની દુર્દીશાઓમાં લઘરાને અને જાતને તળોઉપર કરે, ક્યારેક મરક મરક તો ક્યારેક ખડખડાટ હસે, ‘લઘરા’નું મિથ ઊભું કરે ને પણી જાતે જ કરે એનું રિમિશિઝિકેશનનાં...

‘સ્વ-’ને તથા ચોખાચુંક શબ્દને પામવાનો શોધ અને એના ‘ધમપણાડા’નાં ભાવોત્કટ રૂપો ‘મારા નામને દરવાજે’માં પ્રગટ થયાં. આ શોધ ‘બૂમ કાગળમાં કારા’માંય ચાલી.

‘ધોળી ધોળી કબર સમા કાગળમાં

આ હું

શોધું હું કોને સતત... સતત કાગળમાં કોરા ?’

‘પ્રવાહણ’માં કમોડ પર બેસીને, કરંજતા કરંજતા, ‘શ્રુતિ-સ્મૃતિના અનંતપાર અધ્યાસો’માંથી મુક્ત થવાની મથામણ છે —

‘મારું

આ ચા પા થી

આરંભાયેલું

કાવ્યજીવન

વિષ્ટાવિઝનમાં -

કરંજે છે

કમોડ પર

એકાંતમાં

એકલું એકલું

ને

આઈ એમ ઠનકેપેબલ ઓવ ક્રીપિંગ સાયલાન્ટ

ઉંહ... ઉંહ...’

‘કાલગ્રંથિ’માં સમય વિશેની ભાવોત્કટ અભિવ્યક્તિ છે. એમાં ‘કોનોવાળોજિકલ વાઈમના લસરરકા અને સાયકોલોજિકલ વાઈમના ઘસરરકા’ સાંભળવા લાંઠાંએ બહેરા કાન માંડચા છે. ‘દોળાં અવાજ ધોંઘાટ’માં લાંઠાંની કાવ્યરમત કે ખૂજલી કે લીલા ચાલતી રહી છે. ‘આમ જેંચીએ જરાક જોરથી –’ જેવાં ઘણાં કાવ્યોમાં લાંઠાંની કાવ્યસર્જનપ્રક્રિયાના પ્રત્યક્ષ ગ્રાહક સહદયોને મળે છે.

લય એ કાવ્યનો આત્મા છે. લાભશંકર ઘોડિયમાં હીંચતા, માનું હાલરડું સાંભળતા, જે લખારી કરતા એમાં કવિ લાંઠાંના લયનાં બીજ છે. ‘લખારી’ તો pure surreal.

શરૂઆતના કાવ્યસંગ્રહોમાં લયનો દોર લાંઠાંના હાથમાં રહેતો જણાય છે. આથી ચુસ્ત, સંકુલ લયકર્મ જોવા મળે છે. પહેલા જ કાવ્યસંગ્રહોમાં એમની લયચેતના શબ્દમેળ-અક્ષરમેળ-માત્રામેળમાં બરાબર ધૂંઘાઈ છે એનો કાવ્યાનંદ આપણને મળે છે. પરંતુ પાછળના કાવ્યસંગ્રહોમાં કેટલીક જગ્યાએ લાંઠાં લયમાં લપસતાય જોવા મળે છે; લય અને પ્રાસ દોરે તેમ દોરાત્પાય જગ્યાય છે, હાથમાં લગામ વિના જ તેઓ લયસવારી કરતા હોવાનું ક્યારેક લાગે છે.

‘કલ્યાયન’ સંગ્રહથી વળી એક વળ-વળાંક એમની કાવ્યઘોષાનો.. નાટ્યદેખનનો અનુભવ તથા પશ્ચિમના ઉત્તમ નાટકો જે એમની ભાવક-ચેતનામાં ઊરે ઊર્તર્યા છે તે એમની કાવ્યચેતનામાં

રસાય છે ને લાંડાં સંવાદ પાસેથી કામ લે છે ને વળી એક અવગ લાભશંકરીય કાવ્યમુદ્રા ઊપરે છે. સંવાદ થકી, ઉત્કટ પ્રશ્ન-ચેતના થકી, જાત સાથે ને ભાષા સાથે confrontation અને એન્કાઉન્ટર.

ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ‘કલ્પાયન’ વિશે વાત કરતાં નોંધું છે : “લાભશંકરના ‘કલ્પાયન’માં (કાવ્યનંબર ત્રણથી નવ) આ સમગ્ર કાવ્યજૂથ આજની ગુજરાતી કવિતાનું એક તદ્દન નવું પરિમાણ ઉપસાવે છે. સંવાદો દ્વારા તોભી થતી કાવ્યગતિ અને અવચેતનમાંથી માતૃઆધાનની ધસી આવતી મનોમુદુદ્દોને મળતો વિવિધ વિડંબનાઓનો આધાર – આ રચનાઓને માત્ર ‘લવરી’ કે મનોરૂગણ બબડાત્માંથી ઉગારી જ નથી લેતાં, પણ તોંચાં સર્જનમૂલ્યોથી સ્થાપિત પણ કરે છે.” –

કવિ ભાવક સાથે સીધો સંવાદ કરે છે ને ભાવકની કલ્પનાનેય સંકોરે છે —

ખૂળિયાં શોધું તો  
તળિયાં તુટે છે –  
અભિન્ન અવાજનાં, એમ કલ્પો.

... ...

... ...

હુ, સંભળાય છે તેમ કલ્પો.  
આવે છે અવાજ અંદરથી, કલ્પો.”

આ કાવ્યોથી આધુનિક ચિત્રકાર શ્રી અતુલ ડોડિયાની કલ્પના, ચિત્રચેતના સંકોરાઈ. ‘કલ્પાયન’ તથા ‘કિચ્ચૂડ કિચ્ચૂડ’નાં કેટલાંક કાવ્યોના આધારે એમજો ચિત્રશૈલી રચી અને એનાં એકાધિક પ્રદર્શનો પોજાયાં. આ પ્રદર્શનો માટે પ્રબોધ પરીખ અંગ્રેજમાં એક લેખ કરેલો. (શ્રી પ્રબોધ પરીખ પાસેથી લાંડાની કવિતાનો આસ્વાદ ન મળ્યો, લાંડાનાં થોડાં કાવ્યોને આધારે અતુલ ડોડિયાએ કરેલી ‘ચિત્રશૈલી’ માટે એમજો અંગ્રેજમાં જે લેખ કરેલો એના આધારે એક ‘રમતિયાળ’ લેખ કરી આપવાનું એમજો કહેતું, એ લેખ પણ મળી ન શક્યો. પ્રબોધ પરીખના એ અંગ્રેજ લેખનો અનુવાદ કરીઆપવા બદલ હું મિત્ર પરેશ નાયકનો આભારી છું. પરિશિષ્ટમાં એ અનુવાદ સમાચ્ચો છે.), આ વિશેષાંકના મુખપૂષ્ટ પરનું ચિત્ર એ શ્રેષ્ઠીમાંનું એક છે. એ માટે અતુલ ડોડિયાનો આભારી છું. કવિ-ચિત્રકાર પીયુષ ઠક્કરને આવરણચિત્ર ઉપરાંત એ ચિત્રશૈલી વિશે આસ્વાદ-લેખ કરી આપવા માટે વિનંતી કરી. પ્રેમપૂર્વક એમજો આ કામ કરી આપ્યું એનો આનંદ વ્યક્ત કરું છું.

‘કિચ્ચૂડ કિચ્ચૂડ’ પછી ‘સમય સમય..’ ‘હથિયાર વગરનો ઘા’, ‘ટેવ’, ‘છે’, ‘છે પ્રતીક્ષા’, ‘આઈ ડોન્ટ નો, સર’, ‘રમત ?’, ‘બેં કમિટ કર્યું છે શું ?’, ‘આવ’, ‘કથકનો ક’, ‘કેમેરા ઔન છે’ તથા ‘ઈન અને આઉટ’ ૨૦૦૦થી ૨૦૧૨ના ગાળામાં પ્રગટ થયા. ઉંઝોની જેમ તેઓ

dreamer નથી, માણસની દુર્દર્શાનો સામનો કરતા રહ્યા છે પણ ‘habit of hoping’ તૂટી પડી છે તેમ છતાં તેમની દુર્નિવાર સિસૃક્ષા, પોતાને પ્રત્યક્ષ પામવાની ઝંખના, ચોખાચાણક શબ્દની શોધ, અપાર વિસમય જરીકે ઓછાં નથી થયાં. ‘અંદર નિત નવાજી ફૂટ્યા કરે છે.’ ૨૦૧૨માં પ્રગટ થયેલા છેલ્લા સંગ્રહના પ્રાક્રક્ષનમાં તેઓ કહે છે – “કોરો કાગળ અને પેન મને ‘હાથ’ની પ્રતીતિ કરાવે છે. શીધ દુર્નિવાર સિસૃક્ષા પ્રેરક બની જાય છે. / હા, છું તો રમું છું.” લાંઠાંને સ્વખ પણ કેવું આવે છે ! –

‘ઉડતો હોઉં અને ઉડતો ઉડતો – / કાગળમાં લખતો હોઉં.’  
‘ડૂબતો હોઉં / અને ડૂબતો ડૂબતો કાગળમાં લખતો હોઉં.’

... ...

કોઈ ક્ષણ એવી નથી કે હું / ભાષારહિત અને કાગળરહિત હોઉં.’

મનુષ્ય હોવાની વિ-સંગતિ સતત એમની ભીતર ઘૂમરાયા કરે છે. શબ્દ સાથેની એમની રમત (રમત ?) સતત ચાલતી રહી છે. ઉત્કટ પ્રશ્નચેતના રૂપે એમની વિ-સંગતિ (જાત સાથેની ને શબ્દ સાથેની) બધાર આવતી રહી છે. ચન્દ્રકાન્ત ટોપીવાગાને એમની રચનાઓમાં ‘stuck poem syndrome’ બલે દેખાતું હોય, એટલે કે ‘લાભશંકર પૂર્વકાવ્યપિંડથી અલગ કોઈ નવો કાવ્યપિંડ પછી જન્માવી શક્યા નથી’ એવું બલે એમેને લાગતું હોય (ચં. ટો.ના આ વિધાનનો છેદ ઉડાડવા લાંઠાંનાં પછીનાં કાવ્યસંગ્રહો કે કાવ્યો વિશેનાં ચં. ટો.નાં જ વિધાનોનો ઉપયોગ અભ્યાસીઓ કરી શકે. જેમ કે, “‘કટ્યાયન’માં (કાવ્યનંબર ત્રણથી નવ) આ સમગ્ર કાવ્યજૂથ આજની ગુજરાતી કવિતાનું એક તદ્દન નવું પરિમાણ ઉપસારે છે.’ – ચં.ટો.)

સિતાંશુએ ‘રમત ?’ (૨૦૦૩) વિશે નોંધ્યું છે કે આ કાવ્યસંગ્રહમાં ‘લાંઠાંની એપિસ્ટેમોલોજિક અને લિન્જિવસ્ટિક પ્લેક્ચુલનેસ, પાને પાને પ્રગત થાય છે. ....

ને આ રચના તો માર્કસવાઈઓ અને ગંધીવાદીઓને એકસાથે ગમી જાય તેવી (જતાં કદાચ કંઈક ત્રીજું જ સૂચયતી) રચના છે : ‘સંચયની રમત રમાય છે / ચોરીની રમત માટે ? / સંચય છે તો ચોર-પોલીસની રમત છે ? / રમતમાં / ચોર / પોલીસ પણ હોય / અને / પોલીસ / ચોર પણ હોય ?’ (પૃ. ૪૦)

સામે છેઠે જાગ્રતો લાંઠાંનો કાવ્યસંગ્રહ છે : ‘મેં કમિટ કર્યું છે શું ?’ (૨૦૦૪) લાંઠાં લખે છે : ‘અને જખ્મી થયેલો વાઘ ધસતી વખતે / શિકારના / ભાલાને / ગણકારતો નથી તેમ મેં / કોઈ પણ વિધાતક પ્રતિકારને ગણકાર્યો નથી – / એ જાણવા / કે શું છે મારો જવાબ.’ રૂઢ પ્રતિબદ્ધ સાહિત્યના જે જવાબો હોય (કર્દ રાજકીય કે ધાર્મિક વિચારસરણીને એ પ્રતિબદ્ધ છે, એ મુજબનો), એવો જવાબ આ કવિનો નથી. એ કહે છે : ‘ધાતકી થવું સહેલું છે, સર / પોતાનો ઘાત કરવો સહેલો નથી.’ પછીની પંજીની આ કવિને સમજવામાં સહાય કરે તેવી છે : ‘મેં / સતત મને ઉન્મૂલ કરી / ખોદ્યો છે / ધખનામાં ઉત્કટ / જવાબની.’

... ...

લાંઠાંની ડિમત, એમની ગ્રામાણિકતા અને એમની રમત રમ્યા કરવાની તૈયારી આપણી ભાષા પાસેથી ખોવાઈ ન જાય, એ જવાબદારી હવે આપણી સહુની....”

સંચયની રમતમાં લાંઠાંને ચોર, પોલીસ કે સંચય કરનાર કોઈનાય માટે વિકાર છે ? ના.. કોઈનાય માટે લગાવ કે તાદાત્મ્ય છે ? ના.. પ્રકૃતિ, જાત, absurd, abstract, Good અને evid – બધું તેઓ નીરખ્યા કરે... છેલ્લા સંગ્રહોનાં કાવ્યોમાં લાંઠાં કેવળ નીરખે છે, લીલા કરે ને નીરખે કેવળ... —

‘સંચયદાનંદ આનંદ કીડા કરે...’

કેફિયતમાં લાંઠાંએ નોંધ્યું છે —

‘કવિને શબ્દમાં, શબ્દ વડે, શબ્દ રૂપે સ્વ-ના સકલ સંદર્ભ રૂપે વિશ્વને યથાતથ, the world as it is જોવું છે. હવે passivity of illusion નથી.’

લાંઠાંને ડિલ્બોનો ખૂબ શોખ. જગતભરની ઉત્તમ ડિલ્બો એમજો માણણી છે. એમને ડિલ્બુ બનાવવાનીય તીવ્ર ઈચ્છા હતી. આથી લાંઠાં એમના કાવ્યસંગ્રહોમાં ‘દર્શય’ પાસેથી સરસ કામ લઈ શક્યા છે. એમની કવિદાસ્તિમાં સતત કેમેરા ઓન રહ્યો છે, એમજો ‘શૉટ્સ’ લીધા છે, ‘સિન્સ’ રખ્યા છે અને કાવ્યપ્રક્રિયા દરમિયાન સિકવન્સિજ રચવાની ક્ષાણોમાં નિર્મિત એડિટિંગ કર્યું છે.

કવિ શ્રી નલિન રાવળે નોંધ્યું છે તેમ, પ્રથમ કાવ્યસંગ્રહમાં કવિનો અવાજ આત્મપરિતોષથી ભર્યો ભર્યો છે, પછી “ ‘માણસની વાત’, ‘મારા નામને દરવાજે’, ‘બૂમ કાગળમાં કોરા’ જેવા સંગ્રહોમાં આત્મવિદોહનો તીવ્ર સૂર સંભળાય છે.” રમ્યઘોષા પાછળ રહી જાય છે ને લાંઠાં જ કરી શકે તેવા સાહસ સાથે, લય-લીલા લીલા-લય સાથે, સઘળું ‘મૂલપર્યત જોવાની મથામણ’ સાથે, ઉત્કટ પ્રશ્નચેતના સાથે, ભાષાની ભાંગજીડ સાથે, ‘સ્વ’ને પામવાના ધમપણાડા સાથે, ‘અંતરબાધ્ય સંદર્ભો વિશે નિસબ્તભરી’ સમીપતા અને દૂરતા સાથે, ‘ભાન્તિ-નિર્ભાન્તિની લીલા’ સાથે, ગ્રામાણિકતા સાથે, નિર્ભાન્ત એવા દર્શન સાથે એકાધિક નાનામોટા વળ-વળાંકો લેતી એમની કાવ્યઘોષા અપાર વિસ્મય સાથે વહેતી રહી છે. છેલ્લા સંગ્રહોમાં એમનાં તોઝાનો શમતાં જણાય છે ને ‘જોવું’ અને ‘જોવું’ ઉત્કટતાથી પ્રગટનું રહે છે. સાથે જાતને તથા ભાષાને ઘડતા રહેવાનું ચાલુ રહે છે... પણ આ બધું લાંઠાં ‘સાક્ષીભાવે’ જોયા કરે છે... જોયા કરે છે કેવળ, અંદર-બહાર... ઇન અને આઉટ... ઇન અને આઉટ... અન... અને ? exit...’

૧૮

આ વિશેષાંક માટે લાભશંકર ઠાકરનાં આસ્વાદક્ષમ કાવ્યો તારવવાનું અને કંયું કાવ્ય કોને સોંપવું એ નક્કી કરવાનું કામ સહેલું નહોતું. કવિ અને આસ્વાદક બેયની કસોટી પણ

થાય. લાંઠાના કોઈ કાવ્યસંગ્રહ વિશે લખવું એ અલગ વાત. પણ લાંઠાના કોઈ એક કાવ્યનો આસ્વાદ કરાવવો એ અધ્યરૂપની કાવ્યસ્વાદનાં પરંપરાગત ટુલ્સ ખપમાં નથે આવે; નવાં ટુલ્સ, નવી કર્ણજિખાનીયે જરૂર પડે. લાંઠાના સહાધ્યાદી મિત્ર રાધીશયામ શર્માએ એમનાં ઘણાં કાવ્યોના આસ્વાદ વખતોવખત કરાવ્યા છે. એ ઉપરાંત પણ ચંદ્રકાન્ત શેડ, ચંદ્રકાન્ત ટોપીવાળા તથા અન્ય કવિન્બિવેચકોએ લાંઠાનાં કાવ્યો વિશે અવારનવાર લખ્યું છે. એમાંથી કેટલાંક કાવ્યો વિશેના લેખો પરિશિષ્ટમાં મૂક્યાં છે. લાભશંકર ઠાકરે પણ એકાવિક વખત કાવ્યસર્જન વિશેની ડેફ્ઝિયત આપી છે. એમાંથી ‘સંસ્કૃતિ’ના વિશેષાંક માટે એમજો આપેલી ડેફ્ઝિયત તથા ૧૮૮૧માં કોઈમંતુરમાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સર્જન-વિભાગના અધ્યક્ષ તરીકે આપેલી ડેફ્ઝિયત પણ પરિશિષ્ટમાં મૂકી છે. લાંઠાં માટે એમની કાવ્યસર્જનપ્રક્રિયા ‘અજનબી અગોચર આંતરિક’ રહી છે. આ ‘અજનબી અગોચર આંતરિક’ને આંતરચેતનામાં જીલવાનું અને પછી એને આસ્વાદમૂલક રીતિએ સહદય ભાવકોને બતાવવાનું કામ સહેલું નથી. આ કપરું કામ સમયસર કરી આપવા બદલ સહુ આસ્વાદક મુરબ્બીઓ અને ભિત્રોનો આભાર માનું છું. આ વિશેષાંકની સજાવટમાં ઉપયોગમાં લીધેલાં ચિત્રોના સર્જકોનોય આભારી છું.

અતિવ્યસ્તતાના કારણે લાંઠાના ‘હમદર્દ, હમસફુર’ સિતાંશુ યશશ્રંદ પાસેથી આસ્વાદ-આલેખ મળી ન શક્યો તેનો રંજ છે. અન્ય કેટલાક અભ્યાસીઓ પાસેથી પણ સંજોગોવશાત્ર આસ્વાદલેખ મળી શક્યા નહીં. કવિ શ્રી નલિન રાવળ પાસેથી આસ્વાદલેખ ન મળ્યો, પણ એમજો લાંઠાની કવિતા વિશે લેખ મોકલી આપ્યો, જે પરિશિષ્ટમાં સમાવ્યો છે.

કવિ શ્રી ઉમાશંકર જોશીએ યથાર્થ લખ્યું છે – ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં.’ લાભશંકર ઠાકરનાં પચાસેક કાવ્યોના આસ્વાદ તથા પરિશિષ્ટની સામગ્રી લાંઠાનાં કાવ્યોનો સાક્ષાત્કાર કરવા માટે સહદય ભાવકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે તેવી આશા સાથે, સર્જક લાંઠાને સલામ સાથે, વંદન સાથે વિરમું.

૨૬-૪-૨૦૧૬

૩-૬-૨૦૧૬



## ૧. ‘ચાંદરણું’ વિશે

રઘુવીર ચૌધરી

### ચાંદરણું

હું વસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં  
ત્યાં

આવી પડ્યું ચાંદરણું રૂપેરી.  
મૂગું મૂગું એ હસીને મને ક્યાં  
તેડી ગાંધું દૂર ? - પ્રદોષવેળા  
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને  
વહી જતી પાછળ રમ્યઘોણા  
નાદી; ભરીને જલ-કેશ ભીના  
કપોલની શી સુરખી ભીની ભીની ! -  
જતી હતી તું; નીરખી મને ને  
અટકી જરા; ચાંદરણું રૂપેરી  
ગર્દું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી  
ભીના ભીના રક્તકપોલની પરે...  
આજે હશે ક્યાં અહ કેવી

જાણું ના....

જો ક્યાંકથી આ કવિતા કદ્દિયે  
વાંચે ભલા તો લઈ તું જજે હવે  
(નાદીતટે વૃક્ષ નીચે ઊભેલા  
કુમારને જે દીધ તે) રૂપેરી  
ભીનું                  ભીનું                  ચાંદરણું....

‘ચાંદરણું’ લાંડાની કિર્તિદા કૃતિ છે. મને યાદ છે ત્યાં સુધી આ કવિતા ‘સંસ્કૃતિ’ અને ‘કુમાર’ બેઉમાં પ્રગટ થઈ હતી. એવું પણ સ્મરણ છે કે ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ કાવ્યસંગ્રહના મુખ્યપૃષ્ઠ પર અંકિત છિલિ એક કન્યાની હતી, જેના રક્તકપોલ પર ઘેઘૂર વૃક્ષમાંથી ચાંદરણું ઊતરી આવ્યું હતું. એ ચાંદરણું જોનાર કુમારને પ્રાપ્ત થયું હતું. એ સ્મૃતિમાં તાદશ છે, સુરક્ષિત પણ છે, જેની મૂળ માલિક એ કન્યા છે તેથી પરત મેળવી શકે.

કેવી રીતે એ કન્યા ચાંદરણું પરત મેળવી શકે ?

કન્યા તો કદાચ જાણતી જ નથી કે એના સૌંદર્યવિશે શું સરજયું હતું ? કુમાર જાણતો નથી કે કન્યા ક્યાં છે ?

પ્રત્યક્ષ મળવું શક્ય નથી.

કવિતા મેળવી શકે. જો કન્યા સહદ્ય ભાવક હોય તો, કવિતા નિમિત્ત બની શકે, મિલન માટે, હેતુરહિત મિલન માટે.

આ મિલન પણ કોઈ ભૌતિક ઘટના નહીં હોય, ધન્યતાની અનુભૂતિ હોય.

સર્જનમાં નિમિત્ત બનનારનો સર્જક બીજી કઈ રીતે આભાર માને ? અને નિમિત્ત બનનાર પોતે કેવી રીતે જાહી શકે કે એનો સર્જક પર શો ઉપકાર છે ?

લાંડાના પ્રિય સર્જક પન્નાલાલે એમનાં સંસ્મરણમાં બે સખીનો ઉલ્લેખ કર્યો છે. મુખ્યાવસ્થાના પ્રેમનો નિર્દેશ છે. બહેનબાને ભગેવા જીવ’ વાંચવા મળે છે અને પ્રેમની પ્રતીતિનો અણસાર આટલાં વર્ષે આવતાં એની આંખમાંથી ધન્યતાનાં આંસુ વહે છે. આ ઘટના સાથે લાંડાના ચાંદરણાને કશો સંબંધ નથી. પણ નિમિત્ત બનનારનો નિર્દેશ જરૂર છે.

ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજા, ઉપજાતિ – જે કહો તે, આ કુળના છંદો પર લાંડાનું પ્રભુત્વ હતું, અથવા કહો કે આ છંદોલયમાં એમનો સ્વભાવ વરતાય છે, સ્મરણના નિરૂપણને અનુરૂપ છે આ રમ્ય નાદ જગવતી નદીનું વહેવું.

આ રચનાનાં મુખ્ય ઘટકો છે : ઘેઘૂર વૃક્ષ, રમ્યઘોષા નદી, ભીના જલકેશ, કન્યાના રક્તકપોલ અને ચાંદરણાનું અવતરણું – એ ક્ષણ છે – ‘નીરખી મને ન અટી જરા.’

પરસ્પર પ્રત્યક્ષ થવાની ક્ષણને કવિએ ઘૂરી નથી. નેસર્જિક પરિવેશમાં પરસ્પર દસ્તિ મળે છે. પણ કાવ્યનાયક કશી સ્પૃહાથી કન્યાને જોતો નથી, એને દેખાય છે ચાંદરણું રૂપેરી ઊતરતું, સ્થિર થતું ‘ભીના ભીના રક્તકપોલની પોરે.’ અને સંભળાય છે પાર્શ્વસંગીત – ‘વહી જતી પાછળ રમ્યઘોષા...’ શીર્ષક પણ કેવું રમણીય !

લાંડાને ભલે નવપ્રસ્થાન પૂર્વે ‘કુમાર’ની કવિતા સાથે છેડો ફ્લડવા પોટલું છોડવાની વાત કરી હોય. સહદ્યાનો એમના આ પ્રથમ સંગ્રહની મધુર કોમલ કાન્ત પદાવલિએ જે આનંદ આપ્યો હતો એમાં આજેય ઓટ આવી નથી.

છંદોલય સાથેનો લાંડાનો નાભિસંબંધ એમની અધ્યાંદસ રચનાઓમાં પણ સૂક્ષ્મરૂપે સચવાયો છે.



## ૨. સનાતન સખ્ય, પ્રેમ અને દાંપત્યનું કાવ્ય

હરિકૃષ્ણ પાઠક

### અંતિમ ઈચ્છા

૧

ને વૃદ્ધ હાથે પકડી બપોરના  
તું હોય રામાયણ વાંચતી સખી  
જીણાં કરી લોચન બે નમીને;  
ને વિપ્રલંબે કૃશકાય આકુલા  
કારૂણ્યમૂર્તિ અહ દગ્ધ જાનકી  
ઉભી રહી હો તુજ નેત્રની નીચે  
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય  
મોતી ઝાડુમે ચખ વૃદ્ધમાં;

કહું ?

ત્યારે અનુશા લઈ ઈન્દ્રની સખી  
પતંગિયું એક બની સુવર્ણનું  
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષાળ.

૨

ઉંચી તમારી પ્રિય પુષ્ટ કાયા  
નાચા પછી રોજની જેમ હાથમાં  
પ્રવેશશે છાબ લઈ, અજસ્ત  
મોંથી હસે મંત્ર ઝરંત, સિક્ત  
નમેલ બે રૂક્ષધ પરે પ્રશસ્ત  
ઢાયો હશે આત્પ સહેજ હે સાખે

વિશ્રબ્ધ મારા મુખ-શો; ધીમે ધીમે  
આવી અહીં આંગણમાં કરેણાની  
ડાળી પરે દક્ષિણ હાથ દીર્ઘ  
લંબાવશો; કંપતી અંગુલિ થકી  
થશે જરી સ્પર્શ ત્યાહી જ હું પ્રિયે  
ગરીશ (રાતું ફૂલ) રોજ ધાબમાં.

‘અંતિમ ઈચ્છા’ એવા શીર્ષક હેઠળ પ્રગટ થયેલ બે કાવ્યોનું યુગમ ખરેખર તો એક જ કાવ્ય છે, દાંપત્યપ્રેમનું.

દાંપત્ય ખંડિત થયા પછીના સખ્યભાવે વિલસી રહેલા પ્રેમનું વિદેહ વ્યક્તિના ઉદ્ગાર રૂપે પ્રગટી શેષ વ્યક્તિ તરફની આત્મીયતાભરી જેવાનાનું કાવ્ય છે.

બને કાવ્યોને એકસાચે વાંચી જાનારને કવિએ પ્રગટ રીતે જે કહું નથી પણ માત્ર સંકેતો કર્યા છે તે બાબતો તો તુર્ત જ ખ્યાલમાં આવી જશે. એકની વિદ્યાય પદ્ધી જે પાત્ર શેષ રહ્યું છે તેના વાર્ધક્યના વર્ણનથી દીર્ઘકાળ સુધી જેમનું દાંપત્ય અને સહવાસ મૈત્રીપૂર્ણ અને પ્રેમમય રહ્યા છે તેવાં સ્ત્રી-પુરુષનું આ કાવ્યયુગમ છે, અને વળી જે સંસ્કૃતિ, સંસ્કાર અને જીવનચર્ચા વિદ્યમાન પાત્રની પ્રવર્તનથી સ્પષ્ટ થાય છે તે સૂચાવે છે કે આ એક હિંદુ ધર્મ અને સંસ્કૃતિના પિંડમાંથી જ પ્રગટી શકે તેવું કાવ્ય છે; અલબંત તેની સંવેદના સર્વાશ્રેષ્ણી છે, સનાતન છે, માનવના ઉત્તમ આવિજ્ઞારરૂપ છે.

બને કાવ્યોમાં આ સંવેદનાને કેવી અભિવ્યક્તિ મળી છે તે હવે કમશા: જોઈએ.

પ્રથમ કાવ્ય વિદેહ પતિની ઉક્તિ રૂપે છે.

પત્ની વૃદ્ધ હાથે રામાયણ ગ્રહીને બાપોરના સમયે વાચન કરી રહી છે. સહેજ નમીને, આંખો જીણી કરીને રામાયણ વાંચે તો છે પણ તેમાં, એ સમયે, કયો પ્રસંગ વર્ણવાયો છે ?

જેનો ત્યાગ કરવામાં આવ્યો છે તેવી કારુણ્યમૂર્તિ, વિરહને કારણો કૃશકાય અને દંધ – દુઃખી જનકી આ વાચકને જાણે કે રામાયણનાં જરૂર પૃષ્ઠો પર પ્રત્યક્ષ થાય છે, અને તેથી જે સ્વયં વિરહ વેઠી રહી છે તે પત્નીના હૃદયમાં કૂટતી કરુણાના કારણે તેની આંખોમાં રમ્ય મોતી સમાં અશ્વ ઝડૂમી રહ્યા છે. એવે સમયે પતિ જે વિદેહ છે ને સ્વર્ગસ્થ છે તે ઈન્દ્રની અનુશા – એટથે કે રજા લઈને આવે છે; પણ કેવા રૂપે ?

કવિના શબ્દો જ સાંભળીએ –

‘કહું ?  
ત્યારે અનુશા લઈ ઈન્દ્રની સુખી  
પત્નીનું એક બની સુવાળનું  
આવીશ, પૃષ્ઠો પર બેસવા કાશો.’

‘કહું ?’ જેવા પ્રશ્નથી જાણે કે સાખ્ય અને સંવાદ હજ્યે તૂટ્યાં નથી એવો સંકેત વાંચી શકાય. ‘સાખી’ જેવું સંબોધન બે વાર થયું છે; જે સાખ્યના ભાવને પણ સૂચારે છે, અને પુરુષમાત્રની સ્ત્રી વિશે જે સહજ અપેક્ષા હોય – સૌદર્યની તેના જ એક ઇંગ્લિશ રૂપે અશ્વને પણ – ‘જરાક રમ્ય મોતી ઝૂમે’ કહી નવાજ્યાં છે; ‘ચખ વૃદ્ધ’ બલે રહ્યાં !

રમ્યને પામવા માટે તો રમ્ય રૂપ જ ધારવું પડે તેથી ‘પતંગિયું એક બની સુવર્જાણિં’.

બીજું કાવ્ય વિદેહ પત્નીના ઉદ્ઘાર રૂપે મળે છે. આરંભ જ કેવો મજાનો થયો છે !

‘ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા’ – આ પણ એક સ્ત્રી સહજ અપેક્ષા જે પતિના બલિષ્ઠ દેહના વર્ણનથી પ્રગટ થઈ છે. એકલા પડી ગયેલ પતિની હિન્દ્યાર્યાના સહજ વર્ણનથી આગળ વધતાં કાવ્યમાં ‘સાખી’ના મોંએ ‘પ્રિય’નો ઉદ્ઘાર આરંભે અને પછી અંતે પણ થયો છે. સાખ્ય અને પ્રેમ બંનેનું સાયુજ્ય આપોઆપ પ્રતીતી થાય છે.

પતિને પણ વાર્દ્ધક્ય તો આંબી ગયું છે તેથી તેની દરેક કિયા તે રીતે વર્ણવાઈ છે. પૂજાનાં પુણ્ય માટે નાચ્યા પછી રોજની જેમ હાથમાં છાબ લઈ પ્રવેશતા પતિના મુખે અજાણ-સતત, એકધારા મંત્રો જરી રહ્યા છે. સ્કર્ધ હજી ભીના છે ને વયને કારણે સ્હેજ નમેલા છે, અને પછી એક સુંદર, મનભર શબ્દચિત્ર મળે છે – (અલબત્ત, ભૂતકાળની કોઈ રમ્ય ઘટનાની સ્મૃતિ રૂપે) – કહે છે કે ભીના નમેલા સ્કર્ધ પર તડકે નહીં, ‘આતપ’ સ્હેજ ઢેણેલો છે, અને તે પણ પ્રશાસ્ત. આતપને ‘પ્રશાસ્ત’ કહેવાનું રહસ્ય હવે ખૂલે છે. કે ક્યારેક એ વિદેહાંશે આ જ સ્કર્ધ પર, વિચારસ્પૂર્વક, ધૈર્યથી પોતાનું મુખ ઢાળેલું, તેમ આ આતપ ઢેણેલો છે. આહી સંબોધન છે ‘હે સખે !’

પતિ ધીમે ધીમે આંગણાની કરેણ પાસે જઈ ‘દક્ષિણ હાથ દીર્ઘ’ લંબાવે છે. સમજવાનું કે પતિ આજાનબાળું છે, પણ અંગુલિમાં તો વાર્દ્ધક્યના કારણે કંપ આવી ગયો છે. તેથી જ જરાક સ્પર્શ થતાંની સાથે જ આ સાખીનો, પ્રિયાનો જે ઉદ્ઘાર પ્રગટ્યો છે તે પ્રથમ કાવ્યના છેલ્લા ઉદ્ઘાર જેવો ચ્યામ્લીનિભર્યો છે –

‘થશો જરી સ્પર્શ ત્વર્હી જ હું પ્રિયે

ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.’

એક નાનકડો બેઠ ધ્યાનમાં આવ્યો ?

વિદેહ પતિ કહે છે – ‘આવીશ પૃષ્ઠો પર બેસવા કાણ’ અને આ વિદેહા કહે છે – ‘ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.’

હિન્દુ ધર્મ, સંસ્કૃત અને પરંપરામાં ‘લગ્ન’ એક સંસ્કાર છે, સોળ સંસ્કારો પૈકીનો એક, તેમાં સપ્તપદીનો એક વિધિ પણ રહેલો છે. ‘કુમારસંભવમ્’ના પાંચમા સર્ગમાં શિવજનો ઉદ્ઘાર છે :

– ‘સાપ્તપદીનમ્ સખ્યમ્’ આ કાવ્યોમાં એ સંસ્કાર તો ઓતપ્રોત છે જ, સાખી, સખે

અને પ્રિય-પ્રિયેના ઉદ્ગારો સખ્ય સાથે પ્રેમ અને દાંપત્યને એકસૂત્રે પ્રોવી દે છે. ડિફુઓ  
પુનર્જન્મમાં પણ શ્રદ્ધા ધરાવે છે તેથી ભવોભવના પ્રેમ અને સંગની ધારણાઓ પણ તેમાં છે  
જ છે.

કવિ લાભશંકર ઢાકર એક વ્યક્તિ બેબે આવું કશું માનતા-સ્વીકારતા કે કેમ એ પ્રશ્નો  
અહીં ગૌણ બને છે. અહીં જે મહિમા થયો છે તે સનાતન પ્રેમ અને સખ્યનો, એ દાંપત્યમાં  
હોય તો એનાથી વધુ રૂંકું શું હોઈ શકે ? પુષ્પ અને પતંગિયાનું સાયુજ્ય પણ કેવું રમણીય !  
ઈન્ડવંશા-ઈન્ડવજાના માત્ર ૧૧-૧૨ અક્ષરોના ટૂંકા માપના મિશ્ર છંદમાં અને માત્ર ૧૨-૧૨  
પંક્તિના વ્યાપમાં જ કવિએ આ કાવ્યો સિદ્ધ કર્યો છે.

કવિએ તેમના કાવ્યસર્જન વિશે તેમના ચિત્તમાં રસાઈ ગયેલ લયચેતનાનો મહિમા કર્યો  
છે. અને એ લયવૈવિધ્યમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચારોનોય ઉત્ત્વેખ કર્યો છે. આ સાથેનાં બંને કાવ્યોમાં  
તત્સમ શબ્દો અને છંદની પ્રવાહિતા બંને સંસ્કૃત ભાષાનો સ્પંદ જગાવે છે, ને એક પ્રોઢિનો  
અનુભવ કરાવે છે. બધાએ પંક્તિ ઉમેરાને કવિએ ‘ચોનેટ’ રચવાનો મોહ નથી રાખ્યો.

18





## ૩. આધુનિક પ્રયોગશીલ કવિની છંદોરમ્ય કાવ્યકૃતિ

ભાનુપ્રસાદ પંડ્યા

### સ્મૃતિ

કૂં જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.  
તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી  
આકાશથી જરીક, ને મધુસર્જન્ય  
રોમાંચથી હવી ઉડી અતિ શુષ્ણ સાંઠી !

ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ  
બેંકું કૂંડા પર જરા ફિફડાવી પાંખો  
કૂંડા મહીં છલકતા જલમાં ઝબોળી  
ચંચ્ચુ અને કરી જરા નિજ પુષ્ટ ઊંચી  
છેડી દીધી સહજ કંઈ તણી સતાર !  
એ શેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા  
રેડી રહી ચળકતો લઈ તામ્રલોટો  
ઉંચા કરેલ કરથી જલ, ભાવભીનાં  
નેત્રો ઢળ્યાં મધુર, ભાલ વિષે સુજોર  
સૌભાગ્યચંદ જલકે, તરબોળ ભીનું  
આખુંય દશ્ય નીતરે તડકો

અચાનક

ઉડી ગયું ક્યાહીક દૈયડ દશ્યને લે  
પાંખો મહીં.

નજર વૃદ્ધ ફરી ફરી શી  
છાપા વિષે દૂબી જવા મથતી, સવારે !

કોઈ પણ પ્રતિભાસંપન્ન અને નવોન્નેખ દાખવનાર કવિ પ્રાપ્ત કવિતારીતિ અને રચાતી કવિતાથી સંતુષ્ટ નથી હોતો. એ હેમેશાં કંઈક સ્વકીય કહી શકાય એવું પ્રદાન કરવા માટે ઉત્સુક હોય છે. અલબત્ત, પરંપરાગત કવિતાના ઉત્તમાંશોને પોતાની રીતે યોજને એને આત્મસાત્ત્ર કરવાનું કૌશલ દાખવે છે. સંવેદના, કાવ્યભાષા અને કાવ્યરીતિમાં એ નિરાળાપણું પ્રકટ કર્યા સ્થિવાય રહેતો નથી.

આમાંના એક આશ્રિમ આધુનિક કવિ સ્વ. લાભશંકર ઠાકર હેમેશાં પોતાની પ્રતિભાનો પ્રયોગશીલ અભિગમ આપણા કાવ્યસાહિત્યમાં સિદ્ધ કરતા રહ્યા છે. એમણે ભાવ, ભાષા અને કાવ્યશૈલીની પરંપરાગત સંકળાશોને તોડી છે અને નવપ્રસ્થાન કર્યું છે. તેઓ માત્ર ‘કવિ’ નહીં પણ ‘ભાષાકવિ’ છે, એટલે એમના કાવ્યસર્જનમાં વારંવાર ભાષાગત નાવીન્ય જોવા મળે છે. એમાંના કેટલાંક કાવ્યશીર્ષકો જોતાં એની પ્રતીતિ થાય છે. જેમ કે, ‘લઘરો કવિ’, ‘બૂમ કાગળમાં કોરા’, ‘માણસની વાત’ તેમજ અન્ય કૃતિઓ એનાં દર્શાંતો બની રહે છે. ભાષાકવિ પ્રાતભાષાના સ્તરથી ખુશ નથી. એટલે એનાથી આમ સહજ રીતે થઈ જતું હોય છે. આથી લાભશંકર ઠાકર એમના ટૂંકા ‘લાંઠા’ નામથી પ્રસિદ્ધ છે. નવી ગુજરાતી કવિતામાં સૌથી વધુ ભાષાવળોટ તેમણે દાખવ્યો છે. આથી એવી કલ્યાણ કરવાનું મન થાય છે કે ‘મા ગુર્જરી’ પણ હોઠે આંગળી મૂરીને વિચારતી હશે કે આ સર્જક પુત્રે તો મને બહુ નવાં પટકૂળ પહેરાવ્યા છે ! એણે મને નવો ‘ઠસ્સો’ અને ‘ચાલ’ આયાં છે !

આમ છતાં લાભશંકર ઠાકરે પરંપરાને પણ પોતાની રીતે અપનાવીને સંવેદના, કાવ્યશૈલી અને છંદોને યોજી બતાવ્યાં છે. આનું દણ્ણાંત જોવું હોય તો એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોબા’ જોઈ લ્યો. રાજેન્દ્ર, નિર્જન યુગની સૌંદર્યદર્શી કાવ્યશૈલીને અભિનવ વળોટ આપીને, છંદોને પોતાની રીતે યોજને, અનેક ચિરંજલ કાવ્યરચનાઓ આપી છે. એમાં શીર્ષકમાં મૂકેલો ‘પાછળ’ શબ્દ અર્થવાડી છે, મર્મલક્ષી છે. સહદ્દી ભાવકને એમાં અતીતનો નિર્દેશ પારખતાં વાર નહીં લાગે. અલબત્ત, આ પ્રકારનાં કાવ્યોમાં પણ સંવેદન, ચિત્રગુણ, ભાવપરિસ્થિતિઓનું સન્નિધીકરણ, એમાંથી સ્કુરતો વ્યંગ્યાર્થ અને છંદોનું સ્વકીય નિર્માણ એ એમની વિશેષતા છે. આટલી ભૂમિકાના સંદર્ભમાં આપણે કવિના ‘સ્મૃતિ’ કાવ્યનો આસ્વાદ કરવાનો રહે છે.

કવિએ ‘સ્મૃતિ’ શીર્ષકથી રચેલા આ કાવ્યમાં એમણે પોતાની શબ્દચિત્ર કંડારવાની કલાનો સરસ પ્રયોગ કરેલો છે. આપણી સમક્ષ એમણે સ્મૃતિ-સંવેદના રૂપે અત્યંત બારીકાઈથી બે સ્મૃતિગત દંશ્યો પ્રસ્તુત કર્યા છે ! પ્રથમ અંગણામાં પડેલા જૂના તુલસીના ઝૂંડાને દર્શાવ્યું છે. એ ઝૂંડા પર જળ વરસી ગયું છે, એ જળ કવિ કહે છે તેમ આકાશમાંથી ‘જરાક ઢળી’ ગયું છે ને તેનો સ્પર્શ અત્યંત મધુર છે. આને કારણે તુલસીનું જૂનું ઝૂંડું પણ રોમાંચ અનુભવતું આસે છે. છોડ જૂનો છે એટલે સુકાયેલો, દૂરથી સાંકીકા જેવો લાગે તેવો છે એય પણ રોમાંચથી

જૂલવા લાગ્યો છે. કવિએ મૂકેલી પંક્તિઓમાં નોંધીએ તો આ પ્રકારનું આવેખન છે :

‘તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી  
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય  
રોમાંગથી હલી ઊરી અતિ શુષ્ણ સાંઠી !’

અહીં એક સૂક્ષ્મ લકીરોથી દોરેલા ચિત્ર જેવું શબ્દચિત્ર આપણે સાકાર કરી શકીએ છીએ. કાવ્યનો ઉપાડ આ રીતે કવિની ચિત્રગુણની સર્જનકલાને શબ્દમાં ભાવક તાદૃશ્ય કરી શકે એવી નાજુકાઈ કવિએ દાખવી છે.

બીજા પંક્તિઅંડોમાં કવિએ ‘સ્મૃતિસંચિત’ બીજા દશ્યને આવેખી બતાવ્યું છે. કૂંડામાં જળ તો હતું જ અને સ્પર્શથી મધુર રોમાંગ ઉત્પન્ન કરે એ પ્રકારનું હતું. કવિ એ જળના સ્પર્શનું બીજું શબ્દચિત્ર આપે છે. આવી ઋતુમાં ક્યાંકથી ઊરીને આવેલું દૈયડ પંખી કૂંડા પર પોતાની પાંખો ફંડડાવીને, છલકતા પાણીમાં પોતાની સમગ્ર અંઘળવાની કિયા કરે છે. અહીં કવિએ પુનઃ પોતાની જીણી નજરથી દૈયડની જળમાં નહાવાની ચેષ્ટાઓનું અત્યંત સ્વાત્માવિકતાથી શબ્દચિત્ર ઉપસાવ્યું છે. આપણે એ પંક્તિઓ અહીં પ્રસ્તુત કરીએ :

‘બેદું કૂંડા પર જરા ફંડડાવી પાંખો,  
કૂંડા મહી છલકતા જલમાં જબોળી  
ચંચૂ અને કરી જરા નિજ પુછ્છ ઊંચી  
છેડી દીધી સહજ કંઈ તણી સત્તાર !’

આ દશ્યમાં કવિની દશ્ય જોયાની મનોમુદ્રા કેવી જીણવટથી અંકિત થઈ છે ! પંખી જળમાં નહાતું હોય ત્યારે જે કિયાઓ કરે તેને અહીં જાણો કે છાપી દીધી હોય એવું લાગે છે ! દશ્ય તો છે જ પણ કવિનો કાન પણ કેવો સાબદો છે ! દૈયડનો આનંદમય ચિત્કાર પણ “છેડી દીધી સહજ કંઈ તણી સત્તાર” અહીં કવિની સ્મૃતિમાં રહેલી સ્થિતિ અને આવેખનમાં દેખાતી ગતિ, એમ સ્થિતિ અને ગતિ બંનેનું સરસ આવેખન છે. અહીં કોઈને એમ થાય કે આકાશથી ઢળેલું જળ ‘સુનેરી’ કેમ લાગે છે ? વળી જળ જરીક છે ! પણ કવિએ આગળ જતાં ‘કૂંડા મહી છલકતા જલમાં’ એમ કહ્યું ? સહદ્યી ભાવક કહી શકશે કે પ્રભાતના સમયે સૂર્યપ્રકાશમાં આકાશથી વરસેલું પાણી સોનેરી જાંયવાળું લાગે, વળી જળ આકાશથી પડેલું છે એટલે નાના કૂંડાને છલકતા શી વાર લાગે ? આમ કવિની સ્મૃતિને આપણે સ્વસ્થતા અને આનંદપૂર્વક માણી શકીએ છીએ. શબ્દચિત્ર સાથે કવિએ કંઈની સત્તાર દ્વારા દશ્ય ઉપરાંત શ્રાવ ચિત્રાંકન પણ કરી આપ્યું છે.

રચનામાં અન્ય આસ્વાદી ખંડ કવિએ રચેલું બીજું સ્મૃતિચિત્ર છે. અહીં કવિ આપણા સરેરાશ ગૃહજીવનમાં સહજ રીતે જોવા મળતું દશ્ય કરારે છે. કાવ્યસર્જકે અત્યંત સૂક્ષ્મતાથી એના સકળ અંશોને આવેખી બતાવ્યા છે. ત્યાં એક ગ્રૌઢ નારી ચેત વસ્ત્રોમાં શોભતી, ચણકતો

તાંબાનો લોટો લઈને ઉપસ્થિત થતી દેખાય છે. તેણે જળ રેડવા માટે હાથ ઊંચો કરેલો છે, એનાં નેત્રો ભક્તિભાવપૂર્વક ઢેણેલાં છે. કવિએ વર્ણનમાં બધા જ ભાવપૂર્ણ અંશો પ્રસ્તુત કર્યા છે. એ નારી મધુર ભારે છે, એના અત્યંત ગૌર લલાટમાં સૌભાગ્યના ચિહ્ન જેવો ચાંદલો (સૌભાગ્યચંદ) જબકી રહ્યો છે. ભીનું ભીનું તરબોનું એવું ભાવ તડકામાં સહેજ નીતરનું ભારે છે. અહીં સુધી કવિએ જે વર્ણનચિત્ર આપ્યું છે તે આપણે નેત્ર સમક્ષ આવેહૂબ નીરખતાં હોઈએ એવું લાગે છે. કવિ પોતે જ એનો અહેવાલ આપતાં નોંધે છે : ‘આખુંય દશ્ય નીતરે તડકો.’ ત્યાં પંક્તિને થોડો વિરામ આપી દે છે. અને પછી આગળના ખંડને એની સાથે, ખંડિત પંક્તિ સાથે આ રીતે સાંકળી લે છે :

### ‘અચાનક’

ઉડી ગયું કયહીંક દૈયડ દશ્યને લે,  
પાંખો મહીં.’

જોઈ શકાય છે કે બે સ્મૃતિચિત્રોને સૂક્ષ્મદાસ્થિ-રચનાકારે કૌશલપૂર્વક સાંભળી લીધાં છે. પંખી જ્યારે સહજ રીતે બેદું હોય અને કોઈ વ્યક્તિ આવે એટલે તરત ઉડી જાય એમ પેલું કંઈના સિતારને ગુજરું પંખી ઉડી જ જાય ! એમ દૈયડ એની સહજગતિ પ્રમાણે ઉડી જાય છે પણ કવિ એની કાવ્યમય અભિવ્યક્તિ કરતાં નિવેદન કરે છે કે દૈયડ એ દશ્યને પોતાની પાંખમાં લઈને ઉડી ગયું ! કાવ્યાન્તે પેલી પ્રૌઢ નારીની ભાવલીલાનું દોઢ પંક્તિમાં આવેખન કરીને સમાપન કરતાં પંક્તિઓ યોજે છે :

નજર વૃદ્ધ ફરી ફરી શી !  
છાપા વિષે દૂબી જવા મથતી, સવારે !

પ્રૌઢાની વૃદ્ધ નજર ફરીથી સવારના છાપામાં દૂબી જવા – એટલે વાંચવામાં લીન થવા માટે મથી રહે છે !

કવિએ બે શબ્દચિત્રાંકનો દ્વારા પોતાનું કાવ્યમય સંવેદન પૂરું કર્યું છે. પરંતુ એ બંને શબ્દચિત્રોને જે રીતે એકબીજાના કમમાં પ્રસ્તુત કર્યા છે ત્યાં જ કાવ્ય સંપૂર્ણ નથી થતું, એ સન્નિધીકરણ દ્વારા એમણે જે રમણીય કાવ્યમર્મ વંજિત કર્યો છે તે સહદ્યી કાવ્યભાવકને પ્રસન્ન કરે એવો છે. પ્રથમ શબ્દચિત્રની નવ પંક્તિમાં જે પ્રકૃતિના સ્પર્શવાળું આવેખન થયું છે તેમાં આપણને સહજ નેસર્જિકતા અનુભવવા મળે છે. આકાશમાંથી સહેજ વરસી ગયેલું અને સૂર્યપ્રકાશમાં સોનેરી રંગથી ચમકતું જળ, શુષ્ણ થવા બેઠેલો તુલસીનો છોડ રોમાંચ અનુભવતો દેખાય, ને ત્યાં ક્યાંકથી ઉડતું આવતું રોમાંચ અનુભવતો દેખાય, ને ત્યાં ક્યાંકથી ઉડતું આવતું નિર્બધ, નિર્ઝક્ષા, પાંખો ફફડાતવનું દૈયડ પંખી વરસાદી જળમાં ફૂડમાં પાંખો પ્રસારી, ચાંચ જબોળતું અને એની કુદરતી ટેવ પ્રમાણે પીંછાંવાળી પૂછારી ઉંચી કરતું, અને પોતાનો કિલકિલાટ કરતો કંઈ – કંઈની સિતાર સરખો ધવનિ – વહેતો મૂકે એ આખુંય દશ્ય કેટલું

સ્વાભાવિક અને નિરંકુશ લાગે છે ! કવિનું ચિત્ત આ દશ્યને બરાબર જીલી રહ્યું છે એની સ્વાભાવિકતા, પ્રસન્નતા અનુભવીએ છીએ, ત્યાં નગરમાં એકાએક આવી ચેદેલી ‘શીમ’ કે આવી ચેદેલું ‘વન’ આપણને દશ્યેન્દ્રિય દ્વારા માણાવા મળે છે. આ કાવ્યની આપણી પ્રારંભિક અનુભૂતિ છે. જાણે કે આપણે સ્વયં કુડાના પાણીમાં હાથ પહોળા કરીને અંધોળતા હોઈએ એવું લાગે છે !

જ્યારે દસમી પંક્તિથી શરૂ થતી અન્ય દશ્યચિત્રમાં આયાસ, સત્યતાનો બાબુ ચળકાટ જોવા મળે છે ! એમ તો તાંય કવિએ શૈત વસ્ત્રોમાં શોભતી ગ્રૌંડ નારીને તાંબાનો લોટો જીલીને કુંડામાં જળ સિંચતી દર્શાવી છે. એનાં નેત્રો પણ ઢળેલાં અને ભાવભીનાં છે. ભાલમાં ચાંદલો ચમકે છે અને એ આખુંય દશ્ય તડકામાં નીતરી રહ્યું છે. કવિએ એ દશ્ય જીલીને દૈયડ પંખીને ઊડી જતું બતાવ્યું છે પરંતુ કાવ્યની અંતિમ દોઢ પંક્તિમાં કવિએ જે ચોટ નિર્મિં છે તે પ્રથમ દશ્યથી કેટલી વિપરીત છે ! પ્રથમ દશ્યમાં દૈયડ ખુશાખુશાલ થઈને કૂજન કરતું દેખાય છે જ્યારે અહીં એ દશ્ય સામે ગ્રૌઢાની જંખીપાંખી હેવે વાર્દ્ધક્યાની અસરવાળી નજર – છાપું વાંચવામાં દૂલી જાય છે. કવિએ ‘ફરી ફરી’ શબ્દપ્રયોગ કર્યો છે એટલે એ ગ્રૌઢાએ ઘડીભર છાપું અળગું કરી કુંડામાં જળ રીંચવા માટે ઊભું થવાનું પસંદ કર્યું હશે. છેલ્લી દોઢ પંક્તિ આપણે ફરી અહીં ઉદ્ભૂત કરીએ :

‘નજર વૃદ્ધ ફરી ફરી શી  
છાપા વિષે દૂલી જવા મથતી, સવારે !’

પંક્તિને અંતે કવિએ મૂકેલું આશ્રયવિરામ સ્વયં વંગ્યાર્થનું ઉપાદાન બને છે.

કવિએ પસંદ કરેલો છિંદ વસંતતિલકા અત્યંત અનુકૂળ રહ્યો છે. એના દુંકા ખંડ-ઉપખંડ યોજવામાં કવિએ સારું કોશલ દાખલ્યું છે; જેમ કે ‘આખુંય દશ્ય નીતરે તડકો’ ત્યાં કવિએ પંક્તિ ખંડિત કરી છે. અને ત્યાં એકાએક ગ્રૌઢાનારીના દશ્યમાંથી પંખીના દશ્યમાં જવા માટે ‘અચાનક’ શબ્દ અત્યંત ઉચિત ટુકડો બની રહે છે અને દશ્યની ત્વરાને યોગ્ય રીતે સૂચવી રહે છે. તો ઊડી જતા પંખીના દશ્યમાંથી નારીની પલટાતી નજર માટે ‘પાંખો મહીં’ એટલો ખંડ મૂકી છેલ્લી દોઢ પંક્તિ પુનઃ નારીના દશ્યમાં ભાવકને લઈ જાય છે. આમ દશ્યોને પલટા બતાવવા એમણે પંક્તિના ખંડો કર્યા છે. સમગ્ર કાવ્ય આપણા અનોખા મિજાજના પ્રયોગશીલ, આધુનિક કવિની પ્રતિભાનો પરિચય આપી રહે છે.



## ર. વૃદ્ધચેતનાના મોક્ષનું કાવ્ય

હર્ષદ ત્રિવેણી

### બારી બહાર જોતો વૃદ્ધ

બારી પરે જર્જર દેહ ટેકવી  
જૂકી પડી સહેજ, પછી નિરાંતે  
જોઈ રહ્યો એ ક્ષીણ લોચનોથી  
જ્યાં સૌ મકાનો બની મૂક મોજમાં  
જીલી રહ્યાં અંગ પરે અખંડ  
વર્ષી તણી શીતલ ઝીંક તનમય.  
ને છાપરામાં

કબૂતરાં બે ફફડાવી પાંખો  
નાહી રહ્યાં - નાચી રહ્યાં નિમળન.  
ને શેરીમાં સૌ જવલુદ્ધ બાળકો  
કરી રહ્યાં શોરબકોર, નજન  
દોડી રહ્યાં મોજ મહીં મનસ્તી !  
સુદૂરથી શૈશવની સ્મૃતિની  
આવી પૂરી નાજુક એક વાદળી  
ધીમે ધીમે વર્ષી રહી અજસ્ત.  
બારી મહીંથી નિજ હાથ દુર્બળ  
કાઢ્યો ધીમેથી જરી બહાર, ઝીલવા  
વર્ષી તણી શીતલ ધાર, જેનો  
થતાં જરી સ્પર્શ ફરી વળ્યું કશું  
શરીરમાં ચેતન અંગઅંગે !

ને વૃદ્ધની જર્જર કાય છોડીને  
શેરી મહી શી ચકચૂર નાચતી  
નાગીપૂગી એ શિશુટોળકીમાં  
ભળી ગયું એક શિશુ વિરોષ !

કવિશ્રી લાભશંકર ઠાકરની આ એક વિશિષ્ટ રચના છે. આમ તો નાનાં નાનાં સરસ શબ્દચિત્રો છે. બહાર વરસાદ પડી રહ્યો છે. એક વૃદ્ધ પોતાના ઘરની બારી પાસે જાત અહેલીને બેઠો બેઠો પેલાં મકાનોની માફક વર્ષાની ધારા જીલી રહ્યો છે. કવિ વરસાદી વાતાવરણના ચિત્રની સાથે જ એના ચિત્રમાં જે ફેરફારો થાય છે એને રમ્ય રીતે નોંધી છે :

‘બારી પરે જર્જર દેહ ટેકવી  
જૂદી પરી સહેજ, પછી નિરાંતે  
જોઈ રહ્યો એ ક્ષીણ લોચનોથી  
જ્યાં સૌ મકાનો બની મૂક મોજમાં  
જીલી રહ્યાં અંગ પરે અંડ  
વર્ષા તણી શીતલ જીક તન્યા.’

કલોઝઅપનું દશ્ય છે. કવિ બહુ ઓછા શબ્દોમાં વૃદ્ધનું વર્ણન કરે છે. બારી પર ક્ષીણ દેહ ટેકવી સહેજ જૂદી પડેલો જર્જર દેહ, નિરાંત, વાર્દ્ધક્યને લીધી ક્ષીણ થયેલાં લોચનો. આ માત્ર બાબુ વર્ણન જ નથી, વૃદ્ધની માનસિકતા પણ એમાં પડ્યાય છે. જાણો હવે જીવનમાં કંઈ જોવાનું બાકી નથી. પણ કવિ, અચાનક નવો ચમકારો કરે છે. વૃદ્ધની સ્થિતિ મકાનો દ્વારા મૂકી આપે છે. મૂક મકાનો પોતાનાં અંગો પર મૌજથી વર્ષાની ધારાઓ જીલી રહ્યાં છે. ધારા પણ કેવી ? શીતલ અને અંડ. આગળ ઉપર કાબ્ય-ચિત્રમાં જે બદલાવ આવવાનો છે એનો સંકેત અહીં જોવા મળે છે. લગભગ જીવનરસ ગુમાવી દીધેલો વૃદ્ધ હવેના દશ્યથી થોડી વાર માટે ખાવિત થઈને જાણો કે નવજીવન પામે છે. એનાં ક્ષીણ લોચનો હવે દૂરનું અને રમણીય પણ દેખે છે. ક્ષાણ વારની, પણ આ અનુભૂતિ વાર્દ્ધક્યને દૂર હડસેલી મૂકે છે.

ને છાપરામાં  
કબૂતરાં બે ફફડાવી પાંખો  
નાહી રહ્યાં - નાચી રહ્યાં નિમગ્ન.  
ને શેરીમાં સૌ જલલુબ્ધ બાળકો  
કરી રહ્યાં શોરબકોર, નજન  
દોડી રહ્યાં મોજ મહી મનસ્વી !’

આ બીજું ચિત્ર પણ જીવંત છે. કલોઝઅપમાંથી હવે જરાક દૂરનું દશ્ય. આપણે

કબૂતરાંની પાંખોનો ફફડાટ સાંભળી શકીએ એવી રવાનુકારી એમાં છે. નાહી રહ્યાં – નાચી રહ્યાં એ બે ક્રિયાપદો સમગ્ર જીવનના ઉત્ત્લાસને ચીધવા અને વૃદ્ધની બદલાતી માનસિકતા બતાવવા પર્યાપ્ત છે. હવે કવિનો કેમેરા લોગશોટમાં પ્રવર્તે છે. નજીન થઈને શેરીમાં રમતાં, શોરબકોર કરતાં બાળકો મનસ્વી રીતે દોડી રહ્યાં છે. એમણે બધાં વસ્ત્રો ઉત્તારી નાખ્યાં છે કેમ કે એ બાળકો છે. વરસતા વરસાદને જોઈ બાળકો આમ ન કરે તો જ નવાઈ ! પરંતુ અહીં એમને જોનાર વૃદ્ધ છે એનાં પણ કેટલાંય પડળો ઊતારી જાય છે. ઓનું નાજુક મન પણ જાણો શોરબકોર કરવા લાગી જાય છે. એટલે કવિ કહે છે :

‘સુદૂરથી શૈશવની સ્મૃતિની  
આવી પૂરી નાજુક એક વાદળી  
ધીમે ધીમે વર્ષી રહી અજસ્ત.  
બારી મહીંથી નિજ હાથ દુર્બળ  
કાઢ્યો ધીમેથી જરી બહાર, જીલવા  
વર્ષી તકી શીતલ ધાર, જેનો  
થતાં જરી સ્પર્શ ફરી વળ્યું કશું  
શરીરમાં ચેતન અંગઅંગે !’

હવે વૃદ્ધના મનની યાત્રા શરૂ થાય છે. વરસતા વરસાદમાં દૂરસુદૂર એક વાદળી દેખાય છે. કવિ કહે છે કે એ શૈશવની સ્મૃતિની નાજુક વાદળી છે. જે વૃદ્ધના મનની ગતિએ ધીમે ધીમે, પણ અજસ્ત વરસી રહી છે. એ જોતાં જ વૃદ્ધની ચેતનામાં નૂતન સંચાર થાય છે. એ શીતલ ધાર જીલવા, કહો કે ફરી એક વાર બાળક બની જવા, કુતૂહલ અને મુખ્યતાથી પોતાના દુર્બળ હાથને ધીમે રહીને બારી બહાર કાઢે છે ! જળનો સ્પર્શ થતાં જ અંગઅંગે ચેતન ફરી વળે છે. વીતેલાં વર્ષો આ વર્ષાની ધારામાં ઝરી પડે છે, ઓગળી જાય છે. જાણો કે આ દેહમાં રહ્યે છતે પુનર્જન્મ !

‘ને વૃદ્ધની જર્જર કાય છોડીને  
શેરી મહીં શી ચકચૂર નાચતી  
નાગીપૂગી એ શિશ્યોળકીમાં  
ભળી ગણ્યું એક શિશ્ય વિશેષ !’

આપણો ત્યાંની પરંપરામાં એવું કહેવાય છે કે, માણસના મૃત્યુ સમયે, આ શરીરને છોડીને જીવ – કહો કે ચેતનતત્ત્વ બહાર નીકળી જાય છે. અહીં, એવી જ પણ સૂક્ષ્મસ્તરે, મનની લીલાના ભાગાંપે એક ઘટના બને છે. બહાર શેરીમાં નાગાપૂરાં બાળકોની યોળી નાચવામાં ચકચૂર છે, એમાં આ વૃદ્ધ એક શિશ્ય બની ભળી જાય છે ! શિશ્યઓમાં એકનો ઉમેરો થાય છે. આ મોક્ષ નથી તો બીજું શું છે ? મોક્ષ માટે સ્વૂળ અર્થમાં મૃત્યુ જરૂરી નથી. એક ક્ષાળમાં

જ આ બધું બની જાય છે !

આખી ઘટના વૃદ્ધના માનસપટ પર બને છે. પણ કવિ, જીવનનો મહિમા એવી રીતે કરાવે છે કે કોઈને પણ શિશુ રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ આવે ! આ કાવ્યમાં કવિએ વાપરેલાં તમામ વિશેષજ્ઞાં આકર્ષક છે. એકેએક શબ્દ પોતાની અર્થાચ્છાયાઓ એવી રીતે પ્રગટ કરે છે કે પેલા વૃદ્ધની બદલાતી મનઃસ્થિતિની છબિઓ બરાબર છિલાય. આ કવિને અવાજોનું ગજબનું આકર્ષણ છે. અહીં પણ આપણને વરસાદ, કબૂતરની પાંખો, બાળકોનો શોરબકોર કર્ણન્દ્રિયને આનંદનો અનુભવ કરાવે છે.

છેલ્દે, વૃદ્ધની ચેતનાનું શિશુમાં રૂપાંતર થવું, દોડી જું, ટોળીમાં ઉમેરાવું અદ્ભુત છે. ખરેખર તો એમ છે કે જ્યારે જ્યારે વાઈક્ય બંધિયારપણું છોડીને બારીની બહાર જુઓ ત્યારે ત્યારે જીવનના આઙ્ગલાદનો અનુભવ થયા વિના ન રહે એમ કવિને કહેવું છે. એ માટે એ વરસાદનો, કબૂતરોનો અને શિશુટોળકીનો આધાર દે છે.

અહીં ઉપજાત્કૃતિના ઈન્ડ્રવજા, ઉપેન્દ્રવજા અને ઈન્ડ્રવંશા જેવા મિશ્ર છંદોનો ઉપયોગ થયો છે. પણ, ક્યાંય કાવ્યના લયને આંચ નથી આવતી. પ્રવાહિતા અને એક ભાવમાંથી બીજા ભાવમાં સ્વાભાવિક રીતે સરી જતાં ચિત્રો આંકવામાં લાભશંકર ઠાકર માહેર છે એની પ્રતીતિ કરાવતું આ કાવ્ય એક મનોહર અનુભવ મૂકી જાય છે. આપણે ત્યાં કવિવર રાજેન્દ્ર શાહે વૃદ્ધના ચિત્રને વાચા આપતાં એકથી વધુ કાવ્યો આપ્યાં છે. વૃદ્ધચેતનાના મોકશના આ કાવ્યમાં લાંડાં. વૃદ્ધની ગતિશીલ ચેતનાને તાદ્દશ્ય કરી રાજેન્દ્રથી એક ડગલું આગળ માંડે છે.

## સાભાર સ્વીકાર

### નવલક્ષ્ણ

(૮૨) થૈન્ફ્સ ગિવિગ ઢે : નવીન વિભાગર, ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૨+૨૫૬, રૂ. ૨૩૫ (૮૩) અગનિપિયાસા : જીયશ્રી ભંડ દેસાઈ, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૧૦૬, રૂ. ૧૦૦ (૮૪) ટ્યુમર ઓગળે છે : ભૂપેન્દ્ર વ્યાસ 'રેજક્ઝ, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૭૦, રૂ. ૭૦ (૮૫) ઈતિહાસનું અમર પાનું : રાધવજી માધ્ય : ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૧+૧૪૭, રૂ. ૧૬૦ (૮૬) એવાં હતાં મનેખ : રાધવજી માધ્ય : બીજી આ.-૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૧૨૬, રૂ. ૧૩૫ (૮૭) થર્નિગ પોઇન્ટ : મનહર ઓત્તા, ૨૦૧૫, હર્ષ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮+૨૮૮, રૂ. ૨૪૦



## પ. અન્યની આંખે પોતે કરેલું દર્શન

વિનોદ જોશી

### વરસાઈ પછી

જલભીંજેલી  
જેબનવંતી  
લથબથ ધરતી  
અંગઅંગથી  
ટ્યકે છે કેં  
રૂપ મનોહર !  
ને તડકાનો  
ટુવાલ ધોળો  
ફરી રહ્યો છે  
ધીમે ધીમે.  
  
યથા ચાચિકા  
જમના-જલમાં  
સ્નાન કરીને  
પ્રસન્નતાથી  
રૂપ ટ્યકતા  
પારસઢે  
વસન ફેરવે  
ધીરે ધીરે.  
  
જોઈ રહ્યો છે  
પરમ રૂપના

ધૂંટ ભરંતો  
શું મુજ શ્યામલ  
નેનન માંહે  
છુપાઈને એ  
કૃષણ-કનેચ્યો ?

‘ધૂમકેતુ’ની વાર્તા ‘પોસ્ટ ઓફિસ’માં એક વિધાન આવે છે : ‘માણસ પોતાની દસ્તિ જોડી અન્યની દસ્તિથી જોવા લાગે તો અરધું જગત શાંત થઈ જાય.’ અન્યની દસ્તિથી જોવું એટલે કેવળ આંખોથી જોવું એમ નહીં, વિચારોથી પણ જોવું તેમ સમજાય છે. આંખો તો હોય પણ દસ્તિ ન હોય તેવું ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે. જોવું એટલે નજર માંડવી એમ નહીં. તેના અર્થો ઘણા સૂક્ષ્મ છે. અહીં, લાભશંકર ઠકરની કવિતામાં એ અર્થો કાવ્યાત્મક રીતે સ્કૃત થાય છે અને કાવ્યસૌદર્યનો અનુભવ કરાવે છે.

કાવ્યનું શીર્ષક છે, ‘વરસાદ પછી’. વરસાદના આગમનની જે તીવ્રતાથી પ્રતીક્ષા થતી હોય છે તેવી જ તીવ્રતા વરસાદ વરસી રહ્યા પછીની ભીની માટીની સુગંધ અનુભવવામાં હોય છે. આ વરસાદ એક એવો બનાવ છે જે આપણને મુખ્યતાની સાથે જ પ્રગટભતાનો અનુભવ પણ કરાવે છે. વાણ અને ધરાને સાંધતા રૂપેરી તારને કોઈ ગણવા બેસે ખરું ? જ્યાં જ્યાં ગણિત મંડાય ત્યાં ત્યાં પ્રસન્નતાનું સ્થાન પ્રપંચ લઈ લે છે. આ કાવ્યમાં વરસાદ વરસી રહ્યા પછીની ધરતીની પ્રસન્નતાનું હંદયંગમ ચિત્ર છે. તુષાતુર ધરતીને આલિંગને વરસાદ અદરથ્ય થઈ જાય પણ પછી ધરતીને રોમેરોમ જે રોમાંચાનું લાવાય ફૂટે તેની સરખામણી કશાની સાથે થઈ શકે નહીં.

પ્રશ્ન એ થાય છે કે અહીં વાત ધરતીની છે કે પછી કોઈ મદભરી યુવતીની ? અગાઉ કહ્યું તેમ કઈ દસ્તિ આ ઉકેલવું તે એક કોયડો છે. કવિને અહીં અન્યની દસ્તિ મદદમાં આવે છે અને એ દસ્તિ છે કામણગારા કૃષણની. કૃષણની દસ્તિએ ધરતીને નજરમાં વસાવી લેતો કવિ ધરતીની મર્યાદાઓને આગોળાની દે છે અને તેને એક જોબનકંતી, જણથી લથબથ ભીજાયેલી કામિની તરીકે જોવા લાગે છે. એનું કોઈ અંગ એવું નથી જેણાંથી રૂપ ટપકતું ન હોય. વરસાદના આશ્રેષથી અભિષિક્ત ધરતીનું રૂપ મહોરીન ઊઠે તો જ નવાઈ ! એ યૌવનધારિણીનું આકર્ષણ જ એવું છે કે આંખો ત્યાં અટક્યા પછી ખસવાનું નામ ન લે.

રૂપ એ કંઈ ટપકવાનો વિષય નથી. પણ અહીં ‘જલભીજેલી’ અને ‘લથબથ’ કલ્યા પછી તેની ઉત્કૃષ્ટ કક્ષા દર્શાવવા ટપકવા સુધીની પ્રક્રિયાનો તેમાં નિર્દેશ થયો. ટપકવામાં કોઈ કશું આકમણ નથી. એ એક સુચારુ દર્શાની છે. એટલે તો તેની સાથે ‘રૂપ મનોહર’ એવો વિભાવ કવિએ જોડી આપ્યો છે. વળી આ વરસાદ કંઈ છાનોછપનો નથી આવ્યો. ધોળે હિવસે બધાની

હાજરીમાં આવીને વરસ્યો છે અને વરસીને ચાલ્યો ગયો છે. એણે ભીજવી દીવેલી ધરતી જાણે સંઘર્ષનાતા છે. એક ભરજોબન યુવતીને ભીજાયેલી ન રહેવા દેવાય તેવી સમજ સાથે તડકે શેતરંગી ટુવાલ બનીને ધરતીનું ડિલ લૂછવા લાગે છે. એ કિયામાં પણ કશી ઉતાવળ નહીં. ધીમે ધીમે....

કેવું સુંદર કલ્પન છે ! ગમે તેવી સ્થૂળ નજર પણ સૌંદર્યમંડિત બની જાય તેવું આ આવેખન છે. સંઘર્ષનાતા એટલે તો તાજી નાહેલી. હજી તો શરીર લૂછયું પણ નથી તેવી. કોઈ જોઈ જાય તે પૂર્વે જ ડિલ લૂછી નાખવાની તત્પરતામાં લજાભાવનું કેવું અવ્યક્ત છતાં સહજતાપૂર્વક પમાઈ જતું કાચ્યસૌંદર્ય અનુભવાય છે ! વળી આખી વાત કહેવાઈ રહી છે ધરતીનાં બહાને કોઈ યૌવના અંગે. અને છતાં કાચ્યમાં તો રાધિકાને બહાને ધરતી વિશે જ આ બધું કહેવાતનું હોય તેવું છળ કવિએ રચ્યું છે.

યમુનાના પાણીમાં સ્નાન કરીને રાધિકા જળની બહાર નીકળે અને તેના ‘રૂપટપક્તા પારસદેહ’ ધીમે ધીમે વસ્ત્ર ફરતું રહે તેમ તડકો વરસાદથી ભીજાયેલી ધરતીને જાણે લૂછી રહ્યો છે, કોરી કરી રહ્યો છે. અહીં વપરાયેલ ‘પારસ’ શબ્દ બહુ વિશ્રિષ્ટ અર્થમાં વપરાયો છે. પારસના સ્પર્શથી લોહું સુવર્ણ બની જાય છે એમ કહેવાય છે. અહીં રાધિકાનો પારસદેહ એમ કહેવાયું તેને એ રીતે ઘાલી શકાય કે રાધિકા જેને સ્પર્શો તે સુવર્ણ બની જાય. અહીં રાધિકા ધરતીનું પ્રતીક છે અથવા તો ધરતી રાધિકાનું પ્રતીક છે. જેમ રાધિકા જેને સ્પર્શો તે સુવર્ણ બની જાય તેમ ધરતીના સ્પર્શથી પણ બધું સુવર્ણ બની જાય. વરસાદના આશ્વેષથી ભીજાયેલી ધરતીને જ આનંદ આવે છે તેમ નહીં પણ એ આશ્વેષ આપનાર પણ પારસસ્પર્શ પાય્યો છે તેવી વાત અવળે છેઠેથી અહીં ઉકેલે છે અને વરસાદ પણ કંઈક પામીને ગયો છે તેવો તાળો મળે છે.

પ્રસન્નતાની અવધિ ન હોય તેવી આનંદકીડાને શબ્દોમાં વર્ણવવી શક્ય નથી તે કવિ જાણે છે. કવિ એ પણ જાણે છે કે પરમ રૂપનું સંકીર્તન ગમે તેટલું કર્યું હશે તોપણ તેની એવી અનેક ઘટનાઓ વજાસ્પર્શી રહી જવાની. જે કેવળ અનુભવનો જ વિષય હશે, ભાણનો નહીં.

એટલે હવે કવિને વિમાસણ થાય છે. જે કંઈ દેખાઈ રહ્યું છે એ મનોહરરૂપ દેખાય છે એ પણ સાચું છે અને જે જોઈ શકવાની પોતાની ક્ષમતા નથી એ પણ સાચું છે. કવિ જાણે છે કે પોતાને થઈ રહેલો અનુભવ રૂપની સર્વોત્કૃષ્ટ અવસ્થાનો છે અને તાં સુધી ચર્મચક્ષુ વડે પહોંચવું પોતાનાથી શક્ય નથી. એટલે આ દર્શન નક્કી કોઈ અન્યની આંખે થઈ રહ્યું હોવું જોઈએ એવી કવિને શંકા જાય છે.

જો લથબથ ભીજાયેલી ધરતી કવિને નમણી રાધિકા જેવી દેખાવા લાગી હોય તો એ દર્શન કવિની ખુદની આંખોએ કરેલું દર્શન નથી. પણ એ આંખોના માધ્યમથી કૃષ્ણકનેયાએ કરેલું દર્શન છે. એ જ ઓક એવો દ્રષ્ટા છે જે આ રૂપની સોળે કળાને તેના સાચા અને સાક્ષાત્

અર્થમાં ઉકેલી શકે. પણ કવિ આમ પોતાને મળતો લાભ કૃષ્ણના ખાતે લખી નાખે તેટલા ઉદાર નથી. એ તો અહીં એવો સંભવ વ્યક્ત કરે છે કે કદાચ આ દર્શન પોતે નહીં પણ પોતાની આંખોમાં આવીને છુપાઈ ગયેલ કૃષ્ણ કરી રહ્યો છે. એટલે તો એ પ્રશ્નાર્થ પાસે આવીને કાવ્ય અટકે છે.

પણ કાવ્યનું સૌદર્ય તો એ વાતમાં રહેલું છે કે આવું મનોહારી રૂપ જોતાં જ દરેક જણ કૃષ્ણ બની જાય છે. સૌદર્ય પામવા માટે તેની સામે જ એવું જ સૌદર્યકારી પાત્ર બનવાનો મહિમા અહીં પ્રગટ થયો છે. એક એક, બબ્બે શબ્દોમાં કટકે કટકે કટાવના લયમાં કહેવાની વાત કેવી અખંડતા કે અખિલાઈનો સ્પર્શ કરાવે છે તે આકારમાં પણ બિન્ન લાગતી આ કવિતાનો લાક્ષણિક ગુણ છે.

કોઈ ગુજરાતી ગઝલકારનો આજો શે'ર તો યાદ નથી આવતો પણ તેનો એક મિસરો આમ છે :

‘તમારું રૂપ જોવું એ પછી નોતી રહી આંખો !’

18





## દ. ભૂત-વર્તમાનની સાંકળ સમું પતંગિયું

ધીરુ પરીખ

### પતંગિયું

વાયુ તણી આ ડમરી મહીં અરે  
આવી તણાયું મૃત કો' પતંગિયું  
પડ્યું અહીં ફર્શ પરે વિશીર્ણ.  
જ્યાં ઉંચકી અંગુલિએ હથેલીમાં  
મૂકી રહ્યું છું નીરખી :

પ્રક્રિપિતા

રંગો તણી સૃષ્ટિ સુરમ્ય શૈશવી  
હથેલીમાં દક્ષિણ રે ઝૂલી ઊરી :  
કુમારીના કાંચનકેશ ફરફર્યા !  
ને અશની પીઠ પરે રતૂમહી  
હલ્યા કરે મોજડી વામદક્ષિણે !  
મોતી ચૂગે હંસ સરોવરે

ત્યહીં

ફરી સપાય મહીં ચંડ વાયુના  
હથેલીથી છિન્નવિછિન્ન થૈ બધે  
ચતુર્દિશે શા ટુકડા ઊરે અરે !  
પતંગિયું એક સુરમ્ય, શું થયું !  
રતાલીલા આ ટુકડા સ્મૃતિ સમા  
પડ્યા બધે ફર્શ પરે અહીં તહીં !  
એ સર્વને સાંધી શર્કું ન દસ્તિથી !  
પતંગિયું, ફર્શ, વ્યથા, રતૂમહી  
શી મોજડી ! કાંચનકેશ;

હાથમાં

થેલી લઈ ચંપલ પેરી ચાલતો  
કચેરીએ, શી પલકે પુનઃ પુનઃ  
દસ્તિ :

અરે એક સુરમ્ય, શું થયું ?  
પતંગિયું એક સુરમ્ય, કયાં ગયું ?

**ગાંધીયુગ** પછી ગુજરાતી સાહિત્યમાં જે વલણ-વિચારો તરતાં થાય છે તેને અનુગાંધીયુગીન સાહિત્યિક ચળવળ તરીકે ગણાવાય છે. હા, અલબત્ત આ સાહિત્યના ઈતિહાસની દસ્તિએ આચી ઘટના ગણાય. પણ મૂળ વાત તો કલાત્મક અભિવ્યક્તિની જ છે. યું યું સમય-સંજોગો પ્રમાણે અભિવ્યક્તિ બદલાતી રહે છે, અને બદલાતી રહેવી જોઈએ. આમ છીતાં એમાંની કલાત્મકતા ન અળપાવી જોઈએ.

આ દસ્તિએ જોવા જઈએ તો આધુનિક અને અનુ-આધુનિક સમયગાળામાં જે કેટલાંક કવિનામો આગળ તરી આવે છે તેમાં લાભશંકર ઠાકર એક પણિપક્વ કવિનામ છે. તેમણે વિવિધ નિષયો અને છાંડસ-અછાંડસ વિવિધ રીતિઓ, કલ્યાન-પ્રતીક, કલ્યાન-તરંગ એમ વિવિધ તરકીબો પોતાની કાવ્યયાત્રામાં ખપમાં લીધી છે અને ઘણુંખાં એમાં સફળ રવ્યા છે.

આપણે અહીં જે કાવ્યની વાત માંડવાની છે તેનું શીર્ષક છે ‘પતંગિયું’. પતંગિયું ચંચળતા અને ચારુતાનું પ્રતીક છે. એ ભાગે જ ક્યાંય સ્થિર હોય છે. આ કાવ્યમાં લાભશંકરે છંદનો સુંઘર અને સફળ પ્રયોગ કર્યો છે. ટ્રંક છંદમાં પતંગિયાની ઊડાઉિડ તાદશ કરી અપાઈ છે.

પણ આ પતંગિયું મૃત છે. એનું વજન અને કદ કેટલું ?! આવું એક નાનું મૃત પતંગિયું પવનમાં જેંચાઈને આવ્યું છે અને કવિ જ્યાં છે ત્યાં ફર્સ્ટ પર એ પડે છે. અરે, પતંગિયાનું વજન શું ? કદ કેવડું ? ફર્શને કે પડતા પતંગિયાને જોનાર કાવ્યનાયક કે કવિને એમાં મોટી ઘટના જેવું ન જણાય. પણ એવું નથી. આ મૃત પતંગિયાને આંગળીથી ઊંચકાને કવિ પોતાની હૃથેળીમાં મૂકે છે અને મૂક બની એને જોઈ રહે છે.

બસ, આ કાણે મૃત પતંગિયાની કાયા કવિને ભૂતકાળમાં લઈ જાય છે. કવિ જ્યારે ભૂતકાળમાં યોવનાવસ્થામાં હશે ત્યારે જે પતંગિયાની લીલા જોઈ હશે તે સમરણે ચઢે છે. આ ડેવળ પતંગિયું જ નથી. એ તો રંગોની સૃષ્ટિ ! વિવિધ રંગોથી આકર્ષક પતંગિયાં કવિના સ્મૃતિચ્છુ સમક્ષ તરવરી રહે છે. પતંગિયું તો મરી ગયું છે. હા, પણ એ તો એનું સ્થળમૃત્યુ છે. એની રંગસૃષ્ટિ અજ્રામર છે. કવિ મૃત પતંગિયાને હૃથેળીમાં જોતાં જ પેલી રંગસૃષ્ટિમાં પહોંચી જાય છે. અને એક ચિત્ર સમરણમાં તાજું થાય છે :

‘કુમારીના કાંચનકેશ ફરફર્યું !’

કુમારાવસ્થામાં જે ચિત્તકર્ષજી હોય છે – વિજાતીય વ્યક્તિ પ્રત્યેનું – તે અહીં જગ્રત થાય છે. આ રીતે પ્રેમનો સંસ્પર્શ તાજો થાય છે. અને પ્રેમ આખરે છે શું ? એ પરંગિયા જેવો સુંદર છે ! પરંગિયું મરી ગયું છે પણ એનું સૌંદર્ય સહભર છે. એમ લુખ થયેલા પ્રેમની કાણોની સ્મૃતિનું સૌંદર્ય પણ ચિરકાલીન છે ! તરત જ બીજું ચિત્ર આવે છે :


‘ને અશ્વની પીઠ પરે રતૂમડી,  
હલ્યા કરે મોજડી વામદક્ષિણી !’

સુંભવ છે કે કોઈ પરાણવા નીકળેલા કે પ્રવાસે નીકળેલા નરનું આ ચાક્ષુસ ચિત્ર છે. અને એ સાથે જ કવિની નજર હથેળીમાંના પેલા મૃત પરંગિયા તરફ જાય છે ત્યારે માત્ર અશ્વારૂઢ યુવક નહીં, પણ પ્રચંડ વાયુના ઝપાટામાં પણ અત્રતત્ત્વ ઊરી રહેલા પરંગિયાને જ કવિ જોઈ રહે છે. અને કવિનું ચિત્ર વિખાદમાં સરી પડે છે :

‘પરંગિયું એક સુરમ્ય, શું થયું !  
ચાતાલીલા આ ટુકડા સ્મૃતિ સમા  
પડ્યા બધી ફર્શ પરે અહીં તરી !  
એ સર્વને સાંધી શર્દું ન દસ્થિથી !’

પરંગિયા પ્રત્યેના પ્રભાવી પ્રેમનો આ કવિ-ઉદ્ગ્રાર કરુણાનો પોષક બની રહે છે. હથેળીમાં મૃત પરંગિયાને જોઈ કવિ ભૂતકાળમાં પરંગિયાની જેમ ઊરી રહે છે અને ત્યાં તો હથમાંના મૃત પરંગિયાના ટુકડા થઈ તે ફર્શ પર પડે છે. કવિને હવે વિખાદ થાય છે... પોતે આ મૃત પરંગિયાને જીવતું નહીં કરી શકે. શક્ય છે કે પરંગિયું કાવ્યનાયકના યુવાકાળની મધુર ઘટનાઓ-સ્મૃતિઓનું પ્રતીક પણ હોય ! હવે જેમ મૃત પરંગિયાના ટુકડા ફર્શ પર પડ્યા છે તેમ કાવ્યનાયકના અતીતની કોઈ સુરમ્ય ઘટનાના વિલોપનો અહીં વિખાદ પણ પ્રતીકાત્મક રીતે અભિવ્યક્ત થયો હોય ! બાધ દસ્થિથી એ ભૂતકાળીન સ્મૃતિના ટુકડાઓને સાંધી શકતા નથી. પરંતુ ત્યાં જ પેલું પતંગિયું, ફર્શ, રતૂમડી મોજડી, કાંચનકેશ બધું ચિત્તવંગું થાય છે અને કાવ્યનાયકને જીવનની ઘટમાળના એક ભાગ રૂપે ઘર છોડી ઓફિસે જવા નીકળવું પડે છે ! આ કાણો ફરી પેલા મૃત પતંગિયાના દશ્ય પરથી રંગબેરંગી જીવતું પતંગિયાની સૃષ્ટિમાં કાવ્યનાયક પહોંચી જાય છે, પણ હવે તે કયાં છે ? એને, ગત સુરમ્ય સુખદ કાણોને પુનઃ જીવતું કરી શકાય તેમ નથી એ વિખાદ સાથે કાવ્ય પૂરું થાય છે.

કાવ્યનાયકના વર્તમાન અને ભૂતકાળને સાંધી આપતું આ મૃત પતંગિયું, કાવ્યનાયકના વર્તમાનની કરુણતાને ટેચે પહોંચાડે છે.



## ૭. ‘સાંજના ઓળા લથડતા જાય’

નિરંજન ભગત

### સાંજના ઓળા લથડતા જાય

સાંજના ઓળા લથડતા જાય.  
બબડતું બોર વેચે શહેર આપ્યું  
શહેર પાંખું  
પાંખ  
એકેએકની ફર્ફડા કરે છે પાંખ.  
શી થરક્યા કરે છે આંખ !  
મેં પથ્થરોને ઉડતા જોયા હતા  
ને પંખીઓને બૂડતાં જોયાં હતાં.  
આ નદીની રેતમાં  
બળતી બપોરે  
પંખીઓની દાડતી છાયા  
અરે  
એના વિષાટે આંખમાં  
આંસુ મને આવ્યાં હતાં.  
આંખમાં આંસુ  
અને એમાં સદા યૌવનતરીને હંકતા  
વર્ષો સુધી રોયા હતા.  
વર્ષો સુધી જોયા હતા  
મેં પથ્થરોને ઉડતા  
ને પંખીઓને બૂડતાં.

પથર હવે પથર બન્યા છે.  
પંખી હવે પંખી બન્યાં છે.

જોઉં છું મિત્રો તમોને  
રેતમાં હોડી હમેશાં હંકતા  
ને કેડમાંથી વંકતા  
ને હોઈમાંથી હંકતા  
ગીતની કડી.  
તેથી જ કહું છું કે હવે હું જાઉં છું.  
મૌનને અંતે હવે હું ગાઉં છું.

છો બબડતું બોર વેચો છે  
નગર પાંખું  
નગરની તૂટલી તિરાડ-શી સડકો મહીં  
હું ફક્ત કેવલ ગાઉં છું.  
કાનને સંભળાય મારા  
એટલું ધીમેશથી હું ગાઉં છું.  
ફક્ત કેવલ ગાઉં છું.

આ કાવ્ય એક મરણો-સુખ મનુષ્યની સ્વગતોક્રિયા છે.

કાવ્યનાયક સાંજના સમયે કોઈ એક શહેરની સડક પર આ સ્વગતોક્રિયા ઉદ્ગારે છે :

‘સાંજના ઓળા લથડતા જાય  
બબડતું બોર વેચો શહેર આખું  
શહેર પાંખું’

સાંજ જ્યારે નમતી હોય છે ત્યારે શહેરનાં ઊંચાં મકાનોના લાંબા ઓળા સડકો પર પડતા હોય છે – જેમ જેમ સાંજ વધુ ને વધુ નમતી જાય છે તેમ તેમ વધુ ને વધુ લાંબા ઓળા જાણે લથડતા હોય એમ સડકો પર પડતા જાય છે. સવારે શહેર દિવસભરના કામકાજની તૈયારી કરતું હોય છે, બાપોરે કામકાજ કરતું હોય છે. માત્ર સાંજે જ એ કામકાજમાંથી પરવારતું હોય છે ત્યારે આપું શહેર સડકો પર ઠલવાતું હોય છે, ટોળાંઓથી ઊભરાતું હોય છે. ત્યારે એ ગાજતું (બોર વેચો) હોય છે. પણ ત્યારે એ થાકેલું હોય છે, એથી એ જાણે બબડતું હોય છે. ત્યારે એ પાંખું-જાંખું પણ હોય છે. ‘લથડતા’ અને પાંખું-શહેર આંખને સ્પર્શો છે, ‘બબડતું’ શબ્દ કાનને સ્પર્શો છે. લાભશંકરે માત્ર ત્રણ જ શબ્દોના, ત્રણ જ પંક્તિઓના એક આછા

લસરકાથી ગતિશીલ શહેરનું હૂબદ્ધ આગેહૂબ ચિત્ર સર્જું છે. આ ઈન્ડિયગમ્બ્ય – ઈન્ડિયગ્રાન્થ અને લાઘવયુક્ત ચિત્રાંતકતા એ લાભશંકરની શૈલીની એક લાક્ષણિકતા છે. એમનાં અનેક કાવ્યોમાં આ લાક્ષણિકતા જોવા મળે છે. કાવ્યના આરંભનું આ ચિત્ર એ ચિત્ર માત્ર નથી, પણ ચિત્રથી કંઈ વિશેષ છે એ તો કાવ્યના અંતે જાગાશે.

લાભશંકરની શૈલીની એક અન્ય લાક્ષણિકતા છે. બે શબ્દોના પ્રાસને આધારે અને / અથવા બે શબ્દોના અવાજના થોડાક સામ્યને સહારે તેઓ એક ભાવમાંથી અન્ય ભાવમાં, મિનન અથવા વિરોધી ભાવમાં; એક વિચારમાંથી અન્ય વિચારમાં, મિનન અથવા વિરોધી વિચારમાં; એક કાળમાંથી અન્ય કાળમાં સહેલાઈથી સરી જાય છે. અહીં કાવ્યનાયક ‘આખું’ અને ‘પાંખું’ના પ્રાસને આધારે અને ‘પાંખું’ અને ‘પાંખ’ શબ્દોના અવાજના થોડાક સામ્યને સહારે વર્તમાનકાળમાંથી ભૂતકાળમાં સરી જાય છે :

### પાંખ

એકેએકની ફંકડા કરે છે પાંખ.  
શી થરકા કરે છે ઓંખ !  
મેં પથથરોને ઉડતા જોયા હતા  
ને પંખીઓને બૂડતાં જોયાં હતાં.  
આ નદીની રેતમાં  
બળતી બપોરે  
પંખીઓની દાઢતી છાયા  
અરે  
એના વિષાદે અંખમાં  
અંસુ મને આવ્યાં હતાં.  
અંખમાં અંસુ  
અને એમાં સદા યૌવનતરીને હંકતા  
વર્ષો સુધી રોયા હતા..  
વર્ષો સુધી જોયા હતા  
મેં પથથરોને ઉડતા  
ને પંખીઓને બૂડતાં.’

હવે કાવ્યનાયક એના જીવનભરના, આયુષ્યના આરંભ (સદા યૌવનતરીને હંકતા)થી આ ક્ષણ સુધીના કરુણમાં કરુણ અનુભવનું સમરણ કરે છે :

ઝે પથથરોને ઉડતા જોયા હતા  
ને પંખીઓને બૂડતાં જોયાં હતાં.’

કવિએ કાવ્યનાયકના અનુભવને આ યુગમાં લયવાહી, પ્રાસયુક્ત પંક્તિઓમાં એક જ છંદના, માત્ર હરિઝિત છંદના જ એકમનાં ત્રણ ત્રણ આવર્તનોમાં દફતાથી અને અંતિમતાથી

વ્યક્ત કર્યો છે.

આ યુગમની પૂર્વે અને પછી કાવ્યનાયક પંખીઓની કરુણતાનું સ્મરણ કરે છે :

‘એકેએકની ફષ્ટક્યા કરે છે પાંખ.

શી થરક્યા કરે છે આંખ !

.... ....

આ નદીની રેતમાં

બળતી બાપોરે

પંખીઓની દાઢતી છાયા’

કાવ્યનાયકે પંખીઓની આ કરુણતા પ્રત્યેના એના સંવેદન, સમસંવેદનને કારણે, વિષાદને કારણે જીવનભર આંસુ સાર્યો હતાં. પંખીઓની આ કરુણતા વૈયક્તિક કરુણતા છે. પણ આ કરુણતાના કારણરૂપ જે કરુણતા છે તે આ કરુણતાથી વિશેષ એવી કરુણતા છે. એ વૈશિક કરુણતા છે, એ વિશ્વવ્યાપી કરુણતા છે. વિશ્વ જે કરુણતાથી છલોછલ છલકાય છે એ કરુણતા છે. આ કરુણતા પૂર્વોક્ત યુગમાં વ્યક્ત થાય છે. કાવ્યનાયક જેને કદી ઊડવાનું ન હોય એવા નિર્જીવ પથરોને ઊડવા અને જેને સદા ઊડવાનું હોય એવાં સજીવ પંખીઓને બૂડતાં જોયાં હતાં. આ વિસ્મય અને આશ્રમનો અનુભવ છે, વિધાતાની વક્તા અને વિષમતાનો અનુભવ છે. વિશ્વકમ્મમાં, વિશ્વની રચનામાં અભ્યવસ્થા અને અરાજકતાનો અનુભવ છે, મનુષ્યનો આ કરુણમાં કરુણ અનુભવ છે, ગહન અને ગભીર; કૂટ અને ગૂઢ એવો અનુભવ છે. લાભશંકરનાં અનેક કાવ્યમાં આ અનુભવ પ્રત્યક્ષ કે પરોક્ષપણે વ્યક્ત થતો જોવા મળે છે. એથી જ લાભશંકરનાં કેટલાંક કાવ્યમાં અને ગદ્વાલભાષ્ણોમાં વિશ્વકમ વિશે, વિશ્વની રચના વિશે ફેરિયાસ કરવો જોઈએ; પાંચ હજાર વર્ષની માનવરસંસ્કૃતિ અંગે, પ્રચાવિત મૂલ્યો અને માન્યતાઓ અંગે પરંપરાગત આસ્થાઓ અને શ્રદ્ધાઓ અંગે ફેરતપાસ થવી જોઈએ. એવો આગ્રહ જોવા મળે છે.

કાવ્યના આરંભે જે ચિત્ર છે એમાં આ અનુભવના એકાદ અંશનું આરોપણ છે. એમાં કાવ્યનાયકનો વૃત્તિમય હેત્વાભાસ છે. પછી આ અનુભવનું સ્મરણ કરવાથી અને એમ આ અનુભવમાંથી ફરી એક વાર પસાર થવાથી અંતે આ અનુભવનું નિરસન થાય છે. હવે એ ભૂતકાળયાંથી વર્તમાનકાળમાં સરી જાય છે. હવે એ નિર્ભમ, નિરાસકત અને નિરામય છે. એનો કરુણ શાંતિમાં પર્યવસાન પામે છે.

આમ, કાવ્યનાયકને એકસાથે આત્મવિલોપન અને આત્મોપલબ્ધિનો અનુભવ થાય છે; એકસાથે તાદ્યાત્મ્ય અને તાટસ્થયનો અનુભવ થાય છે. એ પથ્થર અને પંખીને નિર્વેપ નેત્રથી નિહાળે છે.

‘પથ્થર હવે પથ્થર બન્યા છે

પંખી હવે પંખી બન્યાં છે’

એ મિત્રોને પણ નવી નરવી દસ્તિથી જુએ છે :

‘જોઉં છું મિત્રો તમોને  
 રેતમાં હોડી હમેશાં હંકતા  
 ને કેડમાંથી વંકતા  
 ને હોડમાંથી હંકતા  
 ગીતની કરી.  
 તેથી જ કહું છું કે હવે હું જાઉં છું.  
 મૌનને અંતે હવે હું ગાઉં છું.’

મિત્રોની આ અવસ્થા છે એથી કાવ્યનાયક મિત્રોથી દૂર થાય છે. અને ‘હું જાઉં છું’ કહીને જાણો મૃત્યુની નિકટ જાય છે. હવે એનામાં મૌન છે. એ બાધ્યજગત અને બાધ્ય જીવનમાંથી આંતરજગત અને આંતરજીવનમાં સરી જાય છે. હવે એ બહિર્મુખ નથી, એ અંતર્મુખ છે. એથી એનામાં મૌન છે. પાણીથી વધુ મુખર અને વધુ માર્મિક એવું આ મૌન છે. આ મૌનને અંતે એ ગાય છે :

‘ઓ બબડતું બોર વેચે છે  
 નગર પાંખું  
 નગરની તૂટલી તિરાડ-શી સડકો મહીાં  
 હું ફક્ત કેવળ ગાઉં છું.  
 કાનને સંભળાય મારા  
 એટલું ધીમેશથી હું ગાઉં છું.  
 ફક્ત કેવળ ગાઉં છું.’

કાવ્યના આરંભે જે નગર હતું એનું એ જ નગર છે. પણ હવે કાવ્યનાયક એનો એ જ નથી. એ નગર પ્રત્યે એ ઉદાસીન છે, અન્યમનસ્ક છે. એને માટે જાણો એ નગરનું અસ્તિત્વ જ નથી.. એની સડકો જાણો એ નગરની તૂટલી તિરાડો છે. એને હવે આ જગતમાં કશું કરવાનું નથી, કોઈને કશું કહેવાનું નથી.. એને માત્ર ગાવાનું છે. પણ તે કોઈને સંભળાવવા માટે ગાવાનું નથી.. એ હવે માત્ર પોતાના જ કાનને સંભળાય એટલું ધીમેશથી ગાય છે. એ ફક્ત કેવળ ગાય છે. એ પોતાનું હંસગીત ગાય છે. ‘ફક્ત કેવળ ગાઉં છું.’ શબ્દોના પુનરાવર્તનમાં એની આ અંતિમ દૃષ્ટાની પ્રતીતિ થાય છે. આમ, કાવ્યને અંતે કાવ્યનાયક એના અંતરતમમાં અલોપ થાય છે.

માત્ર આ કાવ્ય જ નહિ, કાવ્યમાત્ર કવિને માટે એકસાથે આત્મવિલોપન અને આત્મોપત્તિબ્ધિનો અનુભવ છે, એકસાથે રાદ્યાત્મ્ય અને રાટ્સથનો અનુભવ છે; કાવ્ય એ મરીને જીવવાનો મંત્ર છે.

૨૩ એપ્રિલ, ૨૦૧૬



## ૮. ‘સૂર્યને શિક્ષા કરો’ વિશે

કુમારપાળ ડેસાઈ

### ‘સૂર્યને શિક્ષા કરો’

મૂર્ક

વાતાવન મહીં ઊભી હતી  
શ્યામા.

ગાલનાં અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી  
લોહીની ઉઝ્જ્વા મહીં સૂર્યોલ આકુલતા નરી  
સૂર્ય સંકોરી ગયો.

માધુર્ય જન્માવી ગયો.

ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો  
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ !

□

ઉદરમાં

આખાઢનું ઘેઘૂર આખું આભ લૈ

પીંજરામાં કલાન્ત ને આકુલ

શ્યામા જોઉં છું, નતશિર.

‘કોણ છે આ કૃત્યનો કર્તા?’

મૂર્ક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા.

અંખમાં માધુર્યનાં શાબ જૂલતાં.

હું કાવી

તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું :

‘સૂર્યને શિક્ષા કરો.’

કંઈની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું :

‘સૂર્યને શિક્ષા કરો.’

‘કોણ છે આ કૃત્યનો કર્તા ?’ એવો આર્તનાદ કરતા કવિ અંતે આવા કૃત્યને માટે જવાબદાર એવા સૂર્યને શિક્ષા કરવાનું કહે છે. પરંપરિત હરિગીતમાં વહેતા આ ગીતમાં બારી પાસે મુંગી મુંગી ઊભેલી એક નારીના ગાલ પર સૂર્યનો તડકો પડે છે. બારીમાંથી એ શયામા ફૂટપાથ પર ગર્ભવતી ભિખારાજ બાઈને જુઓ છે. લેખક આ સૂર્યનો તડકો ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશોલી લોહીની ઉઘા સાથે ભજી ગયેલો બતાવે છે. કોઈએ આ ગરીબ નારી સાથે દુષ્કર્મ કર્યું છે અને પરિણામે એના ઉદરમાં રહેલો ગર્ભ એને માટે માતૃત્વના માધ્યુર્યને બદલે કરુણતાનો ઉદ્વિપક બની રહ્યો છે.

જાણે પાંજરામાં પુરાયેલી હોય, તેવી આ સ્ત્રીની લાચારી એવી છે કે એ ગર્ભ પાડી શકતી નથી, અને વળી માંડ માંડ પોતાનું જીવન નિભાવતી ગરીબ નારીને ઉદરમાં બાળક આવતાં એનું લાલનપાલન કરવાની – સાચવવાની – વિશેષ જવાબદારી આવી પડી છે. આ કેવી હદ્યવિદારક પરિસ્થિતિ કે જે પોતે માંડ માંડ જીવન ગુજારે છે એને માથે બાળકના જીવનના ઉછેરનો બોજ પડ્યો. બાળજન્મ એ એને માટે આનંદનો અવસર નહીં, પણ ઉપાધિનું કારણ બનશે. આ સ્થિતિને માટે દોષિત એવા સૂર્યને કવિ શિક્ષા કરવાનું કહે છે. અહીં સૂર્યનો સંબંધ શક્તિ અને પૂરુષ સાથે છે. એક પૂરુષ એક ગરીબ સ્ત્રીની આવી બદટર હાલત કરે, તે માટે કવિ પ્રતીકાત્મક રીતે સૂર્યને શિક્ષા કરવાનું કહે છે.

એ સ્ત્રીને માતા થવાનો આનંદ નથી, પણ માતૃત્વનો બોજ વેંફરવાનો છે. એ પિંજરામાંથી કઈ રીતે બાહાર નિકળું એ એને સમજાતું નથી, કારણ કે જેણે દુષ્કર્મ કર્યું છે, એ તો એની લેશમાત્ર જવાબદારી લેતો નથી. આ સ્ત્રીને તો જીવનું પડે છે –

### ‘ઉદરમાં

### આખાડનું ઘેઘૂર આપું આભ દૈ’

આ સ્ત્રી નતશિર છે. એના થરથરતા હોઈ ખૂલતા નથી. એની આંખમાં મૃત્યુ પામેલું માધ્યર્ય છે. નિઃસહાય નારીનું કવિએ આગવી રીતે ચિત્રણ કર્યું છે.

આ સઘળાને માટે જવાબદાર એવો પૂરુષ દેખાતો નથી; એને દેખાડી શકે એવો સૂર્ય પણ ઘેરાયેલાં વાદળો વચ્ચે દેખાતો નથી. આવે સમયે હદ્યથી જે કવિ તે શું કરે ? એ આ વેદનાભરી પરિસ્થિત જોઈને ચીસ જ પાડી ઊઠે ને ? એ કહે છે કે સૂર્યને શિક્ષા કરો, પૂરુષને શિક્ષા કરો. આ કાવ્યમાં શક્તિવંત સૂર્ય અને નિર્ભળ નારી – એ બંને પરિસ્થિતિને કવિ લાભશક્તર ઢાકરે ઉપસાવી છે, આથી જ અંતે કવિ તારસ્વરે સૂર્યને શિક્ષા કરવાનું કહે છે. સૂર્યના પ્રતીકને કવિ પોતીકી મુદ્રાથી પ્રગટ કરે છે. આમ તો સૂર્ય એ વિશ્વનો જીવનદાતા છે, પણ એણે આ સ્ત્રીનું જીવન છીનવી લીધું છે. આ કાવ્યમાં કવિ એક નિઃસહાય નારીની કરુણ સ્થિતિ અને એ જોઈને કવિહદ્યમાં જાગતી સંવેદનાનું કારુણ્યસભર રીતે નિરૂપણ કરે છે.



## દ. કલ્યાન-પંખીઓનો મુક્ત ગુગનવિહાર....

રાહેશયમ શર્મા

### તડકો-૧

પરોફના ઝકળમાં તડકો  
પીગળે.  
પીગળે પીગળે પડછાયાના ઘાડ.  
ને આંસુમાં  
ડૂબતી તરતી  
તરતી ડૂબતી  
અથડાતી ધૂમરાતી આવે  
થોર તણી કંટાળી લીલી વાડ.  
વાડ પરે એક બટેર બેઢું બટેર બેઢું બટેર બેઢું  
ફષ્ટે ફષ્ટે ફષ્ટે એની પાંખ.  
દાદાની આંખોમાં વળતી ઝંખ.  
ઝંખ ઝંખ પરોફમાંથી પરોફમાંથી  
આછા આછા  
અહો મને સંભળતા પાછા અહો મને સંભળતા  
આછા  
ઠંક ઠંક ઠંક ઠંક અવાજમાં  
હું હૂલ બનીને ખૂલું  
ખૂલું  
ઝાડ બનીને ઝૂલું  
ઝૂલું

દરિયો થેને દૂબું  
 દૂબું  
 પહાડ બનીને કૂકું  
 કૂકું  
 આભ બનીને તૂઢું  
 તૂઢું તડકો થઈને  
 વેરશાંદેરણ તડકો થઈને  
 સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું.  
 મારી કર કર કોરી ધાર પીગળતી જાય.  
 પીગળે પીગળે પડછાયાના પહાડ !

### તડકો-૨

તડકાના ટુકડાઓ  
 જ્યારે  
 અસ્તવ્યસ્ત થઈ  
 આળોટે દરિયામાં  
 માછલીઓની  
 મોંઝાડોમાં  
 વાગે એની ધાર  
 થડ તડકાનું ખડબચું  
 ને માછલીઓનાં પાંદ  
 સાંજકના જૂલે છે  
 ઢગલો પંખીનાં ફળ કાચાં  
 સાચાં રે ભાઈ સાચાં.  
 તમેય સાચાં  
 અમેય સાચાં  
 તડકાના ટુકડાઓ સાચા  
 દરિયો સાચો  
 માછલીઓની મોંઝાડો પણ સાચી  
 થડ તડકાનું સાચું

એ પણ ખડબચું  
 ને માઇલીઓનાં પાંદ  
 ઢગલો પંખીનાં ફળ કાચાં  
 બધાંય સાચાં.  
 જાણો છો ?  
 આ સાચ જૂઠને સંભોગે છે ?  
 ને અંધકારની યોનિમાંથી  
 સરકે છે આ તડકો.  
 તડકો રોજ પરોઢે રોવે.  
 બોરસલીની ઝીંકોરી કૂપળમાં  
 એની આંખ ધીમેથી ખોલે.  
 ગરમ ગરમ ગાડરમાં  
 તડકો ધોળ્ણુ પીળ્ણુ થરકે.  
 તડકો ચંબેલીનાં પાન  
 તડકો જિસકોલીના કાન.  
 ચંબેલીનાં પાન બન્યા છે લાંબાં.  
 જિસકોલીના કાન બન્યા છે મોટા.  
 કેશ કરીને ઢગલો  
 આછાં વસ્ત્ર કરીને અળગાં  
 એકાન્તે વાડામાં લક્ષ્મી  
 આળસમાં નિરાંતે બેસે નહાવા.  
 તડકો એનું રોમરોમ સંભોગે.  
 તડકો જાય મરી  
 ને તડકો રોવે.  
 તડકાણું શબ જાય લઈ તડકાણું ટોળ્ણુ.  
 તડકાની એક ગાય ચરે છે.  
 તડકો કૂણો.  
 તમેય તડકો  
 અમેય તડકો

તડકાના સરવરમાં  
તડકો ઝૂલે.  
તડકો દોડે છે  
તડકો ઊંચે છે  
તડકો બોલે છે  
તડકો નાચે છે  
તડકો તડકો તડકો  
ચારેકોર.  
ઉત્તર તડકો  
દક્ષિણ તડકો  
તડકાનું આકાશ  
તડકાની આ પવનવહરીઓ  
પરશે વારંવાર.  
અમેય તડકો  
તમેય તડકો  
તડકો તડકો રે.  
નાગા થઈને નાચો  
તડકો તડકો રે.  
આધા જઈને નાચો  
તડકો તડકો રે.  
તડકાની ટેકરીઓ પરથી  
તડકો ગબડી જાય.  
તડકાની તલવાર વડે  
તડકાનું માથું કાપો  
તડકો તડકો રે.  
નાગર તડકો  
વાનર તડકો  
ગાંધીજીની ટાલ તડકો.  
તડકાનું ચંદન  
તડકાના પથ્થરને જઈ અર્યો

તડકાની છાતીને  
 ચુંથે  
 તડકાની આંગળીઓ  
 તડકાના ઘડાથી  
 તૂટે છે તડકાની પાંસળીઓ  
 તડકો તૂટેલો.  
 તડકો ફૂટેલો.  
 તડકો બં બં  
 તડકો મં મં  
 તડકો તારી બોચીનો છે મેલ.  
 તડકો પીળો રે  
 તડકો લીલો રે  
 તડકો ઉંડે રે  
 તડકો કાદે રે  
 તડકો આજે રે  
 તડકો ટીલું રે  
 તડકો બીલું રે  
 તડકો મૂંગો રે  
 તડકો ભૂંડો રે

ક્રિવિર લાભશંકર ઠકરનાં બે કાવ્યો, તડકો-૧ અને તડકો-૨ વાંચતાં, ફરીફરી વાંચતાં એમના લયતીલાનાં લાવજ્ય સાથે લેજીમદાવ પણ અનુભવાય ! વળી લયનું અનુસંધાન શી-એસોસિએશન, ઇમેજિનેશન જોડે એટબું સહજ હોય કે મુક્ત સાહચર્યાં અને કલ્યાનમય કલ્યાન વચ્ચે સાંધો શોધવો દુષ્કર લાગે. શોધી શકીએ તોપણ - સુનંદરમું એમને ગમતા છંદ પૃથ્વીનો ભંગ કરે ત્યારેય કાવ્યની આકૃતિ વિકૃત નહોતી લાગતી - એના જેવા ખેલ માણવા મળે.

લાભશંકર એક ઉન્મુક્ત બેફિકર કવિ લેખે મને, બ્રિટિશ લેખક જેરાલદ બ્રેનાનની કલ્યાન વિશેનાં મંત્વની હોળમાં બેસતા વરતાય છે :

**'Imagination means letting the birds in one's  
head out of their cages and watching them  
fly up in the air...'**

(‘Thoughts in a dry season’, 1978)

લાંઠાનું જે કાંઈ સફળ કવિકર્મ છે એનો નિર્જર્ખ પણ કંઈક આવો નીકળે. તેમની તરલસરલ સર્જકચેતનામાંથી શબ્દપંખીઓને પાંજરામાંથી બહાર કાઢી આકાશમાં ઉડાડવાનો લુલ્હે તે લૂટતા રહ્યા – છાંદસૂ, અછાંદસ્સના બહુરૂંગી સણિયાની પરવા કર્યા વગર.

‘તડકો-૧’માં પંખી ઝડપાયું છે ને –

‘વાડ પરે એક બટેર બેહું બટેર બેહું બટેર બેહું  
ફષ્ટે ફષ્ટે ફષ્ટે એની પાંખ’

ત્રણ વાર બટેર બેહું અને ફષ્ટેને ત્રણ વાર એક જ રિધમમાં પ્રયોજી કલમ અટકી નથી, ‘ફષ્ટે એની પાંખ’ સાથે પ્રાસયોજના અને કલ્યાના ઊરીને અજાધાર્યો કેમેરા એન્ગલ દર્શાવે છે તે જુઓ :

‘ફષ્ટે ફષ્ટે ફષ્ટે એની આંખ  
દાદાની આંખોમાં ગળતી ઝાંખ.’

લોન્ગ શોટ વાડ પરના બટેરને ઝડપી ‘દાદાની આંખોની ઝાંખ’નો કવોડઅપ ધારણાથી અધ્યરનો વિસમયપ્રદ નથી ?

કાવ્યારંભે પણ સૂર્યકિરણોની પરિવર્તનગતિને પ્રવાહી રૂપ અર્પ્યું છે :

‘પરોઢનાં ઝાકળમાં તડકો  
પીગળે,  
પીગળે પીગળે પડછાયાના પહાડ’

ઝાકળમાં તડકો, તે અહીં પણ ત્રણ પુનરાવર્તનોમાં (પીગળે પીગળે પીગળે) વિકસ્યો અને કવિ એક નવો જ પહાડ (હનુમાનવત્ ?) ઉપાડી લાવ્યા : ‘પડછાયાના પહાડ !’

(થોમસ માન યાદમાં અવતર્યા, ‘મોજિક માઉન્ટન’ નવલ સાથે !)

પ્રારંભમાં, ‘ઝાકળ’ ભેળો તડકો, સાથોસાથ પહાડ રચ્યો એ જ સકર્યુલર રીતથી રચનાન્ત આવ્યો :

‘સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું.’

અહીં ‘ઝાકળ’ શબ્દને વિદ્યાય... પછી સમાનાર્થ ‘શબનમ’ શબ્દ ઊતર્યો ‘શબનમસાગર’ નવસ્વરૂપે. સર્જક એના તળિયે જઈને અડકે છે ! સમય સવારનો. અહીંયે પડછાયાના પહાડ પીગળ્યા તો છે પરંતુ કર્તા પોતાને ઇન્વોલ્વ કરી, આભાસી પહાડ સાથે પીગળતા જાય છે :

‘મારી કર કર કોરી ધાર પીગળતી જાય.’

‘કર કર’ના નાદ સમેત કોરી કટ શુષ્ક, સુકી ધારને ગળતી-પીગળતી દેખાડી તીક્ષ્ણતાને પ્રવાહિત કરી છે.

મધ્યમાં, દાદાની ઝાંખ સાથે કાવ્યનાયક અવાજના એક ધ્વનિ સાથે પ્રગટ થયો છે :

‘ઠકુ ઠકુ ઠકુ ઠકુ અવાજમાં  
હું ઝૂલ બનીને ખૂલું’

પછી તો ‘જૂલું’, ‘ડૂલું’, ‘કૂદું’, ‘તૂદું’ – પ્રાસની છુક્કશુક્ક ગાડી ભાવકને સોર કરાવે છે !

તડકો-૨ કૃતિમાં, તડકો-૧નું અનુસંધાન એક આધાર તરીકે ખૂલું છે. જોઈએ, તડકો-૧ના અંતની પંક્તિઓ :

‘તુદું તડકો થઈને  
વેરણછેરણ તડકો થઈને’

હવે તડકો-૨માં, વેરણછેરણ તડકો ‘ટુકડાઓ’ રૂપે પુનઃ પ્રવેશ કરે છે :

‘તડકાના ટુકડાઓ  
જ્યારે  
અસ્તવ્યસ્ત થઈ  
આળોટે  
દરિયામાં...’

ઉમાશંકર ‘ચિન્નલિન્ન’-તાને જે વૈયક્તિક દસ્તિ કાવ્યરૂપ નિર્મિત કરે છે એનાથી વિભિન્ન ‘બિનઅંગત’ રીતે લાભશંકર નિશ્ચ લાક્ષણિકતાથી વેરણછેરણપણાને અભિવ્યક્ત કરે છે.

ઉપર્યુક્ત ‘ધાર’ તો અહીં પણ છે : ‘માછલીઓની – મોંફડોમાં વાગે એની (તડકાની) ધાર.’

‘સાચાં રે ભાઈ સાચાં  
તમેય સાચાં  
અમેય સાચાં’

‘સાચાં’ પહેલાંની પંક્તિ છે :

‘ફગલો પંખીનાં ફળ કાચાં’

કાચાં સાથે સાચાંનો પ્રાસ બેઠો ને પેઠો. એ તો ઠીક, તેમ છતાં પંખીને વૃક્ષપદે સ્થાપી ‘પંખીનાં ફળ’ દર્શાવવું સ્વાદેન્દ્રિયનો જુદો જાયકો લહેરાવે છે. કાચાં-સાચાંની માયામાંથી નીસરી ઓચિંતી તત્ત્વ-આલાપ કરતી પ્રશ્ન પંક્તિ પ્રસરી છે :

‘જાણો છો ?  
આ સાચજૂઠને સંભોગે છે ?’

ભાવક જાણતો હોય કે ના માણતો હોય; ‘તડકા’ સાથે નાયકની એકરૂપી તદ્વાપત્તા સંભોગ-

શુંગારમાં, વિશાદ ચિત્રકૃતિસમી મૂર્ત થઈ છે :

કેશ કરીને ઢગલો  
આણાં વસત્ર કરીને અળગાં  
એકાન્તે વાડામાં લક્ષ્મી  
આગસ્તમાં નિરાંતે બેસે ન્હાવા.  
તડકો એનું રોમેરોમ સંભોગો.

અગાઉ, તડકો સર્પની જેમ ‘અંધકારની યોનિમાંથી’ સરકતો દીઠો છે ! કોઈ ભાવકને સાચજૂને નહીં, કાવ્યમાંથી ગુજરતાં જૂઠ સાચને સં-ભોગતું લાગે તો લાંઠા એને પણ ‘યેસ’ કહી ચૂપ કરી શકત, કર્દાય...

ઘણીબધી પંક્તિઓ ટાંકી શકાય – જેવી કે ‘તડકો ધોળું પીળું થરકે’... ‘ચંબેલીનાં પાન’, ‘ખિસકોલીના કાન’ વળી તરત ચોલિન અદાથી ‘ખિસકોલીના કાન બન્યા છે મોટા’ જોઈ શકે લાંઠા !

મારી ગમતી પંક્તિઓ :

‘તડકાનું શબ લઈ જાય તડકાનું ટેળું  
તડકાની એક ગાય ચરે છે.’

તડકો એક વચનમાંથી બહુ રૂપે પરિવ્યાપક બની ‘તડકાનું ટેળું’ તડકાના શબને લઈને જાય અને તે જ કષાણે તત્કાલ ‘તડકાની એક ગાયને’ ચરતી ચીતરવી એ સરૂરિયલ લેખિનીના જાદુગર લાભશંકરની જ કમાલ !

‘નાગા થઈને નાચો’, લાંઠા કથી શકે. ‘તડકાનું ચંદન, તડકાના પથ્થરને જઈ અર્યો’, ‘તડકો બંબ, મંમં’, ‘તડકો તારી બોચીનો છે મેલ’, ‘તડકાની તલવાર વડે તડકાનું માથું કાપો’ (તાત્પર્ય કે આતંકવાદને આતંકવાદની રીતેભાતે ન્યાય આપો) રચનાનો ઉત્તરાર્ધ મૂળ કવિતાનું પૂરું પઠન કર્યા સિવાય પામી નહીં શકાય એટલે અ-ટકુ.

હરીન્દ્ર દેવેએ ‘સૂર્યોપનિષદ’ રચેલું ને ?

લાભશંકરે તિવસ્મી ‘તડકો’ સ્તવન રચી, પૂર્ણાહૃતિ કરી આ પંક્તિથી :

તડકો મૂંગો રે  
તડકો ભૂડો રે

એક તરફ કવિતાકોને લાંઠા સુર્યરાશિમને ભાંડવાની નિર્દ્દિષ્ટ વિદોહઘન ચેષ્ટા કરે ત્યારે મિન્ન પૌરાણિક સંસ્કૃતિ-સંદર્ભ સમા સામવેદનો એક શ્લોક પ્રસ્તુત કરવાનું મન થાય છે :


પવમાનસ્ય વિશ્વિત્ પ્ર તે સર્ગા અસૃષ્ટત |  
સુર્યસ્યેવ ન રશ્મય: ||


(હે સર્વજોથર ! પવિત્ર કરતા આપની વૈદિક ઋગ્યારૂપી ધારાઓ એવી વરસે છે – જેવાં સૂર્યનાં કિરણો..)

ઉમાશંકર-સુનદરમ્ભના, રાજેન્દ્ર-નિરંજનના યુગ બાદ લાભશંકર-સિતાંશુના રચનાકાળમાં પ્રવર્તમાન સર્જકચેતના પણ – એવી અને એટલી પ્રાંજલ, પરિષ્કૃત અને વિસંવાદી, વિશ્વપતામાંથે સૌદર્યશોધન કરતી પ્રવર્તી છે.

---

અહીં પ્રસ્તુત કાવ્યપાદિતાઓ શ્રી ચંદ્રકાન્ત શેઠના સંપાદન ‘ખખડતી ખેંચે કલિતા કોણ ?’માંથી નોંધી છે. – રા. શ..





## ૧૦. નભમાં છિદ્ર થોડું પડવું ત્યાં....

જયદેવ શુક્લ

### શ્રાવણી પૂર્ણિમા

ઘેરાયેલા સધન નભમાં છિદ્ર થોડું પડવું ત્યાં  
આકાશોથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું  
આવ્યું નીચે ફરફર અહીં બારીની બહાર જોઉં  
સામે પેલા ગડવર ઊભા વૃક્ષની ડાળીઓમાં  
ગૂંઘાતું ને ગહ્યકી ઊઠતો મોર જંપી ગયેલો !

નીલા નીલા કમલસરમાં નાહીને શું અનંગ  
ગોરું ગોરું બદન ઉતારે પૂર્ણિમાનું પ્રફુલ્લ !  
કોઢે બાંધ્યા વૃષભ પર ત્યાં પૃષ્ઠભાગે પડે છે  
જ્યોતસા મીઠી, જરીક દૂર ત્યાં ઓસરીમાં મૂકેલા  
ખાલી બેડાં મહીં છલકતી ને દીવાલે અધૂરાં  
છાયાચિત્રો મધુર રચતી ચાંદની સાવ ચોખાં.

શેરીમાં જે જલ ટ્યકતાં નેવલાં એક એક  
ટીપે ટીપે અવ ટ્યકતાં ચાંદની શેત શેત !

રસ્તે હેતાં જલ પ્રબલમાં શી નિહાળું તણાતી  
ગાત્રો ઢાળી શિથિલ, નમણી શ્રાવણી પૂર્ણિમાને !

**શ્રાવણ** વહી ગયો છે. વર્ષનો સ્પર્શ વાતાવરણથોંથી હજી ઓસર્યો નથી. એક ઢાતી સવારે, અગિયારની આસપાસ કવિ લાભશર્કર ઠાકરનો ફીન આવે છે. આરંભે જ હું કહું છું : ‘લાભશર્કરભાઈ, આજે એક હંદોબદ્ધ કૃતિની પંક્તિઓ સંભળાવવાનું મન છે.’ તરત જ ઉત્તર :

‘હા, સંભળવો.’ ‘શ્રાવણી પૂર્ણિમા’ની ત્રણોક પંક્તિનો પાઠ કરું છું :

દેરાયેલા સધન નબમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં  
આકશોથી રજતવરણું રેશમી વસ્ત્ર મૌઘું  
આખ્યું નીચે ફરફર અહીં બારીની બાર જોઉં’

દેરા, ચુંબકીય સ્વરે લાભશંકર એમની અદામાં ‘ખરું ખરું’ બોલ્યા. ને વાતનો તંતુ જોડચો : ‘જ્યદેવ, અમે એમ.એ.ના વિદ્યાર્થીઓ નહીંદિનારે પ્રવાસે ગયા હતા. ગુરુજી (ઉમાશંકર જોશી) પણ સાથે હતા. અવકાશ મળતાં તેમણે પૂછ્યું એટલે તાજી કૃતિ ‘શ્રાવણી પૂર્ણિમા’નું મેં પઠન કર્યું. ગુરુજીએ રજી થઈને તે ‘સંસ્કૃતિ’ માટે માગી હતી.... તમારી જેમ મને પણ આ આ કાચ્ય પ્રિય છે....’ વાગેરે....



વર્ષાત્ભિતુની ચાત્રી હોય. આકાશ કાળાંધેરાં વાદળોથી લચી પડ્યું હોય. હમણાં જ વર્ષા સર્વાંગે વરસી પડશે એવી આશા જાગી હોય ત્યારે, ક્યારેક એવું પણ બન્યું હોય કે થોડી પળોમાં વાદળો વિભરાય અને ચંદ્ર આપણી સામે હસી પડે ! તો, કવચિત્ એવું પણ થયું હોય કે અનન્તરાધાર વર્ષા અચાનક થંભી જાય, એ પછી તરત જ, વહેતા જળમાં ચંદ્ર જાણે પોતાનું પ્રતિબિંબ જોવા અકલ્ય રીતે પ્રગટ થયો હોય ! આવી જ કોઈ ક્ષાળનું કાવ્યાંતરણ ‘શ્રાવણી પૂર્ણિમા’ કૃતિમાં માણણી શકાય છે.

કાચ્યની ચૌદાની પંક્તિમાંના ‘રસ્તે છેતાં જલ પ્રબલમાં’ શબ્દો ધ્યાનમાં રાખી કાવ્યારંભ ફરી વાંચીએ છીએ ત્યારે સમજાય છે કે ધોધમાર વરસીને અચાનક થંભેલી વર્ષા પછી જે કાંઈ કવિએ સંવેદ્યું તે અહીં ઉઘડ્યું છે.

દેરાયેલા સધન નબમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં  
આકશોથી રજતવરણું રેશમી વસ્ત્ર મૌઘું  
આખ્યું નીચે ફરફર અહીં બારીની બાર જોઉં’

વર્ષા પછીની મેઘમહિંડત ચાત્રિના આકાશમાં સહસ્રા ‘છિદ્ર’ પડે છે. અને એ છિદ્રમાંથી રૂપેરી રેશમી વસ્ત્ર સરસરું ને ફરફરતું પૃથ્વી પર છાવતું જાય છે. દેરાં વાદળોથી ખીચોખીચી આકાશમાંનાં થોડાં વાદળો ખસતાં ચંદ્ર પ્રગટ થયો છે અને ભીની ભીની ચાંદની વરસી રહી છે એવું ન કહેતાં કવિએ જે દશ્ય-કલ્યન પ્રયોજયું છે તે આપણા કાવ્યસાહિત્યમાં કદાચ પૂર્વે પ્રયોજયું નથી. આકાશ અને પૃથ્વીને સાંકળતી આ પંક્તિએ વાંચતાં મન બાળપણમાં પહોંચી ગયું. ધાપરાનાં બે-ત્રણ નાનકુડાં કાળાંમાંથી રાતે કે દ્વિવસે ઘરના કાતરિયામાં પડતાં ચાંદરણાં સાથે વિસ્મયથી રમ્યાનું સ્મરણ તાજું થયું. સંદર્ભ જુદી હોવા છતાં ગુરુદત્તની યાદગાર હિન્મ ‘કાગજ કે ઝૂલ’ના ગીત ‘વક્ત ને કિયા ક્યા હસી સિત્તમ’ના દશ્યાંકનમાં ઓરડામાં ઉપરથી પ્રકાશનો જે ધોધ પડે છે તે અવિસ્મરણીય.

કાવ્યની પ્રથમ ત્રણ પંક્તિમાં દશ્ય કલ્યાનની સાથે જ શ્રવણ અને સ્પર્શનાં કલ્યાનો પણ પ્રગત્યાં છે. ‘રજતવરણું રેશમી વસ્ત્ર મૌઘું’ વાંચતાં જ આપણાં ટેરવાં ચાંદનીના રેશમી પોતને અડવા અધીર બને છે. આ રેશમી વસ્ત્રનું ચાંદનીનો ફરફાટ જીજા કાનનો ભાવક સાંભળી શકે છે.

આરંભની અહીં પંક્તિમાં નિરૂપાયેલા દશ્યને કાપીને કવિ દશ્યના દ્રષ્ટા – કાવ્યનાયકને ‘બારીની બાર જોઉ’ શબ્દોથી પ્રત્યક્ષ કરે છે. અને તરત જ બીજો કાપ (કટ) આવે છે. કાવ્યનાયક ભાવકને સામેના જૂના, મોટા, ઘટાદાર વૃક્ષ (ગડવર)ની ડાળીઓ, પાંદડાં પર થતી ચાંદનીની છાયા-પ્રકાશની લીલાને, રેશમી વસ્ત્ર ‘ગુંચાંનું’ જાય છે દ્વારા સંકેતે છે. આમ, અહીં વિલક્ષણ અભિવ્યક્તિનું સાતત્ય માણી શકાય છે. પ્રથમ ખાડુને અંતે કવિ આ. પ્રશાંત. વાતાવરણને મોરની કેકાથી સ-જીવ બનાવી દે છે. લાભશંકર ઠાકરનો શબ્દ પ્રયોજને કહું તો આ કેકારવ નીરવતામાં ‘કર્ષણસાયન’ બને છે. અહીં ફરી દશ્યમાં વધુ સ્પષ્ટ રૂપે શ્રાવ પરિમાળ ઉમેરાય છે.

બીજા ખાડુની શરૂઆત કમલસરના વિશેષજ્ઞ ‘નીલા’ની દ્વિરુક્તિથી થાય છે. પાણી પર ફેલાયેલાં નાનકા તરાપા જેવાં લીલાં કમળપત્રો અને વૃક્ષોની તળાવમાં પડતી છાયા ચાંદનીમાં લીલી-ભૂરી-કાળી લાગે એ સ્વાભાવિક છે. કમળતળાવમાં ચંદ (ચંદ અને આકાશ નિરવયવ છે માટે અનુંગ)ને સ્નાન કરતો જોઈ ખીલી ઉઠેલી ગૌરાંગી પૂર્ણિમા પણ સ્નાન કરવા ઉઠારે છે. આવા રંગદર્શી આલોખન પછી કાવ્યનાયક ગમાણમાં ઊભેલા બળદના પૃષ્ઠ ભાગે પડતી ચાંદનીને ભાવકપ્રત્યક્ષ કરાવે છે. એમાં દશ્યને નોખા કોણથી રજૂ કરવાની સૂઝનો પરિચય થાય છે :

‘કુઢે બાંધ્યા વૃષભ પર ત્યાં પૃષ્ઠ ભાગે પડે છે  
જ્યોતસ્ના મીઠી...’

હવે ચાંદની ગમાણમાંથી ખરીને ઓરસીમાં પડેલાં ખાતી બેડાં પર પડે છે. બેડાંમાં, બેડાં પર અને ઓરસીમાં રેલાતી ચાંદનીથી બેડાં છલકાઈ રહ્યાં છે એવું અનુભવાય છે. એ પછી ભીત પર પડતાં વૃક્ષનાં, થડનાં, ડાળીઓ, પાંદડાંનાં ‘સાવ ચોખાં’ છાયાચિત્રો બતાવીને કવિ ચાંદનીની ઘણ્ણતાનો મહિમા કરે છે.

ચાંદનીનાં બીજાં આરસાદ્ય અને રમણીય રૂપો છેલ્લી ચાર પંક્તિમાં મળે છે તે જોઈએ.

‘શેરીમાં જે જલ ટપકતાં નેવલાં એક એક  
થીએ થીએ અવ ટપકતાં ચાંદની શેત શેત !

વરસાદ વરસ્યા પછી નેવાં પરથી ધીમે ધીમે, એક પછી એક પડતાં થીપાં પર ચાંદની કિલાતાં જાણે ‘થીએ થીએ’ ચાંદની ટપકી રહી છે ! બારમી પંક્તિને અંતે ‘એક એક’, તેરમી

પંક્તિની શરૂઆતમાં ‘થીએ થીએ’ અને અંતમાં ‘ચેત ચેત’ પરોનાં આવર્તન એક પછી એક પડતાં ટીપાંને તાદુશ કરવામાં સહાયક બેન છે. આપણા કાન જો સરવા હોય તો રસ્તા પર ટપકતી ચાંદનીનાં ટીપાંને સાંભળી પણ શકીએ.

‘રસે લેતાં જલ પ્રબલમાં શી નિહાળું તશપાતી  
ગાત્રો ઢળી શિથિલ, નમજી શ્રાવણી પૂર્ણિમાને !’

છેલ્લી – ચૌદમી અને પંદરમી પંક્તિમાં રસે (અને વહેળાઓમાં) વેગે વહેતાં જળમાં શ્રાવણી પૂર્ણિમાની નમજી કાચા મસ્તીથી વહી રહી છે એવાં શૃંગારિક (ઇરોટિક) વર્ણનમાં રહેલું સજીવારોપણ માણી શકાય છે.



આ છંદોબદ્ધ કાવ્યનું પુદ્ગળ સોનેટનું હોવા છતાં પંદર પંક્તિ હોવાથી તેને સોનેટ કહી ન શકાય. અહીં ચૌદને બદલે પંદર પંક્તિ રચવાનો કોઈ અભિનિવેશ જ્ઞાતો નથી. કોઈ પજ પંક્તિ વધારાની લાગતી નથી. ‘શ્રાવણી પૂર્ણિમા’ પૂર્વે રચાયેલું ઉમાશંકર જોશીનું ‘બળતાં પાડી’ પણ પંદર પંક્તિનું છે.

‘વહી જતી પાછળ રમ્યઘોષા’નાં ઘણાં કાવ્યોમાં કવિએ વિવિધ છંદોને પ્રવાહી બનાવી (ક્યારેક તો ચાર-પાંચ પંક્તિ સુધી) પ્રયોજ્યા છે. ‘શ્રાવણી પૂર્ણિમા’ કાવ્યનો મંદાકાન્તા આરંભે તો એકી શાસે વાંચવો પડે છે. છતાં ત્રીજ પંક્તિને અંતે પાઠકને શાસ લેવાનું સ્થાન મળી રહે છે બંધું.

સમગ્ર કાવ્યની બાનીમાં ‘બદન’ શર્બદ ખૂંચે છે. પાંચમી અને ચૌદમી પંક્તિમાં આવતાં ‘શું’ અને ‘શી’નું પરંપરાગત અભિવક્તિ સાથે સંધાન થાય છે. છહી અને સાતમી પંક્તિનો અન્વય રચવામાં ઝીણી તિરાડ રહી જાય છે એવું મિત્રો સાથેની ચર્ચા પણ પણ લાગે છે.

‘વહી જતી પાછળ રમ્યઘોષા’નાં અગિયાર કાવ્યો (પૃ. પાંચ, ઓગાણીસ, એકત્રીસ, સાડત્રીસ, બેતાલીસ, પંચાવન, અહ્નાવન, સાંઠ, ઓગઝાંશેશી, ધ્યાસી, અકચાસી)માં કવિએ કાવ્યનાયકને બારીની બહાર જોતો નિરૂપ્યો છે એની નોંધ લઈએ.

કવિ લાભશંકર ઠાકરના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ની ચર્ચામાં આ તાજપભરી ફૂતિ લગભગ ઉપેક્ષિત રહી છે.



## ૧૧. માણસની વાત : નિર્ભાન્તિ-આન્તિની લીલા

રઘુવીર ચૌધરી

### માણસની વાત

બનીશ વરસથી

થરકતા

દીવાની વાટમાં જોઉં છું :

દીપકના બે દીકરા

કાજળ ને અજવાસ.

‘આ તો ચંડાળનું ધર છે’ એમ માનીને

ચંદ્ર પોતાની ચાંદની ત્યાંથી લઈ લેતો નથી.

હું કમળોને શોભા આપીશ એવી પ્રતિશા

સૂર્ય કોઈની પાસે લીધી છે ?

જો હાથી કાઢવામાં ખૂંચી ગયો હોય તો

તેને બહાર ખેંચી કાઢવાની તાકત

હાથી જ ધરાવે છે.

રાહુના મુખમાં પડ્યો હોય તોપણ

સૂર્ય કમળનાં વનોને વિકસિત કરે છે.

પણ ઉનાળાની નદીઓ

એક દેડકાને પણ ઢાંકી શકતી નથી

અને તેથી તો

સરસવનો દાણો નાનો હોય છે

અને કડવો હોય છે

ઇતાં પણ પોતાની ગોળાશ છોડતો નથી.

તેમ છતાં  
 છેદો, તપાવો, ઘસો કે ટીપો  
 પણ નહીંઓ પોતાનાં જળ પી જતી નથી.  
 અને વડવાનલ હંમેશાં સમુદ્રને બાળે છે  
 છતાં કાચબો પોતાની પીઠ પર  
 પૃથ્વીને ધારણ કરે છે.  
 પણ ધારો કે  
 સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે  
 પર્વતની ટોચ પરની શિલા પર કમલ ઊગે  
 અને કિલયોપેદ્રા દાસીના સ્તનમાં  
 સોનાની ટાંકણી ધોંચે  
 અને આપણે  
 વાસના અને બુદ્ધિ વર્ચ્યે સંઘર્ષ થાય તો  
 બુદ્ધિને સ્વીકારીએ  
 વાસનાને નહીં.  
 આખલાની ખાંધમાં  
 ઝગમગી રહેલી તલવાર  
 ધીરે ધીરે અદશ્ય થવા માંડે  
 અને આંખોમાં બુદ્ધિ ચમકવા માંડે –  
 કપાળની નીચેના ભાગમાં  
 આગળની બાજુ બે ખાડા છે તે આંખ માટે છે.  
 એ ખાડામાં  
 જીવતા માણસોનાં મીણનાં પૂતળાં બનાવતો નરરાક્ષસ  
 મેલી વિદ્યાની આસુરી પ્રવૃત્તિ ધરાવતી સુંદરીને  
 બાડી આંખથી તાકી રહ્યો છે.  
 બંનેની વર્ચ્યે છે કમ ખર્ચનાં રોલિંગ શાટરો –  
 જેની પર ખીલેલા કમળમાં  
 ભગવાન વિષ્ણુ જાગી ગયાનો ડોળ કરે છે  
 અને દીપકના બે દીકરાને  
 આંખમાં આંજુ

શાન્તાકાર બને છે.  
 ભુજગ પર શયન  
 શાન્ત આકાર  
 કમળ જેવી અંખો  
 પદ્મ જેવી નામિ  
 મેઘ જેવો રંગ  
 હું રોલિંગ શાટર છું.  
 મને છેદો, તપાવો, ધસો કે થીપો  
 પડી હું અહીં જ ઊભો રહીશા.  
 કાજળા અને અજવાસની વચ્ચે જ હું  
 રોલિંગ શાટર થઈને પડ્યો છું.  
 ક્રિલયોપેટ્રા દાસીની કમળ જેવી છાતી પર બેઠેલ  
 વિશ્વાધાર ભગવાન વિષ્ણુના કપાળમાં  
 બરાબર વર્ચે  
 કે આજુબાજુ  
 સોનાની કે લોખંડની ટાંકણી  
 ઘોંચી શકે છે  
 એ હકીકિતને ભૂલવા  
 રોલિંગ શાટર પરથી રોજ  
 પ્રેમની કળીઓ આળસ મરડે છે.  
 ઓછા ખર્ચનાં રોલિંગ શાટરો પર લાખેલું છે :  
 Specially prepared for lower standards.  
 શબ્દબ્રહ્મના ઊકળતા તેલમાં  
 મારાં બત્રીશ વર્ષ બળી ગયાં છે  
 છતાં મારો રંગ બદલાયો નથી  
 હું કમળ જેવું હસી શર્કું છું  
 ને શાન્ત રહી શર્કું છું.  
 મેં ભુજગને નાથ્યો છે એમ સ્વીકારી શર્કું છું.  
 જન્મ પછી જેણે ક્યારેય  
 આંખ ઉઘાડી નથી

એ શબ્દને

નચિકેતાની આંખોથી સતત તાક્યા કરું છું —  
પણ એને બાજુમાં હઠાવી શકતો નથી;  
અને નાટકના જન્મની વાટ જોઉં છું.

ચમત્કાર

બની જશે જીવનમાં.

બની જશે જીવન કંઈ અશુંકશું  
હિમાદ્રિ શિખરો પરે સુભગ દશ્ય દીપી ઊંડે  
સર્વેદ કલાળી જીણાં...  
મનુષ્યને ઓળખતો છતાંય હું  
ચાહી શર્કું કેમ મને ?

તને ?

અને તેમને ?

તેમને મેં જોયા છે :

શાહમૃગના ઈંડામાંથી બનાવેલા

ટેબલલોમ્પમાં

વલભીપુરનો નાશ નોતરતા,  
ખગોળભૂગોળની રસમય વાતો કરતા,  
પુરુષાર્થની પતાકા ફરકાવતા,  
હાંડલું તૂટવાની રાહ જોતા,  
સત્તાનો ત્રિકોણ રચતા,  
શોકજનક અવસાન ઊજવતા,  
કાયદેસર ગર્ભપાતનો વિરોધ કરતા,  
સમૂહસનાન કરતા,  
દશેરાની શાનદાર ઊજવણી કરતા,  
૫૪ ખાણિયાઓની ધરપકડ કરતા,  
ફક્ત ચાર મહિનામાં રેઠિયો એન્જિનિયર બનતા,  
રાતોરાત  
ગોળના ભાવ વધારનારા રેપારીઓને  
પ્રશ્નો પૂછીતા,

રાજકારણની ભીતરમાં  
 સાપ્તાહિક દસ્તિ કરતા,  
 સમૃતિનાં ખંડેરોથી ગભરાઈ જતા,  
 બાળકોની વર્તણૂકથી મુંગાઈ જતા,  
 મિસરની વિલાસી મહારાણી  
 ક્રિલયોપેટ્રાની કથા પરથી  
 સજ્યેવા ભવ્ય ચિત્રને જોવા  
 ૧૨૦ માઈલ લાંબી ક્ષ્યૂમાં છેક છેલ્યે ઉભેલા  
 અને ૨૦ કરોડ રૂપિયા ખર્ચી નાખવા તૈયાર થયેલા  
 તેમને  
 ગઈકાલે  
 ‘આપના દાંત અને પેઢાંની સંભાળ’ વિશેની  
 મફત રંગીન પુસ્તિકા માટે  
 ટૂથપેસ્ટ ખરીદતા  
 મેં જોયા છે, હંમેશાં,  
 તેમને  
 તેમની આંખોમાં,  
 તેમનાં મોટાં માથાંમાં,  
 તેમની ઐતિહાસિક ભૂલોમાં,  
 તેમના સોનેરી લેબલમાં,  
 ઘઠટલ ક્રિલયરના સોલિસ્ટરનાં સર્ટિફિકેટોમાં,  
 અભિનેત્રી પરના બળાત્કરમાં,  
 મેઠન રોડ પરના ફ્લેટમાં,  
 બળીચાના ફુવારા પાસે,  
 મંદિરની મરમતમાં,  
 તીખી સડકના ઓગળતા સપનામાં,  
 ટિંક્યરની ૨૫ બાટલીઓ કબજે કરવામાં  
 મોરારજીભાઈની સભામાં ઉમદા ધુમ્રપાન કરતા  
 તેમને  
 જેણે જોયા છે

તे

નવી દિલહીના રેલવે સ્ટેશને

ટિકિટબારી પર

સો રૂપિયાની બનાવટી નોટ રજૂ કરવાના

આરોપસર

પકડાયો નથી

કે ઘરમાં

ઘડિયાળ કપડાં અને ફાઉન્ટન પેનની ચોરી કરનાર ચોરને

એણે પકડાયો નથી

પણ જાતને પૂછ્યું છે :

ઘડિયાળ વગરના બાજુના રૂમમાં ઊગી નીકળતા

નસકોરાના ઝડને

ચાદરમાં લપેટી શકીશ ખરો ?

કપડાં વગરની પઢીતોને વળતા

પરસેવાને

લૂધી શકીશ ખરો ?

અને ફાઉન્ટનપેન વગરની

તારી પીઠની બરાબર વચ્ચે

સ્ટીલના પોઠન્ટ જેટલી

ખૂજલીના

ઊઠળતા અભિયમાં તરી શકીશ ખરો ?

મારા દીવાલો વગરના ઘરનાં બારણાં ખખડાવતા

ચોરને

હું મારી સાથે

સ્વખની તિરોડોમાં

નાટક જોવા જેંચી શકીશ.

મારી આંખો વગરની પાંપણોની સંદૂક ખોલતા

ચોરની પીઠને હું

મારા અવાજના રેશમથી લપેટી શકીશ.

મારી ફર્શ પર અહીંતહીં પડેલાં

ભૂરી ઊંઘનાં ભીનાં પગલાંને  
 હું ચોરપગલે લૂછી શકીશા.  
 તો પછી દરવાજા તાળાં ફૂંચી કૂતરાં કમાડ શા માટે ?  
 આગળ પાછળ શા માટે ?  
 નજીક આધા શા માટે ?  
 ઉપર નીચે શા માટે ?  
 કાગ કોયલ શા માટે ?  
 ડાઘ દરિયો શા માટે ?  
 વાત તમારી ચાચી છે  
 આ પીઠ પવનની પડણાયામાં હલતી  
 તે પણ શા માટે ?  
 બીજ પછીથી નીજ  
 અને આ આવ અગર તો જાવ  
 તમારા કામકોધના ભાવ બધુંચે શા માટે ?  
 અરે ભઈ  
 ચા માટે  
 કડક મહેની ચા માટે.  
 મને ગમે આ ચા  
 અમારી બા  
 સપનામાં આવીને પાતી  
 ચા ચા ચા.  
 ચોર પીશો ચા  
 ચોર ભલે આવે અંધારે  
 અમે કરીશું દીવો  
 સપનાના ધાગામાં રૂબે  
 મનમોહન મરજીવો.  
 અમે અમારી આંખોમાં  
 આ જુઓ મૂકી છે સીડી  
 ચોરપગલે આવો હરિવર  
 બબડે બાક્સ-બીડી.

બીડી શા માટે ?  
 બાક્સ શા માટે ?  
 ચોર બનીને પૂછો છો તો  
 ચોર બનીને કહેશું  
 ચોરી શા માટે ?  
 સૂરજ શા માટે ?  
 જેતર શા માટે ?  
 ભીતર શા માટે ?  
 સવાલ શા માટે ?  
 જવાબ શા માટે ?  
 ઊઠળતા અભિયમાં ઘડિયાળ ડૂબે  
 રખડતી આંખમાં કપડાં ફિફડતાં  
 ચોરી કરો તે ચાલશે  
 પણ શબ્દના દર્દ્દશાની ઉપર  
 તમારો પડછાયો પડે છે  
 તે જલદી ખેસવીને  
 જે જોઈતું હોય તે લઈને ચાલતી પકડો  
 જાવ જલદી ચાલ્યા જાવ.  
 પણ એ ન ગયો.  
 એણો તો  
 ઈયળની આંખમાં સપનું જોયું.  
 અને એણો આંખ આડા કાન કર્યા.  
 એ ખડખડાટ હસ્યો નહીં  
 કે દાંત કચકચાલ્યા નહીં.  
 એણો ઈયળને ગરુડ બનીને  
 ઊડતી કલ્યી.  
 એણો સતત કલ્યના કર્યા કરી.  
 એણો ભુજગ પર બેઠેલા વિષણુનાં ચિત્રો આલેખયાં  
 અને વિષ પીતા શંકરની સુતિ કરી.  
 એણો પાણી પર પથ્થરને તરવા મૂક્યા.

અને આ બધું જ  
 એણો, આંખ વગરની ઈયળની  
 આંખમાં બેસીને કર્યા કર્યું.  
 એ ફૂલ બનીને ખીલ્યો છે  
 ને આડ બનીને ઝૂલ્યો છે.  
 એ દરિયો થૈ ઝૂબ્યો છે.  
 ને પહાડ બનીને ઝૂદ્યો છે.  
 એ આભ બનીને તૂટ્યો છે  
 ને કાચ બનીને ઝૂટ્યો છે;  
 છતાંય ખૂટ્યો નથી એનો કલ્યનાવૈભવ.  
 એક ઉજ્જડ રાનમાં તલાવડી  
 અધમણ સોનું સવામણ રૂપું  
 અમ્મર પહેરે ને ઝ્મર ઝ્મર ચાલે,  
 એ આંગણો વાવે એલચી ને ચાવે નાગરવેલ  
 કનકા કટોરામાં કેસર ઘોળો  
 ને કરે સીતાની પેદાશ.  
 એની કાચની બરણીમાં લવંગિયાં અથાડાં  
 ને કાગજ લખે કપૂરથી.  
 પાંખ વિના તે ઊડતો  
 ન પંખી ન વિમાન  
 પૂરવેગથી દોડતો  
 છતાં ન ચાલે ડગ  
 ડાળે ખીલે ઝૂલડાં  
 ને મૂળમાં લાગે ફળ.  
 આનંદમાં ઝૂબકાં ખવરાવે  
 અને રસમાં તરબોળ કરે  
 તારલાની ગાડી, હો રસિયા  
 કોણ કોણ હંકે ? હો રસિયા  
 કોણ કોણ બેસે ? હો રસિયા  
 ચકોભાઈ હંકે, હો રસિયા

ચકીવહુ બેસે, હો રહિયા.  
 તમે તો ચંપો ને મરવો રોપિયો  
 રે કુદ્ધ મરઘો ચરી ચરી જાય  
 તને મારું રે મનમરઘલા  
 પણ આડા આવે છે  
 કાજળ ને અજવાસ  
 વર્ષેનાં કમખર્ચના રોલિંગ શાટરો  
 હું હઠાતી શકતો નથી  
 ને પટાવી શકતો નથી મારા પ્રાણને.  
 ને છતાં  
 બંધ આંખવાળાથી વિશેષ જોઈ શકતો નથી.  
 પગ વગરનાથી વિશેષ ચાલી શકતો નથી.  
 મન વગરનાથી વિશેષ મહાલી શકતો નથી.  
 કેમ કે  
 સ્વાર્થ માનવીના હદ્યસિંહાસન પર  
 નર્તન કરતો હતો ત્યારે યુનોનો જન્મ થયો,  
 કેમ કે સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અક્ષમાતમાંથી ઊગરી શકી,  
 કેમ કે ખાડિયામાં દારૂની ભક્ષી પકડાઈ,  
 કેમ કે મહુવામાં ગોળીબાર થયો..  
 સુપના ! તું સુલતાન છે  
 ઉત્તમ તેરી જાત,  
 ઈરણા રાણી ચક્કચક્તી અથડાતી આવે  
 સુપનામાં —  
 ઈરણાબારી કચકચતી અથડાતી ફૂટે  
 સુપનામાં —  
 ફોગટ પાણી ભરવા નીકળ્યા  
 રણવગડાની વેળુમાં પડછાયા  
 કાળા મેઘના રે  
 હેજ પલકાતી પાંપણમાં ઈરણા રડી પડવાં.  
 રડી પડવાં રે

કાજળ ફળી પડચાં રે  
 કોરી પાંપણને પડછાયે ઈરણા રડી પડચાં.  
 પણ ઓ ઈરણા આંખ ઉઘાડો  
 જ્ઞાનવિવેકની વીજળી પેદા કરવા માટે  
 શક્તિનો પ્રચંડ ધોધ નાથવાનો છે,  
 મુંબઈમાં અઢી લાખનું સોનું પકડાવાનું છે,  
 શ્રમજીવી વર્ગને અનાજની પ્રાયોરિટી આપવાની છે,  
 વૃદ્ધોની જિંદગી ટકાઉ બનાવવાની છે,  
 દ્રેન નીચે આવી જતા  
 ડાકોર સ્ટેશન પર  
 મૃત્યુ પામેલા સાધુને જિવાડવાનો છે,  
 મેલી વિદ્યા શીખવા પુનીનું માથું કાપવાનું છે,  
 ઉત્તમ તમાકુમાંથી બનાવેલી  
 કુશળ કારીગરોના હસ્તે તૈયાર થયેલી  
 કડક ભીડી  
 અને લહેજતદાર બીડી પીવાની છે,  
 કેમ કે  
 બધી જ વસ્તુઓ પ્રગતિ કરે છે.  
 આગળ જાય છે  
 તે સ્થિર થોભી રહેતી નથી  
 પાછળ જોવા રોકાતી નથી  
 કોઈ જ શક્તિ તેમને પાછળ રાખી શકે નહીં  
 તે આગળ, આગળ ને આગળ વધે છે.  
 મને બબર છે કે  
 જીવનનાટકનો એક દિવસ પડદો પડવાનો છે  
 અને આ ધરતીનું દર્શન બંધ થવાનું છે  
 અને છતાં  
 નીલ નિરભુ આકાશમાં  
 રજનીને નિહાળવા  
 તારા જેમ આવતા હતા તેમ આવ્યા કરશે.

જાણું છું કે  
ચંગી શકે પર્વતની પીઠોમાં  
પ્રલંબતાનો દરિયો  
કમાડ, ખુલ્લાં હશે તે થઈ જાય બંધ,  
ને બંધને  
વાસી શકાય બહારથી..

ઘડિયાળની ચરબી મહીં  
ખંજર હુલાવી ભાગરો,  
મારો જ કોઈ મિત્ર  
ને  
આ  
રોજ ગાડીના અવાજો આવતા.  
ઉંઘમાં ઉડે ઉડે સુપના મહીં  
કોઈ ગાડી છુક છુકા છુક આવતી  
સ્ટેશને ઊભી રહેતી,  
ચાલતી.  
દૂર લીલી ટેકરી પાસે  
વળાંકે  
છુક છુકા છુક જાય,  
વળતી વાંકમાં.  
રોજ ગાડીના અવાજો આવતા.  
રોજ ખરતી કંકરી  
મોટી છબિ ઝાંખી થતી દીવાલ પર,  
દીવાલ પર  
બા-બાપુજી-પત્ની અને ત્રણ બાળકોની  
સાથે પડાતેલી છબિ ઝાંખી થતી  
ખીલા પરે મજબૂત સાંકળથી  
ખુદ બાપુજીએ ફીટ બાંધી છે દીધી,  
વર્ષો થયાં પડતી નથી દીવાલ

પણ

ઇત ખરે છે રોજ

એના છિદમાંથી ગોળ ચાંદરડાં

ગ

રૈ

ની

ચે

અને એ હલબલ્યાં કરતાં બપોરે ઊંઘમાં

ને, ગાડી નદીના પુલને ઓળંગતી

છુક છુક છુક જાય છે ચાલી.

હું ભીતને ટેકે ઊભો રહું

ભીત :

મારી વૃત્તિઓ

આ વૃક્ષ

પથર

ટેકરી

પાણી

હવામાં ઊડતાં પંખી

ટગરનાં ફૂલ

બતી

કાચબાની પીઠ જેવી સાંજ

મારી ભીત

મારી ભીતને આંખો નથી

ને આંખમાં ઊભી રહી છે ભીત

મારી ચામડી થીજી ગયેલી ભીત છે.

જે મને દેખાય તે પણ ભીત છે

મારું નામ-ગામ — તમામ

મારું - તમારું - તેમનું જે કંઈ બધું તે ભીત

આ બધાં તે ભીતનાં દશ્યો

આ બધાં તે ભીતનાં

ગુણો  
 કર્મો  
 સંખ્યા  
 વિશેષજ્ઞ  
 નામ  
 અવ્યય  
 અ અને વ્યયને વિશે અવકાશ તે પણ ભીંત  
 ભીંતનું ચણતર ચણો તે હાથ મારા ભીંત.  
 તારતમ્યોનાં કબૂતર  
 ભીંત પર બેસી કરે છે પ્રેમ તે જોયા કરું છું.  
 ભીંતને પણ પાંખ, જે ફષ્ટે કદાચિત.  
 તારતમ્યોની વચ્ચે  
 ફષ્ટે પાંખની વચ્ચે  
 પ્રાણયનું એક તે ઠેંડું  
 હજુ સેવી શકાયું ના  
 અને આ વાંઝાઈ ભીંતો  
 સુપનામાં સ્તન્યપાન કરાવતી  
 કોને ?  
 હરાયાં ઢોર જેવી દોડતી ભીંતો  
 હજુ શોધી રહી કોને ?  
 હરાયાં ઢોર જેવી દોડતી ભીંતો  
 હજુ અટકી નથી  
 અટક્યું નથી મારી નજરનું આ નદીપૂર  
 મારી નજરનું આંધળુંભીંત આ નદીપૂર  
 દોડતું અટક્યું નથી;  
 તો હવે  
 જે કંઈ નદીનું નામ  
 તે ચંચળ છતાં  
 અસ્થિર છતાં  
 દોડચે જતા ઉંડાણમાં તો

ઊંઘમાં પથર સમું ઊભું રહ્યું છે.  
 ને ચરબીની ભીતોમાં  
 જીણું જીણું સળગતી નજરોથી  
 હું તાકયા કરું છું.  
 મારી જીણી આંખોના પહોળા પ્રકાશમાં  
 રજળતા શબ્દોને  
 મારી ચરબીની ચીકાશમાં ભીજવીને  
 પેટાવવાનું કામ મને કોણે સોંઘું છે ?  
 ધૂળના ઢગલા મેં કર્યા હતા તે ભૂસી નાખવા.  
 સવારે આંખ ઉઘાડી હતી તે ચાત્રે મીંચી દેવા.  
 ઊંચાંનીચાં મકાનોની  
 વાંકીચૂંકી શેરીઓમાં  
 ગાયબકરીની સાથે અથડાતા  
 ને પછિડાતા  
 એ પડધાયાને હું યાદ કરું છું  
 ઊઘડતી સવારોને હું સાદ કરું છું  
 પણ ચરબીની દીવાલોમાં  
 જીણું જીણું સળગતી  
 નજરોના પહોળા પ્રકાશમાં  
 બધું બેસૂધ અને બહેરું જણાય છે.  
 પવન તો વાય છે,  
 શબ્દોના પડધાયા પણ હલે છે  
 ઊંઘણસી દીવાલોનાં નસકોરાંનો અવાજ પણ  
 સંભળાય છે  
 પણ જાણે બધું  
 બેસૂધ અને બહેરું બહેરું લાગ્યા કરે છે.  
 હરણજ્ઞાણે દોડતા પગોના પડધાયા  
 બોરડીમાં ભરાવા છતાં ચિરાયા નહોતા.  
 સાપની કાંચયીમાં સરકી શકેલો વિસ્મય  
 કમળની શાયા પર આંખો બીડીને



અને કડૂચી વાસમાં સોય પરોવીને  
 શનિવારની પોચી પોચી પીઠ પર  
 ગલોટિયાં ખાઉં છું.  
 શું એ હું હતો જે કાચનો ભૂકો ખાઈ શકતો ?  
 મારી ચરબીમાં બોળી બોળીને  
 શબ્દો પેટાવું છું -  
 પણ સણગતા નથી.  
 એના ભભકતા પ્રકાશમાં  
 દીપકના બે દીકરાને હું જોઈ શકતો નથી,  
 ને રોઈ શકતો નથી બેંકડો તાણીને.  
 વાળીને મેં પ્રેમ કર્યો છે કિશોરવયથી  
 પવનમાં વ્યસ્ત બનેલા વાળને સરખા કર્યા નથી  
 ને આંખ બીડીને  
 ચામડીને સાંભળ્યા કરી છે.  
 નળની ધસમસતી ધારા નીચે  
 મારી કામનાનું ગુલાબી ફૂલ  
 ટહ્હાર બની હર્ષોન્મત બન્યું છે.  
 સફેદ બકરીની પીઠનો ધસારો  
 મારી નજરને ગાલીપચી કરતો મને ઓગાળે છે  
 ત્યાં તો  
 હસેલી આંખના ખૂણા મહીંથી  
 ફૂલ આવીને મને વાળ્યું  
 અહીં આ હંદયના મર્મસ્થલે.  
 જાણું ના હું નામ કે ઠામ કાંઈ  
 આકૃતિનું રમ્ય કો' શિલ્પ મારા  
 કોરાયું ના ચિત્તમાં  
 ને છતાંય તે  
 ભીની ભીની આવતી ગંધ  
 વીંધી અંધારાને —,  
 જવાન ગોરી ચામડી નીચે

શેસ છે ઘોર અંધારું.  
 એ અંધારાનો હું આકુલ પ્રેમી.  
 એ અંધારાને નથી આંખ  
 નથી દૃષ્ટિનાં વામજાં બંધન.  
 અ દક્ષિણાનિલ  
 સુગંધથી ભર્યો  
 આવે ધર્સી પ્રબલ વેગ મહી  
 સમસ્તને  
 ઉલ્લાસની અતુલ થાપટ એક દેતો,  
 પુષ્પ પારિજાતનાં ગર્યા કરે  
 અંધકારમાં સુગંધલહેરખી તર્યા કરે.  
 ને ઘનઘોર વ્યોમથી  
 વેણુવિમુક્ત નીરખું અતિ કૃષ્ણ દીર્ઘ  
 લંબાયમાન અહીં ભોમ સુધી.  
 પંખીનો કલ કલ સ્વર  
 પવનની મીઠી ફરજર  
 જૂલી રહ્યું નવું રે પ્રસૂન  
 કદિ પરે આલિ ગુનગુન.  
 સભર આગથી મન્મથ  
 તુર્ણાન મચવી રહે પ્રખર,  
 ઝંખના શી અરે  
 રહું જકડી બાડુમાં  
 નયન બીડતો  
 હોઠ બે  
 ચૂમું ચસચસી અહા —  
 હસેલી આંખના ખૂશા ઢો  
 પ્રાણય લળી જાય  
 મન ગળી જાય  
 આંખ ખોલું  
 દેહકળી હિંગંબર બની ખીલી ઊઠી

કેસરી શી કટિ  
 ધીરી ઉદ્ધત ગતિ  
 કદલી જેવી જંઘા  
 યોજિનો ફાળ  
 અવશ એ ફાળ  
 મારી ડાળે ડાળે સૂરજનાં ઝૂલ  
 મારી અપેક્ષાઓનો પાર નથી  
 મારી સ્થિતિ વિચિત્ર છે.  
 હૈયામાં કંઈ ઊંડું દર્દ દમે છે  
 અને દમે છે છતાં ગમે છે.  
 પ્રેમના દરે પાંખો દીધી  
 અને નિર્જવ દીવાલો પ્રેમના પૂર સામે  
 ટકી શકે શી રીતે ?  
 પ્રેમને ખાતર મોત મળે તોયે મહેદ્દિલ છે,  
 જાણશો મૃત્યુથી પ્રીતિ.  
 મેં તાજ જોયો સ્નેહનો  
 શો રહેનશાહી સાજ જોયો.  
 અરે પણ  
 હવે માત્ર યંત્રનો અવાજ  
 પ્રેમ નહીં, પુરાયો છે પ્રાણ મારો.  
 કોઈ નથી ત્રાણ  
 હવે માત્ર યંત્રનો અવાજ  
 હવે માત્ર ગતિહીન ગતિ  
 આજે માત્ર મતિ  
 માત્ર પતિ  
 રતિ હવે  
 અતીતની વાત  
 ગાત ઊંચકવાં પડે  
 અને છતાં યંત્રંત્ર  
 અવાજે છે ગતિહીન ગતિ

અવાજમાં શોધ્યા કરે  
 રતીભાર  
 રતિ.  
 હવે સપનની લીસી ધાર અડે નહીં,  
 આકાશથી ઝોરું મારા ગાલ પર પડે નહીં;  
 આમ જોકે પડે, પણ  
 અડે નહીં.  
 કબિ હોવાનો કે થવાનો કે થયાનો  
 આ સીંશ સીંશ કેદ  
 નિરક્ષર રેફ મારું મન હવે.  
 મારાં સૂજી ગયાં પોપચાંમાં  
 મરણનો ભાર  
 તે...ય મારે ઊંચકવો.  
  
 જાળની રસ્સીઓ ઘણી જ સાખત છે.  
 પણ એમને તોડવાનો પ્રયત્ન કરતાં  
 મારું હદ્ય દુઃખી થાય છે.  
 મારે મુક્તિ જોઈએ છે  
 એ જ મારી મોટામાં મોટી આકંક્ષા છે.  
 મારી પરાજ્યકથા ઘણી મોટી છે  
 જેને જેને મેં મારા નામ સાથે જોડ્યાં  
 તે બધાં અહીં અંધારા ખૂણામાં જાણે કણસી રહ્યાં છે.  
 છૂટવું છે  
 છતાં હું તો  
 હજ મારી આસપાસની દીવાલને  
 જાણે અધ્યર ને અધ્યર  
 ઊંચે ને ઊંચે  
 લેતો જ જાઉં છું.  
 જેમ જેમ એ ઊંચી થતી જાય છે,  
 તેમ તેમ એના પડણાયામાં

હું મારી જાતને ભૂલતો જાઉ છું  
 અને દીવાલ તો રાતદિવસ  
 ઊંચી વધતી જ જાય છે,  
 મારો પ્રયત્ન પણ  
 એને બંધાતી રાખવાનો ચાલુ છે.  
 અને બધા જ પ્રયત્નોના બદલામાં  
 હું મારી ખરી જાતને ભૂલી રહ્યો છું.  
 જાણે એને ભૂલવા માટે હું આ કરી રહ્યો છું.  
 ના

મારી જાતને મેં ક્યારેય ઈશ્વર માની નથી.  
 હું માનું છું : જિંદગી જીવવા જેવી છે.  
 દુઃખ, દરદ, કંગાલિયત, ઝૂરતા, મૃત્યુ  
 આ બધું છતાંયે હું આમાં માનું છું.  
 હું ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતો,  
 હું નથી માનતો માનવી આત્માની અમરતામાં.  
 ઈશ્વર આપણા સંઘર્ષમાં  
 પક્ષ લેનાર વ્યક્તિ છે,  
 અથવા તો  
 વિશ્વની પ્રક્રિયામાં  
 હસ્તક્ષેપ કરનાર દેવી જુલમગાર છે  
 એવી વૈયક્તિક ઈશ્વરની કલ્યાનાનો  
 હું અસ્વીકાર કરું છું.  
 જે મારા અંત:કરણમાં પ્રવેશી  
 પોતાના તેજથી  
 મારી સૂતેલી વાણીને જગાડે છે,  
 હાથ, પગ, કાન, ત્વચા વગેરેને  
 પોતપોતાના વિષયો ગ્રહણ કરવાની  
 શક્તિ આપે છે  
 તે અભિલશક્તિધર  
 પરમપુરુષને

હું નમસ્કાર કરતો નથી.  
 કેમ કે મારે અંતઃકરણ નથી  
 વાચા, હાથ, પગ, કાન, તવચા  
 કશા પર મારો અધિકાર નથી  
 કશું મારા વશમાં નથી  
 હું ઈશ્વરને ભજુ પણ શકતો નથી  
 તજુ પણ શકતો નથી.  
 “તમારે કોઈક પસંદગી કરવાની આવે  
 અને તમે ન કરો  
 તો તે પણ એક પસંદગી છે”  
 પણ તમારો તર્કનો પાયો જ ડગમગે છે.  
 મારે કોઈ પસંદગી કરવાની આવે  
 એમ હું માની શકતો નથી.  
 હવે હું કદાચ મને મળી શકીશ.  
 તમે કદી તમને મળ્યા છો ?  
 આ વિચિત્ર સવાલ લાગશે  
 પણ વિચારી જોતાં  
 એનો હકારમાં ઉત્તર આપવાનું મુશ્કેલ બની જશે.  
 “પ્રયોક વ્યક્તિને  
 સાચા માણસ બનવાની ઈચ્છા હોય છે.”  
 હું ખડખડ હસી પડું છું :  
 માણસ પોતાનાં પુસ્તકો કેમ ખાઈ જતો નથી  
 એની ઉધેઢને હુંમેશાં નવાઈ લાગતી હશે.  
 પણ ના મને નવાઈ લાગતી નથી.  
 માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે  
 માણસ પુસ્તકોથી ખવાઈ ગયો છે  
 માણસ ઈચ્છાઓથી ખવાઈ ગયો છે  
 માણસ ધર્મ, અમૃત, શ્વાન, ચિંતન, પ્રેમ,  
 પરાક્રમ, પરાજ્ય — આ બધાંથી ખવાઈ ગયો છે.

કેમ કે માણસ છે જ નહીં  
 જે હોય તે હોઈ શકે.  
 જે ન હોય તે ન હોઈ શકે,  
 માણસ માણસ જ છે.  
 અને તેથી તે કશું જ નથી  
 આ મારા અનુભવની વાત છે.  
 બત્તીશ વર્ષના મૌન પણી  
 આ વાત મારે સ્વીકારવી પડી છે.  
 બત્તીશ બત્તીશ વર્ષ સુધી  
 મારે હાથ છે  
 પગ છે  
 વાચા છે  
 એમ મેં માન્યા કર્યું છે.  
 પણ હવે હું બેસ્થૂધ નથી.  
 હવે હું જાણી ગયો છું.  
 કે મારે  
 હાથ હોવા છતાં હાથ નથી  
 પગ હોવા છતાં પગ નથી  
 વાચા હોવા છતાં વાચા નથી  
 હવે આજથી હું બર્ઝૂન નથી  
 હું મૂર્ખ નથી  
 શાની પણ નથી અને અશાની પણ નથી  
 હું ભલે નિર્બળ છું.  
 પણ હવે હું સક્રિય થવાનો નથી.  
 હવે મજાકનો ભોગ બનવાનો નથી.  
 કેમ કે મને કંટાળો આવતો નથી.  
 શબ્દ પાસે પણ મારી કોઈ આશા નથી.  
 કવિની શ્રદ્ધા મને રંગલો બનાવી શકશે નહીં.  
 આકાશના તારાઓ મારે ગણવા નથી  
 કેમ કે મારે આંખો નથી.

હું નિષ્ફળ ગયો છું એટલે મારે સફળ થવું નથી.  
 હું મારી બારી બંધ કરી દઉં છું  
 જોકે એ બંધ જ હતી  
 બારી જ નથી  
 તમે બહાર છો જ નહીં  
 અંદર જ છો  
 કશું બહાર નથી  
 બધું અંદર જ છે.  
 આ બધું તમે વાંચી ગયા અને મારી  
 વાત માની પણ લીધી ?  
 ન માની હોય તોપણ તમે મૂર્ખ છો !  
 કેમ કે આ બધાંને  
 માનવા સાથે સંબંધ નથી.  
 કાચબો પાઇઠીમાં તરે  
 અને તળિયેથી ઉપર સપાટી પર આવે  
 પાછો તળિયે જાય  
 ક્યારેક કંઠા પર પડ્યો રહે  
 આ બધાંને  
 માનવા સાથે સંબંધ નથી  
 અનુરોધ કે વિરોધનો પ્રશ્ન જ નથી.  
 આ તો એક ટેવનો પ્રકાર છે.  
 એથીયે વિશેષ પ્રકૃતિનો પ્રશ્ન છે  
 પ્રશ્ન એટલે સ્થિતિ  
 આ એક સ્થિતિ છે  
 સ્થિત્યન્તર એક ભ્રમ છે અથવા ઝંખના છે  
 અને એથી મૂર્ખતા છે  
 બધા જ નાટ્યકારો મૂરખા છે  
 કેમ કે તેઓ ભ્રમમાં છે  
 તેઓ આંધળા છે.  
 હસવા જેવી વાત છે :

આંધળો માણસ રૂપકો લખે !  
 તો ફરી કહું છું કે આ એક સ્થિતિ છે  
 પ્રશ્ન એનો પર્યાય છે  
 પ્રશ્ન એ સ્થિતિનો સળવળાટ નથી  
 માત્ર પર્યાય છે,  
 પર્યાય પણ નથી.  
 કેમ કે માણસનો પર્યાય માણસ છે.  
 માણસનું કોઈ ઉપમાન નથી.  
 તમે એને અનુપમ કહી શકો.  
 જોકે એને એક લાભ છે  
 મૂરખ બનવાનો.  
 એ મૂરખ બની શકે છે  
 યુગો સુધી મૂરખ બની શકે છે.  
 આ લાભ માત્ર એના જ ભાગ્યમાં છે.  
 મૂર્ખતા એ માણસનું સદ્દ્ભાગ્ય છે,  
 વ્યાવર્તકતા છે.  
 મૂર્ખતા એ બુદ્ધિનો જ અંશ છે.  
 વિચારી જોજો  
 બુદ્ધિ વગર મૂર્ખતા સંભવે નહીં.  
 અને બુદ્ધિ એ માણસનું સદ્દ્ભાગ્ય છે  
 કારણ કે એથી સમય પસાર થઈ જાય છે.  
 બુદ્ધિને કારણે તમે  
 સોલંકી યુગમાં પાંગરેલી  
 દેવાલયોની સ્થાપત્યરચનાનું મૂળ  
 શોધી શકો છો,  
 ગુજરાતનાં બંદરોએ  
 આપણી પ્રજાને  
 દરિયાઈ સફર  
 તથા દરિયાઈ વેપારની તમજા  
 અને કુનેહ બક્ષી છે એવું પ્રતિપાદન કરી શકો છો,

બુદ્ધિને કારણે જ તમે  
 લોકશાહીનાં મૂલ્યોની દસ્તિએ  
 સ્વરાજ્યનાં  
 વીસ વર્ષનું સરવૈયું કાઢવામાં  
 છ અઠવાડિયાં ગાળી શકો છો,  
 બુદ્ધિને કારણે જ તમે  
 ગુજરાતના  
 આર્થિક વિકાસની સમસ્યાઓ  
 ઉકેલી શકો છો,  
 ગુજરાતમાં  
 શિષ્ટ સંગીતના  
 ઉદ્ભબ અને વિકાસ પર પ્રકાશ ફેરી શકો છો,  
 બુદ્ધિને કારણે તમે ભાષાશાસ્ત્રમાં ડોકિયું કરી શકો છો  
 ડોક્ટર બની શકો છો  
 નોકરી કરી શકો છો  
 બસ પકડી શકો છો  
 પરદેશ જઈ શકો છો  
 છાપાં કાઢી શકો છો  
 ભાષણ કરી શકો છો  
 હરીફાઈ યોજ શકો છો  
 'બધું જ ક્ષણિક છે' એવું પ્રતિપાદન કરી શકો છો  
 બોલતા બંધ થઈ શકો છો  
 ઘાસની રોટલી કરી શકો છો  
 દુખાવાને હંડી કાઢવાનો તરિત ઉકેલ શોધી શકો છો,  
 સ્ત્રીરોગ અને પ્રસવવિદ્યા અંગેની  
 ખાસ ટિકિટો બધાર પાડી શકો છો,  
 કલાકના અઢી હજાર રૂપિયા કમાઈ શકો છો,  
 દુનિયાને ગાંડી કરી શકો છો,  
 સૌદર્યસમૃદ્ધિ માટે  
 જાડાનાં પાંડાંઓનો ઉપયોગ કરી શકો છો,

ચેપી રોગો અને ગંદકીની નાખૂંદી માટે  
 જૂબેશ ચલાવી શકો છો,  
 સીધો બિહાર પહોંચતો પેંકિંગનો રસ્તો શોધી શકો છો,  
 હેઠી મિલરની મુલાકાત લઈ શકો છો,  
 ૫૧ વર્ષ સુધી માનવહિતપરાયણ  
 ચિંતનમળન અને અમૃત્ય એવું જીવન ગાળી શકો છો,  
 બુદ્ધિને કારણે સ્ત્રીઓ પંડિત થઈ શકે છે  
 રસ્તા થઈ શકે છે  
 કુટુંબપોષક થઈ શકે છે,  
 બુદ્ધિને કારણે જ  
 અવિદ્યાનો પુરસ્કાર કે તિરસ્કાર કરી શકો છો.  
 સાચે જ માણસ ભાગ્યવાન પ્રાણી છે.  
 હું હતાશ થવા કરતાં  
 મૂરખ થવાનું પસંદ કરું  
 પણ એ મારા હાથની વાત નથી  
 કશું જ મારા હાથમાં નથી  
 મારા હાથ પણ મારા હાથની વાત નથી.  
 હું સાકરની મીઠાશ ગુમાવી બેઠો છું.  
 વસંતત્રણતુમાં વિદ્ધિ થઈ શકતો નથી  
 ખાટી કેરીની કંચુબર મને ભાવતી હતી,  
 પણ હવે —  
 અને છતાં હું ખાઉં છું  
 ઘરમાં, હોટલોમાં  
 મહેમાન બનીને મિજબાનીઓમાં હું ખાઉં છું —  
 હું જાણું છું કે હું ખવાઈ ગયો છું  
 અને છતાંએ હું ખાઉં છું.  
 ખવાઈ ગયેલો માણસ ખાઈ શકતો નથી  
 હાથ વગરનો માણસ લખી શકતો નથી  
 અને છતાં હું લખું છું.  
 આંખ વગરનો હોવા છતાં

રંગીન પુસ્તકો છિપાવું છું  
 એક ટેવ છે આ,  
 માણસની આ ટેવ છે.  
 મૂર્ખ મરી ગયેલા દુર્ભાગી માણસની આ ટેવ છે,  
 માત્ર ટેવ છે.  
 ઊંઘમાં પણ એ લખતો જ હોય છે.  
 અભિમાનથી નથી કહેતો  
 અભિમાન માણસને હોઈ શકે નહીં  
 અભિમાન વંદને કે કાબરને હોય  
 માણસને અભિમાન શેનું ?  
 માણસ મૂરખ હોય કે દુર્ભાગી હોય -  
 પણ ના  
 માણસ દુર્ભાગી નથી  
 માણસ સદ્ગ્રાહી છે.  
 માણસ મૂરખ જ હોઈ શકે.  
 હું હજુ માણસ જ છું  
 કેમ કે દુઃખ એ જ સત્ય છે.  
 સુખ તો માયા છે  
 એનું દુઃખ તો પરમ ધન છે.  
 આ મારી વાત છે  
 બુદ્ધિશાળી માણસની વાત છે  
 માણસની વાત છે  
 મૂર્ખ રહેવા સર્જયેલા માણસની વાત છે.

સપ્ટેમ્બર, ૧૯૬૭

‘માણસની વાત’ વિશે મેં અગાઉ લખ્યું છે તે જોયા વિના આજે જીશવટથી વાંચીને પ્રતિભાવ નોંધવા પ્રયત્ન કરી રહ્યો છું. એ પહેલાં કહી દઉં કે લાભશંકરની કવિતાની લયસિદ્ધિ છેલ્લા પાંચ દાયકામાં સતત અનુભવી છે. આ પણ કવિપ્રતિભાનું એક મહત્ત્વનું લક્ષણ છે.

‘માણસની વાત’માં લયની ઋતુઓ બદલાય છે, જે આનંદદાયી છે પણ અર્થના તારતમ્યનું શું ? ‘તારતમ્ય’ શબ્દ લખતાં કવિની પંક્તિ યાદ આવી :

‘તારતમ્યોનાં કબૂતર  
ભીત પર બેસી કરે છે પ્રેમ તે જોયા કરું છું.’ (પૃ. ૧૭)

સેવી ન શક્યાલું પ્રાણ્યનું દુંડું અને વાંઝણી ભીંતોના શબ્દ-સંયોજનથી હરાયાં ઢોર જેમ ભીંતોના દોડવાની કિયા લંબાય છે. ‘અટકતું નથી મારી નજરનું આ નદીપૂર !’ ભીંતનું નદી બનવું, અને વળી ચરબીની દીવાલોનું પ્રત્યક્ષ થવું.

‘પવન તો વાય છે,  
શબ્દોના પડછાયા પણ હલે છે  
ઉંઘણશી દીવાલોનાં નસકોરાંનો અવાજ પણ  
સંભળ્યા છે.  
પણ જાણો બધું  
બેસૂધ અને બહેરું બહેરું લાગ્યા કરે છે.’ (પૃ. ૧૮)

કાવ્ય શરૂ થયું દલપતરામ સુદી આવેલી ‘દીપકના બે દીકરા કાજળા ને અજવાસ’ સૂચવતી અર્થ-પરંપરાથી. કવિ જગતને ચેત-શયામના વિભાજનમાં નથી જોવાના એ તો લાંઠાંનો ભાવક અગાઉથી જાણે છે. અપેક્ષા જાગે છે બુદ્ધિ અને વાસના વિશે કવિના સંકેતની. પણ એ તો ભાવક સામે કલ્યાનો મૂકી હે છે :

‘કિલયોપેટ્રા દાસીના સ્તનમાં  
સોનાની ટંકણી ઘોંચે  
અને આપણે  
વાસના અને બુદ્ધિ વર્ચ્યે સંઘર્ષ થાય તો  
બુદ્ધિને સ્વીકારીએ  
વાસનાને નહીં.  
આખલાની ખાંધમાં  
ઝગમગી રહેલી તલવાર  
ધીરે ધીરે અદશ્ય થવા માંડે  
અને અંખોમાં બુદ્ધિ ચમકવા માંડે –’ (પૃ. ૪)

સ્વતંત્ર કલ્યાન તરીકે ‘આખલાની ખાંધમાં (કાંધમાં) ઝગમગી રહેલી તલવાર ધીરે ધીરે અદશ્ય થવા માંડે’ સ્મૃતિમાં છિપાઈ જાય. બલ્કે ભાવકની સંવેદના પર પ્રખાર કરે. પણ દાસીના સ્તનમાં સોનાની ટંકણી ઘાંચતી કિલયોપેટ્રાની વાસનાને આખલાની કાંધમાં ઉતારેલી તલવાર સાથે ફૂરતાનો સંબંધ છે – એ પણ વાસના છે એમ તારવી શકાય, પરંતુ અહીં સામ્ય કિયાનું છે. વાસના અને બુદ્ધિના દ્વંદ્વ વિશે ભાવકની અભિજ્ઞા વધતી નથી.

શ્રી રાધેશ્યામ શાર્માએ લખેલું : ‘શબ્દબ્રહ્મમાં જ બ્રમ વરતાઈ ચૂક્યો પછી શબ્દોની

ચરબીવાળી કવિતાનું લેખન લેશ પણ આગળ કયાંથી ચાલી શકે ? આ કૃતિમાં પણ શર્દેહમેદના થર જોવા મળે છે. ‘સંક્રાંતિની પીઠનો ઘસારો મારી નજરને ગલીપણી કરતાં મને ઓગળે છે’ એ બોદ્ધલેરિયન પંક્તિ પછી આશરે અંશી જેટલી લીટીઓ, મારું ચાલે તો કાપી નાખું. ‘વાસના’ની પુનરુક્તિ અને મન્મથના તુર્ણાની તોખારેને આટલી લીટીઓની ભોમ મળે તે ખૂંચે છે. જોકે ‘દેહકળી દિગંબર’વાળી પંક્તિઓ આકર્ષક છે.’ (પૃ.૪૩)

ઉપર્યુક્ત અંશી જેટલી લીટીઓમાં મુખ્યત્વે સંભોગનું એકપક્ષી વર્ણિં છે પણ સ્થૂલ નથી. ‘દેહકળી દિગંબર’ જેવાં કલ્યાણ બીજાં પણ છે. ‘જ્ઞાનશો મૃત્યુથી પ્રીતિ’ ઉમાશંકરનું સમરણ કરાવે, બાણ ભંડ સંદર્ભે, પણ સરવાળે શર્માજીની વાત સાચી લાગે. જે માણસની વાત છે એ અહીં બિનંગત મટી અંગત દેહલીલામાં રમમાણ લાગે. આ દીર્ઘ કાલ્યાણી રચનારીતિ ઉદ્ગાર પ્રધાન છે. વિધાન-સ્ટેટમેન્ટ થતાં જાય છે અને સમાજ-સંસ્કૃતિનાં સ્વીકૃત ગૃહીતો વિશે પ્રશ્ન કરી કવિ નિર્ભાન્ત થવા સૂચ્યે છે – ઘણાખરા અવલોકનકારોએ આ રચનાને નિર્ભાન્ત થવાની પ્રક્રિયારૂપે જોઈ છે.

શ્રી રાધેશયામ શર્માંએ આ રચનાનું મૂલ્યાંકન કરતાં જે ચાર લક્ષ્ણ તારબ્યાં છે એમાં ત્રીજા સાથે ઉમેર્યું છે : પ્રવર્ત્તમાન આસ્થામાં જ અશ્રદ્ધા અને એટલે વિસંગતિસભર લીલાઓ પરત્વેનો અધિક અનુરોગ પણ જોવા મળે છે.’

શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છે :

“લાભશંકર ઢાકુર કૃત ‘માણસની વાત’ (૧૯૬૭) એ દીર્ઘ કૃતિ રચણની પેઠે બિન-અંગત નથી, અંગત છીતાં સૌ કોઈની છે, રચણની પેઠે કેવળ કલ્યાણ દ્વારા પ્રસ્તુત થતી નથી, સીધા કથનનો આધાર દે છે. અને છીતાં ચિત્રાત્મકતા સાધ્ય વગર રહેતી નથી પણ મારે મન એનું મુખ્ય આકર્ષણ એનો લય છે.

‘બનીસ વરસથી

થરકતી દીવાની વાટમાં જોઉં છું;

દીપકના બે દીકરા

કાજળ ને અજવાસ.’

ત્રીજ ને ચોથી લીટી તો દોહરાની પંક્તિ બને છે. કવિ આગળ જતાં છંદોના ટુકડા, જોડકણાં, લોકગીત આદિના લય પણ લીલયા કૃતિમાં વણી લેતા ચાલે છે, અપદ્યાગદ્યાના અણસારા આવ્યા કરે છે, પણ સમગ્ર લયમાં નહાનાલાલીય નહીં પણ ચોખી લાભશંકરીય મુદ્રા ઉઠે છે, જે પકડવી એ આ કાલ્યાણ આસ્વાદ માટે આવશ્યક છે. (શર્દેહની શક્તિ પૃ. ૧૪૨)

મારી પાસે કલકત્તાથી મળેલો ઉમાશંકરભાઈનો ફોટોગ્રાફ હતો, એમના હથમાં ‘વહી

જતી પાછળ રમ્યઘોષા' છે અને એમના ચહેરા પર ખીલતી પ્રસન્નતા છે. ઉમાશંકરભાઈએ 'માણસની વાત'ને આસ્વાદ્ય રચના કહી છે, પણ એમની સાથે ચર્ચા કરવાની તક મળી હોત તો 'નિભાન્તિ' વિશે શક્ય સ્પષ્ટતા થાય. લાંઠાં પોતે બાન્તિ વિશે સ્પષ્ટ થવા જંબે છે ખરા ? કંઈ પણ તારવવું આ કવિતામાં રહેલી લયાત્મક સર્જકતાને અન્યાય કરવા જેવું છે છતાં 'કમ ખર્ચનાં રોલિંગ શાટરો પર ખીલેલા કમળમાં ભગવાન વિષ્ણુ જાગી ગયાનો ડોળ કરે છે અને દીપકના દીકરાને આંખમાં આંજુ શાન્તપાકાર બને છે.' પછી કાવ્યનાયક પોતાને રોલિંગ શાટર કહે છે. લાંઠાંની રચનારીતિથી અનિભિજ ભાવક આટલું જોડી શકે પણ પછી :

'કિલયોપેટ્રા દાસીની કમળ જેવી છાતી પર બેઠેલ  
વિશ્વાધાર ભગવાન વિષ્ણુના કૃપાળમાં  
બરાબર વચ્ચે  
કે આજુઆજુ  
સૌનાની કે લોખંડની ટાંકણી  
ઘોંચી શકે છે.  
એ હકીકતને ભૂલવા  
રોલિંગ શાટર પરથી રોજ  
એમની કળીઓ આળસ મરડે છે.' (પૃ. ૫)

ભારતીય પુરાકલ્પન ભગવાન વિષ્ણુ અને ઐતિહાસિક છતાં દંતકથા રૂપ રાણી કિલયોપેટ્રા, અને વળી એનીય દાસીની છાતી - આ સંયોજન સહદ્ય ભાવકને સૌંદર્યનુભૂતિ કરાવશે કે મૂંજવશે ? કાવ્યશાસ્ત્રની પરિભાષામાં આ રસવિધન કહેવાય કે કેમ એની ચર્ચા અજિત ધકીર કે વિજય પંડ્યાએ કરવી જોઈએ. કવિશ્રી સિતાંશુ યશશંદ્ર પુરાકલ્પનનો વિનિયોગ કરે છે ત્યારે સંહિંધતાનો આશ્રય લેતા નથી, સંકુલતા આવકાર્ય છે.

શાઢને નચિકેતાની આંખથી તાક્યા કરવાની કિયા તો વિધાયક છે. નચિકેતા સ્પષ્ટ છે પોતાના પ્રશ્ન વિશે, તો એને આ બાન્તિની પ્રક્રિયામાં કેમ સામેલ કર્યો ? 'તળેઉપર' એ લાંઠાંનો પ્રિય શબ્દપ્રયોગ હતો. કિલયોપેટ્રા પછી નચિકેતા આવે એમાં કાલવ્યુલ્મ જોવાની એ છૂટ નથી આપતા.

'મનુષ્યને ઓળખતો છતાંય હું  
ચાહી શર્કુ કેમ મને ?  
તને  
અને રેમને ?'

હવે પછી તે તે મનુષ્યોની સૂચિ મુકાય છે. સાદાં વિદ્યાનો ભેગાં સામાન્ય ભાવકને

ચોકાવનારાં વિધાનો આવે છે : ‘કાયદેસર ગર્ભપાતનો વિરોધ કરતા’, ‘અભિનેત્રી પરના બળાત્કારમાં’, ‘મોરારજુભાઈની સાથમાં ઉમદા ધૂમ્રપાન કરતા,’ પછી માણસો ભેગી દીવાલ ભજે છે : રસ પડે એવું કલ્પન રચાય છે :

‘ઘડિયાળ વગરના બાજુના રૂમમાં ઊગી નીકળતા  
નસકોરના ઝડને  
ચાદરમાં લપેટી શકીશ ખરો ?  
કપડાં વગરની પછીતને વળતા  
પરસેવાને  
લૂછી શકીશ ખરો ?’ (પૃ. ૮)

કર્તા ‘હું’ હોય કે ‘તું’ – અહીં ફેર પડતો નથી. પછી લાંઠાંનો પક્ષપાત ધરાવતો શબ્દ આવે છે : ‘ભૂજલી’, ‘સ્વભની તિરાડ’, ‘ભૂરી ઊંઘનાં ભીનાં પગવાંને હું ચોરપગલે લૂછી શકીશ, તો પછી ફૂટરાં કમાડ શા માટે ?’ એક નવી ટેક મળી ગઈ : શા માટે ? આ પ્રાસની મદદથી ‘શા માટે’ સુધી પહોંચી જવાયું. લાંઠાંની આ લીલાની અડફેટમાં કેટલાક કવિમિત્રો આવી ગયા. કવિતામાં એક પ્રાસયુગ સર્જયો અને શમી ગયો.

‘ઓઝે ઈયળને ગરૂડ બનીને  
ઉડતી કલ્પી’ (પૃ. ૧૧)

આવાં સરૂરિયલ કલ્પનો પણ આવતાં રહે છે.

‘અધમજ સોનું સવામજ રૂપું’ – લાંઠાં સારું ગતા હતા, તો લોકગીત પણ યાદ આવી જાય. બાળવાર્તા પણ : ‘ચકોભાઈ હંડે, હો રસિયા, ચકી વહુ બેસે હો રસિયા.’

લાંઠાંને કેટકેટલાં પ્રત્યે પ્રેમ છે ! કિલયોપેટ્રા છે તો ચકીવહુ પણ છે. એ જ રીતે મૃત સાધુ, મેલી વિદ્યાને લગતી અખબારી વાસ્તવિકતા પણ ઉમેરાય છે. ‘ધત ખરે છે રોજ એના છિદ્રમાંથી ગોળ ચાંદરડાં ગરે’ – સરખાવો રમ્ય ધોખાનું પેલું ચાંદરણું ! ‘કાચબાની પીઠ જેવી સાંજ’, ‘મારી ચામડી થીજ ગયેલી ભીત છે.’ લાંઠાંની સર્જકતા નવાં સાંદર્શય રચવાની ક્ષમતા ધરાવે છે.

‘શું ઓ હું હતો જે કાચનો ભૂકો ખાઈ શકતો ?  
મારી ચરબીમાં બોળીબોળીને  
શબ્દો પેટાવું છું –  
પણ સળગતા નથી.  
એના ભબકતા પ્રકાશમાં  
દીપકાના બે દીકરાને હું જોઈ શકતો નથી.’ (પૃ. ૨૦)

શબ્દની શક્તિનો, કવિની સાધના અને શ્રદ્ધાનો આ કાવ્યનાયક સ્વીકાર કરતો નથી,

પોતાને ‘સો અહ્મુ’ કે ‘અનલહક’ માનતા કવિઓમાં પણ લાંઠાં નથી. ‘દુઃખ, દરદ, કગાવિયત, કૂરતા, મૃત્યુ – આ બધું છતાં જિંદગી જીવવા જેવી છે. પછી યઃ અન્તઃ પ્રવિશ્ય મમવાચ્યમ્’ નામના સંસ્કૃત શ્લોકનો અનુવાદ આવે છે. ‘તે અભિલ શક્તિધર પરમપુરુષને હું નમસ્કાર કરતો નથી. કેમ કે મારે અંતઃકરણ નથી.’ વૈદ્યરાજ લાંઠાં તો જાણે છે કે અંતઃકરણ એટલે શું પણ આ કાવ્યનાયક જાણતો નથી, એ ઈશ્વરને ભજી શકતો નથી, ત્યજી શકતો નથી, અહીં પસંદગીનો પ્રશ્ન આવે છે : ‘ઝીડમ ઓફ ચોઈસ.’ પસંદગી ન કરવી એ પણ એક પસંદગી છે. પણ લાંઠાંનો કાવ્યનાયક કહે છે : ‘મારે કોઈ પસંદગી કરવાની આવે એમ હું માની શકતો નથી. હવે હું કદાચ મને મળી શકીશ.’ એમ લાગે કે ‘ચોઈસલેસ અવેરનેસ’ની દિશામાં આગળ વધાશે પણ કાવ્યનાયક તુરત પ્રશ્નમાં વળી જાય છે ! ‘તમે કદી તમને મળ્યા છો ?’ જવાબ તો કોણ આપવાનું હતું ? પણ કાવ્યનાયક તારવે છે : માણસ ધર્મ, અમૃત, જ્ઞાન, ચિત્તન, પ્રેમ, પરાક્રમ, પરાજ્ય – આ બધાથી ખવાઈ ગયો છે.’ – શું આમ તારવવું એ નિર્બાન્તિ છે ? કે આન્તિ ? જ્ઞાન અને પ્રેમને કેવી રીતે નકારાત્મક ઠરાવી શકો ? લાંઠાં સ્વયં કેટલા બધા પ્રેમાળ હતા !

કાવ્યને અંતે ‘બુદ્ધિશાળી = મૂર્ખ’ એવું સમીકરણ રચાયું છે, એ તો આખા કાવ્યમાં પડઘાતું રહ્યું છે પણ ‘દુઃખ એ જ સત્ય છે, સુખ તો માયા છે.’ આ વિધાનમાં સધિયારો જોઈ શકાય. ‘છે’ અને ‘નથી’ના આટાપાટામાં કયાંક દુઃખ રૂપી પરમ ધન પામી શકાય છે, આ એક અણધારી મોકણાશ લાંઠાંએ આપી છે. કહી શકાય કે દુઃખના સ્વીકાર વિના ‘માણસની વાત’ માંડી શકાઈ ન હોત.

ગાંધારી અને ધૂતરાઝ્ઞના સંચાદમાં સૂચવાયું છે : ધર્મના પાલનથી દુઃખો પ્રાપ્ત થશે, દુઃખોથી સ્મરણ થશે શ્રીકૃષ્ણનું. લાંઠાંએ છેલ્લે ગીતા વિશે લખ્યું છે. પણ અહીં દુઃખો પરમતત્ત્વનાં પ્રવક્તા નથી. દુઃખ માણસને માણસ તરીકે ઓળખાવે છે. આટલા તારણમાં બંધાવામાં લાંઠાંની ચેતનાને બાધ નહીં હોય.

૨૦-૦૫-૨૦૧૬



## ૧૨. ‘મેં કવિતા લખવાની શરૂઆત કરી’ – રચનાબંધનો ચમત્કાર

ચન્દ્રકાન્ત ટોપીવાળા

### મેં કવિતા લખવાની શરૂઆત કરી

કપાયેલી પાંખોવાળું કબૂતર  
કૃપારનુંય  
શેરીમાં ફર્ઝિડચા કરે છે.  
વન્દ્યાના ગર્ભશયની  
રિક્તતા  
શેરીમાં થરક્યા કરે છે.  
શેરીના ખાબોચિયામાં  
આજે ફરી  
શતસહસ્ર જંતુઓ જન્મ પામ્યાં.  
પાંડુ વર્જનો એક વૃદ્ધ  
પશ્ચિમ ભાણી ડગ ભરતાં  
શેરીની વિષમ ભૂમિમાં  
ઠેસ ખાઈને પડી ગયો.  
તેમ છતાં  
એક પતંગિયું  
મારી ખરબચડી કાળી દીવાલો પર  
બેંકું ન બેંકું...  
અને  
મેં કવિતા લખવાની શરૂઆત કરી.

‘ઈન્ડિયન એક્સપ્રેસ’ (૨૪-૧-૨૦૧૬)ની રવિવાર-પૂર્તિમાં સૌમ્ય લાખાડીએ લીધીલી મુલાકાતમાં ફિલ્મ-દિગ્દર્શક અભિપ્રેક કપૂર કહે છે કે ‘નવી ફિલ્મનો અર્થ છે તમે નવી વ્યક્તિ છો’ (A new movie means you are a new person’) અને પછી ભારપૂર્વક ઉમેરે છે કે I do not want to have a signature કોઈ પણ સર્જક માટે આ લાલબત્તી છે. લાભશંકર ઢાકર માટે એમ કહી શકાય કે આ શરત તેઓ નભાવી શક્યા નથી. કોઈ એક કિનારા પર તેઓ સ્થિર રહ્યા; કોઈ અન્ય કિનારા પર પોતાની જાતને તેઓ નાંગરી શક્યા નહીં. પ્રારંભમાં જે એમનો કેટલોક વિશેષ રહ્યો તે વિશેષ જ પછીથી એમની રચનાઓમાં શેષ રહ્યો. એમની રચનાઓમાં અટકી ગયેલા કાવ્યનું સંલક્ષણ (stuck poem syndrome) જોવાય છે. એટલે કે લાભશંકર પૂર્વકાવ્યપિંડથી અલગ કોઈ નવો કાવ્યપિંડ પછી જન્માવી શક્યા નથી. એમની પ્રારંભની ‘વહી જતી રમ્ય ઘોણા’ની પારંપરિક છાંદસ રચનાઓ પછી એમણે જે ‘તડકો’ કે ‘અવાજને ખોટી શકાતો નથી’થી તર્કમુક્ત સાહચર્યપદ્ધતિનો વિનિયોગ કર્યો એ જ પછીથી રચનાપ્રક્રિયાને આગળ ધરતો રચનાના અંતિમ પરિણામની ઓછી જેવના સાથે આગળ ને આગળ વધતો રહ્યો. એમ કહી શકાય કે મોટાભાગની એમની રચનાઓ કાવ્ય કરતાં કાવ્યના ડોળિયાં વધુ છે. પરિણામે લાભશંકર સહેલાઈથી ગળે ન ઊતરે એવા કવિ (unpalatable) બન્યા. કદાચ એ કારણે લાભશંકર હોવા જોઈએ એના કરતાં વધુ સમર્થ સાહિત્યકાર (literary heavy weight) ગણાયા.

રચના કરતાં રચનાપ્રક્રિયા પર ભાર મૂકૃતી એમની ‘મારા નામને દરવાજે’ કાવ્યસંગ્રહની એક રચના ‘મેં કવિતા લખવાની શરૂઆત કરી’ને અહીં સઘન તપાસ માટે હાથ ધરી છે. આધુનિકતાવાદી કાળની આ અછાંદસ રચના જે રીતે પાંચ સણ(folds)માં ખૂલેલી છે અને એ પાંચ સણનો જે રીતે પરસ્પરનો સંબંધ રચાયો છે, એમાં સાતત્ય છે અને વૈયક્તિકતા પણ છે; અને એ બધાંને જોડતી અંતે પાછી કોઈ કવિચેતનાની ઉપસ્થિતિ છે. ગિલે દેલ્યુઝ (Gilles Deleuze) લાઈબનિટ્ઝ (Leibnitz)માંથી ઉપાડેલી સંશ્બોધન ‘સણ’ (fold)નું અહીં વપરાયેલી ‘સણ’ સંશોધન અનુસંધાન છે. ૧૭મી સદીની યુરોપય સંસ્કૃતિની બેરોક શૈલી (Baroque)નાં મૂર્તિશિલ્પોમાં પ્રગટ સણો, સાતત્ય અને વૈયક્તિકતાનું સંયોજન નિર્દેશો છે. બરાબર એવું જ સંયોજન લાભશંકરની આ રચનામાં પાંચ સણો વર્ચ્યે જોવાય છે.

વળી, આ પાંચ સણમાં બહારનાં દશથો છે અને દશથોમાં નકારાત્મકતા છે : કપાયેલી પાંખવાળું કબૂતર, થરકતી રિક્તતા, ખાબોચિયાનાં જંતુઓ, મરણાસન્ન વૃદ્ધનું પતન અને ખરબચડી કાળી દીવાલ. – આમ જુઓ તો આ દશથોને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. હા, એ બધાં શેરીદશથો છે પણ આ બધાં દશથોને જોતી કવિચેતના સાથે એનો સંબંધ છે. આ કવિચેતના અવરોધો વર્ચ્યે પાંગરી રહી છે. ‘તેમ છતાં’ જેવો વાક્યખંડ એ રીતે આ રચનાનો મર્મઅંશ છે. કવિતાના જન્મ પહેલાં, જન્મ વર્ચ્યે અને જન્મ સામે કેટલાય અંતરાયો છે. અહીં

‘તેમ છીતાં’ જેવો વાક્યખંડ પહેલા ચાર સળ વાક્યસંકેતોને કવિતાના રચનામાર્ગના આંતરસંકેતોમાં પલટી નાખે છે. રચનાબંધનો આ ચમત્કાર છે. પાછો વાક્યસંકેતોની હૂબદૂ ઈન્દ્રિયગત તાદેશતાનો પણ અહીં મહિમા છે.

પહેલા બે વળનો સમાંતર વાક્યલય રચનાપ્રવેશનું આકર્ષણ બને છે :

‘કૃપાયેલી પાંખોવાળું કબૂતર  
કૃપારસુય  
શેરીમાં ફિફડ્યા કરે છે.  
વન્દ્યાના ગર્ભશયની  
રિક્તતા  
શેરીમાં થરક્યા કરે છે.’

કૃપાયેલી પાંખનું કબૂતર કદાચ છેક વાત્સીક્રિના કૌંચવધને પણ જઈને સ્પર્શી શકે તેમ છે. પહેલા વળમાં મૂર્તનું સામીપ અને બીજા વળમાં અમૂર્તની મૂર્તતા અસરકારક છે. ત્રીજા વળમાં ‘આજે ફરી’ વાક્યખંડમાં પુનરાવૃત્ત થયા કરતો અકળપવનારો close upનો અનુભવ છે : ‘ખાબોચિયામાં’ ‘શતસહસ જંતુઓ જન્મ’ પામ્યાં છે. ચોથા વળમાં ‘વૃદ્ધ પરી ગયો’ના દશ્યને વિશેષજ્ઞ અને કિયાવિશેષજ્ઞોની ફેમમાં ગોઠવી ધ્યાનપાત્ર બનાવ્યું છે. આ ચાર બહારનાં શેરી-દશ્યો છે ? કે પછી કવિના ચિત્તની ભાવદશાઓ છે ? કૃપાયેલા કબૂતર દ્વારા ગતિરોધનો સંકેત સ્પષ્ટ છે; અંદરથી કોઈ ગતિને કાપી રહ્યું છે. ‘ગર્ભશય’ સર્જનસ્થળ છે પણ તે વંધ્ય છે અને તેથી રિક્ત છે પણ રિક્તતા સતત અનુભવ આપ્યા કરે છે. (યાદ કરો એલિયટનું The Waste land.) અંદરની ખાબોચિયા જેવી સંકુચિત સીમાઓમાં ક્ષુદ અને ક્ષુલ્લક કશુંક જન્મ્યા કરે છે, નિર્થક જાય છે. ‘ગર્ભશય’ રિક્તતા પછી ‘શતસહસ જંતુઓનો જન્મ’ એક વ્યર્થતાની નજીક મૂકે છે. અને છેલ્લો નિજળતાનો મૃત્યુ જેવો (Deathlike) અનુભવ છે પાંડુ વર્ણ, વૃદ્ધનો કે કવિતાનો ? પણ્ચિમ ભણી ડગ માંડતો વૃદ્ધ કે અસ્ત ગતિની મરણાસન કવિતા ? વિષમભૂમિ અને ડેશ કે વાંધાઓ અને ગોથાં ? આમ કુલ આ ચાર સળ (Folds)માં શેરીનું સાતત્ય છે અને રજૂઆતમાં નકારાત્મક ભૂમિકાઓની અલગ અલગ વૈયક્તિકતા છે.

આ બધા અવરોધી છીતાં અને નકારાત્મક દશ્યો છીતાં હેવે નકારાત્મક (ખરબચડી કાળી દીવાલો) ફેમ વચ્ચે પહેલી વાર પતંગિયું દાખલ થયું છે. અગાઉના બધા જ સંદર્ભોને આવરી લેતો આ નાજુક સંદર્ભ બલિષ પ્રતીક સાબિત થાય છે. કબૂતરના ગતિરોધ સામે, થરકતી રિક્તતા સામે, ક્ષુલ્લક જંતુઓ સામે, વૃદ્ધના ‘પાંડુ વર્ણ’ની સામે તેમજ ખરબચડી કાળી દીવાલોની સામે પતંગિયું મુકાયું છે. પતંગિયું, આ બધાનો પ્રાણપ્રદ પ્રતિકાર છે. આવા પ્રાણપ્રદ પ્રતિકારનો આંતરિક આવિજ્ઞાર જ કવિને ‘કવિતા લખવાની શરૂઆત’ કરવા તરફ લઈ જાય છે.

કોઈ કવિના અંતર-અવરોધો વરચે અલપજલપ ઉત્તરી આવતા મનના કોઈ ચંચળ સંવેદનનો વેગ આ રચનામાં ધ્વનિત થતો જીલાયો છે. આધુનિકતાવાદી કાળજી આ રચનામાં શરૂના ચાર સણમાં સંવેદાયેલા ચાર અલગ અલગ પ્રત્યક્ષો (perceptions) અને છેલ્યે પાંચમાં સણમાં આવતો ખરબચ્ચડી કાળી દીવાલો પરના પતંગિયાનો પ્રત્યક્ષ - આ સર્વને કવિતા લખવાની શરૂઆત કરતી કવિચેતના સર્જનપ્રક્રિયાના અંતરિક સંદર્ભમાં બાંધી લે છે. પહેલા ચાર સણની ચિત્રપ્રસ્તુતિઓ (pictorial presentation) અને પાંચમાં સણનો પતંગિયાનો કાળી ખરબચ્ચડી દીવાલ પરનો Closeup - લેખનની પ્રક્રિયા સાથે સંકળતા એક બધિક અર્થ (Strong meaning) ઉભો કરે છે. એવું પણ કહી શકાય કે અહીં લખવાની શરૂઆત કરતો કવિ પોતે શોરેલા બધારના જીવનને સુયોજિત કરવા તરફ વળી રહ્યો છે. અહીં કવિતા દ્વારા કવિતાની લખવાની પ્રક્રિયાને વંઝિત કરતો પ્રયાસ આ રચનાને અધિકાબ્ય (Metapoem) તરીકે ઓળખાવવા આપણને પ્રેરે તો એ ઉચિત છે.

18





## ૧૩. અનન્ય કાવ્યત્વ દર્શાવતું કાવ્ય

રજેન્ડ્ર પટેલ

### હું એને જગતું છું

હું  
દરિયાના જળરાશિમાં  
હલબલતો વિસ્તાર.  
પવનની ગલીપચીનાં  
ગતિશીલ શિલ્પોને  
મેં નકાર્ય નથી.  
ને  
ચંદ્રના શીતલ લેપોથી  
આકાશને પલાળી નાખ્યું છે.  
ટેકરીઓની  
ઉત્કૃષ્ટ છાતીની છાયાઓથી  
ટકરાયો છું  
ને પર્વતની  
પ્રવંબ કાયાઓ સાથે  
મૈથુનમળન બન્યો છું.  
  
કંઈઠા-ખડક પર  
જીળ નાખી,  
ઈશ્વર ઊંઘી ગયો છે;  
હું  
એને જગતું છું.

કવિ લાભશંકર ઠાકર ગુજરાતી કાવ્યવિશ્ના એક વિલક્ષણ કવિ છે. એમનાં કાવ્યોમાં ત્રણ પ્રકારનાં કાવ્ય-પરિમાળો જોવા મળે છે. પ્રથમ પરિમાળ એમની શબ્દ-લીલાની સર્જકતાથી સર્જિય છે. એમનાં કાવ્યોમાં શબ્દો સહજ અને વિશિષ્ટ લય અને નાદથી રસેલાં હોય છે. આ અપૂર્વ ભાષાકર્મમાં એમની નિશ્ચ કાવ્ય-મુદ્રા ઊભરી આવતી હોય છે. ‘તડકો’ કાવ્ય એ રીતે તપાસવા જેવું છે. બીજું પરિમાળ તે એમની કાવ્ય-ચેતના, તેની મથામણ અને આવેગભર્યો સઘન કાવ્ય-પ્રવાહ. ઉથલપાથ થતી આ કવિચિત્ની ચેતના એક આગવી કાવ્ય-ગુંથણી રેચે છે. ‘પ્રશ્ન’ કાવ્ય એ રીતે આસ્વાદવાયોગ્ય છે. ત્રીજું પરિમાળ એ એમનું કાવ્ય-વિઝન; એમની સહજ અને અહેતુક પ્રબળ વિરસ્મયથી મુદ્રિત કાવ્ય-વિચારધારા. ચંદકાન્ત શેઠ એમના એક કાવ્યસંગ્રહ સંદર્ભે નોંધે છે કે ભાષા-લય-પ્રતીક-કલ્યાન-પુરાકલ્યાન-આત્મકલ્યાનની જટાજળમાંથી એમની કવિતાનો એક અનન્ય બળવાન ચહેરો ઊપરસી આવે છે. અપૂર્વ શબ્દ-લીલા, કાવ્ય-ચેતના અને કાવ્ય-વિચારતાત્ત્વનું નિપરિમાળિક કાવ્યત્વ એમની અસ્રુદ્ધ કાવ્યશૈલીનું નિર્માણ કરે છે. જે કાવ્યમાં એકસાથે એકરૂપ થયેલું લાધી છે. પ્રસ્તુત કાવ્ય ‘હું અને જગાડું છું’ને એ રીતે અહીં આસ્વાદવાનો પ્રયાસ છે.

આ કાવ્યના આરંભે જ કાવ્યનાયક પોતાનો પરિયય આપી દે છે. અસ્તિત્વનાં કર્દી કેટલાય અગોચર પાસાંઓને વ્યક્ત કરતાં કવિ કહે છે :

‘હું  
દરિયાના જળરાશિમાં  
હલબલતો વિસ્તાર.’

સામાન્ય રીતે ‘વિસ્તાર’ સદ્ગ સ્થિર હોય છે – જોકે અહીં કોઈ નિશ્ચિત સ્થળની વાત નથી પણ જાણે કવિ ચેતોવિસ્તારની ગતિને નિર્દેશ છે જે સતત સક્રિય છે, સર્જનવિસર્જનની લીલામાં રત છે. સતત ચંચલ છતાં ડાયનોમિક.

‘પવનની ગલીપચીનાં  
ગતિશીલ શિલ્પોને  
મેં નકાર્યો નથી.’

કવિસંવેદના કેટલી સૂક્ષ્મ તથા જાગ્રત છે તે બીજા કલ્યાન-વિધાનથી અનુભવાય છે. ઇન્દ્રિયગોચર અનુભવ વ્યક્ત કરતા કવિ ‘ગલીપચી’ શબ્દનો આ કાવ્ય-ક્ષણો કેવો સુંદર વિનિયોગ કરે છે ! એટલે ફરીથી કવિ સ્થિરતામાં નહિ, અસ્થિરતાનો મહિમા કરે છે. નિતનવાં પરિવર્તનો તો જ શક્ય બને. શિલ્પો સ્થિર હોય પણ કવિએ તો જગાડવાનું જાણે પણ લીધું છે. એટલે બીજા કલ્યાનમાં એ સ્થિરને અસ્થિરમાં રૂપાંતર કરતાં કહે છે કે ગતિશીલ શિલ્પોને નકાર્યો નથી.

કાવ્યમાં હવે પછી જે કલ્યાન આવે છે તે ઉપરના કલ્યાન કરતાં જુદું છે. હવેની પંક્તિમાં

કવિ અદ્દરયને દર્શયમાં પહોંચે છે !!

ચંદ્રના શીતલ લેપોથી  
આકાશને પલાળી નાખ્યું છે.'

અદ્દરય આકાશને પલાળવાના ડિયાપદથી વિસ્મયકારી નવો અનુભવ કરાવે છે. એથી જ આ કાવ્ય એના કાવ્યત્વથી એક નવી ભાત પાડે છે. કવિતા વિશે વાત કરતાં આધુનિક કવિતાના મહાન કવિ-વિવેચક ટી. એસ. એલિએટ કહે છે :

I suppose it will be agreed that every good poet has something to give us besides pleasure, there is always the communication of some new experience, or some fresh understanding of the familiar, or the expression of something we have experienced but have no words for, which enlarge our consciousness or refines our sensibility... without producing these two effects it simply is not poetry.

T.S. Eliot, Poetry and Poets (London : Faber, 1957), p. 18.

એલિએટ કહે છે કે કદાચ તમે સહમત થશો કે દરેક જારા કવિએ આપણને આનંદ સાથે કશુંક આપવાનું પણ હોય છે, જેમાં નવીન અનુભૂતિનું પ્રત્યાયન હોય છે, અથવા જાગીરી વાતની તાજગીસભર નવી સમજ હોય છે, અથવા એવી અભિવ્યક્તિ કે જે અનુભવની અભિવ્યક્તિ માટે આપણાને શબ્દો મળતા હોતા નથી, જે આપણો ચેતોવિસ્તાર કરે અથવા આપણી સંવેદનાઓને પરિશુદ્ધ કરે... આ બે વાનાં સર્જે નહિ તે સ્પષ્ટપણે કવિતા હોઈ શકે નહિ.

પ્રસ્તુત કાવ્ય આપણને એક નવીન અનુભવ કરાવે છે એટલું નહિ, પણ નવી સમજ માટે અવકાશ રચે છે. એલિએટે દર્શાવેલાં કાવ્યલક્ષણો પણ અહીં લાધે છે.

કાવ્યમાં હવે પછી આવતું કલ્યાણ વળી એક ગીજો નવીન અનુભવ કરાવે છે. કવિ વાસ્તવમાં જે ઊંઘી ગયું છે સર્જકત્વ તેને જગાડવા વિસ્મય આધારિત શબ્દબળો નવા અર્થના દ્વાર ખોલે છે. હવે કવિ આગળ સ્થિરતામાં સાયુજ્ય સાધી તેની સાથે એકરૂપ બની એને જગાડવાનું ભગીરથ કામ કરે છે.

પર્વતની

ગ્રલંબ કાયાઓ સાથે  
મૈથુનમળન બન્યો છું.'

આટાટલું મથવા પાછળનો સહજ અહેતુક પ્રયત્ન તો ચેતનાને જગાડવાનો છે. કવિ રૂપક પરંપરાનું મૂકે છે. ઈશ્વર. પણ એનો સંકેત નર્યો માણસ ભાગી છે. કારણ કે આ સર્જકત્વ, આ મનુષ્યચેતના અથવા મનુષ્યમાં રહેલું ચેતનતત્ત્વ નામે ઈશ્વર સૂટું છે. બાધ્ય સૃષ્ટિનો પરબ જીન-જીલાર્ડ, 2016

સર્જનહાર કદાચ ઊંઘી ગયો છે પણ અંદરનો સર્જક પણ સૂતો છે.

‘કાંઠા-ખડક પર

જળ નાખી,

ઈશ્વર ઊંઘી ગયો છે;’

નિત્યની જેમ પણ કવિ કહેતા નથી કે ઈશ્વર મરી પરવાર્યો છે. નિત્યને અભિપ્રેત તો છે : ‘God is dead; but knowing the ways of men, there may still exist caves in which his shadow will be exhibited for thousands of years. And we still have to eradicate his shadow too. (The Gay Science, 1882) આ કાવ્યમાં ઈશ્વરનો સંદર્ભ નિત્યો કરતાં જુદો છે.

ઉદ્યમથી અલિપ્ત સર્જકચેતનાને જગાડવા કવિ કેટકેટવા આયામ આ નાના કાવ્યમાં કરે છે !! કવિ એ સંદર્ભે આ કાવ્યમાં પંચતત્ત્વનો ઉપયોગ કરે છે. જળ (જળરાશિ), વાયુ (પવન), અવકાશ (આકાશ), પૃથ્વી(ટેકરીઓ) અને અજિન(મૈથુન) તમામ પંચતત્ત્વનો ખપ લે છે. સ્થિરને અસ્થિરમાં, અદરશને દરશયમાં, મૂર્ત સાથે સંયોજન દ્વારા, માયા પાથરીને જે સૂઈ ગયું છે તે તત્ત્વને જગાડવાની પ્રક્રિયા દર્શાવતા આ કાવ્યમાં લાંઠાની અનેરી સર્જકતા ઊભરી આવે છે. જાણો કવિ પોતાની સર્જકતાને જ જગાડે છે, સંકોરે છે.

રવીન્દ્રનાથ ટાગેર ‘જીવનદેવતાની’ જે ભૂમિકા રચે છે એ જ કદાચ કવિને આ કાવ્યમાં અભિપ્રેત હશે એમ લાગે છે. રવીન્દ્રનાથના ઊંડા અભ્યાસુ અબુ સૈયદ અધ્યુબ જીવનદેવતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં એમના એક લેખમાં નોંધે છે. (He urged more than once that ‘Jivan-devta’ did not mean the Lord of the universe, but only the lord of his own life and destiny. In a way, we are being told not only that each man has his own religion – as we have been told by Vivekanand and Gandhi – but that each man has his own God, who is a different from the God of other men as he him self is from them. This is not polytheism but individualized not heism... That is why he made haste to deny that by Jivan-devta – a name he had given to the moving force behind his poetry – he did not mean the God of all mankind and of all world.) (Tagore Quest, Abu Sayeed Ayyub, p. 45)

જ્યારે કવિ લાંઠાની નિજ ઈશ્વરને જગાડે છે જે સૂતો છે. જળ પાથરીને. ત્યારે ઈશ્વરનો ઉપર્યુક્ત સંદર્ભ બંધબેસતો લાગે છે. હું એને જગાડું છું. એ વાક્યથી અંત પામતું આ કાવ્ય એક અનન્ય કાવ્યપ્રક્રિયા દર્શાવતું જાણો નવા આરંભને ચીંધે છે. આ કાવ્યત્વ કવિની આગવી ચૈતસિક ઔળખ પણ બની રહે છે.



## ૧૪. આંતરખોજના અંશો દાખવતી એક કબૂલપાત

બારીન મહેતા

### મારા નામને દરવાજે

સમીસાંજનું ઘરડું પંખી  
પાંખ પસારી  
ઉડતું  
એના પડછાયામાં  
કલબલતું કલબલતું  
હલબલ શહેર  
શહેરની સીમ મહીં  
ચૂપચાપ ઉભો ચોગરદમ  
રોકી સીમ તણો વિસ્તાર  
બંગલો  
આંખો પાંખો જીર્ણ બંગલો.  
સમીસાંજની જરઠ પાંખ અથડાતી  
આંખો હવા મહીં ઘસડાતી  
ઉભો વૃદ્ધ બંગલો  
રુદ્ધ બધા રસ્તાઓ.  
અતીતનો પણ કુટકછાયો પંથ  
અતીતનો આ અંધકારમાં અંત.  
અંતનું જરઠ સત્ય સળવળતું મારી આંખોમાં  
આંખોમાં ઉધેરે દ્વાર  
કડકતાં.

અંધકારમાં અસ્થિનાં સૂકાં પોવાણો ચીએ  
 પ્રકાશને આ ચામાચીડિયાં પીએ  
 ચીએ ચામાચીડિયાં  
 અવાવરું અંધાર મહી જે  
 ઊંઘે માથે ચૂપચાપ  
 મૂગાંમંતર થઈ  
 અધઃશાખ પર ચોંટ્યાં  
 તે આ  
 ચીઝી ઉઠ્યાં  
 ગોળ ગોળ ચકરાતાં ચીએ  
 ગોળ ગોળ અથડાતી પાંખો....  
  
 અંધકારમાં કશુંય ના દેખાય  
 માત્ર આ અવાજના  
 ચામાચીડિયાના ચિત્કરો આ  
 અવાજના ચિત્કરો  
 કણા કકળે -  
 જમણી બાજુ  
 ગોળ ગોળ આ  
 ઊંઘેનીચે  
 નજીક પાસે  
 ગોળ ગોળ ઘૂમરાતા  
 ચીએ  
 અવાજના ચિત્કરો  
 પાંખે  
 એક કશું  
 જે ભેજભર્યું  
 લાંબું મોટેરું  
 પગ પાસે પગ થઈ ઊગેલું  
 પાગેલું પોષેલું મારું  
 મસમોટું આ પશુ શબ્દનું પીએ

વીંજે  
પીંજે  
ચીંજે  
અવાજના ચિત્કારો  
ચિકવિક  
અવાજના ચિત્કારો  
ક્રિયવિક  
કાન વગરની હોડી મારી  
અવાજના અભ્યામાં  
ઉછળી પડે વળે વળમાં વમળોમાં  
ઉંચે છેક અચાનક ચઢતી પિલ્વર પર મોજાના  
ત્યાંથી  
પડે નીચે પટકાઈ અચાનક  
ભાન વગરની હોડી મારી  
કાન વગરની હોડી મારી  
અવાજના ભીષણ જળવળમાં  
અવળસવળ કચડાતી ક્યાં ગઈ ?  
ક્યાં ગઈ ?  
મને મૂકી  
બેભાન....

ઉઘડતી આંખ  
અને સામે ઉભેલી આંખ  
પલકતી  
પલકારાની નીચે  
બે થડકાર  
ગૌળ  
લીલા કમખામાં  
પલકારાની નીચે  
બે થડકાર.

લહેકતું  
 ખુલ્યું પોયણપાન  
 ચહેકતું જીણું જીણું ગાન  
 તાનમાં લંબાવું હું હાથ  
 બાથમાં ઝાંઝરનો ઝણકાર પકડવા ચહું  
 ચહુંદિશા  
 જુમર લટકે  
 પ્રકાશની પાંદડીઓ ફરકે  
 શીરશમહલમાં  
 પ્રકાશની પાંદડીઓ ભટકે  
 ગોળ ગોળ  
 પોયણનાં ઘૂમતાં પાન  
 પાતળાં  
 કોણી કેડ પરોવું કરમાં ?  
 દીવાલની કમ્મર લચકાતી  
 પગ પછડાતા  
 ઝાંઝરનો ઝણકાર ગયો લોપાઈ  
 અરે હું ક્યાં છું ?  
 ગોળ ગોળ ચકરાતી મારી નજર  
 અરે હું ક્યાં છું ?  
 ઘડીક જલમાં  
 પલમાં થલમાં  
 જલમાં અતલ વિતલ તલતલમાં  
 મારી નજર  
 મને દેખાય નહીં  
 આ કશું મને પેખાય નહીં.  
  
 ખડબચડી  
 તૂટેલી  
 અડતી

દીવાલ કાચકૂટેલી

પગમાં કંક કશું અથડાયું

ને મેં હાથ વડે કંઈ જાયું ?

ને એ સળવળ સળવળ ચાલ્યું ?

અરે કંઈ આવીને પછાયું

ને અડવડિયાં ખાતો

અથડાતો

પડતો

ચડતો દાદર પર

ડાબી બાજુ

કરું જરીક પ્રવેશ

ત્યહીં તો

તીવ્ર ગંધથી

લચી પડેલી

હવા ભેજથી ભરી પડેલી

નિશ્ચલ ઊભી

મને પડી અથડાઈ

અને હું

અહીંથી તહીં

પડતો અથડાતો

ભેજ મહીં દુર્ગધ મહીં

કણ જીણા તીણા

આડે મને

અકળાઉં

ચામડી થરકે

છરકે

શાસ કરું શેં બંધ

અંધ હું

હાથ કરું લાંબો તો

નિશ્ચલ

હવા તણી દુર્ગંધ  
 ચોસલાબંધ  
 હાથમાં આવે  
 રે હું શાસ કરું જો  
 બંધ  
 ગંધના ખાતા કડવા તૂરા તીખા  
 કણ મોંખાં -  
 હું પહું નીચે,  
 ઢીંચણથી ચાલું  
 ઘસડાતો ઢીંચણથી ચાલું  
 ઘસડાતો ઢીંચણથી ચાલું  
 અથડાતો ઢીંચણથી ચાલું  
 શાસ શોધતો ચાલું  
 મારો પ્રાણ શોધતો ચાલું  
 ખખડે નામ હાથમાં ઠાલું  
 ચાલું  
 ઢીંચણથી ઢસડાતો ચાલું  
 ચાલું છું ઢસડાતો ક્યાં હું ?  
 શોધું છું ઘસડાતો ક્યાં હું ?  
 લોથપોથ લથડાતો ક્યાં હું ?  
 અકળવિકળ અથડાતો ક્યાં હું ?  
  
 એક બંગલો  
 આંખો પાંખો જાણ્ણ બંગલો  
 આંખ વગરનો અંધ બંગલો  
 યાદ મને છે  
 ફરતાં પોયણપાન  
 ચહેરકતું જીણું જીણું ગાન  
 બંગલો ખડો રહ્યો.  
 મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો.  
  
 રોધી મારો શાસ

અરે અવરોધી મારો નાશ બંગલો ખડો રહ્યો  
 શોધું છું ઘસડાતો મારો હાથ  
 હથને રોકી રાખી  
 ખુલ્લી એક હથેલી વચ્ચે  
 આંખો પાંખો જીર્ણ બંગલો  
 ખડો રહ્યો.  
 શાને માટે ખડો રહ્યો ?  
 કોના માટે ખડો રહ્યો ?  
 મારા નામને દરવાજે  
 આ હું ખડો રહ્યો  
 ભીતરના ભોગળ બંધ  
 અંધ હું ખડો રહ્યો  
 કલબલતો કલબલતો  
 પલપલ ખડો રહ્યો.  
 મારા રામને દરવાજે  
 હરદમ ખડો રહ્યો  
 આલીશાનને દરવાજે  
 નરદમ ખડો રહ્યો  
 ફળતી સાંજને દરવાજે  
 આકુલ ખડો રહ્યો  
 રમતી રાતને દરવાજે  
 વ્યાકુલ ખડો રહ્યો.  
 આકુલ વ્યાકુલ ખડો રહ્યો.

**પ્રસ્તુત કૃતિના આસ્વાદમાં પ્રેવેશતા પહેલાં વાચકમિત્રોને વિનંતી કે પહેલાં પોતાને સંભળાય  
 એ રીતે કાથ શાંતિથી વાંચી જાય તો શક્ય છે કે આસ્વાદનો સ્વાદ વિશેષ અનુભવાય. આભાર.  
 લાઠાંના આ કાથનો આસ્વાદ સ્મરણાંજલિ ના બને તોપણ, એમના શબ્દોમાંથી  
 સરજાતી એકલદોકલ કૃત પણ એમની ઓળખની પરિચાયક બની રહે એવું બિનંગત રીતે  
 સૂજવાથી, પ્રસ્તુત કૃતિના સ્વરૂપવિધાન અને વસ્તુવિધાનની આસ્વાદક પળોને પામી શકાય  
 એટલી પામવાનું વલણ દાખવવાની મારી મથામણ, આપણા સહુની મથામણ બની રહે એવી  
 સમજણ સાથે વાતની માંડળી કરું છું.**

કાવ્યનું શીર્ષક ‘મારા નામને દરવાજે’ ત્રણ શબ્દોના સાયુજ્ય વડે ત્રણ મુખ્ય વાત નિર્દેશે છે.

એક, ‘મારા’ એવા ઉલ્લેખ દ્વારા પ્રથમ પુરુષ એકવચન એટલે કે ‘હું’ને;

બે, ‘નામને’ એટલે કે જે ‘હું’ આ નામ ધરાવે છે તેને, તેની પ્રાથમિક ઓળખને; અને

ત્રણ, ‘દરવાજે’ દ્વારા ‘હું’ની જે બદ્ધ સ્થિતિ છે, આ દરવાજે જે કંઈક ગોપવીને બેઠો છે, એવા ‘હું’ની ઓળખની કોઈ વાત નિર્દેશાત્મી લાગે.

છીતાં પણ, આ કાવ્ય છે અને આગળ વધતાં હાથને શું લાધશે, આપણી સહદ્યતા શું ગ્રહણ કરશે, કવિનો શબ્દ કદિ ગમ દોરી જોશે, એના ઉપર અવલંબન રાખી આગળ વધીએ.

કાવ્યનો ઉપાડ, એની પ્રથમ પંક્તિ વાંચતાં જ અષ્ટકલ સંઘિના આવર્તનનો લય એક વ્યાપક કલ્યાણ સાથે આપણાને એક એવી ઉડાન આપે કે આપણે અન્ધરથી જોતા હોઈએ એવું લાગે. જુઓ, આ રહી શબ્દની પાંખો –

સમીસાંજનું ઘરરું પંખી / પાંખ પસારી /

ઉડતું / એના પડણાયામાં /

કલબલતું કલબલતું / હલબલ શહેર /

શહેરની સીમ મહીં / ચૂપચાપ ઊભો ચોગરદમ /

રોકી સીમ તણો વિસ્તાર /

બંગલો / જાંખો પાંખો જીર્ણ બંગલો

ફળતી સાંજના સરકતા સમયને ઘરડા પંખીના કલ્યાણ દ્વારા નિરૂપી, સાંજની વ્યાપકતાને સીમિત કરતા જઈશ; શહેર, એની સીમને રોકીને ઊભેલા જીર્ણ બંગલાને ઝીકસમાં લેતાકને એનો કલોઝ-અપ આપણાં મનાચ્છું પર પ્રત્યક્ષ અને નજીક આવતો જણાય તાં જ સમીસાંજની જરઠ પાંખ અથડાતી / આંખો હવા મહીં ઘસડાતી / ઊભો વૃદ્ધ બંગલો / તુદ બધા રસ્તાઓ એમ સૂચાવે છે અવરોધાયેલું છે બધું એમાં ભૂતકાળનો કંટાળો પથ છે, જેનો અંત આ અંધકારમાં છે. એકસાથે ઘણાબધા સંકેતોથી રચનાની પંક્તિએ પંક્તિ સહદ્યમાં અંધકારના શક્ય તે અધ્યાસો સંભરે અને કાવ્યનાયક ઉચ્ચરે :

અંતનું જરઠ સત્ય સળવળતું મારી આંખોમાં /

આંખોમાં ઊઘડે દ્વાર / કડડતાં /

અંધકારમાં અસ્થિનાં સૂક્ષ્મ પોલાણો ચીખે.

અહીં ઊઘડે દ્વાર પછી આવતું ક્રિયારૂપ કડડતા અવાવસુંપણું તો દર્શાવે જ છે, સમગ્ર માહોલને વધારે વેરો બનાવે છે. ઉપરાંત, અસ્થિનાં સૂક્ષ્મ પોલાણો ચીખે એ કલ્યાણ કાવ્યનાયકની હસ્તીને અંધકારમાં એટલી તો વેરવિભેર કરી નાભેલી નિરૂપે છે કે અવાજનાં વિધવિધ રૂપોના પ્રચલનથી એ પોતે વિક્ષિપણ થતો રહે છે : એના ચિત્તવ્યાપારમાં વાસ્તવ અને તંદ્રિલ અવસ્થા

એટલી તો મિશ્રિત થયેલી જગ્ઘાય કે અવાજનાં કલ્પનોની ચડતી-ઉિતરતી ભાંજણીઓ, એને તળેઉપર ના કરતી હોય !

પ્રકાશને આ ચામાચીડિયાં પીંબે / ચીખે ચામાચીડિયાં /  
અવાવરું અંધાર મહીં જે  
/ ઊંઘે માથે ચૂપચાપ / મુંગામંતર થઈ...

જાણે અષ્ટકલ સંઘિનાં આવર્તનોમાં પડધાતાં અવાજનાં ચિત્કારોથી ન્રસ્ત એવો કાવ્યનાયક, પોતાને જાગવવા, જે કંઈ ઘટી રહ્યું છે એનું નિરીક્ષણ કરતી પોતાની જાતને જોઈ રહ્યો છે અને એનાથી કશું થઈ શકે એમ ના હોવાથી એમાંથી પસાર થવાની પ્રક્રિયાનો હિસ્સો બનવા ફાંઝી મારતો હોય, એનું લાગે, એવામાં

એક કશું / જે લેજભર્યું / લાંબું મોટેરું /  
પગ પાસે પગ થઈ ઊગેલું / પાળેલું પોષેલું મારું  
/ મસ્સમોટું આ પશુ શબ્દનું પીંબે / વીંબે / પીંબે  
/ ચીખે / અવાજના ચિત્કારો....

વચ્ચે પોતાની કાન વગરની હોડીને અવાજના અભિના મસમોટા મોજા પર જુએ છે...

કાન વગરની હોડી મારી / અવાજના અભિધમાં /  
ઊછળી પડે વળે વળમાં વમળોમાં /  
નીચે છેક અચાનક ચઢતી પિલ્લર પર મોજાનાં /  
ત્યાંથી / પડે નીચે પટકાઈ અચાનક...

...અવાજના ભીષણ જળવળમાં /  
અવળસવળ કચડાતી ગઈ ત્યાં ? /  
કચાં ગઈ ? / મને મૂકીને / બેભાન....

અહીં કૃતિનો પ્રથમ બંડ પૂરો થાય છે. કવિએ તો સાંંગ કથન પ્રયોજયું છે, પરંતુ સહદ્ય તરીકે આપણે વાંચતા વાંચતા અનુભવીએ છીએ કે અહીં એક પરિસ્થિતિ પૂરી થઈ. એ પછીની પંક્તિ વાંચતા આપણાને તરત લાગે કે દશ્ય બદલાયું છે, સ્થિતિ બદલાઈ ચૂકી છે :

/ ઊઘડતી આંખ / અને સામે ઊભેલી આંખ /  
પલકતી / પલકારાની નીચે / બે થડકાર / ગોળ /  
લીલા કમખામાં / પલકારાની નીચે / બે થડકાર.

આ બદલાયેલી પરિસ્થિતિનો ભાષાપ્રવાહ ઋજુલ-મંજુલ અનુભવ કરાવે છે. અંધકારની વધતી ભીષણ ભીસમાંથી જે બેભાન અવસ્થા આવી મળી, પછીનો આ અનુભવ કશીક હળવાશ આપતો લાગે, કારણ કે સામે ઊભેલી આંખના પલકારાની નીચે બે થડકાર તદ્દન વિપરીત

ને ઈન્ડિયજન્ય નિરૂપણ સાથે સહદયને ઋજુલ તરલ તરંગલીલામાં વિહાર કરાવે છે...

લહકતું / ખુલ્ખું પોયણપાન /  
ચહકતું ઝીણું ઝીણું ગાન / તાનમાં લંબાવું હું હાથ /  
બાથમાં આંજરનો ઝણકાર પકડવા ચહું

આ ચાહના, આ ઈચ્છા, શીશમહલમાં ફરકતી, ભટકતી પ્રકાશની પાંદીઓ અને  
પોયણનાં ઘૂમતાં પાતળાં પાનમાંથી કોની કેડ પરોવું કરમાં ? / સુધી પહોંચીએ ત્યાં તો જાંજરનો  
જણકાર લાપાઈ જાય એવી રીતે દીવાલની કમ્મર લચકાય અને પગ પછડાય ને કાવ્યનાયક  
ઘડીક જળમાં, થલમાં, અતલવિતલ તલતલમાં અડવડિયા ખાવા લાગે, ચિલ્વાઈ ઉઠે :

મારી નજર / મને દેખાય નહીં /  
આ કશું મને પેખાય નહીં

જાણો ઋજુલ તરંગલીલા પૂરી થઈ ગઈ. ફરી પરિસ્થિતિ પલટાઈ. આપણે ત્રીજી  
પરિસ્થિતિમાં દાખલ થઈએ છીએ. સાંજ, વેરાતો અંધકાર, શહેરથી થોડો દૂર જીર્ણ બંગલો,  
અવાજના ચિંતારો, ને એની સાથે સંકળાતું પગ પાસે પગ થઈ ઊગેલું, પોતાનું પાણેલું-પોષેલું  
મસમોટું પશુ શબ્દનું અને એની સાથેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન બેભાન થતો કાવ્યનાયક  
ઓંખ ખોલે પછી થતાં ઋજુલ તરંગલીલાના અનુભવપ્રેરિત ઈચ્છાપૂર્તિ કરવા જતાં એનું લોપાઈ  
જવું અને પોતાને પોતાની નજર જ દેખાય નહીં, કશું પેખાય નહીં એવી સ્થિતિમાં સંડોવાવા  
સુધી આપણે જે કંઈ કર્યાના શબ્દને સહારે પસાર કર્યું એ હેવ આપણને આ ત્રીજી પરિસ્થિતિમાં  
લઈ આવ્યું. એમાંનું વર્ણન વાસ્તવિક કે અતિવાસ્તવિક નહીં, પણ કોઈ આંતરિક વાસ્તવિકતા  
ભણી લઈ જતું હોય એવો ભાસ થાય છે, કાવ્યનાયકનું અંગત જે રીતે છતું થયું છે એ સંદર્ભમાં  
આ છતા થવાની પ્રક્રિયા, કાવ્યના શીર્ષકનો કોઈ વિશેષ પ્રગટ કરે છે કે નહીં એ આપણે આગળ  
જતાં કહી શકીશું એવું લાગે છે.

ત્રીજી પરિસ્થિતિ આપણી સામે આ રીતે ખૂલે છે :

અડબચડી / તૂટેલી / અડતી /  
દીવાલ કાચકૂટેલી....

કશું દેખાય – પેખાય નહીં એવી સ્થિતિમાં કાવ્યનાયક છે એટલે જ ઉપરની પરિસ્થિતિમાં  
એની સાથે જે ઘટે છે એથી એની સ્થિતિ વધુ કથળે છે. પગે કંઈક અથડાય, પોતે હાથ  
વડે કંઈ જાલે ને એ સુળવણ ચાલે ? એવો પ્રશ્ન ન થાય ત્યાં તો કંઈક પછડાતાં તે અડવડતો,  
અથડાતો, પડતો, દાદર પર ચડીને ડાબી બાજુ પ્રવેશો તો....

તીવ્ર ગંધથી / લચી પડેલી /  
હવા ભેજથી ભરી પડેલી /  
નિશ્ચલ ડાબી મને પડી અથડાઈ

સતત ગતિશીલ હવા નિશ્ચલ, અથડાય એવી નક્કર ! જાણો કે બંધિયારપણાનો સ્પર્શ ઘેરી વળે છે. ભેજ અને ગંધભરી નિશ્ચલ હવાના બેજને દુર્ગંધમાં અથડાતા, પડતા કાવ્યનાયકને જીજા ઝીજા કણ અડે ને અકળાય, ચામડી થરકે, છરકે છતાં ચાસ તો બંધ શેં કરાય ? એટલે અંધતામાં હાથ લાંબો કરે તોપણ હાથમાં હવાની દુર્ગંધનાં ચોસલાં આવે છે. કેવો આકારબદ્ધ ગંધનો અનુભવ ! ચાસ જો બંધ કરે તો ગંધના તૂરા, કડવા, ખાટા, તીખા સ્વાદનો અનુભવ ! ઈન્દ્રિયવ્યાપ્તયનું કાવ્યમય નિરૂપણ ! કાવ્યનાયકની બેહાલ સ્થિતિ -

હું પડું નીચે, / ઢીંચણથી ચાલું /  
ઘસડાતો ઢીંચણથી ચાલું /  
ઢસડાતો ઢીંચણથી ચાલું... ચાસ શોધતો ચાલું /  
મારો પ્રાણ શોધતો ચાલું / ખખડે નામ હાથમાં ઠાલું...

અને સવાલ જાણો પલટી મારે છે, આ કંઈ શૈશવની ભાખોડિયા જેવી ચાલ નથી, પુષ્ટ વ્યક્તિ કે જે બેહાલ થઈ ગયો છે એની લથડાતી, લોથપોથ થયેલી ચાલ છે. એની પ્રાણશક્તિ હત્પ્રભ થઈ ગયેલી છે. અને હાથમાં ખખડે છે ઠાલું નામ... નામ વજૂદ ખોઈ બેઠું છે જાણે... નામથી મિન્ન છે કાવ્યનાયકનો હું... પ્રશ્નરૂપ બની ગયો છે :

શોધું છું ઘસડાતો ક્યાં હું ?  
લોથપોથ લથડાતો ક્યાં હું ?  
અકળવિકળ અથડાતો ક્યાં હું ?

આ પ્રશ્નસ્થિતિ કાવ્યની ગ્રીજ પરિસ્થિતિને વળોટીને આપણને ચોથી પરિસ્થિતિમાં પ્રવેશ કરારે છે, બંગલાની ઉપસ્થિતિ સાથે. અન્ય ત્રણોય પરિસ્થિતિનું અહીં Synchronization - પ્રયોજાય છે.

સુમેળ સાધવાનો, સાયુજ્યનો પ્રયાસ કળાય છે. વસ્તુવિધાન કૃતિની એકવાક્યતા અર્થે સ્વરૂપવિધાન વડે, આગળની ત્રણોય પરિસ્થિતિનું સંકલન આ ચોથી પરિસ્થિતિમાં કરી રહ્યું છે.

આરંભમાં દર્શાવાતો બંગલાનો કલોઝ-અપ અહીં પ્રશ્નસ્થિતિ પછી તરતની પંક્તિમાં જ સામે મુકાય છે તે, બંગલાની ‘મારા નામને દરવાજે’ શીર્ષક સાથે સંલગ્નતા નિર્દેશ છે, જે આ કણે કે જ્યારે કાવ્યનાયક હું લથડાતો અથડાતો અકળવિકળ છે ત્યારે અસ્તિત્વની નક્કરતા અને સ્થિતિચુસ્તતા દાખલે છે. એનો સ્થિતિ સ્વીકાર જાણો કે પેલા જીર્ણ બંગલા જેવો છે. એ ઊભો છે એ જ એના હોવાની સાબિતી છે, એણે કશું કરવાપણું રહેતું નથી. એની સાથે જે કંઈ થાય તે આ હોવાનો જ ભાગ છે !

એક બંગલો / જાંખો પાંખો જીર્ણ બંગલો  
 / આંખ વગરનો અંધ બંગલો / યાદ મને છે  
 / ફરતાં પોયશાપાન / ચહકતું ગીરું ગીરું ગાન  
 / બંગલો ખડો રહ્યો. /  
 મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો.

કોણ જાડો કેમ પણ જ્યારે આ કાચ્ય વાંચું છું ત્યારે અહીં એ પૂરું થઈ ગયું એવો ભાવ થયો છે. છતાં આગળ ૨૪ પંક્તિઓ છે ને એ વંચાય છે. એ વાંચતાં વાંચતાં બંગલો, હું અને મારા નામને દરવાજે ખડો રહ્યો નાં અછકલ સંવિનાં આવર્તનો સરસ મજાનો લયધારિ સરજે છે. એ સંભવ છે કે મારી જેમ અન્ય સહદયોને પણ કૃતિના વસ્તુ અને સ્વરૂપવિધાનના સંદર્ભમાં આ પ્રસ્તારી લાગે. અંગત રીતે કાવ્યપ્રમેયને સમજવાની મથામજથી એમ લાગ્યું કે અહીં કવિએ પ્રથમ ત્રણોય પરિસ્થિતિઓને સાંકળીને બંગલો, હું અને મારા નામને દરવાજે – એ સમગ્રને. કૃતિગત સહસરંધક તરીકે સ્થાપીને, શાસ રોધતો અને છતાં મારો નાશ અવરોધતો બંગલો ખડો રહ્યો સાથે હુંની સહોપસ્થિતિને એવી રીતે પ્રયોજ છે કે પોતે જ પોતાના નામને દરવાજે ભીતરના ભોગળ બંધ અને પોતે અંધ છતાંથે, જીર્ણ બંગલો એટલે કે હું ખડો રહ્યો એમ કથતા રહીને અંતે જતાં

ઢાંતી સાંજને દરવાજે / આકુલ ખડો રહ્યો  
 / રમતી ચાતેને દરવાજે /  
 વ્યાકુલ ખડો રહ્યો / આકુલ વ્યાકુલ ખડો રહ્યો.

એમ કૃતિનો બંધ વાળ્યો છે.

આરંભથી અંત સુધી, વિભિન્ન ચાર પરિસ્થિતિમાંથી પસાર થતા કાચ્યનાયક, આંખોમાં ઊઘડે દ્વાર / કડડતાં સાથે આપણો પણ જ્યાં જ્યાં પ્રવેશ કરાવે છે ત્યાં ત્યાં એની હાલત તો સતત કથળતી જ રહે છે. આપણો એના સાક્ષી રહીએ છીએ. ઓળખ ના મળી એની જ માત્ર નહીં પણ, જે જે પ્રક્રિયામાં એણે સંડોવાવું પડે છે એમાંથી પણ એને કશું હકારાત્મક મળતું જ નથી ! જાડો કે એના હતપ્રભ પ્રાણ પાસે એવી ગ્રહણશરીલતા જ નથી. બંગલો એક એવા સંકેત રૂપે ઊપરે છે કે એ એક સ્થિતિવશ નિષ્ઠિય અસ્તિત્વ છે અને અંતે જતાં ‘હું’ સાથેનું એનું સાયુજ્ય સુપત નાટ્યાત્મકતા દાખવે તોપણ કશું પરવશ આકુલવ્યાકુલ ખડા રહેવા સિવાય કશું નહીં. નામ એ તો ઓળખ હોવા છતાં સ્થિતિવશ હોવા સિવાય કયાં કશું હાથ લાધી છે ! બસ પોતાના નામના દરવાજે અજાડો બની ખડા રહેવાની નિયતિનો સ્વીકાર એમાં છે.

આ કૃતિ સાતમા દાયકાની દેશગી. સતત કવતા આ કવિ જે પ્રકારની વૈયક્તિકતા ધરાવતા હતા એમાં સીધી સમાજની નિસબત શોધવી એ સાહસ કહેવાય. અહીં શહેર સીમ અને

બંગલાના જે સંદર્ભો છે એ જાણે કે શહેર, ગામથી એક પ્રકારનું વેગળાપણું દર્શાવે છે. કવિ-ચેતના જે રીતે અભિવ્યક્તિમાં આસપાસને વણી લે, કાવ્યના પદાર્થ લેખે ત્યારે એમની વ્યક્તિગતતા સાથે એમના આગવા સામાજિક સંદર્ભ અસંપ્રણાત ધોરણે પ્રવેશે તો ખરાં જ. એ અર્થમાં આ કાવ્ય સ્વકીય વેગળાપણાની એક આંતરખોજના અંશો દાખલતી એક કબૂલાત છે.





## ૧૫. ‘અવાજને ખોદી શકતો નથી’ તथા ‘કવિ લઘરાજુનું ચિંતન’ વિશે

ચંદ્રકાન્ત શેડ

### અવાજને ખોદી શકતો નથી

અવાજને ખોદી શકતો નથી  
ને ઊંચકી શકતું નથી મૌન.  
હે વિખ્લવખોર મિત્રો !  
આપણી રજણતી ખોપરીઓને  
આપણે દાટી શકતા નથી  
અને આપણી ભૂખરી ચિંતાઓને  
આપણે સંધી શકતા નથી.  
તો  
સર્ફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને  
તરતાં મૂકવા માટે  
કૃયાં સુધી કાલાવાલા કરીશું  
આ ઉષરભૂમિની કાંટાળી વાડને ?  
આપણી આંખોની ઝંખાશનો લાભ લઈ  
વૃક્ષોએ ઉડવા માંડયું છે તે ખુંસ  
પણ એય શું સાચું નથી  
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?  
વાગીથરીના નેત્રસરોવરમાંથી  
ખોબોક પાણી પી  
ફરી કામે વળગતા  
થાકી ગયેલા મિત્રો !

સાર્યે જ  
અવાજને ખોદી શકતો નથી  
ને ઊંચકી શકતું નથી મૌન.

### કવિ લઘરાજીનું ચિંતન

ચરણ ચાલ્યા કરે છે  
એટલે ચારણ બન્યો છું ?  
કારણ નથી કોઈ ?  
અને ભારણ નથી કોઈ ?  
તરણ તાર્યા કરે છે એટલે  
તારો બન્યો છું ?  
આરણ અને કારણ બધાં  
છે આમ તો  
ચકો મનોરથનાં  
તૂટેલાં !

ધાર ચય્યાની અરે ચીરી શકે ના કંઈ,  
સૂકાલંઠ શબ્દોથી જખડતી  
વાટકી આ હાથમાં.  
મને આપો અમી-ની ચ્યાલી, ઓ ચ્યારા પ્રભુ  
હું પી જવાનો છું નહીં તો પાપને,  
પાપના પ્રાસે  
શકું જેંચી અનાદિ આપને.  
તાર કાચો  
તૂટતાં તૂટી જવાનો છું  
કાચનો ચ્યાલો કદી ઝૂટતાં પ્રભુ  
ઝૂટી જવાનો છું.  
ઉલેચાતો શબ્દ,  
ક્યાંક તો ખૂટી જવાનો છું.  
અને તૂટી જવાનો છું  
કિયાના

કર્મથી  
 નામના વ્યયથી  
 વિશેષજ્ઞાથી  
 આમ-થી ને તેમ-થી  
 તે-થી અને છે-થી  
 છે અને છુંછા થકી.  
 હેલ જૂની છે ને વાંકી ધૂસરી  
 ચડે બેસે ને વળી ઊતરે  
 ખખડતી ખેંચે કવિતા કોણ ?  
 ચૂંચવે છે ચરણ કોણા ?  
 ચારણ બનીને કોણ આ  
 ચાલ્યા કરે છે ?  
 આરણ નથી કારણ નથી,  
 ને છિતાં  
 ખખડતી ખેંચે કવિતા કોણ ?

પ્રિય યોગેશભાઈ,

આપણા એક વરિષ્ઠ કવિ લાભશંકર ઠાકર વિશે ‘પરબ’ દ્વારા વિશેષાંક કરવાનો ઉપક્રમ વિચાર્યો તે માટે સંપાદક તરીકે તમને તેમ જ ‘પરબ’ જેનું મુખપત્ર છે તે સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ્ધને અભિનંદન ઘટે છે.

લાભશંકરનાં બે કાવ્યો વિશે આસ્વાદલેખ લખવાનું તમે મને સૌંઘ્યું તેનો આનંદ જરૂર છે, પણ એ ખરેખરો પડકાર છે એમ મને લાગ્યું છે. લાભશંકરની ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ની કાવ્યમાધુરીનો – લયમાધુરીનો મને નશો હતો અને આજેય છે. લાભશંકરે સતત મને એમની કવિતાના વર્તુળમાં રહું એવું કરેલું, તેથી પ્રસંગોપાત્ર, એમની કવિતા વિશે અત્રતત્ત્વ બોલવા-લખવાનુંયે બાચ્યું. ‘રે’ મધે જાયારે કવિતાને સમજવાની બાબતનો વિરોધ કર્યો ત્યારે એ વિરોધનો વિરોધ કરવાનું મેં તેમ જ રધુવીરભાઈએ પણ મુનાસિબ માનેલું એવું મને સમરણ છે. કાવ્યને ‘ઝીલ’ કરવાની – સંવેદવાની વાત મહત્વની હતી અને આજેય એ વાત મહત્વની છે જ; પરંતુ કાવ્યને સંવેદીને સમજવામાં કોઈ તકલીફ ન આવવી જોઈએ. કાવ્યને સમજવા માટેની બુનિયાદ પણ કાવ્યના ભાવન-સંવેદન સાથે અનિવાર્યતયા સંકળાયેલી હોવાનું મને લાગ્યું છે.

આ પણ્ણેક્ષયમાં પહેલાં તો હું વાત કરું છું લાભશંકરના ‘અવાજને ખોદી શકતો નથી’ એ કાવ્યની એ અછાંદસ કાવ્ય છે પરંતુ આપણા એક ઉત્તમ વાગ્યોયકાર શ્રી ક્ષેમુભાઈએ તેમને સરસ રીતે સ્વરબદ્ધ કરીને ગેયસ્વરૂપે તરતું મૂકેલું. એ રીતે એ કાવ્ય ગેયતાની દસ્તિએ

પણ કર્ષરસાયણની ચીજ બની શકેલું. લાભશંકરના મુખેય એકાવિક વાર મેં એનું પઠન થતું સાંભળેલું. એક આદના 'પ્રોક્લિસિં પોઅર્ટ' તરીકે તેમની આ કાવ્યમાંની ચાલેને પકડવા-સમજવાનો પ્રયાસ પણ અનેક વાર કરેલો; પરંતુ આજેય એમાં પૂરેપૂરો કામયાબ થઈ શક્યો છું કે કેમ એની મને શંકા છે. પ્રસ્તુત કાવ્યમાંથી જીવનતત્ત્વનું રહસ્ય પામવા માટેનો ઉત્કટ અભિનિવેશ દાખવનારા આપણા પ્રિય કવિનો પદકમ જેટલો પામી શકાય એટલો પામવા મથીએ. મને તો એ મથામણ જ કોઈ કોષ્ટકો ઉકેલવાના પ્રયાસ જેવી લિજજતદાર લાગે છે ! લાંઠાની આ રચનામાંથી કેટલું અંકે થઈ શકે એવું છે એનો તાગ કાઢવાની આ એક કોશિશમાત્ર છે. દેવદૂતો જ્યાં પગલાં માંડતાં ડરે ત્યાં ધૂષ્ટપૂર્વક પ્રવેશ કરવાની આ ચેષ્ટા છે.

કવિ આ કાવ્યનો આરંભ કરે છે 'અવાજને ખોટી શકાતો નથી' – એ ઉક્તિથી અને એની સાથે જ સાંકળી દે છે મૌનને – ઊંચકી ન શકાય એવા ભારેખમ મૌનને. અહીં જે 'અવાજ' છે તે 'કવિતાનો અવાજ' છે. કવિતાનો એટલે સર્જકચેતના શબ્દચેતનામાં રૂપાંતરિત થતાં પ્રગટેલો અવાજ. આકાશના ઊંડાણનો તાગ લઈ શકો તો જ અવાજના તળિયાનો તાગ લઈ શકાય. સર્જકની તો સતત ખેવના રહેવાની ખોજની – અતાગનો તાગ મેળવવાની, પોતાના અસિત્તવના છેડા પામવાની; પણ એ બાબતમાં સર્જકનો પુરુષાર્થ પૂર્ણતાએ પહોંચશે જ એમ કહી શકતું નથી. આત્મભનન ('ચેલ્કઅંકરસ્લોરેશન') ભલે ચાલે; સર્જકનું આત્મભનન ચાલતું પણ જોઈએ, પણ એમ કરતાં હાથમાં કોઈ આંબળું આવી જશે એવું મુશ્વતાથી માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. આ કવિને જીવનની વાસ્તવિકતાની પાકી ખબર છે. જીવતરમાં વેદનાનો વ્યાપ કેવો ને કેટલો હોય છે તેનોય અંદાજ એમને છે. તેઓ સાચા કવિ હોવાથી શબ્દની શક્તિ જો જાણે છે તો તેની મર્યાદા પણ જાણે છે. મૌનનો કેવો ભાર અને તેની લ્લાંસ હોય છે તેનો પણ એ આ સંવેદનશીલ કવિને અંદાજ છે. શબ્દને સહારે કવિ પોતે પોતાને કેટલા પામી શકે એ પ્રશ્ન પેચીદો છે જ. મૌન પણ કવિને ભારેખમ લાગતું હોય. એમાં મદદરૂપ થાય એવું નથી. સંભવત: તેથી તે મૌનનો મુંગારોયે કેમ વેઠવો – એ પણ પ્રશ્ન ! કવિ આત્મબંધુઓને – પોતાના વિપ્લવખોર – બંડાઓર મિત્રોને એ દસાવવા માગે છે કે આપણે આપણું ધાર્યું બધું કરી શકવાના નથી; આપણે આપણી વેદનાના રંગ રંગાયેલી ભૂખરી ચિંતાઓથી ચિરાવાનું રંઘું છે તેમાંથી ઊગરી શકાય એવી આપણી નિયતિ પણ કદાચ નથી. કવિતા પણ આપણને આપણી પાચાની આવી ઘણીબધી ઉલ્ગ્નામાંથી ઉગારી શકે – મુક્તિ આપાવી શકે એવું લાગતું નથી. એ રીતે કવિની સંપ્રક્ષતા જ એના માટે વેદનાકર બની રહે છે. આપણને – કવનકર્માઓને કદાચ સફેદ હંસ જેવાં મીઠાંમોહક સ્વખ્નો જો આવે તો તે ગમે પણ એવાં સ્વખ્નોને પણ આપણે યથેચ્છ રીતે સેવી શકીએ, સિદ્ધ કરી શકીએ એવું કહી નહીં શકાય; કેમ કે, આપણે ઊષરભૂમિની કંટાળી વાડથી ઘેરાયેલા છીએ.

આપણને વિભસ્યો ગમે. જે સ્થગિત છે તે જો ગતિ પકડીને વિસ્તરે તો તે પણ ગમે. આપણને કલ્યાણવિહારનો આનંદ માણવો પણ ગમે; પરંતુ ગમવાની બાબત એક છે ને નઠોર

નકરી વાસ્તવિકતાઓનો અનુભવ અલગ છે. આપણાને ખરેખર જે દેખાવું જોઈએ એ દેખાતું નથી, જે આપણી ઈચ્છાનુસાર અનુભવમાં આવતું જોઈએ એ આવતું નથી અને આપણાને આપણી મર્યાદાનો કંટાળો ને કડવો ખ્યાલ પીડ્યા કરે છે; આપણાને આંખો આપીને છેતર્યા હોય, જીવન આપીને ફસાવ્યા હોય એવો ભાસ થયા કરે છે. કવિતાનું કર્ય વરદાનરૂપ છતાં વેદનાને કારણે સર્જકસ્વભાવને અભિશપ્તરૂપ પણ લાગે તો નવાઈ પામવા જેવું નથી. કવિતા કર્યા કરો, શબ્દોના થર એક પણી એક વીધ્યા કરો, ચુપકીદીથી ભીતરમાં ઉંડે ઉત્તરો પણ કયાં પહોંચાશો ને કયારે પહોંચાશો તેની કોઈ બાહેદરી નથી, ખાતરી નથી. વાગીશરીના નેત્રસરોવરનું ખોબોક પાણી પીતાં ભલે થોડી પણ તાજગી ને સ્કૂર્ટ જો સાંપડે તો કવિતા દ્વારા આત્મભનનું જ કામ ચલાવવાનું છે; પણ ખબર નથી કવિતાનો સધિયારો, કવિતાનું આચાસન કેટલું સર્જકચેતનાને ઉપકારક કે ફળદારી નીવડશે. કવિની સર્જકચેતનાએ તો શબ્દથી મૌન સુધીના અંતરાલમાં સતત પોતાનું તળિયું પામવાના પ્રયત્નોમાં લાગી રહેવાનું છે; એવા પ્રયત્નોમાં સર્જકનું સહાસ અને તેનો આઝ્લાદ છે તો પારાવાર વેદનાયે છે. ‘મુક્તિ સુધુ મરીચિકા’ની પ્રતીતિ જેમ જીવનના પ્રત્યક્ષ અનુભવમાં તેમ તેની સાથે અવિનાભાવિસંબંધે સંલગ્ન સર્જનમાં પણ થતી રહેવાની ! અન્યથા કા ગતિ: ?



લાભશંકર કાવ્યસર્જનની પ્રક્રિયાને કેવી રીતે લય, કલ્પન આદિના કીમિયાથી પ્રત્યક્ષ - મૂર્ત કરે છે તે જેમ ઉપરના કાવ્યમાં તેમ તેમના આ બીજા કાવ્ય ‘કવિ લઘરાજીનું ચિંતન’માંથી પણ પામી શકાય એમ છે. ૧૮૮૭માં લાભશંકરે ‘લઘરો’ નામનો કાવ્યસંગ્રહ આપ્યો. એમાં લઘરા વિશે વાત કરતાં લઘરામાં ‘મોડન મિથિફિકેશન’ હોવાનો એમણે સંકેત કરેલો. દરેક વ્યક્તિમાં બારીક રીતે જોઈશું તો લઘરાનું કોઈ ને કોઈ ગુણવક્ષણ જરૂર જડશે. માણસપણા સાથે જ લઘરાપણાનો તાર વાશાઈ ગયેલો જ્ઞાનશે. લઘરો તો લાભશંકરની કવિતામાં કવિના ધર્મકર્મથી - કવિની હેસિયતથી પ્રવેશેલો છે ! એ ચિંતન પણ કરી શકે એવો છે ! એનામાં અસ્તવ્યસ્તતા ખરી તો અસ્વિયત પણ ખરી ! લઘરાના અવતરણમાં સર્જક લાભશંકરનાં જિન્સ હોવાનું વરતી શકાય. લઘરો બદ્ધ છે ને મુક્ત પણ છે. એનું કર્તૃત્વ અનેક નિમિત્તો પર નિર્ભર અને દેખીતી રીતે સીધુસાદું છતાં સંકુલ છે. એની પાસે ચરણ છે તો ચાલ છે ને ચાલ છે તો સાથે એનામાં ચારણાની મતિ પણ પ્રાદુર્ભાવ પામેલી છે. એની પાસે પ્રશ્નાર્થી છે તો એની પૂઠે વિસમયાર્થી પણ જણૂંબેલા છે. જીવનના ગહન કવણમાં ઉંડે ને ઉંડે ખૂંપતાં ખૂંપતાં વધુ ને વધુ કવનની વાગુ-લીલામાં સરતો એ પોતાને વિસ્તારે છે. એની વ્યક્તિચેતના વાડુમય અભિવ્યક્તિના સ્તરે સંચાર પામતાં કેવી કેવી બ્યાકરણાદિ સુધીની રૂપતરેહો ધારણ કરે છે તેનું એક ધ્યાનપાત્ર નિ-દર્શન છે આ કાવ્યરચના. જીવન અને જગતની રહસ્યમયતા, ઓબ્ઝર્વિયર, આક્સિમિક્ટા, સંકુલતા - આવાં આવાં તત્ત્વોનું સંકુલ મિશ્રણ ચાકે ચંડતાં એમાંથી ઉત્તર્યો જગ્ઘાય છે આપણા લઘરાનો પિંડ. લઘરો ચારણ બન્યો હોય તો તે શું ‘ચારણ’-પદના જ કારણે ?

ચરણથી ચાલી શકાયું તેથી ચારણ થવાયું ? લઘરાને મનમાં આવો પ્રશ્ન ઉત્તે છે. તરણ તાર્યા કરે – તરાય તેથી જ શું તરનાર ઉપરાંત તરાવનાર તારો થવાય / જીવન અને કવન વચ્ચે, સંજ્ઞેય અને સંશા વચ્ચે, અટપટા અર્થ અને શબ્દ વચ્ચેના સંબંધોના તારતંતુઓ કેવા તો અટપટા હોય છે તેનો સંકેત આ કાબ્યમાંથી પામી શકાય છે.

લઘરાનું પોતાનું જીવન અને કવન નરસિંહ મહેતાની વહેલ જેવું અખણડખળ છે. જેમાં તેમ કરીને ગાંધું ગબડતું હોય એમ એ ચાલે છે. નથી જરાયે જંપ; નથી સહેજ શાંતિ. પોતાના જીવતરની ચક્કવત્ર ચાલના સતત ચુંચવાટનું આકમણ છે. ગતિ છે પણ ઈજ દિશા નથી. વાણી છે પણ તેથી છે અદોદળી. એમાં પોતાનું કશુંધે સરખી રીતે ફાળી શકાય – વ્યક્ત થઈ શકે એવું નથી. પોતાનું કશુંધે વજન વહીને આગળ વધાય એવું નથી. જીવનમાં ભાસતી નિરર્થકતાની ભીસ છે. જે કંઈ ભરાવો પોતાનામાં, પોતાની વાણીમાં થતો હોય તેને ઉલેચીને કેમ નિવારવો એ પાયાનો પ્રશ્ન છે. લઘરો જે કંઈ વર્થ-નિરર્થક છે તેના ભારથી મુક્ત થવા ઈછે છે પણ એ કંઈ સહેલું નથી. એક તબક્કે રુચિપૂર્વક જે કાબ્ય-કળાનું સર્જન કરવામાં રસ લીધો તેથી હવે નીરસ – કંટાળજનક કે નકામું લાગે છે અને તેથી જ લઘરો ‘ખખડતી ખેંચે કવિતા કોણ ?’ એવો ઉદ્ગાર વેદનાપૂર્વક કાઢે છે. જે એક સમયે થયું તે થયું. તેનો ભાર લઈ સંપ્રતમાં આગળ વધિતું લઘરાને – કવિને હવે ત્રાસદ્યાયક લાગે છે. કવિને કંઈક નવું જોઈએ; અર્થપૂર્ણ જોઈએ, રોમાંચક જોઈએ. એ માટે તો નવી ગિલ્લી લઈ નવો દાવ લેવાનો થાય ! કવિ પોતે જ પોતાનામાંના લઘરાને પૂછે છે કોઈ આરણકારણ ન હોવા છતાં, એનું ભારણ ન હોવા છતાં; ખખડાટ કરે એવી જીણશીર્ષ કવિતાને નરસિંહ મહેતાની વહેલની જેમ ખેંચવાનું કામ કોણ કરે છે ને શા માટે કરે છે ?

જેમ જીવનમાં તેમ કાબ્યાદિ કળાનાં ક્ષેત્રોમાં પણ ખખડધજ વહેલને ખેંચવાનું અર્થહીન વૈતરું કરનારા બદ્ધ ચેતનાવાળા લઘરાઓ મળવાના. સાધ્ય તો સધાય ત્યારે ખડું, પણ સર્જનની સાધ્ય ચેતનાને ભીસનારો સાધનોનો ખખડાટ તેમ જ રૂઢિગ્રસ્ત સાધનાનો દાબદબાવ ત્રાસદ્યાયક થવાનો. આ કાબ્ય એ દિશામાં વિચારવા આપણાને મજબૂર કરે એવી બંજકતાવાળું લાગે છે. સંભવ છે, તમને કે અન્ય ભિત્રોને તે અન્યથા પણ લાગે !

ફરીથી જણાવું કે આ કાબ્યના એકાવિક પઠને મારા ચિત્તમાં પ્રતિભાવ રૂપે જે તરંગો ઊઠાં તેની અહીં રજૂઆત છે. એથી જુદું કે અલગ ભાવનપ્રક્રિયાના ફળ-સ્વરૂપે પ્રગટ થયું હોય તો તે પણ જાણવા-સમજવાની ઉત્કટ તત્પરતા મારી છે જ.

મને આ બે કાલ્પોને મિષે દિંગી સર્જકતા ધરાવતા કવિ લાભશંકરના સાનિધ્યમાં રહેવાની ઉમદા તક મળી તે બદલ તમારો આભાર માની વિરમું.

તમારો સ્નેહધીન  
ચંદ્રકાન્ત શેઠ



## ૧૬. અને ઓફ્સર્ડ કવિતાને સાર્થક થવા ખપ લાગ્યો વ્યાજસ્તુતિ અલંકાર

નીરવ પટેલ

### અને છિટલરને મેં જન્મતાં જોયો છે

અને છિટલરને મેં જન્મતાં જોયો છે.  
એક મનુષ્ય સ્ત્રીના પેટેથી  
મેં અને અવતરતાં જોયો  
ત્યારે હું  
શિરીષના સુકોમલ ઝૂલની મત ગંધથી  
બેભાન બનીને  
આંખ વગરની દીયળની ઊંઘમાં દૂબતો જતો હતો.  
હું અબકિને જાગ્રી ગયો.  
સ્વખની વાતને સ્વખ તરીકે  
કોઈ સ્વીકારતું નથી, પ્રબોધ !  
અને હું ઊંઘમાં પણ ઊંઘી શકતો નથી.  
છિટલરને હું વિક્કારી શકતો નથી  
અને ગાંધીને હું ચાહી શકતો નથી.  
અને તેમ છતાં હું કેટલું બધું હું !  
ભઠ્ઠિયાર ગલીની ચાંપો ખાતાં ખાતાં  
ભિખારીના છોકરાને  
ગજવામાંથી પાંચિયું કાઢીને આપું હું.  
બારા હાંડીના પાયાની ચીકાશ  
માણસને બેસૂધ ન બનાવી શકે ?  
પ્રબોધ !

મધ્યનું સરોવર ન હોઈ શકે ?  
 અથવા મારા માથામાં  
 પાણીમાંથી બરફ બનાવવાનું  
 કારખાનું ન બનાવી શકાય ?  
 તને મને સતત ગાળો દઈને  
 શબ્દોના ચણતરથી ગુંગળાવી દઈ શકો છો.  
 હિટલર બોબડો નહોતો  
 અને આપણો ભાષા-બાજ છીએ, પ્રબોધ.  
 તું તારા નહોરોને તીક્ષ્ણ કરી રહ્યો છે તે માટે અભિનંદન;  
 કેમ કે  
 મેં તો હિટલરને જન્મતાં જોયો છે.

કવિતા મને ગમે છે, કારણ કે અંતતોગત્વા એ માનવકલ્યાણ અને માનવપ્રગતિની વાત કરતી હોય છે. હા, પાશ્ચાત્ય વિવેચકો જેને એસ્થેટિક પ્લેઝર કહે છે અને ભારતીય વિવેચકો જેને આધ્યાત્મિક આનંદ કે બ્રહ્માનંદ કે નિજાનંદ કહે છે તે સૌનો સમાવેશ પણ હું તો માનવ-કલ્યાણમાં જ કરી લઉં છું. એટલે જ જેણે મર્કરની વ્યાખ્યામાં આવે તેવા ૧, ૨, ઉનહિ, બલકે માસેકર-જનોસાઈડની વ્યાખ્યામાં આવે તેવા ૬૦ લાખ વહૂદીઓ સમેત સાચ્યવાદીઓ, યુદ્ધકેદીઓ, શારીરિક વિકલાંગો-મનોરોગીઓ, રોમા-જીબીઓ, આદિવાસી મૂળ નિવાસીઓ વગેરે જેવા બીજા ૫૦ લાખ લોકોને મોતને ઘાટ ઉત્તાર્યા એવા માનવવિકારની પરાકાણાનો પર્યાય બની ગયેલા હિટલર વિશેની આ કવિતા વાંચવા માટે માનવપ્રેમી એવો હું ખાસ આકર્ષણી હું.

માનવજાતને સાવધાન કરતા હોય તેમ કવિએ જાણે શરૂઆત જ ભારોભાર ભયસ્થુચક લાલબત્તી જેવું શીર્ષક બાંધીને કરી છે : ‘અને હિટલરને મેં જન્મતાં જોયો છે.’

વ્યાકરણ થકી આપણે સૌ જાણીએ છીએ કે ‘અને’ તો એક ઉભયાન્વયી અવ્યય છે જે બે શબ્દો અથવા બે વાક્યોને જોડે છે. હવે આ કવિતાની ઉઘાડપંક્તિને જોઈએ : ‘અને હિટલરને મેં જન્મતાં જોયો છે.’ શું કવિને વ્યાકરણ નથી. આવડતું કે એની કશી સરતચૂક થઈ છે કે એણે જાણીજોઈને કે ઈરાદાપૂર્વક અધ્યાત્મર રાખી દીધું છે ‘અને’ સાથે અનિવાર્ય રીતે જોડવું જોઈતું આગળનું વાક્ય ? કદાચ કવિનો આશય છે કે હર કોઈ પોતાની મેળે એ જાણવાનો પ્રયત્ન કરે, અને તો જ એની કવિતાનું કવિને અપેક્ષિત એવું પ્રત્યાયન થઈ શકશે ભાવકરે.

તો ચાલો, પ્રયત્ન કરીએ. કદાચ આપણે જેટલા ગાંધીના નામથી પરિચિત છીએ એટલા

જ હિટલરના નામથી. ૧૮૮૮માં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ ‘હિટલર’ પાડવામાં આવ્યું હતું, તો પછી સવાલ એ થાય છે કે ૧૯૩૭માં, એટલે કે ખાસ્સાં ૪૫ વર્ષ બાદ જન્મેલ આપણા આ કવિએ ડેવી રીતે ‘હિટલરને જન્મતાં જોયો’ હોય ? એના વિશે સાંભળ્યુ કે વાંચ્યું તો એના સમકાળીન ના હોય તેવા આપણે સૌ હોઈ શકીએ ? અલબત્ત, એક શક્યતા બચે છે જેને કવિએ પોતે જ આ પંક્તિઓમાં ઠંગિત કરી છે :

‘હું જબકીને જાગ્રી ગયો.  
સુખની વાતને સુખન તરીકે  
કોઈ સ્વીકારતું નથી, પ્રબોધ !’

ઢીક, કવિએ હિટલરને જન્મતાં જોયો છે પણ સાપનામાં.

ભવે એનું નામ હિટલર પડ્યું હોય, પણ એ જન્મ્યો ત્યારે તો ‘હિટલર’ હતો જ નહિ, બલકે એ પણ હર કોઈ નવજાત બાળકના જેવો ‘પ્રભુનો પયંગબર’ જ હતો ! આપણે જે ‘હિટલર’ને ઓળખીએ છીએ એનો જન્મ તો કદાચ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન (૧૯૩૯-૧૯૪૫) થયો. એટલે કે હિટલરનો જન્મ કોઈ જન્મતાં સ્ત્રીની કૂઝે નહિ, બલકે એન્ટી-હ્યુમન વિચારધારાની કૂઝે થતો હોય છે. આ ઉઘાડંપંક્તિનો વાર્યાર્થ અને લક્ષ્યાર્થ કદાચ આ રીતે બંધ બેસે.

ચાલો, આગળ વધીએ. કવિએ એને ‘એક મનુષ્ય સ્ત્રીના પેટેથી’ અવતરતો જોયો છે. આપણે પણ જાણીએ છીએ કે હિટલર કોઈ ઘાતકી પ્રાણીની કૂઝેથી નહિ, કોઈ લેતી ડ્રેકુલાની કૂઝેથી નહિ, બલકે એક જેન્ટલ લેતી અને મમતાળુ માતા એવી ‘મનુષ્ય સ્ત્રીના પેટેથી’ અવતર્યો હતો. માણસ ‘જન્મતો’ હોય છે, ને ભગવાન ‘અવતાર’ લેતા હોય છે. કવિએ કશી સભાનતાથી આવાં બે કિયાપદો અહીં વાપર્યા હોય છે ? આ કવિતામાં જેમનો ઉલ્લેખ થયો છે તે કવિમિત્ર પ્રબોધ પરીખે ‘રે મહાના વિશોષાંકમાં જે ઢંઢેરો લખ્યો હતો એનું શીર્ષક હતું : ‘હિટલર, ધ ઓન્લી ગોડ’ ! હિટલર ‘અવતરતો’ હતો ત્યારે કવિ શું કરતા હતા ? તેઓ તો ‘શિરીખનાં સુકોમળ કૂલની મત ગંધથી બેભાન બનીને આંખ વગરની ઠયળની જેમ’ ઉંઘમાં દૂબતા જતા હતા !

આ જાણીને હવે તો કવિની જેમ આપણે ભાવકો પણ અપરાધબોધ અનુભવીને કહી શકીએ કે ‘મનુષ્ય સ્ત્રીના પેટેથી’ જ જન્મ પામતા આપણા સાંપ્રત સમયના હિટલરોને આપણે જોયા છે અને ત્યારે કવિની જેમ આપણે પણ માનવી મટી જઈને નરી ‘ઠયળ’ની જેમ કશીક ‘ંધ’ માણવામાં મસ્ત, બલકે ‘બેભાન’ બની રહીને આપણા સમયના હિટલરોને જન્મતા જોઈ રહીએ છીએ !

‘અને’ આગળ જે અધ્યાહર હતું તે જાણો હવે પ્રગટ થાય છે : માનવીમાંથી પત્તિત થઈ ઠયળ જેવા જંતુમાં પરિવર્તિત થતા, નાનામોટા અનેક હિટલરોના જન્મસમયના મૂક સાક્ષી

બની રહેતા આપણ સૌ ભાવકોને આવો અપરાધબોધ કરાવવાનો જ કવિનો આશય હતો કદાચ.

કવિને હજુ આગળ કહેવું છે : એ આ દુઃસ્વખનમાંથી જાણે જબકીને જાગી ગયો છે. એ મિત્ર આગળ પોતાની કરુણ લાચારી લઈને આપે છે : સ્વખની વાતને હડીકત તરીકે કોઈ ન સ્વીકારે એ તો સમજ્યા, પણ ‘સ્વખની વાતને સ્વખ તરીકે કોઈ સ્વીકારતું નથી, પ્રબોધ.’ સ્વખ ક્યારેક વાસ્તવિકતાઓને અવળસવળ પણ કરી કાઢે છે, એક અગોચારના પ્રદેશમાં, એક સરસ્રિયાલિઝમના પ્રદેશમાં પણ લઈ જાય છે. અને ગુજરાતી કવિતામાં કોઈએ હિંમત નહિ કરી હોય તેવી બોલ પંક્તિઓ અચાનક જ ગુજરાતી ભાવકને વીંધી નાખે છે : ‘હિંટલરને હું ઘિક્કારી શકતો નથી અને ગાંધીને હું ચાહી શકતો નથી.’ ગાંધીની હત્યા કરી શકતી હોય કે ગોડસેનું મંહિર બનાવી શકતું હોય, એ દેશમાં એબસર્ડ કવિતાના કવિને આવું કહેવાનો પણ અધિકાર હોય ! બને કે એબસર્ડ કવિતાને સાર્થક થવા ખપમાં આવ્યો હોય આ વ્યાજરતુંનિ અવંકાર !

કોઈને થાય કે ‘કવિ’ શબ્દને એક વિશિષ્ટ આભા પ્રાત થઈ છે, એટલે વિવેચકો પણ ક્યારેક મેજર પોઅેટની શેહમાં આવી જઈને લાચાર ન્યાયાધીશની જેમ બેનિસ્ટિટ ઓફ ડાઉટ આપીને એને બાઈજાત બરી કરતા હોય છે.

કોઈને એવુંય લાગે કે કવિતામાંથી, સવિશેષ એબસર્ડ કવિતામાંથી કંશું પણ નિષ્પન્ન થાય છે કે કેમ એ શોધી કાઢવાની સંઘળી જવાબદારી વાચકને શિરે મૂકીને કવિ તો માત્ર કાવ્યપાઠ આપીને અલોપ થઈ જાય છે. અને પાઠમાં શું હોય છે ? શબ્દો, અટૂલા કે એકબીજા સાથે વ્યાકરણીય અંતર રાખીને ગોઠવાયેલા. અર્થ સમેતના સૌંદર્યથી આભૂષિત. હા, કવિતાને થોડી વધારે સજ્જતાની અપેક્ષા હોય છે એના વાચક કે શ્રોતા પાસેથી. ભાષાનો વારસો તો બેનુંનો એકસરાખો પણ હોઈ શકે, પણ કવિ પોતાની આગળી રીતે કામ લેતો હોય છે એ સહિતારી ભાષા પાસેથી અને ત્યારે એ પોતાના હમજુબાન ભાવકનેય અચંબિત કરી મૂકોતો હોય છે.

ગજલ કે ગીતની અડધીપડ્ધી પંક્તિ સાંભળી નથી કે વાહવાહી કરવા ટેવાયેલા ગુજરાતી ભાવકને તો તમ્ભર આવી જાય એવી આ કંડિકાને સમજવા સવિશેષ આયાસ. કરવો પડે તેમ છે : ‘I do not see why man should not be as cruel as nature.’માં માનતા અને હેવાનિયતભરી હિંસાનું બીજું નામ બની ગેયેલા ‘હિંટલર’ માટે અપરાધબોધ કરાવ્યા પછી આવી પંક્તિઓ ? માની લઈએ કે કદાચ કવિને ગાંધીવિચાર અને ગાંધીઆચારમાં કશી તુટ્ટિઓ જગાઈ હોય. પણ તેમ છતાં ઓવરઅોલ પ્રદાનને લઈ કવિ આનાથી ઊલટી અભિવ્યક્તિ આપી શક્યા હોત તો ભદ્ર ગુજરાતી વાચકને માટે એ કદાચ સહ્ય બની રહેત : ‘ગાંધીને હું ઘિક્કારી શકતો નથી અને હિંટલરને હું ચાહી શકતો નથી’ ? ગાંધીભક્ત ગુજરાતી ભાવકને આવો કૂર આંચકો આપવાની શી જરૂર પડી કવિને ?

કદાચ, એ સમજવા માટે આ કાવ્યપાઠમાંથી બહાર નીકળી આપણે કવિસમયમાં જવું

પડશે. કારણ કે કવિ પણ એના સમયનું ફરજંદ હોય છે.

આપણે સૌ જાડીએ છીએ કે લાભશંકર ઢાકર, આદિલ મન્સૂરી, ચિનુ મોદી, મનહર મોદી, સુભાષ શાહ, રાજેન્દ્ર શુક્ર, મુકુન્દ પરીખ, અબ્દુલ કરીમ શેખ, પ્રબોધ પરીખ અને રાવજી પટેલ જેવા મિત્રો પ્રસ્થાપિત કાવ્યપરંપરાની, એની પ્રચાલિત વિભાવનાની સામે ઉગ્ર ચળવળ ચલાવતા હતા. વિષય અને અભિવ્યક્તિ એમ બેઠ બાબતે કંઈક નવું થવું જોઈએ એનો એ સંદર્ભ હતો. અધિંદસ, ગીત અને ગુજરાતી જેવાં કાવ્યસરૂપો નવાં કલેવર ધારણ કરી રહ્યા હતાં. લાભશંકર પરંપરાના ઈશ્વરમાં માનતા નહોતા, અને કહેતા કે ‘મારા માટે ગુડનેસ ઇસ ગોડ... વિક્કાર એ પણ હિંસા છે, મનુષ્યને વિક્કારવો એ મારો ધર્મ નથી. મનુષ્ય માટે મારી પાસે એક જ ભાષા છે તે પ્રેમની ભાષા છે.’

કાવ્યપાઠ બહારની, આ માહિતી સાથે રાખીને આપણે પુનઃ પાઠમાં પ્રવેશીએ :

શું હિટલર ‘મનુષ્ય’ હતો ? શું એ હિંસ પ્રાઇડીઓથી વધારે હિંસક ‘જાનવર’ નહોતો ?

કે આગળ કહું તેમ હિટલર પણ જન્મ્યો ત્યારે તો એક માનવબાળ જ હતો, એને ‘હિટલર’ એટલે કે જાનવર તો બનાવ્યો સમાજે જ, એ સમાજે જેણે એક માનવસમૂહને બીજા માનવસમૂહથી નીચો-હલકો-પશુતુલ્ય ગણ્યો ? એ સમાજે કે જેણે એક માનવસમૂહને સુપર વ્યુમન ગણ્યો ને બીજાને વેસર વ્યુમન ? કે જેણે એકને બ્લૂ બ્લડનો ને બીજાને બ્લોક બ્લડનો માન્યો ? કે જેણે એકને વર્ઝાશ્રેષ્ઠ માન્યો ને બીજાને વર્ઝાસંકર ?

આપાર માનવપ્રેમ, અપ્રતિમ સહિષ્ણુતા, નિર્સીભ કરુણા અને પારાવાર પ્રબુદ્ધતાને લઈ જન્મેલી ઉદારતાને કારણે માનવીના દુરીતનેય વિક્કારી ન શકતો અને શ્રેયસ-ગ્રેયસનેય પૂર્ણપણે ચાહી ન શકવાની દ્વિધામાં અટવાતો આ એબ્સર્નો કવિ ‘અને તેમ છતાં હું કેટલું બધું છું’ પંક્તિ સાથે જાણે લઘરાની લવરી પર ચઢી ગયો હોય તેમ લાગે. કે આ પણ ભદ્ર-શિષ્ટ કવિતામાં માનતા અહેસામાં માનતા શિષ્ટ-ભદ્ર ગુજજુ વાચકને આંચકો આપવા માટે જ ? એ ભડીયાર ગળીની મટનચાંપો ખાતાં ખાતાં બિભારીના છોકરાને પાંચિયું આપે છે. પોતાના મિત્રને પૂછે છે કે બારા હંડીના પાયાની ચીકાશ માણસને બેસૂધ ન બનાવી શકે ? અને મધ્યનું સરોવર ન હોઈ શકે ? મારા માથામાં બરફ બનાવવાનું કારખાનું ન બનાવી શકાય ? શું આ ભાષા, આ વિચાર, આ કલ્યાન, આ અભિવ્યક્તિ કવિસમયની ભદ્રવર્ગ્ય શિષ્ટ કવિતા સામેના પ્રયોગલક્ષી બળવા રૂપે તો નથી આવી ?

હા, કવિને અમયાદ પોએટિક લાયસન્સ જરૂર હોય છે, પણ એક કેવિયટ સાથે. એ કોઈ પણ ભૌગોલિક કે ઐતિહાસિક કે વૈજ્ઞાનિક સત્ય અને તથ્યથી વિરુદ્ધ જરૂર જઈ શકે છે, પણ એણે એમ કરવા પાછળનું પોએટિક જસ્ટિઝિકેશન તો પૂરું પાડવું જ પડે. પૂર્વમાં ઊગતા સૂર્યને ભલે પણ્ણિમાં ઊગાડે કવિ, કે સાદાય પ્રકાશમાન સૂરજને કાળો સૂરજ ભલે કહે કવિ, પણ એ દેખીતી વિસંગતતાઓને એણે પોતાની કવિતા થકી જ વાજબી તો ઠેરવવાં જ રહ્યાં.

કવિતા પણ એક પ્રમેયની જેમ જ ‘ઈતિ સિદ્ધમ’ થવી જોઈએ. મને આશર્વ થાય છે કે નવલકથા, ટૂંકી વાર્તા, નાટક વગરેના વિવેચન ટાજે ઈરરેશનલ કે અનરીજેનેબલને વખોડતો ગુજરાતી વિવેચક કવિતાના વિવેચન ટાજે લય-પ્રાસ-છંદ-ગ્રયતા-પદ્ધલાલિત્ય વગરેની કેવી મોહિનીમાં સરી પડે છે કે અને ઈણિત પણ નથી કરી શકતો !

સાહિત્યકારોને સલાહ આપત્તાં સાર્વાં પણ કહું જ છે કે અન્યાયો-દુરીઓ પ્રત્યે આપણા આ. કવિની આંખ વગરની ‘ઈયળ’ની જેમ ઊંઘણાશી ના બની રહો, તમારા શબ્દોના પાવક અભિન્થી, તમારા અંતરાત્માના પુષ્યપ્રકોપથી અમને સળગાવી દો, નેસ્તનાબૂંદ કરો, માનવજાતને શોષણ-દમન-અત્યાચારથી મુક્ત કરો.

અંતિમ પંક્તિમાં કવિનાયક આપણા ‘ભાષા-બાજ’ સાથી કવિઓને યાદ કરી, જાડે અનિષ્ટો સામેના કવિર્ધમની યાદ અપાવતો હોય તેમ કહે છે : ‘તું તારા ન્હોરોને તીક્ષ્ણ કરી રહ્યો છે તે માટે અભિનંદન, કેમ કે મેં તો છિટકરને જન્મતાં પણ જોયો છે અને અવતરતાં પણ જોયો છે.’ છિટકર પણ બોલડો નહોતો, પોતાના જેપાની એજન્ડાને કાર્યાન્વિત કરવા માટે એણે તો આખું પ્રોપેગેન્ડા ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું હતું ભાષા થકી જ. એટલે કવિએ પ્રયોજેલા ભાષા-બાજ શબ્દ સાથે ભાષણભાજ-ચાલભાજ-દગભાજભાજ-શકરભાજ-રંડીભાજ-ચૂલભાજ જેવા નેગેટિવ અર્થછાયાવણ શબ્દો પણ વાચકને સહજ યાદ આવે, ને તે પણ ભાષાનો બેજવાબદાર ઉપયોગ કરતાં આ કવિ સમેત સૌ કવિઓ માટે આ કુદ્ધ કવિનું ભાષાકરતબ લાગે.

એસ્ટર્ડ હોય કે સર્વાયિત, લઘરા કવિની લવારીનેય વાચકે કદી નિરર્થક નહીં માનવી જોઈએ. કપરા વાસ્તવે એની સંવેદના અને વિચારોને એવાં તો છિન્નભિન્ન કરી કાઢવા હોય છે કે એની અભિવ્યક્તિ ટાજે બીટવીન ધ લાઈન્સ વાંચવાથી જ ‘કવિતા’ જેવું કશુંક મળે છે વાચકને.

## સાભાર સ્વીકાર

### જીવનચિત્રિત્ર

(૧૮૪) મારી જીવનયાત્રા : એ.પી.જે. અબુલ કલામ, અનુ. : ખ્યાતિ બારોડ, ૨૦૧૫,  
આર. આર. શેઠ ઓન્ડ કંપની પ્રા. લિ. મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૧૮, રૂ. ૧૨૫ (૧૮૫) ભારતરાન  
સચીન તેલુકર : જગદીશ શાહ, ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૧૬+૨૧૬,  
રૂ. ૩૦૦



## ૧૭. 'કવિવર નથી થયો તું રે' વિશે

હરિદ્રષ્ણ પાઠક

### કવિવર નથી થયો તું રે

કવિવર નથી થયો તું રે  
શીદને ગુમાનમાં ઘૂમે ?  
લઘરા, તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ  
આંસુમાં પવળેલા શબ્દો  
શબ્દો પાણીપોચા  
પાણીપોચાં રણ રેતીનાં  
પાણીપોચા રામ  
પાણીપોચા લય લચકીને  
ચકવાકને ચૂમે  
કવિવર નથી થયો તું રે  
શીદને ગુમાનમાં ઘૂમે ?

લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મરછર  
એ મરછરની પાંખો ફંકડે  
શબ્દો તારા થરથર થથરે  
ફંકડાટોની કરે કવિતા  
કકળાટોની કરે કવિતા  
પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર ઝૂમે  
કવિવર નથી થયો તું રે  
શીદને ગુમાનમાં ઘૂમે ?

શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે  
 વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે  
 અરે, ભલા ! શીદ પરસેવાનું કરતો પાણી પાણી ?  
 તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણો.  
 શબ્દો છોડી ખેતરને તું ખેડ  
 ડિ.ડિ.ડિ. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.  
 શબ્દોનો સથવારો છોડી  
 લય લંપટના તંતુ તોરી  
 ઘર-અંગાજિયે શાકભાજને વાવો  
 કવિવર ! વનસ્પતિ હરખાય અશું કેં પ્રેરક સંગીત ગાઓ  
 અને જુઓ આ રોંગાજ મરચાં ગલકાં તૂરિયાં  
 આંખ સમીપે લટકે લૂમે લૂમે  
 કવિવર નથી થવું તારે  
 શીદને વિષાદમાં ઘૂમે ?

વૈષ્ણવ નથી થયો તું રે  
 શીદને ગુમાનમાં ઘૂમે ?

મધ્યકાલીન કવિ શ્રી દયારામના જાણીતા પદની પ્રથમ બે પંક્તિમાંથી આરંભનો એક  
 જ શબ્દ બદલીને કવિશ્રી લાભશંકર ઠાકર ભાવકને મધ્યકાલીન ભાવજગતમાંથી ઊંચકીને  
 આધુનિક કવિતાના વિશ્વમાં લાવી મૂકે છે.

કવિના ‘લઘરા’ જૂથનું આ એક મનભર કાવ્ય છે. આપણે જાણીએ છીએ કે અભિવ્યક્તિ  
 માટે, ભાષાસામર્થ વિશે, શબ્દ વિશે અશ્રદ્ધાનો ભાવ જાગતાં કવિ હાસ્ય-કટાક અને વિંબનાનો  
 એવો તો વિનિયોગ કરે છે કે કવિ સ્વયં ભલે એવું કહે – ‘ડોલ શબ્દની કાણી રે’ – આપણાને  
 તો પ્રતીત થાય છે કે આ કવિના શબ્દની ડોલ તો કાણી નથી જ નથી.

પ્રસ્તુત કાવ્યમાં ‘કવિવર’ થવાનો મનોરથ સેવતા કે થઈ બેઠાની ભાંતિમાં રાચતા  
 ‘લઘરા’ને સંબોધીને કવિ જે કંઈ કથે છે તેમાં મૂળનો પદબંધ ભલે સાચાંત જાળવતા નથી,  
 ને તે અનિવાર્ય પણ નથી, હતાં આરંભના લયબંધ સાથે સંવાદમાં રહેતો પરંપરિત પદ્યલય  
 કશા ખાંચા-ખચકા વિના સચવાયો છે ને વધારામાં ટેકની પંક્તિઓમાં જે પ્રાસયોજના સર્જ  
 છે તે તો પ્રેમાનંદની હાસ્યસર્જનની શક્તિની યાદ અપારે તેવી છે.

આમ પણ કવિએ પોતાના સર્જન વિશે ‘આંતરકથામાં’ જે કંઈ કદ્યું છે તેમાં પોતાના

ચિત્તમાં રસાઈ ગયેલ લયચેતનાને એક મહત્વનું પાસું ગણેલ છે, અને કવિતા માટે તો ‘શ્રવણસંપદા’ જેવી ઓળખ પણ આપી છે.

અહીં જે પાત્ર-વિશેષ છે ‘લઘરો’ તે કોણ ?

કવિશ્રી ચિનુ મોડીના મતે કથા, નાટક, આધ્યાત્મિક વગેરેમાં અનિવાર્યપણે હોય તેવું આ પાત્ર નથી; તો ડેવળ હાસ્યના પ્રયોજન માટે સર્જયેલ પાત્ર પણ નથી જ. અન્ય સર્જકોએ સર્જલ-મગન, અમથાલાલ, ચંદુદિયો, ઓછવલાલ કે લેંચ્યુલ્યથીયે અલગ એવું પાત્ર છે – લઘરો. કવિને ખુદને પરંપરાએ પકડાવેલ ગૃહીતોને તાટસ્થાપૂર્વક જોવા-જોગવવા માટે ને ખુદનીયે ખણખોદ માટે આબાદનો ‘લઘરો’ જરી ગયો છે, અને વળી પરંપરાના પદફળનો નવેસર ઉપયોગ કરીને આ નવી વાતને વધુ સ્વીકાર્ય-આવકાર્ય બનાવી છે.

દ્યારામના પદમાં તો ‘ઘેણવ’ થવા માટે શું શું હોવું ને થવું ઘટે અને શું શું ન હોવું ઘટે તેનાં ઉદાહરણો ચીંધાયાં છે; અહીં તો જે ‘કવિવર’ થયો નથી ને થવાનોય નથી તેને નિર્ભાત કરવાનો ઉપકમ રચાયો છે – પ્રમાણો આપીને, ન તિક્કલ્ય પણ ચૂચવાયો છે. આંગળમાંથી અવિરત ખરતાં આંસુનું તેમાં પલળીને પાડીપોચા થઈ ગયેલ શબ્દો તો ખરા જ, સેતીનાં રણ પણ પાણીપોચાં ને છેલ્યે તો ‘પાડીપોચો લય લચકીને ચકવાકને ચૂમે’ તેવી સ્થિતિ દર્શાવી છે. પાડીપોચા લયની ઉડાન એવી ડેમ હોવાની કે ચકવાકને – પણીને પણ ચૂમે ? પહોંચની બહાર છે તેને પામવાના ઉધમાતાનો આ સંકેત છે. વધારામાં ચેતલવેડા તરફ પણ આંગળી ચીંધાઈ હોવાનું સમજાય. ‘લઘરો’ કવિની એક બીજ્યે મુશ્કેલી છે. કાનમાં પેસી ગયેલું મચ્છર તો મરેલું છે, તેના ગણગણાટનું સંગીત પણ રહ્યું નથી. મચ્છરની ફક્ફડતી પાંખોની માફક ‘કવિવર’ના શબ્દોય થથરે છે, પણ બીજું તો શું થાય ? ! ‘ફક્ફડાટોની કરે કવિતા / કકળાટોની કરે કવિતા’ દ્વારા કદાચ કાચેતર હેતુઓ માટે ખુદ કાવ્યકલાને ગાજરની પીપૂડી સમજને પ્રવૃત્ત થનારનો સંકેત અહીં વાંચી શકાય.

‘પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર જૂમે’ એ ટેકના પ્રાસની પંક્તિમાં બે ઇનિતો પડચાં છે. ‘ભાવજગત’ એટલે કે ‘ભાવનામયતા’ કવિ લાભશંકરને મિથ્યા લાગી હશે. અને આનંદ પ્રગટ કરવા માટે યોગ્ય ગણાય એવું ક્રિયાપદ ‘જૂમે’ મૂકીને ‘લઘરો’ની અણસમજ પ્રત્યે ઇશારો થયો છે. ‘ભય’ અને ‘જૂમે’ એકસાથે કેવી રીતે હોય ? અહીં સુધી આવ્યા બાદ કવિ ‘લઘરો’ને યથાર્થ સમજ આપીને સથિયારો પણ બંધાવે છે.

‘શહીદ બનતાં બરી ગયો તું ખડક શબ્દના ખોડે  
વાણીના પાણીની મનમાં પરબ મંડતો મોઢે’

– અહીં ‘શહીદ’ શબ્દ તો હાસ્ય પ્રેરે જ પણ ‘મોઢે’થી સર્જતો મર્માણો વિનોદ આત્મતુષ્ટિમાં રાચનારાઓએ તો સમજવો રહ્યો.

‘લઘરો’ને આટલી સમજ આપ્યા પણી કાવ્યકલાની અસાધ્ય ઉપાસના છોડી દેવા

આપેલી શીખ પણ મોં મલકાવી દે તેવી મર્મણી છે -

‘અરે ભલા ! શીદ પરસેવાનું કરતો પાણી પાણી ?

તું તરસ્યો છે એવી સાચી વાત હવે લે જાણી...’

માણસમાત્રમાં એક લોકેષણ રહેલી હોય છે તે વાત અહીં કહેવાઈ ગઈ છે; ને પછી શબ્દબ્યાધામ છોડીને જેમાં કશીક સ્થૂલ પ્રાપ્તિ તો થઈ શકે તેવું ફલદારી કામ વિકલ્ય રૂપે સૂચવે છે.

‘શબ્દો છોડી ખેતરને તું જેડ

તી.ડી.ટી. છાંટીને ઘરમાં અનાવિલને રેડ’

(“અનાવિલ એ કોઈ શાંતિ નહીં, કશુંક શુદ્ધ, કશું નિર્મળ—”)

તેના અનુસંધાને લય-લંપના તંતુ તોડવાની વાત પૂર્તિરૂપ બને.

અને પછી પ્રાપ્તિ તો જુઓ :

‘અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં

આંખ સમીપે લટકે લૂમે લૂમે

કવિવર નથી થવું તારે

શિદને વિષાદમાં ઘૂમે ?

આમ કાવ્યને અંતે કોઈપણ લઘરો, જે કવિવર થવા સર્જાયો જ નથી તેને ઝોગટ વિષાદમાંથી બચી જવા કહે છે -

‘કવિવર નથી થવું તારે...’

પંડને પામવા ને અભિવ્યક્ત થવા માટે શબ્દ સિવાય કશું માધ્યમ નથી ને એ પણ અપર્યોગ - એવી પ્રતીતિમાંથી પ્રગટેલાં ‘લઘરા’ જૂથનાં કાવ્યો પૈકી આ પણ એક મનભર કાવ્ય છે.

## સાભાર સ્વીકાર

### લેખો

(૧૮૭) રવીન્દ્રનાથ યાગોર : ભોગાભાઈ પટેલ, સંકલન : તોરલ પટેલ, ૨૦૧૫, રંગદાર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮૪૫, રૂ. ૪૦૦ (૧૮૮) ભારતીય નવલકથા પરંપરા અને ગ્રામ કેન્દ્રી નવલકથા : ભોગાભાઈ પટેલ સંકલન : વીરેન્દ્ર નારાયણ સિંહ, ૨૦૧૫, રંગદાર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૨૬૦, રૂ. ૨૦૦



## ૧૮. 'स्तवन' વિશે

રમણ સોની

### સ્તાવન

ગો વિના તો વણ કિમ જવિ વણ વારિ કિમ મીન ?  
આભ વિના પંખી નવ જવિ શબ્દ વિના હું દીન.  
તુંય વિના હું કહિ પિરિ જીવું ? અદીઠ અપરંપાર !  
આશા મોટી તાહારી મુજનિ જીવું તુજ આધાર.  
અહરિનિશ તુજ સ્વર સાંભળતો તોથ કશો હદબાર,  
મુખનું મહોરું હઠાવી મોહન દિયો દરસ દરબાર !  
કાશુ એક તારા વિના ન ચાલે, અકળવિકળ તુજ ફેંડ.  
પલપલ તુજને આરાધું શે, છૂટે ન તારો છંદ ?

આ કાવ્ય પહેલી વાર ચાળીસ વરસ પહેલાં વાંચેલું. એ પછીય કેટલીક વાર વાંચવાનું થયું હશે. પણ આજે લખવાનું થયું છે એના વિશે, ત્યારે થયું કે સૌથી પહેલા વાચનનો કોઈ પ્રતિભાવ સમરણમાં સચ્યવાયો છે ખરો ? ગમેલું, એ સિવાય વિગતો તો કોઈ યાદ નથી – માત્ર, ‘અકળવિકળ તુજ ફેંડ’ એ મનમાં જરાક વધારે છિપાઈ ગયેલું – પણ ત્યારના લાભશંકર, એમની અ-રૂઢ કાવ્યછટાઓનો રોમાંચ થતો એ યાદ છે. છેક ૧૯૬૫ પથી, એમના ‘...રમ્યઘોષા’ સંગ્રહનાં સુડોળ શિષ્ટ છંદ-કાવ્યોથી અને કટાવમાં દોડતાં-ઉિછળતાં તોઝાની કાવ્યોથી લાભશંકરની હંદે કવિતાનો પરિચય થયેલો. એ દિવસો જ અમારા કાવ્ય-ચાકચૂર્યના ! એ પછી ધીમે ધીમે કાવ્ય-ચીકાશ ને ખણખોદ-મૂલ્યાંકન આવતાં રહ્યાં, પણ કાવ્ય-પ્રીતિ અકબંધ રહી. એટલે લાભશંકરની તે વખતે દિશા-દિશામાં હરણફ્ઝાળ ભરતી કવિતા ગમે; ગુજરાતી કવિતાનો મુખ્ય અવાજ બનતા ગયેલા કવિની કાવ્યછટાઓય ગમે, ક્યારેક નયે ગમે; વળી કાવ્યછટાઓને મિષે જયારે લાઠાં, કવિછટાઓ-સ્ટાઇલો-મારતા જગાય ત્યારે એ પ્રિય કર્તિ પર જરાક ખીજ ચેકે, ને પછી તરત રમૂજ થાય – એમણે ક્યાંક લખેલું કે, ‘હું પછી દીધે રાખું છું?’ એની

નીચે સહી કરવાનું મન થઈ જાય ! પછી વળી થાય કે કવિ દીવિ ન રાખે તો તો કાગળો કોરા જ રહી જાય; અર્થાતું, આ મુહરોક્તિ પાછળ કવચિતુ મર્મોક્તિ પણ સંભળાય. જોકે પછી તો લાભશંકરે બહુ લખ્યું બહુ લખ્યું બહુ લખ્યું ! અમે પાછળ રહી ગયા, એટલે કે એમના શરૂઆતના (ઇસ્સાત ?) કાબ્યસંગ્રહોના જ પ્રેમમાં પડ્યા રહ્યા – હા ‘પ્રમત્તાવસ્થામાં નજર પણ’ નાખી એમની પછીની, છેક લગીની, કવિતા પર, કંઈક કંઈક...



આ કાબ્ય પર લખવાનું આવ્યું એટલે ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪; અને આ બીજું આવૃત્તિ ૧૯૮૬)નાં બધાં જ કાબ્યોમાં લયાર લગાવી. અતે સમીક્ષા કે સર્વેક્ષણ નથી કરવાં પણ આ સ્તવન કાબ્યના એક પાર્શ્વ દશ્ય તરીકે આ સંગ્રહ પર નજર કરું : એમાં ૪૦ રચનાઓ છે, ૧થી ૪૦ એમ આંકડાબદ્ધ છે. આ સંગ્રહમાં ત્રણ જ પંક્તિ અને નવ જ શરૂઆતનું (કહે જોઈએ ?) એક સૌથી નાનું કાબ્ય છે, ને ૭૮ કમવાળું કાબ્ય, અ, સ્વ, ક, ખ, એવા વિભાગો દ્વારા, ૭ પાનામાં વિસ્તરેલું સૌથી લાંબું કાબ્ય છે. કોઈ કહેશે કે આવી વિગતો આપવાનો શો અર્થ ? તો કે લાભશંકરનું આવું જ છે. આખી ચોપડીને છૂટી પાડીને, પાનાં જો લાઈનસર ગોઠવીએ તો ટૂંકી-લાંબી રચનાઓની એક કાર્ડિયાગ્રાહિક આકૃતિ બને ! વળી એમાં અદ્ભુત ને વળી અનદ્દભૂત એમ બંને જાતની રચનાઓ છે – મજા તો સંણગ આવ્યા જ કરે...

હવે આ સ્તવન કાબ્યમાં ‘શર્બટ’ અંગેની જે એક સંવેદના છે એ ‘બૂમ કાગળમાં કોરા’ની અનેક રચનાઓમાં કેવા કેવા મૂડ ધારણ કરીને આવી છે ! આ બદલાતા મૂડ, તત્કષણ સંવેદનો, લાભશંકરની કવિતાનું એક સ્થાયી લક્ષ્ણ છે. જુઓ : જાણિતું, ને આજ લગી એવું જ તરફું ને સમર્થ રહેલું કાબ્ય – ‘ડેલ શર્બટની કાણી રે...’ અને તરત બીજું એવું જ માર્મિક ‘શર્બટ /વિશેષણની ચાદર ઓડીને ઊંઘી ગયો છે ઘસઘસાઈ/જગાઉં એને ?’ અને આગળ, આપણાને, વાંચનારને આરંભે જ બેવડો ધક્કો આપતી રચના-પંક્તિઓ છે : ‘શિરાઈ ગયો છે શર્બટ લોહીલુહાણ,’ અને આવી પોથેટિક પંક્તિ પૂરી થતાં જ કવિ એક ઝાટકે આ લથપથ લાગણીમાંથી બહાર કૂટી આવે છે. કહે છે. (અનો) ‘કયા અંગલથી ઝીટો પાડું ?’ સંગ્રહને લગભગ સાવ છીએ એક રેઅંકન છે : ‘શર્બટની સપાટી પર કરચલીઓ પડવા માંની છે.’ છેલ્યું કાબ્ય શીર્ષકવાળું છે : ‘કવિનું મૃત્યુ’. પણ એ શીર્ષક કાબ્યનો જ એક અકાટ્ય અંશ છે. વાંચીએ : ‘ઝંધાતા ગળામાંથી ઊંચકાઈને / ફંડડતા હોઈ સુધી આવેલો / સૂક્ષ્મ કચડાતા પાંદડા જેવો / શરૂઆતોનો અસ્પૃષ્ટ લય / જરાક ઢોળાયો / અને...’

પહેલા, સ્તવન કાબ્યથી ફરી શરૂ કરીએ તો – ‘... શર્બટ વિના હું દીન.’ હવે, આટલી બધી વાર લગાડીને, મૂળ સ્તવન ફૂતિની રચના પર આવું.

કાબ્ય બેચાર વાર ન વાંચીએ ત્યાં સુધી એ ‘આપણું’ થતું નથી – કાં તો પ્રિન્ટિંગ પ્રેસનું રહી જાય છે કે પછી કવિનું જ રહે છે. અને આપણે, જૂના જમાનામાં કહેવાતું એમ, ‘કવિને શું કહેવું છે ?’ એમાં ને એમાં જ ફસાવેલા રહીએ છીએ...

કાવ્યની શર્બટરચના, આરંભે છેક જૂની ગુજરાતી પહોંચી જાય છે ને ૧૭મી સદીમાં પરબ્ય જૂન-જુલાઈ, 2016

પસાર થઈને આજની ગુજરાતી સુધી આવી જાય છે. કવિ-સ્તવન-પરંપરાનો આખો સમયપટ એકસાથે ઉઘડે છે. પણ પણાં પરનું તીર નવું/જુહું છે. દોહરો પણ જાણીતો છે – હેમચંદ્ર-ઉલ્લિભિતથી લઈને લાભશંકર (આદિ આધુનિક કવિ)-લિભિત સુધી.

સ્તવન જાણીતા દષ્ટાંતથી શરૂ થાય, ને પછી, કવિ-કિમિયો આવે, એ મધ્યકાળીન રીતિ કવિએ સ્વીકારી છે. અહીં પણ એવાં જાણીતાં દષ્ટાંતો છે અને એ પંક્તિ લયપૂર્વક વાંચવાની મજા પડે છે : ‘ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન ?’ ‘આભ વિના પંખી....’ એ ચરણથી કવિ પોતે પ્રવેશે છે – કવિનો આર્ત ને આર્ડ્ર સ્વર ઉઘડે છે : ‘શબ્દ વિના હું દીન.’ ‘મીન’ સાથે એનો પ્રાસ છે તે પેલા તરફડાટને સંભળાવી જાય છે. પ્રાસ ખાતર પ્રાસ તો આપણી (કે કોઈ પણ) ભાષામાં ઢગલાંધ હોય છે. પણ મર્મ વિના પ્રાસ ઝીગટા...

બીજો દુહો પહેલામાંથી ધ્વનિનીંતુઓ લઈને રચાયો છે : ‘તુંય વિના હું કહ્લિ પિરિ જીવું ?’ એ ચરણ વાંચતાં જ ‘શબ્દ વિના’/‘તુંય વિના’ તથા ‘વછ કિમ જીવિ’/‘કહ્લિ પિરિ જીવું’ એવા તાણા/વાણાને ગુંથતો ભાતીગળ લય સંભળાય છે અને દેખા છે સ્તવનનો આરાધ્ય – ‘તું’. દેખા હે છે એટલે કે છે, અનુભવાય છે; ભવે ‘અદીઠ’ છે પણ ‘અપરંપાર’ છે.

આમ તો, પરંપરાગત સ્તવન(કાવ્ય)ના ઘણા ઘટકો અહીં હાજર છે. મધ્યકાળીન ભક્તિ-સંવેદન વાંચવું હોય તોય વાંચી શકાય એવું ચરણે-ચરણે સામે મળે છે. કશું તારવીને ટંકવાનીય જરૂર નથી. કદાચ કોઈને ‘અકળવિકળ તુજ ફેદ’માં આ કવિ આધુનિક સર્જક તરીકે ફૃયાતા હોય એવું ઘડીક લાગે, પણ તરત સ્મરણમાં નરસિંહ મહેતા જબકે – હા, નરસિંહ એમના આરાધ્યના અકળ અને વિકળ એવા સકળ ફંદની વાત અનેક વાર કરી છે.

પણ રચનાના ગુંફ વચ્ચે કાવ્યાનું સંવેદન-કેન્દ્ર છે શબ્દ. ઉપર કદ્યું એમ, શબ્દની એમાં તીવ્ર આરત છે. કવિ-શબ્દ કે કાવ્યસ્વયમ્ભ. કે સંસ્કૃત મીમાંસા કહે છે એ ‘કાવ્યપુરુષ’. પહેલાં એ સ્વર રૂપે (લય. રૂપે) સંભળાય છે, સતત સંભળાતો એ અવાજ (શબ્દ એટલે મૂળો.તો. અવાજ, ‘ભગવદ્ગીતા’માંય છે એમ, સ શબ્દો તુમુલોડભવત્, એ અવાજ) – એ સ્વર – કવિસંવેદનના અર્થ/મર્મ સુધી આવે એ રીતે કવિ સતતે છે. કહે છે, સ્વર સંભળાય છે પણ, અરે હજુ જાણે મારી હંદની, મારા કાવ્યાનુભવની બહાર છે; તો હે શબ્દ, એ રીતે મૂર્ત થાઓ – ‘મુખનું મહોરું હટાવી મોહન દરસ દિયો દરબાર.’ સાક્ષાત્-કાર વિના ભક્તને, તેમ કવિને જંપ નથી. (આ પંક્તિ પણ કેવી તો શ્રવણીય છે : ‘મુખનું મહોરું હટાવી મોહન’ અને પછી ‘દરસ દિયો દરબાર.’) જરાક વધારે અર્થ-મેળ(!) તરફ જવું હોય તો અવાજને શબ્દ-સક્રિય કરવાની આ, આરતભરી, પાડ્યા વિના ન જ ચાલે એવી બૂમ છે, એમ કહી શકાય. આપણે જોડી શકીએ – બૂમ, કાગળમાં, કોરા.

પહેલા ત્રણે દોહરા આમ, હવે ફરી એક વાર વાંચીએ એટલે મધ્યકાળની (અલબત્ત, એય જીવંત) પરંપરાની સમાંતરે આધુનિક કવિની – કવિમાત્રનીય શા માટે નહીં ? – શબ્દ-સુતિ નવા ગુંઝિત રૂપે પ્રતીત થશે. લગાતાર પ્રાસ – અપરંપાર અને આધાર અને હંદબાર અને દરબાર –; અને ‘અહનીશિ’, અને સૌને ગમી જાય એ ‘મોહન’ (‘મોહન’ એટલા માટે

છે કે એ સાક્ષાત્ નથી થતો ત્યારે પણ, ને થાય છે ત્યારે પણ એ મોહી લેનારો, આ-કર્ફક છે.) એ બધું મનને વળી વળીને રોમાંચિત કરે છે.

‘શબ્દ વિના હું દીન’ કહ્યું, ‘કહે પિરિ જીવું ?’ કહ્યું, જીવું તુજ આધાર’ કહ્યું – તે છતાં ફરી કવિ કહે છે ‘ક્ષણુ એક તારા વિના ન ચાલે.’ એકદમ સ્પષ્ટ, ચોખ્યું, કાવ્યની બહાર પણ કહી શકાય એવું; કોઈ કહી શકે કે, હા, ગવ્યાળ વિધાન ! આપણી ભાવકની વાચનામાં તો આ ચરણ પર પેન્સિલ પણ ફરી વળે, પાઠકર કરી નાખવાનું મન થાય – એમ થાય કે, કવિ, તમે ચાર દોહરામાં થઈને ત્રણ વાર ‘તુજ’ લખ્યું તો અહીં રોથી વાર પણ ‘તુજ’ લખવાની લય-જગા તો હતી; જેમ કે, ‘ક્ષણુ એક તુજ વિના ન ચાલે’ કે ‘ક્ષણુ એક તુજ વિણ નવ ચાલે’, એમ. ને કહેવાનું મન થાય કે કવિરાજ, તમારા ચરણને બદલે અમારા આ પાઠકરમાં દોહરો પણ જરાક સરખો થાય છે.

હશે, કવિને ગમ્યું તે ખરું.

મૂળ વાત તો એ જ છે કે, તારા (=શબ્દના, કવિશબ્દના) ફંડ અ-કળ ને વિ-કળ છે; મોહન કહ્યો એટલે આવા ફંડ તો રહેવાના. પણ તોથી, કે એટલે જ, તારા વિના ચાલતું નથી રે. પછી, છેલ્યે તો, કવિને વળી થાય છે કે આ હું પલેપલ તુજને શે [શે ?] આરાધું છું, શે તારો છંદ છૂટતો નથી ? કેવી રમ્ય અકળામજા છે – દયારામની ગોપીનેય થયેલી : મન કહે કે, પલક ના નિભાવું...

અહીં વળી મારામાંનો ભાવક (આ ‘મારામાંનો ભાવક’ એ જાણો કે લાભશંકરની જ મોનોપોલોઇઝ્રડ લઢણ...) એ ભાવક એમ વિમાસે છે કે આ છેલ્યી પંજિતમાં અલ્યવિરામ ખોટી જગાએ તો નથી મુકાઈ ગયું ને પ્રેસથી ? ‘પલપલ તુજને આરાધું શે, છૂટે ન તારો છંદ’ને બદલે હું તો આમ પણ વાંચું : ‘પલ પલ તુજને આરાધું, શે છૂટે ન તારો છંદ ?’ (૧૯૭૪ની પહેલી આવૃત્તિ જોવાની રહી ગઈ છે મારાથી.. એની વાચનામાં આવું હશે. ?)

‘બૂમ કાગળમાં કોરા’નાં ૪૦ કાગ્યોનો પ્રારંભ સ્તવનથી કવિએ કર્યો છે. ને પછી, એ પણ ઉપર કહ્યું એમ, અવાજીથી શબ્દ સુધીના અનેક સંચારી ભાવોમાં – કષ્ટ, અકળામજા, જરીક નિરાશા, જરાક ભાન્તિલંગ, વળી પ્રસન્નતા, વળી અંતિમ ઠંચણમાં – એવી એવી મનમોહન કાવ્યરૂપ છથાઓ દાખવે છે ! પછીના જ ‘પ્રસ્તાવના’ કાવ્યમાં છે એમ, ‘ડોલ શબ્દની કાશી’ છે ને ‘લાવી ભરચક પાણી પાણી રે’ની રમણીય ભાન્તિ છે; અને એથી વારંવાર ‘ડોલ’ પાછી ‘ઉંડાં ફૂવાનાં પાણી’માં નાખવાની છે – ‘ભરચક’ થવા માટે.

કવિપ્રવૃત્તિ કેવી તો અ-વિરત છે ને એથી જ કવિ-ભાવક માટે કેવી તો કાણનંદભરી છે !



## ૧૮. કાણી ડોલથી જળાશય ભરવાની વાત

રવીન્દ્ર પારેખ

### પ્રસ્તાવના

ડોલ શબ્દની કાણી રે  
ઉંડા કૂવાનાં પાણી રે  
હરખભેર દામણ બેંચે છે લઘરો તાણી તાણી રે  
આ આવી છલકાતી લઈને  
ભરચક પાણી પાણી રે !

કોઈ પણ કવિતા મૌનમાં કેમ નથી થતી ?

મૌન પર કવિતા ઘણી છે, પણ મૌનમાં કવિતા નથી. મૌનની કવિતા પણ શબ્દ વગર શક્ય નથી. શબ્દ છે માટે જ મૌન પણ છે. એમ લાગે છે કે શબ્દ કવિતામાં આવે છે તો તે બ્યાંખાર છીઠીને તહેવાર તરફ વધારે ગતિશીલ હોય છે. શબ્દ ગમે તેવો હોય, ગાંડોવેલો કે સ્વસ્થ, તે કવિતામાં આવે છે ત્યારે એક વણલાંબું શિસ્ત સ્વીકારી લે છે. કવિ લઘરવધર હોય તો ચાલે, લઘરો હોય તો ચાલે, પણ શબ્દ કવિતામાં લઘરવધર હોય તો પણ તેણે કવિતા રહેવું હોય તો તેણે શિસ્ત પાળવાનું રહે જ છે. લઘરો પણ કવિતામાં સૌંદર્યમંડિત હોવાનો. કવિતા કશામાં બંધાતી નથી, પણ તે સ્વયં અને સંપૂર્ણ શિસ્ત રચે છે ને તેની બહાર જવાનું તે સ્વીકારતી નથી. તે અરૂઢ હોઈ શકે, પણ અકૂદરતી થવાનું તેને પાલવે નહિ.

શબ્દ જ કવિની સંપત્તિ છે. સોનામહોર છે. તે કસર કરીને ખર્ચે છે. કવિનો શબ્દ કસરી છે. કવિએ શબ્દ ખર્ચવાનો છે, ઉડાવવાનો નથી. તે ના ખર્ચે તોય શબ્દ વહી જવાનો છે. ખર્ચવું એ જ કવિનું ભાગ્ય છે. તેના શબ્દની ડોલ કાણી છે. પાણી ખર્ચે તોય ઘટવાનું છે ન ખર્ચે તોય ગળવાનું છે. ખર્ચવું એ નિયતિ છે.

લાભશંકરે શબ્દ ખર્ચ્યા છે ને એ સાથે જ ખર્ચ્યું છે મૌન. અઠળક શબ્દોના સ્વામીએ પણ શબ્દ વગર પોતાને રાંક અનુભવ્યા છે. ‘મરી જવાની મજા’માં લાભશંકરે જ નોંધ્યું છે,

‘કેવી વાણીની ખીચોખીચ સમૃદ્ધિ ! એક વાર હુંય કુબેરબંડારી હતો. ઘૌટ વરસનો એ કુબેરબંડારી ગામ છોડીને નગરમાં આવ્યો. ભાજ્યો-ગાજ્યો, પ્રોફેસર થયો અને સાવ લૂંઠાઈ ગયો.’ ગ્રામજીવનનું જે ભાથું હતું તે શહેરી સમૃદ્ધિ વચ્ચે પણ કવિને વધારે માતબર લાગે છે.

ઉંડા કુવામાંથી પાણી ખેંચવાનું અધ્યંતું છે. દામણ ખેંચ્યા જ કરો, પણ છેડો આવતો નથી ને ડોલ કાણી છે તે નજીમાં ! આ પરિચિત અધ્યાસો વચ્ચે કવિએ પોતાનો શબ્દ પાડવો હતો. એટલે તેમણે ડોલ તો કાણી રહેવા દીધી, પણ તેને શબ્દની ડોલ કરી.

### ડોલ શબ્દની કાણી રે

પછી બધું એમ જ રાખ્યું છે. કૂવો ઉંડો જ છે. દામણ ખેંચાયા જ કરે છે, ખેંચનાર લઘરો જ છે. પણ પરિણામની હવે બે શક્યતાઓ ઊભી થઈ છે. એક તો એ જ પરંપરિત પરિણામ. દામણ ખેંચ્યા જ કરો ને ડોલ ભરાય જ નહિ ! ડોલ કાણી હોય તો આ જ થાય, પણ આ ડોલ શબ્દની છે. કવિની છે. તે દામણ ખેંચે ને પાણી છલકાય નહિ એ તો બને જ કેમ ? કવિએ પોતે કંબું છે, ‘ના. લઘરો, સર્જક ચેતનાને ત્યજ્ઞને જતો નથી. એ ‘મીથ’ બનીને સર્જકને એની નાગચૂડમાં, હા, દર્શનિક નાગચૂડમાં નાદ્યાય કરી નાખે તે પહેલાં સર્જકતા ડી-માયિફિકેશનની પ્રતિકાર-પ્રક્રિયામાં મુકાય છે.’

કાણી ડોલમાં પાણી ખેંચવાનો હરખ ન હોય, પણ આ કાણી ડોલ શબ્દની છે. એટલે કવિ લઘરાને હરખાતો બતાવે છે, ‘હરખભેર દામણ ખેંચે છે લઘરો તાણી તાણી રે’

હરખાવાનું કારણ પછી મળે છે,

‘આ આવી છલકતી લઈને  
ભરચક પાડી પાણી રે !’

કાણી ડોલ ભરાને આવે છે. તે છલોછલ નથી, ‘ભરચક’ છે. પાણી ઓછું નથી, તો વધારેય નથી. વધારાનું તો નથી જ ! બલકે ગળાઈ, ચણાઈને, માપનું જ આવ્યું છે. ખપનું જ આવ્યું છે. કવિનો શબ્દ વધારાનો તો ન જ હોય ને ! ડોલ કાણી ચાલશે, શબ્દ કાણોકોચરો નહિ ચાલે.

આ કાબ્ય ઉપરાંત પણ લાંઠાની કવિતામાં શબ્દ પ્રવાહી થઈને વહે છે. સર્જક ચેતનાનો પણ જાણો એ જ પ્રવાહ છે. એમ વહેતાં વહેતાં જ જે બદલાવ આવે છે તેને સાંપ્રત સમયની અભિજ્ઞા સાથે જ જુદા જુદા, પણ, એકબીજામાં લય પ્રવાહ સાથે જ, ભણી, વહી જવા દે છે. શબ્દ દ્વારા જ મૌનને પ્રગટાવવાની આ રમત છે.

એક પ્રકારનો નકાર એમાંથી જન્મે છે. આય નથી ગમતું ને તેય નથી ગમતું. પણ શોધ કશાક હકારની છે.


‘હું ઈશ્વરને ભજુ પણ શકતો નથી  
તજુ પણ શકતો નથી.’

બિલકુલ એમ જ જેમ,

‘હિટલરને હું વિક્કારી શકતો નથી  
અને ગાંધીને હું ચાહી શકતો નથી,’

લાંઠાં શબ્દસાધક નથી, શોધક છે. એક નરવા શબ્દની શોધ એમની છેવટ સુધી રહી. આ શબ્દ વડે જ એમજે અવાજને ખોદવા કર્યો છે ને મૌનને ઊંચકવા ધાર્યું છે. લાંઠાંએ ઢાલાપણું પ્રમાણ્યું હતું, તેની આ આટલી – ‘પ્રસ્તાવના !’

18





## ૨૦. અમથાને સમજ્ઞને થતું અમથું મહિમાગાન

સંજુ વાળા

### સમજ્યા

સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ...સમજ્યા.  
અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ...સમજ્યા.

અમથું આ પંખી બોવે છે, અમથું ઊડે કાગ...સમજ્યા.  
અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ...સમજ્યા.

અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ...સમજ્યા.  
અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ...સમજ્યા.

તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ...સમજ્યા.  
ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ...સમજ્યા.

કાગળનો દૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ...સમજ્યા.  
અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ...સમજ્યા.

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત...સમજ્યા.  
અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત...સમજ્યા.

ગુજરાતી ભાષામાં વીસમી સદીના મધ્યભાગથી લઈને એકવીસમી સદીના પૂર્વાર્ધ સુધીની કવિતાને એક ભાવક તરીકે જોતાં એવું તારણ આપી શકીએ કે, એ અનુગાંધીય વિચારધારામાંથી ઊંચકાઈને આધુનિક પ્રવાહમાં મુકાઈ અને આજે, એટલે કે ૨૦૧૬ માં આપણે ઊભા છીએ ત્યારે એ અનુ-આધુનિકના ચમકારા કરે છે. આપણે અહીં જે કાવ્યની વાત કરવી છે તે, આ કવિના કાવ્યસંગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪, દ્વિતીય આવૃત્તિ-૧૯૮૬)માં પ્રથમ વખત ગ્રંથસ્થ થાય છે. એટલે એને કાળના સંદર્ભમાં જોઈએ તો એ આધુનિકકાળની રચના છે. આપણે

એ પણ જાહીએ છીએ કે માત્ર આ સમયમાં એ પ્રગતી તેટલાં કારણોસર જ એ આધુનિક ના ગણાય. કારણ કે આ કાળમાં પ્રગટેલી કોઈ રચના મધ્યકાળની રચનારીતિએ ભજનભાવની હોય તો એ આધુનિક ના જ કહેવાય. પણ પ્રસ્તુત રચના કાળ, ભાવ, ભાષા, રચનારીતિ, સંવેદન, અભિવ્યક્તિ અને કાવ્યપુરુષથની રીતે આધુનિક છે. આટંસુ સૌપ્રથમ અંકે કરી લઈએ.

લાભશંકર ઠાકરાહવે પછી ક્યાંક આપણે લાંઠાં તરીકે, જે સંશા કવિનામ તરીકે આ પહેલાં સ્થાપિત થઈ ચૂકી છે તે પણ પ્રયોજશુંને આપણે સામાન્ય રીતે આપણા સમયના અછાંડસ કવિતાના કવિ તરીકે જાહીએ-પ્રમાણીએ-ઓળખીએ છીએ. પરંતુ આ કવિની સર્જનનાભિમાં વિવિધ તરીકા, વેગ, આરોહ-અવરોહ, ભાત-પોત અને રીતિ-રિદ્વિએ લય વહેતો-ઘૂમરાતો-અથડાતો અને અવતરતો રહ્યો છે. અછાંડસ કુળ-મૂળની તેમની અનેક ટૂંકી અને દીર્ઘ રચનાઓમાં, અનેક પંક્તિઓ લયખચિત જ નહિ, લયના વાંક-વળાંકથી કાવ્યત્વ અને કાવ્યની પઠનક્ષમતાને આલોકિત કરતી આપણે પ્રમાણી છે. આ કવિએ અનેકાધિક વખત કવિતા, લય, લયપલય અને ભાષાના વિવિધ સત્તરોથી રચાતી કાવ્યભાષા, ભાષાનું સંયોજન અને તોડફોડ વિશે વાત કરી છે. લય વિશે તેઓ કહે છે : ‘પોણાયો છું લયના અવિરત સિંચનથી’ (સર્જકની આંતરકથા, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧) એટલે લય એ લાંઠાંની કવિતામાં અનેક આયામથી વહેતો, જીવત વેગ છે. ગાંધી કે પદ્યલયનું પ્રયોજન અને સિસુસ્કા એ બને આ કવિના રસ અને આનંદનો વિષય છે. ભાષાના તોર, તરીકા અને આંતરસોત સુધી પહોંચવું અને ભાષાદ્વારના અર્થની કોટીઓ રચાવી એ આ કવિમાં સૌથી વધુ સર્જનાભક રીતિએ પ્રગટે છે. આવી કેટલીક સાવ પ્રાથમિક અને સર્વ વિદ્ધિત વાત પછી ‘સમજા’—ને લાંઠાં રીતિએ કહું તો સાંભળીએ.

કોઈ પણ ઉદ્દેશ્ય સાથે થતી વૃત્તિ-પ્રવૃત્તિને આપણે સંકારણ કરીએ છીએ. એની સાથે કર્તાનાં છિત સંકળાવેલાં હોય. બગાબર એની સામેની બાજુ એટલે ગ્રાફ્ટિક પ્રચલન. બધું થતું રહે, છીતાં બધું આપમેળે અને આપબળે. જ્ઞાનીઓ એને જરા જીહી રીતે જુબે. કહે : અકર્તાપણું એવું લાગે છે કર્મનો ભાવ અને ભાર ઓગળી જાય ત્યારે આ અકર્તાપણું શરૂ ચઢું હશે. સાધનાના કે ગ્રાપ્તિના છેક છેડાની વાત હશે? પણ પ્રકૃતિ માટે તો સાવ સ્વાભાવિક. આ પ્રકૃતિએ કઈ સાધના કરી હશે તે આવું સ્વાભાવિકપણું અને સિદ્ધ ના કરવું પડવું અને જન્મતાની સાથે જ મળ્યું? યોગીઓ કહે છે જ્યાં જાપ પૂરો થાય ત્યાંથી અજ્પાજાપ શરૂ થાય. કબીર કહે : ‘લેખ સમાના અલખમે, આપા માંહી આપ.’ એટલે વસ્તુજગતનાં સત્યોના ઈન્દ્રિયવ્યાપારનો જ્યાં અંત આવે ત્યાંથી શરૂ થાય તે અનુભૂતિના ભાવવિસ્તારમાં સ્થિર થતો સત્યો. એક રિસ્થિતિએ પહોંચાયા પછી થતું સ્વયંભૂપ્રકટીકરણ. આ જ્ઞાનપરિધિના ચક્કરમાં ઊંડા ઊતરશું તો કાવ્યનો આસ્વાદ બાજુમાં રહી જશે. પરંતુ, ગંગાસતી એક જ પંક્તિમાં આપણો રસ્તો સરળ કરી આપે છે : ‘ભાઈ રે કરતાપણું કોરે મૂકશો પાનબાઈ, ત્યારે આવશો પરપંચનો અંત.’ કાવ્યને પણ એક પ્રકારનો ભાષાપરંચ આપણે ત્યાં કહેવાય છે. વ્યવહારજગતમાં તો હું કરું છું કે મારું

કરેલુંની સંવધણી ભામકતા. એને ગાયા, વગાડચા કરવું એ પણ નર્યો પ્રપંચ. આપણા આ કવિ જે કાંઈ સહજ, સ્વાભાવિક અહેતુક કે અમયું થાય છે એને વર્જાવીને પંક્તિના અંતે કહે છે : ‘સમજ્યા.’ એટલે ઘણુંબધું સમજી લીધા પછી, એનાં પ્રચલન, વિચલન અને વ્યાવર્તકતા જાણી લીધા પછી કહેવાયું છે આ ‘સમજ્યા.’

પ્રથમ ચાર પંક્તિઓમાં સાવ સહજ, નૈસર્જિક રીતે આંખ સામે તરવરતી અને તરી આવતા પ્રકૃતિના રૂપનો કાબ્યનિષ્ઠતિ માટે લયસભર ટેકઓંફ લેવાયો. જેવું સહજ અનું અવતરણ થતું હોય છે, એવી જ લાક્ષણિક પણ અકૃતિમ અભિવ્યક્તિ. પરંતુ આ પંક્તિઓ કવિને જે સ્થાપના કરવી છે તેનું રૂપક કે ઉપમા તો ના કહીએ પણ નિર્દેશિકા બનીને અવતરી. જે માત્ર વાચ્યાર્થ કરવા ટેવાયેલા હોય એને તો એમ જ થાય કે કવિતાનું કંયું મોટું કામ આમાં થયું ? સૂરજ ઊરો, ફૂલ ખીલે, ઝકળ પડે, પંખી બોલે કે બાગ ખીલે આ બધું સાવ અમસ્તું. આમ કહેવાથી કેવા રસાનંદ કે કાબ્યાનંદનો ઊભરો આવે ? પરંતુ વાત આટલેથી અટકતી નથી. સૂરજ જેવી શાશ્વતીનો રોજિંદો સાક્ષાત્કાર ભલે પૃથ્વીની ભામણનિયતિને કારણે હોય પણ આપણા માટે તો એ ઊરો છે. એની બરાબર બાજુમાં એકાદ ફૂલનું ખીલવું જુઓ. આ બે ઘટનામાં આધાર પૃથ્વી છે. છતાં બંનેની સ્થિતિ જુદી છે. એકની પ્રચંડ તાકાતથી સર્જતી વૈશ્વિકતા અને બીજાની રમણીય પણ સ્થળવિશેષની સાભિપ્રાયતા. અકળનું બાજાવું કે ડાળખી પર ફૂલની બાજુમાં જ કંટાનું હોવું, પંખીઓના ચહેકાટીથી વાતાવરણની સભરતા અને એની સામે એકલતા. કવિની ચૈતસિક અવલોકના કહે : બધું અમયું. આ બધાં નિર્દેશાયેલ સાયુજ્યોની લક્ષણાગત સહોપસ્થિતિઓની બારીકીઓ નિરૂપી શકાય. એની ઝીણવટ અને લક્ષ્યગતિ આવેખવી શક્ય પણ છે. પરંતુ આસ્વાદમાં પણ, આરોપિત અર્થ કરી કરીને કૃત્રિમ નથી કરવા. રસસ્થાનનો ખપ પૂરતો ઈશારો જ કરવાનો હોય. હવે ભાવક એની રીતે આગળ વધે. આ બધાં ઉપમાનોની સાથે જોડાયેલી એની વિશેષતાને જરાક ઝીણી નજરે જુઓ એને કવિતા મળો. એ ભાવકનો પોતીકી વાચનાનો અભાવિત અવિકાર. તેમ છતાં પણ આ પ્રથમ ચાર પંક્તિ એ કાબ્ય માટે લેવાતો ટેકાંફ છે. પદ્ધિથી જે શબ્દના જાગવાની પ્રક્રિયા થવાની છે એના સાપેક્ષમાં.

**અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ... સમજ્યા.**

**અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ... સમજ્યા.**

એક અન્ય કાબ્યમાં આ કવિ ભાવકને પ્રશ્ન કરે છે. ‘શબ્દ/વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ/ જગાંડું એને ?’ જવાબ નહીં મળ્યો હોય અને જગાડી દીધો હશે કે એમ જ ઊંઘવા દીધો હશે એ ભાવકપ્રદેશ છે. અહીં જગત શબ્દ છે. પરંતુ, અહીં ખબર પડી કે એની સાથેની આવી પ્રક્રિયા તો નિર્હેતુક છે. ભાષા સાથે લયલીલા કરતા અને શબ્દને ભાષાનું એકમ ગણતા કવિ માટે શબ્દ મહત્વનો છે. એ વિશેષણથી ફ્લૂરાયેલો હોય ત્યારે

નિર્વસ્ત્ર કરવો અને ધબકતો હોય તો, કે ત્યારે પણ એની સ્વાભાવિક અને મૂલગત પ્રક્રિયામાં છે એમ સમજાને એની સાથે કામ પાડવું બંને એક જ છે. ઊંઘતો કે જગતો શબ્દ બંને સ્થિતિએ અમથો, અને એની આ સ્થિતિમાં વળગોલો અર્થ પણ અમથો. આવા શબ્દનું પ્રયોજન, એને પ્રજ્વલિત કરી રચાતો અજવાસમય આવોક હોય કે યથાતથના શબ્દજાળમાં ફસાયેલી અડાબીઝતા હોય, બધું અમથું, શબ્દ જેવો છે તેવો જ સાર્થક છે. કોઈ સકારાત્મા કે હેતુપરસ્તી આ શબ્દના સાનિધ્યમાં રહીને પાર પાડવી નથી. જે કંઈ પ્રક્રિયા થાય કે કરવામાં આવે છે તે અહેતુક અને અકારણ છે. બસ માત્ર શબ્દની સ્વકીય લીલા. આટલી તો ખબર પડી. પણ અહીંની મળા, પછી આવતા ‘સમજ્યા.’ આ નિવેદનમાં છે. આ સમજનું ધરાતલ છે, અને વિકસિત કેન્દ્ર પણ છે. બસ, આ શબ્દની સપાઈ અને પરિપાઈ, કર્મ અને કાકુ, વંજના અને વ્યવૃત્તિ તરફનું અભિજ્ઞાન. અને એનું આ લયાભિધાન. નર્યા કુતૂહલ અને વિસ્મયથી ભર્યા, પણ સાવ સહજ સાદશ્યો પડાયે પડાયે બેસીને જે સ્થિતિ રચે, અને સુજ્ઞ ભાવક અને કાવ્યત્વના જાણકાર કવિતા. કહે, પણ નરી નિર્દેખપતાથી શબ્દની ત્રિવિધાને સાક્ષીભાવે અનુભવતો સર્જક તો હા, હશે, આમ પણ હોયનું સમાધાન શોધીને ઉદ્ગારે ‘સમજ્યા’. આ સર્જકના ચિત્તની અવસ્થા અને ભાવકના મનના ઉફ્ફયનને એક દોરે પરોવતી અભિવ્યક્તિની રમણા નહીં તો બીજું શું ?

શબ્દ પાસેથી કંઈ પામવું નથી, તો પછી શા માટે શબ્દ સુધી જવું કે આસપાસ ફરકવા દેવો ? એનું આ કર્મજી રૂપ કે ચૈતસિક અવલોધન સાવ નકામું ? આવો પ્રશ્ન થાય ત્યારે સમજાય કે સાવ આવું તો નથી. આ શા માટે ? કે શું કામ ? એવો પ્રશ્ન થવો એ મનની ચંચળતા છે. શબ્દની પારબ્રહ્માલિક સ્થિતિને એ પ્રયોજય કે ના પ્રયોજય એનાથી પણ કોઈ ફેર પડતો નથી. આપણી ચેતનાના વિવિધ સ્તર પર ઊઠતા આ ખ્યાલ, એક ભ્રમ માત્ર છે. શબ્દ સ્થિર છે, એક સ્થિતિ છે. એને પ્રમાણવા, પ્રયોજવા કે પામવાની આપણી માનસિક અસ્થિરતા સાથે એ સંકમણ રચે છે, અને એને કારણે ઉદ્ભબવતી મનની હાલકડોલક સ્થિતિ આ પ્રશ્નોની જનેતા છે. આવું નરાતાજ સત્ય લાઘ્યું અને સાથે જ પરમ શાનની ઉપલબ્ધ થઈ એકમાત્ર શબ્દ ‘સમજ્યા.’ માં. સાવ સરળ રીતે મોટી વૈચારિક અવધારણા કવિએ રચી. ‘તેમ ઇતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ’ આ પંક્તિમાં ‘અમથું’ અને ‘અમથો’-ની વ્યાવર્તક લક્ષણા પ્રમાણવા જેવી છે. ‘અમથું’-નો છેદ ઉડાડવા ‘અમથો’-નું પ્રયોજન ભાષાનો બરાબર કસ કાઢે છે. પ્રશ્નનું ઉદ્ભબવું પણ અકારણ અને આવા પ્રશ્નોના ઉદ્ભબવકેન્દ્ર તરીકેના વિચાર પણ સાવ અમથા. આવી ઘણીબધી નિયોજના સાથે મળીને, ભાષાના મોટા કવિ તરીકેની સ્થાપના કરતી હશે.

કાગળનો દૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ... સમજ્યા.

અમથા અમથા તારા ઊરો, અમથી સળગે વાટ... સમજ્યા.

સમગ્ર પ્રક્રિયા પછી કશું નીપજે નહીં, ત્યારે કાગળ પરની બધી મથામણ સમેટાઈને

કાગળને દૂચો થવા તરફ ધકેલે. અસરફળતાનો બબડાટ છે આ? કે એકસામટા હલ્લો કરતા શબ્દના કાફલાનો? જેમાંથી એક પણનો ચહેરો સ્પષ્ટ નથી, એટલે એક પણ ઉપયોગતો નથી. અહીં પણ સમાધાનનો કર્તા, ‘સમજ્યા.’ આચાસનરૂપ છે. એ એક હોય કે અનેક બંને સ્થિતિ સમાન જણાય છે. એના ટેક માટે, એક સરસ સાયુજ્ય કવિએ નિરૂપ્યું. એક બાજુ તારાઓથી ખીચોખીચ ભર્યું આકાશ અને એની પડકે ઝીણી જબૂકતી જ્યોત. અહીં પણ આગળ આપણે જોઈ એવી આ સહેપસ્થિતિ ખપમાં લેવાઈ. એક બાજુ પ્રાકૃતિક પરિવેશ તો બીજી બાજુ નિર્મિત ઉપાદાન. બંને અહેતુક. અતિ દૂર ટમટમતા તારાઓ અને પડખે જ દૂરના કોઈ ગવાક્ષમાં ટમટમતી દીવડી. બંનેની સાભિગ્રાયતાથી અજાણ કાવ્યનો નાયક. અને ઢાવકાઈથી ‘સમજ્યા.’ કહીને, બધા જ હોવાને અકારણ, અહેતુક અને અકર્તયપણાને ધરમૂળથી પામી ગયાના દઢ વિશ્વાસ સાથે ઊપસી આવતો કવિઅવાજ. બંને પંક્તિના સ્વાભાવિક સંતુલનને કે પારસ્પરિક સાભિગ્રાયતાને પણ મરોણીને એક પ્રકારની અસમંજ્સતા પણ અહીં ઊભી કરવામાં આવી. આવું વિચલન પણ કાવ્યની અને જગતની કેટલીય રહયસ્યમયતાને ચીંધી આપે છે. અને આ રહસ્યોને જેમ જગતના હોવાની નિયતિ એક દોરે પરોવી રાખે છે, એમ જ અહીં લય આ અસંબંધી પ્રયોજનાને તાલમાં રાખે છે. આ પણ કવિવિશેષ છે તે આપણે સૌ સારી પેઠે આ કવિના સંદર્ભે જાણીએ છીએ. એમ કહીએ આ પણ અમથું. અમથાનું જ શાસ્ત્ર રચવું છે તો પછી ભલે ને અમયું જ સર્વોપરિતા ભોગવે. કવિતાનો હેતુ ખુદ કવિતા. દરો હવામાં ઉણણી દીધો. હવે પછીના પરિણામની રાહ જોવાની..

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત... સમજ્યા.

અમયું અમયું સમજ્યો જે કર્દી, અમથો બાધ્યું તંત... સમજ્યા.


કવિ લા.ઠા.ને કોઈ પૂછે કે તમે શું કામ કવિતા કરો છો? કવિતાનો ઉદ્દેશ્ય શું? નવી ભોંય ભાંગીને કાવ્યસર્જન કરવું છે? તો આ પંક્તિઓ કવિને યાદ આવવા સંભવ છે? હા, છે. ‘કવિતા અને હું’ (સં. હર્ષદ ત્રિવેદી)માં કેફિયતના અંતે લા.ઠા. કહે છે : ‘ના કાવ્યસર્જન એ હારજીતની ભાષાની બહાર છે. હોય તો સર્જક કવિની, હોવાના સકલ પણ અ-કલ સંદર્ભો સાથે સહજ અને ઉત્કટ નિસબ્ધ છે. એ સંદર્ભો હજુ અ-કલ છે.’

આ પંક્તિઓ પણ કેફિયત જેવી છે. જેને સમજાઈ ગયું છે કે કવિતા એ ભાષામાં રહીને ભાષા સાથે થતો સંવેદનબ્યાપાર છે, આમાં કોઈ હેતુઓ પાર પાડવાના નથી હોતા, એ આમ જ કહે. સકારણ અને સહેતુક હોય એના માટે કવિતા સાધન. આવા કવિ માટે તો આ લીલા. આવી સમજના આગ્રહનો પણ જ્યાં તંત ના હોય એને બધું અમયું જ હોય. ના કોઈ આરંભ, ના કોઈ અંત. સહજ વહન માત્ર. પ્રકૃતિગત પદાર્�ો ઊગે, મહેરે, વધી, ખરે કે વહે અને વિલીન થાય પરંતુ એને પોતાને એવી કોઈ સભાનતા નહીં હોય. એને પોતાને આનંદ કે અફ્સોસ સાથે

કોઈ લેવા-દેવા નહીં. એક સાહજિક પ્રક્રિયાના ભાગ રૂપે આ બધું થતું રહે. આપણી એની સાથેની અંગત રાગ-દ્વેષમય ગ્રાહકતા વિવિધ ભાવસ્થિતિઓ જન્માવે છે. એટલે એ પ્રતિક્રિયા છે, અને હેતુપરક છે. આહીં તો સહજતાની છડી પોકારવામાં આવી. છેવટે એવું પણ કહેવાયું કે આવી સમજ હોવી એ પણ એક આગ્રહ છે. આ આગ્રહનો પણ નિરેધ. તો આ નિરેધ શું ? લાભશંકરીય રીતે કહીએ તો, કોઈ અંત નથી આવા તંત્તનો.

કાવ્યપ્રકારના આગ્રહીઓ માટે આ ગીત છે. બધી ધ્રુવપંક્તિઓ કે મુખડાઓ. ગીત-પ્રકારની કંપિક વિકાસરેખા કે ઉર્ભિમય સંવેદનની લયછોળ કે હૃદયકોશની ભાષાનો લયસભર વિનિયોગ ગીત, એવી નિયત સમજનો છેદ ઉડાડવો કે જવાબ દેવાની પણ આ પ્રયુક્તિ નથી. કવિતા કરતા કરતા સર્જકની આંતરચેતનામાં કાવ્યદ્વય તરફની, એમાં નિહિત સૌંદર્ય તરફની સમજ કેળવાતી જાય, વિકસતી જાય, ત્યારે અંદર ઉદ્ઘભવતા ઠાવકાઈભર્યા જાતસંવાદનું આ કાવ્ય છે. એટલે સિદ્ધ કરવું તે કાવ્ય છે, ફોર્મ નહીં. છતાં અહેતુક કે અનિર્ણિત રીતે જે કંઈ થયું છે તે પણ નોંધનીય છે. અમથત્વની ખેવના અને ખાંખત પણી જે સમજ નામનું દ્વય હાથ લાંઘ્યું તેને અંકે કરી લેવા માટેની આ મથામણ છે. એક બાજુ આખી પંક્તિમાં પ્રયોજયેલ પ્રાકૃતિક કે વસ્તુનિષ્ઠ ઉપદાનોનો પ્રક્રિયાગત ભાર અને બીજા પલ્લવામાં સમજણા નામે સ્વકીય જાગૃતિની હળવાશ હોવા છતાં કૃતિને સમતોલ રચનાબંધ સાંપડાયો એ આવી કૃતિના વિશેષ તરીકે જોઈ શકાય. એની ભાવઘટનાને ભાવકપક્ષની સક્રિય ભાગીદારીમાં ઊગવાની અપેક્ષા અને શક્યતા અહીં વધુ છે.

આખા કાવ્યમાં વિવિધ સ્તરની વસ્તુપરક કિયા-પ્રક્રિયા સાથે અમથા-અમથી-અમથોનું વિગલન એક સ્વસ્થતાપૂર્વકની નિર્દર્શનાનાં કે કવિના નવ્ય દર્શનાનાં ક્યાંક વાસ્તવદર્શી, તો કેંક અંશે રમતિયાળ છતાં બોલકાં નહીં તેવાં ચિત્રો રચ્યો આપે છે. એ પણી તરત અને વારંવાર સંભળાતો એક જ શબ્દ ‘સમજ્યા.’ સમજનું નવું સોપાન ખૂલ્યું હોય કે બંગસભર દાઢમાંથી બોલાનું હોય એવો મિશ્ર ભાવ રજૂ કરે છે. એટલે આ અમથા-અમથાને સમજ લીધા પણીય થતું અમથું-અમથું મહિમાગાન છે.



## ૨૧. કવિતાની દિશા તાકતી રચના

જ્યદેવ શુક્લ

### ક્યારે વૃત્તિ થાય અને....

ટેબલ પર તાજું સફરજન શબ્દનું  
બાજુમાં કાચની સ્વર્ણ દિશ જેવો કાગળ  
હાથમાં  
ચકચકિત છરી જેવી  
ધોઈને સાફ કરેલી પેન.  
રાહ જોઉં છું  
ક્યારે વૃત્તિ થાય  
અને....

(‘ભૂમ કાગળમાં કોરા’ – પૃ. ૨૮)

ચિત્રના ભૂ-દશય (લેન્ડસ્કેપ), વ્યક્તિ/આત્મચિત્ર (પોર્ટર્ટ/સેલ્ફ પોર્ટર્ટ), વસ્તુચિત્ર (સ્ટિલ લાઇફ) આદિ પ્રકારો જાણીતા છે. કેળાંની લૂમ, દાડમ, સફરજન, થાળી, લોટો, કાચની રંગીન બોંટલ, પારદર્શક કાચના જગમાં પાણી, રંગીન કપડાનો ટુકડો જેવી વિવિધ વસ્તુઓ ટેબલ પર કે અન્યત્ર ગોઠવાઈ હોય. કળાકાર આવી વસ્તુઓની સામે બેસી તેનાં આકાર, કદ, રંગ, રૂપ, પોત અને તેના પરની પ્રકાશ-ધ્યાની લીલાને કાગળ/કનવાસ પર પોતાની સૂક્ષ્મથી ચીતરે તેને સામાન્યતા: વસ્તુચિત્ર (સ્ટિલ લાઇફ) કહેવામાં આવે છે.

આ ક્ષણે ગુલામમોહમ્મદ શેખ (‘અથવા અને’ – પૃ. ૫૪ અને ૫૫), જ્યન્ત પારેખ (‘એતદ’, ૧૯૭૬, ડિસે., ૨૦૧૦ – પૃ. ૬-૭)નાં ‘સ્ટિલ લાઇફ’ કાવ્યોનું સ્મરણ થાય છે.

કવિ લાભશંકર ઢાકરની ‘ભૂમ કાગળમાં કોરા’ સંગ્રહની ઓગણીસમી રચના વાંચતાં વસ્તુચિત્ર માટેની સંરચના સાથે અનુસંધાન થાય છે. પણ કવિ પ્રથમ પંજિતમાં જ ભાવકનો અપેક્ષાભંગ કરે છે :

ટેબલ પર તાજું સફરજન શબ્દનું

આહીં સફરજન છે, પણ શબ્દનું છે તે ભૂલવાનું નથી.

‘હોલ શબ્દની કાણી રે’ કહેનાર લાભશંકર ડાકરે ટેબલ પર શબ્દનું તાજું સફરજન ગોઠવ્યું છે. તાજું વિશેષજ્ઞ જેમ સફરજનનું બને છે તેમ શબ્દનું પણ બને છે. જે ભાવકને વસ્તુચિત્ર વિશે કંઈ જ ખબર નથી તે તો શબ્દના સફરજનનું કહિ શું કરે છે તે માટે ઉસુક બને છે. તે કદાચ એવું પણ વિચારે કે શબ્દનું સફરજન તાજું તો છે, પણ પક્વ હશે કે નહીં ?

પછીની પંક્તિ ધ્યાનથી વાંચીએ તો ‘કાચની સ્વર્ચદ્ધ ડિશ’ જેવા ‘કાગળ’ પર શબ્દનું સફરજન નથી, તે તો ટેબલ પર બાજુમાં છે. અને

‘હાથમાં

ચક્કચક્કિત છરી જેવી

ધોઈને સાફ કરેલી પેન’

વંચાય / દેખાય છે.

રૂપ, રસ, રંગથી સભર શબ્દનું તાજું સફરજન છે, કાગળ છે અને પેન છે. હવે કાવ્યનાયકને પ્રતીક્ષા છે કે ક્યારે એક શબ્દનું એટલે કે કવિતાનું અવતરણ થાય. કાગળ પર પેન / પેન્સિલ / બોલપેનથી કવિતાનો શબ્દ સાકાર થાય છે એ કોણ નથી જાણતું ? પ્રશ્ન એ છે કે ‘ચક્કચક્કિત છરી જેવી’ પેન’ કહેવામાં માત્ર ચક્કચક્કાનું જ સાચ્ય ભાવકે અંકે કરવાનું ? છરીનું કામ કર્શું પણ કાપવાનું, વણાઝોઈતો ભાગ દૂર કરવાનું, ક્યારેક કોઈ પણ રીતે હાનિ પહોંચાડવાનું છે. છરીનું કાવ્યસર્જન સાથે કોઈ પણ રીતે સામ્ય અનુભવાતું નથી. તો એની અનિવાર્યતા શી ? (ચિત્રકાર ક્યારેક નાઈફ પર રંગો લઈ ચિત્રનું વિશિષ્ટ પોત રો છે તે વાત અલગ ને તે છરી પણ અલગ.) હા, તાજા સફરજન જેવા તાજા શબ્દને અવતરવા પેનને કાવ્યનાયકે ધોઈને સ્વર્ચદ્ધ કરી છે ખરી. પેન ધોવાથી તાજા અને ઉચ્ચિત શબ્દો પ્રાપ્ત થશે જ, કવિતા અવતરશે જ એની કોઈ ખાતરી નથી. તેમ ધતાં કવિ રાહ જોઈને બેઠા છે. ‘સ્વર્ચદ્ધ ડિશ જેવો કાગળ’ છે એમ કહેવામાં રંગનું ને સુંવાળી સપાટીનું સામ્ય અનુભવી શકાય છે.

હેલ્લી ત્રણ પંક્તિમાં આશા સહિતની પ્રતીક્ષા છે. જેની પ્રતીક્ષા છે તે કવિતાના શબ્દો પ્રગટ થશે કે નહીં તેના કોઈ સંકેતો કવિએ મૂક્યા નથી. બંને શક્યતાઓ ખુલ્લી છે.

કવિ આરંભે ‘તાજું સફરજન શબ્દનું’ કહે છે તેમાં ખષી વિભક્તિનો લાપટો થઈ ગયેલો પ્રયોગ કરે છે. તેમ ધતાં આગળ કંઈક બનશે એવી શક્યતા સફરજન અને શબ્દને કરારણે રહેલી છે. પણ ‘સ્વર્ચદ્ધ ડિશ જેવો કાગળ’ અને ‘ચક્કચક્કતી છરી જેવી... પેન’ સુધીમાં તો બધું મુખર થઈ જાય છે. લક્ષણા કે બંજનાના. પ્રવર્તન. માટેનો. અવકાશ. રહેતો. નથી..

આઈ પંક્તિની આ નાનકડી રચનામાં કાવ્યરૂપ વેત છેટું જ રહી જાય છે. આરંભની સ્ફુરેલી પંક્તિ પછી રચનાને આગળ લઈ જવામાં કવિ હંજી ગયા છે. કાગળ અને પેનનાં સામ્ય રચવામાં કવિનો આયાસ દેખાઈ આવે છે.

કવિતાની દિશા તરફ તાકતી રચના !



## ૨૨. ‘હું શોધું છું’ વિશે થોડું

શ્રીરિષ પંચાલ

### હું શોધું છું...

ટેબલ પર

એક ખૂણામાં એશા-ટ્રે

ડાબી બાજુ સિગારેટનું પાકીટ ખુલ્લું -

બાજુમાં ક્ષાળાર્થમાં સળગી શકવાની ક્ષમતાવાળું  
લાઈટર.

હું ખુરશી પર આરામમાં ફેલો.

ડાબા હાથમાં સિગારેટ

કશ ખેંચ્યું

ધુમાડાની સેર.

બસ આટલું જ, બીજું કશું નહીં

બસ આટલું જ, બીજું કશું નહીં.

હા, કહેતું હોય તો કહી શકાય કે

પેન છે જમણા હાથમાં

કાગળ છે કોરા સફેદ

અક્ષર છે, કાળા કાળા.

બસ આટલું જ, બીજું કશું નહીં

બસ આટલું જ, બીજું કશું નહીં

હા, કદાચ એટલું કલ્પી શકાય કે

આ કાણો હું વાંચ્યું હું શબ્દો

તમે સાંભળો છો શબ્દો

તમારી પ્રતિક્રિયા શબ્દો  
બસ એટલું જ, બીજું કશું નહીં  
બસ એટલું જ, બીજું કશું નહીં  
સ્પષ્ટતા કરવા એટલું ઉમેરું કે..  
આ ક્ષણો...  
આ ક્ષણો એટલે ‘આ ક્ષણો’  
બરાબર આ ક્ષણો  
અર્થાત્ આ જે ‘અર્થાત્’ લખાયું તે પછી તરત જે કંઈ  
લખાયું –  
અને તે પછી તરત પેન ઉંચકાઈ – એ ક્ષણો...  
પણ ‘એ’ ક્ષણની વાત તો નથી કરવી મારે.  
એ ક્ષણની નહીં.  
ના, એ ક્ષણની તો નહીં જ.  
આ ક્ષણની  
બરાબર આ ક્ષણની  
અંતિમ...  
અંતિમતમ ક્ષણની  
વાત મારે કહેવી છે.  
પણ કેવી રીતે કહી શકીશ એ વાત ?  
અને જો કદાચ કહી શકીશ....  
તો સાંભળી પણ શકીશ મને એ ક્ષણો ?  
કારણ કે...  
છિ... છિ...  
કારણ બારણના કીચડમાંથી તો બહાર...  
પણ જવા દો એ વાત.  
જોયું ને આ તો માત્ર મતિ જ ગતિ કરે છે  
અતીત પ્રતિ ?  
આ શબ્દો પણ માઇલીઓ જેવા  
કોના સ્પર્શો તરત ઉઠળી પડે છે સુવ્વર સાલા  
અતીતમાં – ભાવિમાં ?

વૃદ્ધ નજર

દોરો પકડી બેઠી છે.

નજર છિદ્રને આરપાર તાકીને જોતી પલક વગર,  
પણ સોય અને દોરના સંબંધોની વાત હજ બાકી છે.  
જોયું ને ?

શબ્દમાછલી રૂપ અનેરાં ધર્યા કરે

મનને હર્યા કરે

ને જોયું ને એ કાન કને રણકાવે જીણી ઝાંઝર !

અરે અરે બદમાશો

શું ઊછળો છો ઠાલા !

( હસી પડ્યું આ કોણ ખડખડ ? )

મેં તો આશા છોડી નથી ચોખ્ખાચણક શબ્દની.

ભૂત-ભાવિના સ્પર્શ વિનાનો

આ ક્ષાણનો

બિલકુલ આ ક્ષાણનો

અવતાર શબ્દનો થશે.

થશે, થશે ને થશે જ.

ના પણ ‘થયે-થયા’ની વાત નથી કરવી.

મારે તો....

મારે તો....

હું શોંધું હું એક સ્વરચ્છ સાફ સાદો સીધો

જો મળી જાય તો....

શબ્દ

વર્ષોથી પ્રશ્ન પુછાતો રહ્યો છે – કવિ, કળાકાર શું શોધે છે ? કવિ શું શોધે છે એનો એક સાદોસીધો ઉત્તર છે – શબ્દ. નરવો શબ્દ. ‘વિશેષજ્ઞોની ચાઢર’ વિનાનો શબ્દ. લાભશંકર ઠાકરની સમગ્ર કવિતાના કેન્દ્રમાં આ શબ્દની શોધ રહેલી છે – પરંતુ અતિ વપરાશથી, બદદાનતથી વપરાતા શબ્દો મળે તોય શું અને ન મળે તોય શું ? એક શબ્દ માટે ક્યાં ક્યાં ઘૂમવું પડતું હોય છે અને છતાંય હાથમાં આવે છે શું ?

‘ફું શોધ્યું છું...’ કાવ્યનો આરંભ પદાર્થજગત અને કવિ વર્ચ્યેના સંવાદ-વિસંવાદથી થાય છે. લાઈટર વડે સિગારેટ સળગાવવી, હોઠ વર્ચ્યે મૂક્કવી અને કશ બેંચવો, ધૂમાડો બહાર કાઢવો – બસ આ સિવાય કરવાનું કશું જ નથી. કંટાળને દૂર કરવા આવું જ એક કંટાળાજનક – સમય પસાર કરવાનું કામ કરવા. સિવાય કવિને કશું જ કરવાનું નથી.. હાથમાં પેન તો પકડી છે, લખવા માટે સામે કાગળ છે, પણ તેથી શું ? કાગળ પર લખેલા શબ્દો ભાવક સંભળે છે, કશોક સંવાદ રચાય છે; પણ તેથી શું ?

એક ચિંતકે કહ્યું કે તમે એકની એક નદીમાં બીજી વાર પગ મૂકી શકતા નથી, અહીં કવિ પણ આ ક્ષણે એટલે કે નર્યા વર્તમાનની વાત કરવા માગે છે ?

‘આ ક્ષણે એટલે ‘આ ક્ષણે’

બરાબર આ ક્ષણે

અર્થાત્ આ જે ‘અર્થાત્’ લખાયું તે પછી તરત જે કર્દી  
લખાયું –

અને તે પછી તરત પેન ઉંચકાઈ – એ ક્ષણે....

પણ ‘એ’ ક્ષણની વાત તો નથી કરવી મારે.’

તો પછી કર્દી ક્ષણની વાત કરવા માગે છે કવિ ? આ ક્ષણની અંતિમ ક્ષણ કર્દી ? કવિ મૂળવશમાં છે – વાંચનાર પણ મૂળવશમાં છે. એ અંતિમ ક્ષણ લાવવી ક્યાંથી ? એ વાત નથી. કરી શકતી કારણ કે બહાર કીચડ છે – શાનો કીચડ ? કવિએ એક કાવ્યમાં હજારો ટન ભાષાના કાદવની વાત કરી હતી – પણ એ કાદવમાંથી જ નરવો, પ્રાણવંત શબ્દ તો શોધવાનો છે અને પછી તો કવિ મતિ-ગતિ-પ્રતિના પ્રાસમાં સરી જાય છે – વાદસ્થિક બનીને હેઠે સોયમાં દોરો પરોવવા માગતા વૃદ્ધની વાત પર જઈ ચઢે છે. વૃદ્ધ છે એટલે સોયમાં દોરો પરોવવાનું કામ અધરું છે – અને એ જ રીતે શબ્દની વાત કરવી પણ અધરી છે.

‘શબ્દમાછલી રૂપ અનેરાં ધર્યા કરે

મનને હર્યા કરે...’

શબ્દ શા માટે માછલી બની ગયો ? માછલી હાથમાંથી સરકી જાય તેમ શબ્દ સરકી જાય છે ? હાથમાં ઢાલા ઢાલા શબ્દો જ આવ્યા કરતા હોય તો ?

અને છતાં કર્દી લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે–ની જેમ કવિએ પણ જીવંત, ચોખાચાણાક શબ્દની આશા ત્યજી દીધી નથી. દરેક કવિ આવો એક શબ્દ આપણને આપવા માગે છે : કેવો હશે એ શબ્દ ?

‘ભૂત-ભાવિના સ્પર્શ વિનાનો


આ ક્ષણનો

બિલકુલ આ ક્ષણનો

અવતાર શબ્દનો થશે.  
થશે, થશે ને થશે જ.'

કવિ ભૂતકાળ અને ભવિષ્યકાળમાંથી સંપૂર્ણ મુક્ત થઈને નર્યો 'સ્વરણ સાફ સાદો સીધો' શબ્દ શોધવા નીકળ્યા છે પણ શબ્દની ડોલ કાણી થઈ ગઈ હોય તો ?

એક રીતે આ પ્રકારની કવિતા 'ક્ષાળનત્ત્વાણ' નિબંધોના ગોત્રની છે. એને પદ્ધતિ કરતાં ગંધર્વપ વધુ અનુકૂળ આવે.





## ૨૩. કવિતા વડે ભાષા રચતા કવિની કાવ્યમથામણ

મહિલાલ. ડ. પટેલ

### વ્યવસ્થાઓ

ચારે તરફ  
અહીંતહીં બધે  
પડેપડમાં  
અણુ જેવી પરમાણુ જેવી પર્વત જેવી પ્રકાશ જેવી  
વ્યવસ્થાઓ.  
કોઈ ઊભી છે, કોઈ બેઠી છે.  
કોઈ ચાલે છે, કોઈ ઢોડે છે.  
કોઈ બોલે છે, કોઈ ખોલે છે કશુંક.  
કોઈ હસે છે, કોઈ ભસે છે કે ખસે છે.  
કોઈ ઊળી છે, કોઈ મૂળી છે.  
પણ છે, ચારે તરફ વ્યવસ્થા વ્યવસ્થા વ્યવસ્થા.  
કોઈ સૂક્ષ્મ તણખલા જેવી  
અમથી અમથી ફરક્યાં કરે  
દાખલા તરીકે :  
મારા ગામના સરોવરકંઠે દેરી પર  
ત્રીસ વરસથી ફરકતી ધજાની સ્મૃતિ.  
ધજા પણ વ્યવસ્થા, સ્મૃતિ પણ વ્યવસ્થા.  
પવન પણ વ્યવસ્થા  
શરીરને શેકી નાખતો ઉનાળો પણ વ્યવસ્થા  
ટંકણીયે વ્યવસ્થા, ઢંકણીયે વ્યવસ્થા;

અને ક્યારેક કપરી કોઈ વેળાએ  
 ફંકણીમાં દૂબી મરવાની પણ વ્યવસ્થા.  
 આસ્થા અને અનાસ્થા : વ્યવસ્થાના જ અંશો.  
 અને અવસ્થા પણ વ્યવસ્થાનો જ એક ભાગ.  
 પછી દાતણનો કૂચો કરાવવો પડે  
 કે ચોકઠાથી ચલાવવું પડે —  
 પણ ચાલે  
 ચાબુકની વ્યવસ્થાથી પથરનો ઘોડો પણ ચાલે.  
 કાલે શું ખાશું ને શું પીશું-ની  
 આજથી જ વ્યવસ્થા કરવામાં પરોવાયેલાને  
 ભાન પણ ક્યાંથી હોય, ભાઈ !  
 કે કોઈ વ્યવસ્થિત રીતે  
 વાળની જેમ આપણને ઓળી રહ્યું છે  
 ને પતંગની જેમ ચગાવી રહ્યું છે.  
 ભાતની જેમ રંધી રહ્યું છે  
 ને લેંઘાની જેમ સાંધી રહ્યું છે.  
 છાણાની જેમ થાપી રહ્યું છે  
 ને કાપડની જેમ કાપી રહ્યું છે.  
 આપણે થપાઈએ છીએ ને કપાઈએ છીએ સતત.  
 સતત આ જે દોડધામ કરતી  
 કિડીઓ જેવી ક્ષણો  
 ક્ષણોની કલ્યાના  
 તે તો જિન વિથ લાઈમનો ગ્રીજો પેગ.  
 કોઈએ વ્યવસ્થિત રીતે  
 કશું એવું ગોઠવી દીધું છે  
 જેને —  
 આપણે કબૂતરની જેમ ગણું કુલાવીને  
 Sense of time કહીએ,  
 એ ગુમાવનારને  
 સિક્ઝોફેનિક કહીએ.

કેમ કે

એ કશાકની વ્યવસ્થા ખાસ માણસને માટે.

એ કશાકના કબાટમાંથી

ખરખર ખરે

ક્ષાણને ઓળખનારી ને ક્ષાણમાં ખરનારી

ખોખાં જેવી અંધ દેડકીઓ.

એક દેડકીની આંખ નીચે

અઢાર હજાર સંકલ્પો

ને એંશી હજાર વિકલ્પોનાં ઈંડાં.

એક એક ઈંડામાંથી

આઈ લાખ અંધ દેડકીઓ નીકળે,

એક એક અંધ દેડકીની આંખ નીચે

અઢાર હજાર સંકલ્પો

ને એંશી હજાર વિકલ્પોની

વ્યવસ્થિત થપ્પીઓ.

પળના પ્રત્યેક પચ્ચીસમા ભાગના આરંભની તડ પરથી

એક સંકલ્પની પાછળ વીશ વિકલ્પનાં ઈંડાં

ગબડવા માંડે

અને સતત વ્યવસ્થિત રાંડે

એકવીશ ભૂંડણો.

ભૂંડણો, મા વ્યવસ્થાની અપંગ બાળકીઓ

ગાય ગરબા.

એ ચોક ચાચરનો ગોળાકાર ગતિ ગીત

બધું જ બધું —

બાજુની મુતરડીના બ્રહ્મસરોવરમાં તરફડતા.

વંદાની મૂઢ્યોનો ફરકાટ

બધું જ બધું

મા જગાંબાનો, મા વ્યવસ્થાનો પ્રભાવ.

આપ, જાપ, તાપ, બાપ ને પગારમાં મુકાતો કાપ

બધું જ મા વ્યવસ્થાના નેત્રરસ્કુરણને આભારી.

ભાષાની ભૂંડણ આ —  
 જે હરદમ જણતી  
 લાખ લાખ જણતર,  
 અકળ-વિકળ કરનાર આકોશ બધા,  
 આ સવર-વ્યંજનનાં ચેંચું કરતાં શૂકર-બાળ,  
 આ આળ-પાળ-પંપાળ-બધું  
 આ રોષ ઉગ્ર તેરીલો જે ડંખ્યા કરતો સતત જાત  
 કે પાણીપોચો ભાત,  
 આ ખૂજલી  
 (એટલે દર સપ્તાહે સાત કવિતા લખવાની)  
 જે ભાષામાં જણતી  
 જીણા જીણા ત્વચારોગ  
 ને ખંજવાળે એને સતત  
 સુવ્વરો, ખૂજલીબાજો કવિઓ....  
 ઓહ !  
 ચૂપ મરું, તોડી નાખું કલમ, ભાષાને ચીરું...  
 પણ આ કોણ કરાવે કોઈ, વ્યવસ્થિત ?  
 એને પણ ચીરી નાખું — રગડોળી નાખું — ખતમ કરું  
 પણ એ શું છે ? ક્યાં છે ?

કવિતા ભાષામાં લખાય છે. એટલે સામાન્ય રીતે આપણે બધા ભાષાને કવિતાનું સાધન — માધ્યમ — માનીએ છીએ. ને એ સાચું પણ છે. પરિચિત વસ્તુ, વિચાર, ભાવને કવિ ભાષા વડે અપરિચિત બનાવીને, વિશેષ રૂપ્ય એને રસાર્દ બનાવીને રજૂ કરે છે. એટલે ભાષા માત્ર માધ્યમ નથી બની રહેતી, વસ્તુ આદ્ધિને, બદલીને નવું રૂપ આપતી, કાબ્યભાષા પોતે પણ નવું પરિમાણ પામે છે. એ માધ્યમ મથીને ‘સાધ્ય’ બનવા તરફ ગતિ કરે છે. અહીં સફ્ફળતાનો આધાર કવિની સર્જણક્ષિતને અધીન હોય છે. અનુભવોનું જગત તો અમર્યાદિત છે, જ્યારે ભાષાને એની સીમાઓ છે. આમ અમર્યાદિત વસ્તુ કે ભાવલોકને જીવવા મર્યાદિત ભાષા પાસે (એની નિષ્ઠ મર્યાદા સાથે પણ) કામ લેવાનો પડકાર કવિએ ઉપાડવાનો હોય છે. આમ વસ્તુ-વિચારની સાથે સાથે કવિએ ભાષા સાથે પણ ‘કન્ફાન્ટેશન’ કરવાનું જ હોય છે. લાભશંકર દાકર ભાષા સાથે ને ભાષા સામે (પડીને) મુકાબલો કરનાર વિલક્ષણ કવિઓમાં મોખરે રહ્યા છે. એમણે ભાષામાં કવિતા લખી છે એમ કહેવા કરતાં એમણે કવિતામાં (કવિતા દ્વારા) ભાષા લખી છે

- સર્જ છે, એમ કહેવું વધારે ઉચિત છે.

આરુઠ કાવ્યસર્જનલીલાના નિત્ય ચાહક અને પ્રવર્તક લાંઠાં કવિતા અને કાવ્યભાષાના પણ નોખા ઘડવૈયા - (બલકે એવા લડવૈયા) - રહ્યા છે. છેક ઉત્તર કવિ લાંઠાંને બાદ કરતાં, આપણાને એમની સાહસપૂર્ણ કાવ્યાત્માના કેટલાક આસ્વાદ્ય પડાવો મળ્યા છે ને એ અતિ મૂલ્યવાન છે. પ્રસ્તુત કાવ્ય - ‘બ્યવસ્થાઓ’ - વિચાર અને ભાષાભાતની દણિએ પ્રભાવક છે. વસ્તુવિચારને - ભાવસંવેદનને, આરંભે સાદીસરળ ભાષાનીતિમાં વર્ણવતો કવિ, ઘડીકમાં ક્રિયાપદો અને પ્રાસાનુપ્રાસની રમણીમાં વસ્તુવિચારને રમણે ચઢવે છે ને કેન્દ્રથી પરિધિ તરફ વિસ્તરતો ને વિસ્તારતો આગળ ચાલે છે. ‘બ્યવસ્થા’ નામની ઝીઝી અને રોજની વાતને કવિ અણુથી આકાશ સુધી વિસ્તારે છે... ભીતરની ભૌંયની અતિલાંત વાતો - વિગતો આવેખતો કવિ પોતાની સર્જનલીલાનો રોમાંચક અનુભવ કરાવે છે.

આપણી અંદરબધાર ઉપરનીએ આગળપાછળ પથરાયેલી જાલિલ બ્યવસ્થાઓને કેવી રીતે કવિતાના સંકાળમાં દે છે તે જોઈએ : બધી જ બ્યવસ્થા છે. બધું જ બ્યવસ્થા છે... બ્યવસ્થાની બધાર કશું જ નથી.... ને તોય આપડો એને અડીને અંગત નથી કરી શકતા... મુહીમાં લઈને ગજવે નથી ભરી શકતા.... દેખાય છે ને નથી દેખાતી એ બધી મૂર્ત-અમૂર્ત બ્યવસ્થાઓને કવિ ભાષાના સાંશસામાં પકડતા - અઙ્ગત વિસ્તારને અંકે કરતા આગળ વધે છે. આ માટે આરંભે જ ક્રિયાપદો પાસેથી કામ લીધું છે. બ્યવસ્થાઓને જડપવા કવિ પણ બ્યવસ્થા કરે છે - સંરચના કરે છે - ભાષામાં ભાષાની ભાષા વડે સંરચના કરે છે : બ્યવસ્થાને ‘અણુ જેવી પરમાણુ જેવી’ કહેતો કવિ એને ‘પર્વત જેવી’ કહીને તરત જ ‘પ્રકાશ જેવી’ દર્શાવીને દેખી શકતી બધી બ્યવસ્થાઓને નિર્દેશે છે - સૂક્ષ્મ અને અમૂર્ત એવી બ્યવસ્થાઓને ચીધતો કવિ ક્રિયાપદો પ્રયોજને રોજનું કિયાશીલ જગત દર્શાવીને બ્યવસ્થાઓની માયાજાળ વર્ણવે છે :

‘કોઈ ઊભી છે, કોઈ બેઠી છે.

કોઈ ચાલે છે, કોઈ દોડે છે.

કોઈ બોલે છે, કોઈ ખોલે છે કશુંક.

કોઈ હસે છે, કોઈ ભસે છે કે ખસે છે.

કોઈ ઊળી છે, કોઈ મૂળી છે.

પણ છે, ચારે તરફ બ્યવસ્થા બ્યવસ્થા બ્યવસ્થા.’

(ખખડતી ખેંચે કવિતા કોણ ? : પૃ. ૬૦)

ક્રિયાપદો દ્વારા સૂચવાતી બ્યવસ્થાઓ આપણને, આ સમગ્ર જગતને જડબેસલાખ ધેરી વળેલી છે એવો અનુભવ પણ થાય છે. તકલાદી તણાખલા જેવી અને જામેલી જડ / મૂળની જેમ આ બ્યવસ્થાઓ બ્યાતીતથી વર્તમાન સુધી અંતરબહિર બ્યાપેલી છે. કવિ સંકેતમાં સૂચવે છે તેમ એ આપણને ધેરો ઘાલીને ઊભેલી છે. એનાથી છૂટી શકાતું નથી.... સરોવરકંઠેની દેરી,

તેને માથે ફરફરતી ધજા હજ્ય - ત્રીસ ત્રીસ વર્ષો પછીય - કવિચિત્તને વળગેલી છે ! ધજા અને સ્મૃતિ પણ વ્યવસ્થા જ છે. આ ઋતુઓ - આ શરીરને શેડી નાખતો ઉનાળો - પણ વ્યવસ્થા છે. અરે ઢાંકણી પણ અને એના પ્રાસે આવતી ઢાંકણી પણ વ્યવસ્થા સ્તો છે ! હા, દૂબી મરવાનીય વ્યવસ્થા-ઢાંકણી સાથે જોડાયેલી છે !

આસ્થા અને અનાસ્થાને પણ વ્યવસ્થાના અનુપ્રાસમાં ધક્કે ચઠાવતો કવિ અવસ્થાનેય સાંકળીને દાંતનું ચોકટું અને વૃદ્ધે કરાવવો પડે તે દાતાણનો કૂચ્ચો પણ લઈ આવે છે. માત્ર ચોકટાથી જ ચલાવી લેવું પડે એવું નથી... અહીં તો જે કંઈ છે તે વ્યવસ્થાને નામે છે... ને એ સિવાય કોઈ બીજો રસ્તો નથી ! ‘ચાબુકની વ્યવસ્થાથી પથરનો ઘોડો પણ ચાલે...’ હા ! સત્તાનો આ ભિજાજ કંઈ ઓછો નથી જ નથી ! દેખાતી અને નહિ દેખાતી વ્યવસ્થાઓ માણસને હંકાવતી જ રહે છે. બિચારો માણસ તો રોજિંદા જીવતરની લહાયમાં - (‘કાલે શું ખાશું ને શું પીશું—ની આજથી વ્યવસ્થા કરવામાં પરોવાયેલાને ભાન પણ ક્યાંથી હોય, ભાઈ’ - એજન, પૃ. ૬૧) - એવો તો બધાવાયેલો છે - રધવાયેલો છે કે એને કશી ખબર પડતી નથી કે કશુંક ગોચર-અગોચર - વ્યવસ્થાને નામે એની વલે કરી રહ્યું છે : કવિ આ વાતને જીવનચર્ચા સાથે જોડાને વધારે પ્રભાવક રીતે રજૂ કરે છે :

‘કે કોઈ વ્યવસ્થિત રીતે  
વાળની જેમ આપણને ઓળી રહ્યું છે  
ને પત્તંગની જેમ ચંગાવી રહ્યું છે.  
ભાતની જેમ રંધી રહ્યું છે  
ને લેંઘાની જેમ સાંધી રહ્યું છે.  
છાણાની જેમ થાપી રહ્યું છે  
ને કાપડની જેમ કાપી રહ્યું છે.  
આપણો થપાઈએ છીએ ને કપાઈએ છીએ સતત.’

(એજન, પૃ. ૬૧)

‘લેંઘાની જેમ સાંધી રહ્યું છે -’ જેવા નર્મમર્મમાં, કવિ આપણને ઘેરી વળેલી વ્યવસ્થાઓને, હળવાશથી વળેવે છે ને સાથે સાથે આપણને વ્યવસ્થાઓની વળગેલી પળોજણોને ગંભીરતાથી ચીંધે છે. આપણે જેમાંથી છૂટવા ચાહીનેય નથી છૂટી શકતા એ વ્યવસ્થાઓની પ્રત્યક્ષ છતાં નહિ ઉકેલી શકતી રહસ્યમયી વ્યવસ્થાને કવિ ભૂંડજા પણ કહે છે - હા, જે વ્યવસ્થાઓને જણે જ જાય છે. ભૂંડણો, મા વ્યવસ્થાની અપંગ બાળકીઓ છે - એ જે છે તે છે જ ! ને વ્યવસ્થા સહજ રીતે ‘મા’ - દેવી રૂપા - તરીકે રજૂ થઈ છે. હા... એનો વિકલ્ય નથી ! એ આપણને જોતરે છે, ચકરાવે ચઠાવે છે... બાંધેલા ન રૂંધેલા રાખે છે ! મા વ્યવસ્થા, ધન્ય હો !!

‘ક્રીડી જેવી ક્ષણો –’ (રાજેન્દ્ર શુક્ર સાંભરે છે ?) – ને એ ક્ષણોમાં જીવતાં લોકો... ક્ષણોની કલ્પનામાં રચતાં લોકો – જાણે ‘જન વિથ લાઈમનો ત્રીજો પેગ’ – પીને ડેફમાં રચતાં લોકો વ્યવસ્થિત રીતે વ્યવસ્થાઓના સર્કજામાં સપડાયેલાં છે ! સમયનું ભાન હોય તોય શું ને કોઈ સિક્ઝોફેનિક કહે તોય શું ? કોઈ ને કોઈ વ્યવસ્થાની અંધદેડકીઓ અને છોડવાની નથી. અરે ‘અડાર હજાર સંકલ્પો / ને અંશી હજાર વિકલ્પોનાં ઈડાં... ને એમાંથી જનતી દેડકીઓ... ને એવા સંકલ્પો-વિકલ્પોની ખૂબ જ વ્યવસ્થિત થપ્પીઓ આપણને બક્ષવા દેતી નથી.... ગબડતી-રખડતી-કાયા રગડતી પેલી બૂંડણો જેવી જ છે આ વ્યવસ્થાઓ ! હા એ જ મા જગદબા – મા વ્યવસ્થા છે... એની જ પાંપણને પલકારે ‘ભાષાની બૂંડણ આ. / જે હરદમ જણાતી / લાખ લાખ જણાતર / અકળ-વિકળ કરનારા આક્રોશ બધા...’ આ જ ખૂજલી ખણતા-ખંજવાળતા કવિઓને કવિ ‘સુવરો, ખૂજલીબાજો કવિઓ !’ – કહીને નિસહાયપણે ચિત્તકાર કરી ઉઠે છે ! પછી પોતાને પણ ઠપકારે છે : ‘ચૂપ મરું, તોડી નાખું કલમ, ભાષાને ચીરું... / પણ આ કોણ કરાવે કોધ, વ્યવસ્થિત ? / અને પણ ચીરી નાખું – રગદોળી નાખું – ખતમ કરું / પણ એ શું છે ? ક્યાં છે ?’ (પૃ. ૬૩)

અર્થાત્ કવિને, આ ભાષાને અને ભાષામાં રચતી કવિતાને પણ વ્યવસ્થાઓ જડબેસલાક વળગેલી છે જે મંજૂર નથી ! જીવનને ઘેરીને પડેલી વ્યવસ્થાઓ ભાષાને / કવિતાનેય વળગેલી હોય તો કલમ તોડી નાખવાનું ને ભાષાનેય ચીરી નાખવાનું કહેતો કવિ છેવટે કશીક વ્યવસ્થિત રીતે કોધ કરાવતી એ વ્યવસ્થાનેય ચીરી / રગદોળી દેવા મારે છે પણ – “પણ એ શું છે ? ક્યાં છે ?” – એનો અતોપત્તો તો મળતો નથી એટલે નિસહાય કવિ પ્રશ્નસૂચક મુદ્રામાં જ મૂંગો થઈ જાય છે. વ્યવસ્થાઓ જીવનને ઊંડળમાં લેતી ભાષા તથા કવિતાનેય બક્ષતી નથી ! આપણે એની સામે લાચાર છીએ... એ વાત કવિએ સફળ રીતે અનુભૂત કરાતી આપી છે. બૂંડણ-દેડકીના સંદર્ભો બહુ ચગવ્યા ન હોતો તોપણ ચાલત. પોતાની વિક્રોહી મુદ્રા દર્શાવવા પૂરતા જ આવ્યા હોય એવા ‘મુતરરી’ તથા ‘વંદાની મૂછ’ના ઉલ્લેખો કાબ્યમાં ઉપકારક નથી બન્યા ! થોડી વાજિતા પણ કઠે છે. તેમ છીતાં ‘વ્યવસ્થાઓ’ જેવી નોખી વસ્તુ લઈને કવિતા કરવાનો કવિએ ઉપાડેલો પડકાર આસ્વાદ જરૂર રહ્યો છે....

૧૦-૩-૨૦૧૬



## ૨૪. 'કવિ'નું મૃત્યુ

હર્ષ બ્રહ્મભટ્

### કવિનું મૃત્યુ

રૂધાતા ગળામાંથી ઊંચકાઈને  
ફરૂડતા હોઠ સુધી આવેલો  
સૂકા કચડાતા પાંદડા જેવો  
શબ્દોનો અસ્પષ્ટ લય  
જરાક ઢોળાયો...  
અને...

લાભશંકર ઠાકરના 'કવિનું મૃત્યુ' કાવ્યના આસવાદેખ માટે પત્ર મળ્યો. કાવ્યમાંથી પસાર થયો. શરીરમાંથી પહેલાં તો એક લખલખણું પસાર થઈ ગયું. પછી સવાલ જાગ્યો – માત્ર છ પંક્તિના આ અછાંદસ કાવ્ય વિશે શું લખ્યું ? શું લખી શકાય ? ત્યાં તો ઊડાણમાંથી જેમ માછલીઓ સપાઠી પર આવે તેમ, મૃત્યુ વિશેનાં કેટલાંક કાવ્યો મનમાં ઉભરાવા લાગ્યાં.

સૌપ્રથમ રેઈનર મારિયા રિલેનાં મૃત્યુવિષયક કાવ્યો – કરુણપ્રશસ્તિઓ – યાદ આવ્યાં. ગુજરાતીમાંય આ કરુણપ્રશસ્તિઓનાં એકાધિક અનુવાદો થયા છે. રિલેને કહેલું "કવિતા મારું અસ્તિત્વ છે." લાંઠાં માટે કહી શકાય કે "લય એ એમનું અસ્તિત્વ છે." લય એ લાંઠાંની કવિતાનો જીવ છે. "લય" અને "લીલા" એ જાણો એમની કવિતાની "ઠડા" – 'પિંગલા' !

રિલેનાં એક કાવ્યની અંતિમ પંક્તિઓ યાદ આવે છે :

I am the rest between two notes,  
which are somehow always in discord  
because Death's note wants to climb over –  
but in the dark interval, reconciled,  
they stay there trembling.  
And the song goes on, beautiful.'

સેનિશ કવિ ફેડરિકો ગાર્સિયા લોકર્નું કાવ્ય “Farewell” પણ યાદ આવે છે -

‘If I die –  
leave the balcony open.

The little boy is eating oranges  
(From my balcony I can see him.)

The reaper is harvesting the wheat.  
(From my balcony I can hear him.)

If I die,  
leave the balcony open !’

ડી.એચ. લોરેન્સના કાવ્ય “The Ship of Death”નો પ્રથમ ખંડ -

‘I

Now it is autumn and the falling fruit  
and the long journey towards oblivion.

The apples falling like great drops of dew  
to bruise themselves an exit from themselves.

And it is time to go, to bid farewell  
to one’s own self, and find an exit  
from the fallen self.’

ઘણાંબધાં મૃત્યુવિષયક કાવ્યોમાં પાનખરની વાત આવે છે. લાંઠાંના આ કાવ્યમાં પણ “સૂક્ષ્મ કચડાતા પાંદડા” થઈ પાનખરનો સંકેત છે. મરણવિષયક મોટા ભાગનાં કાવ્યોમાં કવિતા રચનાર “મનુષ્ય”નું સંવેદન, સિંતન, દર્શન જોવા મળે છે; કવિતા રચનાર “મનુષ્ય”ના મૃત્યુની વાત જોવા મળે છે. જ્યારે લાંઠાંનું આ મૃત્યુકાવ્ય અન્ય મૃત્યુકાવ્યોથી અલગ એ રીતે છે કે એમાં “માણસ”ના મૃત્યુની વાત નથી, પણ શીર્ષક સૂચયે છે તેમ “કવિ”ના મૃત્યુની વાત છે. તરત આપણને સુરેશ જોખીનું “કવિનું વસિયતનામું” યાદ આવે -

‘કદાચ હું કાલે નહીં હોઉં -

કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે  
મારી બિડાયેલી આંખમાં  
એક આંસુ સૂક્કવવું બાકી છે,

... ... ...

... ... ...

કાલે જો અન્નિ પ્રગટે તો કહેજો કે  
મારા વિરલી પડછાયાની ચિત્તા  
હજુ પ્રગટાવવાની બાકી છે.

કદાચ હું કાલે નહીં હોઉં :

આહી કવિએ પોતે નહીં હોય એ પછીયે શું શું બાકી છે એવું કાબ્યાત્મક વસિયતનામું  
કર્યું છે. જ્યારે લાભશંકરે એમના આ વિવક્ષણ કાબ્યમાં “કવિ”ના મૃત્યુનું પ્રત્યક્ષીકરણ કર્યું  
છે. કાન સરવા કરો તો જાણો સંભળાશે -

‘ગળામાંની રૂંધમણ  
હોઈનો ફફડાટ  
સૂક્ષ્મ પાંદડાનું કચડાવું  
શબ્દોનો અસ્પષ્ટ લય...’

શબ્દોનો લય જો સ્પષ્ટ હોત તો ? તો “કવિ”ના મૃત્યુની સંભાવના જ નહોઠી.

હવે લાંઠાના સર્જક-કેમેરા થકી શું શું દશયબદ્ધ થયું છે, એ જોઈએ -

આપણે ત્યાં કહેવાય છે કે “જીવ” આંખ વાટે ગયો, મુખ વાટે ગયો.... વગેરે, “કવિ”નો  
“જીવ” એટલે એનો “લય”. “જીવ”ની જેમ આ “લય” કઈ રીતે જાય છે એનું લાંઠાએ  
કેવું પ્રત્યક્ષીકરણ કર્યું છે ! કેવું અમૂર્તને મૂર્ત કર્યું છે ! “ઠાકરની આંખ” જ, લાંઠાનો સર્જક-  
કેમેરા જ, કવિનો જીવ જવાનું આ દશય, “લય” જરાક ઢોળાવાનું આ દશય આમ દર્શાવી  
શકે -

‘રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને  
ફફડતા હોઈ સુધી આવેલો  
સૂક્ષ્મ કચડાતા પાંદડા જેવો  
શબ્દોનો અસ્પષ્ટ લય  
જરાક ઢોળાયો....  
અને....’

કેવી નજીકતી, કેવી સૂક્ષ્મતાથી “કવિ”ના “લય”ને જરાક ઢોળતો દર્શાવ્યો છે ! અને  
“લય” કેવો ? રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હોઈ સુધી આવેલો ! સૂક્ષ્મ કચડાતા પાંદડા  
જેવો. લાંઠાએ કલાસંયમપૂર્વક મૃત્યુના, “કવિ”ના મૃત્યુના સંકેતો મુક્યા છે. કાબ્યનો અંત  
કોઈ પણ કવિની કસોટી કરે. આ કાબ્યનો અંત જુઓ - “શબ્દોનો અસ્પષ્ટ લય / જરાક  
ઢોળાયો...” એ પછી માત્ર “અને”, તથા એ પછી ત્રણ ટ્રપાં - “....”.

“અને...” પછી ભાવકચેતનામાં શું ઊંઘડે ? કે શું આગળ ચાલે ?! તો કે, લય જરાક  
ઢોળાયા પછીની કાળી નીરવતા ? કે સર્ઝેટ ચાદર જેવી શાંતિ ?!

મનમાં સવાલ થાય – “લય” ઢોળાયા બાદ શું “કવિ” નું મૃત્યુ થાય ?! “પરબ” (હિન્દુઆરી : ૨૦૧૬) નો તત્ત્વિકેખ વાદ આવે છે જેમાં કવિમિત્ર ઘોગેશો ચોકા પર સૂતેલા લાંઠાનું વર્ણન કરતાં નોંધ્યું છે –

“નસકોરંમાં તુંનાં પુમડાં ભરાયાં નહોતાં... ચાસ તો બંધ થઈ ગયો, પણ ચાસના બદલે ચાલુ હશે હજી લયની આવન-જાવન ?”

કવિનો “લય” લય પામે ખરો ? એમાંથી આ તો લાંઠાનો “લય”... લય પામે ?! ના, એનું તો રૂપાંતર થતું રહે “લીલા”માં...

18





## ૨૫. કવિ લાભશંકરના નિબ્રાંત દર્શનથી શુભચેત - 'પ્રવાહણ'

રામેશચંદ્ર શર્મા

### પ્રવાહણ

નિશ્ચિત છે નિશ્ચિત આ કમોડ, ચક્કાર ઘૂમતું.  
ને કશુંય ના નિશ્ચિતની કાણ પર બેઠા છીએ -  
ઈરિંગ્યુસિબલ લિટરરી મિનિમમને કાઢવા મથતા,  
ઉં...હ, ઉં...હ.

તરબૂચ-ટેટી-હોક્સો-ગાદી-લૂંટ્ઝાટ-અણવિદ્યુત-લીલમ  
ગાર્ભધાન-અચેતન-ગાંડું-ઇન્ટરલોક-નિવેદન-દૂષણ  
સ્ટ્રેટ્જ-સ્ટ્રેટ્જમ-રુખસંદ-તત્કાલીન  
વોરહેડ્ઝ-મિઆઈલ-કિટિ.  
પૂછડી વિનાનું એક પંખી પોપટ જેવું,  
જોયાનું પ્રિય તને યાદ છે ?  
કીવી કીવી, ટીવી પર જોયાનું, કેમ વળી, નિશ્ચિત,  
બરાબર યાદ છે.

ન્યૂઝીલેન્ડનું પંખી કીવી  
નીવીબંધને સરકાવીને યાદ કરે છે બીવી,  
તો પછી મોકસિનના સુંવાળા જોડા પગમાંથી કેમ નથી નીકળતા ?  
પેટ આવે છે આંદું, હાથ પગ સુધી પહોંચતા જ નથી,  
ઉં...હ, ઉં...હ.  
કળી-મમરા, સૂતરફેણી અને લીલી લીલી ગળયટી કમળકાકડી  
યમેટાં પાકાં દેશી લાલ, કેડ કેડ મૂળા-મોગરી ને  
ભીમનાં પરાકમો

ક્યા કિચકને કોણે માર્યો ? મેં માર્યો લૈ મેં -  
ને રાજ જનક ઘેર સૈંવર રચિયો પરણે રાજકુમારી  
મારા વા'લા.

કલાનાં જુંડવાં ખેતરમાં જ ફૂલાં ફૂલાં, ખાધાં છે  
ને મતીરાં-ચીભડાં-કાતરા-લોચનને લોભાવનારા લાડવા  
વહાલી મુને ઝીચાડી  
બટાકાની ભાજી સુખડી ગરમ તાજી  
વાટકા ભરીભરીને રસ, કેરીનો, યસ  
ને કસ જેંચીને, સૂર્ય-ચંદ્ર જેવા સમુજ્જીવલોને, ચસ ચસ  
શમાયણ-મહાભારતને ધાવ્યો છું બચ, બચ, સચ  
કચકુચ ચાસણીનાં પાક-પકવાન  
કિસમિસ-કાજુ-બદામના બૂકડા  
ગળી ગળી સેવ, કલાપીનો કેકારવ  
પરથમ પે'લા સમરીએ ગવરી પુતર ગણોશ  
ને કોપરાની શેષ  
શાન્તાકારમું ભુજગશયનમું  
આડ પર ચઢીશ નહીં, બોલ બાઢમ  
કુંગળીનો સૂપ, વ્હાઈટ ચીકન, ડબ્બાઘોસ  
દેવદાસ, કણરાત્રિનું ખૂની ખંજર,

સા વિદ્યા યા વિમુક્તયે, પ્રચોદયાત્  
ગાંધીજની આત્મકથા, એકાંતનું પાપ  
નાભિ નીચેના આધા જરાક જ ઊગેલા -

સોનેરી, સોનેરી, તડકામાં જ દેખાય એવા, તારકસબ  
મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ઠેકતાં  
કૂવાને કંઠે સાંઘણી ઝેકારો માણારાજ  
સૂતરફેંઝી-ગાંઠિયા-સડસડાટ વાંચેલી શરદભાબુની નવલકથા  
શામન બંસીવાલા, રૂપરૂપનો અંબાર, નંદલાલા, ચીક  
શ્રીગોકુલકા ઉજ્જિયાલા, ક્રિવિક -  
નિદ્રાના સમુદ્રના તળિયે સ્વભન્સાવ,  
આવ રે કાગડા કઢી પીવા

અહું બ્રહ્માસ્મિ, જરાક જરાક ઉંચકાતી આંધી  
 ધન્ય સૌરાષ્ટ્રની ધરતી, જેણે આપ્યા  
 ગાંઠિયા અને ગાંધી  
 તારા યૌવનનો દોષ છે શકુન્તલા, ટાઈટ - તંગ - એક જ અંગ  
 વસનરહિત તારુણી, પ્રવંબ પેંગ વારુણી  
 તિક્કા-ખીરી-ચાંપ - ખા ખા કર્યું છે ખાંતથી  
 ઓળિયાર મોંએ

પી પી કર્યું છે

ચાખ ચાખ કર્યું છે

ચૂસ ચૂસ કર્યું છે

ચાવ ચાવ કર્યું છે

મમળાવ્યા કર્યું છે વાગોળ્યા કર્યું છે કાનથી  
 આંખથી, જીભથી, ચામડીથી

— હું સ્પોતોમય પુરુષ —

અપરિસંખ્યેય

છિદ્રોમાંથી

લળકતી મારી જીભે

ચાટ્યા કરી છે

સૂર્યની તામ્રવરણી ટશરોને

હુંઝાળી હુંઝાળી બિલિયન્સ ઓવ બિલિયન્સ છિદ્રોવાળી  
 સ્પોતોમથીના

આતિ

સૂક્ષ્મ

ગઢ્ઘવરોમાંથી

ઝ

મ

તા

અદંશ્ય પણ સ્પર્શ મદને

રણતકાર કરતા પદને

નિભિલને નવડાવતી નદને

યુલિસિસના નોનસ્ટોપ કદને  
 અહીંતહી સતત મારી બા, સવલી સેડાળી, છગન ક્રોળી  
 નરસિંગો મારો ઘોડાગાડીવાળો; ને વળી  
 નીરખને ગગનવાળા આકાશમાં ઘોડાગાડી ચલાવતા  
 નરસિંહ મહેતા, ને મનમુદ્ધ કહું મામેરું  
 મહેતાતણુંવાળા પ્રેમાનંદ,  
 મારા સૂરજભાભુ, ચોખોવની વાતું, પિટર હેન્કી-  
 ન એવું તો ઘણું બધું  
 વીજયું વીજાય નહીં, ગાજયું ગજાય નહીં,  
 ગાયું ગવાય નહીં, વાવ્યું વવાય નહીં  
 પડ્યું છે શિલાવત્ત સંઘાત પામીને, સ્થિર, સજડબમ્ભ,  
 ઊંઠ... ઊંઠ...

ਅਰੇ ਕੋਈ ਹੈ ?

હે તો હટાવો ઈસ મોબોક્સિકો, ઉં...હ, ઉં...હ.

નથીંગ ટુ બી ઇન્.

ੴ ਸਤਿਗੁਰ

ਮੁਨਮਾਂ

ਤਨਮਾਂ

ੴ ਸਤਿਗੁਰ

સળગતા સનમાં

ੴ ਸਤਿਗੁਰ

## મારી કાવ્યચેતના

વલવલે; એન્ડ આઈ એમ નોટ એબલ—

ટેબલખુરસીવાસણકુસણદોરમરેલાંખોપરીઓ

તूटेलांकाचरकाबीकूचाडूया

પકડાયેલાપ્રેમીહેમીબાપમરેલોસાપકથાકારનુંપાપ

## સમાજીઓ ધૂમતીભૂખીડાંસ

## લાશપછીલાશપછીલાશ

સરકતીચર્ચગોટની પાસ

ઉં...હ ઉં...હ ઉં...હ

કમોડ પર બેઠો છું : કૃતઃ અપિ અકૃતઃ

ગ્રાઉન્ડફ્લોર પર ઉધારી રહી છે જાન

ઓફ્કોર્સ પરણ્યા આજે આપ

ને બન્યાં કાલ મા-બાપ

ઉંવા...ઉંવાનો મેસેન્જર આવે છે લઈને અવાજ

જે સાંભળવા

સમજવા

ઉકેલવા

બેઠેલા

કણોત્સુક બધાં ઉંઘી જાય તો

કુંડ સાંભળી જાગે છે કુકડાની

ઉં ઉં ઉકેલવા

કાલી કાલી આંગળિયુને

ઉકેલવા

તે ચાલશગાડી ચાલશગાડી ચાલશગાડી છોડી છોરો

ગોળ ગોળ માતાની કરતો પરિકમા

તે ગવરીપુતર ગણેશ

છીવટે ગણાતો ગણાતો બની જાય છે ભણ્યો-ગણ્યો

પારાવાર પીડાથી જેને

જ

દ્વારો

હતો તે લબરમૂછિયો

બણ્યો ઠણ્યો

આવ્યો છે લઈને વહુ

મે હેવન્સ ચોઈસેસ્ટ બ્લેસિંગ બી શોવર્ડ ઓન ધ યંગ કપલ

નવંપતી પર પરમાત્માકી અસીમ કૃપા હો -

આસો માસોની રાત -

જામી છે ત્યારે

સાયબા વનરા તી વનમાં એક જાડવું રે

તેની રૂડી વાંસળિયું ઘડાવ એમ કે' છે ઈ

હેલભરી હવે છે ઉતાવળી. ઈને હૈદે હરબ નથી માત્રો  
 સાગ-સીસમના ઠોકિયે રસિયાને  
 લીલી ખજૂરીનો વીંઝણો વાતી  
 ક્ષણમાં દિગ્રવસન થઈ જાય છે;  
 કેમકે ફળ વિના જૂરે પીપળી ને ફૂલ વિના જૂરે ઝડ  
 પુત્રજન્મ પર હાર્દિક બધાઈ  
 મેસેન્જરનો અવાજ રેલાતો ઊંવા ઊંવા  
 ભોમથી વ્યોમ લગણ  
 ને અગણ.

### કાન

ઉત્સુક પેસેન્જરના

આ અર્થભારથી ભરચક્ક

સોલિડ અવાજ ઊંવા ઊંવા-ને ઉકેલવા.  
 લેકિન ક્યા હો જાતા હૈ અગેઠન ? ઊં...હ  
 કશું ઉકેલાતું નથી, ઊં...હ  
 ને મેસેન્જર પુરાઈ જાય છે પાંજરે પેસેન્જરના  
 પોપટ પંડિત કાલું કાલું બોલે, કહું છું સાંભળો છો ?  
 ને આખું સ્થળકાલસાપેક્ષ શાનવિજ્ઞાનકલાનું

પાંજરું

ડોલે

હા ક્ષણે ક્ષણે પોપટ બોલે છે બોલેલું ઉચ્ચિષ્ટ  
 ને ક્ષણે ક્ષણે

સ્થળકાલસાપેક્ષ શાનવિજ્ઞાનકલાનું

પાંજરું

ડોલે છે -

ઉચ્ચિષ્ટ -

ને સતત સન્નારીઓ

પગ બે પહોળા કરે છે

ને જરે છે

સ્રિક્સ્ટી મિલિયન્સથી અવિકાં

અં

ગ

ત

ને

પુંગવો.

ઔર બાત બનતી રહેતી હૈ

ધાનિ કિ કુછ બનતા નહીં હૈ, ઊં...હ, ઊં...હ

ગૂઢતિગૂઢની અભેદ્ય

નક્કર

ધાતુની દીવાલો

રણક્યા કરે છે.

આહીં અંદર બહાર બધે

ને, વેલકમ હુ ધ નેશનલ પ્રોગ્રામ

આ વર્ષે ગ્રીઝ ઋતુને નવી જ તાજગીથી આવકારો

કેમ કે સુગંધસભર

લહેરોમાં વહાવી જાય

એવો સાબુ

તમારા હાથમાં છે.

હજુ પણ તમે જૂની ફ્લેના સેનિટરી નોપ્રક્રિનો વાપરો છો ?

તેથીસ્તો સંભવ છે, એ માત્ર એક

અસાધ્ય સ્વર્ણ બની રહેશે -

બસો એકવીશ

આદ્ભુત ઈનામો જીતવાની તક.

તો પછી અનવેદીલ

યોર હિડન, ઊં...હ, ઊં...હ

અનવેદીલ, ઊં...હ, ઊં...હ

અનવેદીલ ઊં...હ, ઊં...હ

પરસેવો લૂણું છું કમોડ પર બેઠો બેઠો, શાબ્દબ્રહ્મનો.

રણકે છે માત્ર ગૂઢતિગૂઢની અભેદ નક્કર ધાતુની દીવાલો  
અને

ફોમ સિંગ વી સ્ટેપ ઈન્ડુ ઓટમ  
રિઅલી ધ હોલ વર્લ્ડ ઈજ જસ્ટ  
એક ડબલું -

સાલું -

કાટચઢેલું -

ઘોબાળું

મારા વિચારની ઠોકરથી

ઉછળતું

મારા મનોતંત્રમાં, ઊં...હ

અને પછાતું ખાલીખમ બોંદું બોંદું

આ અહીં કાનની બધિર સપાટી પર

ધિસ ઈજ નોટ એકાઈલ ફોમ પેરડાઈઝ

ધીર ઈજ નો હેલ, નો પેરડાઈઝ

હિયર ઈજ માય મોરિબન્ડ પેનિસ

ઓન્ડ આઈ ઓમ મોર્મન, પ્લેઝંગ ટેનિસ, વિથ માય પેનિસ

દિવસનો ગોળાકાર દડો

ઉછાળું છું

દૂર

અંધકારમાં.

ગૂઢતિગૂઢનો અભેદ રણકાર સંભળાય છે;

ને સૂર્યોદય સાથે

દડો

આવીને પડે છે

પગ પાસે

ઓન્ડ આઈ પ્લે, ઊં...હ, ઊં...હ.

મરચન્ટ ઓવ વેનિસ બચી ગયો

શાયલોક પણ બચી ગયો

અને હું પણ બચી ગવો

વારસદાર

સર્વ કોડ્સ સાથે

પ્રોપલી જૂથ સિલાઈથી બાઇન્ડ કરેલા ઇનેટ થોથા જેવો  
આ અહીં પડગો

ચક્કાર કમોડ ૫૨

અપરિસંખ્યેય આવૃત્તિઓ જેવો

ફરફરતો, ઉં...હ, ઉં...હ

મારા પ્રાપોત્રની પાયુ વિશે પણ

મારામાં લાભેલા છે કોડ્સ મારા પ્રપિતામહે.

એટલે આ પ્રવાહણ, આ ઉંહકાર પણ...

સોડ તાણીને સૂતા હોય તો જાગશો નહીં

અમથા અમથા

પોતાને જ સાલા

કુક્કરો

જીલાની જેમ

મેટાફિલ્ડિકલ

વાગશો નહીં

ઉઈ ઉઈ બાત

મારે છે લાત

ઉઈ ઉઈ

અંદર

આ અંદર

આ અંદર

મારે છે લાત

સાત વાર

સાત હજાર વરસથી

સાત ગુણ્યા સાત જગ્યાએ

આ અંદર

આ અંદર

આ અંદર

ઉઈ ઉઈ બાત

મારે છે લાત

રસનીયે અંદર ને લોહીનીયે અંદર  
મજજાની અંદર ને માંસનીયે અંદર  
મેદનીયે અંદર ને અસ્થિની અંદર  
રજનીયે અંદર ને શુક્કનીયે અંદર

ઉઈ ઉઈ અંદર

મારે છે લાત

ઉઈ ઉઈ બાત

પર સેકન્ડ પંદર

મારે છે લાત

ઉઈ ઉઈ બાત

રત રત રત  
રતનો સમય છે પૂનમનો હોજુ હો  
ઉત્તર કેન્યા અને દક્ષિણ-પશ્ચિમ ઈથિયોપિયાની પાસે હો જુ હો  
કુડોલ્ડ નામે એક સરોવરકંઠે હોજુ હો  
ઉત્સર્ગલીન હતો

ત્યારે મેં

સ્લોવરમાંથી

ઉંચક્યો'તો

પૂનમનો

ચાંદો

એની સ્મૃતિ લઈ બેઠો છે મારો સજડબમ્બ આ ફાંદો હો જુ હો.  
ફોસિલ્સ

ફો

સિ

ં

સ

મારા ફાંદાના ફોસિલ્સ શોધીને શું કાઢ્યા કાંદા ?  
આ સજડબમ્બની વાત; આ કૂર કોઇની વાત -

આ રવ રવ કાળી રત

પરબ્રહ્માં જૂન-જુલાઈ, 2016

ને આ ઢંક્યાઢૂબ્યાં ગાત;  
ના પણ એ નિર્વસન હતી

સીસમ જેવી

શયામ

નારંગી રંગનો તડકો

એની બૂટ પરથી

લસરીને

કુંટી પર પડ્યો હતો

સોનેરી રોમાવલીને ચમકાવતો, આ....હા !

અને અમને

ભફંગ.

ડા

ઈ

મા

ર

વા

પ્રેર્યી હતા -

સફરજનના ગળચટા અફાટ

ઉડા

દરિયામાં -

ભફંગ.

પણ એનું આ પરિણામ ?

લબડી પડેલા રામ

ક્ષાણમાં ટણ્ણાર તંગ લવિંગની લાકડી જેવા

ઉછાળે

ગેંદ

વોજાઈનલ

વેક્યુમમાં...

લેટ મી સ્ટોપ ટોકિંગ ફોર અ મિનિટ.

... ... ... ... ... ...

લેટ મી સ્ટાર્ટ અગોઈન, ઉં...હ, ઉં...હ.  
ઈટ વિલ પાસ ધ યઈમ, ઉં...હ, ઉં...હ.  
છોડી દે આ ઉંહકારા.

પિગ !

અપ !

પ્રક્ષાલન કરી નાખ તારા બાપનું, તારા કુળનું, તારા મૂળનું -  
અપ !

લે આ ચાનો કપ, અપ !

છોડી દે આ લ...પ,

અ...પ !

લે આ માળા ને રામનામને જપ

કે આવ અહીં ખોકિટમાં પેસી, કરીએ કંઈ ગપસપ  
અ...પ !

છોડી દે આ તપ કમોડ પર બેસી રહેવાનું અર્થરહિત, અ...પ  
જો, ઉંચી રે કવિતા કેડે પાતળી

ઓગળતી ઓગળતી

અમે છે

ટપક ટપક

તારાં પોપચાં પર

તારાં ટેરવાં પર

તારા અધરોઝ પર

તારા પ્રહૃદિલિત ગુલાબી મણિ પર

ટીપ્સ પર ટપકે છે ઝાકળનાં ટીપાં જેવી આકાશમંડિત  
ની

ચે

ં

પ

ક

ર

પ

ક

૨૫૬ છે ઉંચી રે, કેદે પાતળી, ૨૫૭ છે ઓગળતી ઓગળતી  
નીચે-

૨૫૮-

૨૫૯-

ગોરી ગાગરીમાં સોપારીના કટકા જેવી પ્રજ્ઞા પોચી પડી જાય એવી  
૨૫૧ છે, ને  
મધુકુજ ફોરે, અંબ મહોરે, મહક દે રે મંજરી  
પિતળ લોટા જ્ઝે ભર્યા રે, ચમકે છે, પા પા પગતી—  
ભરતા શિશુની આંખમાં

મેં ઓલવાઈ જતો જોયો છે મારો છેરો,  
હવે મારા મન-વચન-કર્મને

આડેધઃ

હેરો

હું કયાંય નથી

ભ...પ ભ...પ ઓલવાઈ જતા દીવામાં  
રામાયણ-મહાભારત-ગીતા-ષડ્દર્શન-યુલિસિસ-ઈડિપસ-મેંકલેથ  
ડૉલ્સહાઉસ-વેઇટિંગ ફોર ગોદો-નાં ફરજરતાં પૃષ્ઠો પર  
કિતિરસ તરુશાખાએ પ્રસરતો

પ્રસરતો

ઉંગી નીકળે છે

તેઠિલ્લ રૂપે

રૂપેરી પરદે

ઓડિયો વિઝ્યુઅલ લટકા લાખ કરોડ કરતો  
સાકર-ધીના ચૂરમા ચાક્ષુષ કરતો  
કર્તિક માસનું હિમ બની

ઉનાળાની અગન બની  
 તાળ મૃદુંગ અને ઘમઘમતી ઘૂઘરીમાં –  
 ભ...પ ભ...પ  
 ચીક ચાર્ટ ચીતરતો  
 લલ્વી-ચાર્સિંગ-સેક્સી  
 તીક્ષ્ણ આંખો – વેલ મોડયુલેટેડ સ્વર  
 છીણી વડે શિલ્પીએ ગ્રેનાઇટમાંથી કંડાર્યો હોય એવો  
 શાર્પ ચહેરો  
 ભ...પ ભ...પ ખતરનાક ગૂગળીમાં  
 ઊપસી આવે છે, રેડ, ટફ, મેઝ્યુલીન  
 ને બોલ અથડાય છે અભેદ્ય–  
 નથી સાંભળવું  
 દીવાલોમાં–  
 ચૂપ  
 હાર્ડસ્ટુલના, એન એક્સક્લ્યુઝિવ ઇન્ટરવ્યૂ જેવી–  
 ચૂપ  
 ગંજાવર નવલકથાઓ  
 ચૂપ  
 શોભાયાત્રાઓ-સભાઓ-રાંડિરાંડના ખભાઓ–  
 ચૂપ મર  
 ચૂપ મરું, મોંમાં મગ ભરું કે ચારધામમાં હરુંફરું  
 નથી ઉત્તરવાનો આ હાર્ડ–  
 સ્ટુલ–  
 ચપોચપ–  
 ચુસ્ત–  
 નર્યો  
 હું નથી, એક વર્યો ગોપીજનવલ્લભને  
 પણ હું એનો જ  
 વારસદાર, હજુ સુધી નથી મર્યો  
 નિર્ભાત, નર્યો

બૂમ પાંકુ છુ  
 ફરી ફરી  
 બૂમ પાંકુ છુ  
 ઘટાકાશમાં  
 દોદળી

અને કવિતાની કરું છુ—  
 આમ-

પિટિઅસ-  
 પોદળી.

અને ઉલેચાતો નથી હાડ્ક-  
 ઉત્સર્ગની ભાન્તિ કરાવતું

મારું  
 બા ચા પા થી  
 આરંભાયેલું

કાવ્યજીવન  
 વિષાવિજનમાં-  
 કરાંઝે છે  
 કમોડ પર  
 એકાંતમાં

એકલું એકલું  
 ને  
 આઈ ઓમ ઈનકેપેબલ ઓવ કીપિંગ સાયલન્ટ  
 ઊંઠ....ઊંઠ...

‘ક્રિંગ લીઝર’ના અંતે શેક્સપિયર કહે છે :

‘The weight of this sad time  
 We must obey  
 Speak what we feel,  
 not what we ought to say.’

પ્રતેક સર્જક કલાકારને પોતાના જિન્ન સમયનો ભાર સાખેદ વહેવાની (રણ્યામજી ?) ઘડી આવે છે પણ તત્કષે જો તે લાગ્યું તેવું ના ઉચ્ચારે – અને ઉચ્ચારાનુસાર ના આચરે તો તે પરંપરાપૂજક પોશીપોપટ બની જાય ! અને યાદ રહે કે પ્રતેક સમર્થ પરંપરાભંજક સર્જક પરંપરાને પરમ નિર્ણયભાવે પણ ઉલટી રીતે પૂજતો હોય છે. કેમ કે પૂરતી ઓળખ વગર એ ઉચ્છેદ શાનો કરે ?

તીવ્ર તાદીત્ય (આઈનિફિકેશન) વગર એ પરંપરાના પુરાણકલ્યાણનું ડિમિનિફિકેશન કરવાની ચેષ્ટા કે કષ શા માટે ઉપાડે ? આ માટે ડિમિનિફિકેશનનીયે મિથ કરવાની હંદે એને જવું પડે, પરવશપણે !

પ્રસ્તુત પ્રક્રિયામાં વિરોધ, વિરોધભાસ કે વદતો વ્યાઘાતનાં સ્બલનો દૂષણરૂપ ન બનતાં આવા દર્શન-સર્જનમાં આભૂષણ સમાજાં ઓપે. દા.ત. ‘પ્રવાહણ’ કવિતાના આરંભમાં જ બેંકેટ-આયનેસ્કોની ઓલાદ જેવું અવતરણ Nothing is more real than nothing. અહીં ‘real’નો સ્પેક્લિંગ ખોટો ‘rael’ છાપાયો છે. એથ સોમિંગના માત્ર વિરોધ દાખલ, જાણી-જોઈને જવા દેવોય હોય તોય હરકત નહિ.

પરંતુ નિર્ભાતિકરણને લાગેવળો છે ત્યાં સુધી કવિ લાભશંકર પારદર્શક અને ગ્રામાણિક છે. ‘સજડભૂ ફાંદા’ સાથે કમોડસ્થ ચેતના બાપોકાર કરી ગુર્જરગિરામાં ગર્જે ગાંગરે છે : આઈ એમ ઠંકેબલ ઓવ ક્રિપ્સિંગ સાયલન્ટ. એક મૌલિક્ય બુલંદ અવાજ ઉદ્ગ્રારે છે :

મારું બા ચા પાથી આરંભાયેલું કાવ્યજીવન વિષાવિજનમાં કરાંઝે છે કમોડ પર એકાન્તમાં.

અન્યત્ર કબૂલાત છે : ‘અને કવિતાની કરું છું આમ પિટિઅસ પોદળી.’

ભાષાભંગિમા અને ધારદાર શૈલીની દસ્તિએ, આવી સેટમેન્ટ જેવી શુષ્ણ જજાતી પંક્તિઓ પણ દીસે છે શું દોદળી ? યુનિક એવી, લાંઠાંની આ લીટીઓ કાવ્યોક્ત સ્ટ્રોલ જેટલી હાર્ડ હોવાથી છોલે, વગાડે, લોહી કાઢે પણ વેધક ગણવી પડે. ઊં...હ, ઊં...હ.

‘ઔર બાત બનતી રહેતી હૈ

યાનિ ક્રિ કુછ બનતા નહીં હૈ...’

આમાં હું ક્યાં છે ? કવિ કહે છે : ‘હું ક્યાંય નથી’ છતાં તેમની કાવ્યચેતનામાં નિવસિત અને તેથી જ ન-નિગાશ્ચિત એવો હું ગાય છે : સળગતા સનમાં વેદેહી મારી કાવ્યચેતના વલવલે. છતાં કવિ કેપેબલ છે સરૂરિયલ કાફ્કા-યાદ જગાવવા. આવી પંક્તિઓથી :

‘લાશ પણી લાશ પણી લાશ

સરકતી ચર્યેગેટની પાસ.’

એક જ લીટીમાં નાટ્યકથાલીજોનાં શુક્કણો પણ વેરાણાંના દાખલાય જડે :

‘પકડાયેલા પ્રેમી વ્લેમીબાપ મરેલો સાપ કથાકારસું પાપ...’

આહી ‘ઝી એસોસિએશન’ની રીતિએ વેમી બાપને મરેલા સાપ તેમજ કથાકારના પાપ સાથે પ્રાસંગિકતિ કરવાનું અવચેતનામાં ‘સમયિંગ’ અચૂક ખળભળ્યું છે. પિતા / પરમેશ્વર પરંપરાને, ટૂંકમાં ઓથોરિટીને ઓળખી પાડી, જાતે નિર્ભાત થયાથી બીજી સુખકર મૈથિક ભાંતિમાં ભાડવાની મજા જતી કરે એવો સર્જક તો હોય નહીં, હોય તો ભાવવો મુશ્કેલ (‘પ્રક્ષાલન કરી નાખ તારા બાપનું...’ પંક્તિઓ નોંધો....).

પરંપરાનો અજગર જેમને ગ્રસી ગયો હોય એવા પોપટ તો ચર્વિતર્ચર્વણ ને ‘ઉચ્ચિષ્ટ’ જ બોલે પણ જ્યારે કવિને ‘ક્ષણે ક્ષણે સ્થળકાલસ્પેક્શન જ્ઞાનવિજ્ઞાન કલાનું પંજરું’ ડેલાનું દેખાડે છે ત્યાં અને ત્યારે ભાવકચેતના પણ ડોલી ઊઠે એવું કલ્પનબદ્ધ સંઘાન ન્યાણી શકાય.

‘પરસેવો લૂધું છું કમોડ પર બેઠો બેઠો, શબ્દબ્રથનો’ જેવી પંક્તિ મને શબ્દોથી ખચોખચ ભરેલી બેકેટની કથાસૂસ્થિના નિર્વદના વીજાબકારમાં પરોવી ગઈ... અંગુઝુંાં ઓસર્ચાં કે બેકેટના શકટચકના ચીલા પર જ મેજર પોએટ બનવાની ધાસ્તી અર્પનાર સર્જકને સ્થિત સ્થિર જોવાની ઘાડી આવી, ધંટી બજી...

‘પ્રપિતામહે લખેલા કોડસ’ ભૂંસી શકાય એમ નથી, વિક્રોહનો દાહક દાવાનળ શબ્દથી પેટાવવો છે પણ શબ્દમાં રામ કે બ્રહ્મ નથી છતાં, તેવાય શબ્દકર્મ વડે જ ‘ચક્કાકર’ પર સંસ્કૃત કાવ્યચેતનાની મિથનું ફેલિકેશન યુગપતવત ચાલુ રહે છે. ‘હજુ સુધી નથી મર્યો નિર્ભાત’ તારસ્વરે ગતી અને ભરે દોઢળી પણ ઘટાકાશમાં ‘બૂમ પાડતી’ (કોરા કાગળમાંની બૂમ અહીં બૂમરેંગ થઈ કહીએ ?) ચેતના સ્વયં ‘કમોડ’ને પણ મિથની એક અપરિહાર્ય ઓળજેકટ, અથવા વધુ સાચું તો ‘સમયિંગ’ બનાવે છે.

તત્વદસ્તિએ કશું જ ના હોવાની અહેસાસ, ‘હોવાની’ સંઘટના સાથે – સંકળાયેલો અને – સંડોવાયેલો હોઈ તેમજ ભાષા પણ વ્યર્થને પ્રકટાવવાની પ્રક્રિયામાં ‘સાથ’ સ્થિર થતી હોઈ કવિ-સર્જકનું સાહિત્યિક પ્રદાન વિધીયાત્મક બન્યા વગર રહેતું નથી. રહે નહિ.

સ્વભાવત: વ્યક્તિ લાભશંકરનું વિષ્ણવિજ્ઞન, સર્જક લાભશંકર ટાકરનું – કાબિલેદાદ ને કલ્પનગુંઠિત, મિથિકલ કક્ષાએ વિહરતું-વિસ્તાવિજ્ઞન નિશ્ચિત બને છે.

‘જયયુ’ જેવાની મિથની ટેકણલાક્ટીએ ભાષાશિલ્પો રચવાં એને મારા જેવા રસધારાવાહી નવલ-કથા કહી નવાજવા આતુર રહે જ, પરતુ ‘કમોડ’ સ્થિત કાવ્યચૈતન્યની ‘મિથ’ની અંગતતમ ને મૌલિભૂત નવલ – કાવ્યકળા લાંઠાં જેવા કો’ક જ સર્જ શકે; તેથી ભાવના-વાદી ‘યુટેપિઆ’ની સામે તીરે તરવાનું સાહસ વાસ્તવવાદને સબળતાથી મૂર્ત કરવાની ચેષ્ટા આવકાર્ય ઢરે.

‘દેખોય’ જેવા નખરાળા સામયિકમાં રશિયન કવિ યેવતુશેન્કોએ ૧૯૭૨માં કવિતા પાસેથી ગંભીર અપેક્ષા સેવેલી કે, ‘કાવે મનુજના અવાજની તમામ પંક્તિઓ જેવી કે બૂમબરાડા, ગોષ્ઠાગુંજનો, વાર્તાલાપો, વિલાપો અને ધ્વનિશૂન્ય મૌનને પણ પ્રતિબિંદિત કરવું ઘટે.’

કવિ લાભરંકર ઠાકરના ‘પ્રવાહણ’નો પાઠ કરતાં આ બધી જ વસો ભાવક સમક્ષ વિવિધ વેશાંતરે પ્રત્યક્ષ થયા વિના રહેશે નહિ. પૃ. ૨૧ ઉપર ‘હેટ મી સ્ટોપ ટોકિંગ ફોર અ મિનિટ’ નાયકના ઉદ્ઘાર પછી બે પંક્તિઓ શબ્દરહિત રાખી દસ ડોટ્સ ઉપર-નીચેની બે પંક્તિમાં પ્રસ્તુત થયા છે પછી લગભગ સવા હુંચ જેટલી જગ્ગા છોરી, બંધ પડેલી સ્વગતોક્તિઓની ટેપ ફરી ચાલુ થાય છે. આમ ‘હેટ મી સ્ટાર્ટ અગેઈન, ઊં...હ, ઊં...હ / ઈટ વિલ પાસ ધ યાઈમ, ઊં...હ, ઊં...હ ...ઈટ. કમ્બિંજ આદિ કવિઓની કૃતિઓના મુદ્રણમાં સાધારણથી વિભિન્ન એવું અહીં પણ દસ્તિગોચર થાય છે.

‘નંંંંંંંં’ને ‘ખોર રિયલ’ શબ્દકૃતિમાં સિદ્ધ કરવા મથતું સબળ આદેખન કમોડિસ્થિત સંચેતનાને નિશ્ચિત અને ‘સમંંંંંંં’ બનાવીને જ છોડે છે, પણ બહુ મહત્વનો મુદ્રો એ નથી.

‘પ્રવાહણ’ જ આપણા ભાષા-સાહિત્યની એક પ્રથમ સબળ રચના છે. જેમાં કાવ્યનાયક મિષે સર્જકચેતના એનલ-ઓરલ-જેનિટલ મનોદશામાંથી કેવી અને કેટલી રીતે ગુજરી એનો સકળ શાલ્લેટ આદેખ પણ આપી રહે છે.

‘ચક્કાર ઘૂમતા’ કવિના વિશ્વવિજનિક ગ્રામાંજિક હુર્દ્દર્શનના પ્રતીક સમા કમોડ પરથી થતો રચનારંભ પેલા એનલ સ્ટેજને પરિલક્ષિત કરે છે. આખી કૃતિમાં ઉક્ત એનલ-અવરસ્થાનાં બહુરંગી ચિત્રાણનાં નિર્દ્દશનો અત્રતત્ત્વ મળી આવશે. ‘ઈન્સ્ટેટ્ક થિયરી’ અનુસાર ચેતનાના લિભિડોનો વિકાસ ગુદા-વિષામાંથી સાંપડતાં ઈન્ડ્રિયુબ સાથે સંકળાયેલ છે અને શિશુની જાત-સભાનતાનું કેન્દ્ર પણ તાં જ શોધવિષય બને એવું છે. આવા વિશ્વેષણનો ઉપયોગ એટલો કે કાવ્યકૃતિ દ્વારા શબ્દાભિવ્યક્તિના માધ્યમથી આવેશો કે આવેગોનું પર્યાપ્ત સામાજિકીકરણ સંભવ્યું છે બર્દું ? તે તપાસનું ઘેરે. ઈમ્પાસ (મડાગાંઠ) શબ્દકર્મની સભાન અભિવ્યક્તિમાં અવતરી – એટલે સોશ્યલાઈઝેશન સામાજિકીકરણ તો થયું જ. સાથોસાથ સર્જકનું દર્શન ભલે ન-અસ્તિત્વાચક હોય છતાં એની સાથે સામાજિકીકરણની પ્રક્રિયાને જ ચુસ્તપણે વળગી પડવા જેવું નથી.

એક તો ‘પ્રવાહણ’ શીર્ષક જ ઉક્ત એનલ સ્ટેજની છડી પોકારી હે એવું હિંમતપૂર્ણ દેખાવવાનું છે પણ સર્જકચેતના એ અવરસ્થા પૂર્વે તદ્વન સ્વાભાવિક રીતે જેમાંથી પસાર થઈ એ ‘ઓરલ’ સ્ટેજનાં મુખ્યમુખ સરસ દણ્ણાંતો ગોચર બન્યાં તે નોંધપાત્ર છે :

‘કળી-મમરા, સૂતરઙ્ગેણી અને લીલીલીલી ગળચટી કમળકકડી  
યમેટાં પાકાં દેશી લાલ, કેડ કેડ મૂળા-મોગરી...’

સ્વાદુપિંડ ગ્રંથિરસ ઝરાર નિર્ઝરે એવી લથબદ્ધતાથી ‘લોચનને લોભાવનારા લાડવા’ (અમારા કોલેજવાચનકાળમાં સહાધ્યાયી લાંઠાં સાથે પન્નાલાવની ‘લાડુનું જમણ’ ઘણી ઘણી વાર વાંચેલી, જીના કાળુપુર સ્ટેશન પર, કોલેજ મેસોમાં, તેમના વૈદ્ય નિવાસે લાડુ આરોગેલા એની સંસ્મૃતિપૂર્વક...) ‘વહાતી મુંને ખીચડી’, ‘બટાકાની ભાજી સુખી ગરમ તાજી’ની. સાથે

જ એકદમ પંક્તિ ઉત્તરી છે :

‘વાટક ભરીભરીને રસ, કેરીનો, યસ

ને કસ જેંચીને સૂર્ય-ચંદ્ર જેવા સમુજ્જવલોને ચસ ચસ’...

અહીં ‘સક્રિંગ’ની ઓરલ કોરેક્ટર ‘સેન્સ્યુઅસસ અને ‘એરોટિક’ શુંગારિક વળાંક ધારણ કરે કે સ્થિર થાય તે પૂર્વે જ –

‘શમાયણ-મહાભારતને ધાખ્યો હું બચ, બચ, સચ’

ધાવવાની ચેષ્ટા પર સર્જકની સાંસ્કૃતિક, પારંપરિક, અભિજ્ઞતાનું પ્રલેપન (સુપર ઈમ્પોલિશન) થયું છે.

પૃ. ૪ પર વાંચો :

‘અગ્નિયાર મોએ પી પી કર્યુ છે ચાખ ચાખ કર્યુ છે

ચૂસ ચૂસ કર્યુ છે ચાવ ચાવ કર્યુ છે.’

અહીં શું શું ચાયસ્યું-ચૂસ્યું-ચાવ્યું (ચોષ્ય) છે એમ પૂછવા કરતાં, શું શું નથી ચૂસ્યું કે ચાગાયું છે એમ સામેથી પૂછી શકાય એવું ઘણણબધું હાજર છે.

‘શ્વોતોમયીના અતિ સૂક્ષ્મ ગઢ્ઢવરોમાંથી જમતા

અદશ્ય પણ સ્પર્શ મધને...’

થોનિ જિછવા (સમાગમની) વિલક્ષણતાને સ્પર્શો છે ‘લળકતી જ્ઞભ’ !

દર્શનથી નહીં એવું જિછવાથી, આવું અપૂર્વ પર્સોણન’ ગુજરાતી નિરામાં લાભશંકરની લેખિનીમાંથી પ્રશ્નાયું.

‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા’-ની પ્રચારિત ઉક્તિ પૃ. ૨૧ ઉપર આમ ઉદ્ધૃત થઈ છે :

‘ઉછાળે ગેંદ વેજાઈનલ વેક્યુમમાં...’

એનલ-જેનિટલનો સંકર પણ અહીં સંભવ્યો.

પૃ. ૨૦ ઉપર નિર્વસન, સીસમ જેવી શ્વામાની બૂટ પરથી લસરીને નારંગી રંગનો તડકો સોનેરી રોમાવતીને ચમકાવતો દૂંઠી પર પડ્યો ત્યાં ‘ભઙ્ગંગ-ડાઈ મારવા’ની અભિવ્યક્તિ, એરટિક-સેક્સોટિક સાથે એકોટિક પણ કહેવા ઉતેજે એમ પ્રકટી છે.

‘ચાંદો’ સાથે ‘ફાંદો’, ‘એનિસ’ સાથે ‘પેનિસ’ પ્રાસ પૂરતું જ પ્રયોજન પકાવે છે એમ તદ્દન સમજ બેસવું બાલિશ છે.

તત્ત્વતઃ, કમોડ પર બેઠો બેઠો શબ્દબ્રહ્મનો (અને શબ્દસર્જિત ભમનો નહીં ?) પરસેવો લૂધતો નાયક દૂર અંધકારમાંથી પણ ‘ગૂઢાતિગૂઢનો અભેદ્ય રણકાર’ સાંભળવા સક્ષમ હોવાનું માત્ર કહેવાથી – નિરીક્ષણ અપૂર્ણ ગણારો.

હકીકતે ‘ગૂઢાતિગૂઢના અભેદ્ય રણકાર’નો ટંકાર સાંભળવા એસ્ટાબ્લિશમેન-જમાતના

કેટલાય લેખકો કરતાં તે અત્યંત આતુર છે. મારા મતે કર્તાના ‘નથીંગ’નું ‘ભોર રિપલ’ વિસ્તાવિક્રિન  
(માઈએડ વેલ કવિક્ષિત વિષયવિજ્ઞાનનહીં) આવા કાચાંશોમાં ભોક્તાતુર વિસ્તરી પડ્યું છે.

કવિની અંતરતમ-ચૈતસિક રેખાઓ જેટલા પ્રમાણમાં પ્રામાણિક વિધાનોમાં આવિભાવ  
પામી છે એટલા જ પ્રમાણમાં, માત્રામાં આધ્યાત્મિક કહો કે સૂક્ષ્મતઃ ધાર્મિક છે. વેદનાને  
વિદૂષકનું મહોરું પહેરાવતી શૈલી – અર્થાત્ આવંબન લેવાની અનિવાર્યતા, નૂતન સાહિત્યિક  
પ્રવિધિની પ્રતિજ્ઞા કરે છે. જુઓને, ગુરુ ચાંડાલીય હીનોપમાની નિકટનું મજાક વેરતું વિધાન :  
‘ધન્ય સૌરાષ્ટ્રની ધરતી જેણે આચા ગાંઠિયા અને ગાંધી’ ! અહીં ગાંઠિયા સાથે, કહો કે  
ગાંઠિયાની સામે ગાંધી-જ્ઞને સહોપલબ્ધ કરવામાં ટિખળ જેવું નાચીજ નખરું જ અભિપ્રેત નથી.  
ઉદેશ તો વિપરીત છે. જે વિશ્વમાં સર્જક શસે છે એમાં પ્રગટેલો સંદર્ભ ‘ધ્યમન કંડિશન’ને  
એવી અવસ્થામાં ઉપસાવી રહ્યો છે જ્યાં મજાકની મારફતે જ કરુણ વિલસે ! લાભશંકરની  
દઢ મુદ્રા ધરાવતી શૈલીનું આ એક પરિમાણ જો ના પ્રમાણાય તો ગેરસમજ ઘેરી બને.

વાસ્તવમાં ‘ખોલોકસીને હટાવવા’ કર્તા પ્રતિબદ્ધ દીસે છે પણ જાતે થઈને કશું ‘કરી’  
શકે એમ ના હોવાથી, માત્ર ‘કહી’ને કાંક કરી છૂટે છે, શું ? ‘નથીંગ ટુ બી ડન’ એમ ભલે  
સુણાવી દે પણ પણી –

‘વનમાં

મનમાં

તનમાં

ધનમાં


સળગતા સનમાં

વૈદેશી

મારી કાચ્યેતના વલવલે.’

પ્રેમાનંદની વૈદેશી વનમાં નળવિહોણી વલવલતી હતી, બરાબર એટલી માત્રામાં શબ્દસ્થા  
વલવલ પ્રકટ કરતી, વલવલ કાચ્યેસર્જન કરતી કશાક અભીષ્ટ માટે ‘સળગતા સનમાં’ અવશ્ય  
પ્રત્યક્ષ થઈ છે. આવું બધું પામવા માટે આપણે કેવળ ‘કૃતિની ભાષા’ સમક્ષ જ પ્રણિપાત કરી  
એકસૂરી ધૂનમાં મચી પડીએ તે કેમ ચાલે ?

પૂ. ૨૪ પર ક્ષિતિરસ ‘ટેઇલિઝ’ રૂપે રૂપેરી પરદે પરિષાત થતો બતાજ્યો છે. હવે ‘ટેઇઝ’  
પુષ્પ વચ્ચે પીળું ને ફરતે સર્ઝેટ હોય છે. ‘પ્રવાહણ’ પણ એક પ્રકારનું ‘ટેઇઝ’ ફૂલ છે. વચ્ચેથી  
વિષાસિક્ત પીળું પીળું, પણ એની ફરતે કર્તાના નિર્ભાત દર્શનથી શુભશૈત...



## ૨૬. જન્મથી જ મૂકેલો છે ટાઇમબોમબ કોણે ?

રજેશ પંડ્યા

### કાલગંથિ

શાસ લઉં તો પીડા લાડા,

શાસ મૂકું તો પીડા.

ડાબા પડખે પીડા લાડા,

જમણા પડખે પીડા.

ચત્તોપાટ સૂતો છું તોપણ પીડા પીડા પીડા.

એકસરખી એકધારી અતૂટ પીડા.

હોસ્પિટલના જનરલ વોર્ડના પવંગમાં રેબેલ, અધરાતે મધરાતે  
સૂતો છું પીડાગ્રસ્ત

ક્ષાળ પછી ક્ષાળ પછી ક્ષાળ સ્પષ્ટ સ્પષ્ટ, પ્રગટ  
અનુભવાય છે પૂર્ણ જાગૃતિમાં —

સમય અનુભવાય છે પીડા—

ન્તર પામીને પ-સા-ર થતો ધીમે ધીમે

અહીં આ મારા ઉદરમાં.

નિષ્પલક ખખડ ખખડ

સ્ટ્રેચરમાં લઈ જવાતો બંડમાંથી —

પેસેજમાંથી —

લિફ્ટમાંથી —

નીચે

નીચે

નીચે

ખખડ ખખડ ખચકતા

ઉંચકાતા આંચકા સાથે લિફ્ટમાંથી બહાર -

કઢતો પેસેજમાં

હજારો હજારો સેકન્ડું સુધી એક્સ-રે - રૂમની  
બહાર પ્રતીક્ષામાં -

પીડાતા પેટમાંથી પસાર થતો  
અખંડ, પરિપૂર્ણ, અનવદ્ય, નિરન્ધ, સોલિડ સમય  
તારો સાક્ષાત્કાર પૂર્ણ  
આવો કદી થયો નથી.

તુટક તુટક કદી તારા આણસારા  
અનુભવ્યા છે કચડાયેલી આંગળીમાં, ગામ છોડીને - મા છોડીને  
નગરમાં પ્રવેશોલા કિશોરના મૌનમાં, રાવજીના સ્મરણમાં,  
તરછોડાયેલા બેઘર ભૂખ્યા અર્ધનગ અસંખ્ય  
હડપિંજરોની પસાર થતી લથડતી ભાંગલી તૂટલી કીણ જરઠ  
સૂકી લૂખી કાળી પ્રલંબ કતારોમાં

તને જોયો છે કલકત્તામાં સમય ખં-

ડિત, લથડાતો,

અથડાતો તને, અધરાતે અનનોનમાં બેગબિસ્તરા ઉંચકીને  
રજાયો છું ઈધર ઉધર લંડનમાં અનિશ્ચિત, સમય  
રસ્તે રજાળી ખોપરીમાં તને જોયો છે;

જોયો છે મરી ગયેલા ઢોરને

વીંખી પીંખી ચુંબતા

ગીધોના તદ્વાપ ફર્ફાટમાં -

ખવાઈ ગયેલા જીર્ણ પુસ્તકના પાને પાને જામેલી ગન્ધના  
નાક સુધી ઉંચકાતા કષોમાં,

કોણાર્કની બંડિત યોનિઓમાં,  
સભલન પૂર્વની ઉંઠટામાંથી તૂ કું તૂ કું થતો, બગલના વાળ સાથે  
કપાઈ જતો, હાથમાંના બરફના ગોળા સાથે અચાનક જમીન પર  
ગબડી જતો, કપાયેલા બટાયમાં ઈયળ સાથે સરકતો,  
હાથમાં પકડેલા દેડકાની જેમ થરકતો અને ઠંકું ઠંકું

મૂતરી જતો, સમય

તને અનુભવ્યો છે આમ તો સતત પણ તુટક  
તુટક, કવચિત્ મારી કાવ્યચેતનામાં શબ્દોની ગતિમાં  
ગતિમાન તને સ્પર્શ્યો છે મારી કર્ષિચેતનાથી, સમય  
પણ તારો આવો અખંડ પરિપૂર્ણ સાક્ષાત્કાર  
આ પહેલો છે.

નિતાંત વેદના રૂપે આવ્યો અખંડ અમિત્ર સમય  
કલ્લાકો કલ્લાકો  
સુધી આ સજ્જવ દેહમાંથી, ચેતનામાંથી સ-ર-ક-તો –  
સ-ર-ક-તો

તને અનુભવ્યો પૂર્ણને ચાલ્યો ગયો.  
એક્સરેઝ-માં ન લિલાઈ તારી  
છબિ.

ભૂખ્યા ખાલીખમ્મ પેટમાં તને ફંબૂરી શક્યો નહીં.  
તું તો પસાર થઈ ગયો  
હોસ્પિટલની શુભ દીવાલોને ઘ-સા-  
તો ઘસા-તો

મારી વેદનાને આત્મસાતુ કરી, ક્યાંક.  
હવે માત્ર સમૃતિ રૂપે સ્મૃતિશેષ, શબ્દશેષ  
સમય, મારો સાક્ષાત્કાર, મારો વેદ, મારી વેદના, સમય  
શું તું ચોંટી રહ્યો છે મારી ચેતનામાં અત્યલ્ય ફરકતો ?

કદાચ.  
તડકાનો મૂદુ હાથ જમણી બાજુથી  
અને અપંગ દર્દીનો કીણ હાથ ડાબી બાજુથી  
પકડવા મથતા હતા તે નારંગી તારી પુષ્ટના થરકાટથી  
ગંબડી પડી ટેબલ પરથી.

આ તારું અંતિમ દર્શન હતું હોસ્પિટલમાં.  
એ પછી તને શોધું છું, સમય,  
ખાલીખમ્મ મહેલની આયરીએ ઊભેલા વૃદ્ધની આંખોમાંથી  
સામે દૂર દૂર પથરાયેલી નીરવ નિર્જવ યુદ્ધભૂમિમાં –

જ્યાં ગીધોના - સમડીના - કાગડાના ચિત્કારો છે કદાચ;  
પણ એના અવાજ

વૃદ્ધના કાન પાસે આવીને અટકી જાય છે.  
એથી અવાજ રૂપે તને પામી શકાતો નથી.  
માત્ર ગીધ-સમડી-કાગડાના ઊડાઉડ-ફફડાટો-ચૂંથાચૂંથ રૂપે  
તને પામી શકાય છે;

અને તેથી મોતિયાની આરપારના  
અંખાં જાંખાં શ્યામ ઉછળતાં ટપકાંઓ રૂપે, સમય  
અને તેથી આમ મીંચેલી અંખની અંદર, મેટાઝોરિકલ.  
સમય, તું મેટાઝોરિકલ ટપકાંઓ છે માત્ર

વિસ્થિન્ન, અલગ સાવ ?

સાવ અન્ન-એક્સાઈટિંગ ?

ફેન્ટસી કે આર્ટિફિસના ઈન્ટરવેન્શન  
વિના તને પામવો છે મારે; ડેમ કે 'વાર્તા' એ માનવપરાજ્યને  
ઢંકવાનો અજ્ઞાત રસ્તો છે. તેથી દેંડ ફોર્મ્યુલાજ સુપર ઈમ્પોઝ  
કરવાની ટેક્નીકને સાવ ચીરી નાખીને-

નીચે-

એની નીચે

મારે મને પામવો છે સમય;

તેથી તો સતત આ રિયાલિટીનું

ઉત્થનન કરતો કરતો

ડ્રોબ વિશેની કરું કવિતા

વણધોયેલા ભૂખરા મેલા રંગની રે  
કંઠણો ઉપજાવે એવી એકસૂરીલી  
દંડ અને કાણાની હરફમ, તંગની રે.

કૂબડી કૂવડ કુલટા-ના  
ઉઘડેલા ઊલટા અંગની રે.  
ગોળાકાર ગતિમાં આગળ વધવું, ચડવું  
ક્ષૂપિડ થઈને  
બચ્ચા-કચ્ચા હીન ભૂમિમાં ડચ ડચ ડચ

ડિબોચરીના ખર્ચરને ડચકારી  
આકડભાજ-ફંકડો-પુરુષ બનીને  
બિલિગ્રાજેટ-ની

બુલેટ્સ છોડી

ધડ ધડ ધડ ધડ

પીપ-ટોપલી-ડભામાં સૂતેલી બિચના

કાઉના અવાજ વીંધી

નીક ગટરમાં ઉડે ઉડે બ્લેક બીટલ થઈ

ફરકાવી મૂછ દૂઅર બનીને

કુ-ડીડ-ડનના કુઠીંગ રચવા

ઓભા હલેસે ફોસ્ટિટ ખોલી

નિકલ - ફડચો - નિઝાય - દઢતા - કસૂર - ગજીલત - હાર - પરાજય -

મનોભંગ -

હા અદબ વિશેની, લોભ-મોભ ને થોભ વિશેની

પ્રિક-પ્રિકલના સંકુલ સંધા સંગની રે

કરું કવિતા

કૂસ વિશેની -

અપ્રિદેશન -

દૂશ વિશેની

કર્યા પછી તુર્ત જ લઈ લેવો દૂશ સમયસર

પછી ન ઉગે સંભવના કોઈ લવ અને કોઈ કુશ.

બાઈટ ઓફ્ફ મોર ધેન યૂ કેન ચ્યૂ યાઈમ

ઓન્ડ ધેન ચ્યૂ લાઈક હેલ.

ફેલ-

નાગી ઉઘાડણોગી

કૂવાને તળિયે જઈ પોગી.

અને બ્રહ્મના ઈડામાંથી સમય ઉઘાડચો

ટેંહોંક..ટેંહોંક...

જણો જનાના, ખખડો, ખીલો ધૂળ અને ફેફામાં

સાર્વનામિક

જ્યાજળોમાં

કવીની

તુર્ગમાં કેદ

હેતે છલોછલ

હૈયાં ઉછાળતાં ઊભાં આડાં સાથળનાં વનમાં

દિવ્ય સ્પર્શ-દર્શનનાં વમળોમાં ગ્રસ્ત

શ્રદ્ધાની કાચેરી

ઈટો પડાવતા મનમાં અને ચાંદીનો મોબ નખાવતા

તનમાં અને સોનાની વળીઓ નખાવતા, ઉડાડતા રે

ધૂમાડા અભીલ-ગુલાલના, જેતર-પાદર ખેડતા, રાતી રાતી

રંગ ચણોઠડી જેવાં, જળ ભરવાને જતાં જોઈ રહું છું, આઉટ.

આઉટ થઈ ગયો છું હું, ગેટ આઉટ થઈ ગયો છું હું

ચૂપ બનીને

વાંચું છું જાહેર નોટિસ સેરિબ્રલ લાઈન પર

જરૂરી સમારકામ કરવાનું હોઈ હિફ્ઝી વન ડાઉન

કૂલરિશ-કૂલો-કૂલાવર સબસ્ટેશનમાંથી પી-કવાર્ક એન-કવાર્ક

સમયસર નીકળી શકશો નહીં અને લાઈનનું સમારકામ પૂરું થયે

કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના

વિદ્યુત-પુરવઠો

રાખેતા મુજબ ચાલુ કરવામાં આવશે

આવશો

તલાવડીની પાળે બે આંબા હો બંધવા

એની ડાળે ડાળે અઢળક કેરી આવશે

આવશો

તેથી

હરાજથી કાચી કેરી વેચવા અંગે જાણ કરવામાં આવી છે સમયસર

કે હરાજના સમય પહેલાં કાચી કેરીને કલ્યી લેવાની રહેશે

આ પછી પાછળથી કોઈ તકરાર સાંભળવામાં આવશે નહીં.

હરાજની શરતો સ્થળ ઉપર તુબુરુમાં

વાંચી સંભળાવવામાં આવશે, સમયસર.

અને સ્થળ ઉપર

અમે બેઠા છીએ પ્રતીક્ષામાં મેટાલેંજેજની સપાઈને સુંધતા,  
મનવગડામાં ખમકે ઘૂઘરમણ તેને સંભળતા,  
રૂડી બાજરીનું રાંદું રોપતા

સૌંદર્ય અને કળાની

ગંધનું અનુમાન કરતા

ઓન્ટોલોજિકલ એકાક્ષથી

તડકાના પક્ષમાં

પડછાયા સાથે એન્કાઉન્ટર કરતા.

આ પ્રક્રિયા, આ તબક્કાઓ,  
આ દરમિયાનગીરી, આ સન્નિકર્ષ, આ પ્રભાવ, આ પરિવર્તન,  
આ અન્યોન્ય નિર્ભર મૃત પદાર્થની અથડામણ વચ્ચે  
કોઝિનિટિવ કલેઇમ કરતા બોબડા વ્યાપારોના વહાણનું પાણી  
ઉલેચતા, ઈન ગાઈમ,

આહાં ઝન ઝન ભવ્ય સત્તાર !

બોલો બચુભાઈ, બા બા બા

મૂળ વસ્તુ જડ પ્રકૃતિ જ છે, બચુભાઈ બા બા બા

તે જ એક અદ્ભુત યંત્રની જેમ વિકાસ

પામતી

પામતી

ઈન ગાઈમ, જાણારું

સમજનારું

વિચાર કરનારું

વધનારું

અને પેદા કરનારું ચેતન રસાયન બની જાય છે

બચુભાઈ

બા બા બા

કેટલાંક ઊંચા પ્રકારનાં યંત્રો એવાં હોય છે કે

પોતાની ગતિનો અહેવાલ નોંધી શકે, બા બા બા

કાંઈક ભૂલ થાય તો અટકી જઈ શકે છે, સમયસર  
 અને તે રીતે ધ્યાનિકનું ધ્યાન ખેંચી શકે છે  
 ઊંઘી નહીં જવાનું બચુભાઈ  
 બોલો બચુભાઈ હા હા હા  
 પોતાની ગતિ જરૂર પ્રમાણે પોતાની મેળે જ  
 વધારી કે ઘટાડી શકે છે. હા હા હા  
 કેટલાંક વિમાનો વિમાની વિના જ  
 ધારેલ સ્થળે પહોંચી શકે છે ઈન ટાઈમ  
 અને પાછાં આવી શકે છે, ઈન ટાઈમ, હા હા હા  
 શું તું એવું યંત્ર બની શકીશ, બેટા બચુ ?  
 તારી ગતિનો અહેવાલ નોંધી શકીશ, બચુડા ?  
 ભૂલ થાય તો અટકી જઈ શકીશ, બચુડિયા ?  
 બચ બચ આંગળી નહીં ધાવવાની, દીકરા.  
 બોલ, જરૂર પ્રમાણે તારી ગતિ  
 વધારી કે ઘટાડી શકીશ ?  
 વિમાની વિના જ, બોલ બચુ, ધારેલ સ્થળે પહોંચી શકીશ ?  
 અને પાછો આવી શકીશ, મારી સાત ખોટના બ-ચુડા ?  
 અને બચ બચ કરતા બચ્યા રાણા

આ પ્રત્યક્ષ લોકના

નીચે ઉપર ડાબે જમણો ફેલાયેલા

મિરરમાં

શોધે છે ઉત્તરો. ત્રણ શકમંદ ત્રાસવાદીઓએ કરેલા  
 આડેધડ ગોળીબારના અવાજોને

ઝીલી લે છે મહિતાજની

સોળપેજુ કાઉન સાઈઝની ઝોળીમાં.

પશ્ચિમ રેલવે સમર સ્પેશિયલના સમય-પત્રક પર  
 સુજ્ઞ દાણિને સ્થિર રાખીને વાંચે છે :

ન હન્યતે હન્યમાને શરીરે.

પછી, બચુભાઈ, પાણીએ વિચાર કર્યો કે હું ઘણાં રૂપ ધર્યું,  
 પછી તેણે અન્ન ઉપજાયું - વન ઉપજાયું - તન ઉપજાયું -

મન ઉપજાવ્યું

બચુભાઈ ચમક્યા, તરસ લાગી છે મારી બેટી,  
ક્યારનીય -

એ તો ધર્યા, નેચરલી, પાણી પીવાના નળ પાસે  
ઘણુંય સખળાખળ કર્યું શતાબ્દીનો સુધી  
પણ એક ટીપું જો નીકળે સમ ખાવા જેટલું.

બચ બચ

બચુ-બચલા-બચુડિયાઓ-બચુભાઈઓ બસ કરો.

કેંકિંગ મિરરમાં ફૂટી ગયાં છે તમારાં પ્રતિબિંબો

આભનો સાગર

જળ જળ ભરિયો માંહી સૂરજ ને સોમ,

આ આરે છે ધરતીની ભેખડ  
ત્યાં અથડાય છે મારો સમય લગા ગાગા ગાગા —  
ચૂરેચૂરા થઈ જતો લલલ લલગા —

વેરાઈને વિચિછન થઈ જતો  
પૃથ્વીના કરોડો કણ કણમાં ગાલ લલગા —

શા માટે હું

ઇન્ફારેડ સંવેદનશીલ નજરથી તાકી રહું છું  
અને રિમોટ સેન્સિંગથી સુંદું છું પૃથ્વીને ?

હસી હસીને

બેવડ વળી જાઉં છું અચાનક આમ, શા માટે ?

શા માટે

ખડખડાટ આળોટું છું કાવ્યપ્રક્રિયાના આ કાણ સુધીના  
પ્રલંબ પાથરણા પર

બધું વેરવિભેર કરી નાખતો ?

અંહાર્યના ઝીણ કાઢવાનું બંધ કરી  
ઉઠ અલ્યા તું બેઠો થા રાઈમના રસ્તે  
કાવ્યપંક્તિઓ શેકી ખા રાઈમના રસ્તે  
શેકતાં શેકતાં રાત પડી રાઈમના રસ્તે  
અને રીતસર દેખ ઉજ્જડ આકાશમે

ટ્રિવિકલ ટ્રિવિકલ લિટલ સ્ટાર્સની ભાત પડી  
 ઔર નીચે ખડી વાંકી બજૂરી  
 નક્કર ઘડા ઉપાડી બે,  
 દે દે તાડી પી  
 તારી પીધી ઘડા ભરી બે : જે શિવશંકર જે;  
 નારી તોડી, નહીં બોલું બસ, જે શિવશંકર જે.  
 હળવે હળવે હીંચો, બોલે બજૂરડી, રાઈમના રસ્તે  
 નક્કર નળથી સીંચો, બોલે બજૂરડી, રાઈમના રસ્તે  
 અખાજા દખખણ અડકો, બોલે બજૂરડી, રાઈમના રસ્તે  
 તૂ હે લબરમુલ્લિયો લડકો, બોલે બજૂરડી, રાઈમના રસ્તે  
 આમ અમે વાલ્યું બજૂરીમાં બી, હેયારા હેવે.  
 શાટ અપ યુ બાસ્ટર્ડ  
 સન્નાટો સન્નાટો  
 વિધાઉટ પેનિટ્રેશન, પ્રિમેચ્યોર ઠજેક્યુલેશન કરી  
 બી વાલ્યાંની વાત કરે છે, ક્લિબ ?  
 આ ત્યારે એમ વાત છે  
 અમારી પણ બચુભાઈની જાત છે,  
 'ટાઈમ'ની વાત કરતાં કરતાં 'રાઈમ' પર ચડી ગયા  
 રાધર પડી ગયા. વોટ અ કાઈમ !  
 એમાં પાછી બજૂરીમાં બી વાલ્યાંની વાત  
 અને તેથી આ ઉમરે, માય ગોડ, વોટ અ હ્યૂમર....!  
 ટ્યૂમર...  
 મનુષ્યમાત્રને જન્મજાત મળતી, ઠનેટ, ટ્યૂમર  
 મનુષ્યભૂતાનામ્ય કારણમ્ય -  
 અ-કારણમ્ય : જેનું કોઈ કારણ નથી..  
 પણ જે મનુષ્યનાં મન-વચન-કર્મનું કારણ છે  
 મનુષ્યમાત્રમાં એક એક અવ્યક્ત અતિસૂક્ષ્મ અનુમેય ટ્યૂમર  
 તકેદમ્ય પણ ઠન્યુમરેબલ એની ઠંકેકટસ્ય  
 બહુનામ્ય બહુનામ્ય કાર્યકારણમ્ય ટ્યૂમર.  
 ધ ટ્યૂમર ઓવ ટાઈમ.

કાલો હિ નામ ગ્રંથિ

સ્વયમ્ભૂ

ધુમન સ્પિસિસના

આરંભ સાથે એનો આરંભ.

સ સૂક્ષ્મામૃ અપિ કલામૃ ન લીયતે

ઈતિ કાલ :

એ સતત ધબકે છે, કલગ્રંથિ.

મનુષ્ય વ્યક્તિની આંખના

નિમેષોન્મેષમાં વ્યક્ત થાય છે એનો ફરકાટ

અને સંકળાય છે

ઓટમિક વાઈબ્રેશનસ - સૂર્યચન્દ્રના ઉદ્યાસ્ત - કાણા - કળા -

મુહૂર્ત-અહોરાત્ર-સપ્તાહ-શુક્લપક્ષ-કૃષણપક્ષ-માઘાદયો દ્વાદશ

માસ-શિશિરાદિ પડુંઝતુઓ-વર્ષ-સંવત્સર-યુગ.

બીજ ફૂટે છે

ને સંકળાય છે ટીશીઓ-પાંડેપાંડાં-ફરફરતા ફૂલગુઢાઓ-  
લટકતાં ફલો - ખરતાં પીત પત્રો - કડડ તૂટી નગન ડાળો-  
ઉન્મૂલ થઈ ધબકારા સાથે પછડાતી ઘટનાઓ-મુશળધાર વરસાદો-  
ધૂટેલા કેશર જેવા સવારના તડકાઓ-સૂની બપોરો-તોઝાની પવનો-  
સમી સાંજના પડળાયાઓ-સગર્ભા ગાયો-સૂકાં સરોવર-ઉત્તર તરફનો  
શીતલ પવન-રજ-ધૂમસથી વ્યાપ્ત દિશાઓ-

જ્ઞાનથી ઢંકાયેલો

સૂર્ય - કાગડા, ઘેટાં, ગેડા, પાડા અને હાથીઓની મસ્તી-

સંકળાય છે

ખાખરા, કમળો, બૂરસાતી, આંબા, અશોકની પલ્લવપુષ્પાંધો-

કોકિલના પંચમ સૂરો -

સણગતો પવન - નદીના પાતળા પ્રવાહો -

જળાશય માટે ભટકતાં ચક્કવાક પક્ષીઓ -

જલપાનાકુલ મૃગો -

ધ્વસ્ત લતાઓ - ઊમડધૂમડ ધનગર્જન -

નદીકાંઠાનાં ભાંગી ગયેલાં

વૃક્ષો - હંસપક્ષીઓનાં પડખાંથી ચલાયમાન કમળો -  
મસ્તકહીન મિનારા - કટાયેલા સિક્કા - કસબ - કામળા -  
હડ હવન - છંદોમય વાણી -

દવાઈ લામા -

ઠેમ - દાયકો -

સાંકેતિક લિપિ - સ્તવનગીત - અવશેષ - અવાજો ધુમ્મટમાં  
પડઘાતા - સેટેલાઈટ પ્રોગ્રામ -

બધું સંકળાય છે અને સર્જાય છે  
મનુષ્યની કાલગ્રંથિના નિમેષોન્મેષથી.

કાલ : સંકલયતિ.

મને - તમને - બચુભાઈઓને એ વિભક્ત કરે છે  
અને સંકલિત કરે છે. એ વિભક્ત કરે છે રામ - કિશ્ચ -  
લાડા - લવજી - ભોપાલ - ભિવન્દી - ધામ - ધૂમ - ધરતીકંપો -  
ધડ - ધાવણ - ફોસિલ્સ અને સંકલિત કરે છે.

એ ચૂસે છે

સતત સક્લને વિભક્ત અને સંકલિત કરતી.

અને સ્મૃતિનું ડોઝરું ભરાયાં કરે છે.

આંખ - કાનથી, સ્પર્શ - સ્વાદથી નસ્ય નિરંતર ચૂસ્યાં કરે  
ને ભર્યા કરે ભૂતોદર એનું કાલગ્રંથિ.

એ સુપર સેન્સ છે :

સેન્સ ઓવ ટાઈમ.

એના ડોઝરામાં સમાઈ ગયાં છે  
સંહિતાઓ - શ્રુતિઓ - શાનવિજ્ઞાનભેદો - વાદવિવાદો - ધર્મભેદો -  
જાતિભેદો - સ્થાનભેદો - માનભેદો - ભાનભેદો.

મનુષ્યની - મનુષ્યસમુદ્ધાયોની  
કાલગ્રંથિઓ સતત ચૂસે છે અને ઓકે છે

સમાજો અને સંસ્કૃતિઓને.

એ ઉલટીઓ અથડાય છે - ઝૂટે છે - તૂટે છે

નગરની શેરીઓમાં -

રાજ્યોની સીમાઓમાં - સમુદ્રોમાં - અવકાશમાં.

ભાષાના

કશે કશમાં, માણસ માણસની મુલાકાતોમાં -

યૌન રાતોમાં -

નતોમાં - જતોમાં - મદમાતોમાં - વાતંલાતોમાં -

ઈમ્પોઝ થતી,

સુપર ઈમ્પોઝ થતી ઉલટીઓ ગંધાય છે.

સડે છે સતત

ગંધારું અંધારું અડાબીડ ધર્મકારણમાં -

સમાજકારણમાં-રાજકારણમાં.

અને આ બધું ચૂસે છે સતત  
શિશુઓની, કુમારોની કાલગ્રંથિઓ.

કાલગ્રંથિ

તું મહા સમર્થ છે. નથી કરી કોઈએ તને ઉત્પન્ન.

તું આદિ, મધ્ય અને અંતથી રહિત છે.

સંત કહો કે જંત કહો

સતત સંતતિ-સાતત્યોમાં

અવતરે છે

કાલગ્રંથિઓ.

મારા જીવન-મરણનું કારણ તું કાલગ્રંથિ

કાલયત્તિ મનુષ્ય ભૂતાનિ ઠતિ કાલ :

કાલગ્રંથિ, તારું સ્મૃતિઓઝરું

સતત ઓકે છે

ચીકણા અધ્યાસો.

જે મને ચોંટાડી રાજે છે

પિતા-માતા-બંધુ સાથે;

નામ, રામ ને ધામ સાથે; વામ સાથે; વામા સાથે.

નનામાને નામ આપી તું ભાષાના રસ્તે ઢસડી

ચૂસી જાય છે.

ચૂસી જાય છે એક મુખે તું -

હજુ તો સ્કુટ થતા વર્તમાનને, કલ્યાનાની ફૂપળને

અને યુગપત્ર ઓકીને અતીત સહસ્ર મુખોથી

ખરડી નાખે છે મારા આશર્થને, મારા ટેન્જિબલ અવાજને.

બે મનુષ્યોની વચ્ચે, લયની પગદી પર

ઓડિબલ-વિલિબલ કળાઓ નામે

ઓકે છે તું

મમત્વનાં ખાબોચિયાં, ખાબડાં

અને રડાવે છે

મારા જેવા બચુભાઈઓને, ઘડા ઊંચકી ઊભેલી

વાંકી ખજૂરીઓને.

તારા ડેઝરમાંથી ઠલવાય છે

ફરજ-અહિંસા-પ્રેમ-નીતિ-માનવતા;

જે સડી સડીને

ઉત્પન્ન કરે છે

વિકાર-અનીતિ-હિંસાનો ઘોંઘાટ.

જે પ્રસરે છે માણસના હાથમાંથી

પગમાંથી

જીભમાંથી

સર્વત્ર, નીચે ઉપર બધે : સ્કાય ઈજ ધ લિમિટ.

મારી આત્મખોજના મૂળમાં-

અનવરત ભાન્તિઓના કુળમાં

તું જ ચાંપ દબાવે છે અને બધું

ઉઘાડ-બંધ થાય છે.

તારા જ રસબસ તંતુઓમાં

લથબથ સરકું છું આમ

ખખડ ખખડ સ્ટ્રેચરમાં-

ભાષામાં-રૂબમાં-કાઉ કાઉના અવાજ વીંધી - શ્રદ્ધાની

કાચેરી ઈટો પડાવતો - સેરિબ્રલ લાઈન પર - હરાજના સમય પહેલાં -

ઓન્ટોલોજિકલ એકાક્ષથી - બોબડાં વ્યાપારોના

વહાણનું પાણી ઉલેચતો - બા બા બા કરતો - મૂળ જડ

પ્રકૃતિમાંથી વિકાસ પામીને - જાળીને - સમજુને - વિચારીને -

વધીને - પેઢા કરીને - તારું જ ચેતન રસાયન બનીને -

ગતિનો અહેવાલ નોંધીને – વિમાની વિના જ – ઘણુંય સખળાખળ  
કરી – લગા ગાગા ગાગા – કાવ્યપંક્તિઓને શેડી ખાતો –  
વિથ કે વિધાઉટ પેનિટ્રેશન –

ઘૂમરના પ્રાસમાં પ્રગટેલી

સૂક્ષ્મ છતાં સર્વવ્યાપ્ત ટ્યૂમર –

હું આવી પહોંચ્યો છું

ખખડ ખખડ બાન્ત સ્ટ્રેચરમાં

તું ગ્રસી દે નિઃશેષ

તે પહેલાં તને તાકતો, અ-નિમેષ.

૨૬-૫-૧૯૮૮

હજી તો હમણાં, વહી જતી પાછળ રમ્યઘોષાની ‘સ્મૃતિ’નો આસ્વાદ લખ્યો, ને આજે ‘કાલગ્રંથિ’નો આસ્વાદ લખવા બેઠો છું. ‘સ્મૃતિ’ વીતી ગયેલા સમયનું કાવ્ય છે. જ્યારે ‘કાલગ્રંથિ’ છે સમયદર્શન એટલે કે જીવનદર્શનનું કાવ્ય. એનું આ રસદર્શન ? દર્શન શબ્દ સાંભળી લાંઠાં એની જાણોતી અદામાં હાથ હવાવતાંક બોલે ‘છદ્દ.’ હું સામું જોયું ન જોયું કરી, ફરી લખવા માંડું છું ઝટપટ... ...કે

‘કાલગ્રંથિ’ એ એકોક્રિટિ ફેનનું દીર્ઘકાવ્ય છે. દીર્ઘકાવ્યસંરચના અને આત્મલક્ષીસંવેદના બંનેનો મેળ પાડવા માગતું ‘કાલગ્રંથિ’નું કાવ્યસ્વરૂપ કોઈ પ્રચયિત ઢાંચાઢાણ નથી. એ છે લાંઠાંની લેહ-લઢણનું પોતીકું દીર્ઘઅછંદસ અનોખું ‘માણસની વાત’થી લઈ વાયા પ્રવાહણ થઈ લાંઠાંની કાવ્યશોધ સમયસમાંતરે ‘કાલગ્રંથિ’ને કંઠે જઈ નાંગરે છે. ‘કાલગ્રંથિ’ આમ તો સર્વાંગકાવ્ય છે પણ આસ્વાદની સગવડ ખાતર એના કેટલાક એકમ પારી શકાય. અંત-આરંભની વચ્ચે.

**આરંભ**

‘શાસ લઉં તો પીડા...’થી શરૂ થતી પંક્તિઓ. જે ‘કાલગ્રંથિ’ એકોક્રિટિની નાન્દી જેવી છે. આ પંક્તિઓ છે :

‘શાસ લઉં તો પીડા લાઠા,  
શાસ મૂર્ખ તો પીડા.  
ડાબા પડખે પીડા લાઠા,  
જમણા પડખે પીડા.’

આ ચતુર્થદીનો પહેલો શબ્દ છે : ‘શાસ’. કાલ-નું સૂક્ષ્મ અતિસૂક્ષ્મ જીવંત પરિમાણ. પણ એનું પરિણામ પીડા કેવળ પીડા. નખશિખ. જીવનભર. પીડાએ અંદરબહાર બેય બાજુથી

બમજો હુમલો કર્યો છે કાવ્યનાયક લાડા પર. ‘પીડા લાડા પીડા – પીડા લાડા પીડા’ એવા આવર્તનોમાં લાડાની આગળ પીડા છે ને પાછળ (મુદ્રણમાં નીચે) પણ પીડા છે. વચ્ચે ચાસ લેતાં મૂકતાં ડાબેજમજો પડખું ફરતા લાડા છે. આમ, ‘કાલગ્રંથિ’ એ પોતીની પીડાનું કાવ્ય છે. એ જેટલું અસ્તિત્વની પીડાનું કાવ્ય છે એટલું સમયની કીડાનું કાવ્ય છે. પીડામાંય કીડાગીત ગાય તે કવિ લાડાની કવિચેતના પીડામાં કષસી નહીં, લયમાં રણગ્રણતી આ આરંભના રાઈમમાં.

આ ચાર પંક્તિથી, ‘કાલગ્રંથિ’નો વધુ સારો આરંભ બીજો ન હોત, કદાચ.

આ ચાર પંક્તિ જેટલી લઘુ છે, કાવ્ય એટલું જ દીર્ઘ છે.

આ ચાર પંક્તિ જેટલી સરળ છે, કાવ્ય એટલું જ અટપઢું છે.

આ ચાર પંક્તિનો આરંભ અને પણીનું આખું કાવ્ય – એ વચ્ચે સતત તણાવ થાય છે. એથી જે પૃષ્ઠતાશ રચાય છે તે કાવ્યને તંગ રાખે છે. આ તંગદોર પર ભાવકે ચાલવાનું છે ટટાર. ચાલતા ચાલતા આવે પહેલો પડાવ....

18

## એકમ ૧થું

‘હોસ્પિટલના જનરલ વૉર્ડના પલંગમાં રેબાઝેબ, અધરાતે મધરાતે સૂતો છું પીડાગ્રસ્ટ...’થી ‘...આ તાંદું અંતિમદર્શન હતું હોસ્પિટલમાં.’ સુધી.

આ એકમમાં કાવ્યનાયક કવિને સમયનો અખંડ પરિપૂર્ણ સાક્ષાત્કાર થાય છે, પહેલી વાર. નિતાંત વેદના રૂપે. હોસ્પિટલમાં પીડાગ્રસ્ટ પરિસ્થિતિમાં પલંગમાં સ્ટ્રેચરમાં. એક્સ-રે રૂમની બહાર. એક્સ-રેમાં જેની અખંડ છબિ છિલાતી નથી તે ‘સમય’ને આ એકમમાં ગીલી બતાવે છે કવિ, બખૂબી.

અત્યારના અખંડ સમયાનુભવને પડછે સમયના ખંડ ખંડ ખંડ અણસારાનું વર્ણન કાવ્ય(માં) સમતોલન સાથે છે. એમાં સમયનાં ખંડિત રૂપોને પ્રત્યક્ષ કરાવતા ક્રિયાપદ્યોગો કેવા અર્થધન છે તે જોઈએ :

- ખવાઈ ગયેલા જીર્ણ પુસ્તકના ગંધકણોમાં નાક સુધી ઊંચકાતો સમય
- કોણાર્કના નારીશિલ્યની ખંડિત યોનિમાં સ્બલનપૂર્વેની ઉર્કટતામાં ટૂટું ટૂટું થતો સમય
- હાથમાંના બરફના ગોળા સાથે અચાનક જમીન પર ગબાડી જતો સમય
- કપાયેલા બટાટામાં દ્યુળ સાથે સરકતો સમય
- હાથમાં પકડેલા દેડકાની જેમ થરકતો પછી ઠંકું ઠંકું મૂતરી જતો સમય – આમ તો અનુભવ્યો છે સતત પણ ન્રૂટક-ન્રૂટક ‘સમય’નો અખંડ પરિપૂર્ણ સાક્ષાત્કાર તો થાય છે પર-અપર પીડાંતર પામી પહેલી વાર, હોસ્પિટલમાં.

આ એકમનો અંત જીવનરસભરપૂર ‘નારંગી’ની પ્રતીકાત્મકતા, અપંગ દર્દીની તીવ્ર

જિજ્ઞાસા અને પ્રકૃતિની મૂદુનિષ્ઠુર તટસ્થતા એ નિસ્તરીય સંકુળ કલ્યાન સાથે આવે છે, આમ :

‘તડકાનો મૂદુ હાથ જમાઈ બાજુથી  
અને અપંગ દર્દનો ક્ષીણ હાથ ડાબી બાજુથી  
પકડવા મથતા હતા તે નારંગી તારી પુર્ખના થરકાટથી  
ગબડી પડી ટેબલ પરથી.

આ તારું અંતિમદર્શન હતું હોસ્પિટલમાં,’

અહીં ‘અંતિમ-દર્શન’નું અર્થાવિચલન પણ કેવું સાભિગ્રાય છે ! અંતઘડીએ આયુષ્યભરનો ‘સમય’ દશ્યસંધારો એક અખંડ અનુભવાય છે જેવો. ‘કાલગ્રંથિ’ના પહેલા એકમનો રચનાકીમિયો છે અદલ એવો.

18

## એકમ રજું

‘એ પછી તને શોધું છું સમય...’થી ‘ઓન્ડ ધેન ચ્યુ લાઇક હેલ.’ સુધી.

આ બીજું એકમ સમયની શોધનું છે. જેમ જેમ પકડા જઈએ એમ હાથતાળી દઈ સરકી જતા જટ છટકણા સમયને જાલી લેવા પટ પટુકરણશીલ કવિ જીણી જૂલગૂંથણીવાળી કલ્યાનજાળ પાથરે છે આ એકમને ઉંબરે :

‘ખાલીખમ્મ મહેલની અટારીએ ઊભેલા વૃદ્ધની અંખોમાંથી  
સામે દૂર દૂર પથરાયેલી નીરવ નિર્જવ યુદ્ધભૂમિમાં –  
જ્યાં ગીધોના – સમરીના – કાગડાના ચિંતારો છે કદાચ,  
પણ એના અવાજ

વૃદ્ધના કાન પાસે આવીને અટકી જાય છે.

એથી અવાજ રૂપે તને પામી શકતો નથી.

માત્ર ગીધ-સમરી-કાગડાના ઊડાઉિડ-ફફડાટો-ચ્યૂથાચ્યૂથ રૂપે  
તને પામી શકત્ય છે;

અને તેથી મૌતિયાની આરપારના

ઝંખાં ઝંખાં શ્યામ ઊછળતાં ટપકાંઓ રૂપે, સમય

અને તેથી આમ મીંચેલી અંખની અંદર, મેટાઝોરિકલ.

મેટાઝોરિકલ એટલે રૂપકાત્મક. કેટકેટલા વર્તુલાકાર રૂપાંતર પછી ‘સમય’ – બંધ આંખે દેખાતાં અવળસવળ ગતિમાન કાળાં ‘ડીટાણું’ના – ‘રૂપક’ સુધી પહોંચે છે ! સમય આમ રૂપકાત્મક રીતે જ બ્યક્ત કરી શકતો હોય છે ભાષામાં. એટલે આ રેખાંકિત અને ઘાટા અક્ષરો કર્યા છે આવો ભાષાવિશેષ ચીંધી બતાવવા માટે.

અહીંથી ‘કાલગ્રંથિ’માં ભાષાકર્મ અને કવિકર્મનો સંદર્ભ દાખલ થાય છે. ‘તને પામવો છે મારે’ એવું સમય-ઉદ્ઘોધન ‘મારે મને પામવો છે, સમય’ એવા આત્મસંબોધનમાં પરિણામે

છે ત્યારે સમયને પામવો અને જાતને પામવી બંને એક બની જાય છે. કવિ માટે તો એનો હાથવગો રસ્તો છે કાવ્યલેખન. ‘તેથી તો સતત આ રિયાલટીનું / ઉત્થનન કરતો કરતો / ડ્રેબ વિશેની કરું કવિતા...’થી ‘પ્રિક-પિકલના સંકુલ સંધા સંગની રે / કરું કવિતા...’ સુધીની સઘણી પંક્તિઓ સર્જન-સ્વ-સમય સૌનું critic બની જાય છે. આ પંક્તિઓમાં, જુગુપ્સાજનક સંવનનું વર્ઝન, સર્જનની બધી જ રમણીય વિભાવનાઓનો છેદ ઉડાડે છે. કાવ્યલેખન એ કોઈ ભવ્ય કે દિવ્ય મહાન પ્રવૃત્તિ નહીં પણ એક જાતનું ખોદકામ બની રહે છે. લાંઠાં વાસ્તવમાં અને સ્વમાં ઊર્ઝ ઊર્ઝ ઉત્થનન કરનાર કવિ છે. આ બંનેથી ઉત્થનન એક-મેકની હરીજાઈ કરતા ચાલે છે એમની કવિતામાં. ‘અવાજને ખોદી શકતો નથી / ને ઊંચકી શકતું નથી મૈન..’ એ એમની દઢ પ્રતીતિ. ઘડી વહેલેથી.

૧૮

### એકમ ઉજું

‘ફેલ – નાગી ઉઘાડછોગી, કુવાને તળિયે જઈ પોગી...’થી ‘બોબડા વ્યાપારોના વહાણનું પાણી ઉલેચતા, ઠિન ટાઇમ...’ સુધી.

આ નીજે પગથિયે પગ જ્યાં મૂક્યો કે તરત પાત્રાઙ્કુવાને તળિયે ઊર્ઝે અતાગથી વહાણવટી વેપારે સપાટીબહાર સર્વત્ર વાણીના પાણીની રેલમછેભ ઊછળે ચોધાર. આ એકમમાં કવિ, જુદી જુદી રજિસ્ટર-ભાષા ખપમાં લઈ રોજિંદા રેઢિયાળપણાને ‘સમયસર’ છતું કરે છે. ‘કાલગ્રંથિ’નું આ એકમ મને વધુ પડતા સંગોપનવાણું લાગ્યું છે. કવિ એમાં ઘણું અદ્યાહાર પણ રાખે છે.

૧૯

### એકમ રજું

‘બોલો બચુભાઈ, બા બા બા...’થી ‘...કૂદી ગયા છે તમારાં પ્રતિબિંબો’ સુધી.

આ એકમમાં પોતીકા અવાજને પામવાની અને જાળવવાની જિકર થઈ છે. રૂઢિચુસ્ત દુનિયા જડબેસલાક કૃતિમ સમયસીમાઓમાં નિર્દોષતાને અને અનેક જીવનશક્યતાને જકડી કુદરતી બહુવિધ મૌલિકતાને ટૂંકી નાંબે છે તરત. તેનું છે આ એકમ. ‘બા બા બા’ અને ‘હા હા હા’ના સામસામા તંગ તોળાતા શબ્દોચ્ચારમાં આ વિરોધાભાસ અર્થવ્યંજક બની પડધાય છે.

આ એકમ ‘બોલો બચુભાઈ’થી શરૂ થાય છે પણ બચુભાઈ તો જરાય બોલતા નથી. બચુભાઈને બોલવનાર જ બોલ બોલ કરે છે. બચુભાઈ મૂંગા રહે છે ત્યારે બચુ બચુબા બચુદિયા પર પ્રશ્નમારો ચલાવાય છે. આ પ્રશ્નકાદુઓ તીવ્યથી તીવ્યતર બનતા જાય છે.

છતાં, બચુભાઈ તો મૂંગા મૂંગા નીચે-ઉપર ડાબે-જમણે ફેલાયેલા આ પ્રત્યક્ષ લોકના ‘મિરર’માં શોધે છે ઉત્તર. મસિતજ્ઞમાં ભૂત-વર્તમાન-ભાવિના ત્રણ શકમંદ ત્રાસવાદીઓએ કરેલા ગોળીબાર જીલે છે. રેલવેના સમયપત્રક પર ન હન્યતે હન્યમાને શરીરો વાંચે છે, દસ્તિને સ્થિર રાખી. છેવટ આ એક બચુભાઈ અનેક બચુભાઈઓમાં બદલાઈ જાય છે, ને એમનાં પ્રતિબિંબો

કેંકિંગ મિરરમાં ફૂટી જાય છે, એકમને અંતે. મિરરથી કેંકિંગ મિરર વચ્ચે ‘પાણી’નો ઉલ્લેખ છે એમાંથી જ તરસ - નળ...નો અથેવિસ્તાર થાય છે. આ પાણી જ પછીના એકમનો આરંભ બને છે.

આ એકમમાં જડ પ્રકૃતિ – ચેતન રસાયન, વિમાની – વિમાન જેવા સંકેતો દ્વારા કવિ જીવ-જગત-આત્મા-પરમાત્મા (?)ને લક્ષ્ણિત કરી બધા પૂર્વપ્રાપ્ત તૈયાર શાનવારસાનો પ્રતિકાર કરે છે. આ એકમ (અને આગળના નીંખ એકમ)માં ‘સમયસર’ – ‘ઈન ટાઇમ’ જેવા શબ્દો ચાવીરૂપ સ્થાને ચોજાયા છે. એની હેરફેર સાથે અર્થની હેરફેર થયા કરે છે.

18

## એકમ પમું

‘આભનો સાગર જળ જળ ભરિયો...’થી ‘બી વાવ્યાંની વાત કરે છે, ક્લિબ ?’ સુધી.

આ એકમની શરૂઆતમાં જે પંક્તિઓ આવે છે તે કોઈ પણ ગુજરાતી ગીતકવિને દર્શા કરાવે એવી છે :

‘આભનો સાગર  
જળ જળ ભરિયો માંહી સૂરજ ને સોમ,  
આ આરે ધરતીની ભેખડ’

પછી ચોથી પંક્તિ પરંપરાગત નથી, અપેક્ષાભંગ થાય છે. સાથે ઘણુંક ઘણું ભંગાય છે, જુઓ :

‘ત્યાં અથડાય છે મારો સમય લગા ગાગા ગાગા –  
ચૂરેચૂરા થઈ જતો લલવ લલગા –  
વેરાઈને વિચિન્ન થઈ જતો પૃથ્વીના કરોડો કણ કણમાં ગાલ લલગા –’

જુઓ કે શિખરિણી છંદની પહેલી સંધિ લગા ગાગા ગાગા સાથે (મારો – કવિ, કાવ્ય નાયકનો) સમય અથડાય છે, પરિણામે બીજી સંધિ લલવ લલગા જેમ (મારો સમય અથડાઈને) ચૂરેચૂરા થઈ જાય છે અને ત્રીજી સંધિ ગાલ લલગામાં (મારો સમય અથડાઈને ચૂરેચૂરા થયા પછી) પૃથ્વીના કણકણમાં વેરાઈને વિચિન્ન થઈ જાય છે. આમ છંદગતિ સાથે પૃથ્વીગતિનો છંદોલય પણ ખાંડિત થયો. ત્રીજી પંક્તિમાં ધરતીની ભેખડ જે અંદર હતી તે પછીની ત્રણ-ચાર પંક્તિમાં વિચિન્ન થઈ ગઈ, આમ આ ‘વિચિન્ન’ શબ્દ ઉમાશંકર જોશીના કાવ્ય ‘છિનભિન્ન છું’ સુધી બેંચી જાય. એમાં ઉમેરાય ‘નિશ્ચંદ કવિતામાં ધનકવા કરતા લય સમો’ એ આખી પંક્તિ. ઉંઠ જોંયે પોતાના કાવ્યમાં જેનું સીધું કથન કર્યું તેનું લાંઠાંયે પોતાના કાવ્યમાં - કિયા દ્વારા - સમર્થન કર્યું. એ રીતે ગુરુના કાવ્યસંકેતનો શિષ્યના કાવ્યમાં સંકેત-વિસ્તાર થયો.

હવે આવે છે પૃથ્વીજીવન અને કાવ્યસર્જન વિશે પ્રશ્નો : શા માટે ? આગળ પૃથ્વીગતિનો

સંસ્કૃતશિદ હતો. અહીં પૃથ્વી સાથે ઈન્ફરેડ – રિમોટ સેન્સિંગ જેવા અંગ્રેજ શબ્દોની અથડામણ છે. પૃથ્વીને એ રીતે તાકવાની ને સુંઘરાની કિયા પ્રશ્નો ઊભા કરે છે. એની પ્રતિકિયા રૂપે હસ્તિહસ્તીને બેવડ વળી જવાય છે; ખડખડાટ આળોટી પડાય છે; અંગ્રેજના ઝીંક નીકળી જાય છે. આ ત્રણે પ્રતિકિયામાં હાસ્યની તીવ્રતા વધતી જાય છે તેમ તેમ એની પદ્ધતાનેનો કરુણ ઘૂંઠાઈને વેરો બનતો જાય છે. આ બ્લેક હ્યૂમર આગળ વધે છે રાઈમના રસ્તે. હવે કવિતા નવસર્જન નહીં, કાલગ્રંથન બની રહે છે માત્ર. રાઈમના રસ્તે ખખડ થતી ને ખોડંગાતી સ્ટ્રેચરગાડી આગળ ચાલે છે. એને અટકાવી એક ઉદાહરણ નોંધીએ : ‘શા માટે / ખડખડાટ આળોટું છું કાવ્યપ્રકિયાના આ ક્ષાણ સુધીના / પ્રલંબ પાથરણા પર / બધું વેરવિભેર કરી નાંખતો ?’ આ પંક્તિઓ ‘કાલગ્રંથિ’ની રચના વિશે કવિનું critical statement છે. લાંઠાં પોતે જ પોતાના સર્જન પ્રત્યે, કોઈ પણ વિવેચક કરતા, વધુ critical હતા તેનું આ પ્રમાણ છે.

[નોંધ : ‘રાઈમના રસ્તે’વાળા આ કાવ્યખંડનું બીજા એકમના, ‘કરું કવિતા’ કાવ્યખંડ સાથે વાચન કરવું, એ પછી, તે નિરર્થક પુનરવર્તન છે કે કેમ તે નક્કી કરવું.]

18

### એકમ દર્શાવી

‘આ ત્યારે એમ વાત છે...’થી ‘તું જ ચાંપ દબાવે છે અને બધું ઉધાડ-બંધ થાય છે.’ સુધી..

આ એકમમાં કાલની ગતિનું વર્ણન છે. એકમ ઉ-જ-પમાં અટવાતી-ગુંચવાતી-ઢેબાતીઠેલાતી ચાલતી જીવનગતિ હવે ‘કાલગ્રંથિ’ સુધી ખેંચાઈ આવી છે રમત રમતમાં આમ –

‘આ અત્યારે એમ વાત છે  
અમારી પણ બચુભાઈની જાત છે  
‘યાઈમ’ની વાત કરતાં કરતાં ‘રાઈમ’ પર ચડી ગયા  
રાધર પડી ગયા. વોટ અ કાઈમ !’

આ કાઈમનો અર્થ પણ બદલાઈ જાય છે પછીની પંક્તિથી : ‘એમાં પાછી ખજૂરીમાં બી વાવ્યાંની વાત / અને તેય આ ઉમરે, માય ગોડ, વોટ અ હ્યૂમર...!’ અને હવે હ્યૂમરના પ્રાસમાં આવે છે : ‘ટ્યૂમર...’ આ પણ લાઠાલઢણની શબ્દરમત જ લાગે રૂઢ પણ... પણ એ કેટલી કાવ્યોપકારક છે આ તકે તે તપાસો. અને ‘ધ ટ્યૂમર ઓવ રાઈમ’ અને ‘કાલો દિ નામ ગ્રંથિ’ એ પંક્તિઓના કેન્દ્રથી ‘કાલગ્રંથિ’ના આગળનાં અને પાછળનાં પાનાં ફરી ફરી વાંચો તો.... તો લાગશે કે આ ‘ટ્યૂમર’ની પ્રતીક શોધ કવિસર્જકતાની ટોચ છે.

[અહીં શબ્દાર્થની ખેંચતાજ થોડીક : ‘ટ્યૂમર’ના ટ્યૂમર-માં રાઈમનો ધ્વનિસંકેત પડ્યો છે. રાઈમ એટલે સમય. કાલ, ટ્યૂમર, મસ્તિષ્કમાં, એક ગાંઠ રૂપે થાય છે. ગાંઠ એટલે ગ્રંથિ. આમ ધ્વનિ અને રૂપ બંને સંકળાય, બની જાય કાલગ્રંથિ. ‘કાલગ્રંથિ’ તો હવે કાવ્યશીર્ષક થયું. એનું મૂળરૂપ ટ્યૂમર કાવ્યનું પ્રતિરૂપ – કાલગ્રંથિ – બન્યું.]

આ કાલગ્રંથિ જેને જેને સંકલિત કરે છે અને વિભક્ત કરે છે સતત અનો જે વિસ્તારી વર્ણનખંડ (એટિમિક વાઈબ્રેશનસ્થી ફોસ્ટિલ્સ સુધી) આવે છે તેમાં કવિના શાખસામર્થ્ય અને બહુશ્રુતપણાનો પરિચય થાય છે. લાંઠાને ભાષાના બાળગર ને કવિતાના તીમિયાગર કહેવા પડે એવો છે આ વર્ણનખંડ. આ ખંડનું આરોહાવરોહ સાથે લયવાહી પઠન કરવા જેવું છે.

આ પછી સમયપરિમાળમાં એક વધુ પરિમાળ ઉમેરાય છે સ્મૃતિનું (પહેલા એકમ સાથે તેનું અનુસંધાન છે). સમય અને સ્મૃતિનો સંબંધ બિંબ-પ્રતિબિંબ જેવો છે. અરસાપરસ આધારિત. ‘ભૂપર સેન્સ’ અને ‘સેન્સ ઓંવ ટાઇમ’માં સેન્સના બંને અધ્યાત્મો એકેકને સતત પોષે છે, આવી રીતે : ‘એ (કાલગ્રંથિ) ચૂસે છે / સતત સકલને વિભક્ત અને સંકલિત કરતી. / અને સ્મૃતિનું ડોઝરું ભરાયાં કરે છે. આંખ-કાનથી, સ્વર્ણ-સ્વાદથી નસ્ય નિરંતર ચૂસ્યાં કરે / ને ભર્યા કરે ભૂતોદર એનું (સ્મૃતિનું) કાલગ્રંથિ.’

અહીં ‘ભૂતોદર’ શબ્દ છે. ‘કાલગ્રંથિ’ના આરંભે અગ્નિયારમી પંક્તિમાં આવે છે ‘મારા ઉદરમાં.’ ‘પછી પીડાતા પેટમાંથી પસાર થતો’ (સમય) તથા ‘ભૂપ્રા ખાતીખમ્મ પેટમાં તને (સમય) ફાબૂરી શક્યો નથી’ એવા બે ઉલ્લેખો પણ પહેલા એકમમાં આવે છે. આ ત્રણોને સાંકળીએ તો સમજાય કે આ પેટ ને પેટની પીડાનું કાવ્ય નથી; ખરેખર તો માણસજાતે પેટ ચોળીને ઊભી કરેલી પીડા(સમય)નું કાવ્ય છે. ભૂતોદર ઉલ્લેખથી એ પ્રાણીમાત્રમાં ફેલાઈ જાય છે.

આ વૃકોદર કાળ કેટકેટલુંય ઓહિયા કરી જાય છે, એથી સ્મૃતિનું ડોઝરું ઊભરાય છે ને ઓકારી થાય છે ને ગંધાર છે સમાજસંસ્કૃતિઓ, જ્ઞાનવિજ્ઞાનો, સત્તાસંસ્થાનો, જીવનવ્યવસ્થાઓ, જન્મમરણો. બધેબધ, છેક આભ લગી (સ્કાય ઈજ ધ લિમિટ) અત્રતત્ત્રસર્વત્ર સમય અને સ્મૃતિનું જ વર્ચસ્વ છે. કવિ પણ કબૂલ કરે છે છેવટ કે ‘મારી આત્મખોજના મૂળમાં અનવરત ભાંતિઓના કુળમાં / તું જ ચાંપ દબાવે છે અને બધું / ઉઘાડ-બંધ થાય છે.’

18

## એકમ અમું

‘તારા જ રસબસ તંતુઓમાં...’થી ‘વિથ કે વિધાઉટ પેનિટ્રેશન –’ સુધી.

આ એકમમાં કવિ સમગ્ર કાવ્યપથરાટને સમેટે છે. ‘ખખડ ખખડ સ્ટ્રેચરમાં’ અને ‘ખખડ ખખડ ભાંત સ્ટ્રેચરમાં’ના બે છેડા વચ્ચે. એમાં કાવ્યના મુખ્ય મુખ્ય જબકારા જબૂક જબક છે ને અજવાણું પાથરે છે. એ આછાં અજવાળાંમાં આખી કવિતા વંચાય છે ફરી એક વાર તંતોતંત એમ, મરણાસન્ન વ્યક્તિને જતી વેળાના જબકારે આપું જીવન દેખાઈ જાય જેમ. પહેલા એકમમાં હોટિસ્પટલમાં થયું હતું બરાબર તેમ. આ છેલ્લા એકમમાં પણ ત્રૂટક ત્રૂટક (-લઘુરેખાથી દર્શાવાય છે તે) પણ આમ તો સતત (લયસાતત્ય જળવાય છે તેમ) સમયોના અનુભવ સંકલિત થતો થતો ‘કાલગ્રંથિ’માં પરોવાઈ પરિપૂર્ણ અખંડ બની જાય છે છેલ્લે. ‘કાલગ્રંથિ’ની

કાવ્યસંકલના અને સમયસંકલના આમ અલગ ન રહેતાં એક બની જાય છે અંતે.

અંત :

અંતમાં માત્ર પંક્તિઓનો ઉતારો. ('કાલગ્રંથિ' એકોક્ષિતાનું ભરતવાક્ય)

'ધૂમરના પ્રાસમાં પ્રગટેલી / સૂક્ષ્મ છતાં સર્વવ્યાપ્ત ટ્યૂમર -

હું આવી પહોંચ્યો છું / ખખડ ખખડ બાન્ત સ્ફેચરમાં

તું ગ્રસી લે નિઃશેષ / તે પહેલાં તને તાકતો, અ-નિમેષ.'

આ વિશે થોડી નુક્તેચીની :

૧. ધૂમર શબ્દ ધૂમનનો ધ્વનિ અધ્યાસ જગાડે છે.

૨. ટ્યૂમરનો પાછળનો ભાગ - મર મે-મર - મેમરીમાં સમાઈ જાય છે. (આ શબ્દરમત એટલા માટે કે લાંઠાને એ પ્રિય છે.)

૩. સૂક્ષ્મ અને સર્વવ્યાપ્ત જેમ ટ્યૂમર માટે તેમ યાઈમ માટે પણ ખરું.

૪. ખખડ ખખડ સ્ફેચરનો અવાજ ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂણી -નું રમરણ જગાડે. આ પંક્તિનું લાઠાએ કરેલું પઠન પણ યાદા'વે. (જુઓ-સાંભળો : રાજેન્દ્ર શાહ વિશેની ગુ.સા.પ. નિર્મિત અને પરેશ નાયક દિગુદ્દર્શિત ફિલ્મ 'નિરુદ્ધેશે'.)

૫. બીજીવારના સ્ફેચરમાં 'આન્ત' શબ્દ ઉમ્રાય છે. એથી સૂચવાતો વિશેષ અર્થ વાચકે પોતાની રીતે ઘટાવવો.

૬. 'તું ગ્રસી લે નિઃશેષ' [તે પહેલા] 'તમે તાકતો, અ-નિમેષ'માં 'નિઃશેષ-અનિમેષ' માત્ર અંત્યાનુપ્રાસ છે કે કંઈક વધુ છે ? આખી પંક્તિઓનું શું ? આ પંક્તિકમ અને કિયાનો વ્યુક્તમ શાથી ? નિઃશેષનો વિસર્ગ અને અનિમેષની લઘુરેખા પણ અર્થપૂર્ણ લાગે છે ? વિચારવું.

૭. 'કાલગ્રંથિ'નો પહેલો શબ્દ છે : 'શાસ' અને છેલ્લો શબ્દ છે : 'અ-નિમેષ'. શાસથી શરૂઆત અને અનિમેષથી અંત. વચ્ચે જીવન, એટલે કવિતા : 'કાલગ્રંથિ' : જન્મ-રમરણ વચ્ચેની કાલગ્રંથિ. શાસ હોય કે નિમેષ. છેવટ છે ક્ષણ. નિર્ણય તથાગત બુદ્ધ કહે : ક્ષણિકા સર્વ સંસ્કારા. 'કાલગ્રંથિ'ના કવિ લાંઠા પ્રશ્ન કરે : 'જન્મથી જ મૂકેલો છે યાઈમબોખ કોણે ?'

18

થોડી ચોખવટ :

'કાલગ્રંથિ' સમય જેમ સણંગ કાવ્ય છે. એના સાત ખંડની (સપ્તાહ જેમ) ધારણા કરી છે પણ તે જરબેસલાક નથી. સાત ઓછા બે બરાબર પાંચ કે સાત વતા બે બરાબર નવ પણ કરી શકાય. વાચનારને સુવિધા મુજબ પોતપોતાનાં સરવાળા-બાદબાકી કરવાની છૂટ છે. થોડી રજૂઆત (કવિ અને કવિતા વિશે) :

લાંઠાને આત્મનિષ્ઠ કવિ લાગ્યા છે. એમનું આત્મનિષ્ઠ હોવું સ્વાર્થ નથી. એમના


‘હું’માં ‘સહુ’ સમાય છે. અને સામા છેઠે ‘સર્વસ્વ’માં ‘સ્વ’ પમાય છે. આ બેય વખતે હું – સ્વ આગળ થઈ જતા નથી, પાછળ જ રહે છે. <sup>221</sup> લાંડાંની કવિતામાં સતત આત્મોનન ચાલે છે. સાથે સાથે ભાષાનું ઉત્થનન પણ ચાલે છે. એને લીધે ચિત્તપ્રદેશના અને વાસ્તવના અનેક સંવેદનશીલ આલોખ અંકયા છે એમની કવિતામાં – કાવ્યપંજિતઓમાં <sup>222</sup> આધુનિક કવિતામાં ‘જીવન’ નથી – જીવનની ‘પ્રતિબદ્ધતા’ નથી. એ માન્યતાને લાંડાં (અને સિતોંશુ યશશંક અને બીજા કવિઓ) ખોટી પાડે છે. હા, એમનાં કાવ્યોમાં જીવન તરત નજરે ચે એવું ઉપરછલું નથી. જીવનનો એવો સીધો અનુવાદ કરવાને બદલે એમજો જીવનની સંકુલ સંરચના આલોખવાનું કામ કર્યું છે. જે કહેવાતા જીવનાભિમુખ કાવ્યો કરતાં વધુ અસરકારક છે. આ કાવ્યમાં ને બીજાં કાવ્યોમાં એનાં ઘણાં ઉદાહરણો મળશે. <sup>223</sup> ‘કાલગ્રંથિ’ કાવ્યમાં લાંડાંની ટેવવશ રચનારીતિ નથી એમ નથી. કવિની બધી જ (પ્રાસની, પ્રસ્તારની, લયની, લવારાની) આડોડાઈ અહીં હાજર છે. પરંતુ તે બીજાં કાવ્યોમાં છે તે કરતાં ઘડી સર્જનાત્મક છે. આ કાવ્યમાં કવિ કયાંય (?) વિભેરાઈ જતા નથી. સમયની ધરી પર એમની સર્જકતા ગતિશીલ રહી છે. <sup>224</sup> અજ્ય સરવૈયાના મતે ‘કાલગ્રંથિ’ એ મેટાફિક્શિકલ પોએમ છે. ઉપનિષદ્ધના ઋણિકવિએ જીવ-જગત-આત્મા-પરમાત્મા વિશે પરંપરાગત રીતે ચિંતનાત્મક કવિતા લખી. તો લાંડાંએ ‘ભૂમય’ની ભૂમિકાએથી માનવ-જીવન-જગતના અસ્તિત્વ વિશે આધુનિક કાવ્યચિંતન કર્યું. <sup>225</sup> સમયસંવેદનાની આવી કાવ્યસંરચના ભાષે જ બીજી, ગુજરાતી કવિતામાં મળશે. આવા સાચકલા સર્જનપુરુષાર્થ વિના કોઈ પણ ભાષાની કવિતા ત્યાં ને ત્યાં અટકી જાય. સ્થગિત બની જાય. ત્યારે લાંડાંએ હંમેશાં એને ધક્કો માર્યો છે. હવે, ખખડતી જેંચે કવિતા કોણ ?

### થોડી કબૂલવાત (આસ્વાદ વિશે) :

મારે કબૂલ કરવું જોઈએ કે ‘કાલગ્રંથિ’ મને પડકારે છે અને પદ્ધૂરી કાઢે છે મારી. <sup>226</sup> મારે એ પણ કબૂલ કરવું જોઈએ કે કાવ્યગ્રહણની જેટજેટલી પ્રાપ્ત રીતો છે તે બધાની પકડમાં ઝટ ન જાલાય એવું કાવ્ય છે ‘કાલગ્રંથિ’. ‘કાલ’ની જેમ ‘કાલગ્રંથિ’ પણ છટકી જાય એવું છટકણું છેતરામણું કાવ્ય છે. <sup>227</sup> કવિ ન્હાનાલાલે લખ્યું : ‘અમૃત અંજલિમાં નહિ જીલું, રે બેન ! જીલું તો ઝરે દશ ધાર’. માટે ‘કૂલડાંકટોરી ગુંથી લાવ...’ રમ્ય પ્રકૃતિ ને રોમેન્ટિક કવિતા બંને માટે એ બરાબર. પણ ‘કાલગ્રંથિ’ જેવી કવિતા માટે કયો ઉપાય ? <sup>228</sup> મારે કબૂલ કરવું જોઈએ કે જેમ અનુવાદ કાવ્યનો વિકલ્પ ન હોઈ શકે તેમ આસ્વાદ પણ કાવ્યનો વિકલ્પ ન હોય, કદાચ. ‘કાલગ્રંથિ’ શું નિર્વિકલ્પ કાવ્ય છે ? પોએમ ઈન ઈટસેલ્ફ છે ? એવો પ્રશ્ન થાય છે મને, આટાઅટલું લખ્યા પછી. મને લાગે છે કે હજુ આ વાચના અપૂર્ણ છે.

### છીલ્યે સ્મરણ :

પ્રકાશ, હેમંત, નિરીશ, મમતા તથા અજ્ય સરવૈયા. જેમની સાથે આ કાવ્ય વાંચ્યું. અને કવિની-કવિતાની વાતો કરી. અજ્યે થોડાં સૂચન પણ કર્યા. એટલે આભાર એમનો.



## ૨૭. બહેરાશને સંભળાતાં ટોળાં અવાજ ધોંઘાટ

કમલ વોરા

### ટોળાં અવાજ ધોંઘાટ

ટોળાં અવાજ ધોંઘાટ  
શિયેટરની બહાર ફૂટપાથ પર  
રસ્તા પર બસ-ટર્મિનસમાં બસમાં  
ટોળાં અવાજ ધોંઘાટ  
હોટલમાં બગીચામાં પુલ પર નદી પર  
અથડાતાં લથડાતાં  
ક્યારેક પોલાં અને પાતળાં  
ક્યારેક ધનિષ્ઠ નિરન્ધ : ટોળાં અવાજ ધોંઘાટ  
છે હજુ આ હમજાં જ છૂટેલા છેલ્લા શોમાંથી  
ધીમે ધીમે ચાલતાં લહેરમાં  
કે સાઈકલો પર સરકતાં ટિન્ઝ ટિન્ઝ  
કે સ્કૂટર લઈ ભાગતાં ઘ રૂ રૂ...  
કે રિક્ષાઓમાં ભાગતાં ધૂંઊંઊં....  
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પીડમાં  
એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે ? અલગ જ  
સાવ એકબીજાંથી, બાજુમાં ઘસાઈને અથડાઈને પસાર  
થતાં હોવા છતાં અલગ જ, ઉબલ સવારીમાં સાઈકલ પર બેઠેલાં  
હોવા છતાં કે સ્કૂટર પર ખબે હાથ ટેકવીને બેઠેલાં  
કે રિક્ષામાં ચીપડીને ચપોચપ કે ક્ષિલષ્ટ ચતુર્ભુજ  
પણ સાવ વિશ્વિષ્ટ એકબીજાથી -

અરે પોતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ  
 સાવ અલગ ચાલતાં - અટકતાં - સરકતાં - દોડતાં - ગાતાં  
 - હસતાં -  
 જઘડતાં - બગડતાં - ગગડતાં  
 ટોળાં અવાજ ધોંઘાટ  
 ફૂટપાથો પર જ છે શું રસ્તાઓ પર જ છે શું  
 ટોળાં અવાજ ધોંઘાટ ?  
 સીડી પર નથી દાઈરની ? દુકાન પર નથી કાપડની ?  
 છે છે બધે છે ટોળાં અવાજ ધોંઘાટ -  
 સોસાયટીમાં ટેનામેન્ટ, ઓપાર્ટમેન્ટમાં રોયલ,  
 કોરિડોરમાં કમરામાં ડ્રોઝગર્ઝમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં  
 બાથરૂમમાં બારીમાં ટેરેસમાં ધાબામાં  
 ધરબી ધરબીને ભરાયાં છે કીડિયારાની જેમ ઊભરાયાં છે  
 બધે જ બધે  
 એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવાં  
 ચપોચપ સતત અવિરત એકધારાં વર્ધમાન  
 ટોળાં અવાજ ધોંઘાટ  
 રડતાં રખડતાં ભીસતાં ચૂમતાં ચીખતાં  
 ગાતાં ગબડતાં બોલતાં બગડતાં ચૂમતાં ચીખતાં  
 ગાતાં ગબડતાં બોલતાં બગડતાં વાગતાં વગડતાં  
 નાચતાં નસીકતાં પડતાં પછાડતાં  
 માતાં માતીલાં મદમસ્ત છકેલાં છૂટી ગયેલાં સખળડખળ  
 ખખડતાં ઘઘરતાં ઘોરતાં ઘુરકિયાં કરતાં પટકાતાં  
 પછડતાં અડવડતાં અડિયલ અઘોરી અગડંબગડં  
 ચેંચૂડાં ચોર ઘાતકી  
 બબડતાં સાવ નિર્દ્દેખ બાળક જેવાં સ્વૈર  
 લબડતાં જાડ પરથી લીંબળી-પીપળી જેવાં  
 ભોળાં -  
 પણ કયારેક વકરતાં - ચકરતાં - ચકરાતાં - અકળાતાં -  
 અથડાતાં

વળ ખાઈને એક થઈ જતાં  
 મારતાં - તોડતાં - બાળી નાખતાં  
 શતસહસ્ર બાહુઓથી અટકાવી ઢેતાં યંત્રને અધવચ  
 લટકાવી ઢેતાં તંત્રને મંત્રની મહાગાંઠમાં  
 કાંઠાને ઉલ્લંઘીને ઉછણતા ઉંચકાતા જનરાશિથી  
 તણાઈને તૂટી જઈને છોતાં છોતાં થઈને અલગ અલગ થઈને  
 કરોડો કષમાં વેરાઈને વહી ગયેલા મનને  
 આ એકદું કરવાની મથામજા કોણે માંડી છે ?  
 ‘કાંડી છે, પ્લીજી’  
 આ બીજી સળગશે એ જ ચમત્કાર  
 કાંડી ઘસાશે એ જ ચમત્કાર  
 જ્યોતનો તણખો એ જ ચમત્કાર  
 ધુમાડો નીકળશે એ જ ચમત્કાર  
 ધુમાડાની સેર સ્કૂટરના ધુમાડાને ચોંટી પડરો એ જ ચમત્કાર  
 છીક ખાતું નાક ચમત્કાર, ખાંસી ખાતું દેડકું ચમત્કાર  
 ઊઠ જાગ મુસાફિર  
 ટોળાં અવાજ ઘોંઘાટના આ સરિયામ કે વાંકાચૂકા  
 પાકા કે ધૂળિયા  
 વામ કે દક્ષિણ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી  
 ઊઠ જાગ મુસાફિર  
 કાવ્યના વોટરટાઈટ કંપાર્ટમેન્ટમાં પણ  
 તારી કલમમાંથી ધોધમાર છૂટી રહ્યાં છે : ટોળાં અવાજ ઘોંઘાટ  
 તું  
 બેબાકળો થઈને ભટકાઈને ભળી જા  
 કે બગડીને બળી જા  
 કે ગબડીને ગળી જા  
 કે લબડીને લળી જા  
 કે ચગદાઈને ચળી જા  
 કે મસળાઈને મરી જા પણ સતત  
 ઊભાં છે ચપોચાપ સરકતા વર્ધમાન

તારા કાગળના કંઠે, તારી આંખોના ઓવારે  
 તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ  
 તારી જ્ઞાના ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ  
 તારી પાંપડણા પલકરે : ટોળાં અવાજ ઘોંઘાટ  
 તારી બહેરાશના ફૂવામાં ઉંડે ઉંડે ઉછળતાં  
 ટોળાં અવાજ ઘોંઘાટ

નવેમ્બર, ૧૯૭૫

ટોળાં અવાજ ઘોંઘાટ, ટોળાં અવાજ ઘોંઘાટ, ભાવકને સહજ જ પ્રશ્ન થાય કે ન તો કોઈ વાક્ય,  
 ન કોઈ કર્તા, કર્મ કે ક્રિયાપદ – માત્ર ત્રણ શબ્દોની સહોપસ્થિતિ; તો પછી યાદસ્થિક શું  
 આ શબ્દોનો કમ બદલી શકાય ? અથવા તો આ કમ બદલવાથી કઈ ફેર પડે ખરો ? આ  
 ત્રણ શબ્દો મનોમન કે મોટેથી ફરી ફરી બોલીએ તો તરત જ સમજ પડે કે સાચો કવિ શબ્દોની  
 ગોઠવણી સહેતુક કરતો હોય છે અને એક શબ્દ પણ ખસેડવાનો, બદલવાનો, આઘોપાછો  
 કરવાનો અવકાશ આપતો નથી. વાયકને તરત જ પ્રતીતિ થાય છે કે ટોળાં અને ઘોંઘાટની  
 વચ્ચે ભીસાઈ, દબાઈ, કચડાઈ, રહેસાઈ, ચગદાઈ રહ્યો છે અવાજ. કોનો છે આ અવાજ ?  
 આ અવાજ કવિનો અવાજ છે, આ અવાજ મનુષ્યનો અવાજ છે. આ અવાજ બાધ જગતનો  
 પણ છે જે દ્વારા આ જગત, મનુષ્ય-ચેતનામાં પ્રવેશે છે અને ફરી મનુષ્યની અભિવ્યક્તિમાં  
 પડધો થઈ પ્રગટ થાય છે. આ અવાજ એને એના હોવાની સાર્થકતાનો અનુભવ કરાવે છે.  
 આ અવાજ, ટોળાં અને ઘોંઘાટની વચ્ચે પીસાતો, ગુંગળાતો નામશેષ થઈ રહ્યો છે.

કવિના અવાજને મૂક કરી મૂકતું આ પ્રચંડ આકમણ એને કેવું તો વ્યથિત કરતું વિડુવળ  
 કરતું અને છેવટે નિરૂપાય હતાશાની ગર્તમાં ઉતારી દેતું હશે કે કવિએ એમના કાવ્યસંગ્રહનું  
 પણ આ જ નામકરણ કર્યું છે ! ભલે કાવ્યસંગ્રહ ૧૯૮૦માં પ્રગટ થયો, આ કાવ્યની રચનાસાલ  
 ૧૯૭૫ છે. ૧૯૭૫માં ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો સૂર્ય ધોમ તપતો હતો અને કવિ  
 લાભશંકર ઠાકર, નિઃશંકપણે આધુનિક કવિતાના પ્રમુખ સ્વરોમાંના એક હતા. એમના સમર્થ  
 સમકાલીનો સાથે એમડો આધુનિક કવિતાની બાની રચી જેની લાક્ષણિકતાઓ ‘મારા નામને  
 દરવાજેથી આરંભાઈને ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ કાવ્યસંગ્રહ સુધી અને તે પછી પણ વિસતરી  
 છે. ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ કાવ્યમાં તે સમયનાં તેમનાં અનેક કાવ્યોની જેમ એ લાક્ષણિકતાઓ  
 ઊરીને આંખે વળજે છે. અહીં સુધી પહોંચતામાં એમની અગાઉની કવિતાનો રમ્ય ઘોષ ટોળાંના  
 ઘોંઘાટમાં ફેરવાઈ ચૂક્યો હતો.

આ કાવ્યમાં પ્રવેશ કરવાની બીજી પણ એક કુંચી છે. વૈદરાજ જેમ ત્રણ જુદી વીકરીએનો  
 પીસીને ચૂરણ કરી નાખે પછી એ ચૂરણમાંથી કોઈ એક વીકરીનો અંશ તારવવો અઘરો હોય

છે તેમ અહીં ટોળાં, અવાજ અને ઘોંઘાટ એક થઈ ગયાં છે. જાણો કે આ ત્રણ જુદા શબ્દો મટીને હવે એક શબ્દ જ થઈ ગયો છે. ખરેખર તો આ કોઈ શબ્દ નથી રહ્યો પણ એક હાલતો-ચાલતો, જીવિત માણસ થઈ ગયો છે. અરે, માણસ પણ શેનો, આ તો એક હરતું-ફરતું ચિત્કાર કરતું, ડરતું અને ડારતું પણ થઈ ગયો છે. એવું પણ જે મનુષ્યનો અવાજ ગળી જઈને હષ્ટ-પુષ્ટ થઈ રહ્યું છે ! એક વ્યક્તિ વીભરાઈને ટોળામાં ભળી જઈને ટોળું થઈ ગઈ છે, એક ટોળું સમેટાઈને એક વ્યક્તિમાં સમાઈ ગયું છે. કોઈ પણ છેદેથી કવિની વાત તો એ જ છે, એક જ છે અને તે વાત જ કવિની, કવિતાની વેદનાની ક્ષણ છે અને આ કવિતાનો વિષય છે. સ્વાભાવિક છે કે નગર-ચેતનામાંથી ઉદ્ભવેલી આ કવિતા છે અને એ કારણે નગરની ઓળખનાં ચિત્રો, એક પછી એક, અવિરત આયાં કર્યાં છે.

કાવ્યારંભે ટોળાં અવાજ ઘોંઘાટ ક્યાં ક્યાં ફરી વળ્યાં છે તેની લાં...બી....યારી છે. જાણો ઠેર ઠેર ફરી વળેલાં કોઈ નદીના પૂરનાં ખદબદતાં, ગંધાં, કીચડ-માટીવાળાં, ડહોળાઈ ગયેલાં પાણી ! ટોળાં અવાજ ઘોંઘાટ ચોમેરથી ઊભગતાં, ઊભગાઈને બધે, બધે જ ગ્રસરી, ઘૂર્ણી ગયાં છે; પ્રલયના પૂરની જેમ કે કાવ્યમાં કવિ કહે છે તેમ ઊભગાયાં છે એનાં કીર્ણિયારાં. આખા કાવ્યમાં વારંવાર આવતાં ટોળાં અવાજ ઘોંઘાટનાં આવર્તનો ઘોંઘાટનો અનુભવ તો કરાવે જ છે પણ જે પરિવેશનું વર્ણન થઈ રહ્યું છે તેને આ કથાં તે પૂર-પાણી હેઠળ હુબાડી રાખે છે. બહાર આવવા મથતી, તરફદિયાં ખાતી, પોતાનો અવાજ શોધતી વ્યક્તિને છૂટવાનો કે ઊગરવાનો કોઈ ઉપાય જ નથી.

‘સાવ અલગ ચાલતાં – ટકતાં – સરકતાં – દોડતાં – ગાતાં –

હસતાં –

ઝઘડતાં – બગડતાં – ગગડતાં

ટોળાં અવાજ ઘોંઘાટ’

તે સમયની અનેક આધુનિક કવિતાઓમાં ડેખાતી કિયાપદોની આવી વજથંભી શુંગલા ભાવકને શાસ લેવાનો અવકશ પણ આપતી નથી. એક પછી એક આવતાં, ગબડતાં-ગબડાવતાં કિયાપદો અને પંક્તિઓથી વર્ણનું-શબ્દનુમાસ યોજના કાબ્યને વેગવંતું રાખે છે. કવિતા હેતુપૂર્વક દીર્ઘ પ્રલાપમાં સરી પડે છે. આ દીર્ઘ, કયારેક તો અર્થહીન ભાસતો દીર્ઘ પ્રલાપ – આ અગાઉનાં અને આ પછીનાં કાબ્યોમાં કવિ લાભશંકરની વિશિષ્ટ કાબ્ય-યોજના તરીકે પ્રસ્થાપિત થાય છે. અલબત્ત કથાં એ સફળ થાય છે અને કથાં નિષ્ફળ તે જુદી ચર્ચાનો વિષય છે. કવિતાની પ્રથમ પંક્તિથી તે કાબ્યના લગભગ બે-તૃતીયાંશ પછી આવતી પંક્તિ :

‘કરોડો કણમાં વેરાઈને વહી ગયેલા મનને

આ એકહું કરવાની મથામજા કોણો માંની છે ?’

– સુધી એક શાસે, અવિરામ વાંચી જવી પડે એમ છે, વાંચવી અનિવાર્ય થઈ પડે એમ છે.

જાણો કે બે પૃષ્ઠી લગ્ની લંબાયેલું આ એક જ વાક્ય છે ! વાંચનાર હાંઝી જાય, ખાસ ચડી જાય, થાડી જાય અને દરમિયાન કર્તિ કહે છે કે એ ઘોંઘાટ તૂટી જતો, અલગ અલગ થઈને કરોડો કણમાં વેરાઈ જતો માણસના મનમાં પણ ફરી વણે. આમ જે ઘોંઘાટ સ્થૂળ હતો, જે બહાર જ હતો તે મનની ભીતર સુધી પણ પહોંચી જાય છે. હવે અંદર-બહાર ઘોંઘાટ સમયાપ્ત થઈ ગયો છે. હવે આ ટોળાં અવાજ ઘોંઘાટ સ્થૂળ-સૂક્ષ્મ રૂપે સર્વવ્યાપ્ત છે અને એટલે જ એનાથી છટકવાનો કે ઊગરવાનો કોઈ ઉપાય નથી.

આ બોવી જુઓ, સાંભળો :

‘ટોળાં અવાજ ઘોંઘાટ

રડતાં રખડતાં ભસતાં ભીસતાં ચૂમતાં ચીખતાં

ગાતાં ગબડતાં બોલતાં બગડતાં ચૂમતાં ચીખતાં

ગાતાં ગબડતાં બોલતાં બગડતાં વાગતાં વગડતાં

નાચતાં નસીકતાં પડતાં પછાડતાં

માતાં માતીલાં મદમસ્ત છકેલાં છૂટી ગયેલાં સખળાખળા’

કે આમ આગળ આવતી પંક્તિ પર પંક્તિ તો ભાવકના કાનમાં બહેરાશ લાવી દે અને એ બહેરાશ સુધ્યાંમાં પણ એને ઊડે ઊડે સંભળાય છે, દેખાય છે એ જ એ, ટોળાં અવાજ ઘોંઘાટ. કરોડો કણમાં વેરાઈને વહી ગયેલા મન માટે બીડી સણગે એ જ ચમત્કાર, ધુમાડો નીકળે એ જ ચમત્કાર. કવિ ભજનની પંક્તિ ઉચ્ચારે છે :

‘ઉઠ, જગ મુસ્સાફિર’

પણ અરાજકતામાં ઊંઘીને નિશ્ચેત થઈ ગયેલ માટે ભોર થવાની નથી. જેને સત્ય તરીકે ગૃહીત ધરેલું છે તેમાંથી પણ વહી રહ્યા છે ટોળાં અવાજ ઘોંઘાટ. કવિની કલમમાંથી પણ ધોધમાર વહી રહ્યા છે. કાગળના કંઠે, મનના મિનારે, જીબના ટેરવે, પાંપણના પલકારે ઊભરાતાં આ ટોળાં અવાજ ઘોંઘાટ બહેરાશના ફૂલવામાં ઊછળી રહ્યા છે પણ અગાઉ કંધું તેમ એ, ન તો કવિને કે ન તો ભાવકને બધિર થવા હેતા. બહેરા કાન સાંભળી રહ્યા છે એ જ એ ટોળાં અવાજ ઘોંઘાટ. કવિએ જે આ ક્ષણ પકડી છે તે કવિતા થયાની ક્ષણ છે. કવિ આવી ક્ષણની પ્રતીક્ષામાં હોય છે અને સહદ્ય ભાવક એ જાણી-પામી લેશે એટલી પોતાની કવિતામાં એને શ્રદ્ધા હોય છે.

લાઠાદાદાને રૂબરૂ મળવાનું ભાગ્યે જ બન્યું પણ ફૈન પર ખાસ્સી વાતો થતી. કવિતા અને કવિ પ્રત્યેનો એમનો ઊમળકો હૃદયસ્પર્શી રહેતો. એમની તીવ્ર સ્મૃતિથી અચંબો અનુભવતો. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી, ‘એતદ્વા’માં એમનાં કાબ્યો પ્રગટ કર્યા ત્યાં સુધીનાં એમનાં કાબ્યોને મેં હુમેશાં રસપૂર્વક વાંચ્યાં છે. મારા કાબ્યલેખનના આરંભનાં વર્ષોમાં તો ‘મારા નામને દરવાજે’ અને ‘માણસની વાત’નું ભારે ધેલું હતું તે પણ સમરણો ચકે છે. છેક સુધી કવિ જાણે

કે પ્રાણવાયુથી નહીં પણ શબ્દથી જ અથવા તો કહો કે શબ્દની લીલાથી – એ ભલે શબ્દની રમત કહેતા – જ જ્યા. એમનો પ્રિય શબ્દ કહીએ તો વર્બલ ગેમ એ રચતા અને એમાં રચતા. વિવેચનો-ભાવકોમાં એમની કવિતા માટે મત-ભેદ થયા તેને અવગણીને, અર્જુને જેમ પક્ષીની આંખ જ જોઈ હતી તેમ કવિ લાભશંકર ઢાકરે માત્ર અને માત્ર શબ્દની ખેવના અને ઉપાસના કરી તે ગુજરાતી સાહિત્યમાં અનન્ય છે. હું મારા આ સમર્થ પૂર્વ-સમકાળીન કવિને સલામ કરું છું. આ આસ્વાદના નિમિત્તને કારણો આ લખીને હું ઉદાસ છું.

18





## ૨૮. હોવાપણાની નિરર્થકતાને ઉકેલવા મથતું કવિકર્મ

મહિલાલ ડ. પટેલ

### જણ જવો જી

ઠકરની આંખમાં ઠળિયા રે જણ જવો જી.  
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જવો જી.  
તૂટ્યા કડડ સાત સળિયા રે જણ જવો જી.  
ખૂટ્યાં નાગર તારાં નળિયાં રે જણ જવો જી.  
મારગમાં મોહનજી મળિયા રે જણ જવો જી.  
રાધાનાં હાડ સાવ ગળિયાં રે જણ જવો જી.  
ઘણથી ઊથલજી ઢળિયા રે જણ જવો જી.  
અધવચ પાથલજી મળિયા રે જણ જવો જી.  
ખાવું શે? પીવું શે? લાળિયા રે જણ જવો જી.  
હાલતા ને ચાલતા પાળિયા રે જણ જવો જી.  
ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જવો જી.  
ખટમાસ લેણ સાવ વાળિયાં રે જણ જવો જી.  
ભડભડ ચેહમાં બાળિયા રે જણ જવો જી.  
અમથાં અલખ અજવાળિયાં રે જણ જવો જી.

માર્ચ, ૧૯૭૬

કવિતા દરેક વખતે કશુંક કહેવા સારુન પણ લખાતી હોય. બલકે કવિતા ઘણી વાર કશુંય કહેવા માટે નથી જ લખાતી. કવિતા કવિના મનની કશીક વિશેષ આબોહવા વર્ણવવા તાકે છે. મનને તાગવાનું અઘરું કામ કવિતા ઘણી વાર કરી આપે છે. કવિતા આપણને કશોક વિશેષ અનુભવ 'ઝીલ' કરાવવા ચાહે છે. કવચિત્ વિચારતત્ત્વને પણ કવિતા ભાવોર્મિમાં ભીજવીને આપણને 'અનુભવવા' કહે છે. કવિતા અનુભવનો વિષય છે – ને એ અનુભવનો આપણા

મનને સૂક્ષ્મ આસ્વાદ મળી રહે એવી એની રચનાપ્રયુક્તિ હોય છે. કવિનું સંવેદન, કવિના ભાગાકર્મના બળે કરીને, ભાવકમાં જીવી ઉઠે છે – ભાવકનું આવું સમસંવેદન કવિનો તથા કવિતાનો મફકસદ છે. લાભશંકર ઠાકરની આ રચના ‘જણ જીવો જી !’ આ સંદર્ભમાં વાંચવાની અને ‘જીલ’ કરવાની છે.

વળી કવિતામાં પંક્તિઓ પંક્તિનો અન્વય આપી અને એનો અર્થ બેસાડી આપવાનું દરેક કાવ્ય સંદર્ભે શક્ય નથી. ડેટલાક સર્કારિયલ સંદર્ભો પંક્તિ રૂપે હઠાત્ આવીને ગોઠવાઈ જતા હોય છે – એ અર્થ ન પણ આપે તોય પઢન તથા આસ્વાદમાં ડેંક ઉમેરણ કરી આપતા હોય છે – કમસેકમ એ કશો વિક્ષેપ કરતા નથી. બેસણામાં ચાર-પાંચ સગાંઓની વચ્ચે એકબે બિનસગાં આવીને બેસે છે ત્યારે એ પણ પરિવેશનો આવકાર્ય હિસ્સો બની જાય છે. ‘જણ જીવો જી’માં આવું કશુંક બને છે ને એય કૃતિસમગ્રમાં મળીભળી જાય છે.

આ કાવ્ય લયમાં છે, લોકલયમાં છે, મરશિયાં જેવાં લોકકાયોનો લય અહીં લોકભાગ સાથે પ્રગટ થયો છે – પ્રાસાનુપ્રાસોએ એને પોષ્યો છે. મિત્રો બેદા હોય અને ડેંક માયાની કે જીવનની નિરર્થકતાની વાતો ચાલતી હોય ત્યારે લાંઠાં પોતાના પોતે રચેલા આ મરશિયાને તાલ/લયમાં ગાતા... જાણે નિરર્થકતાનો ઉત્સવ ઊજવતા હોય. લાંઠાંના મરણ બાદ લાંઠાંનાં સંસ્મરણો વાગોળતાં ચિન્નુ મોઢી પણ આ કાવ્યની પંક્તિઓ ગાઈને – મનોમન – જાણે પરંપરાગત અંજલિ આપે છે ને ભીની આંખો ફેરવી દે છે ! ‘જણ જીવો જી’ – એ મરી જનારને થયેલું હ્યાતીવાચક સંબોધન છે. મુશ્કુ પામનારની પાછળ સ્વજન (સાવ અંગત એકબે પ્રિયજન હોય તે) –ની ઘવાયેલી ને નિરાધાર બની ગયેલી લાગણીઓને જુદે જુદે સંદર્ભે કવિ રજૂ કરે છે – જરા ઊંચે અવાજે ગાઈ દેખાડે છે :

‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી  
હૈયાનાં ખાલીખમ ફળિયા રે જણ જીવો જી.’

‘ઠાકર’ એટલે લાભશંકર ‘ઠાકર’ ! (ઘડીક ‘ઠાકર’ કહેતાં ત્રભાજામાં બિરાજી નહતા ઠાકોરજી પણ આંખમાં બલકે મનમાં હાજર થઈ જાય છે ખરા ! પણ અહીં એ ‘ઠાકોરજી’ વગરના ‘ઠાકર’ની વાત છે.) લાંઠાંએ હ્યાતીમાં લખેલું આ પોતાનું મરશિયું છે – એમાંય વાત તો નિરર્થકતાની જ કરેલી છે. જે આંખો હાલ વરસાવતી કે કોષી રાતીપીળી થાતી હતી તે હવે બોરના ઠળિયા જેવી ઠાલી થઈ ગઈ છે – હવે કીકી કશું જોતી – કહેતી નથી ! ઠળિયા જેવું હોવું કશા કામનું નથી. હૈયાનાં ફળિયાં ખાલીખમ થઈ ગયાં છે – કોનાં હૈયાનાં ફળિયાં ? –ની વાત છે ? પાછળ મરશિયું ગાવા મજબૂર બનેલા સ્વજનના હૈયામાં હવે પડસાળ – આંગણું – શેરીનો એકસામટો સ્થૂનકાર ફરી વળ્યો છે. ફળિયાનું હોવું પણ શૂન્ય થઈ ગયું છે ! હવે બોલનારા નથી, બેઠક નથી.. પગરવ.. નથી.. આવનજાવન.. નથી ! બધું ખાલીખમ થઈ ગયું છે ! ‘ઠાકર’ – ચેતના – પરમતત્ત્વનો અંશ ચાલી જતાં દેહમાં પણ આવો જ ખાલીપો વ્યાપી જતો

હશે – આવી વંજના – કવિને અભિપ્રેત ન હોય તોય – ભાવકના ચિત્તમાં જાગે છે.

હયાતી અટકી પરી. દિવસો ખૂટ્યા – રોજેરોજ વાર રૂપે ગજાતા તે સણિયા (હીચકો તૂટે એમ) કડકડ કરતા તૂટી પડ્યા... ઘર ઉપર છવાયેલાં / છાયેલાં નળિયાંય ખૂટી ગયાં ! વર્ષો જેવાંન નળિયાં, જે હયાતીના છાપે છાયેલાં હતાં !! હે નાગર, હે નગરમાં (દેહમાં) વસનારા માનવ... બધું તુટ્યું છે – ખૂટ્યું છે ! હોવાનું અંજળ ખૂટી ગયું છે. હવે તો તમે તમારા મનમાં જીવવાના... સરરણમાં જીવવાના ! તમને તો સરગપુરીને મારગ જતાં મોહનજી મળ્યા જ હશે... પણ અહીં તમારી રાધાનાં હડ તમારા અભાવે કરીને સાવ ગળી-ઓગળી ગયાં છે ! જીવનમાં સહેજવારમાં ઊથલપાથલ મચી ગઈ. કવિ લાંઠાંની ભાષાપ્રયુક્તિ અહીં નોખી રીતે હોવાની નિરર્થકતાને ચીંધી ઢે છે :

‘દ્વારથી ઊથલજી ઢળિયા રે જજી જીવો જી.

અધવચ પાથલજી મળિયા રે જજી જીવો જી’

હોવાપણાની અર્થહીન ઊથલપાથલને – એવા જીવનને – કવિ તાકે છે.

જજી / જનારો જીવ તો ચાલ્યો જાય છે. પાછળ રહે છે એ પ્રિયજનને તો ખાવુંપીવું લાળા-કોલસા જેવું (વાળિયા) થઈ પડે છે. જીવતાં જીવતાં જ જાણે પાળિયા – હોવાની પ્રતીતિ થાય છે. નથી ઉમંગ, નથી ઉલ્લાસ ! જીવનની નિરર્થકતાને પિદ્ધાજનાર અને અસ્તિત્વવાદની ભૂમિકાએ વિચારનાર લાંઠાંને પોતાને જીવતેજીવ પણ આવો – શૂન્યતાનો – અનુભવ થયો હોય... ને આ કાબ્ય એવી ભૂમિકાએ કશોક અર્થસંકેત કરતું હોવાનો મને વહેમ પડે છે.

ઇ માસ બધું નિદામાં વહી ગયું ! જીવવાની પ્રતીતિ જ જાણે નહોતી થતી – હાસ્તો ! પ્રિયજન (હોવાને અર્થ આપનાર) તો હતા નહિ ! પછી તો જીવવાનાં વ્લેણ પણ પાછાં વળતાં થયાં ! હા, હેવે ચઢતાં પૂર્ણ નહોતાં ! વળતાં પાણી હતાં... પછી તો ભડ ભડ ચોહમાં એય બળ્યા ને પાછળ રહ્યાં તેય બળ્યાં ! પણ જે આ હોવાપણાનો અર્થ/નર્થ જે સમજી કે પામી ગયા... તેમજે ખરેખર અલખને અજવાળવાનું કામ કર્યું છે. ‘અમથાં અલખ’ ! હા, આ અલખ અને એની લીલા પણ અમસ્થી જ તો છે ! જેમ જીવવું / હોવું તે પણ અમસ્થું હોય છે ! લાંઠાંના એક બીજા અસ્તિત્વપરક તત્ત્વને તાકતું ગીત યાદ આવશે : – ‘આ અમથું ખીલ્યું ફૂલ સમજ્યા... આ અમથો તીજ્યો સૂરજ સમજ્યા.’ હોવાને આમ હળવાશથી જોવું – અનુભવવું તથા હોવાપણાની અર્થહીનતાને ગંભીરતાથી ચીંધી બતાવે એવું કવિકર્મ કરનાર લાંઠાંને સલામ !

૨૮-૦૩-૨૦૧૬



## ૨૬. આમ ખેંચીએ જરાક જોરથી -નું એક અનુ-આધુનિક વાચન

સુમન શાહ

### આમ ખેંચીએ જરાક જોરથી -

આમ એ ખેંચીએ જરાક જોરથી —

તો ખ્ય ખેંચાઈને આવે બહાર.

પણ ત્રીશ વર્ષથી એમ ખેંચ્યું નથી ખ્ય.

મન થાય છે કે ખેંચ્યું —

પણ એ કંઈ આમ આજુબાજુમાં હાથવગું નથી.

એ માટે પ્લાન કરવો પડે, પ્રવાસ કરવો પડે.

પણ પ્લાનની કે પ્રવાસની દુરદા થતી નથી.

જોકે મન થાય છે આમ ખેંચ્યું અને ખ્ય ખેંચાઈને આવે બહાર,

મૂળસોતું મન.

‘મૂળસોતું મન ખ્ય ખેંચાઈને આવે બહાર’ એવો અર્થ કયાંથી

ટપકી પડ્યો ?

ખ્ય ખેંચાઈ આવે બહાર, એમાં જે ખ્યકાર સાથે

હાથની પકડમાં

કશુંક આવી જવું મૂળસોતું (જેમ કે કમળનું મૂળ.)

તે સંવેદન માત્ર પર્યાપ્ત છે, રોમાંચ માટે;

એમાં વળી ‘મૂળસોતું મન’ ખ્ય ખેંચી કાઢવાની વાત કેમ ઘૂસી ગઈ ?

મૂળસોતું મન કે શૂળસોતું મન કે કુળસોતું મન કે ધૂળસોતું મન

અને હવે બીજું કંઈ પ્રાસમાં તરત સૂઝાતું નથી તેથી નિર્મૂળ મન....

ના પણ લયવશ લખવું હોય તો ‘નિર્મૂળસોતું’ મન;

જોયું ને ‘નિ...’ અને ‘સોતું’એ પરસ્પર પોતું ફેરવી દીધું

અને અંતિમ ક્ષણો જે મેં પીધું કર્ષરસાયન  
 એ અપૂર્વ.

એ જ લક્ષ્ય હતું એની ખબર પછી પડી  
 અને અડીકડી-માં ભરેલો દારુ ભડકો કરે  
 પછાડતાંની સાથે જ, એ જ ચેતોવિસ્તાર.  
 આમ ‘શાલ્લિક ટેવવશ’ થયા કરવું તે નિર્હેતુક નથી.  
 હેતુની યાત્રા ચાલે છે શબ્દની માત્રા-ઓમાં.  
 ક્ષણો ક્ષણો સ્વર-વ્યંજનનો રમણીય લટકો  
 એનો લાગી જાય કાનને ચટકો  
 જરાક અટકો –  
 ફિટકો પ્રાસમાં આવ્યો.  
 ચાબુકનો ફટકો.  
 અને અન્ય એક આંખ મીંચકારીને કહેવાના અર્થમાં પણ ફટકો.  
 ડેરીનો કટકો  
 અને રંગરસિયા હવે આટલેથી અટકો જેવા પ્રાસ તો ઘણા ઉછળે છે.  
 પણ ત્રાસ થવાથી યાત્રા આગળ ચાલે છે.  
 ‘ફાલે છે’ એવું સૂઝું, પણ શું ફાલે છે ?  
 પ્રજા ? ધોંઘાટ ? ઊધઈ ? જાડ ? દેડકાં ? માખી ? મચ્છર ખચ્ચર ?  
 ખચ્ચર તો ફાલી ન શકે.  
 ચાલી શકે, દોડી શકે, ઊભાં રહી શકે, બેસી જાય, પેસી જાય –  
 ક્યાં ? મનમાં અને અફાટ વનમાં  
 મનના વનમાં ખચ્ચરો બોજા સાથે ધીમે ધીમે કે ઝડપથી  
 ચાલી રહ્યાં છે કે દોડી રહ્યાં છે અથવા બેસી રહ્યાં કે બેસી પડ્યાં છે.  
 ખચ્ચર ? ચાલો તરત કહો શેનાં ખચ્ચર ?  
 ખચ્ચર શબ્દનાં-લાગણીનાં-વિચારનાં-ઈચ્છાનાં-વાસનાનાં-ઈજ્ઞાનાં-  
 ઈસ્થેટિક્સનાં-સ્મૃતિનાં-વિસ્મૃતિનાં-કૃતિનાં-વિકૃતિનાં-સંસ્કૃતિનાં-  
 ગતિનાં-સતીનાં-પતિનાં-જતિનાં-મતિનાં-રતિનાં-વિરક્તિનાં-  
 ખચ્ચર  
 મનનાં અફાટ વનમાં...

મનનાં જ શા માટે ? તનનાં નહીં ?  
 નસેનસમાં, રક્તમાં, રક્તના કોષેકોષમાં, મગજના તંતુએતંતુમાં,  
 રજોશુકમાં માતાપિતા દ્વારા સંતતિમાં -  
 સતત સરકી રહ્યા છે ખર્ચરો.  
 ક્યાં પહોંચવાનું છે ? ખબર નથી. બસ ચાલી રહ્યા છે  
 આ અત્યારે જેમ ચાલી રહ્યા છે કાગળ પર શબ્દો  
 એક પછી એક તેમ ચાલી રહ્યા છે ખીચોખીચ ખર્ચરો  
 નપુંસક.  
 હવે આમ રમતાં રમતાં કશો અર્થ ઘૂર્ણી ગયો હોય તો તે જેમ -  
 'મૂળસોતું મન' એ એક અનભિપ્રેત ગરબડ હતી  
 જોકે તેથી જ રોમાંચક હતી.  
 તેમ અહીં આ ખર્ચરવાદ - બખરવાદ જે કંઈ ચાલ્યો  
 કે ફાલ્યો  
 અને એમાં આ નપુંસક લેખિનીપ્રયોગ મહાલ્યો  
 તે અનભિપ્રેત હતું, અનપેસ્કિત હતું.  
 એ આમ આવ્યું કૂવામાંથી જેમ અવાડામાં આવે તેમ  
 પણ એને બહાર કાઢવાનું પણ અભિપ્રેત નહોતું  
 મૂળસોતું છતાં જે આવ્યું ખબૂ દેતું એ રોમાંચક છે.  
 રોજ અસંખ્ય બૂધોને પોલિશ કરનારો બૂટની ચમક જોઈને ચકિત થતો હશે ?  
 પણ જવા દો -  
 ગાત્ર છું એટલે ગળું છું.  
 પાત્ર છું એટલે ઢળું છું.  
 માત્ર છું એટલે મળું છું.  
 ફળ છું એટલે ફળું છું.  
 ખરેખર તો આ છેલ્લી પંક્તિઓને આધારે -  
 આમ થોડી ક્ષાણો પસાર થઈ ગઈ;  
 એટલે કંટાળો નથી આવતો  
 ગળ્યો ગળ્યો શીરો નથી ભાવતો.  
 આમ એક પછી બીજી ક્ષાણ સુધી પહોંચી જવાનું, કાલચકના કમમાં  
 અને ક્ષાણોનો અંત નથી.

અને હું કઈ સંત નથી કે નથી પંત  
 પ્રાસવશ છું માત્ર જંત  
 પણ કઈ કશી ચંત નથી  
 કે નથી આ માત્રાઓનો કાચો તંત કે તૂટી જાય  
 કે કુળગાની જેમ ફૂટી જાય.  
 એમાંની નિરવધિ શક્યતાઓ ખૂલતી જાય છે  
 શાખા - પ્રશાખા ઝૂલતી જાય છે  
 અને આ આપણી ડાગળી ઝૂલતી જાય છે  
 પણ એમ કંઈ કશું અભિપ્રેત નથી આપણને  
 કે નથી એમ કશા અનૌચિત્ય - ફનૌચિત્યની પડી.  
 આપણે તો અરીકડી -  
 પછાડી, અને જે ભડાકો થયો....,  
 પણ એમાંય ભડાકાની અપેક્ષા છે  
 આ તો એનાથીયે વધુ રોમાંચક યાત્રા છે  
 માત્રાઓની -  
 અંતહીન.  
 ‘અંતથી બેડી રહ્યો છું’ એમ લખાઈ ગયું  
 પણ લખવું જોઈએ : ‘બેડાઈ રહી છે’ —  
 અલબત્ત યાત્રા, માત્રાઓની, અંતહીન.  
 ‘છેડાઈ રહ્યો છું સિતારની જેમ’ એમ સૂજયું  
 પણ કોણ છેડનાર ?  
 કેમ કે સિતારિસ્ટ સિતાર વગાડતો નથી એનાથી સિતાર વગાડાઈ રહી છે.  
 જમનાદાસ જશોદાને જગાડતા નથી  
 પણ જમનાદાસથી જશોદા જગાડાઈ રહી છે.  
 અર્થાત્ છરી - ચઘુ - હાથો - હથોડી;  
 પણ ક્યાં છે હાથ ?  
 હાથીભાઈ ચાલી શકતા નથી.  
 લીમડાભાઈ ફાલી શકતા નથી.  
 જમના નદી જેમ અટકી શકતી નથી કે દોડી શકતી નથી.

અથવા સુકાઈ શકતી નથી કે બે કાંઠે છલોછલ થઈ શકતી નથી.  
એટલે જમના દોડે છે. જમના છલકાય છે.  
જમના જાગી, ભેંશ ભાગી.

આ બધા પ્રયોગોમાં કિયાપદનાં ચડો ચાલતાં નથી.

જેમ કોઈ ચક ચાલી શકતું નથી તેમ.

તો હવે એનું શું ? આ ફસાયા છીએ તેનું ?

અને કોઈ ફસાવનાર જ નથી તેનું ?

કર્તાનો સર્વથા છેદ છે

અને તેથી જ મને અતિશય ખેદ છે

કે હું એક નિર્દોષ, ચોખ્યું વાક્ય કે પંક્તિ લખી કે બોલી શકતો નથી.

અને છતાં આ કાવ્ય-બાવ્યના ચક્કરમાં આમ ગોળ ગોળ ભમવાનું.

અને પાછું એ આમ ગમવાનું

ટેવવશ.

હવે આમાં શું સર્જન અને શું વિસર્જન

મિયાંગામ કર્જન —

લખાઈ ગયું તોય શું ? અને કાકડીનું કડવું શાક ચખાઈ ગયું તોય શું ?

અને ભૂલથી આ ઝૂંચી વગરનું તાણું વખાઈ ગયું તોય શું ?

અર્થાત્ અમુક સામગ્રી છે. અમુક સામગ્રીનું અમુક પરિણામ છે.

આમાં આપણું કશું જ ચાલે તેમ નથી.

આપણે જ ચાલી શકતા નથી.

ચાલવાની ‘ઈચ્છા’ જ આપણે ઉત્પન્ન કરી શકતા નથી.

એ તો, એટલે કે ઈચ્છા, થવી હોય તો થાય.

અને છતાં કેટલું બધું થાય છે મારું બેટું !

એક અમસ્તું ટેટું અપરિસંખ્યેય વતવૃક્ષોને સંગ્રહી બેટું છે !

મથી શકીએ છીએ મન : જો ઈચ્છા થાય તો.

નહીં તો ખાવાનું છે, નાવાનું છે, ધોવાનું છે, રોવાનું છે, જોવાનું છે

પણ ખાવાની ઈચ્છા થાય તો થાય

નાવાની ઈચ્છા થાય તો થાય

ધોવાની ઈચ્છા થાય તો થાય

રોવાની ઈચ્છા થાય તો થાય  
 અથવા ખબરે ન હોય ને રોવાઈ જાય, અચાનક.  
 ઈચ્છા થાય તો માણસ ગાય  
 કે નદીમાં જઈને નાય  
 અને ઈચ્છા ન થાય તો ન થાય.  
 ન થાય તો કંઈ ન કરે.  
 પડગો રે એમ જ મુંગો મુંગો  
 જાડની જેમ સુકાતો જાય, ખરતો જાય, ખખડતો જાય સૂનમૂન  
 અને એક દિવસ લથડી પડે ધબ  
 અર્થાત્ રામનામ સત્ય છે.  
 તાત્પર્ય એ કે ઈચ્છાની મૂર્ઠમાં આપણે જકડાયા છીએ  
 પૂરેપૂરા પકડાયા છીએ  
 સંહતર સપદાયા છીએ.  
 છેલ્લી પંક્તિ લખવાની ઈચ્છા થઈ એટલે લખાઈ.  
 અથવા મનમાં જન્મી પછી પરખાઈ  
 અને આમ કાગળ પર રખાઈ  
 તો પછી આ પંક્તિને મારી ઈચ્છા સાથે સંબંધ નથી.  
 એ તો આવી —  
 જેમ હું અને તું આવ્યા આ જગતમાં, ઈચ્છા વગર.  
 અને જવું પડશે આ જગત છોડીને ઈચ્છા વગર.  
 ‘આવ્યા’ કિયાપદ ઓદૃં છે  
 ભાષાનું આ જ તો દુઃખ મોદૃં છે.  
 ‘જવું પડશે જગત છોડીને’ — કયાં ?  
 મારો જન્મ : મારું મૃત્યુ.  
 મારો કોઈ નહીં કર્તા : મારો કોઈ નહીં હર્તા.  
 કર્તા – હર્તા હોય તો હેતુ હોય  
 ધૂમકેતુ હોય નીલાકાશમાં  
 મીનકેતુ હોય ચિદાકાશમાં  
 પણ માત્ર હોય, અને આપણને હોવાની ખબર પડે.

અર્થાત् ‘માન’

એક પછી એક આવતા શબ્દોની ગતિમાં સૌંદર્ય સર્જાતું જાય  
અને કવિને અહો ! અહો ! થાય.

એના મગજમાં આનંદની પવન-લહરીઓ આઈ આઈ વાય  
બસ આટલું જ.

પ્રકટ થયા પછી પરખાય છે જ્યાં પંક્તિ  
ત્યાં શેની કાન્તદાસિ ? ‘દર્શક’ને દેખાય

જેમ મને આ કાગળમાં લખાતા જતા અક્ષરો એક પછી એક  
દેખાતા જાય છે તેમ.

બસ આટલું જ

બાકી આ કળાનું બખડજંતર બેઝિકલી છે ફાટલું જ.

પ્રાસમાં ઊછળી આવે છે કાટલું જ.

પણ શેનું કાટલું ? જોખવાનું ?

કે શિયાળામાં શક્તિ માટે વાળીને ખાવાનું કાટલું ?

સાચું કહું તો પૂર્વજોએ પકડાવેલું અથવા પકડાઈ ગયેલું  
ફસડાઈ ગયું છે માટલું જ —

કવિતાનું.

પ્રેય ઢોળાઈ ગયું છે

શ્રેય રોળાઈ ગયું છે

શ્રેય — પ્રેય કશું નથી હેય કે ઉપાઠેય.

પડચું છે બધું કટકેકટકા થઈને નીચે —

શું કરું ? અથવા શું કરીશ ? અથવા શું થશે મારાથી ?

બસ આમ આ દશ્ય ફિઝ થઈ ગયું છે.

પૂરું થવાનું નથી નાટક ?

ખૂલવાનું નથી કોઈ ફાટક ?

મારો જ પ્રેક્ષક મને અનિમેષ તાકીને સત્તાવી રહ્યો છે —

આ પરદા વિનાની રંગભૂમિ પર.

ઓંકરોબર, ૧૯૭૬

આ રચના એક કાવ્યશીલ ઘટનાનું નિખાલસ કથન છે. કથનાત્મક રચનાનો કથક આમ તો લેખક વતી હોય છે પણ ભૂમિકા બજવે છે નાયકની. નાયક નાટકમાં જ હોય એવું નથી. જ્યાં જ્યાં કથા-કથન હોય ત્યાં ત્યાં એ હોય. નાયકને પ્રોટેગનિસ્ટ પણ કહીએ છીએ. આમ તો પ્રોટેગનિસ્ટ લેખકથી ય મુક્તા, એક સ્વાયત્ત હસ્તી હોય છે. સર્જનાત્મક હેતુ ભવે લેખકનો હોય, એનો ઘડવૈયો, નિયામક અને પ્રતિપાદક પ્રોટેગનિસ્ટ હોય છે. એ અર્થમાં એ કોઈપણ ડિસ્કોર્સમાં -સંભાષણમાં- હોય છે અને એ જ ભૂમિકા બજવતો હોય છે. મારું દૃઢ મનત્વ છે કે શ્રોતાએ કે વાચકે, એટલે કે આપણે, હમેશાં પ્રોટેગનિસ્ટને શોધી લેવો રહે. એને માણીએ-પ્રમાણીએ તો રચનામાં બધું સુગમ રહે, રચનાના પલસ-માઈન્સ પકડવામાં સરળતા થાય.

આ રચનાના પહેલા જ બન્ધમાં મેં પ્રોટેગનિસ્ટને શોધી કાઢ્યો. મને મળી ગયો છે :

જરાક જોરથી જેંચે તો ખચ્ચ જેંચાઈ આવે પણ ત્રીશ વર્ષથી એમ જેંચયું નથી ને એ પણ કંઈ આજુબાજુમાં હાથવગું નથી. ને વળી એ માટે પ્લાન કરવો પડે પ્રવાસ કરવો પડે, એવી પ્રોટેગનિસ્ટ-નાયક-વાત માંડી છે. (આ લેખમાં પ્રોટેગનિસ્ટને હું ‘નાયક’ પણ કહેતો રહીશ.) વિમાસણ થાય કે શું હશે એ ખચ્ચ જેંચાઈ આવે એવું નાયકનો ઉત્તર છે, ‘મૂળસોટું મન’ મૂળસોટું મન મોટી લાભ્ય કહેવાય. કેમકે માણસ ગમે એટલું જેંચે, તૂટેલું જ હાથ આવે છે, મૂળ તો રહી જ જતાં હોય છે. એમ પણ કહેવાય કે આ લાભ્યથી નાયકને એક અનેરી તક મળી – આત્મસાક્ષાત્કારની તક. જેંચાઈ આવેલું મૂળસોટું મન અને નાયક બન્ને વચ્ચે મૂક વિનિમયો તો થયા જ હશે. દેખીટું છે કે વિનિમયો નિઃશબ્દ હશે એટલા જ અકથ્ય હશે. તેમણીતાં, બને કે નાયક એ નિઃશબ્દ અકથ્યને આ કાવ્યશીલ ઘટનાના સમગ્ર કથનમાં ઉમેરી લેવાનો હોય.

નાયક એવું કંઈપણ શરૂ કરે ત્યાં તો મેં જોયું કે અને એક કવિ મળી ગયો (જેનું નામ લાભશંકર ઠાકર હોઈ શકે છે). મેં અનુભવ્યું કે કવિ ભાષાજ છે. જોયું કે વાત વાતમાં નાયકને એણે ચૂપ કરી મેલ્યો.. વારે વારે ભાષાને લડાવી લડાવીને પોતાની જ વાત કરવા લાગ્યો. ખાસ તો મેં એ જોયું કે પોતાની એણે લાંબી લસરક શબ્દ-જાતરા જે ચલાવી, એમાં નાયકની નાનકડી સુન્દર જેંચ-લાભ્ય જે હતી-મૂળસોટું મન- એવળોટાઈ ગઈ. મેં અનુભવ્યું કે સભાનપણે સખત દખલગીરી કરી શકતો કવિ ભાષાજ તો ખરો જ, પણ એટલે જ, અર્થવ્યાધ પણ છે. આવતાંમાં જ પ્રશ્ન કર્યો : “મૂળસોટું મન ખચ્ચ જેંચાઈ આવે બહાર” એવો અર્થ ક્યાંથી ટપકી પડ્યો ?” : શાસ્ત્રીની જેમ કહેવા લાગ્યો કે હાથની પકડમાં કશુંક મૂળસોટું આવી જાય તે સંવેદનમાત્ર રોમાંચ માટે પર્યાપ્ત છે; દાખલો આપ્યો – ‘જેમકે, કમળનું મૂળ’.

મારા ધ્યાનમાં આવ્યું કે ‘અર્થ’, ‘પર્યાપ્ત’ ‘જેમકે’ જેવા વિદ્વત્તાભર્યા શબ્દપર્યોગો એ આસાનીથી કરી જાણે છે. પછી તો આગળ વધી ગયો. શુંણસોટું દુંણસોટું જેવા મૂળસોટું -ને મળતા આવતા શબ્દો કહેવા લાગ્યો. હોશિયારી કરી રહ્યો, જેમકે : ‘અને હવે

બીજું કઈ પ્રાસમાં તરત સૂજતું નથી તેથી નિર્મૂળ મન; / ના પણ લયવશ લખવું હોય તો નિર્મૂળસોતું મન' : આપણને પ્રશ્ન થાય કે 'નિ' લગાડવાથી 'મૂળ' નિર્મૂળ થોડું થઈ જાય - ? પાછો ડહાપણ ડ્રોળવા માંડ્યો : "જોયુને નિ..." અને 'સોતું'એ પરસ્પર પોતું ફેરવી દીધું અને અંતિમ ક્ષણે જે મેં પીધું કર્ષારસાયન / એ અપૂર્વ' : મને થાય, શેનું કર્ષારસાયન ! શેનું અપૂર્વ ! એ જ કહે છે એમ, બધું એણે લયવશ તો લખેલું ! બોલ્યો, 'ક્ષણે ક્ષણે સ્વર-વ્યંજનનો રમણીય લટકો' - એટલે એમ બોલાયું કે 'એનો લાગી જાય કાનને ચટકો'. પછી 'જરાક ચટકો' બોલાયું તો કહે - 'ફટકો પ્રાસમાં આવી ગયો'. પછી કહે, 'આબુકનો ફટકો'... 'કેરીનો કટકો' : (જુઓને, હું પણ કેવો લપેતાતો ચાલ્યો છું એની વાતોમાંન / કેવો ભૂલતો ચાલું છું નાયકને, પ્રોટેગનિસ્ટને !). એ એમ પ્રાસે ચડી ગયો. પાછો બડાશ મારવા લાગ્યો કે 'અને રંગરસિયા જરા આટલેથી અટકો જેવા પ્રાસ તો ઘણા ઉધાળે છે' - જાણો પોતે જુદું કરતો હોય ! અરે, એટલે લગી માની બેટો છે કે 'પણ ત્રાસ થવાથી યાત્રા આગળ ચાલે છે' : જાતે સ્વીકારે છે કે હુંમેશાં પોતે આમ 'શાબ્દિક ટેવવશ' થયા કરતો હોય છે ! તેમણીતાં, એક વાત છે - ચિત્તમાં એણે એક જબરું સત્ય સંભરી રાખ્યું છે : એમ કે, 'અડી-કડીમાં ભરેલો દારુ ભડાકો કરે ને પછાડાતાંની સાથે જ થાય, ચેતોવિસ્તાર' : હા, પણ, અડી-કડીને એ પછાડે છે એમ વારંવાર ન પછાડાય ! 'ચેતોવિસ્તાર' શબ્દ એણે દેખાદેખીથી વાપર્યો છે; ક્યાંકથી સાંભળ્યો હશે....

'ચાલે છે' પરથી એ કહે છે એમ એને 'જ્ઞાલે છે એવું સૂજાયું'. એ કહે છે એમ એને તરત થયું છે કે 'પણ શું જ્ઞાલે છે ?' આ 'પણ શું જ્ઞાલે છે ?' પ્રશ્ન, માનું ધારવું છે કે એને નાયકે પૂછેલા પ્રશ્નનો પડધો છે. કેમકે પ્રાસની લતમાં એને એવા ઊંડા પ્રશ્નો શી રીતે થવાના ! નાયકે પૂછ્યું : 'પણ શું જ્ઞાલે છે ? પ્રજા ? ધોંઘાટ ? ઊધાઈ ? અડ ? દેડકં ? માઝી ? મણ્ણર ખચ્ચર ?' ભાષાજને તો આમ જ પૂછ્યું જોઈએ ! જોકે સાચકલું કે ખરેખાતનું શું જ્ઞાલે છે એ તો 'મૂળસોતા મન' -નો માલિક નાયક જ કહી શકે. એ કહે છે : 'મનના વનમાં ખચ્ચરો બોજા સાથે ધીમે ધીમે કે જડપથી / ચાલી રહ્યાં છે કે ધોડી રહ્યાં છે અથવા બેસી રહ્યાં છે કે બેસી પડયાં છે' : જોકે સાંભળીને કવિ તરત જ બોલ્યો : ખચ્ચર ? ચાલો તરત કહો શેનાં ખચ્ચર ? : અને વ્યાખ્યા-મતલબી જાતે ને જાતે ઉત્તરે ચડ્યો -એ જ એની શબ્દાળું સ્થાઈલમાં : 'ખચ્ચર શબ્દનાં-વાગણીનાં-વિચારનાં-દીક્ષાનાં-વાસનાનાં-દીક્ષમનાં-દીસ્થેટિકસનાં-સ્મૃતિનાં-વિસ્મૃતિનાં-કૃતિનાં-વિકૃતિનાં-સંસ્કૃતિનાં-ગતિનાં-સતીનાં-પતિનાં-જતિનાં-મતિનાં-રતિનાં-વિરક્તિનાં' : સારું છે કે અટક્યો. કદાચ, પ્રાસ ખૂટી પડ્યા. અથવા, હંજી ગયો. બાકી, એને તો એમ જ હોય છે કે જેવી તક મળે, શબ્દોનાં ઓંજાર ખબડાવતા બસ આમ તૂટી પડવું. બાકી, નાયકના 'શું જ્ઞાલે છે' પ્રશ્નનો ઉત્તર આટલી લાંબી ન સર્જાઈદાર વાર્ષાનુપ્રાસી યાદી ફટકારીને થોડો અપાય ?

જુઓને, નાયક એ જ વસ્તુને કેટલી સારી રીતે કહી જાણે છે ! : 'ખચ્ચર મનનાં અંજાટ

વનમાં... મનનાં જ શા માટે ? તનનાં નહીં ? નસેનસમાં, રક્તમાં, રક્તના કોષે કોષમાં, મગજના તંતુઓંતંતુમાં, રજોશુકમાં માતાપિતા દ્વારા સંતિમાં -સતત સરકી રહ્યા છે ખચ્ચયરો' : પણ પેલો તો યાદીમાં વ્યસ્ત હતો એટલે એને સવાલ થાય છે : 'ક્યાં પહોંચવાનું છે ? ખબર નથી' : એને 'ક્યાં' પ્રકારના અગમની ખબર કેમની પડે ? એને તો શબ્દો સાથે રમતા રહેવાની ગમ છે. પ્રારમ્ભે પૂછેલો પ્રશ્ન 'મૂળસોંતું મન ખચ્ચ જેંચાઈ આવે બહાર' એવો અર્થ ક્યાંથી ટપકી પડકો ? એને યાદ આવે છે. ને ઉત્તર સૂરી જાય છે કે 'અર્થ' તો રમતાં રમતાં ઘૂરી જતા હોય છે. ઈતિ સીધામું પ્રકારે કહી નાખે છે કે 'મૂળસોંતું મન' એવી 'અનભિપ્રેત ગરબડ' હતી એટલે 'ચોમાંચક' હતી.

નાયકની અનુભૂતિને વિશેનું એનું આ જજમેન્ટ ચોંટડુક છે, એની બેઢંગ રીતમાતનું ફળ છે. ખાસ તો એમ કરીને એ પોતાની જાતનો લૂલો બચાવ કરી રહ્યો છે. જુઓને, પોતાના 'ખચ્ચયરવાન-ખચ્ચયરવાન' ને એને 'નાયુંસક લેખિનીપ્રયોગ' ને પણ 'અનભિપ્રેત' કહેવા લાગ્યો ! 'વાદ' 'અભિપ્રેત' 'અનભિપ્રેત' 'લેખિનીપ્રયોગ' જેવી શ્રમત્વાપ્યે સંખાચો પ્રયોજને ભ્રમજળ રચ્યો છે. ખરેખર તો એવું બધું હેમેશાં એના અર્થવ્યાધ સ્વભાવનું, વાતને પરિભાષામાં ચગાવવાની શાસ્ત્રીના જેવી એની કુટેવનું પરિણામ હોય છે. 'મૂળસોંતું મન' જેવી નિર્વાજ વસ્તુ સાથે પોતાના એવા સદા-સયુક્તિક વાગ્યવહારને જોડતાં એ લજવાયો નથી. મને વિમાસણ થાય કે મગજાં આટાટલું જ્ઞાન, આટાટલી સમજજારી, આટાટલી સભાનતા ભરી પડી છે એવાને શું કામ હું કવિ કવિ કચ્છા કરું છું ? કંઈ બીજું કરતો હોત તો લેખે લાગત ! જે વસ્તુને જેમ જાણો-સમજે છે ને જે પ્રકારે ગોઠવે-કરે છે, તો તેને પાછો ગબડાવે છે શું કામ ? ઉથલાવીને હેરે-ફરે છે શું કામ ? જ્ઞાનની જોડે આવી વગર મફતની ઊલટાસૂલટી શું કામ કરતો હો ? ના જ ફાવવનું હોય તો એનાથી મૌનનો આશરો કરાય કે નહીં ? જોકે, મૌન ? જવા દો ! એના બારામાં 'મૌન' બોલવું ય મિથ્યા છે !

એ તો કહ્યે જ રાખે છે, પ્રાસની લઢણમાં : 'ગાત્ર હું એટલે ગળું હું, / પાત્ર હું એટલે ઢળું હું, / માત્ર હું એટલે મળું હું, / ફળ હું એટલે ફળું હું.' : આ આત્મદર્શન ઠીક ઠીક સારું હતું, કેમકે એમાં શાબ્દનો ખખડાટ નહિવત્ હતો. પણ ટિપ્પણી કર્યા વિના એનાથી થોડું રહેવાય ? કહ્યું જ : 'ખરેખર તો આ છેલ્લી પંક્તિઓને આધારે આમ થોડી ક્ષાળો પસાર થઈ; / એટલે કંટાળો નથી આવતો' : 'આવતો' -ના પ્રાસમાં એને 'ભાવતો' સૂચાંચું એટલે કશશાય કારણ વગરનું સાવ ફાલતુ કહી નાખ્યું કે - 'ગળ્યો ગળ્યો શીરો નથી ભાવતો.' : એને તો એમ કે 'શીરો' લાવીને બેલિન્ છેડાની વાતોને પોતે કેવો તો નવતર અર્થ અર્પી દીધો ! એ જ માનસિકતાનો માર્યો એકદમની હિલસૂઝી હંકવા મંડચો - 'આમ એક પછી બીજી સુધી પહોંચી જવાનું, કાલચ્યકના કમમાં / અને ક્ષાળોનો અંત નથી' : પેલા સીધાસાદા આત્મદર્શન આગળ એની આ સુદ્ધિયાણી વાત કેટલી તો કૃત્રિમ છે એની ખબર એને તો શી રીતે પડવાની ?

કોણ જાણે....

જુઓ, પાછો પ્રાસે ચડ્યો : ‘હું કંઈ સંત નથી કે નથી પંત / પ્રાસવશ છું માત્ર જંત...’ : એવા આત્મભાન પછી આત્મસમર્થન માટે, સાંભળો, કેવું કહે છે : ‘પણ કંઈ કશી ચંત નથી / કે નથી આ માત્રાઓનો કાચો તંત કે તૂટી જાય ! કે કુંગાની જેમ ફૂટી જાય’ : આટલું ઓછું હોય એમ બારોબાર જ કહી દીધું : ‘એમાંની નિરવધિ શક્યતાઓ ખૂલતી જાય છે / શાખા-પ્રશાખા જૂલતી જાય છે’ : આપણાને થાય, અરે ભઈ, કોમેન્ટ્રી આપનારાની જેમ તું એમ સપાટ વિધાનો કરે તે થોડું સ્વીકારી લેવાય કે શક્યતાઓ, પાછી નિરવધિ શક્યતાઓ, ખૂલતી થઈ જાય છે ? શાખાઓ અને પ્રશાખાઓ જૂલતી થઈ જાય છે ? આમ ગમે ત્યારે અતિશાયોક્તિઓ કરી આપણાને ભરમાવે છે. હવે એને ય ઊંધું પાડે છે. એનામાં બેઠેલો શાસ્ત્રી ઔચ્ચિત્યવિચાર છાંટે છે, શેખીથી રાજાપાર્ટમાં બોલે છે – ‘પણ એમ કંઈ કશું અભિપ્રેત નથી આપણાને / કે નથી એમ કશા અનૌચિત્ય-ફનૌચિત્યની પડી.’ : અરે, એને ય ભગાડી મૂકે છે ને ચિત્તમાં સંઘરી રાખેલું એ જ પેદું સત્ય વળીને સંભળાવે છે – ‘આપણો તો અડી-કડી / પઢાડી, અને જે ભડાકો થયો...’ : ત્યાં અટક્યો હોત તો સારું હતું. અરે પણ, એ સત્યમાં ય એને હવે ‘અપેક્ષા’ દેખાઈ ! કહું કે, ‘એમાંય ભડકાની અપેક્ષા છે’ : અત્યાર લગ્ની જે ભડાકા કર્યે રાખ્યા તે જાણે અમસ્તા અમસ્તા કરેલા ! પાછો કંઈક તૃતીયમૂલ્ય શોધી લાય્યો ! એ છે, ભડાકાથી ય ‘વધુ રોમાંચક યાત્રા માત્રાઓ’ –ની. યાત્રા-માત્રાનો યોગ-પ્રયોગ પણ જોડકણું છે. કેમકે કંઈ માત્રાઓ ? કોની માત્રાઓ ? નથી કહી શક્યો. બારાખડીમાં આવે છે એ હોય તો, એ જાણે ! પાછી આ યાત્રા-માત્રા પણ ‘અંતહીન’ છે, જેને એ ‘ખંત’ -થી બેડી રહ્યો છે. તો ય પાછો સુધારો કરે છે : “‘ખંતથી બેડી રહ્યો છું’ એમ લખાઈ ગયું / પણ લખવું જોઈએ – ‘બેડાઈ રહી છે.’”

કવિ આગળ ધ્યાને હવે આમ વ્યાકરણી ભુલભુલામણીમાં અટવાતો થયો -કરુણતા એ છે કે જાણી -કરીને ! જુઓ, ‘બેડી રહ્યો છું’ એ કર્તારિપ્રયોગ છે. એમાંથી હવે ‘બેડાઈ રહી છે’ પ્રકારના કર્મણિપ્રયોગમાં સંચર્યો -નરી સતકૃતાથી. ને એટલે, એ જાતના રવાડે ચંદ્ર્યો : એમ કે ‘સિતારિસ્થ સિતાર વગાડતો નથી, એનાથી સિતાર વગાડાઈ રહી છે.’ ‘જમનાદાસથી જશોદા જગાડાઈ રહી છે.’ હાથીભાઈ, લીમડાભાઈ, જમના નદી વગેરે જાતે કશું કરી શકતાં નથી, વગેરે ચલાવ્યું, એ બધાંને જોઇને ટહુક્કો કે ‘આ બધા પ્રયોગોમાં કિયાપદનાં ચક્કો ચાલતાં નથી’, ‘કર્તાનો સર્વથા છેદ છે.’ એ હકીકતનો વળી એને પ્રાસીય રેપ ઊડ્યો તે કહી નાખ્યું કે ‘અને તેથી જ મને અતિશય ખેદ છે / કે હું એક નિર્દોષ, ચોખ્યું વાક્ય કે પંક્તિ લખી કે બોલી શકતો નથી.’

હકીકત એ છે કે એ આપણી રામે તેમ જાતની સામે ઇળ કરી રહ્યો છે. અત્યારસુધીમાં એણે જે કંઈ લખવા-બોલવાનું કર્યું એ સંઘર્ષનું વર્તન ભાષિક હોઇને એટલું જ નિર્દોષ અને ચોખ્યું છે. વાગ્વૈખરી કે શબ્દજરી રૂપે જર્યાં ખોડું નથી. શબ્દો મોંમાંથી ઝર્યાં કરતા હોય, માણસ

એવો વાગ્યોગ માર્ગ્યો કરતો હોય, પણ એનાથી એ વૈખરીના પંજાથી છુટાય નહીં. આ કવિનો કિસ્સો, એ છે. એજો કંધું જ કે ‘આ કાવ્ય-બાવ્યના ચક્કરમાં આમ ગોળગોળ ભમવાનું / અને પાંદું એ આમ ગમવાનું / ટેવવશ.’ હા, એટંબું સારું છે કે એનાંમાં એ નકરી વાસ્તવિકતાનું આવું ભાન નિરન્તર ઘૃતાતું રહ્યું છે. જોકે એથી એ સુધ્યર્થો નથી. ને તેથી કિસ્સો વધારે જાલિય બન્યો છે...

સવાલ એ છે કે કશા ભાષા ઉપરાન્તના કે ભાષાથી ઠિતર કે ભાષાથી બંજિત શુચિતર ધ્વન્યાલોકમાં ગુજરવાની એની કશી દાનત ખરી - ? અને જો છે, તો ભાષા વડે ભાષાની પેલે પાર પહોંચાડી દેનારા સર્જક કીમિયાની અને ખબર છે ખરી ? એ તો બસ, વૈખરીગ્રસ્ત મર્યાદાઓનાં કથન કર્યા કરે છે - ‘શું સર્જન અને શું વિસર્જન / મિયાંગામ કર્જન- / લખાઈ ગયું તોય શું ? અને કાકડીનું કંડવું શાક ચાદાઈ ગયું તોય શું ?’ : આવા ચયાંકેદાર એકરારોનાં બયાન કર્યા કરવાથી, વળી વળીને કર્યા કરવાથી, જે રંજક વિવાસ પ્રગટે છે તેને જ જો આપણે એનો કવિત્રોષ ગણવાનો હોય, તો એ વિશોષ જ એની મર્યાદા બને છે ને જેથી સરવાળે એનો કિસ્સો ઢીકીક કરુણ પણ દીસે છે.

પણ પ્રોટેગનિસ્ટને -નાયકને -ખબર છે કે અંદરની વાસ્તવિકતા શી ચીજ છે. કવિના જ અનુભવને એ આવી રીતે ઉકેલે છે; આમ વર્ણવી બતાવે છે : ‘અને ભૂલથી આ કૂંચી વગરનું તાણું વખાઈ ગયું તોય શું ? / અર્થાતું અમુક સામગ્રી છે. અમુક સામગ્રીનું અમુક પરિણામ છે. / એમાં આપણું કશું ચાલે તેમ નથી. / આપણે જ ચાલી શકતા નથી; : નાયક અંદર વધારે ઊતરીને જણાવે છે કે ‘ચાલવાની ઈચ્છા જ આપણે ઉત્પન્ન કરી શકતા નથી. / એ તો, એટલે કે ઈચ્છા, થવી હોય તો થાય.’

આ સાંભળી કવિ પાછો સાંભળેલું વાગોળવાની એની આદત પ્રમાણે બોલ્યો છે : ‘અને છતાં કેટંબું બધું થાય છે મારું બેટું ! / એક અમસ્તુ ટેટું અપરિસંખ્યે (-આટલો અધરો શબ્દ પણ એજો બીજે ક્યાંકથી સાંભળ્યો લાગે છે; દેખાદેખીથી વાપર્યો છે.) વટવૃક્ષોને સંગ્રહી બેટું છે !’ : પછી, ‘ઈચ્છા’ શબ્દથી જે કંઈ સૂઝે તેની જંજાળમાં પાછો ખોવાયો પણ છે. પણ ‘મૂળસોત્તા મન’ -નો સાક્ષાત્કાર કરી ચૂકેલા કવિએ એને જણાવી દીધિલું એક પરમ સત્ય એ હતું કે - ‘મથી શકીએ છીએ મન : જો ઈચ્છા થાય તો.’

પણ શબ્દમથામણનો રસિયો મનને થોડું મથવાનો તો ? એ તો એની એ-ની-એ વૈખરી-શૈલીમાં કખ્યા જ કરતો છે - ‘કળાનું બખડજંતર બેળિકલી છે જ ફાટલું’, ‘પૂર્વજોએ પકડારેલું કે પકડાઈ ગયેલું ફસડાઈ ગયું છે માટલું જ - કવિતાનું’, વગેરે. એટલે કે પુનરાવર્તન-દ્રોષ કરતો જ રહ્યો છે -જે દોષને એનું વિદ્વાદ ચિત્તપરિસર ન ઓળખતું હોય એવું ન બને. પણ આપણે શું કરી શકીએ ? વિદ્વાને એમ પણ ઠઠાયું કે ‘પ્રેય ઢોળાઈ ગયું છે / શ્રેય રોળાઈ ગયું છે / શ્રેય-પ્રેય કશું નથી હેય કે ઉપાદેય. / પડયું છે બધું કટકે કટકા થઈને નીચે -

/ શું કરું ? અથવા શું કરીશ ? અથવા શું થશે મારાથી ? / બસ આમ આ દશ્ય છીજ થઈ ગયું છે. / પૂરું થવાનું નથી આ નાટક ? ખૂલવાનું નથી આ ફાટક ?

આમ એની આ વાંબી લસરક શબ્દ-જાતરા દરમિયાન પ્રોટેગનિસ્ટના સ્વાયત્ત દૃષ્ટિદોરનો વિકાસ થઈ શક્યો નથી. એ જાતરા કાબ્યસર્જનની અશક્યતાનું વાગ્યતુરાઈભર્યુ માત્રબયાન છે, જોડી કાઢેલી કર્મેન્ટ છે. એને ‘કાબ્ય’ ગણવા માટે અમુક પ્રકારે કેળવાયેલી માનસિકતાની જરૂરત રહે છે. ખોર, છેલ્લે એ અગતિક થઈ ગયો છે. ભારે મૂળવણ અને નિષ્ફળ હતાશાને પામ્ભો છે. પરન્તુ પ્રતિભાવમાં નાયકે છેલ્લે એને જે સંભળાવું છે એ જો એનામાં વસે, તો ભયોભયો ! નાયકે કહ્યું : ‘મારો જ પ્રેક્ષક મને અનિમેષ તાકીને સત્તાવી રહ્યો છે – / આ પરદા વિનાની રંગભૂમિ પર.’ : પણ આ ભઈ પાસે તો પોતાના પ્રેક્ષકને તાકવા માટેની જિગર છે જ નહીં. અરે, કદ્દી અંદર જ નથી જોતો ત્યાં ! શબ્દ પર શબ્દના પરદા ઝાપટ્યા કરનારાને પરદા વિનાની રંગભૂમિની કશી ભાગ હોય ખરી ? શી રીતે હોઈ શકે ? કિસ્સો આત્મધારી સ્તર્ધતામાં દરી ગયો ભારો છે...



આ રચનાનું મારું આ વાચન જેટલું નિઝ છે એટલું જ અનુ-આધુનિક દૃષ્ટિમતિના ધક્કાથી છે. અનુ-આધુનિક દૃષ્ટિમતિનો અર્થ એ કે વાચનને કાબ્યશાસ્ત્રની ચીલાચાલુ ભૂમિકાએ નથી રાખવું. કોરાણે મુકાઈ ગયેલા વાગ્મીતાશાસ્ત્રની ભૂમિકાએ વિકસાવવું છે. ખાસ તો એ પ્રકારે રચનાનું પુનર્વાચન કરવું છે. કેમકે આપણી આધુનિક કાબ્યપરમારાની અછાન્દસતામાં, એની અરૂઢ અલંકરણસૂચિમાં, એની આસ્વાદ્ય અને આકર્ષક સાહિત્યિકતામાં, વાગ્મીતાનો ઘણો ફાળો છે. એ કેટલો ઉપકારક કે અનુપકારક છે તેની તપાસ હજી થઈ નથી. બીજું, નામજોગ કવિ અને તેના નાયકને એક ગણી લેનારી રીઠી પ્રવૃત્તિથી મેં અહીં છેડો ફાંડ્યો છે. કેમકે બન્નેને એક ગણી લેવાથી ભાગયેજ ખ્યાલ આવે છે કે ખરેખર શું સરજાયું ને કેવાક રૂપમાં સરજાયું છે. એમાં નામજોગ કવિની પૂર્વ-કીર્તિની પ્રકૃત્લિંગ વારતાથી દોરવાઈ જવાનું પણ બનતું હોય છે. એટલે કે મેં એ અદ્વૈત તજ્જ્ઞને દ્રવૈતનો આશ્રય કર્યો છે. તદનુસાર, આ રચનામાં મેં પ્રોટેગનિસ્ટ -નાયક -અને કવિ એમ આગવો બેદ શોધ્યો છે, સંસ્થાપ્યો છે. બેદ-સંસ્થાપિત મારું આ વાચન પ્રાસંગિક છે એટલે એમાં એનું વિસ્તૃત સ્વરૂપ માગે એટલો બહોળો અવકાશ નથી. પણ મારું માનવું છે કે અનુ-આધુનિક વિવેચના એ દિશા પકડે તો અનેક આગેવાન કવિઓનાં આ પ્રકારનાં પુનર્વાચન કરી શકે એમ છે.

લાભશંકરના મનમાં એ લેદ હોય પણ ખરો, ન પણ હોય. જોકે, મને મળેલા નાયકને તેમજ કવિને બેયને સર્જ શકેલા લાભશંકરને હું મોટા આધુનિક લેખું. બને કે એમને મન એ બને અને સ્વયં લાભશંકર કોઈ કોઈથી બિન્ન ન હોય. (ને તેથી, અગાઉ કરેલો ઉત્તેખ ‘જેણું નામ લાભશંકર ઠાકર હોઈ શકે છે’ આપોઆપ ડુલ થઈ જાય છે). તેમ છતાં, મારે એ કહેવું

છે કે મને દેખાયેલો એ બેદ કવિ લાભશંકર અને વ્યક્તિ લાભશંકર વચ્ચેની તિરાડ છે, કાયમી તિરાડ છે. સર્જક અને વ્યક્તિવિશેષ વચ્ચેની તિરાડ મૂળે તો મોટાફિલ્કલ સ્થ્લીટ કે રિપ કે ચીરો હોય છે. આમ તો, ‘હું’ અને ‘હું’ -ને જોતી રહેતી સાક્ષીરૂપ ચેતના. તેથી રચનામાં બેદ બેદ રહે છે અને એટલે નાયકને કવિ પામી શકતો નથી. બલકે બાજુ પર હડેસેલતો રહે છે. પોતાની એવી બેદકતાને જ સદાકાળ વરેલો-વળગેલો રહે છે. તિરાડનું બળપ્ત ઉલ્લંઘન કરવાને બદલે, કશી ઊંચી ઉડાન ભરવાને બદલે, એ, એ ચીરા-ને જ સેવ્યા કરે છે, તાક્યા કરે છે. તાત્પર્ય, પોતાની છિન્ન મનોદશાને રૂઝવતો નથી, નિરંતર ચંગળ્યા કરે છે.

આધુનિક સાહિત્યકલાઓમાં સર્જકની એવી સાક્ષીરૂપ ચેતનાનો અને એની છિન્ન-વિછિન્ન મનોમણી બલકે મનઘંડંત સૃષ્ટિનો અદકેરો મહિમા થયેલો. લાભશંકરનો પણ થયો છે. તિરાડને મહામોટું કલામૂલ્ય અપાયેલું, કેમકે એનાથી એક એવું દર્શન લાઘતું હતું કે જે વડે સર્જકના તમામ સ્વૈર ખાણદર્શનોનું સમર્થન મેળવી શકતું હતું. દાખલા તરીકે, લાભશંકરમાં છે એ માધ્યમ ભાષાને વિશેના સંશયનું સમર્થન કે પરમ્પરાપ્રાપ્ત પદ્યરચનાને વિશેના કે સર્વજ્ઞ કથકને વિશેના સંશયનું સમર્થન મારા સમેતના ધૂરીણ વિવેચકોએ કર્યું જ છે. પંક્તિઓની સીમામાં રહી તેની અંદર જ કાવ્યાર્થને શોદ્યા કરવાની જે ફુતિનિષ્ઠા ઊપર્સી આવેલી, તેનું સમર્થન તો સ્વ-અર્થની સિદ્ધિધ કાજે સર્જકો અને વિવેચકો બન્નેએ કર્યું છે. ટૂંકમાં, આધુનિકોએ આ બધાં સમર્થનોનાં વિદ્વતાયુક્ત ને એટલાં જ આસ્વાદ સમર્થનો જ કરેલાં ને તેમાં જ લિટરરી ડિસ્કોર્સનું ઓકમલીશમેન્ટ ભાગેલું ! સર્જન-વિવેચનના એવા નિભિડધન સાચુજ્યને પ્રતાપે નુકસાન એ થયેલું કે, જરૂરી પ્રશ્નો થયા નહોતા, બહાર-ના-બહાર રહી ગયેલા. સર્જક કલાકારે તિરાડનું ઉલ્લંઘન કરીને કશા અભિનન અને અભાગકાર વસ્તુપ્રેશોમાં સંચરવું જોઈએ પ્રકારનો સદાગ્રહ વાંબા સમય લગી બ્રોકેટમાં મુકાઈ ગયેલો. જાણો એમ કરવાથી આધુનિક સર્જકમાવનાનો નાશ થઈ જવાનો હોય. વાસ્તવમાં એથી ખાડાશ્વરી લઘુક સિદ્ધિધાને વિશેની આત્મરતિમાં ઠીંગરાયેલા રહેવાનું ખાસ બનેલું, અનુ-આધુનિકતાવાદી સમીક્ષા-અભિગમ એમ સૂચયે છે કે વિવેચનાએ એ કે એવા તમામ સદાગ્રહોને કેન્દ્રમાં લાવીને આધુનિક કલાઓનું પુનર્વચન કરવું જોઈએ. અને પૃથક્કરણ સમેતનાં તમામ ઔજારોને એ આશયે નવેસર પ્રયોજવાં જોઈએ....




આટલાં વરસે સાવ સ્પષ્ટ થઈ ગયું છે કે લાભશંકર ઠાકર આપણી ભાષાના સાવ જ નોખા કવિ રહ્યા અને ગણાયા. સદા એમનો સર્જનતરીકો અરૂઢ અને અપૂર્વ ભાસ્યો. મારા મનમાં તો એમની એક સમ્પ્રક્તા સર્જક તરીકેની છબિ પહેલેથી દૃઢ થયેલી છે. માં માનવું રહ્યું છે કે સમ્પ્રક્તા એમનામાં સંશયથી પ્રગતી છે. સંશય મનુષ્યજીવન વિશે તેમ ભાષા વિશે. સંશય કાવ્ય સરજી આપતી ભાષા વિશે સવિશેષ. એટલે નિરંતર એમની સર્જકચેતના

માધ્યમસભાન રહી. સભાનથી ય સભાન થયા કરી. એટલે લગ્ની કે કવિ એથી કદી યે છૂટી શક્યા નહીં. કહો કે એથી મળતાં પરિણામોને એમજો કાવ્યો ગણ્યાં. પછી તો એ જ એમનો માર્કો બની ગયો. એ જ એમને નોખા દર્શાવનારી ઓળખ બની રહી. લાભશંકરના કાવ્યપુસ્તકથને પામવાની શરત પણ એ જ બની રહી. આટલાં વરસે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે જો એ શરતને વશ થઈ શકાય તો લાભશંકર તમારા કવિ; બાકી, બીજા બધાના; કે પછી કોઈનાય નહીં... મારે ઉમેરવું જોઈએ કે લાભશંકરમાં છે એવું સમ્મજ નોખાપણું મને આધુનિક કલાઓના સર્જનમાં જરૂરી લાગ્યું છે. વળી, એમના જેવા સંશયગ્રસ્ત નિજત્વને હું કલાકારમાત્રની વ્યક્તિત્વાનું આગવું રસાયન ગણ્યું છું. તેમછતાં, રીપીટ, તેમછતાં, હું એમ પણ માનું છું કે એ જ આગવાં કારણોસર હવે લાભશંકર સમા કવિઓને કશી અનુઆધુનિક દૃષ્ટિમતિથી જોવા-તપાસવાને મોંડું થઈ રહ્યું છે. આ રચનાનું મારું આ વાચન એ વાતનું પણ એક આંદું નિર્દર્શન છે... અસ્તુ.

18





## ૩૦. ‘હેઈસો હેઈસો’ : એક આસ્વાદ !

યજોશ દવે

### હેઈસો.... હેઈસો

દરિયાકંઠે બેઠો છું હેઈસો હેઈસો  
દર્ભઘાસના અગ્રભાગ પર હેઈસો હેઈસો  
જળનું ટીપું ઊંચક્યું છે હેઈસો હેઈસો  
દરિયાને ઉલેચ્યું છું હેઈસો હેઈસો  
અ-વિરતને ઉલેચ્યું છું હેઈસો હેઈસો

૧૮

અવિરતના કાંઠે બેસીને ઉલેચો ઉલેચો  
ટીપે ટીપે દર્ભઅણીથી ઉલેચો ઉલેચો  
પિતૃકુલને ઉલેચો  
માતૃકુલને ઉલેચો  
મત્સ્યમૂલને ઉલેચો  
જ્ઞાનકોશને ઉલેચો  
ચિત્તકોશને ઉલેચો  
રક્તકોશને ઉલેચો  
શાબ્દકોશને ઉલેચો  
ઉલેચવાની ઈચ્છાને પણ ઉલેચો  
ઈચ્છા ‘જને’ થાય ‘એને’ ઉલેચો  
કોણ કોને ઉલેચે છે એની બ્રમજા થાય : તોપણ ઉલેચો  
કર્મકાડ છે ઉલેચો  
દર્ભઅણીથી બેઠા બેઠા દરિયો આખો ઉલેચો

અભિજ્ઞાન-ની તીક્ષ્ણ અણીથી ઉલેચો  
 કુશાગ છે બુદ્ધિની તીજી ટોચ તે-થી ઉલેચો  
 સભાનતાની ગર્ભશૂલને ઉલેચો  
 ભગીરથોના આન્ત ગર્ભનાં કુલ બધાંયે ઉલેચો  
 સભાનતાથી સભાનતાને ઉલેચો  
 જીવન દરિયા-ખેડ માટે ઉલેચો  
 ‘એ’થી માંડી ‘હેડ’ આખું ઉલેચો  
 ઉલેચતા આવ્યા છો માટે ઉલેચો  
 બીજું શું છે કામ ? માટે ઉલેચો  
 કર્તાખીન તમામ, માટે ઉલેચો  
 તમે સતત પરિણામ, માટે ઉલેચો  
 કારણની ના જાણ, માટે ઉલેચો  
 સભાનતાથી ઉલેચો કે અભાનતાથી ઉલેચો  
 ખાતાં ખાતાં ગાતાં ગાતાં નાતાં નાતાં ઉલેચો  
 સંત બનીને ઉલેચો કે જંત બનીને ઉલેચો  
 રમણી સાથે નમણી સાથે ઉલેચો  
 ઉલેચવાનું ભૂલી જઈને ઉલેચો  
 ઠવિલ-ફિલિનાં આળ સાથે ઉલેચો  
 રામ નામની નાળ સાથે ઉલેચો  
 ઓળઘોળ અંઘોળ અવિરત ઉલેચો  
 ગોળ ગોળ ને ગોળ અવિરત ઉલેચો  
 ભમે ભમરડો ઘૂમ ત્યાં લગ ઉલેચો  
 ગતિ થાય ના ગુમ ત્યાં લગ ઉલેચો  
 ઢળી પડો થઈ ધૂળ ત્યાં લગ ઉલેચો  
 મોત લગણનું મૂળ મળશો ઉલેચો  
 ઉલેચો રે ઉલેચો રે ઉલેચો  
 દરિયો થાશો ઝૂલ આખો ઉલેચો  
 ઉલેચો રે ઉલેચા રે ઉલેચો.

‘હેઈસો’ ‘હેઈસો’ના અવાજો હવે તો ભૂતકાળ બની ગયાં. એક કાળે મોટાં વહાણો હલેસાંથી ચાલતાં ત્યારે બને તરફની હારનાં હવેસાં મારનારાઓને પાનો ચડાવવા તેમનો લય જાળવવા ‘જોર લગા કે હેઈસા’ કે ‘હેઈસો હેઈસો’ જેવી હવામણી બોલાતી. સામૂહિક મહેનતથી કોઈ ભારે સામાન ખેડેડતી વખતે પણ આ ‘હેઈસો’ પાનો ચડાવતું, પણ અહીં તો કોઈ સમૂહ નથી. કવિ એકલાં છે અને ‘Self Suggestion’થી કવિ પોતાને જ પાનો ચડાવી રહ્યા છે – દરિયો ખેડવા કે હંકારવા નહીં પણ દરિયો ઉલેચવા બેઠા છે. પણ કેવી રીતે ? કવિ તો તૃણની ટોચથી ટીપે ટીપે દરિયો ઉલેચવા બેઠા. ટિટોડીનાં ઢેડાં ચોરી ગયેલ સમુદ્ર પર રોષે ભરાઈ ચાંચેથી એક એક કણ કંકરી લઈ સમુદ્ર બૂરતી ટિટોડી યાદ આવી ગઈ. ગળા સુધી આવી ગયેલી, જીવ પર આવી ગયેલી વ્યક્ત શું ન કરે !

‘ઉંડો કૂવો ને કાણી ડોલ’ જેમ લઘરો થાક્કો છે કાણી ડોલ તાણી તાણી. ટેકરી પર પથ્થર ચડાવવાના સિસિફસના યત્ન-પ્રયત્ન રોજેરોજ નિઝળ છતાં રોજ પથ્થર ચડાવવાનો, તે ગબજી નીચે આવવાનો, તેને ફરી ચડાવવાનો – નિઝળતાનું નિર્ભર્ત દર્દન થયું હોય તોપણ.

માણસને નરવો માણસ ન રહેવા દેતો આ વરવો દરિયો – ડહોળાયેલો દરિયો છે – પિતુસત્તાક પિતુકૂળ-માયાવી મરિચિક જેવું માતુકૂળ, ઉત્કાંતિના પહેલા પગથિયે રહેલું મત્સકૂળ, એકબીજામાં ગૂચચાઈ ગયેલા જ્ઞાનકોષ ચિત્તકોષ શબ્દકોષ. કેન્સરની ગાંડ જેવી વકરતી જાતજાતની ગ્રંથિઓ, સાચી-ખોટી વ્યાખ્યાઓ, માણસને તોલવાનાં જુદાં જુદાં ગ્રાજવાંઓ – આ દરિયો તેનાથી ભરિયો.

આમ તો છે એ એકાલાપ-પ્રલાપ. પોતાની એક જાત પોતાની જ બીજી જાતને કહે તેવું. એક રીતે આ છે અર્હનિશ ચાલતું આત્મભનન. અંદર જે ભરાઈને પડયું છે તેને ઉલેચવાની વાત – જેમ પ્રવાહણામાં અંદર ગંઠાઈને જે પડેલું તેને કોમોડ પર બેઠાં બેઠાં કરાંજતા કરાંજતા ઉત્સર્ગ કરવાની વાત પણ આ જ.

વહાણમાંથી છિદ્ર પાડી દરિયો વહાણમાં આવવા લાગ્યો છે સતત. એને તો ઉલેચવો જ રહ્યો – નહીંતર બેડલીને બુડાડી દેશો. ધર્મબર્મ અગાડમું બગાડમું, બાંધી રાખતા. કર્મકંડ – જેમાંથી સર્જાય છે અનેક કંડ – તેને ઉલેચી ફેંકી દો. ઉત્કાંત થઈ આપણે *Homo sapien* – Thinking man – વિચારપુરુષ બન્યા ધીએ તો એ બુદ્ધિને ખપમાં લઈ વાસ્તવ લાગતી આ રજજુસર્પ ભાંતિને ઉલેચો. કુળમૂળ બધું. ગંગાસતી કહે છે તેમ જાતિવિજાતિ એ પણ ભાંતિ. સત્ત-અસત્ત ઈવિલ-ફિવિલ બધું ભાંતિ. રામ સાથે નામ સાથે ગામ સાથે પરધામ સાથે જોડાયેલી નાળ એ પણ ભાંતિ. ઉલેચવાની ઈચ્છા ધરાવનાર જે છે – એ સભાનજાતને – પણ નિર્મમતાથી ઉલેચો. ઉલેચવાનું સાચું કારણ પણ ભૂલી જવાય એ રીતે ઉલેચો. ઉલેચવાનું જે છે તે ઉલેચાઈ રહ્યું છે કે નહીં તેવું ભાન ખોઈ બેસી માત્ર યંત્રવત્ત ઉલેચો. કશોક વળગાડ વળગી ગયો હોય તેમ નાચતાં-નાચતાં ભમરડાની જેમ ફેરફુદરી ફરતાં પોતાના ગતિના કેન્દ્રમાં

સ્થિર થઈ નાચતાં-નાચતાં જ થાકીને ઢગલો થઈ જવ ત્યાં સુધી ઉલેચો.

લાંડાં કહેશે શબ્દની ડોલ કાળી.. તેમ અર્થનીય કાળી. ઉલેચો. ઉલેચ્યા જ રાખો. ભૂકૃષ્ટિ  
તંગ કરી રોષપૂર્વક લાંડાં મને કહે “આ શું માંડયું છે ? મેં કૃયાં આવા અર્થમાં લખ્યું છે ?  
આસ્વાદના. નામે ડિંડકમાં તારા ઘરનું તેં ક્યાંથી ઘાલ્યું ? પહેલાં કવિતાપદાર્થનો સ્વાદ લે -  
ચોષ્ય પદાર્થની જેમ ધીમે ધીમે તેનો રસ અંદર ઉતાર ને પછી આસ્વાદ-ઝાસ્વાદનાં લફરાંમાં  
પડ. મારી કવિતા અને તેના ભાવક વચ્ચે તારી દરમિયાનગીરી નહીં ચલાવી લઉં. ભ્યાન કરી  
બેસી જા. જોકે લાંડાંમાં રહેલો બીજો લાંડાં તો ખુશ જ થશે ને કહેશો “યજ્ઞશ, આ જ  
તો છે કવિતાની મજા. હું કશુંક એક ધારું તમે કશું બીજું. આમ કવિતા એ નિશ્ચયતાની,  
અંતિમતાની દાસી ન બની રહે પણ શક્યતા, સંભાવના ધારણા તરીકે મુક્ત રહે. જૈન સ્યાદ્વાદની  
જેમ મેં લખ્યું તે સાચું, તને જે દેખાયું તે સાચું ને બીજાને જે દેખાશો તે પણ સાચું.





## ૩૧. ‘...આવે છે અવાજ અંદરથી, કલ્પો...’

શિવાસ પટેલયા

### એમ કલ્પો

મૂળિયાં શોધું તો  
તળિયાં તૂટે છે –  
અભિન્ન અવાજનાં, એમ કલ્પો.  
આ શોધાયન –  
કલ્પાયન –  
રામાયણના  
સ્બાહિત અવાજને કલ્પો.  
સાંભળવા ઉત્સુક બેબાકળી  
લયસ્તબ્ધતાને કલ્પો.  
રણકયો છે, કલ્પો.  
રણકીને અટકયો નથી, કલ્પો.  
અટકીને રણકશો,  
કલ્પો.  
હા, સંભળાય છે તેમ કલ્પો.  
આવે છે અવાજ અંદરથી, કલ્પો.

૧૧-૬-૧૯૯૮ (યુ.એસ.એ.)

**લાભશંકરના આ કાવ્યનું શીર્ષક છે – ‘એમ કલ્પો’ ! એમ એટલે કેમ, એનો જવાબ કાવ્યમાં છે. કાવ્યનું પઠન કરતાં કરતાં સમજાય છે કે ‘એમ કલ્પો’ એવું કવિ કહે છે ત્યારે એક ભાવકલેખે આપણે શું કરવાનું છે. આરંભથી જ કવિએ ભાવકને પોતાની સાથે જ સાંકળ્યો**

છે. કાવ્યના ઉઘાડમાં જ શોધયાત્રાનો સંદર્ભ પ્રત્યક્ષ થાય છે. ‘મૂળિયાં શોધું તો’ એમ કહેતાવેંત જ કવિ ઉચ્ચારે છે ‘તળિયાં તૂટે છે –’ શોધવાની પ્રક્રિયા સાથે જ તૂટવાની વાત પણ જોડાતી આવે છે. અસ્તિત્વનાં મૂળિયાં શોધવાની મથામણ કંઈ જેવાતેવી હોતી નથી. જગ્બાર વેદનશીલ માનવની જ આ નિયતિ હોય છે. સરેરાશ માનવીને માટે આવી કશી જ પળોજણ હોતી નથી. મૂળિયાં શોધવાનો જે સંદર્ભ છે એનોય અર્થ કંઈ સીમિત નથી. કુળ-વંશ કે પેઢી આદિની શોધ માણસ કરે અને પોતાની પરંપરાના પાતળ લગી પહોંચવા મથે એ એક બાબત છે, કદાચ એ એટલી અશક્યવત્ત નથી. એની જાણકારી મળેય ખરી પરંતુ પોતાના હોવાપણાના, ભીતરી લોકના અંધારાના અને આઘાતપ્રત્યાઘાત કે સંઘાતના પ્રભાવનાં મૂળિયાં ક્યાં છે, એ કંઈ રીતે કામ કરે છે અને એના કારણે માનવ-માનવ વર્ચ્યેના સંબંધોનાં કેવાં રૂપો હોય છે એ શોધવું-જાણવું-માણસવું અગત્યનું હોય છે. માટે જ એ પ્રક્રિયા દુર્દીત છે, તેથી તો કવિ તળિયાં તૂટે છે, એવી વાત તરત કરે છે. એ તૂટે છે. એનો અભિન્ન અવાજ છે. આમ થાય જ છે. થશે જ. મૂળિયાં શોધીએ તો તળિયાં લગી જવું પડે. ત્યાં લગી જતાં જતાં હંસી જવાય. તળિયાં તૂટે છે – એમ કવિ કહે છે ને વળી એ તૂટવાના અવાજને કલ્યો, એમ પણ કહે છે. મતલબ કે આ એક એવી પ્રક્રિયા છે, જે બનશે, એ પહેલાં તમે ‘એમ કલ્યો’ !

પછીની પંક્તિ બે-બે શબ્દોની છે.

### ‘આ શોધાયન –’ ‘કલ્યાયન’

આ બંને શબ્દો પ્રક્રિયાસૂચક છે. શોધની ડિયામાં શોધાયન છે. એ શોધમાંથી કલ્યાયન છે એટલે કે એમ યા આમ કલ્યો ! તેથી સમાંતરે કલ્યાનાવ્યાપાર પણ સક્રિય છે જ ને હોવો જ જોઈએ, તો જ પેલી શોધ વધારે જીવંત અને બલવત્તર બની રહે. આ એક પ્રક્રિયા થઈ. એના સંદર્ભમાં જ કવિ ભાવકની ચેતનાને વિશેષ સતેજ કરતાં કહે છે : ‘રામાયણના / સ્બાહિત અવાજને કલ્યો.’ / મૂળિયાં શોધવાની અને તળિયાં તૂટવાની, વાત ચાલતી હતી, ત્યાં રામાયણના સ્બાહિત અવાજને કલ્યાનાની વાત ક્યાંથી આવી ગઈ, એમ પ્રથમ દસ્તિએ આપણને સહજ જ થાય, પરંતુ કવિ રામાયણનો સંદર્ભ લઈ આવે છે, તો એનો કશોક તો અર્થ હો જ ને ! એમ જ શોખ ખાતર, એક શબ્દ જોડી દીધો, એવું તો ના જ બને ! વળી કવિએ પ્રારંભથી જ ભાવકનેય સાથે લીધો છે, એટલે સ્બાહિત અવાજને, પણ કયા અવાજને ? તો ‘રામાયણના’ ! એને કલ્યો, એમ કવિ આપણને કહે છે. ભાવકની અહીં કસોટીય છે ને મજાય છે. એકદમ જ થંભી જવું પડે છે. વિચારકણ પ્રજજવલિત થાય છે. એમાં ચેતના ભણે છે ને ભાવકનો ચેતોવિસ્તાર થાય છે. રામાયણ, જેનાથી આપણું મન અને બુદ્ધિ પરિચિત છે, એના પાત્રો, ઘટનાઓ ને સ્વથી તાદૃશ થાય છે. એના સ્બાહિત અવાજ સંભળાય છે, આમ કલીએ ત્યાં તો એ અવાજ સંભળવા શરૂ થઈ જ જાય છે.

હવે સંભળવાની પ્રક્રિયા !

‘સાંભળવા ઉત્સુક બેબાકળી / લયસ્તબ્ધતાને કલ્પો.’

સાંભળવા ઉત્સુક ને વળી પાછી બેબાકળી... જાણો કોઈ સજ્જવપાત્રની પરિપક્તયના અહીં સાકાર થઈ છે. આ ઉત્સુક કોણ છે ? આપણે એની કલ્પના કરવાની છે – એ છે ‘લયસ્તબ્ધતા’ ! અદ્ભુત શબ્દ છે આ ! આભિજ્ઞ અવાજ, સમલિત અવાજ આપણે કલ્પી લીધો છે ને એ સંભળાતોય રહ્યો છે. એ અવાજનું આવર્તન રોમાંચક લીલા રચે છે ને એક સુંદર લયસ્તબ્ધતા જામે છે. એ લય આપણી ચેતનામાં ધૂંટાતો જાય છે. ધૂંટાતો રહે છે.

ફરી કવિ આપણાને અવાજની દુનિયામાં લઈ જાય છે. એ અવાજ લય રચે છે. સ્તબ્ધતા ઘડે છે. એ કોલાહલ નથી જન્માવતો. એ રણકતો રહે છે ને લયબદ્ધ થતો રહે છે માટે કવિ કહે છે :

‘રણકયો છે, કલ્પો.  
રણકીને અટક્યો નથી કલ્પો  
અટકીને રણકરો,  
કલ્પો.’

સુંદરતમ અનુભૂતિના અહીં ત્રણ પડાવો છે. એ ત્રણેયમાં સતત કલ્પના કર્યા કરવાની વાત છે. કવિની સંવેદનાનાં અહીં ત્રણ રૂપો પણ છે. ધૈર્યની કસોટી છે ને એની જ તો મજા છે. અવાજ સાથે તદ્વાપ થવાનો કવિનો અનુરોધ પણ છે. કવિનો નાટ્યાત્મક સૂર પણ અહીં છે. ‘રણકયો છે...’ એમ કવિ કહે છે એમાં સરચાઈનો રણકો છે કે અવાજ રણકયો છે એમ કલ્પો, કલ્પના કરશો કે તરત એની પ્રતીતિ થવાની જ છે. તરત કવિ કહે છે કે રણકયો છે ને રણકીને એ નથી કંઈ થંભી ગયો, તમે એની કલ્પના કરતાં કરતાં માણતા રહો એને, કેમ કે એ અટક્યો નથી, અટકીને એ તો રણકરોજ, માટે જ એ અટક્યો નથી. એનું ગુંજન અનુગુંજન ચાલુ જ છે.

આટલી માંડીને વાત કર્યા પછી કવિ કહે છે :

‘હા, સંભળાય છે તેમ કલ્પો.  
આવે છે અવાજ અંદરથી, કલ્પો.’

‘હા’ એ એકાક્ષરી કાંકુ પણ કેટલો બધો અર્થદોત્ક છે ! કવિનું વિધાયક વલાણ એ ‘હા’માં જામ્યું છે. એ અવાજ સંભળાય જ છે એમ સતત કવિ કહે છે ને આમ થાય જ છે, થતું જ રહે છે, એવું કલ્પો એમ કહેતા રહે છે. કાવ્યની અંતિમ પંક્તિ અર્થગંભીર છે : ‘આવે છે અવાજ અંદરથી, કલ્પો.’ જે અવાજ છે એ અંદરથી આવે છે. આ અંદરનો સંદર્ભ આ કાવ્યને નવું જ પરિમાણ આપે છે. અંદરના, મનના એક સંકુલ રામાયણના એ અવાજ છે, એ સંભળતા રહે છે. એ સાંભળવાની અને એને સમજવાની મજા છે. એટલે જ ‘એમ કલ્પો’ એ પ્રક્રિયામાં સંડોવાનીય જબરી મજા પડે છે.

કાવ્ય લઘુ છે, પરંતુ પરમ આસ્વાદ્ય છે. પ્રારંભથી જ ભાવકની ચેતનાને ચેતનવંતી બનાવી દે છે. સાત વાર ‘કલ્પો’ શબ્દ આવે છે. આ આવર્તન પણ કાવ્યમાં લય તો જન્માવે જ છે સાથે સાથે ભાવકને સતત સાબદો રાખે છે કે તારે તારા અંદરના અવાજને સાંભળવો છે તો આમ કર ! ‘મૂળિથાં’ ‘તાળિથાં’ ‘શોધાયન’ ‘કલ્પાયન’ ‘શમાયણામાં’ ‘થાં’ ‘થન’નું આવર્તન આ શબ્દોમાં છે. આને કારણે લયાન્વિત પંક્તિ આનંદજન્ય બની રહી છે. ‘રણકલ્પો’ ‘રણકીને’ ‘અટકીને’ આ શબ્દો પણ કર્ષણમંજુલ બન્યા છે ને એના વડે પણ લયસ્તબ્ધતા જન્મી છે જે પ્રસન્ન કરી દે છે.

આખાય કાવ્યમાંથી સંવેદનભીની નાટ્યાત્મકતા જન્મે છે. એ જુદા જુદા કાદુઓય રચે છે, જેમ કે ‘એમ કલ્પો’ ‘કલ્પો’ વારેવારે આવે છે, તો દરેક વેળા જુદા સૂર ને જુદી ભાવસ્થિતિ હોય છે. સરવા કાને એ સાંભળીએ તો જ એને પામી શકીએ ને એમ એની મજા લઈ શકીએ. આ લઘુકાવ્યમાં આમ ભાવક તરીકે તદ્વૂપ થતાં સાચે જ આનંદલયમાં હૈયું લય પામ્યું, સલામ લાડા !

—18—





## ડર. વીભાવેલું દ્રુતપદ

રમણીક સોમેશ્વર

### આપણે પ્રવાસી પારાવારના

આપણે પ્રવાસી પારાવારના

ઠેબાતા પછિડતા

આપણે પ્રવાસી પારાવારના.

અકબંધ કોચલા જેવા

કહોવાયેલા

આપણે પ્રવાસી પારાવારના.

અટકાતા

બટકાતા

સંધાતા સમૂહોમાં

પરસ્પરથી સૂંઘાતા

આપણે પ્રવાસી પારાવારના.

અભા વગરના હાથ વગરના પગ વગરના

પાઇળથી ધક્કાતા

અતીતાતા

આપણે પ્રવાસી પારાવારના

ઉચ્ચારાતા - સંભળાવાતા - સંગ્રહાતા

ભૂસાતા - ભુલાઈ જવાતા - ઉકેલાતા

આપણે પ્રવાસી પારાવારના.

સંતોના - ભંદંતોના - હંતોના - મહંતોના

મનોમાં મનોવાતા  
પંથાતા

આપણે પ્રવાસી પારાવારના.

આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા  
વિદેશાતા  
વેશાતા  
કાબ્યપુરુષની કિચૂડ કિચૂડ નીકમાં  
દિગમ્બરાતા  
ભાષાતા  
આપણે પ્રવાસી પારાવારના.

૧૭-૬-૧૯૯૮

એક તરફ આ બળબળતા ઉનાળાનો તાપ અને બીજી તરફ વલખાં મારી જીવે જતા માશસનો સંતાપ એ બેની વચ્ચે ભીસાતો હું બેઠો હું આ કાબ્ય લઈને.

જેમની કવિચેતના અક્ષરમેળ-માત્રામેળ છીએ; મધ્યકાલીન દેશીઓ, લયભરી લોકવાણી કે ગીતોમાં ગુજરી લયધારાને આત્મસાત્ર કરવા હેઠાં તન્મય રહી છે એવા કવિ લાભશાંકર ઢાકરની આ રચના છે. ગીત તો ગાઈને જ વંચાય એવું કહેનારા અને મીઠા હલકથી ગીતોનો ગુંજારવ કરી લેનારા આ કવિ એક સ્થળે પોતાની કેદ્ધિયત આપતાં કહે છે :

‘જીવનલય અને શબ્દલય અભિનન લાયા છે. તારુણ્યના કોઈ તબક્કે આછો આછો વિરોધ અને કમશઃ ઉત્કટ સંઘર્ષ આરંભાય. આંતરયુદ્ધ જીવનલય અને યુગપદ્ધ શબ્દલયનું જેવાય, સર્જકના અંતઃશ્રુતિપટ પર. અછાંદસ-અલયાંદસ કે નર્યા ગદ્યકાબ્યનો આવિજ્ઞાર ઉત્કત ધમસાણનો સંકેત છે.’

(‘સોનેરી ચુંબન’ પૃ. ૧૦૦)

હા, તો આપણે અત્યારે જે કાબ્યની વાત કરી રહ્યા છીએ તે પણ કવિના અંતઃશ્રુતિપટ પર જેલાતા જીવનલય અને શબ્દલયના આંતરયુદ્ધના સંકેતો લઈને આવે છે, એક એક પંક્તિ ખોલતા જઈ રસચર્વણા કરવાનું આ કાબ્ય નથી, પણ પદે પદે પ્રવાસ કરી આપ ઓળખની મથામણ કરવાની આ કવિતા છે.

પહેલી જ પંક્તિ વાંચીએ ત્યાં આપણી સ્મૃતિ આપજાને લઈ જાય કવિ શ્રી બાલમુકુન્દ દવેના જાડીતા ગીત તરફ -

“આપણે પ્રવાસી પારાવારના હે... જી”

કવિ લાંડાંએ મંદ સ્વરે આ ગીત ગાવાનું આરંભ્યું હશે, પણ ‘હે...જી’ની હલક કંઈ સુધી પહોંચે તે પહેલાં જ અંદરના કોઈ ઘમસાણે કવિને રોકી લીધા હશે અને આરંભાયો હશે આમ એક જુદી દિશાનો પ્રવાસ.

પૂર્વસ્થુરિઓની લયચેતના પાસે થોખવું અને પછી ફૂટાઈ જવું, સજાગ રહીને એ કવિ લાભશંકરની કાવ્યરીતિનો એક વિશેષ છે. મને યાદ આવે છે નરસીહની આ પંક્તિઓ :

‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર  
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે’

એ ગાતાં ગાતાં કવિ લાંડાં કહી ઉઠે છે :

‘પિચ્છધર  
ક્યાંશી રે આવે ને પિવડાવે પ્રેમરસ ?  
કામદીનુંથો  
ભાંભરતી ભાંભરતી ભાષામાં  
તારી મારી  
બહેરાશોને ચાટે છે.’ (‘આઈ ડોન્ટ નો, સર’)

તો, આપણે બહેરાશોને ચાટતી કામદીનુંનો હંભારવ અહીં પણ સંભળાય છે.

‘આપણે પ્રવાસી પારાવારના’...

હમણાં જ જાણે આકાશ હાથવગું થઈ જશે એવી ધૂનમાં આપણે આ પંક્તિ લયબદ્ધ વાંચવા કે ગાવા લાગીએ એટલામાં કવિ સટાકું દઈને ભમનું જણું તોડી નાખે છે :

‘ઠેલાતા પછિડાતા’

અડવડિયું ખાઈ જઈએ છીએ આપણે વાંચતાં વાંચતાં. પ્રારંભે જ લયભંગ દ્વારા મોહભંગ. જીવનના વીભરાવને દર્શાવતું વિભેરાઈ જાય છે આખું ધ્રુવપદ – કવિતાનું.

અહીં કવિતાની જે આકૃતિ રચાય છે તે પણ રસપદ છે. ગીતના મુખડાની જેમ ‘આપણે પ્રવાસી પારાવારના’ એ પંક્તિ પુનરાવર્તિત થતી રહે. અને પછી ખોડંગાતી કિયાઓ દર્શાવતાં વર્તમાન કૃદંતો આવતાં રહે. ધીમે ધીમે કૃદંતોમાં ભરતી આવે અને ધ્રુવપંક્તિ દૂર ઠેલાતી જાય. વળી, અતીતાતા, મનોવાતા, પંથતા, દેશાતા, વિદેશાતા, જેવા કૃદંત-ગ્રયોગો સાથે ભાષાનું પોત પણ પલોટાતું અનુભવાય.

માણસ પ્રવાસી તો ખરો પણ જીવન-પારાવારની અંટીવૂંટીઓ અપાર. અજાખૂટ વાંગણી દીર્ઘાઓ લઈ ઠેલાં ખાતાં ભક્ત્યા કરવાનું અને રટતા રહેવાનું :

‘આપણે પ્રવાસી પારાવારના’

એક તરફ લહેરાતો સાગર અને બીજી તરફ આપણે તો –

‘અકુલંધ કોચલા જેવા

કહોવાયેલા’

વહે તે વિશુદ્ધ રહે અને સ્થગિત થાય તે ગંધાય. વિરોધાભાસ વચ્ચેનું આ છે વાસ્તવદર્શન. સુશોને વધુ શું કહેવું ! અહીં નર્મદ યાદ આવી જાય :

‘ઝટ ઝડોળી નાખો રે મનજળ થંબ થયેલું’

આ થંભી ગયેલું મનજળ, કોહવાટભરી મનુષ્યચેતના એ કવિની ચિંતા છે. જીવનનો લય જ્યાં લપટે પડી જાય ત્યાં કવિતાનો લય કઈ રીતે સ્થિર થઈ શકે ? આમ જીવન અને કવિતાના તૂટા લયના સંદર્ભો આ કાવ્યમાં જોવા જેવા છે.

લાઠાં કહે છે કે, “માણસનું જીવન અતિ કરુણ અને અતિ હાસ્યજનક છે.” અપાર જિજ્ઞાસા અને જાણવા-પામવાની અપરિમેય ઈચ્છા હોવા છતાં માણસ નથી પામી શકતો પોતાને કે નથી પામી શકતો પોતાના વ્યાપ્ત સંદર્ભોને. આ કરુણ વિસંગતિ એની નિયતિ છે. માનવસમુદ્દાયો રચાય છે, પણ કેવા ?

‘અટકાતા / બટકાતા / સંધાતા સમૂહોમાં / પરસ્યરથી સુંઘાતા’

બધું જ કૃતક. માપી માપીને, કુંકી કુંકીને, સૂંઘી સૂંઘીને રચાતા લટકણા માનવસંબંધો.

અનંતને આરે નાંગરવા ખાબકવાનું છે પારાવારમાં, પણ વિવશતા જુઓ, આ પ્રવાસીઓ તો છે –

‘ખભા વગરના હાથ વગરના પગ વગરના

પાછળથી ધક્કાતા

અતીતપત્રા’

આ વાંચ્યતાં વાંચ્યતાં કવિના દીર્ઘકાવ્ય ‘માણસની વાત’ની થોડી પંક્તિઓ યાદ આવી જાય છે. કહું :

‘...હવે હું જાણી ગયો છું

કે મારે

હાથ હોવા છતાં હાથ નથી

પગ હોવા છતાં પગ નથી

વાચા હોવા છતાં વાચા નથી..’

આધારો છે પણ કામના નથી. આમ હાથ-પગ-ખભા વગરનો માણસ ધક્કેલાતો, હડસેલાતો અવશ આગળ વધતો જાય છે – (પ્રવાસની આ કેવી પ્રતારણ !) અને ઓગળતો જાય છે પાછળ અતીતમાં. અને પછી –

‘ઉચ્ચારાતા – સંભળાવાતા – સંગ્રહાવાતા

ભૂસાતા – ભુલાઈ જવાતા – ઉકેવાતા’

(ધમણના લયમાં હંસી જવાય આટબું વાંચતાં) – આમ અટવાતા અને ઉખાણાંની જેમ ઉકેવાતા માણસો – ગુંગળાતું ને ગુંચવાતું માનવ-સંવેદન આપણી સામે પ્રત્યક્ષ થતું રહે છે.

કવિના સ્વભાવોકમાં તો છે આંડ મનુષ્ય. આજે આખો સુવાંગ માણસ. માણસનું મન એ કવિને મન તો છે વૈશ્વિક મન. એક નિબંધમાં તેઓ આગવી અદામાં કહે છે :

‘...મહાત્મા લાંઠાંજી કહે છે : મનને વાંચો. રસપૂર્વક, લગનથી વાંચો. આમ વાંચવાથી તેનું શોધન થશે.’ (‘મુંજારો...’ પૃ. ૧૨૮)

તો, મન અને મનધારી મનુષ્યના શોધનની આ કવિતા છે. અહીં ‘મનોવાતા’ શબ્દ મુકાયો છે અને તે દ્વારા આપણોણખ ગુમાવી બંદિત થતા જતા મન અને મનુષ્યની વાત કહેવાઈ છે.

‘સંતોના – ભંદ્તોના – હંતોના – મહંતોના  
મનમાં મનોવાતા / પંથાત્’

કેવી કેવી ચુસ્ત જીવનરોધક દીવાલો આમ રચાતી રહે છે અને એમાં વહેંચાતો અને વહેરાતો રહે છે માણસ ! આમ પંથાતો અને પોતાના ખરા પંથથી ભટકી જતો માણસ અહીં દર્શાવાયો છે.

ફરી કવિ બાલમુકુન્દને યાદ કરી આપણા કવિ કહે છે :

‘આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા...’

કેવો મોટો વિરોધાભાસ ! વર્તમાન સંદર્ભોમાં એ આપણી સામે વધુ ઘણ થતો જાય છે. દેશના અને તેથી વિદેશના, વેશના અને ગણવેશના અનેકવિધ બાદ સીમાડાઓમાં માણસ વધુ ને વધુ અટવાતો જાય છે. પણ, કવિતા એટલે તો સીમોલ્લંઘન.

જુઓ, આવું વિપન્ન વાસ્તવદર્શન કરાવતાં કરાવતાં કવિ આપણને લઈ જાય છે એક એવા પ્રદેશમાં જ્યાં સંપ્રદાય – સંસ્કૃતિ – દેશ-વેશના બધા જ કૃતક વાદ્ય ઉતારી નિર્વચન થઈ શકાય – પરિશુદ્ધ થઈ શકાય.

‘કાવ્યપુરુષની કિચૂડ કિચૂડ નીકમાં  
દ્વિગ્યભારતા  
ભાષાતા  
આપણે પ્રવાસી પારવારના’

આભાસી વસ્ત્રોનું સરી જું, નિર્વસન થવું એટલે નવો જન્મ પામવો. દિશાઓના અંબર ઓઢી દરો દિશામાં વિસ્તરવાની, નવી ભાષા દ્વારા નવોનેષની આ છે અનોખી કવિતા.

‘કાવ્યપુરુષ’ની વાત લાંઠાંની કવિતામાં જુદી જુદી રીતે આવતી રહે છે. કાવ્યપુરુષ –

કવિ - સરસ્વતીનો પુત્ર. આલંકારિકોએ કાવ્યપુરુષને ‘સાલંકાર ધન્ય’ કહ્યો છે. કવચ-કુંડળ સાથે જન્મેલા કર્ણની જેમ કાવ્યપુરુષ પણ અલંકારોની સાથે જ જન્મ્યો છે. એટલે કે એને કોઈ બાધ્ય અલંકારોથી વિભૂષિત થવાની જરૂર નથી. કાવ્યપુરુષનું હોવું એ જ એની અલંકૃતિ. વળી, કાવ્યપુરુષની ઉત્પત્તિ સંદર્ભે રાજ્યોખરે એવું કહ્યું છે કે બ્રહ્માના વરદાનથી સરસ્વતીએ કાવ્યપુરુષને જન્મ આપ્યો અને એણે જન્મતાની સાથે જ મા સરસ્વતીના ચરણોમાં વંદન કરીને છંદોબદ્ધ વાણીમાં કહ્યું : “હે માતા, આ સમગ્ર વાક્યમય વિશ્વ જેના દ્વારા અર્થના વિવિધ રૂપો ધારણ કરે છે તે હું કાવ્યપુરુષ તારા ચરણોમાં વંદન કરું છું.” તો, આમ જે નિરર્થક જીવનને પણ નવા નવા અર્થો આપે છે તે કાવ્યપુરુષ છે.

કાટ અને કોહવાટના રુગ્ણ કિચૂડાટોને વળોટી, કાવ્યપુરુષની ખળખળ વહેતી કિચૂડ કિચૂડ નીકમાં લઈ જઈને અવશ્યુદ્ધ મનુષ્યચેતનાને કવિતા દ્વારા અસીમમાં પુનઃસ્થાપિત કરતી આ કવિતા ખોવાયેલા ધ્રુવપદનું અનુસંધાન રચતી કવિતા છે.

18





તૃતી. ‘સિસિફસની સંગી’ :

‘દરજણા’ કવિતા

પરેશ નાયક

### બટકણી ભાષાના ધાગાથી

બટકણી ભાષાના ધાગાથી સીવતી કોટ રે  
છે શિયાળો.

નિર્વસન, વસન આશાનું પકડી  
એકાગ્ર આંખથી

દરજણા કવિતા

સીવતી કોટ રે, છે શિયાળો.

નથી માપપણી કે કાતર,  
કાનામાતરના રણકારે, કાન સહારે  
ગણગણતી,

વગર અહીની સોય લઈને કોડભરી ઉત્સુક  
સીવતી કોટ રે, છે શિયાળો.

સીવતાં સીવતાં ધાગો બટકી જાય  
પરોવતાં રે ગાંઠ વગરનો ધાગો સરકી જાય  
શતકોનાં શતકો ઊંટોનાં

સોયના કાણામાંથી

સરક સરકી જાય રે.

ખાણાથી બેઠી બેઠી, કાણાને શોધી  
મમળાવી ધાગો મૌંભાં  
ધીરજ ખંતથી પરોવવા તત્પર  
દરજણા કવિતા

સહૃદા યત્નથી સિમતભરી, સીવતી કોટ રે  
છે શિયાળો.

કંપિત અંગ-આંગળાં

લયમાં

સંકોરી કાવ્યભાન

ખંતીલી તંતીલી

વેદના વારાથી

દરજણ કવિતા

સીવતી કોટ રે, છે શિયાળો.

(‘કવિતા’માંથી, ખંડ : ૭૮)

કવિતા નામે એક દરજણ છે. પંડે નિર્વસ્ત છે. વેદકાળથી એ એક કોટ સીવી રહી છે. નિર્વસ્ત હોય તેને ઓઢાડી શકાય એ માટે.

પણ આજ લગી આ કોટની સિલાઈ પૂરી થવા પામી નથી. શિયાળો આવી પહોંચ્યો છે !

યાદના આ દિવસોમાં કોટ સીવવાનું કામ વિરોધ કપડું બન્યું છે. પણ કોટ સીવવો જરૂરી છે. કોટ સીવવા માટે દરજણ પાસે ફક્ત આશાનું વસ્ત્ર છે. એકાગ્ર નજરે દરજણ કવિતા કોટ સીવે જાય છે. ભલે શિયાળો છે !

દરજણ પાસે માપપણી નથી. કાતરેય નથી. એ તો અક્ષરોને વળગેલા કાનામાતરનો રણકાર સરવા કાને સાંભળતી જાય છે ને ગણગણતી જાય છે. કોટ સીવવાનો છે ! શિયાળો છે તો છે !

દરજણ પાસે જે સોય છે તે પણ અણી વગરની છે. પણ દરજણના અંતરમાં કોટ સીવવાના એવા તો ભારે કોડ છે ! તે એ તો વગર અણીની સોય લઈને પણ ઉત્સુકતાબેર કોટ સીવે જાય છે. શિયાળો હોય તો હોય !

કવિતા પાસે કોટ સીવવાનો જે દોરો છે તે પણ બટકણી ભાખાનો છે. એટલે સીવતાં સીવતાં વારે વારે એ ધાગો બટકી જાય છે. ધાગાને છેવાડે ગાંઢ પણ નથી. તે સોયના કાળામાં ધાગો પરોવવા જતાં એ સરકી જાય છે.

ન જેવો ધાગો સરકી જાય છે કે લાગ જોઈને સોયના કાળામાંથી સેંકડો ઊંટો પણ સરકી જાય છે. સરકી જ જાય ને !

તોય દરજણ કવિતા કોટ સીવવાનું મૂકી દેતી નથી. દિવસો લગ્ની ધીરજપૂર્વક બેસી એ સોયના કાણાને શોધી, ધાર્ગો મોંમાં બરોબર મમળાવી, વગર અણીની સોયમાં એ દોરાને પરોવવા તત્પર બને છે. ને ધાર્ગો પરોવાય છે !

સોયના કાણામાં પોતે ધાર્ગો પરોવી શકી છે એ જ કંઈ નાની સિદ્ધ છે ? એટલે કવિતા દરજણ તો પોતાના આ સહણ પ્રયાસથી હરખાઈને પુનઃ કોટ સીવવા લાગે છે. ભલે ને હોય શિયાળો !

ઠઢ વેદકાળથી આ દરજણ આમ કોટ સીવવા મથી રહી છે તે હવે તો એનાં અંગો ને અંગળા કુંપી રહ્યા છે. ને તોય એ તો પોતાના કાવ્યભાનને લયમાં સંકોરી આજેય ખંતતંતથી કોટ સીવી રહી છે. શિયાળો ભલે છે !

લાભશંકરની કવિતાનો આસ્વાદ કરવા બેસવું એ નાગી તલવાર હસ્તગત કરવા જેવું કામ છે. મૂઠથી જાલશો તો એ વધુ કરવા તત્પર થશે, ને ધાર ઉપર મૂઠ ભીડશો તો લોહીલુહાણ કરશે.

આ રચનાને લાભશંકરની એક ધારદાર પ્રતિનિધિ રચના તરીકે ઓળખાવી શકાય.

દરજણ કવિતાના સિસિફસવત્તુ પાત્રની આસપાસ ઘૂંઠાતું આ ચિત્રાત્મક કાવ્ય લાભશંકરના કાવ્યવિશ્વાનું પ્રવેશદ્વાર પણ છે.

કાવ્યનાયિકા એક નિર્વસન દરજણ છે. એ કામૂના સિસિફસના કુળની છે.

સિસિફસ પાસે પોતાના વિચારને વળગી રહેવા વિશે પ્રાબી જિદ્દ હતી. નિશ્ચયબળ હતું. એમ, આ દરજણ કવિતા પાસે આશાનું વસન છે. જે એને કોટ સીવવાના કામથી કદમ્પિ વિચલિત થવા હનાર નથી.

સિસિફસે દેવોને નારાજ કર્યા હતા. એમની સત્તાને લલકારી હતી. મૃત્યુને એણે પોતાના તાબામાં કેદ કર્યું હતું.

લાભશંકરની દરજણ, કવિતા ઉપરોંતના તમામ માનવીય પ્રાંચોને લલકારે છે. દેવોને નહીં, એ મનુષ્યમાત્રને પડકારે છે. ને એટલે જ ભરશિયાળે ‘નિર્વસન, વસન આશાનું પકડી, એકાગ્ર આંખથી... સીવતી કોટ રે.’

હોમરના સિસિફસને કામ્બૂ એંબર્ડ હીરો તરીકે જુએ છે. દેવોએ એને સજા ફરમાવી હતી. મસમોટો પથ્થરના ગોળાને પહાડની ટોચ સુધી ધકેલતા વિશે જવાની. પૂર્ણ પુરુષાર્થ અને અમાપ બળ સીંચીને સિસિફસ પથ્થરના ગોળાને પહાડની ટોચ પર પહોંચાડે છે.

જેવો સિસિફસ પોતાના આ કામમાં સહણ થાય છે કે તરત દેવો પેલા પથ્થરને ફરી તળેટીમાં વળતો ગબડાવી આપે છે. હવે સિસિફસે ફરી એક વાર તળેટીમાં ઊતરી એ પથ્થરના ગોળાને ફરી. ઉપર ચડાવવાનો છે. સિસિફસ પુનઃ તળેટી ભણી ઉત્તરાણ આદરે છે.

કામૂને સિસિફસની આ ઉત્તરાણની ઘડી સાથે નિસબત છે.

કામૂ લખે છે, ‘It is during that return, that pause, that Sisyphus interests me... that is the hour of consciousness. At each of those moments when he leaves the heights and gradually sinks towards the lairs of the gods, he is superior to his fate. He is stronger than his rock.’

જેમ આ નિશ્ચયની પળે સિસિફસ પેલા પથરના ગોળા ઉપર વિજય મેળવી લે છે, એમ લાભશંકરની દરજા કવિતા શિયાળા ઉપર જ નહીં, ભાષાની બટકણી સોય પર, ગંઠ વિનાના ધારા પર, ખુદના કંપિત અંગાંગળા પર, પ્રત્યેક વાર વધુ ને વધુ નક્કર વિજય મેળવતી રહે છે.

લાભશંકરની દરજામાં આપણને રસ પડે છે પુનઃ પુનઃ એક જ કિયાને પૂર્વવત્ત હોંશાલેર હાથ પર લેવા માટેના એના ‘ઓઝસ્ડ’ કમિટમેન્ટને કારણે.

લાભશંકરની કવિતાનું નેરેટિવ પ્રતીકાત્મક છે. તો કાવ્યનાયિકાનું ઠેઠ માનવીય ચરિત્ર નરી વાસ્તવવાદી વિગતોને સાંકળીને ચીતરાયું છે. આ પ્રકારનો રચનારીતિનો આંતરિક વિરોધ એ કવિ લાભશંકરની આગવી વિશેષતા છે.

અહીં વિરોધને આપણે contrastના અર્થમાં ચર્ચા રહ્યા છીએ.

એમની અન્ય પ્રસિદ્ધ રચનામાં ‘હોલ શાબની કાણી રે’ કહેવા સાથે તરત એ ઉમેરે છે, ‘ઉંડાં કૂવાનાં પાણી રે.’

આ કાવ્યના પ્રતીકાત્મક નેરેટિવને ઉકેલતા પહેલાં આપણે કવિ લાભશંકરની ભાષાની ચાલથી પરિચિત હોઈએ એ જરૂરી છે.



જેમ સિસિફસે આ ઉત્તરચઢ અનંતકણ લગી કરવાની છે, તેમ આ દરજા કવિતાએ પજ વારેવાર સોયના કાણામાં દોરો પરોવવા મથવાનું છે. પ્રત્યેક વાર દોરો સોયમાંથી સરી જવાનો છે. ને લાગ જોઈને સેંકડો ઉંટો એની સોયના નાકાની આરપાર સરકી જવાના છે.

પ્રત્યેક નિષ્ફળતા બાદ આ દરજા કવિતા પુનઃ: ‘કાણાને શોધી, ભમળાવી ધાગો મોંમાં ધીરજ ખંતથી પરોવવા’ તત્પર થવાની છે. આખું અંગ ને હાથનાં આંગળાં કંપી રહ્યા હશે તોપણ એ પુનઃ પુનઃ: ‘લયમાં સંકોરી કાવ્યભાન ખંતીલી તંતીલી’ કોટ સીવતી રહેવાની છે.

લાભશંકરનું કમિટમેન્ટ અસ્તિત્વ સાથે છે. માટે જેવી છે તેવી ભાષાને જ આધારે એ ભાષાની નિરર્થકતા સિદ્ધ કરવા લગાતાર મથતા રહ્યા છે. ને એમ કવિતા સિદ્ધ કરતા રહ્યા છે.

એમને મન કવિતા આથી વિશેષ કશું કરી શકતી નથી. પણ, આથી વિશેષ કરવાપણું આ જીવનમાં બીજું છે પણ નહીં એ અર્થ પણ લાભશંકરને અભિપ્રેત છે. કવિ લાભશંકરનું આ નિખાલસ કમિટમેન્ટ જ એમની કવિતાને સ્થળકાળની પેલે પાર ટકાવે છે. ટકાવશે.

કવિના જવાથી ગુજરાતી સાહિત્યનો શિયાળો વધુ ટાઢો બન્યો છે. તોય, આકરી ટાઢના આ દિવસોમાં કવિતા નામની દરજણને કોટ સીવવા માટે આશા નામનું જે વસન જોઈશે એ લાભશંકરની કાબ્યબાનીમાંથી સતત સાંપડવાનું છે એ વાતની હુંક છે !





## ૩૪. ઊંઘની વિમાસણા : મહેતાથી ઠાકર સુધી....

સમીર ભડ્ક

### ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી

ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી  
ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે, ઊંઘણશી.

તડકામાં સોનેરી રસ્તે ચહેલપહેલ ઘનઘેરી ઊંચકી  
ઉપર નીચે આગળ પાઇળ સડસડાટમાં  
તનમાં મનમાં અવળ સવળ અંધારા વનમાં  
દોડે છે હણહણતી લઈને ઈચ્છાઓ અણાઈઠી રે, ઊંઘણશી.

વાતચીત કરતા પડછાયા  
સાવ સમીપની નિત્ય પરિચિત શૈશવની અંધારસુંવાળી  
સ્પર્શિંગલી વાંકીચૂકીમાં  
બચ બચ બચ તત્પરતા અડતાં, સ્પર્શ ઉઘડતાં  
અપારદર્શક એકાંતોમાં  
ચસ ચસ ચૂસતા તગ તગ રંગ મજાઈ રે, ઊંઘણશી.

સદીઓના ઓળાઓ અમૃત  
રેબળેબ ભીડોમાં સંકુલ અર્થથાંયડે ઈતિહાસોના, ઉભડક બેસી  
કલોકઅપમાં ચોળે છે,  
અર્ધનજન ભાષાના અંગે — શેત શ્યામમાં —  
તડકાતી પીત પીઠી રે, ઊંઘણશી.

ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી  
ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે, ઊંઘણશી.

(૧)

૧ પમી સદ્ગીમાં મહેતાજીએ લખ્યું : ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં.’ અને આખો સમાજ લમણે હાથ દઈને બેસી ગયો કે આ મહેતાજ કેવા ? જેને જાગ્યા પછી ન દેખાય અને ઉંઘે ત્યારે અટપટા ભોગ ભાસ્યા કરે ! ‘અરે મહેતાજી તમે તે વળી કેવા ?’ પણ મહેતાજને ‘ઊંઘ’ અને ‘જાગૃતિ’ કંઈક જુદા જ અર્થમાં અભિપ્રેત હતી. એટલે મહેતાજીએ કહ્યું : ‘અમે એવા રે વળી એવા’ – પૂરો આધુનિક – નફ્ફરો – એ સમયને સહન ન થાય તેવો નાખશિખ તેજરવી મિજાજ...’

(૨)

૫૦૦ વરસ પછી ઠાકર લખે છે : ‘ઊંઘી ગયા છે ટેવ ભર્યા રે ઊંઘણશી’ – અહીં પણ વાત ઊંઘની જ છે. ‘અટપટા ભોગ’વાળી ઊંઘની. પણ પહેલી પંક્તિમાં તો સમાજને વાંધો ન હોય. ઊંઘવાની ટેવ હોય... ઘણાંને... મોટાભાગનાને... એટલે પંક્તિ સાંભળી જબકી જઈને એ સુભેઠી માથા ડોલાવે ને ફરી પાછા ઝોલે ચીડી જાય... “ભૈ, બઉ સારુ” – બોલતાં બોલતાં. પણ ઠાકર કેં આટલેથી અટકે નહીં. એટલે બખડજંતર શરૂ. માને જ નહીં ને આ અસસલ ૧ પમી સદ્ગીના મહેતા જેવા મિજાજના ઠાકર... નર-સિંહની જેમ એ ડણકે... “ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે...” આખો સમાજ ચોકે. આ ઊંઘ વળી કેવી ? છતરી પલંગવાળી તો નંઈ જ લાગતી હેં ને યોગેસ લૈ ???? આ ઊંઘ તો ભાષામાં. ‘બખડતા બોર વેચતા શહેર આખાની ભાષામાં. અહીં સવાલો ઊઠવા માંડે. પેલા મહેતાની ઊંઘ તો અંગત પ્રતીતિવાળી. જેવી બિનંગત બને કે ફરેક ભાવક – ‘પોતાને પણ આવું ક્યારેક ક્યારેક થાય છે’ – એમ વિચારીને સંમત થઈ જાય. પણ ઠાકરની આ ‘ઊંઘ’વાળી વાત જુદી જ... તદ્વન બિનંગત. મોહું કટાણું થઈ જાય તેવા કડવા ઔષધ સમી. આખો સમાજની ચિકિત્સા કરનારી. એટલે સવાલો ઊઠવા માંડે. ઊંઘણશી કોણ ? ભાષામાં ઊંઘી જવાની ટેવ છે. એક આખો સમૂહ ઘેનમાં સરી પડ્યો છે.

(૩)

જાત અને જગતની – ચીરી નાખે તેવી નિર્મમ તપાસ એ ઠાકરની જૂની ‘ટેવ’ છે. અહીં ‘ઊંઘણશી’, ‘ટેવ’ અને ‘ભાષામાં ઊંઘવું’ – આ ત્રણેય બાબત જરા જુદી રીતે જોવી પડે. અહીં પહેલો સવાલ કે ઊંઘણશી કોણ ? ઠાકર બે દિશામાં તીર છોડે છે. એક તો ટોળાં અવાજ અને ઘોંઘાટથી સંપૂર્કત એવી માનવચેતના – માનવજાત... અને બીજા પલાયનવાદી કવિજન.... આવા ઊંઘણશી ભાષાની છલના આદરે છે. ભાષામાં ઊંઘી જવાની ટેવ છે. એક આખો સમૂહ ઘેનમાં સરી પડ્યો છે.

મોં ભાંગીનાખે તેવી મધમીઠી આશાઓ સાથેની, જાતને છેતરતી છેતરતી અને પાછી એને જ પોતાની સાચી ઓળખ માનતી માનવચેતનાની દુખતી રગ પર ઠાકર હાથ મૂકે છે.

આચી ઓળખ ક્યાં ? અપાર કુતૂહલ છે ઠાકરને કે ‘તળિયે’ શું હશે ? એક તરફ ઊંડાં જળ છે અને બીજી તરફ કાણી ડોલ જેવી ભાષા વઈને તેને ઉલેચવા મથતો કવિ... ઉપરથી વિશેમણો ઓદીને સૂર્ય ગયેલા શબ્દનું છટકિયાળપણું... માનવચેતના અને ભાષા બંનેની ન પકડાતી ઓળખ છતી કરવાની, એની ચેતનાના અંધારા પાણીને ઉલેચવાની મથામણ ઠાકર કોરા કાગળમાં બૂમ પાડીને બહુ પહેલેથી માંડી બેઠા છે. વળી બીજી તરફ માનવ અને ભાષાનું સાચું ‘જત’ તાગવામાં ઊંઘ ઊતરતાં અને મોટેભાગે અવરોધરૂપ બનતા રંગદર્શી વલણોને પણ તેઓ જાંખી સદીવળા અખાજુના કાફ્ફલાના મુસાફર બની ચાબજા મારતા રહ્યા છે. આ બધી મથામણોથી તેમનું જ પોતીંકું દર્શન ઘડાયું છે તે આ ધૂવપંક્તિમાં પ્રગટે છે.

#### (૪)

પંડિતો એવું પણ કહી ગયા છે કે ઘણી કવિતાની પ્રારંભની પંક્તિ જ એનું ચાલકબળ હોય. પછી તો એને અનુમોદન આપતી પંક્તિઓ સર્જક પોતાના વિતથી સર્જ. અહીં પણ એમ જ થાય છે. ટણાર, ભલે ધારદાર હોય, સહેવાય નહીં તેવું હોય કે પછી ગમે તેવું હોય – માનવસમાજનું – સંસ્કૃતિના સાચા અસ્તિત્વની ઝંખના સેવવાને બદલે ભાષામાં પ્રપંચ આદર્યો જ કર્યા છે, પાછા મધ્યમીઠી આશાઓ લઈને બેઠાં છે. સંપ્રક્રાન્તિક આધુનિક કવિનું આ ‘દર્શન’ છે. ભાવકને ઠાકરનાં આ કટાક્ષની ઝંય સ્પર્શ ત્યારે પોતાના જ દૂંગતા ઘાવ ચાટતા જીબ પર જે ત્રમત્રમાટ થાય તેવું કશુંક અહીં અનુભવાય છે. ઊંઘના માર્ગે આદરેલી છલના, unbearable lightness of being – અસ્તિત્વની આ અસ્થિ એવી હળવાશમાં રાચતી કવિચેતના – સમાજચેતના તરફ ઠાકરે લયની હળવાશથી ચાબખો માર્યો છે. ધૂવપંક્તિમાં અને પછી આખી કવિતામાં આવતો ‘રે’ પૂરક કાંઈ લય સંધાન કરતો લહેકો નથી. કવિઓ અને સમાજ બંનેની ખીલ્લી ઉડાડતા ઠાકરનું શબ્દચિત્ર છે.

#### (૫)

ધૂવપંક્તિ પછીનાં ત્રણ દરથો ઊંઘનો વિસ્તાર છે. દ્રષ્ટ બનીને ઠાકર એ વિસ્તાર નિરૂપે છે. દરેક દર્શની અંતિમ પંક્તિ તારણ આપે છે. ત્રણોય દરથોના છેલ્લા ચરણને જોઈએ –

૧. ‘દોડે છે હણહણતી લઈને ઈચ્છાઓ આજાઈઠી રે...’
  ૨. ચસયસ ચૂસતા રંગ મજાઠી રે...
  ૩. તડકાતી પીત પીઠી રે...
- આ ત્રણોય દરથો અને અંતિમ ચરણમાં તેનું તારણ ભાષાનાં પુસ્ક, ઓજસ ભર્યા અને રવાનુકારી અનુભવ વડે ઊંઘના વિસ્તારને પ્રત્યક્ષ કરે છે.

#### (૬)

આખું કાવ્ય ચાર કિયાપદ પર ઊભું છે. ‘ઊંઘ છે’, ‘દોડે છે’, ‘ચૂસે છે’ અને ‘ચોળે

છે.’ આ કિયાપદના માર્ગે કાવ્યમાં પ્રવેશી શકાય. ઊંઘણશી દોડે છે હણહણાતી ઠચ્છાઓ લઈને. તીવ્ર ગતિશીલ ચિત્ર અહીં સુક્ષમ છે. ચોતરફ ઠચ્છાઓનો – ન દેખાતી, માત્ર અનુભવાતી ઠચ્છાઓનો – કશુંક પામવાનો હણહણાટ તગતગતી તડકાથી લઈને અવળસવળ અંધારિયા તનમનના વન સુધી ફરી વખ્યો છે. ઘનઘેરી ‘ચહલપહ્લવ’થી લઈને છેક આદિમ વૃત્તિઓ સુધી વિસ્તરતી ઠચ્છા-દોટ દશ્યશ્રાવ્ય કલ્યાનો દ્વારા પ્રત્યક્ષ થાય છે. આપણે હજી તો તડકાના સોનેરી રંગે અંજાઈએ ત્યાં તો અવળસવળ અમળાતું અંધારું વન અનુભવાય અને પાર્શ્વભૂમાં અસ્થનો – તેજ તર્ફાર તોખારનો હણહણાટ તો પાર્શ્વભૂમાં સંભળાતો જ હોય.... આ સેળબેળ થયેલી આમતેમ ફેંકાતી – આશડ્યા કરતી આખી માનવજાત એની સંસ્કૃતિ, છલના અને સાથોસાથ કવિચેતના.... અને છેલ્યે ઠાકરની આગવી ઠેક – ‘રે ઊંઘણશી !!!’

બીજો અંતરો ‘ચૂસે છે’ – કિયાપદવાળો... આધુનિકતાનો શરીરી સ્પર્શ – ‘ચૂસે છે’ અને ‘ચોણે છે’ કિયાપદોમાં અનુભવાય... તીવ્ર આધુનિક બોધ આરંભે જ થાય. ‘વાતચીત કરતા પડછાયા.’ મૂળ આકારો કયાં? ચહેરા – ઓળખ ગુમાવી બેસેલું જગત... એની પલાયનવૃત્તિ ચૂસ્યા કરે શૈશવની સ્પર્શશાળીને. ભૂતકાળને ધાવતાં – સંતોષમાની જીવે જતાં ઊંઘણશીઓ પહેલા અંતરામાં વર્તમાનનું બેલગામ ગતિશીલ હણહણાતું ચિત્ર અને બીજામાં ભૂતકાળમાં સરી સરી પોતપોતાના શૈશવને ‘બચબયબચ’ ચૂસતાં પ્રલાયનવૃત્તિ ધરાવે છે. જે પારદર્શક નથી, જેને રંગદર્શી બનાવી રજૂ કરવાની ટેવ પડી ગઈ છે. અહીં ભૂતકાળમાં રાચ્યા કરતાં, બચકારા કરતા કવિ જીવો પર પણ ઠાકર ‘છદ્ર’ કહીને તાતું તીર છોડે છે.

ત્રીજામાં વિસ્તાર છે. આરંભે પુષ્ટાયેલો ‘ત્રીજો પ્રશ્ન’ આ ટેવ વળી ક્યારથી પડી છે ?- નો જવાબ. ઠાકર અહીં સ્પષ્ટ રીતે ત્રાટ્કે છે.

‘સર્દીઓના ઓળખો અમૃત રેલઝેબ’ ઓળખ ગુમાવી બેઠેલી આ કહેવાતી સંસ્કૃતિ યાંત્રિક, અર્થહીન, પરિણામ સુધી ન પહોંચી વૃત્તિ-પ્રવૃત્તિનું એક સુરીલું ગાન આદરી બેઠી છે. ઠતિહાસનું શરણ લઈ પોતાની સંકુલતા પામવા ઠચ્છે છે... સર્દીઓને ‘કલોઝ-અપ’માં લાવી ચોણે છે. અધખૂલો બીભત્સ એવો ભાષાચાર આદરે છે... અધકચરી, ઉપરછલ્યી, રંગદર્શી, મોં ભાંગી નાખે તેવી ગળચાઢી અભિવ્યક્તિ ક્યારેય પૂર્ણતા પ્રગટાવી શકતી નથી. કારણ કે ‘ઉભડક’ ચોણે છે. સંકુલતાને પામ્યા વિના... સંકુલ ઓળખને નિરંતે નહીં પણ ઉભડક રીતે ભાષામાં ‘ચોળ્યાં’ કરતી કવિઓની જગત અને સંસ્કૃતિની વંચના કર્યા કરતી.... ઘેનમાં રહી સારા ચિત્તને ક્યારેય ન પામી શકેલી માનવજાત.... અર્થહીનતાને જન્મ આપે છે. અધખૂલી ભાષામાં ન પકડાતા અસ્તિત્વને, પોતે બરોબર સમજ-ઉત્તારી શકી છે. એવી છલનાની ઊંઘ આદરનાર આખી વાત અર્થહીન બનાવી દે છે. શેત-શ્યામમાં ‘તડકાતી પીત પીઠી’ – અંજી નાખે તેવો રંગ ઢોળી નાખે છે...

Black humour (કાળું હાસ્ય) આધુનિક સર્જકનું સબળ હથિયાર છે. એ હથિયારનો સમુચ્છિત ઉપયોગ થાય ત્યારે પરિણામ પણ ધારદાર આવે. દાકર આ કવિતામાં તો એનો યોગ્ય ઉપયોગ કરી શક્યા છે. વળી ઊંઘ અને એ ઊંઘની જુદી બંજકતા... અહીં ‘જગૃતિ’ જ ઊંઘ છે. રંગદર્શી-પાણીપોચી-ઘેનભરી શબ્દછલના કર્યા કરતા કવિજનો પરનો સૌંસરો ઊતરી જાય તેવો કટાક્ષ કાવ્યનું એક સંરચન છે તો બીજું સંરચન આ સાંસ્કૃતિક છલનાનું છે. ઊંઘ અને કિયાશીલ જગત વિશ્વ એકમેકમાં ભણે છે... બે વિરોધી બાબતોની સેળભેળ કાવ્યમાં એક તણાવ, આંતરવિરોધ રચે છે... ગતિશીલ દશ્યશ્રાબ્ય કલ્યાણો તો અત્યંત જગત કિયાશીલ જગત નિરૂપે છે પણ અંતે આવતી ઠેક - રે ઊંઘશશી. આખી વાતને પૂરેપૂરી પલટાવી ઢે છે. વળી ધ્રુવપંક્તિના ઉત્તરાર્થ બંજકતા છે તે અહીં ઉફ્ફાં-તેજતરર્ર - મહેતાની જેમ જ આખા સમાજને ચોકાવી દેતા, તેની દુઃખતી નસ દબાવતા નખશિખ આધુનિક સર્જક દાકરને છાજે તેવી કાવ્યાત્મક છે. અહીં એમ કહેવાનો આશાય નથી કે આ રચના કવિની સર્વોત્કૃષ્ટ રચના છે પરંતુ વર્ણોથી તેમની આ સંસ્કૃતિ, સમાજ, ભાષા અને રંગદર્શી કવિજનો તરર્ફની જે તીવ્ર શંકા છે, પોતીકું દર્શન છે તેની કાવ્યાત્મક પ્રતીતિ કરાવતી એક આસ્વાદ્ય રચના છે.





## અ. ટેવ : જીવનના એકધારાપણાનું કાવ્ય

કિશોર વ્યાસ

### ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે

ટેવ

જગડાવે

બબડાવે

�ઘડાવે

ચલાવડાવે

હાથ બે હલાવડાવે

ચલો જીતવા જંગ ગાઈ બ્યૂગલ વગડાવે.

ટેવ

નવડાવે

ખવડાવે

ભાવભર્યા પિરસાવી ભોજન ભરચક ભરચક ભવડાવે.

શબ્દભાવના ચૂંંગ ગમને ચગળી ચગળી લયબદ્ધ લવનમાં ચવડાવે.

ટેવ

સાંદર્શયમૂલકનાં સમાધાનમાં સુવડાવે

લયોધરોના થડકારાથી ધરપત ધરપત ધવડાવે

અર્થાશયમાં અકલ સકલને મવડાવે

સ્મૃતિઓમાં સ્થલકાલ સકલને વવડાવે

શ્રુતિ-શકલને લાલિત લુભ્યમાં અચકો લચકો ગવડાવે.

ટેવ

ગપટાવે

લપટાવે

ભજન ધોળ પદ ગીત ગજલના ભાવશીકરને જપટાવે.

મધમધ મોદકવૃક્ષ બ્રહ્મનું પલભર ફલભર લટકાવે

લાડુ લચપચ બટકાવે

છે છે છે - ના ખાતીપાને ઊડતો અધવચ અટકાવે.

કેવળ શબ્દમાત્રના ફેરફારથી કે આવર્તનથી કવિતા શક્ય બનતી હોત તો ? કેવળ લયનાં આવર્તનો કે શબ્દટુકડાઓમાં ફંગોળાતા પ્રલાપોને કવિતા કહેવાની કવિ-રઢ સામે આપણા કવિતા-સમીક્ષકો ફરિયાદનો સૂર કાઢતા રહ્યા છે તોયે લાભશંકર આપણા મહત્વના ને એક નોંધપાત્ર કવિ રહ્યા છે.

પડી ટેવ યણી કેમ ટળેનાં આવર્તનો કરતી આ રચના એક મૂરખને એવી ટેવ...નો જાગે અખા ભગતે રમરમાવેલો ચાબખો મારે છે. જગડાવે, બબડાવે, ઝઘડાવે, ચલાવડાવે જેવાં કિયાપદો એક પછી એક આવતાં જ જાય પણ એના મૂળમાં જો કોઈ હોય તો તે આપણી જીવે જવાની આદત... કહો કે ટેવ... અને આપણે છીએ કેવળ આદતના ગુલામ. પહેલાં એક પંક્તિના ગુરુછમાં બાયોલોજિકલ કલોક આપણને જાતે જ પથશરીમાં ઉઠ, ઉઠનો પોકાર પાડીને જગાડી દે, સૂરું હોય તોપણ સૂવા શેની દે એ આદત ? કેમ કે આદત તો આગળની આદતો માટે ઘસડાતી ચાલતી હોય છે ને સ્વયંને ઘસડતી હોય છે. બબડાટ કરવાની ટેવ... ભાષા-સંવાદ બનવાને બદલે બબડાટ બની જાય એ હુદે ભાષાને વાપરી નાખતી ટેવ, અન્યની સાથે ઝઘડાઓ કરવાની ટેવ જેવા શબ્દોમાં અહીં કેટલીક માત્ર શારીરિક કિયાઓ છે તો કેટલીક કિયાઓ આપણા મન સાથે જોડાયેલી છે. કવિ નર્મદની પંક્તિને પણ અહીં સ્મરણમાં લાવીને એ કડખેદ થવાની ટેવને યાદ કરી લે છે. કવિતાના બીજા સ્તબકમાં ટેવ નવડાવે, ખવડાવે કે ભાવભર્યા ભોજન ભરચુક ભરચુક ભવડાવે તાં સુધી તો સંઘળી કરામાતના અંદજમાં આપણે રહીએ એ વેળાએ કવિ શબ્દમાત્રની ચૂંઠંગ ગમને આપણી સમક્ષ છતી કરે છે. આ શબ્દ અને ભાવને ટેવવશ આપણે સતત ચાવ્યા-ચગળ્યા કરીએ છીએ ને લયબદ્ધ લવનમાં ચવડાવ્યા પણ કરીએ છીએ. શબ્દ અને ભાવના લયને પામીએ એ તો ભાષાવારસ હોવાનું ધન્યભાગ્ય. પરંતુ એને સતત ચગળી ચગળી એના રસકસને ખતમ કરી નાખીને લયબદ્ધ કવનમાં ને બદલે લવનમાં-લવરીમાં પલટાવી નાખ્યા. શબ્દ અને ભાવ ભાવભર્યા ભોજનને બદલે નિરર્થક બોબડી બોલી બની રહે પછી સંવાદની શક્યતા પર પૂર્ણવિરામ છે. આ ટેવ સાંદર્શયમૂલ્યકના સમાધાનમાં ‘સુવડાવે’ એવા ગીજા સ્તબકના આરંભે મુકાયેલી પંક્તિ અલંકારનું સ્મરણ કરાવી રહે. જે

પછી કશું ઉમેરવાનું બાકી ન રહે, પૂર્ણતાનો ઘટ ભરાઈ જાય, પર્યાપ્ત થઈ રહે તે અવંકાર. આવાં સમાધાન પણ કેવળ આદતના જોરે મનના ભીતરે ભર્યા પડ્યા રહેતાં હોય છે. જાગતો જણ હોય તો જાતને ટકોરે, દેખે, પરબે કે નિરાયે પણ અહીં તો આદતનો માર્યો જણ... લયોધરો ને અર્થાશય, લલિત લુભ્ય જેવા શબ્દપ્રયોગો કવિએ સહેતુક પ્રયોજ્યા છે જેમાં સ્મૃતિઓમાં સ્થલકાલ સક્લને ‘વવડાવે’ કે ‘લલિત લુભ્યમાં અચકો લચકો ગવડાવે’ જેવી પંક્તિઓમાં ટેવની લીલાઓ વિસ્તરતી દેખાય છે. આ ટેવ જ બજન, ધોળ, ગીત-ગાલના ભાવશીકરોમાં આપણને ભીજું, એકકાર થવાની આદત પાડે, ભાવની આવી શીતવહેર ઝપટવે એમ લપટવે પણ ખરી.

‘મધ્યમધ મોદ્કવૃક્ષ બ્રહ્મનું પલભર ફ્લભર લટકાવે, લાડુ લચપચ બટકાવે’ જેવી પંક્તિમાં કવિને પન્નાલાલ પટેલની અત્યંત મનભાવક બની રહેલી ‘લાડુનું જમણ’ કૃતિનું સ્મરણ કરાવ્યા વિના ન રહે. પણ એ અગાઉ ખવડાવે, ભાવભર્યા પિરસાવી ભોજન ભરચક ભરચક ભવડાવે’ પછી પુનર્ગવર્તન પણ લાગે. આવા પ્રયોગો કાનને કઠે છે પણ ખરા. શબ્દરમતો કરવાની કવિની પણ ટેવ જ કે બીજું કશુંક ? કાવ્યની અંતિમ પંક્તિમાં કવિએ ‘છે છે છે છે-ના ખાલીપાને ઊડતો અધવચ અટકાવે’ એમ કહીને એક વળાંક આયો છે. નથી-નો ખાલીપો નહીં, પણ છે... છે-ના અભરેભર્યા ખાલીપાને પ્રગત કરતી વક્તા અહીં સામે આવે છે. છે તો કેવળ ખાલીપો, તો શું નથી ? નવતા નથી. એજ સેજ, એજ બેજ... જેવું સઘણું ટેવવશ છે અને એ જ મનુષ્યજીવનનો કરુણ છે. સમગ્ર રચના કવિએ બબડાવે, નવડાવે, ખવડાવે જેવાં અનેક પ્રેરક ક્રિયાપદોથી ભરી દઈને આપણી સઘણી ક્રિયાઓના એકધારાપણા સામે, ગતાનુગતિકતા સામે જાણે કે આપણને ઊભા કરી દીધા છે. એમાં કશુંજ મૌલિક નથી, આગવું નથી ને ટેવવશ જીવાતા જીવનમાં એટલે જ બધું છે ખરું છે ને તે છતાં ખાલીપો અંદરબહાર ખખડતો રહે છે. ટેવવશ વહેરાતા જતા ને એટલે જ અનુભવાતા મનુષ્યજીવનના થાકનું ને એમ કંટાળનું એ સૂચન કરે છે. કવિએ ભવડાવે, ચવડાવે, મવડાવે જેવા કરેલા પ્રયોગોથી ટેવ શીર્ષકને બળ મળે છે. એ કવિનો એક પ્રયુક્તિ તરીકે લેખવા જોઈએ.

લાભશંકર ઠાકરની આ કૃતિમાં પ્રત્યેક સ્તબકનો આરંભ ટેવથી કર્યો છે જે વિસરાતી નથી, ભૂલવા ચાહો તો ભૂલાતી નથી ને એ પ્રત્યેક પળે આપણને દોરી રહી છે એની પ્રતીતિ કરાવે છે. કવિએ માનવજીવનના એક સત્યને આપણી સામે અહીં પ્રકાશિત કરી દીધું છે.



## ઉ૬. ‘કાચબો ચાલે છે’ : ‘ચાલવું’ એ જ નિયતિ

દક્ષા વ્યાસ

### કાચબો ચાલે છે

સુકાયેલા સમુદ્રને

ઉંચકીને

કાચબો

ચાલે

છે –

જળાશયની

શોધમાં.

લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ સર્જકતાથી છલકાતા કવિ. એમની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે ત્રણ સ્થિત્યંતરો સ્પષ્ટ દેખાય : પરંપરાગત અભિવ્યક્તિ, આધુનિક પરોગપરાયણ અભિગમ અને લાઘવયુક્ત પોતીકો લાક્ષણિક આવિષ્કાર. ત્રણેમાં એમનું ભરભર સર્જનતેજ માણવા મળે. જીવનની તમામ ગતિવિધિઓમાં વ્યાપ્ત અસંગતિથી પ્રવૃત્તિમાત્રની વર્થતાની લાગણીથી એમની કવિતાનું અંતરંગ રંગાયેલું છે. અછાંદસમાં બહુવિધ લયોને રમાડનાર; ‘માણસની વાત’, ‘પ્રવાહણ’ જેવાં સુદીર્ઘ કાચ્બો રચનાર કવિ ઉત્તરોત્તર સર્જનમાં લાઘવની ઉપાસના કરતા દેખાય છે. કવિ લયપદેશ છોડીને ગદ્યલયમાં વિચરવા લાગે છે. કવિતા લધિમા-અણિમા રૂપે ગદ્યમાં ઉત્તરતી રહે છે. ‘કાચબો ચાલે છે’ એમની આવી લધુ ગદ્યરચના છે. સરળ-વિશાદ અને સપાટ અભિવ્યક્તિ આહી ભાવકને મૂળવી મારે છે. એક કલાકૃતિ રૂપે અવગત કરવા એણે અને વારંવાર ઘૂંટવી પડે છે.

આહી કાચબો આપણાને છેક પુરાણકાળમાં લઈ જઈ દશાવતાર સાથે જોડી આપે છે. તો સમુદ્ર વ્યાપક સંસાર – ભવસાગર સાથે. આમ સ્થળ અને કાળના વિશાળ પરિમાણ વચ્ચે આપણે મુકાઈએ છીએ. ‘ચાલવું’ આ સ્થળ-કાળને ચાલના-ગતિ આપે છે.

કૂર્માવતાર એટલે વિષ્ણુનો કાચબા રૂપે થયેલો અવતાર. દિતિના બળવાન દાનવપુત્રો અને અદિતિના ધમ્પિભી દેવપુત્રોએ અમૃતપ્રાપ્તિ માટે ક્ષીરસમુદ્રનું મંથન કર્યું. મંદાર પર્વતનો રવૈયો બનાવ્યો, પરંતુ તે પાતાળમાં સલવાઈ જતાં વિષ્ણુએ કૂર્મના આકારમાં પોતાની જાતને સમુદ્રના તળિયે મૂકી મંદાર પર્વતને આધાર આપ્યો.. દેવો-દાનવોએ તેને વાસુકિ નાગનું દોરડું વીઠી – એ રવૈયાથી સમુદ્રમંથન કર્યું. એમાંથી નીકળેલો અમૃતકુંભ દાનવોના હથમાં આવી જતાં વિષ્ણુએ મોહિનીરૂપ લાંઘું... ની કથા પ્રચલિત છે. પુરાકથાનો કાચબો વિષ્ણુનો અવતાર છે. આ કવિતાનો કાચબો અવતાર છે ? મનુષ્ય છે ? કવિ છે ? અવતારની નિયતિ છે પુનઃ પુનઃ: પ્રગટ થતા રહેવાની – ચાલતા રહેવાની. એનું અવતરણ થાય છે ઉદ્ધાર માટે. પરંતુ શું એ ખરેખર ઉદ્ધાર કરી શકે છે ? માનવનિયતિ પણ એવી જ છે. સંસાર-સાગરનાં જળ ખારાં છે. જળ એ જીવન છે; પરંતુ જળ સુકાયું છે. ખારાશ રહી છે. મનુષ્યે આ ખારાશબર્યા સંસારસમુદ્રને પીઠ પર લઈને ચાલતા રહેવાનું છે નિરંતર – મીઠા જળના જળાશયની – સુખ નામના પ્રદેશની ખોજમાં.

કહે છે કે તમામ સીમારેખાઓ વટાવીને એક બિંદુએ કવિતા અને તત્ત્વજ્ઞાન-ચિંતન એક થઈ જાય છે. આ અણાઘડ-સપાટ લાગતી પદાવલિ પ્રથમ વાચને કદાચ માત્ર શબ્દો જ આપે છે, જે ક્યાંય લઈ જતા નથી. પરંતુ એમાં ઊડા ઉત્તરતાં એ ત્રિપાર્વતી કાચની પેઢે અર્થધાયાનાં અનેક કિરણો વચ્ચે ભાવકને મૂકીને શબ્દનો શક્તિનો સાચો પરિચય આપે છે. વિષ્ણુના મોહિની રૂપના – અવતારકૃત્યની કથાના અધ્યાસો પછી ચિત્તમાં માનવનિયતિ અને કવિનિયતિના અધ્યાસો પણ જાગ્યા કિના રહેતા નથી. અતું આશાતંત્ર માનવકાચબાને ચાલતો રાખે છે. જળાશય – મીઠું જળ તો મળેય ખરું, નયે મળે. પણ ક્ષીણ ગતિએ સંસારનો ભાર વેંબારીને નિરંતર ચાલતા રહેવાની – કર્મ કરતા રહેવાની જીવમાત્રની નિયતિ છે. એ કવિનીય નિયતિ જ. જીવનરસ સુકાયો હોય, ખારાશ જોડાયેલી અને જડાયેલી હોય તોય કાવ્યસંસારનો ભાર ઊંચડીને કવિ ચાલતો રહે છે... સર્જન કરતો રહે છે... એક અનુપમ જળાશયની – કશાક ઉત્તમની ખોજ કરતો રહે છે. એમ કરતાં કદાચ કશુંક નીવરી આવે ! અમૃત અંજલિમાં ડિલાઈ જાય ! અહીં કાચબો, સુકાયેલો સમુદ્ર, જળાશય નરો શબ્દો પ્રતીકતમક ઊંચાઈ પર પહોંચ્યા છે. અને અનુપમ કાવ્યરસનો આસ્વાદ કરાવે છે.



## ઓ. ‘છે-ની બારીમાંથી સામે’ વિશે

સુભાષ શાહ

### છે-ની બારીમાંથી સામે

છે-ની બારીમાંથી સામે

કદાચ

લીમડાભાઈ લહેરાય છે.

મંજરીઓના મધ્યમઘતા થર આવીને

કદાચ

હાલકડોલક નાક સુધી પથરાય છે.

ડાળ પરે કોઈ અજાણું પંખી

કદાચ

ઉત્કટ એકલતાને ગાય છે.

પાંદડાં પવનસહિત રૂપેરી તડકામાં

કદાચ

ફરફર ફરફર નહાય છે.

ઘોળીને ચૂસેલી પડી ગયેલી પક્વ લાંબોળીનો

મીઠો કડવો સ્વાદ

કદાચ

અધરોઝના ચસકારામાં સંભળાય છે.

ટજબા જેવીના સ્પર્શમાં ટેરવાં

કદાચ

રણજાણ રણજાણ થાય છે.

છે

છે-ની હાલકડોલક સ્મૃતિઓમાં

કદાચ

છે-ને તાકે છે... ચાખે છે...

સુંદે છે... રૂપરો છે...

એવું

છે-ને

ઉંઘભરેલા ઝોકામાં લયભર

કદાચ

લાગે છે.

મિત્રો, મેં ખૂબ કાવ્યોના આસ્વાદ કર્યા છે પરંતુ ભાગ્યે જ કોઈ કાવ્યનો આસ્વાદ કરાવ્યો હશે. હા, અત્યારે એવું ચોક્કસ યાદ આવે છે કે લાભશંકરના જ પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્ય ઘોણા’માં એક કાવ્યનો આસ્વાદ કરાવ્યો હતો. આસ્વાદ તો શું પણ જે હું સમજેલો એ લાગેલું. કાવ્યના આસ્વાદ તો સુરેશ જોષીએ કરાવ્યા છે. આ બાબતમાં એમનું બહુ મોટું પ્રદાન. લાંઠાંએ પણ પોતાને ગમતાં કાવ્યોના કરાવેલા આસ્વાદમાં એક નવી જ બાની – નવા જ ઈંડિયમ્સ – સરજર્યા હતા.

પહેલાં તો આસ્વાદના બે જ અર્થ હતા. ‘કવિ આ કાવ્યમાં શું કહેવા માંગે છે’ અને ‘કાવ્યનો ભાવાનુવાદ’ લખો. આજે કાવ્યો અતિ સંકુલ બન્યાં છે. એનું Poetic Structure પણ એટલું જ સંકુલ થતું ગયું છે, અને એમાં પણ લાભશંકર, સિતાંશુ, મનહર મોદી ક્યારેક ચિન્નુ આ બધાંનાં કાવ્યોનો આસ્વાદ કરાવવો એ એક મોટો પડકાર છે. આ કવિઓનાં કાવ્યોના આસ્વાદ માટે કાં તો ‘આસ્વાદ’નો અર્થ બદલવો પડે અથવા આસ્વાદ કરાવવાનાં નવાં જ મૂલ્યો જે સાંપ્રત કાવ્યો સાથે મેળ ખાતાં હોય એવાં શોધવાં પડે.

આ બધું લખી હું મને સૌંપેલી જવાબદારીમાંથી છટકવા નથી માગતો. અને એટલે જ આ કાવ્યનો આસ્વાદ કરાવવાનું સાહસ કર્યું છું.

સૌપ્રથમ તો હું ‘છે-ની બારી’ વાંચીને જ ચ્યામકી ગયેલો. બારી તો મકાનની હોય – આ ‘છે’ની બારી એટલે શું ? આ ‘છે’ એટલે શું ? આપણા ભાવ-વિશ્શેમાં આવે એ બધું જ ‘છે’. આપણે જ્યારે છીએ ત્યારે જે કંઈ ઈન્ડ્રિય-ગોચર છે, આપણા અન-અસ્તિત્વ પછી પણ જે ઈન્ડ્રિય-ગોચર રહેશે એ ‘છે’; ‘છે’ એક એવો શાબ્દ છે અથવા કિયાપદ છે જેની સાથે જ કોણ છે ? કેમ છે ? કયાં છે ? કયારે છે ? સત્ય કે અસત્ય છે – ઈન્ડ્રિયગમ્ય છે કે ભમણા છે એવા માનવજાત સાથે યુગોશી સંકળાયેલા તૈખિક પ્રશ્નો છે. એવા આ ‘છે’ની બારી જેમાંથી હવાની અવરજનવર થાય છે, જેની પાસે જતાં જ એ તમને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડી દે છે.

જેને કવિવર યાગોરે હમેશાં ખુલ્લી રાખવા અનુરોધ કર્યો છે. એવી આ ‘છે-ની બારી’ અને એમાંથી કવિએ જોવાનું વિચ - જે આમ સરળ છે પણ એટાં જ સંકુલ અને અધરું છે.

સરળ એટાં માટે છે કે ‘છે’-ની બારીમાંથી જે દેખાય છે એ દશ્યો - અથવા દશ્ય કલ્યાનો. અને એને અનાયાસ કાવ્યાત્મક બનાવતા કેટલાક શબ્દો ‘મધ્યમઘતા ઘર’, ‘હાલકડોલક ના’, ‘ફરફર ફરફર નાય છે’, ‘હાલકડોલક સ્મૃતિઓ’ વગેરે... અને આ બધી કરીઓ વચ્ચે જે શબ્દ વપરાયો છે - જે લાંઠાં જ વાપરી શકે એ શબ્દ છે ‘કદાચ’. આ ‘કદાચ’ એટલે ચિત્તની શંકા. છે કે નથી, હશે કે નહીં હોય, સત્ય હશે કે અમણા હશે. આવું થવાનું નિમિત્ત અથવા આ બધું આમ દેખાવાનું કારણ કદાચ તત્કાલીન મનઃસ્થિતિ હશે અથવા છે.

### ‘છે-ની હાલકડોલક સ્મૃતિઓમાં

#### કદાચ

છે-ને તાકે છે... ચાખે છે...

સૂંધે છે..., સ્પર્શે છે...

એવું

એવું છે-ને

ઉંઘ બરેલા ઝોકામાં લયભર

#### કદાચ

લાગે છે.’

અહીં ‘છે’નું જે personification થયું છે એ આસ્વાદે છે. આ કરીમાં જ્યાં ‘છે’ તાં લાંઠાને કલ્યીને ક્રૂરીને કાવ્યને વાંચો... મઝા પણ આવશે અને કદાચ કાવ્યની ઘણીબધી અર્થધારાઓ સ્પૃષ્ટ થઈ જશે.

લાભશંકરનાં અનેક કાવ્યોમાં કેન્દ્રસ્થ છે ફુદરત, ફુદરતનાં અનેક તત્ત્વો... પછી બોરસલીનું વૃક્ષ હોય (જે એમના માર્ગિનગરના ઘરના આંગણમાં જ હતું. એ વૃક્ષ નીચે અનેક વખત હું અને લાભશંકર એ...ય, ખાટલા ઢાળી સૂતા છીએ, રાતે અને વહેલી સવારે એની માદક સુગંધ માડી છે. પથારીમાં પથરાયેલાં એનાં ગીણાં ગીણાં ફૂલોને હાથમાં લઈ નજીકથી જોયાં છે, સુંધ્યાં છે.), લીમડો, તડકો, સૂરજ, ચાંદો, નરી (વહી જતી પાછળ રમ્ય ઘોણા નદી, ભરીને જળ...) દરિયો વગેરે.

મઝાની વાત એ છે કે આ બધાં તત્ત્વોને કાં તો સ્વતંત્ર રીતે અથવા એકબીજા સાથે juxtapose કરીને મૂકે છે (બોરસલીની કૂપળમાં / તડકો / એની આંખ જીણોરી ખોલે...) અને પછી એનું એવું ક્રમશઃ જે રીતે રૂપાંતર થાય છે - Metamorphosis - અને એ જ રૂપાંતર ભાવકને કવિચિત્તના પરિસ્થિત કે ગોચર પ્રદેશમાંથી સાવ અજાજ્યા અથવા અગોચર વિશ્વમાં ખેંચી જાય છે.

પરંતુ આ કાવ્યમાં તો ‘છે-ની બારીમાંથી સામે’ સાથે કાવ્યનો જે ઉપાડ કર્યો છે એ તો તમને તરત એમના ચિત્તના અગોચર પ્રદેશમાં ખાબકવાનું જ નિમંત્રણ આપે છે.

‘ઉલ્કટ એકલતાને ગાતું કોઈ અજાહયું પંખો’ પવન સાથે રૂપેરી તહકમાં ફરફર નહાતા પાંદડાં ‘રણજાણ રણજાણ થતાં ટેરવાં’ ‘છે-ને તાકે છે, ચાબે છે...’ આ બધાં કલ્યાણો જેટલાં તાજગીભર્યા છે એટલાં જ અદ્યતન અને અદ્ભુત છે.

દ્વિનેશ કોઠારી, વાભશંકર અને મેં, સાથે ટી.એસ. એલિયેટના અનેક લેખો વાંચ્યા છે, એમાંથી ગમી ગયેલાં વાક્યોનું અનેક વખત ચચન અને ચર્ચા કર્યા છે. ઓમાનું એક વાક્ય હતું ‘Context is the meaning’ – સર્જનમાં ‘સંદર્ભ’ જ અર્થ આપે છે... પછી એ કાવ્ય હોય કે ચિત્ર. (અહીં અમસ્તું જ ભૂપેન ખાખરના ‘Temple wall’ જેવાં ચિત્રોનું સ્મરણ થાય છે. મંદિરની ગંઢી-ગોબરી, લાલ-કાળા ધજા કે હાથના પંજાની છાપ પડેલી, સ્પષ્ટ-અસ્પષ્ટ રીતે વાંચી શકાય એવાં લખાણવાળી ગામડાનાં મંદિરની દીવાલો તો સૌઅ જોઈ હશે. પણ ભૂપેન એને કેન્વાસ ઉપર મૂકી એક જુદ્દો જ સંદર્ભ આયો અને આ મંદિરની દીવાલની અનેક મૂર્ત અને અમૂર્ત અર્થછાયાઓ પ્રગત કરી) એવું જ અંતરરાષ્ટ્રીય કક્ષાનું કામ ‘લાભુ ડિયરે’ કરેલું છે (મધ્યના બે પેગ પછી કે અતિ વ્હાલના આવેગમાં હું એમને ‘લાભુ ડિયર’ કહી બેસ્તો અને એ મને કહેતા ‘સુભલો’) એ કામ બે-નમૂન છે.

આ જ કાવ્યમાં અનેક પરિચિત દશ્યો-કલ્યાણો કે ભાવજગતને ‘છે’ અને ‘કદાચ’ જેવો લગભગ અમૂર્ત કરી શકાય એવો સંદર્ભ આપી આ કાવ્યને પણ અત્યંત આસ્વાદ અને કલાત્મક બનાવી દીધું છે.

અંતે વાચકને મારી એક જ વિનંતી છે કે આ લઘુ ‘આસ્વાદ’ વાંચ્યા પછી કમસે કમ બે વખત સંણંગ આ કાવ્યને વાંચજો અને આ કાવ્ય તમારા ઉપર એટલે કે તમારા ભાવ-જગત ઉપર જાહુરી અસર કરશે.



## ૩૮. ‘કોણ ઘડે છે કીડીઓનાં નેપુર ?’ : સાધન આપું ને સાહેબ દૂર !

દલપત પદ્મિયાર

### કોણ ઘડે છે કીડીઓનાં નેપુર ?

॥ ૧ ॥

સાહેબની પ્રતીક્ષામાં  
કીડીઓ  
કણ ભૂલીને  
નીકળી છે –  
સોનારાની શોધમાં  
લયભેર  
નેપુર  
ઘડાવવા..

॥ ૨ ॥

કોણ ઘડે છે  
કીડીઓનાં નેપુર ?  
પૂછતી પૂછતી રે  
કીડીઓ  
તનમન ફિરત ઉદાસી.  
દાસ કબીર  
જતનસે બોલે  
તો  
ક્યા બોલે ?

॥ ३ ॥

સાદેશ્વરમૂલકના સમાધાનમાં રે  
 જીભ  
 સંતની  
 સજડબાબું આ -  
 જવાઈ ગઈ છે રે  
 મુંહ ખોલે તો ખોલે  
 લેકિન  
 કહે કબીરજી  
 કેસે બોલે રે ?

॥ ૪ ॥

સાહેબ અને દાસ વચ્ચેની  
 સરિયામ સડક પર  
 કીડીઓ  
 અર્થભેર  
 કચડાઈ રહી છે રે.

॥ ૫ ॥

છે  
 દોહા-સાખીની સાક્ષીમાં  
 સપ્તદ્વિપ નવખંડ મહીં  
 આતંક યુદ્ધનાં ખેદાનો મેદાનોમાં  
 સાહેબ વગરના સાહેબોની  
 શતકોટિ ખંડોમાં  
 ચૂપ બહેરાશો રે  
 એમ  
 ભાષાની ઊભી બજારે  
 કહત  
 કબીરા રોયા રે.

॥ ૬ ॥

રે કીડીઓએ કીડીઓએ, દયામણી  
 તનમનવનમાં  
 વચનકર્મમાં  
 નેપુરની લયામણી  
 પ્રતીક્ષામાં  
 છે  
 જન્મારા જોયા રે  
 કહેત કબીરા, રોયા રે.

॥ ૭ ॥

ભક્તિકા મારગ જીના રે  
 નદીઓના કંઠે  
 છલકત્તી છલકથી ભીના ભીના રે  
 પલળેલી કીડીઓનાં  
 તનમન  
 જાય તશ્પાતાં જોયાં રે  
 દેખત દેખત  
 ચૂપ  
 કબીરા રોયા રે.

॥ ૮ ॥

લિખાલિખીકી હૈ નહિ  
 છે  
 દેખાદેખીની વાત  
 દેવળ મંદિર મસ્જિદ  
 છે  
 ઘટ ઘટમાં અંદર  
 છે  
 તેથી તે બહાર.  
 અંદર કર્યારઘાણ છે ઘટમાં

છે  
 તેથી  
 તેવો  
 તે  
 બહાર.  
 કબીર ક્યા બોલે ?  
 રો લે પલભર, રો લે.

॥ ૯ ॥

મનઘટમાં તનઘટમાં  
 છે  
 જળ થંભ થયેલાં  
 જોયાં રે.  
 જેમાં  
 કાગળની હોડિમાં  
 સાહિબ  
 પલકારામાં  
 ડબ ડબ  
 દૂબતાં જોયા રે.  
 એસા સાહિબ કિસને બોયા રે ?  
 પૂછત પૂછત  
 નિર્જિજ વૃક્ષ સાહિબકા  
 છૂ  
 દેખત  
 હસતા હસતા  
 કબીરજીએ  
 છે  
 લોચનિયાં બે લોયાં રે.

સાહેબની પ્રતીક્ષામાં – સાહેબની શોધમાં નીકળેલી કીડીઓનું બન્યું છે એવું કે, રસ્તામાં ‘કણ’ જેવા કણને વીસરી, એ બધી નીકળી પડી છે સોનારાના ઘર તરફ ! જવાનું હતું ક્યાં અને

કાફ્લો વળી ગયો કઈ બાજુ ! સોનારો આવી ગયો આગળ અને સાહેબ ગયા પાછળ ! સાહેબ ગૌણ; સોનારો મુખ્ય ! આજો જેલ જ ફરી ગયો છે. મામલો જ પલતાઈ ગયો છે. બાજુ કઈક આવી બની બેઠી છે. એક બાજુ સાહેબ, બીજી બાજુ કીડીઓ અને વચ્ચમાં સોનારો ! પરંપરાની ભાષામાં કહીએ તો એક બાજુ બ્રહ્મ, બીજી બાજુ જીવ. અને વચ્ચે માયા. જીવ અને શિવ વચ્ચે જે કઈ કારસો છે તે માયાનો છે. એણે ભલભલાને ભૂલા પાડી દીધા છે. અહીં ભલભલા થાપ ઘાઈ ગયા છે. માયાનું ચલણ એકદમ છાનું, છેતરામણું, લોભામણું અને લયામણું છે. અન્યથા, કીડીઓ ‘કષા’ને પડતો મૂકીને, એમ જ કઈ નીકળી પડે સોનારાનું ઘર પૂછતી ?!

અહીં કબીર આપણી સન્મુખ આવી ઉભા રહે છે. અથવા અહીં કવિ આપણને કબીર પાસે લઈ જાય છે. અથવા અહીં કવિ, વાયા કબીર થઈને, આપણી પાસે આવે છે. જુઓ અને સાંભળો, કબીરની પેલી પંક્તિઓ :

‘ના જાને સાહેબ કેસા હૈ !  
મુલ્લા હોકર બાંગ જો ટેવે;  
કયા સાહેબ તેરા બહરા હૈ ?  
કીડી કે પગ નેવર બાજે,  
સો ભી સાહેબ સૂનતા હૈ !’

બબર નથી કે સાહેબ કેવો છે ! (આ) મુલ્લા ઘાંટા પાડી પાડીને બાંગ પોકારી રવ્યો છે તો શું એનો સાહેબ બહેરો છે ? (અરે ! નાનકડી એવી) કીડીના પગમાં નેપુર વાગતાં હોય તેને પણ સાહેબ સાંભળતો હોય છે ! મતલબ કે એ બહેરો નથી. એને સંભળાવવા માટે ખોય બૂમબરાડા પાડવાનો કે બીજાં બહારનાં સાધનો દલારવાનો કોઈ અર્થ નથી. કબીરની અભિવ્યક્તિનો આ વેદિક, બલિષ્ટ, બુલંદ, પ્રભર, પ્રહારક અવાજ, આપણા આજના કવિના કાનને કોઈક છેદેથી પ્રભલ રીતે, ઢંઢોળી ગયો છે. અને એના આજના આવિષ્કાર રૂપે આપણને સાંપડે છે એક વિચારધન, વસ્તુધન અને રસધન, નૂતન, મૌલિક, આધુનિક કાવ્યરચના.

કીડી એટલે સૂચિ ઉપરનો એક સાવ જ નાનકડો, ક્ષુદ્ર, તુચ્છ, નગણ્ય જીવ. આમ એના અસ્તિત્વની ગણના શી ? કોણ એના હોવાપણાની નોંધ લે ? અહીં મરમની વાત એ છે કે ઈશ્વરના ધ્યાન બહાર, કાન બહાર કશું નથી. એનાથી કશું છાનું નથી; કશું અજાણું નથી. કીડીના પગનાં ઝાંઝરનો અવાજ પણ એને સંભળાય છે. કીડીઓને ભલે ન સંભળતો હોય !

ઈશ્વર જે સાંભળે છે એ સૂરના, એ કાનના, એ શ્રવણના ઈશારા જુદા છે. મૂળ સૂચન સરકી જવાને લઈને આજો જેલ બદલાઈ ગયો છે. ઝીકી વસ્તુ જાડી થઈ ગઈ છે. સૂરને બદલે સાધન સમર્થ થઈ ગયું છે. ‘ઝંકાર’ની વાત છૂટી ગઈ. ‘અંજર’ આવી લીધું. અજવાળાને બદલે કોડિયું મોટું થઈ ગયું ! ચીટી તો ‘ચાવલ’ દે કે ચલી થી; (લેક્નિ) ‘બીચ મેં મિલ ગઈ દાર !’ બસ, પછી કાફ્લો નેપુરના નાકે જ, આભરણની પળોજણમાં પરોવાઈ ગયો. અખાએ

ચીંધેલી ‘કહું કરું ને સાંભળ્યું કરું !’ – ને નીકળી પડેલી વાગ્યાર તે આ કે કોઈ બીજી ?!

‘કોણ ઘડે છે કીડીઓનાં નેપુર ?’ એવું પ્રશ્નાર્મદંબું કાવ્યશીર્ષક માર્મિક છે. તેની યોજના વસ્તુ અને વાત વિશે ઉત્સુક અને આતુર કરે છે. આપણી જિજાસાને અંદરથી ઉંચકે છે. કવિ એક અલગ ખૂણેથી કૃતિમાં પ્રવેશવા પ્રેરે છે.

કલીરની ‘કીડી’ એકવચનના પ્રયોગમાં છે. લાભશંકરભાઈએ ‘કીડીઓ’ એવું બહુવચન પ્રયોજયું છે. કલીર સૂચિત કીડી એકલપ્રવાસી અને તત્ત્વગામી છે. લાભશંકરભાઈ-નિર્દિષ્ટ કીડીઓ સંઘપ્રવાસી અને સાધનગામી છે. કલીરસાહેબમાં ‘સાહેબ’ કેદ્રમાં છે; ડાકરસાહેબમાં ‘સોનારો’ ! આ સોનારાને કવિએ સર્જરો છે. એણે જ આગળ આવીને આખી બાજુ બદલી નાખી છે. એ સાહેબના મારગાની વચ્ચે મુકાયેલો અને મોટો કરાયેલો છે જરૂર, પણ સાહેબની સામે મુકાયેલો નથી. માનવજીવન, તેના વાસ્તવને, તેની વિભીષિકાનાં રૂપને નજરઅંદાજ કર્યે કેમ ચાલે ? વળી, સાહેબના ઘરની વાટ તો ‘પીપીલિકા’ની – કીડીની પણ સરકી જાય તેવી લપસણી, કઠિન અને વસમી હોય, પછી સોનારાના ઘરનું સરનામું પૂછનારાઓની તો લંગારોની લંગારો જ હોય ને ! કીડીઓ એવું બહુવચન પ્રયોજને કવિએ સંસારલુભ્ય, માયાલીપસ, સ્થૂળ ઈચ્છાધારી પામર માનવજીવસમૂહોની અધિકતાને નિર્દેશી છે. આવાં ટેળાં ક્યાં ઓછાં છે ? નેપુરની લાલચયમાં લહેરે ચેદેલી લંગારોમાં કવિએ આપણને પણ કેવા ઉમેરી દીધા છે ! મૂળ સાદને નહીં સમજનારામાં, અસલ નાદને નહીં સાંભળનારા અધીરોમાં આપણી ગણતરી નથી મુકાયેલી શું ??

વસ્તુવિચાર નવ એકમોમાં વિસ્તરતો, વિકસણો, વિલસણો કાવ્યરૂપ પામે છે. આ એકમાં તેના સ્વતંત્ર પ્રવર્તન સાથે, સરવાળે સમગ્ર કાવ્યકૃતિના અર્થ અને આકાર વિશે પ્રવૃત્ત રહે છે. કવિ એમની આગળી રચનારીતિ, નોખા અનોખા ભાષાકર્મથી કૃતિને ઘડે છે. માર્મિક વિચારવસ્તુના દ્વારા ઉપર વિંબણાની કેટકેટલી અને કેવી કેવી તરાહો પ્રગટી રહેલી અનુભવાય છે ! ‘કીડીઓ’ને જુઓને ! એની યાત્રા, એની કતારો, એનાં લય, એનાં ચલણવલણ, એનાં દિશાદોર, એનાં સ્થાનનિષ્ઠિત આદિ કેવાં ચિત્રપટની જેમ પ્રત્યક્ષ કરી આપાં છે ! ‘સાહેબ’ની પ્રતીક્ષામાં નીકળેલી કીડીઓને, આગળ જતાં, કેવી ‘નેપુરની લયમણીપ્રતીક્ષા’ તરફ વળી ગયેલી બતાવી છે ! યાત્રાને મારી ફંટાઈ જાય, ‘સાહેબ’ને બદલે ‘સોનારો’ ખેંચી જાય પછી શું થાય ? ઉમંગભેર નીકળેલી કીડીઓને પછી ‘ઉદાસી’ થતી, ‘લયમણ’ હતી તેમાંથી ‘દ્યામણ’ થતી, ‘લયભેર’ નીકળેલી હતી તેને ‘અર્થભેર’ અથડાતી જતી ને એમ કુટાતી, કચડાતી, કચ્ચરદાણ થતી મરી જતી કવિએ નિરૂપી છે. પ્રીતમ સ્વામી અહીં સાંભરે છે : ‘પામર તે હરિરસ શું પીવે ?

નેપુરના નાકે કીડીઓ લલચાઈને ભૂલી પડી છે એ તો એની ભૂલ ખરી પણ અને આ નાકે ઊભી રાખી દેનારા, ભૂલા પાડી દેનારા સોનારાઓ કંઈ એક છે ? મુલ્લા, મૌલવીઓ,

આચાર્યો, ધર્મગુરુઓ, પંડિતો, પુરોહિતો સંઘણ અહીં સપાટમાં લેવાયા છે. ધર્મો અને સંપ્રદાયો વચ્ચે, પંથો અને પરંપરાઓ વચ્ચે, શાસ્ત્રો અને વચ્ચાનો વચ્ચે, સાહેબો અને દાસોની વચ્ચે, શાનના જીના જીના અને ભક્તિના ભીના ભીના માર્ગની વચ્ચે, આ કીરીઓ કઈ બાજુ જાય ? કોનું સાંભળે ? કોનું માને ? નીકળવા માગે તોપણ કેમ કરીને નીકળે ? ‘દો પાટન કે બીજમે’ બિચારી કઈ રીતે સાબૂત રહી શકે ??

આ આખા ખેલમાં કવિએ કબીરને પણ કેટકેટલે ખૂણેથી કૃતિમાં સંડોવ્યા છે ! ક્યાંક એમને બોલતા બતાવ્યા છે તો ક્યાંક બંધ થઈ જતા પણ બતાવ્યા છે. ક્યાંક ‘ચૂપ’ થઈ ગયેલા રજૂ કર્યા છે તો ક્યાંક ‘સજજદબમ્બ’ રીતે ઝીબ ઝલાઈ ગયેલા બતાવ્યા છે. ‘જતન સે બોલે’ તોપણ ‘કયા બોલે ?’ અને મોહું ખોલે તોપણ ‘કેસે બોલે ?’ એવી અવફવ અને અવાક્ષ દશામાં બતાવ્યા છે. સમગ્ર ‘કચ્ચરઘાણ’ વિશે લોચનિયાં લોતા અને ‘નાવમેં નદિયાં ડૂબ જાય’ના ઉદ્ગાતાને કાગળની હોડીમાં ‘ડબ ડબ ડૂબતા’ સૂચક બતાવ્યા છે. ડબ ડબ આંસુ સારવાનો રૂઢુપ્રયોગ અહીં ડબ ડબ ડૂબવાની રીતે કેવો નવતા અને બંજકતાનો વોતક બની રહ્યો છે !

આમાંય તે, જે જેને વાસ્તે અથવા જેની આસપાસ આખો ખેલ મંડાયો છે એ ‘સાહેબ’ને જ ‘ધૂ’ – ગુમ, ગાયબ કરીને કવિએ (જે એમને જ આવડે) કમાલ કરી છે. ‘પૂછત પૂછીત / નિબીજ વૃક્ષ સાહિબ કા / ધૂ !’ની પ્રયુક્તિ નાટ્યાત્મકતાની સાથે અનેક રીતે અર્થગર્ભ અને બંજનાત્મક છે. ‘નિબીજા’ની વળી વાવળી કેવી ? એનો ઉગાવો પણ કેવો અને એનો વિસ્તારો પણ ક્યાંથી ? અહીં ‘બીજમાં વૃક્ષ’ કે ‘વૃક્ષમાં બીજાનો આ પટ-અંતરો, આ છેદેથી ખસેડોકો ?! કદાચ, ‘બીજક’ – બોધિત બારણું અહીં એકસાથે બંધ અને ખુલ્લું વિલસ્યા કરે છે. એક છેદેથી, પલકમાત્રમાં આખા ખેલ ઉપર જાણો પહડો પડી જાય છે અને બીજે છેદેથી નેપથ્યમાં, નવેસરથી આખો ખેલ ભજવાનો શરૂ થઈ જાય છે !

આખી કૃતિ એક માર્મિક, ગાહન વસ્તુ-વિચારના દોર ઉપર, નૂતન નિર્વહણ અને વિડંબણાના વિશિષ્ટ સર્જનવ્યાપાર સાથે, સંતુલિત ઊભી છે. ધર્મમાં, સમાજમાં, જીવનમાં ક્યાંય પણ, શું ‘તનઘટમાં’ કે શું ‘મનઘટમાં’, વ્યાપેલી બદ્ધતા, બધીરતા કવિને મંજૂર નથી. નર્મદની જેમ ‘થંભ થયેલાં’ જણની સ્થિતિ વિશે વિદોહી છે. વિચાર, ભાષા, અભિવ્યક્તિના બંધિયારપણ વિશે પણ કવિ એ જ મતના છે. એમની સમગ્ર કાચ્યપ્રવૃત્તિઓ, એમની આ પ્રતિબદ્ધતાનો, સુપેરે હિસાબ આપેલો છે : કથિતવ્યને વાસ્તે, કવિતાને વાસ્તે તેઓ ભાષાનાં અનેકવિધ ઓજારોને હથમાં દે છે અને પોતાની રીતે તેની અજમાયેશ કરે છે. ભાષાને, ક્યાંક વ્યાકરણને પણ, તેઓ વિલક્ષણ રીતે – વિચક્ષણ રીતે પલટે છે, પલોટે છે. એમણે ઊભી કરેલી ભાષા, વ્યાકરણ આદિની અસ્તનવ્યસ્તતા, સરવાળે, કૃતિનાં આંતરિક લય, એકતા અને સંવાદ વિશે, ઓતપ્રોત અને સક્રિય બની રહે છે. કાચ્યમાં યોજાયેલી એકલી ‘સે’ની આવૃત્તિ ગણી જોવા જેવી અને એથીયે વધારે માણવા-પ્રમાણવા જેવી છે.

કબીર એક યા બીજી રીતે રચનાના આખા પટમાં પથરાયેલા છે. વાણીની રીતે, અવળવાળીની રીતે, રૂપકો, પ્રતીકો, કલ્યાણો, બાનીની રીતે અને ખાસ તો વસ્તુવિચારની રીતે અહીં એમનું રમણ છે. પણ આહી કબીર કે કબીર-વિચારદર્શનનું કોઈ સાઢું અનુસરણ, અનુકરણ કે અનુરણન નથી; આજના એક સમર્થ સર્જકની કલમ થકી થયેલું નૂતન પુનાર્વધાન છે, નૂતન સર્જન છે. કબીર આપણી ભારતીય સનાતન સાધનાધાર અને તત્ત્વદર્શનના સમર્થ ઉદ્ગાતા અને માનવસભ્યતા, સંસ્કૃતિ-સમાજજીવનના મહાન પ્રવક્તા છે. આજથી ઇસો વર્ષ પહેલાં અભિવૃક્ત થયેલો અવાજ, આજે આપણા આજના કવિએ, પરંપરાના અનુસંધાન સાથે, પોતાની રીતે નવા અવકાશ સાથે, પ્રગટાવી આય્યો છે. કબીર આટલાં વર્ષો પછી પણ આજના લાગે છે એમ ઠાકરસાહેબ, સંભરૂપ કવિ તરીકે આજના છે તે સાથે આવતી કાલ માટેના, વધારે જમા લાગે છે.





## ૩૮. મૃત્યુના માર્દવનું ગાન

દર્શના ધોળકિયા

મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

મૃત્યુ

મા જેવું

મધુર હાસ્ય કરે

અરવ મૃહૃતાથી થપથપાવતું લયબદ્ધ

મેળેટિક રોટેશનનો સ્વીકાર કરાવી

ઉંડી

ગાઠ

ઉંઘમાં

સરી જવાની

રમત

રમાડવા ?

લાભશંકર ગયા. આ સમાચારે રહેલા સૌના જીવનનો એક અંશ જાણે ખૂંચલી લીધો. કેવા લાભશંકર ગયા ? જેવા નકર તેવા. વર્ષો પહેલાં, સ્મૃતિદોષ ન થતો હોય તો 'ફાર્બર્સ'માં 'મરમી માનવગુરુ મીરાં' વિશે મારો લેખ પ્રસિદ્ધ થયેલો. ન એ પછી પરિષદ્ધના અધિવેશનમાં અચાનક લાભશંકર મને પ્રત્યક્ષ થયા ! બંને પહેલી જ વાર મળીએ. ને તેમના ચહેરા પર પ્રસન્નતા લીંપાઈ ગઈ. અમારા પરિચયનો તાર સાંધવામાં મીરાં ને મંજુબહેન જવેરી નિમિત્ત બન્યાં. ન એ કાણથી માંડીને પૃથ્વીના જણ ન લાગે તેવા લાભશંકરે આ પૃથ્વી પરથી મુકામ ઉઠાવ્યો ત્યાં લગણ મારાં લગભગ દરેક લખાજા નિમિત્તે એમનો રણકદાર સાદ મારા ટેલિઝ્નેન પર રણકતો રહીને મને સાદ પાડતો રહ્યો, વિદ્યાતપ તપવા પ્રેરતો રહ્યો, નવું નવું વિચારવા પડકારતો રહ્યો. ન સચવાતો રહ્યો મારા કર્ષાપટલમાં કાયમને માટે. આ સાછનો નાશ થઈ ન શકે. હા, કહેવું હોય

તો લાભશંકર ઠાકરને માટે કહી શકાય કે, એ ઠરી શકે મૃત્યુએ લાભશંકરને દાર્યા છે. લાભશંકરનું ઠરવાનું ધામ એટલે મૃત્યુ.

લાભશંકરનો ચહેરો જેમના સાથે મળતો આવે એવા કેટલાક જગ્યે જીવતાંજીવત જ મૃત્યુનો પરિચય મેળવી લિધો છે. ‘ભરતાં પહેલાં જા ને મરી’ કે ‘મૃત્યુ નામ પરપોટો મરે’ કહેતા અખાએ જીવતેજીવ મૃત્યુનું અતિકમણ કર્યું. અખાના ચાહક ને લાભશંકરના ગુરુ ઉમાશંકરે ધબકતા શ્વાસની વચાણે ‘મૃત્યુ સાથે હાથ મિલાવવા’ની રેષ્ય કરી છે. અખો અને ઉમાશંકરની લગોવગ લાભશંકરની શોધ પણ રહી છે ‘મૃત્યુ નામ પરપોટા’ની ચકાસજીની.

તા. ૬-૧-૨૦૧૬ ની સવારે મૃત્યુમાં ઠરેવા લાભશંકરની ૧૯૮૪માં બરોબર બત્રીસ વર્ષ પહેલાંની ધખના છે અંદર ઊતરવાની. અર્થાત્ મરવાની. (‘મરી જવાની મગ્ના’ શીર્ષક આમ જ આવ્યું હો ) ‘સર્જકની આંતરકથા’માં પોતાની આ ધખના વ્યક્ત કરતા લાભશંકર ધખતાં ધખતાં નોંધી છે : ‘વળી એક નિર્ભમ, બિનંગત, સાક્ષી જેવું, જલકમલવત્ત પ્રાણી અનુભવાય છે અંદર, અનિદિત, નિષ્પલક; તગતગતી આંગ્રેવાળું, જેને આમ શબ્દમાં રૂપાંતરિત કરવાના પ્રયત્નો હજુ ક્યાં પૂરા થયા છે ? ધડુ ધડુ ધડુ ધડાકા સાથે કવચ તોડવાનાં છે બધાં શબ્દચેતનનાં અને પ્રવેશતા જવાનું છે અંદર – નિસરણી મૂકીને પગથિયાં ઊતરતાં ઊતરતાં, ક્યાંક ભૂસકા મારીને, ક્યાંક સરિસૂપ સરકતાં, સાવધાન, નકશા વિના, છેક મૂળિયાં સુધી... કામે લાગી ગયા છીએ. કીડી કણ શોધવા નીકળે એવું કંઈ નથી આ....” (‘સર્જકની આંતરકથા’ આવૃત્તિ પ્રથમ, પૃ. ૭)

જીવનના પાંચમે દાયકે જે જણ મૂળિયાંની શોધ કરવા નિસરણી મૂકીને અંદરનું દ્વાર ખોલવા અવતરણ કરે એવી શોધ જીવતરણાં કેન્દ્રી જ હોય ને ? એનું એક નામ જો જીવન હોય તો એની લગોવગ બીજું નામ મૃત્યુનું જ હોય ને ? ને આ તો ભાઈ, લાભશંકરનું મૃત્યુ. એ બિહામણું તો ક્યાંથી જ હોય ? એ તો છે મા જેવું મધુર, માર્દવયુક્ત, સ્મિતસમર, પ્રસાન્ન, અલૌકિક.

લાભશંકરના બાલ્યકાળથી આ બે જણ એમની આંગળી પકડીને એમની સાથે ચાલતાં રહ્યાં છે. મા અને મૃત્યુ ‘મ’ માનો ને ‘મ’ મૃત્યુનો. મૃત્યુમાં માતાને નિખળતા લાભશંકર પોતાનાં મૂળિયાં ફંઝોસતાં જોઈ શક્યા છે તેમ, પોણાયો ઈંલ લયના અવિરત સ્થિયનથી. બા મારી હલકથી ગાય. ગળામાં મીઠાશ. વત-પ્રસંગોનાં અઢળક ગીતો એને કંઠસ્થ. ક્યારેક પરોઢિયે ઘંટી દળતાં ગાય. મારું માથું નિરાંતે જોતી હોય, પાંથીએ પાંથીએ એની તર્જની ફેરવતી હોય ત્યારે આગ્રહ કરીને ગવડાનું.’ (સર્જકની આંતરકથા, આવૃત્તિ પ્રથમ, પૃ. ૧)

માતા ને લય લાભશંકરનો રોગમાં લોહી બનીને વહેતાં રહ્યાં. મૃત્યુને બાયમાં સમાવવાની આગળી કષે મૃત્યુએ કવિને કંઠ લંબાવેલા હાથને અપલક નેત્રે તાકી રહેલા લાભશંકરની સ્વગતોક્રિત છે આ કાવ્ય :

મૃત્યુ  
મા જેવું  
મધુર હાસ્ય કરે.’

માતા જો જીવનનો આરંભ તો મૃત્યુ જીવનનો અંતિમ વિરામ. આરંભે પણ પ્રસન્નતા ને અંતે પણ સ્થિતનો ઉજાસ. જન્મ આપનાર પણ મા ને જન્મ પૂરો કરનાર મૃત્યુનું રૂપ પણ મખમલી નજકતથી સભર, સહાસ્ય, સુકોમળ, મસૂશા. માની જેમ દોડી આવેલું આ મૃત્યુ માત્ર સ્થિત કરીને જ અટક્યું નથી. કવિને ગોદમાં લઈને માની જેમ જ અમને થપથપાવીને એને પોતામાં ભેળવવા, એકાકાર કરવા એ પલાંઠી લગાવીને બેસી ગયું છે :

‘અરવ મુદ્દુતાથી થપથપાવતું લયબદ્ધ’. વિલય થવાની કાણનો આ લય છે. અથવા તો કહો કે વિલય થવાની અનુભૂતિ. કવિને માટે તો આ થનગનાટ એક આદિમ અનુભૂતિ છે. કંઈ આજકાલની નહીં; મા, રામનવમીને દિવસે ઊછળતું-ગાતું ખેડૂતવૃંદ, ગામનો ચીથેરેહાલ ગાંડો, ગામનો છોકરો દામલો આ બધાને અનિમેષ આંંખે એક-કાને જોઈ-સાંભળી રહેલા કર્તિ કહે છે તેમ : ‘અમના શાલ્લયોના તંતુએ તંતુએ મારી લયચેતનાનાં રેશમ વજાયાં છે... આવું આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવજાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં બાના વહાલબર્યા મીઠા કંઠથી...’ (સર્જકની આંતરકથા, પૃ. 2)

અંદર ઊતરીને ચેતનાના પ્રદેશને ફંઝોસતા કવિ માટે માતા ને લય મૃત્યુ સાથે કમશા: ભજતાં રહ્યાં, કવિને થપથપાવતાં રહ્યાં. જુઓ તો ખરા - કેવી રીતે ? ‘અરવ મુદ્દુતાથી.’ બિલકુલ અવાજ કર્યા વિના, પુષ્પ-શી કોમળતાથી.

કવિને મુદ્દુતાથી થપથપાવવા પાછળનો મૃત્યુનો આશય શો છે ? ‘મેનેટિક રોટેશનનો સ્વીકાર કરાવવાનો.’ મૃત્યુનું જીણો કવિને ચુંબકીય આકર્ષણ રહ્યું છે. કવિ જીવનની ધરી પર મૃત્યુની આસપાસ ફરતા રહ્યા છે. જીવતાં જીવતાં મૃત્યુનો આરાધાતા રહ્યા છે. કવિને મન મૃત્યુ જીવનનો અંત નથી. એ તો છે એક વર્તુળાકાર ભમણ. મૃત્યુ એક ભૂમિકા પૂરી કરાવે છે ને તત્કષણ આરંભાય છે બીજી ભૂમિકા. પુનર્જમન નહીં, પણ નવસર્જનની ભૂમિકા. જર્જરિતનું ખંડન ને નૂતનનાં મંડાણ. જીવનની નિત્યનૂતનતા અખંડ, અવિરત, અવિરામ ચાલતી રહે છે ને એની લગોલગ માતૃત્વની નિત્યતા સંકળાતી રહે છે.

સ્વાભાવિક રીતે જ અહીં પુનરપિ જનન, પુનરપિ મરણમ્ની વેદના નથી, જન્મોજન્મ અવતારની ધન્યતા છે, જેનાં મૂળમાં જીવનના અખંડતવને પામવાની મથામણ ને પ્રસન્નતા બંને પડેલાં છે.

આવાં મેનેટિક રોટેશન પૂર્વની આવશ્યક શરત છે ઊંડી, ગાઢ નિદ્રા. સ્વર્ણ જાગરણ માટેની આ પૂર્વશરત છે. સમય પાકયે જ આ ગાઢ ઊંઘમાંથી બહાર અવાય. ત્યાં સુધી તો લાંબો વિરામ. એટલે જ મૃત્યુ વિશેના એક બીજા કાવ્યમાં કવિ કહે છે :

“મૃત્યુ લપાઈને સૂટું છે  
 ઘસઘસાટ  
 ઊંઘણું મારી ઊંઘના પડખામાં.  
 ના -  
 નથી જાગવું  
 એય ભલે ઊંઘણું ઘસઘસાટ.”

(‘પરબ’ એપ્રિલ, ૨૦૧૩)

એ મૃત્યુ જ્યારે કવિના પડખામાંથી જાગ્યું ત્યારે એનું થયું માના પડખામાં રૂપાંતરણ. જાગીને એણે કવિને હાથમાં નહીં, ગોટમાં લીધા ને માતાની ગોટમાં તો શું હોય ? નિર્ભયતાપૂર્ણ નિરાંત. જીવનભરના થાકથી હાશકારો. આ હાશકારો છુટકારાનો ન જ હોઈ શકે. જીવતરની વિલિન્ ભૂમિકાઓ પસાર કર્યા પછીની પ્રસન્નતાનો. અથક ચાલ્યા પછી અટકવાનો. શાસ છોડતી વેળાએ ખાલી થઈ જઈને નિરાંતનો ચાસ લેવાનો.

મૃત્યુએ મા બનીને કવિને આપી છે આવી નિરાંત. તેથી જ આ મૃત્યુ એ જીવનનો અંત નથી. અન્ય રમતોની જેમ આ પણ એક રમત છે. જેમ જાગવાની રમત તેમ સૂવાનીય રમત. સૂઈને જાગવાનું, જાગીને સૂવાનું. આ રમત રમતાં મૃત્યુ ને કવિ બંનેને પરી ગયેલી મજા અહીં લયનો હિલ્લોળ બનીને સહદયને જીલાવતી રહે છે.

એક સમયે લાભશંકરનાં માતાએ આ પુત્રને પારણામાં જીલાવતાં ગાયેલું :

‘હલુલુલુ હાલમાલ રે ભઈ પારણિયામાં પોઢ્યો,  
 ખીચડી ખાલમાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો.’

પુત્રને વાત્સલ્યથી પોઢાડતી માતાની જગા જીવતરના વર્તુણાકારના કેન્દ્રબિદ્ધુએ પહોંચતી વેળાએ મૃત્યુએ લીધી ને સૂતાં સૂતાં, લયને અવિરત જીલતા રહેલા કવિ જાગતા ગયા, જાગતા રહ્યા ને’ અગોચર અંતરિકમાં ઊત્તરવાની એમની ઉત્કર્ષ પરિતૃપ્ત થઈને ઠરી મૃત્યુરૂપી જીવતરના અંકમાં.



## ૪૦. એ કેવળ સ્વકેન્દ્રી કવિતાના કવિ નથી

પ્રવીષ પંડ્યા

### ઘેરું છે

ઘેરું છે. ઉઠતાં વાર લાગે.  
પણ તને ઉઠાડ્યે છૂટકો.  
તારી ઊન ઉતારવાની છે,  
જેમ બધાંની ઉતારવાની છે તેમ.  
સિઝન છે ઊન ઉતારવાની..

હા

આગળ ચાલે છે બધાં તેની પાછળ પાછળ ચાલ.  
શિયાળે શીતળ વા વાય  
ઠરી જાય ગાત્રો ડિમોક્સીનાં  
તે પહેલાં  
તારી ઢંકયેલી ખાલને નજીન કરવાના સરિયામ સત્યમાં  
તારો ફાળો  
ઊનનો.  
તારો મતાવિકાર ખાલ ઉતારનારાની પસંદગીનો.  
એમાં તારી પાસે જ નથી તે ગુમાવવામાં ભય નથી.  
તારાં ફાંફાં  
એક ઘેરું બની રહેવાનાં અકબંધ રહેશે.

ગુજરાતી સાહિત્યના સંદર્ભે ૧૯૨૦થી લઈને ૧૯૪૫ સુધીના સમયને વૈચારિક પ્રભાવને આધારે  
જો આપણે 'જાંધીયુગ' કહેતા હોઈએ તો ૧૯૪૫થી લઈને ૧૯૮૦ સુધીના સમયને ભાષા-  
શૈલી-વિચાર અને રચનારીતિના આધારે 'લાભશંકર યુગ' કહેવામાં આપણે સહેજ પણ છોછ

કે સંકોચ ન રાખવો જોઈએ. છંદાવંકારથી લદાલદ વિચારધારા, ઉપહેશ અને પ્રચારની મેટસ્ટિતાથી અદોળી બની ચૂકેલી ગાંધીયુગના બીજા છેડાને કવિતાને ભઠિયાર ગળીનાં ગંધધૂમાડા, ટોળા અને ઘોઘાટમાં પ્રકટેલી કવિઓની નવી પ્રજ્ઞતિએ ફુર્લભ વળાંક આપ્યો હતો. આ વળાંક ‘માણસની વાત’થી આરંભાયો હતો, ‘મહા માનવ’ની આસપાસ ચાચ્યી કવિતાને લાભશંકર ‘અદ્ધના માણસ’ પાસે લાવીને ઊભી રાખે છે એ એમની કવિતાની વિલક્ષણતા છે. આપણે સહુ સહેજ થોલ્ને વિચારીશું તો આપણને ચોક્કસ એવું લાગશે કે સાહિત્યિક રીતે ઉમાશંકર પછી એમનાં કદ-કાઠીને ઝાંબે એવું સ્વબળે પ્રકટેલું નામ એ લાભશંકર ઠાકર છે.

આપણે સહુ લાભશંકરને સ્વકેન્દ્રી અને વ્યક્તિલક્ષી કવિતાના જ કવિ ગણીએ છીએ. એમની કવિતા વિશે ખાસ કરીને ‘લઘરો’ અંગે એવી બુમરાજ પણ મચી કે તેઓ નકારના કવિ છે. એ જાતનો પણ નકાર કરે છે. મને ‘રે’મથ અને હોટલ પોઅટ્રેસ જેવાં જૂથ રચીને પોતાની વિશિષ્ટ અને વિલક્ષણ છાપ ઉપસાવવા મથતા અમારા પહેલાંની પેઢીના કવિઓમાં હુંમેશાં કુતૂહલ અને શંકા બને રહ્યા છે. કુતૂહલ એ કારણો કે તેઓ સાહિત્ય-સર્જનમાં હુંમેશાં નિતનવા અને ચોકાવી મૂકે એવા પ્રયોગો અને વિધાનો કરતા, અને શંકા એ કારણો પણ રવ્યા કરતી કે આ જે કંઈ તેઓ પોતાના સર્જનમાં કે સાહિત્યના સંદર્ભે કહી રહ્યા છે એમાં તેઓ કેટલા ગંભીર છે ? આમાં સ્વાનુભૂતિનું તત્ત્વ કેટલું અને આંધળા અનુકરણની બેળસેળ કેટલી ? મોટો કવિ એટલે પણ મોટો હોય છે કેમ કે એના હાથમાં શબ્દનો રણકતો સાચો સિક્કો હોય છે. લાભશંકરે અને પછી સિતાંશુએ આધુનિકતાનાં પ્રમુખ લક્ષ્યણોને આત્મસાત્ત તો કર્યો જ છે પણ પ્રમાણિકતાથી નભાવ્યાંય છે, જેમ કે ધર્મ સંસ્થા માટેનો અને પોતે ધાર્મિક અર્થમાં આધ્યાત્મિક નથી એવો એમનો ચોખ્યો નકાર ‘નરસિંહ મહેતા પુરસ્કાર’ના અરસીકારમાં પણ દેખાય, જ્યારે એમને અડીને ઊભેલા બીજા આધુનિકો એ પુરસ્કાર માટે પોતાનો ‘સ્વર્ધર્મ’ (આધુનિકતાના પાયાના સિદ્ધાંતો) છોડીને લાગલા દોડી જતા પણ દેખાયા છે.

‘ઘુંઠું છે’ કવિતાનો આસ્વાદ કરાવતી વખતે આવી અને આટલી ભૂમિકા એટલે બાંધવી પડી કેમ કે લાભશંકરની આધુનિક અને કાયારેક બુર્બુધ લાગતી કવિતાને સમજવાની ચાવી એમની ‘શબ્દશ્રદ્ધા’માં છે જે એમની રચનાને જીવંત બનાવે છે. ઘેટાં પર કવિતા તો આ પહેલાં પણ થઈ છે, કેટલાક અંધશ્રદ્ધા આધુનિકોના ઈછદેવ એવા સુરેશ જોખીની ‘એક રાહ’ કવિતામાં પણ ઘેટાં અંગે આ પ્રમાણોની પંક્તિઓ જોવા મળે છે :

‘ઘેટાં અને બકરાંની રાહ / અંગે લગાડી બહુ રંગ છાપ, / જાણ્યા વિના કે શાશગાર શાને / ચાલી જતી જોઉં હું કટ્લખાને’ – અહીં સુરેશ જોખી ઘેટાં-બકરાને ‘ઈતર’ ‘ઉણાં’ અને ‘અજ્ઞાની’ ગણે છે. માણસપણાને ઘેટાંપણાથી છૂટું પાડવાનો પ્રયાસ કરે છે. એમના આ અભિગમથી તદ્દન જુદ્દો અભિગમ લાભશંકરમાં છે. કાવ્યનો ઉપાડ જુઓ :

‘ઘુંઠું છે, ઊઠતાં વાર લાગે. / પણ તને ઉઠાડ્યે છૂટકો.’

આહી ‘તને’ શબ્દ મહત્વનો છે. લાભશંકર ઘેટાં માટે તને શબ્દ પ્રયોજે છે એનો અર્થ માત્ર અને માત્ર એ જ થાય કે આ ઘેટું લાભશંકર નામનો બીજા અનેક જેવો એક સામાન્ય માણસ છે અને કવિ લાભશંકર એને આ કહી રહ્યા છે. એમની પહેલાંના સુ. જો. અને પછીના મારા જેવા કવિ. ‘ઘેટાં’ને કટાક્ષ, વંગ અને ઉપહાસથી જાતથી અગળા કરી જુઓ છે. આ દસ્તિકોણમાં કવિ હોવાની ‘ગુરુતાપ્રણિ’ પણ ભણેલી છે, પણ આપ જોઈ શકશો કે અહીં કવિ લાભશંકરને ઘેટાં માટે એવો કોઈ ભાવ નથી પણ એક પ્રકારનો સ્વીકાર છે. જન્મગત મેળેલી ન ટાળી શકાય એવી ઘેટાંપણાની પીડા માટે ઊંડી કરુણા છે. અને એટલે લાભશંકર બ્લેક વ્યૂમરના કવિ છે. આ બ્લેક વ્યૂમર પણ આધુનિકતાની દેણ છે. અહીં યુજિન આયોનોસ્ટિકના ‘ચાહ્યોનોસિરસ’ના નાયક કે કાફ્કાના ‘મેટામોર્ફોસિસ’ના નાયકની સ્થિતિ પર જેમ પહેલા તમને સહેજ હસવું આવે પણ પછી તમને ખબર પડે કે આ તો મારી સ્થિતિ છે, આ તો હું જ છું – અને પછી તમારામાં જે કરુણા કે જીવન પ્રત્યે નિર્વેદ જાગે એ સ્થિતિ લાભશંકર પોતાની રચનાત્મકતા દ્વારા સર્જે છે. કેવો નમ્ર સ્વીકાર ‘ઘેટું છે. ઊર્કતા વાર લાગે. પણ તને ઉઠાડ્યે છૂટકો.’ આ ‘છૂટકો’ શું છે ? લાભશંકરના અનેક કાવ્યનાયકોમાં જીવનની સ્થગિતતા અને એકવિધતામાંથી છૂટકો મેળવવાનો ભાવ તીવ્રતાથી દેખાય છે. આ છૂટકો એટલે મધ્યકાલીન કવિતાનો મોકાની પણ આધુનિક કવિતામાં ‘માણસ હોવાની’ જે પ્રકૃતિદત્ત પીડા મળી છે એમાંથી છૂટવાનો તલસાટ છે. અને એટલે જ કવિ કહે છે ‘તને ઉઠાડ્યે છૂટકો’ આ ઊર્કતું પણ જાગવું છે. બીજા અર્થમાં જોઈએ તો માણસની નાગરિક તરીકેની અકર્મજીવતા અને આગસ છે તેનો પણ એમાં નિર્દેશ છે.

‘તારી ઊન ઉત્તારવાની છે, / જેમ બધાની ઉત્તારવાની છે તેમ.  
સિઝન છે ઊન ઉત્તારવાની.’

ઠાકરસાહેબની કવિતાની બીજી મોટી ખાસિયત એ છે કે એમાં ગજબની સાહજિકતા અને તાજગી હોય છે. ઊંઘતા ઘેટાને જગાડ્યા પછી કવિ હોવે ઊન પર આવ્યા, ફરી અહીં એક બીબાંડળ જીવનમાં જડબેસલાક રીતે ઝીટ થયેલા માણસની અકળામણને કવિ હળવાશથી નિરૂપે છે. આ ઊન શું છે ? આ રચના મને એટલે પણ આર્કો છે કેમ કે પહેલી વાર લાભશંકર વ્યક્તિની પીડાને સામાજિક-રાજકીય રીતે જુઓ છે. એટલે જ તો કહે છે :

‘હા. / આગળ ચાલે છે બધાં એની પાછળ પાછળ ચાલ. / શિયાળે શીતળ વા વાય  
/ ઠરી જાય ગાત્ર ડિમોક્રસીના. / આ ઘેટાની વાતમાં ‘ઠરી જાય ગાત્ર ડિમોક્રસીના’ જેવું વાક્ય લોકશાહીને ગાત્ર તો આપે છે પણ થીજી ગયેલા ! આ પંક્તિઓ પાસે ઊભા રહીને જોઈશું તો ખબર પડશે કે ડિમોક્રસીના ઠરી ગયેલા ગાત્ર એટલે સંવેદનશીલતા ગુમાવી બેઠેલી ડિમોક્રસી, એના ગાત્ર ઠરી જાય તે પહેલાં ઘેટાંએ કશુંક કરવાનું છે, શું ? તો કહે કે :  
‘ / તે પહેલા / તારી ઢંકાયેલી ખાલને નજન કરવાના સરિયામ સત્યમાં / તારો ઝાળો

/ ઊનનો. / તરો મતાપિકાર ખાલ ઉતારનારાની પસંદગીનો /

શું આમ વારેવાર પોતાનું ઊન ઉતારવાથી અને ખાલ ઉતારનારા પસંદ કરવાથી થીજ ગયેલી ડિમોક્રસીના ગાત્રોમાં ગરમાવો આવશે ?

અંતે કવિ કહે છે :

‘તારા ફાંઝાં / એક ઘેટું બની રહેવાનાં અકબંધ રહેશે..’

‘ઘેટું છે’ એક નાનકડું કાબ્ય છે. પણ આ નાનું એવું કાબ્ય કર્મકંડ બની ચૂકેલી લોકશાહીમાં નાગરિકમાત્રનાં ઘેટાં બની જવાની વ્યાપક પીડાને નિરૂપે છે. મોટો કવિ પોતાના પદધાયા બધાર ડાંફ ભરતો હોય છે એનું પ્રમાણ પણ આ કવિતા છે કેમ કે લાભશંકરને વ્યક્તિ-કેન્દ્રી કવિતાના કવિ કહેવામાં આવે છે પણ અહીં એ સમાજકેન્દ્રી અને નાગરિકકેન્દ્રી બને છે. મારી સામે ઊભેલા આદમકદ કવિ લાભશંકરને નમન.

## સાભાર સ્વીકાર

### પ્રક્રીષ્ટ

(૪૮) ગીતા સ્વાધ્યાય (ગાગરમાં સાગર) : આદેખન : અરવિંદ પી. મહેતા, ૨૦૧૫ (બીજું આ.), લેખક પોતે : ત૬, અરુણોદયપાર્ક, નવરંગપુરા, અમદાવાદ-૮, પૃ. ૫૬, રૂ. ૩૦ (૪૯) અસિતત્વની અભિવાઈની અનુભૂતિ (કબીર વિચાર દર્શન) : ૨૦૧૫, લેખક પોતે, ત૬, અરુણોદય પાર્ક, નવરંગપુરા, અમદાવાદ-૮, પૃ. ૧૦૦, રૂ. ૬૦ (૫૦) સુંદરકંડ (નૂતન અનુસર્જન) : અરવિંદ પી. મહેતા : ૨૦૧૫, લેખક પોતે, ત૬, અરુણોદય પાર્ક, નવરંગપુરા, અમદાવાદ-૮, પૃ. ૪૪, રૂ. ૪૦ (૫૧) પંદરમું રતન : કલ્યાણ દેસાઈ, ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરલ કાર્યાલય, અમદાવાદ, પૃ. C+૧૬૦, રૂ. ૧૨૦ (૫૨) સ્વી સંવેદનાની કશમકશ : અનિતા મહેતા, ૨૦૧૫, હર્ષ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૪+૧૫૪, રૂ. ૧૮૦ (૫૩) રંગભૂમિ-૨૦૧૪ : ઉત્પલ ભાવાણી, ૨૦૧૫, ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૬૮, રૂ. ૧૫૦ (૫૪) શેરબજારમાં આપણે નિષ્ફળ શા માટે જઈએ છીએ : જ્યેશ ચિત્તવિદ્યા, ૨૦૧૫, ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ., મુંબઈ/અમદાવાદ, પૃ. C+૨૦૮, રૂ. ૨૦૦ (૫૫) જૈન સાહિત્યની પરિભાષા : સંચા. કવિન શાહ, ૨૦૧૫, હાલોલ જૈન સંઘ, નવકાર આરાધના ભવન, હાલોલ, પૃ. ૧૨+૧૩૨, રૂ. ૧૨૫ (૫૬) ગા મેરે મન ગા : ડૉ. પ્રકુલ્પ દેસાઈ, ૨૦૧૫, સાહિત્ય સંકુલ, સુરત, પૃ. ૨૦૦, રૂ. ૧૮૦ (૫૭) મહિતે ચાહી ના આમિ : રાજેન્દ્ર પટેલ, ૨૦૧૫, ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૪+૧૮૬, રૂ. ૧૮૦



## ૪૧. ઉત્તરફળની એક ઉત્કટ શોધ

રજેન્ડ્ર પટેલ

પ્રશ્ન

સર, આપે પૂછ્યું કે હું લંગડાઉં છું કેમ ?  
તે તો સર વા છે

વાર્ધક્યને કારણે  
અને આમ સતત આવી ઉત્તરકાંઠાની  
રજળપાટને લીધે.

તે તો છે સર. હોય.

જે આપ કંઈ બોલ્યા ?

હું હું... હું...

અરે સાહેબ રજળપાટમાં શોપિંગ કરવાનો

સમય મને

ના મળ્યો કદ્દી.

તેથી વસ્તુરહિત છું.

ન ટેવાઈ ગયો છું.

ને ઢાંકવા જેવું પણ શું છે ?

આ નિત્ય નગનધાકોર જિશાસાને ?

કોઈ ઉદ્દેશ વગર કે કોઈ તુલના વગર

લંગડાતો

લંગડાતો ઊંચ્યકિને ફરું છું

પ્રશ્ન.

સામસામે રાખેલા અરીસામાં

પડતાં

endless પ્રતિબિમ્બોને  
 પૂછી પૂછીને  
 આવ્યો છું.  
 લૂધી લૂધીને અંતઃકરણના  
 અરીસાને  
 પૂછતો રહ્યો છું હું.  
 જેના ભૂતલમાં અંદર  
 સદીઓથી ઊંઘતા  
 પાપોને જગડીને મેં પૂછ્યું છે  
 ને અજવાળાની નીકોમાં વહેતા  
 મારા પરંપરાના બધિર  
 બોબડા  
 પડછાયાને પૂછ્યું છે.  
 પુઝયના ખોબામાં નિર્નિમેષ  
 તાકીને  
 પૂછ્યું છે લૂંટાઈ જવાના ભય વગર  
 અંધારી આલમમાં  
 રાત પછી અધરાતે  
 મધ્યરાતે  
 રેડ લાઈટમાં વર્તમાનની ભીંતો પર  
 હુલબલતા  
 વસનરહિત પડછાયાને  
 ઊંચકીને;  
 જે  
 પુઝયના ખોબામાંથી ઢોળાઈ જતા  
 દશ ધારે.  
 તોળ્યા ના તોળ્યાય કદી  
 તુલનામાં  
 કોઈ.

મરણોન્મુખ પિપાસાના ઉત્કઠમાં મેં  
 માટી  
 નાખી છે ઉત્તરને ઉગાડવા.  
 ફૂટતાં ઊગતાં  
 મરણને ઊગશે ઊગશે  
 ઉત્તરફળ  
 તેવી પ્રતીક્ષામાં મેં  
 નિનિમેષ તાક્યું છે.  
 કુર નથી હું.  
 હું તો હું મજબૂર.  
 શૂર નથી  
 ધડથી ધૂટા પડયા પછીયે તાકયા કરતી આંખોવાળો તે  
 જે  
 આયનામાં ઊભો છે  
 અંગન  
 ધડ વગર તાકતો  
 અંદર  
 અથવા બહાર  
 ઉત્તરની આશામાં.  
 સદીઓની સદીઓથી  
 નદીઓની  
 નદીઓમાં નદીઓનો  
 હાલકડોલક હિસાબ છે -  
 શ્રીમદ્ ચદ્રવતો વાદનનો  
 કાન્દૂબ  
 રંજનનો  
 મન હરણ થઈ  
 વીંધાઈ ગયાનો.  
 હા, સર તર ઉત્તરનો આવે તો ના નૌકાનું કામ.  
 ના નદીઓના  
 સદીઓના હિસાબનું

કુર્દ કામ.

ના સર, હું મનરંજનવિદ્ધ નથી.

સિંહ જેવાએ મેં ઘેડું બનીને પરંપરાની

પાછળ પાછળ

ચાલ્યાં કર્યું છે એમ નથી.

યથાસમય અટકી ગયો છું

સ્વયં

સ્વેચ્છાથી પરંપરાથી

બટકી ગયો છું.

અને જખમી થયેલો વાઘ ધસતી વખતે

શિકારીના

ભાલાને

ગણકારતો નથી તેમ મેં

કોઈ પણ વિધાતક પ્રતિકારને ગણકાર્યો નથી -

એ જાણવા

કે શું છે મારો જવાબ.

ઘાતકી થવું સહેલું છે, સર

પોતાનો ઘાત કરવો સહેલો નથી..

મેં

સતત મને ઉન્મૂલ કરી

ખોટ્યો છે

ધખનામાં ઉત્કટ

જવાબની.

મારા જ લોહીમાં

ભમી ભમીને ઘોંઘાટોમાં

કાન

મારા બહેરા થઈ ગયા છે.

મેં કર્મ માત્રને બાળ્યાં છે

નિર્લિપ્ત થવા

મારી દસ્તિસૂચિના

વિસ્તારોમાં

૨૩૫૩.

દેશકળને પરાધીન કરી મેં

સ્વાધીન

સૂતેલી

શ્રદ્ધાના આશયને અતિલ

ઉલેચી નાખ્યો છે.

કથ્યાગરી ભાષા આપી પર

ત્રાસ ત્રાસ

વરતાબ્યો છે.

ધોરી માર્ગ ઉજ્જવ કરી નાખ્યા છે.

કડકા સાથે

સિસુક્ષાના ઘનઘોર

તૂટી પડ્યો છું -

કાગળની હોડીમાં બેસી નીકળેલા

અંતઃસોત્રાનાં આભાસી જળમાં -

સદીઓથી સરતા

મંગળ જેવા

વિરોષણોના પડધાઓ પર.

સંબંધોના સ્નેહસ્પર્શની

માયાની મમતાની

ઘટાટોપ મનઃસ્થલીઓ

મેં બાળી છે

મારામાં ભડભડ

પામવા ઉત્તરને

જિજ્ઞાસાથી જૂમ કરીને દસ્તિને.

પાપીનું વહાણ પણ સમુદ્દ્ર તરી જાય છે.

મેં તો પુષ્પના સમુદ્રને

આકંઠ

પીધો છે અને

મૂતરતાં

મૂતરતાં મારી તૃપ્તિ તવપત્તિ

જિજ્ઞાસાને

તન્મય કરી છે

અર્થોટક્ટ

એકાદશ ચાંપોને ચુપચાપ

દબાવતાં -

મારી ઘનધોર બિનંગત એકલતાની

લોબમાં.

યસ સર, અસ્તબ્યસ્તના ઓટ્ટસને

એના સબપાર્ટિકલ્સને

નિશ્ચયના ચીપિયાથી પકડચા છે

ઉત્તરને

હસ્તામલક કરીને તાકવા.

અને સમજાયું છે :

ના ના, આ તો અટકચાળાં છે

પલાયન છે

પ્રશ્નથી દૂર જવાનાં, એને ભૂલી જવાનાં.

બૂરાઈ

કોઈ પણ બૂરાઈ

નિત્ય રહેતી નથી તે સાચું.

પણ અગેઠન તે તો આડવાત છે.

પ્રશ્નનો ઉત્તર બૂરાઈમાં છુપાયો નથી

કે નથી છુપાયો ભલાઈમાં

સર, આ સ્વાનુભવની એરણના

રણકારા છે.

લાલસા છે, તૃષ્ણા છે

આમ અંદર છે

તેથી તે બહાર છે.

તેને અવળસવળ ઉથલાવી છે  
અંદર

પ્રતપત્ત ભડભડતા ભંડકિયામાં  
લાલચોળ  
જિશાસાથી

અંતે તો ઠરી જવા.

ઇતા

ઠરી ઠામ ક્યાં થઈ છે  
મારામાં

સતત વીંઝતી પાંખોવાળી  
નિત્ય ઉજાગર આંખોવાળી  
ગાંખોવાળી

કાળી ધોળી કાબર ચીતરી  
આભાસોની  
સપાટીઓને ચીખી ચીખીને  
પીંખવાવાળી

ઉત્કટ ઇતાં અનુત્કટ  
આમ

અંગત ઇતાં બિનંગત મારી જિશાસા.  
હા એ જાણો છે સમજે છે.  
લોંગ શૉટથી ખસતા ખસતા

મિડ શૉટમાં

તાકે છે  
બ્રહ્મના અંડને ફૂટતું  
ઉત્તરપંખીને ચાંચ ખોલતું તાકે છે

તરત

જૂમ કરીને કલોકઅપમાં  
ને

કટ.  
કલ્યાનોત્તરો ઊડે છે નીલ નીલ નભમાં  
ને નીચે

મૌનમાં  
 વાણીમાં  
 સ્થળકાલસહિત વહેતી  
 નદીઓનાં  
 સ્થળકાલરહિત  
 વહેતાં ને કહેતાં  
 વહેણમાં  
 માણસનાં.  
 ને નિર્વિશેષ શેખને  
 તાકે છે  
 કણ કણમાં  
 કણ કણને  
 એકસ્ટ્રીમ કલોઝઅપમાં -  
 થરક્યા વગર.  
 ચરકની કણીઓ છે  
 પંખીલોકની  
 ધારેલા ઉત્ત પછીના  
 ઉત્તરની  
 ઉત્તમની  
 પાંખ વગર પણ ઉડતી  
 છાપાની ભાષામાં  
 ને  
 કવિવરની આશામાં  
 જ્યાં  
 અંડ થયું છે છિન્ન  
 ને બિન થયું છે પંડ  
 સજીવ ધબકતા ઉત્તરપંખીનું  
 જે  
 ચાંચ ખોલતું ચરકે છે  
 ખળ ખળ વહી જતી અંતઃશ્રોતામાં.  
 હા કવિઓ આજ સુધી  
 આમ

સતત ચરક્યા છે

ને ચરકે છે

તે પાંખ વગર પણ ઉત્તરપંખી થઈ

ઉડવા માટે;

જેથી ચરકી શકાય.

ઉત્સર્જના

સર્જના સર્જ રચી શકાય

દુર્નિવાર અનુત્તરા

જિશાસાને

ભૂલી જવા

ભૂલી શકાય તો.

ભૂલી જવાના અડાબીડ ઇતિહાસો છે,

સર.

પરના છે, પરાત્પરના છે.

નરના છે, નારાયણના છે.

તરતમનાં

ક્રિઝિયારાં છે

ક્રમશબ્દમણ કરતાં

લાઈનસર.

એકમાત્ર ગોપીજનવલ્લભને વરનારા છે

ને વગર તરાપે ભવસાગર તરનારા છે.

અન્યથા ભાંડ છે ભવાયા છે

ભૂલોકથી

સ્વલ્લોકમાં

મલકારાથી

પલકારામાં

લઈ જનારા.

કે વેદના વારાથી છે મારી

કરોળિયાની

તંતુજાળ

પરબ્ર ફાઈલ જૂન-જુલાઈ, 2016

જિજ્ઞાસાને જિવાડનારી  
જે  
જવવા માટે હું ગળી જાઉ છું નિત્ય  
અને

કહું છું બહાર પાઈ  
જવવા માટે  
નિત્ય.

અનિત્યનાં અડાબીડ અહુંજાળમાં  
આ ભક્ષ્યરહિત ભક્ષક એવી  
મારી એકલતાનો હિસાબ છે આ કાણ સુધીનો.  
છે

પ્રશ્નની મજૂસને તાળું મારી  
ચાવી ખોઈ નાખનારા

મારા પડછાયા  
કરતાલસહિત અથડાતા

મારા અનેકાન્તની  
અવફવની ગલીઓમાં મને જ.  
વળી કોઈ

છે  
કાનતંત્રથી રહિત કાનમાં  
વગાડનારા

મંત્રની ટોકરીઓ  
ટોકરીઓ છે શતસહસ્રજીવી ચાવતી સપનાંઓ  
ડાબલીઓ બોખીમાં

નિત્ય વૃદ્ધ  
ને  
શુદ્ધ.  
અને છે અમૃત સમજુને  
પાન કરનારાઓ  
નિજની અમરતકૂપીમાંથી

ધારોખણ

જીલતા યથાસમય

હા યથાર્થ જ સુપથ્ય તે -

સાચું હોય

હશે

કે છે.

સુપથ્યની ભાષામાં કથ કથ કરી કરીને

શોધું છું હું પથ.

અથથી ખસ્યો નથી આ

તસુએ મારો રથ.

મનોરથ જોડીને

સદીઓથી હણહણવું મારું મારામાં

૫૬ ૫૭ાડતા

કિયા વગરનાં કિયાપદોની જેમ.

ઘાટ ઘડવાના યંત્ર

તંત્ર

ને મંત્ર

પછીના અંતેના હેમના હેમ હોવાના

ને એને દૂરદર્શનથી જોવાના

ને

નિજમાં નિમગ્ન નિજને

નિરંતર

ખોવાનાં

પદ્માસનમાં

હજુ આ કાળ સુધી હું નથી ગયો કચડાઈ.

રાઈનો દાણો છું

નગણ્ય

સર્વથા તુચ્છ

પણ પુરુષ

પ્રશ્નની નાખે છે

ડહોળી

મનવંતરના મનમંથનજળ અંધકારમાં

મારા

થંલ થયેલાં.

સત્તુ પણ નથી અને અસત્તુ પણ નથી.

ઉદ્ધ્વ પણ નથી અને અધઃ પણ નથી

વામ પણ નથી અને દક્ષિણ પણ નથી.

મૃત પણ નથી અને અમૃત પણ નથી.

નિત્ય પણ નથી અને અનિત્ય પણ નથી.

કોઈ દિશાએથી શુભ

કે અશુભ

સુંદર કે અસુંદર

અવાજ

આવતો નથી.

આવતો હોય તો સંભળતો નથી.

સંભળતો હોય તો સમજતો નથી.

તેમ છતાં છે અંધકાર મારામાં.

જ્યાં નથી કોઈ સર, જી હજૂર કે વર.

છે જુણ

દુર્નિવાર બળથી પૂછીને

પછડાતો બંબાકાર

પળ પળ મારામાં માણસમાં.

મને અને આ તને

સતત

તરડાયેલાં ખરડાયેલાં ખંડ ખંડ ખંડિત

દર્પણમાં

ભાષાના : શા માટે હા પૂછ્યા કરું છું હું ?

મેં કમિટ કર્યું છે શું ?

બાઈન્ડ રસેવે સમગ્ર વિચના તમામ પ્રશ્નોને માત્ર ત્રણ પ્રશ્નોમાં વિભાજિત કર્યા છે : મનુષ્યના પ્રકૃતિ સાથેના પ્રશ્નો, મનુષ્ય સાથેના પ્રશ્નો અને મનુષ્યના પોતાની જાત સાથેના પ્રશ્નો. કહિ લાભશંકર ઢાકરનું પ્રસ્તુત કાવ્ય 'પ્રશ્ન' એ રીતે એક વિશિષ્ટ કાવ્ય છે. રસેવે જે ત્રીજા પ્રકારનો પ્રશ્ન ચીધ્યો છે તે અહીં કેન્દ્રસ્થાને છે. પણ કવિ જ્યારે જાતનું ઉત્થનન કરે છે ત્યારે સ્વાભાવિક-પણે બીજા અને ત્રીજા પ્રકારના પ્રશ્નો પણ ઈંગિત થઈ જતા હોય છે.

પ્રસ્તુત કાવ્ય 'પ્રશ્ન'માં કહિ પ્રશ્ન શો છે તે તો કાવ્યની અંતિમ પંક્તિમાં મૂકે છે. કાવ્યાંતે જે ભાષાથી કવિનું આસ્તિત્વ છે, તેના ખંડ ખંડ દર્પણને જ કહિ પૂછે છે : ‘એં કમિટ કર્યું છે શું ?’ આ કાવ્યમાં શબ્દ વડે અશબ્દની શોધ કરતા કરતા કવિની એક પ્રબળ ઉત્કટ કવિ-ચેતના સક્રિય બને છે. સર્જકની પોતાની અધર સેલ્ફ સાથેનો સંવાદ આ કાવ્યમાં રચાયો છે પણ એ સંવાદ પાછળ એક સઘન મથામણ છે. એથીજસ્તો કવિ પોતાના આ પ્રશ્ન સંદર્ભે નર્મદની જેમ બોલી ઊઠે છે :

‘પણ પુછુછુ

પ્રશ્નની નાને છે

ઢહોળી

મનવંતરના મનમંથનજળ અંધકારમાં

મારા

થંભ થયેલાં.’

જે ઉત્તરની ઉત્કટ શોધ કવિ સ્વથી સમગ્ર સુષ્ટિ સુધી કરે છે તે પ્રશ્ન ‘એં કમિટ કર્યું છે શું ?’ એ છે. એક સર્જકનો આ પ્રશ્ન છે. શબ્દ-ચેતના દ્વારા પુછાયેલો પ્રશ્ન છે. જાણો મનુષ્ય માત્રની અનેપદ વૃત્તિ વડે પુછાયેલો આ પ્રશ્ન છે. એટલે જ સમગ્ર કાવ્ય જાણો એક ઉત્તર માટેનો પ્રબળ ધારારો છે. પણ આ કવિના શબ્દકર્મની ઉપલબ્ધિ કંઈક જુદી છે. કવિને મન પ્રશ્નનો જવાબ એ જ હોઈ શકે કે પ્રશ્નનો કોઈ જવાબ નથી ! અને આ વાત જ એક સાચા સર્જકનો ઉત્તર હોઈ શકે. રવીન્દ્રનાથનો મરણશીતર કાવ્યસંગ્રહ ‘શૈષલેખા’માં ‘પ્રથમ હિનેર સૂર્ય’ નામે કાવ્ય છે. કવિને જીવનનો અંતિમ સૂર્ય પ્રશ્ન પૂછે છે...

‘દિવસેર શેષ સૂર્ય

શેષ પ્રશ્ન ઉચ્ચાસ્તિલ

પચ્ચિમ સાગરતીરે

નિસ્તરબ્ધ સંધ્યાય –

કે તુમિ ?

પેલ ના ઉત્તર.’ (શેષ લેખા)

(અંતિમ દિવસના સૂર્યે પચ્ચિમ સાગરતીરે નિઃસ્તરબ્ધ સંધ્યામાં પ્રશ્ન ઉચ્ચાર્યો – તું કોણ

છે ? ઉત્તર પામ્યો નહિ.)

સર્જકનું કામ જ મથામણ કરવાનું છે. એને મન કોઈ અંતિમ સત્ય હોઈ જ શકે નહિ. પોતાના શબ્દકર્મ દ્વારા કવિ નવા નવા રૂપે સત્યને ખોળે છે. લાભશંકર ઠાકર એક એવા કવિ છે જે પ્રબળ ઉત્કટ જિજ્ઞાસાથી પોતાનાં કાલ્યોમાં સતત આ મહામથામણ થકી એક શોધમાં રમમાણ રહે છે. એમને મન કદાચ ભાષા સાધન તો છે જ પણ એના વડે જ ભાષા સાધ્ય પણ ક્યારેક બની શકે એમ છે. જ્યારે એ કાવ્યક્ષણ રચાય છે ત્યારે અસ્તિત્વના ઊંડાણની શોધપ્રક્રિયા ઉદ્ભબે છે. ત્યારે આવાં કાલ્યો રચાત્માં હશે. પ્રસ્તુત કાવ્ય એ રીતે જુદી ભાત પાડે છે. ભાષા એ અસ્તિત્વ માટેનો પ્રાણપ્રશ્ન છે.

કવિ એથી જ જાણો કહે છે :

‘તરડાયેલાં ખરડાયેલાં ખંડ ખંડ ખંડિત

દર્પિણમાં

ભાષાના : શા માટે હા પૂછ્યા કરું છું હું ?

મેં કમિટ કર્યું છે શું ?’

આ કાવ્ય પોતાની જાતને પૂછેલા એક પ્રશ્નના જવાબની શોધયાત્રા છે. કાવ્યમાં એક નાનકડા પ્રશ્નના સંદર્ભે કવિની ઉત્તરશોધયાત્રા ન્રાણ સ્તરે આગળ વધે છે. પ્રથમ સ્તરમાં કવિ જવાબ માટે શું શું કર્યું તેનો નિર્દેશ કરે છે, બીજા સ્તરમાં આ મથામણની પ્રક્રિયા કેવી છે તેની અભિવ્યક્તિ છે અને ત્રીજા સ્તરમાં ઉત્તર માટે કોને કોને કવિ પૂછે છે તેની વાત છે.

પહેલા સ્તરમાં ઉત્તર માટે કવિએ કેટકેટલી મથામણ કરી છે એ છે. કવિ કહે છે :

- કખ્યાળગરી ભાષા આખી પર / ત્રાસ ત્રાસ / વરતાલ્યો છે.
- સુપથની ભાષામાં કથ કથ કરી કરીને / શોધું છું હું પથ / અથથી ખસ્યો નથી આ / તસુઅ મારો રથ.
- સર્દીઓથી હણહણવું મારું મારામાં / પદ પછાડતા / ક્રિયા વગરનાં ક્રિયાપદોની જેમ.

આ કાવ્ય કવિની એક શબ્દ-શોધયાત્રા તો છે. આ મથામણો અને પ્રયાસોમાં મનુષ્ય-ચેતનાની એક ઉત્કટ ઊથલપાથલ છે. કશો પણ ઉત્તર ન મળ્યો હોવા છતાં એક શુદ્ધ જિજ્ઞાસાથી જાતનું સહજ ઉત્થનન કરતું એ જ જાણો સર્જકનું પરમ લક્ષ્ય.

આ વાત ટી. એસ. એલિયેટે ‘ફોર કવાર્ટસ’ના એક ખંડ ‘ઈસ્ટ કોકર’ના પાંચમા ખંડમાં કવિકર્મની શબ્દલીલા સંદર્ભે કહે છે :

For us, there is only the trying. The rest is not our business.

East coker (T. S. Eliot)

(આપણે તો કેવળ મથ્યા જ કરવાનું. બાકીની ન કરવી પંચાત.)

કવિનો ધર્મ મથામણ કરવાનો છે. બીજું કોઈ કામ એનું નથી.

કવિ આ કાવ્યમાં આ વક્ષપ્રશ્નના સંદર્ભે ઉત્તર માટે ક્યાં પ્રયાસ કરે છે એ કાવ્યત્વનો આરસાદ ગીતવા જેવો છે : કવિ કોને કોને આ પ્રશ્નનો જવાબ મારે છે જે કાવ્યનું બીજું સ્તર દર્શાવે છે :

- સામસામે રાખેલા અરીસામાં / endless પ્રતિબિંબોને / પૂછી પૂછી જોયું.
- લૂધી લૂધીને અંતઃકરણના અરીસાને પૂછ્યું.
- ભૂતલમાં અંદર / સર્દીઓથી ઉંઘતાં / પાપોને જગાડીને મેં પૂછ્યું છે.
- અજવાળાની નીકોમાં વહેતા / મારા પરંપરાના બધિર / બોબડા / પડછાયાને પૂછ્યું.
- પુષ્યના ખોબામાં નિનિમેષ / તાકીને / પૂછ્યું છે.
- અધરાતે / મધરાતે / રેડ લાઈટમાં વર્તમાનની ભીતો પર હલબલતા / વસનરહિત પડછાયાને / ઊંચુકીને.

પણ કવિ સુપેરે જાણે છે કે ઉત્તર ક્યાં નથી.

- બૂરાઈમાં છુપાયો નથી / કે નથી છુપાયો ભલાઈમાં / સર, આ સ્વાનુભવની એરણના / રણકાર છે.

વાસ્તવમાં કવિની નિજ મુદ્રા તો તેની ઉત્તરફળની ખોજમાં છે. પ્રસ્નના જવાબ માટે કવિ ક્યાં જાય છે અને કવિચેતના ઉત્કટ જિજ્ઞાસાથી કેવા કેવા આચામો રચે છે એ ખૂબ રસપ્રદ છે. એ પ્રક્રિયા જ જાણે નરી માણસની માણસ બની રહેવાની મથામણ છે. જવાબ માટે કવિ શું શું કરે છે એ જોવા જેવું છે. આ કાવ્યનું બીજું સ્તર છે :

કવિ પ્રતીક્ષા કરે છે અને કહે છે :

- મરણોનુભ પિપાસાના ઉત્કઠમાં મેં / મારી / નાખી છે ઉત્તર ઉગાડવા.
- સ્થિંહ જેવાએ મેં વેદું બનીને પરંપરાની / પાછળ પાછળ / ચાલ્યા કર્યું છે એમ નથી / યથા સમય અટકી ગયો છું / સ્વયં / સ્વેચ્છાથી / પરંપરાથી / બટકી ગયો છું.
- જખમી થયેલો વાદ ધસતી વખતે શિકારીના ભાવાને / ગણકારતો નથી તેમ મેં / કોઈ પણ વિધાતક પ્રતિકારને ગણકાર્યો નથી.
- સતત મને ઉન્મૂલ કરી / ખોદ્યો છે.
- મેં કર્મમાત્રને બાળ્યાં છે / નિર્વિપ્ત થવા / મારી દાઢિ સૂદ્ધિના વિસ્તારોમાં રહ્યાં.
- દેશકાળ ને પરાધીન કરી મેં / સ્વાધીન / સૂતેલી / શ્રદ્ધાના આશયને સતત / ઉલેચી નાખ્યો છે.
- સંબંધોના સ્નેહસર્થાની / ઘટાટોપ મનઃસ્થલીઓ / મેં બાળી છે.

આ કાવ્ય સંદર્ભે અને એમના સમગ્ર કાબ્દો અન્વયે એવિયેટની ઝોર કવાર્ટસની પંક્તિઓ બંધબેસતી લાગે એમ છે. ઈસ્ટ કોકરમાં કવિની શબ્દ પ્રયેની આ જ પ્રતિબદ્ધતા જાણે દર્શાવી છે.

Trying to learn to use words, and ever attempt  
 Is a wholly new start, and a different kind of failure  
 Because one has only learnt to get the better of words  
 For the thing one no longer has to say, or the way in which  
 One is no longer disposed to say it. And so each venture  
 Is a new beginning, a raid on the inarticulate  
 With shabby equipment always deteriorating  
 In a general mess of imprecision of feeling,  
 Undisciplined squads of emotion.

(શબ્દને કેવાપરવા શીખવાનો કરતા'ત્ત્વ યત્ન, અને એકેએક યત્ન  
 નવો પાવન આરંભ, ને વિફળતા જુદા જ પ્રકારની  
 કારણ કે કશું નથી કહેવાનું જે તેને માટે  
 માણસ શીખ્યો છે વધુ સારા સારા શબ્દ પ્રાપ્ત કરવાનું  
 પેલી વસ્તુ જેના વિશે કશું હવે કહેવાનું ન હોય, યા તો એવી રીતે  
 જેમાં કહેવાને ન હવે હોતેયાર, અને તેથી જ તો પ્રત્યેક સાહસ  
 એક નવ્ય આરંભ છે, અને વળી અચોક્કસ લાગાડીનો  
 કરી નાખે વ્યાપક ગોટાળો એવી સેડવી નાખતી ગંદી  
 સામગ્રીથી સંદિપન્થતા ઉપરનો હલ્લો,  
 શિસ્તહીન ઊર્ભિઓની ઠોળી પર હલ્લો.) – અનુ. ધીરુ પરીખ

એલિયેટ્ના આ કાવ્યની જેમ જ આ પ્રશ્નકાવ્ય એક શોધ છે, મથામજ છે. એટલે જ લાભશાંકર ઢાકર આપણા સાહિત્યના એક અનન્ય કવિ છે.

કાવ્યના પાઠની છ્યાઈ પણ આ સંદર્ભે અરૂઢ છે, કાવ્યના મર્મને અનુરૂપ છે. પ્રશ્નના ઉત્તરની વિવિધ શોધલીલા છે એટલે કાવ્યપંક્તિઓ સીધી રીતે નથી મૂકી. પંક્તિના ટુકડાઓ ઉપરનીચે વેરાયેલા છે. કવિની ચિત્તની સર્જનાત્મકતા અહીં જુદી રીતે કાગળ ઉપર અવક્ષિપ્ત થઈ છે. કવિની ચેતના કેવું અનેનું ઉડાન કરે છે અને એને કેવી રીતે છાયું છે તે પણ સાચ્યંત આસ્વાદ્ય છે.

‘લોંગ શૉટથી ખસતા ખસતા  
 મિડ શૉટમાં  
 તાકે છે  
 બ્રાનના અંડને ઝૂટટું  
 ઉત્તરપંખીને ચાંગ ખોલતું તાકે છે  
 તરત

ગૂમ કરીને કલોઝઅપમાં

ને

કર.

કલ્યાણોત્તરો ઉડે છે નીલ નીલ નભમાં

ને નીચે

મૈનમાં

વાણીમાં

સ્થળકાલસહિત વહેદી

નદીઓનાં


સ્થળકાલરહિત

વહેતાં ને કહેતાં

વહેણમાં

માણસનાં

કવિચેતનાની સ્થળકાલનિરપેક્ષ આ સર્જનાત્મક શબ્દલીલા આ કાવ્યમાં ઉત્કટ રીતે અભિવ્યક્ત થઈ છે. પ્રશ્નનો જવાબ તો, એ માટેની શોધપ્રક્રિયામાં હોય છે, એના કોઈ અંતિમ ઉત્તરમાં નહિ. કવિ લાભશંકર ઠાકરનાં કાવ્યો એ રીતે ગુજરાતી કાવ્યાકાશમાં અવિસ્મરણીય અને અનન્ય રહેશે.





## ૪૨. સેલ્ફનું એડિટિંગ સંભવ છે ?

બનુલ ટેલર

### આંખની ઉઘાડ-વાસમાં....

આંખની ઉઘાડ-વાસમાં  
 દૃશ્યપતની કાપકૂપ થતાં થતાં  
 હવે નિરર્થક શોટ્સને વાળતી  
 સાવરણી સક્રિય છે.  
 સરળ નથી છતાં હું મને વાળી રહ્યો છું.  
 ક્યારે વાળી શકીશ -  
 બેડોળ કદાવર પ્રાણીની વેરણાછેરણ કતરણને  
 સ્વભાવપતના સંદર્ભ ચોકમાંથી ?

કવિ-નાટ્યલેખક લાભશાંકર ઠાકરને એક સર્જનાત્મક માધ્યમ લેખે સિનેમા-સ્વરૂપમાં એવો જ પ્રબળ રસ હતો. તેની સર્જનાત્મક પ્રક્રિયામાં પણ તેમને એવો જ રસ.. કેમેરા વર્ક, એડિટિંગ જેવાં વાનાં પણ તેમનામાં રહેલી ભાવક્યેતના ગ્રહણ કરવા તત્પર રહેતાં.. સર્જક લાંઠાં જિવાતા જીવન અને પોતાના પરિવેશને આત્મસભાન રહેવાની પારદર્શી તીવ્રતાથી પોતાના ઊંડળમાં લેવા સક્રિય રહ્યા છે. તેમની અંદર એક પ્રકારના ગિલ્ટનો ભાવ પણ રહેલો છે. કવિ લાંઠાં ‘માણસ લાંઠાં’ને પૃથ્વી રાખીને પણ જોતા. તેઓ આધુનિક કવિ હતા એટલે સુન્દરમુની જેમ અધ્યાત્મનો કોઈ માર્ગ અપનાવ્યો નહીં. તેમની આત્મશોધ એક માણસ તરીકેની હતી.

આ એક નાની લાગતા છે પણ તેનું પોએટિક ફોકસ મોટું છે. સૌથી મોટો વ્યૂમન કેમેરા તો આંખ છે. તેના શાર્ટર્સનું મિકેનિઝમ ઓવું જ રસપ્રદ છે. લાંઠાં અહીં દૃશ્યપતને જોતી આંખની ગતિવિધિને એક કેમેરાવર્કની રીતે જાણે જુઓ છે. સામે વિરાટ દૃશ્યપત છે અને આંખની ઉઘાડ-વાસમાં તેની કાપકૂપ થતી રહે છે. આ એડિટિંગ પણી સ્વભાવિક રીતે જ ઘણા નિરર્થક શોટ્સનો ઢગલો થવાનો. પણ જે ‘કેચ’ થયું છે તે તો બધા જ સંદર્ભો સાથેનું

જીવન છે અને તેનું એડિટિંગ કાંઈ સરળ ન હોઈ શકે. જેને નિરર્થક શોટ્સ ગણો તે પણ તેમાં રહેલી જીવનની ક્ષણો સાથે જીછ કરવાના કે અમને તમારા ફૂલ વર્જનમાં સમાવો. એડિટિંગની સાવરણી નિરર્થક શોટ્સને વાળી તો રહી છે પણ તે સરળ નથી.

લાંઠાં પાંચમી પંક્તિમાં ‘હું’નો સંદર્ભ જોડે છે અને આખો સંદર્ભ બદલાઈ જાય છે. લાંઠાંમાં રહેલી આત્મશોધ અહીં ઓડિટર તરીકે ક્રિયાશીલ બને છે. વાળવાનું શરૂ કરતાં સદ્ય એક પ્રતીતિ જાગી ઉઠે છે કે ‘ક્યારે વાળી શકીશા –’ અહીં પ્રશ્નાર્થનો આરંભ છે અને તે વિસ્તરે છે ત્યારે બિગ ક્લોઝઅપથી પોતાને જ જાણે ‘બેડોળ કદાવર પ્રાણી’ જુએ છે. અહીં કુરૂપતા સાથે ભય સર્જતું ‘કદાવર’પણું છે. લાંઠાં જાણે કે પોતાના હોવાપણાને પૃથ્વી પરના પ્રથમ માણસથી માંડી આજ સુધીના માણસે રેચેલા બેડોળ-કદાવરપણા સાથે જોડી મનુષ્યત્વની વ્યાપકતા રચી, તેમાં પોતાનું આરોપણ કરે છે. લાંઠાંમાં ઓબ્સર્વની એક આંતરપ્રતીતિ હતી અને તેમાંથી જ જન્મેલો ગિલ્ટ હતો. આ ગિલ્ટને કારણે જ અહીં ‘બેડોળ કદાવર પ્રાણી’ જેવા શબ્દો આવ્યા છે. સ્થિરલબર્ગની ડિલ્ટમાં એકદમ ક્લોઝઅપમાં ડાયનોસોર જોતાં પ્રેક્ષક ભયભીત થઈ ઉઠે છે. અહીં લાંઠાં એક સવાલ કરે છે કે આવા આ બેડોળ કદાવર પ્રાણીની વેરણછેરણ કરતરણને સ્વભાવપણના સંદર્ભ ચોકમાંથી ક્યારે વાળી શકીશા ? પણ એ પંક્તિ પહેલાં સિસિફસની જેમ અખંડ ચાલતી, સાધય ઉદ્યુત સભાન ચેતના વડે ‘અતાં હું મને વાળી રહ્યો છું’ની પ્રક્રિયા છે. સ્વભાવના સંદર્ભમાંથી જે કાંઈ જિવાયું છે તેને એડિટ કરવા જાઓ તો કેટલું શક્ય છે ? આ ‘સ્વભાવ’ કાંઈ એક રીતે રચાયો નથી હતો. માણસને મળતી પ્રકૃતિ ઉપરાંત માણસને પોતાના પરિવેશમાંથી અને જે જે કાંઈ પામતો જાય, કેળવાતો જાય તેમાંથી ‘સ્વભાવ’ રચાતો હોય છે. આ સ્વભાવપણના સંદર્ભચોકમાંથી પેલા બેડોળ કદાવર પ્રાણીની વેરણછેરણ કરતરણ વાળી શકાવાનું સંભવ નથી. જે સંભવ છે તે તો વાળતા રહેવાની સભાન ચેતના કે જેમાં મનુષ્યત્વ યા કહો કે વ્યક્તિત્વની અપેક્ષિત ભૂમિકા સંભવ છે.

લાંઠાંએ આ નાનકડી કહેવાય તેવી કવિતામાં બહુ સંકુલ ભાત ઉપસાવી છે અને અભિવ્યક્તિમાં તેઓ સ્થિનેમાના માધ્યમનો જે રીતે પ્રયોગ કરે છે તે બહુ રસપ્રદ છે. ભાષા-અભિવ્યક્તિની આ રીતે તેઓ અન્ય માધ્યમની મદદ વડે નવી ધાર કાઢી એક રસપ્રદ પરિમાણ ઉમેરે છે. કાવ્યસંગ્રહનું શીર્ષક બહુ સૂચક છે : ‘કેમેરા ઓન છે’. સતત કેમેરા ઓન હોય તો શું તેમાંથી કશું છુપાવી શકાય ? અને તો પાર વિનાના શોટ્સ ભેગા થઈ જાય છે. જે જિવાઈ રહ્યું છે તે સતત જોવાઈ રહ્યું છે અને આ કોઈ ઈશ્વરી આંખ નથી, મનુષ્યની આંખ છે જે મનુષ્યત્વને જુએ છે. ક્યારેક નવાઈ લાગે કે લાંઠાંમાં આત્મશોધની તીવ્રતા જે પ્રકારે હતી તેમાં તો અધ્યાત્મમનો કોઈ માર્ગ સંભવ હતો. પણ ના, તેમણે તેવું નથી કર્યું માણસપણાને સતત જીવતા રહેવાની આ આરત તેમને આધુનિક બનાવતી હતી.



## ૪૩. ‘કેમેરા ઓન છે’ – સર્જકચિતાનું આધુનિક ભિથ

યોગેફ મેકવાન

તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે ?

તું આ ક્યારનો ય શું ખોદી રહ્યો છે ?

ભાષા.

કેમ ?

મારે એને ખોદી નાખવી છે.

પણ શા માટે ?

મને બહાર કાઢવા.

પરંપરાગત આર્દ્ધ મૂલ્યોનો વિદ્રોહી અવાજ એટલે લાભશંકર ઠાકર.

કવિ શ્રી ચંદ્રકાન્ત શેડ તેમને ‘સાર્થકતાની શોધના કવિ’ કહ્યા છે. મારા મતે તેઓ પળેપળે જીવનમૂલ્યો પ્રત્યેની નિષ્ઠાને ઉઝાગર કરવાની મથામજા કરતા કવિ છે.

એક કવિ તરીકે લાંઠાના રસનો વિષય સતત શબ્દ અને સમયમાં ફસાયેલી પોતાની જાત છે, સ્વયમ્ભુ છે. એ રીતે સ્થૂળ અર્થમાં નહીં પણ વિશાળ અર્થમાં મનુષ્યજાતની વાત કરે છે. એમની આત્મલક્ષ્ણતા પરલક્ષ્ણતાના પરિધિમાં વિસ્તરતી અનુભવાય છે. આમ, એમની નિઃબન્ધ વર્તમાનમાં જીવતા અને જીવુતા માણસને સમજવાની મથામજા સાથે રહી છે. માટે, કવિ હોવાને નાતે ભાષા અને ભાષાનું જે માધ્યમ છે તે તેમની સામે આવે છે. તેથી તેમની સજાગતા અભિવ્યક્તિના વિવિધ સ્તરે રચાતી લીલયા કરતી ચાલે છે. તેઓ સભાનપણે ભાષાપ્રયોગો કરતા રહે છે. એમાં સાથોસાથ ભાષા નિખરતી રહે છે. એનું એક પરિણામ એટલે ૨૦૦૮માં પ્રગટ થયેલ ર૧મો કાવ્યસંગ્રહ ‘કેમેરા ઓન છે’ :

એમની સર્જકશક્તિની ઉત્કટ ક્ષણોના ચિત્તમાં પડેલા જે ‘રસીજ’ હતા તેમાંથી એડિટ કરેલાં ૭૭ કાવ્યોનો આ સંગ્રહ છે. પરંતુ આ ભાષા સાથે કામ પાડવાનું કવિકર્મ તો પેલી ‘તડકો’ કવિતાથી જ પાંગર્યુ છે. ‘ગાંધીજની યલ તડકો’ એ પંક્તિથી ‘મન જળ થંબ થયેલાં’ માં

ખળખળાટ મચી ગયેલો. ભાષાની આવી સતતની મથામજ એટલે લાંડા. ૨૦૦૦માં પ્રગટ થયેલ સમય સમય' કાવ્યસંગ્રહમાં પટમા કાવ્યમાં કહે છે -

'ભાષામાં સમય છે.

સમયમાં

ભાષા છે.

બહાર કશું નથી..

છે

અંદર બધું.

ભાષામાં સમય

સમયમાં.

ભાષા

ગતિ

પરસ્પર

એકબીજામાં.'

કવિચેતનામાં અંદર ને અંદર અનેકવિધ રૂપ વર્મળતાં રહ્યાં સમય અને ભાષા ગતિશીલ રહ્યાં કર્યાં. અને એકબીજામાં ભળતાં રહ્યાં ! એ બંને કેવાં છે ? એની સૂક્ષ્મ અનુભૂતિ કવિ આમ નિરૂપે છે - કાવ્ય ઉપમાં -

'કાવ્યચેતના

સમયમુક્ત ભાષાને

સુંઘર્ષા

કુલાવે નસકોરાં

લયબદ્ધ

અને

ગુંગળાય.'

પોતાની કાવ્યચેતનાને આ રીતે દશાન્વિત કરતા કવિ તારારે છે સમયમુક્ત ભાષા. એથી સતત કાર્યરત રહે છે. પણ કેવી રીતે ? તો કહે 'ગુંગળાય....'

તો પછી કવિ સમયને માટે શું કરે છે -

'સમય શબ્દ છે,

શબ્દ

ભાષાનો અંશ છે.

શબ્દ

ભાષાનું સત્ય છે.

ભાષા સત્ય છે

ભાષામાં સત્ય નથી.'

ભાષાને સત્ય કહે છે. એ ભાષા દ્વારા જ માનવજાતિનો આટલો – જેવો છે તેવો – શબ્દોના ટેકે વિકાસ થયો છે. કવિને મન એ ભાષાનું સત્ય છે.

કવિતાની કે આમ કોઈ પણ કળાની આ પ્રક્રિયા સર્જકચિત્તમાં સતત ચાલ્યા કરતી જ હોય છે – પછી તે કવિ હોય, ચિત્રકાર હોય, નૃત્યકાર હોય, સંગીતકાર હોય, શિલ્પી હોય કે પછી કોઈ ઉત્કૃષ્ટ ચિત્તનો ફિલ્મ ડિરેક્ટર હોય... વગેરે વગેરેને નિર્દેશિત કરતું કવિ લાંઠાંએ અનાયાસ જ જીવંત એવું રચી દીધું આ ‘આધુનિક મિથ’.

ઉપર જણાવ્યા તે સૌના સર્જકચિત્તમાં પોતપોતાની કળાવિષયક ઉત્કૃષ્ટ ક્ષણોને ઝડપવા, તેમની ચેતનાના ‘કેમેરા ઓન’ જ હોય છે તેઓ કંઈક નવીન અભિવ્યક્તિ માટે સતત મથતા રહે છે. એ લોકોના ચિત્તનું મિથ એટલે જ ‘કેમેરા ઓન’. જિને સૃષ્ટિના આ શબ્દને કવિ લાંઠાંએ સાહિત્યના વિશાળ અર્થમાં મૂકી પોતાની ઉત્કૃષ્ટ સર્જકતા સિદ્ધ કરી દીધી. ગુજરાતી ભાષાને આ એમનું મહત્વનું યોગદાન જ થયું.

– પણ અહીં સુધી પહોંચવા તેમજો જે મથમણ કરી, ભાષાનું જે પોત સર્જરૂ, તેનો એકરાર એટલે ‘કેમેરા ઓન છે’ નું કાવ્ય ૭૮...

‘તું આ ક્યારનો શું ખોડી રહ્યો છે ?

ભાષા..

કેમ ?

મારે એને ખોડી નાખવી છે.

પણ શા માટે ?

મને બહાર કાઢવા.’

ઘાટ કરો.... આપહી રોજબરોજની ખીચડિયા ભાષાના થતા કોકટેલ પ્રયોગો.... કવિએ અહીં – આ દ્વારા – એની જિલ્લી ઉડાવી છે ! આ કવિકર્મ્ય ખરું ને ભાષાકર્મ પણ સાચું. આપણા વ્યવહારમાં રોજબરોજ વપરાતી ભાષા.... રાજકારણીઓની ભાષા.... કહેવતા દેશનેતા કે દેશસેવકોની ભાષા, જાતિવાદો-ધર્મવાદોની ભાષા, વર્ગવિશ્રાંહોની ભાષા,... દોસ્તો, આ યાદી લંબાવી શકાય.... સમજદારકો....

– તો ઉપરના કાવ્ય ૭૮... માં ‘ક્યારનો’ કળવાચક કિયાવિશેષણ શું સૂચરે છે ? એ જ કે જ્યારથી સમજણ આવી છે ત્યારથી પોતાને પામવા, સમજવાની મથમણ ચાલે છે. આ બધી ભાષાઓમાં મારું – આપણા સૌનું અસ્તિત્વ દર્શાવ્યું છે. વ્યક્તિત્વ ભીસાઈ ગયેલું છે. એને બહાર કાઢવા માટે ‘ભાષાને ખોડી રહ્યો છું’ – હું, મારા જેવા બીજા માણસને, તેની વેદનાને, તેના આનંદને, પ્રસંગોપાત્ર તેને જે કંઈ થાય... સારું-નરસું, સાચું-ખોટું... તે દ્વારા હું મને સમજવા પામવા માગું હું માટે બોલાતી, લખાતી.... જે કંઈ શુદ્ધ કે ભેળસેળિયા ભાષા હોય... બસ, આ બધાંને ખોડી એમાંથી – બધાં બનાવતી આવરણો હટાવી એમાંથી – મને

મારી જાતને ઉગારવી છે !

– આ કાવ્યસંગ્રહનો પ્રધાન સૂર જ આ છે. એને કવિએ સંગ્રહના ટાઈટલ પર મૂકેલાં ચાર ચિત્રોથી પણ ધ્વનિસભર કર્યું છે.

સૌથી ઉપર પહેલું ચિત્ર છે બધા ધર્મગ્રંથોની ભાષાને ખોદી પોતાની જાતને બહાર કાઢી ગાંધી માનવ બન્યો. આપણે તેને મહાત્મા કહ્યો. મહાત્મા ગાંધીનું એ ઈન્જિટ કરે છે જેણે સમગ્ર માનવજાતને ચાહી, સત્ય-અહિંસાને જીવનમંત્ર બનાવ્યો. બીજું ચિત્ર છે પૂર્ણિમાના ચંદ્રનું. એ શીતળતાનું ઘોટક છે. માશસ જીવનમાં શાતા શોધી છે, ત્રીજું ચિત્ર છે ચકલીનું ને પાંચમું ચિત્ર છે મૃગલાનું છેલ્યાં બંને ચિત્રો નિર્દ્દેશતાને ઈન્જિટ કરે છે... આમ, આ સંગ્રહ પર ગાંધીજી, ચંદ્ર, નિર્દ્દેશ પક્ષી-પ્રાણીનાં ચિત્રો મૂકી કર્યા લાગ્યાં એ માણસમાં મનુષ્યત્વ હોવું એટલે શું એ તાકી બતાવ્યું છે. અહીં તો કાવ્યસંગ્રહનું ટાઈટલ જ પ્રસ્તાવના થઈ ગઈ !

આ દિશામાં વિચારી શક્યો હું એનું એક જ કારણ કે ઘણી વાર અમારે ટેલિફોનિક વાતો ચાલતી. મને મૂંજવતા સાંસારિક-વ્યવહારિક પ્રશ્નોના ઉકેલ મને સૂચયવતા.... સાહિત્યની પણ ચર્ચા તો હોય જ. ટેલિફોન પર થતી વાતો એટલી સાહજિક લાગે કે લા.ઠા. સામે જ બેઠા છે એવી એમના અવાજની તાસીર હતી ! તેઓ જ્યારે સાજાસમા નરવાગરવા હતા ત્યારે કનોરિયા આર્ટ સેન્ટરમાં શનિ સભામાં અમે મળતા. કવિતાની રસલ્હાજ લુંટતા, ત્યાંથી છૂટીને ચીનુ, લા.ઠા. અને હું મારા સનશાઈનના ફ્લેટ પર આવતા અને મહેશ્ચિલ માણતા. એનું હવે સમરણ રહી ગયું. અને એ તો જીવશું ત્યાં સુધી યાદ આવશે – કેમ કે આ વિચામાં સમરણને વય જેવું કર્યાં છે ?

પ્રિય લાઠા, જો તમે આઈ દિવસ રોકાઈ ગયા હોત તો... તમારી વર્ષગાંડની કેટલી બધી ટેલિફોનની ઘંટીઓ રણકી હોત....!

– પણ બહાર કર્શું નથી  
        છે

અંદર બધું...



## ૪૪. સામે કંઠે પહોંચવાની રાહ

પારુલ કંદ્ર્પ દેસ્માઈ

ઘડું છું મને પણ હજુ ઘડાયો નથી..

ઘડું છું મને પણ હજુ ઘડાયો નથી.

મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે.

ક્યાં ?

જીવનસરિતામાં..

શા માટે ?

તરતાં તરતાં મારે સામા કંઠે જવું છે.

વ્હાય ?

ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.

કોણ ?

મારેય તે જાણવું છે કે

સામા કંઠે કોણ અને શા માટે કોઈ

મારી પ્રતીક્ષા કરે છે.

પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ ?

ઘડતાં ઘડતાં

હું

મને એ જ પૂછું છું :

રે હું ક્યારે ઘડાઈ રહીશ ?

સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન આદિ આ જગતને, માણસને, જાતને ઓળખવાના, સમજવાના પ્રયત્નો કરે છે પણ એક સીમાથી આગળ એ જોઈ શકતો નથી. પરિણામે ભંગુરતાનો અનુભવ થાય છે. લાભશંકર દાકરની કાવ્યસૂચિમાં ભંગુરતાનો અનુભવ જાતઉપાલંબ, વેદના,

વ્યથા, વિરતિ, વિંબના, વિફળતા જેવાં અનેક રૂપોમાં પ્રબળ આવિજ્ઞાર પામે છે.

ઉત્તર લાભશંકર પાસેથી કશુંક નવું કરવાના અભિનિવેશ કરતાં વધુ તો સાદગીપૂર્ણ ભાષામાં અર્થસમૂહ રચનાઓ મળે છે. તેમના પ્રત્યેક કાવ્યમાં નિઝ મથામણનો આલોખ મળે છે. શબ્દ અને સંવેદનને નવેસરથી સાથે મૂકીને જોવાનો તેઓ પ્રયત્ન કરે છે. છેલ્દે સુધી લખતા રહેલા આ કવિનો દરેક કાવ્યસંગ્રહ કવિનો આગવો અવાજ લઈને આવે છે.

૨૦૦૮માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘કેમેરા ઓન છે’માં એક પણ કાવ્યને શીર્ષક નથી. કેમેરા ઓન કરીને કવિએ જે જીલ્યું છે એ માત્ર બાબુ જગત જ નથી, જે દેખાય છે એ જ નથી પરંતુ અસ્તિત્વપરક ઊડી સંવેદનાથી રસાયેલું ચિંતન પણ છે જે વિવિધ કલ્યાણમાં અને પ્રતીકાત્મક સંદર્ભોમાં પ્રગટ થયું છે.

આ સંગ્રહનું અહીં પરંદ કરેલ હત નંબરનું આ કાવ્ય અસ્તિત્વના એક મૂળભૂત પ્રશ્ને સ્પર્શે છે. જન્મથી મૃત્યુ સુધી મનુષ્ય સતત પોતાને ઘડવાનો પ્રયત્ન કરતો રહે છે, એટલું જ નહીં, ક્યારેક તો એવું માનવા પ્રેરાય છે કે પોતે હવે ઘડાઈ ચૂક્યો છે, પૂર્ણ છે. પણ અહીંયાં તો કવિ પહેલી પંક્તિમાં જ પોતાની નિર્ઝળતાનો એકરાર કરે છે. કાવ્યની પહેલી પંક્તિ છે :

‘ઘડું છું મને પણ હજુ ઘડાયો નથી.’

ઘડાવાની પ્રક્રિયા છે અહીંયાં અને હજુ એ પૂરી નથી થઈ. ચાલુ જ છે. આમેય કશોક ઘાટ ઘડવા માટે જ તેઓ ભાષા સાથે ને જાત સાથે જીવનભર તોડફોડ કરતા રહ્યા છે. શા માટે ઘડાવું છે અથવા તો ઘડાઈને શું કરવું છે એવો પ્રશ્ન આપણને સહજ થાય. બીજી પંક્તિમાં કવિ એનો ઉત્તર આમ આપે છે :

‘મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે.

ક્યાં ?

જીવનસરિતામાં.’

‘ઘટરૂપે તરવું’ – મારીમાંથી ઘડો બનવાની આ પ્રક્રિયા દેખાય છે એટલી સીદીસાધી નથી. પહેલાં તો ચાકડે ચડવું પડે, પછી નિંભાડામાં શેકાવું પડે અને ટકોરાબંધ પાક થવું પડે. અહીંયાં તો જાતઘડામણની વાત છે. કંઈ-કેટલાય નિંભાડામાંથી પસાર થવાનું છે. એટલું જ નહીં, તરવા માટે અંદરથી ખાલી પણ હોવું પડે. અને આ ખાલી થવાનું ક્યાં એટલું સહેલું છે. જીવનસરિતામાં ઘટ રૂપે તરવાની ઠચ્છા, આકંક્ષા તો બધાંને હોય છે. તોઈને રૂબાવું હોતું નથી પણ એ માટે વેઠવાની તેયારી કેટલાની હોય છે? કવિ પ્રશ્નો પૂછિતા જાય છે અને ઉત્તરો પણ આપતા જાય છે :

‘શા માટે ?

તરતાં તરતાં મારે સામા કંઠે જવું છે.’

રૂબાવું નથી આ નાયકને, તરવું છે. સામે કંઠે પહોંચવું છે. સામે કંઠે પહોંચવાની ઉત્કર્ષ છે, આતુરતા છે કારણ કે એ જાણો છે કે સામે કંઠે કોઈ પ્રતીક્ષા કરે છે.

‘ખ્યાય ?

ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.’

અહીંયાં સુધી તો બરાબર છે. પરંપરાગત માન્યતા તો એવી છે કે સામે કાંઠે જે રાહ જુએ છે તે ઈશ્વર છે, પરમતત્ત્વ છે ત્યાં સુધી પહોંચવાનું છે અથવા તો મૃત્યુ છે, જીવનનો અંત છે. પણ આ કવિ એવા કોઈ ભરમાં નથી. સામે કાંઠે કોણ પ્રતીક્ષા કરે છે ? પ્રશ્નોત્તરની સીધી સાદી પ્રક્રિયા અહીં નથી એ ‘આ કોણ ?’ ન ઉત્તરમાં સમજાય છે. આ ‘કોણ ?’ નો ઉત્તર અપેક્ષિત નથી. કવિને તો મૂંળવાજ છે, દ્વિધા છે, પ્રશ્ન છે તે આ પંક્તિઓમાં વ્યક્ત થાય છે.

‘મારેય તે જાણવું છે કે

સામા કાંઠે કોણ અને શા માટે કોઈ  
મારી પ્રતીક્ષા કરે છે.’

અહીં ઉફ્ફન છે વિચારનું, ચિંતનનું, અસ્તિત્વપરક સમસ્યાનું. ઘડાઈને, ઘટ રૂપે જીવનસરિતામાં તરતાં તરતાં સામે કાંઠે જવું છે કારણ કે ત્યાં કોઈ રાહ જુએ છે. પણ કોણ રાહ જુએ છે, શા માટે રાહ જુએ છે, કોને મળવાનું છે એ કવિને ખબર નથી. પ્રતીક્ષાનો ભાવ લાભશંકર ઢાકરનાં કાવ્યોમાં અનેક રૂપે અને અનેક રીતે ડેકાતો રહ્યો છે. આપણને ‘વેદિંગ ફોર ગોદો’નાં પાત્રો તરત યાદ આવી જાય. પણ એના કરતાં અહીં જુદી વાત છે. ત્યાં કોઈની રાહ જોવાય છે અને કોઈ આવતું નથી. અહીંયાં કોઈ રાહ જુએ છે પણ ત્યાં જવાતું નથી. વળી, એ સામે કાંઠે રહેલા શા માટે રાહ જુએ છે એની પણ કવિને ખબર નથી. એટલે જ ભંગુરતાનો અનુભવ અહીં પ્રશ્ન રૂપે આવે છે. કાવ્યના અંતમાં પ્રશ્ન પુનરચર્વિત થઈને ભાવકચેતનાને સંક્ષુદ્ધ કરી દે છે.

‘પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ ?

ઘડતાં ઘડતાં

હું

મને એ જ પૂછું છું

રે હું ક્યારે ઘડાઈ રહીશ ?’

ક્યાં ? શા માટે ? કોણ ? જેવા પ્રશ્નો દ્વારા કવિ આ કાવ્યમાં મનુષ્યની મથામણ અને એની નિયતિને તાકે છે. ‘ઘડું છું મને’થી આરંભાયેલું આ કાવ્ય ‘ક્યારે ઘડાઈ રહીશ ?’ સુધી પહોંચે છે અને દર્શાવે છે કે ઘડાવાની પ્રક્રિયા અવિરત ચાલતા રહેવાની છે. જે કોઈ રાહ જુએ છે તેના સુધી પહોંચવાનું નથી. કારણ કે સામે કાંઠે જે પ્રતીક્ષા કરે છે તે તો પૂરેપૂરા ઘડાયેલાની પ્રતીક્ષા કરે છે. પ્રશ્નોત્તરમાં ચાલતા આ કાવ્યમાં છેલ્યે તો પ્રશ્ન જ રહે છે. જાતઘડામણની આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે એ ખબર નથી. લક્ષ પ્રાપ્ત ન કરી શકવાની આ પીડા કવિ સાથે ભાવકની પણ બની જાય છે.



## ૪૫. પંચેન્દ્રિયમાં પ્રસરતો પંખી-સ્વર

રમણીક સોમેશ્વર

શી-ઈ-ઈ-ઈ- !

શીતલ પવનની પીઠ પરેથી લસરે છે

લીલુરુંગનો તડકો

બોરસલીની ડાળ પર ચળકે છે પુંછથી શ્યામ

ચેત રંગના સંયોજનમાં : શી-ઈ-ઈ-ઈ !

શુભ પતાસા જેવું પેટ, દૈયડ

મેગપાઈ રોબિન, આવ -

તારા અવાજમાં ધૂયાયા છે, લીલુરુંગી સુખોજા તડકો,

શીતલ પવન ને કામ. આવ -

દૈયડ અતીતમાંથી આ ક્ષણમાં સામે.

હું તો બેઠો છું નિષ્કામ ને અનિષ્ટ. આવ -

તારા અવાજથી ઉઘાડી છે મારી આંખ

તાકવા તને, મારી એકલતાની ડાળે

સ્મૃતિ શ્રુતિના ફળિયામાં સકામ કેમેરાનાં

આંખ-કાનની સામે મિડ શોટથાં.

તારી પ્રતીક્ષામાં કેમેરા ઓંન છે. આવ -

શી-ઈ-ઈ-ઈ !

વસ્તુતના દિવસો છે. અવનવાં પંખીઓના ચહેકાટથી સવારનું મારું આંગણું આકાશ બની ફરજરતું રહે છે. ત્યાં, આ કવિ લાભશંકર ઠાકરના ઓંન થયેલા કેમેરામાંથી એક કલધનિ મારાં કાન-ભાનને ઝણાઝાવતો આવી પડોંચે છે. :

‘શી-ઈ-ઈ-ઈ- !’

ધનિ, અવાજ. કેવળ હવામાં તરતો અવાજ. બધા જ કોલાહલોને શમાવી શાંત પળોમાં નિમજજન કરાવતો પંખી-સ્વર. શી-ઈ-ઈ-ઈના સ્વર-હિલ્લોળ સાથે જાણે જૂમી ઊઠ્યું છે આખું વતાવરણ.

ક્લિક કરી સ્થગિત ચિંતો આપતો આ કોઈ યાંત્રિક કેમેરા નથી. આ તો છે કવિનો કેમેરા. પંચેન્દ્રિયોના રસકોણોમાં રસબસતો કેમેરા.

શી-ઈ-ઈ-ઈના આલાપમાં સંગોપાઈ ગયું છે બધું. એની તાનમાંથી જ સૌપ્રથમ થાય છે સ્પર્શાનુભૂતિ અને સાથે સાથે જ આસ્વાદ દરશાનુભૂતિ.

‘શીતલ પવનની પીઠ પરેથી લસરે છે  
લીંબુરંગનો તડકો’

સ્પર્શના રોમાંચ સાથે દરશ્ય ઊઘડતું જાય છે. પવનની પીઠ પરથી લસરતો લીંબુરંગનો તડકો. અરે ભાઈ ! આ તો દેહ વિનાનો પવન પણ દેખાયો અને આપણે તો લસર્યા આ ખટમધુરા તડકામાં સરરર... (પ્રિય કવિ, તડકાને તો તમે કેટકેટલા રૂપે જોયો છે ! અને કેટકેટલી રીતે તમે જીલ્યો છે અવાજને !) - હજુ આપણે આ તસતસતા સ્વાહુ તડકાથી મોહિત થઈ અંગુલિ એના તરફ લંબાવીએ એટલામાં તો પ્રત્યક્ષ થાય છે ઘટાદાર બોરસલી. સંકોરો જરા તમારી નાસિકાને, શેત સુગંધી પુષ્પોની સુવાસથી છલાંછલી ઊઠશે તમારી ઘાણેન્દ્રિય. પણ નજર કરો, ત્યાં શેત પુષ્પોથી લચેતી ડાળી પર તો પ્રગટ થઈ શ્યામ રંગની ચળકતી પૂંધરી. અને આ શેત-શ્યામના સંયોજનમાં રેલાતો જ રહ્યો, રેલાતો જ રહ્યો એક સ્વર -

‘શી-ઈ-ઈ-ઈ- !’

આમ આંખ, કાન, નાક, જીબ અને રૂંવેરૂંવેથી જોતાં જોતાં કેમેરા તો કરતો રહ્યો ક્લિક્ક ક્લિક. અને સામે દેખાયું -

‘શુભ પતાસા જેવું પેટ, દૈયડ...’

રંગ, રૂપ ને સ્વાદ કેવોં એકરસ થઈ જાય છે ! ‘શુભ પતાસા જેવું પેટ...’ ડેવી રસભરી ઉપમા !) અને જીબ સહસા ઉચ્ચારે છે, ‘દૈયડ’ અને પછી દૈયડનું અંગ્રેજી નામ પેગપાઈ રોબિન પણ પાછળ પાછળ સરકી આવે છે. સ્વરને હવે દેહ મળે છે. આમ નામ તો છેક હવે આવે છે. (નામમાં શું ?) - આવકારો આપવા નામ તો જોઈએ ને ?

બાહુ પ્રસારી કવિ આમંત્રે છે દૈયડને - ‘આવ -’. કવિતા વાંચતાં વાંચતાં મારા કાન ઘડીક દૈયડના સ્વરમાં જૂને છે તો ઘડીક કવિતાના જીણા લયમાં લીન થાય છે. અને કવિ પણ હજુ તો અવાજના જ નશામાં છે ને !

‘તારા અવાજમાં ધૂયાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો...’

વસંતનો ખરો પરિચય તો આ પંખીઓ જ કરાવે છે ને ! પંખીઓ અને પુષ્પો ન હોય

તો આપણને કદાચ વસંતના આગમનની ખબર જ ન પડે. અને આ તો પાછું દૈયડ. વસંત આવતાં જ એનો અવાજ ખૂલી જાય, ખીલી ઉઠે. જોયું ? પેલો લીંબુરંગનો તડકો હવે સુખોષ્ણ બની ગયો. ઉષ્ણ છતાં સુખ આપે તેવો, હૂંફાળો. જરા ફરી સાંભળી લઈએ આ શબ્દો :

‘તારા અવાજમાં ધૂટ્યાય છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો,  
શીતલ પવન ને કામ. આવ –’

કેટકેટથું આવે છે આ પંખીના અવાજમાં ધૂટ્યાઈ ધૂટ્યાઈને. મસૂણ તડકા સાથે ગેલ કરતો વાયરો અને એની સંગે ધૂટ્યાયો છે કામ. અનંગ. (બે અનંગની આ સહોપરિસ્થિતિ જોઈ !) આ તો પુષ્પધનુ લઈ શરસંધાન કરતો મહિર અવાજ.

કવિતામાં આમ ડિલ્લોળા લેતાં લેતાં આપણને કદાચ એવું પણ થાય કે અરે ! કવિએ દૈયડને જોયું કે પછી માત્ર એનો અવાજ જ સાંભળ્યો ? શું અવાજમાંથી જ રચાઈ આ બધી લીલા – મનઃચક્ષુ સામે ! કવિ તો દૈયડને બોલાવે છે અતીતમાંથી આ ક્ષણમાં – સામે. આ એક એવું બિંદુ છે જ્યાં વિગત અને આગત એકાકાર થઈ જાય છે. જે આરથાદિત છે તેને અનાવૃત્ત થવા જાણો સાદ પાડે છે કવિ. અને પાછા કહે છે –

‘હું તો બેઠો છું નિષ્કામ ને અનિરખ. આવ –’

નિષ્કામ સ્થિતિમાં તરંગાતી સકામ સ્મૃતિઓ. અનિરખ અવસ્થાના શાંત સરોવરમાં સ્પૃહાની લહરી. ઉદ્વિપન અને ઉપશમનું આ કેવું અનોખું સાયુજ્ય ! વસંતના છિવસોમાં દૈયડનો સ્વર જાણો અતીતના સુખાનુભવોને નવપત્રવિત કરવા આવી પહોંચ્યો. કવિ ઉલ્લાસપૂર્વક પોકારે છે – ‘આવ –’

‘તારા અવાજથી ઊઘડી છે મારી આંખ’

કવિતા વાંચતાં વાંચતાં પંક્તિએ પંક્તિએ પોરો ખાઈએ તો એમાં નવી નવી ખૂલીઓ આપણને દેખાય. મને થાય છે કે આ એક નાનકડા કાવ્યમાં શૈત-શ્યામનાં કેવાં કેવાં સંયોજનો કવિએ બાખૂબી તરતાં મૂક્યાં છે !

‘...ઊઘડી છે મારી આંખ.’ મળસરું છે. કવિ હજુ જાગ્યા જ છે. ભળમાંખળું... (અરે, સ્મૃતિમાં સળવળવા લાગે છે આ પંક્તિઓ – ‘પરોઢના અકળમાં તડકો / પીગળે...’ અને ત્યાંથી પાછું ‘બટેર બેટું, બટેર બેટું બટેર બેટું...’ – પરોઢ અને પંખી જાણો કવિની ચેતનામાં અવિનાભાવે વણાઈ ગયા છે.) – આછું અંધારું અને શુભ કિરણોના સથવારે ઊઘડતું સવાર. આ શૈત-શ્યામનું પહેલું દર્શન. એને જીલીએ જીલીએ ત્યાં દેખાય બોરસલીની ઘટામાં ડોકાતો શ્યામ અને ડાળી પર ઝૂલતો શૈત. એમાં પાછું આવ્યું આ દૈયડ. કાળો ચળકતો દેહ અને કવિ કહે છે તેવું, ‘સર્ફેટ પતાસા જેવું પેટ.’ ફરરક કરતું ઉડે આ પંખી ત્યાં એની કાળી પાંખોમાં

દેખાય સર્કેદ પટા. કેવી છે આ ચેત-શયામની રમણી !

ચાલો, ચાલો ફરી વાંચી લઈએ આ થોડી પંજિતઓ :

‘તારા અવાજથી ઊઘડી છે મારી આંખ  
તાકવા તને, મારી એકલતાની ડાળે  
સ્મૃતિ શ્રુતિના ફળિયામાં સકામ કેમેરાનાં  
આંખ-કાનની સામે મિડ શૉટાં.’

આયુષ્યના અવરોધે કવિ બેઠા છે એકલતાની ડાળે. બધું જ સંકોડીને અનિયા બેઠેલા કવિ ઈરછે છે – ‘તાકવા તને –’ દૈયડને ? કેવળ દૈયડ તો નહીં. દૈયડ તો સંચારી છે. શી-ઈ-ઈ-ઈ કરતું પલમાં સરી જાય એવું. કેમેરા તો મંડાયો છે સ્મૃતિ-શ્રુતિના ફળિયામાં. કામનાભર્યા – ઈચ્છાભર્યા સકામ છે આંખ-કાન.. કવિનાં. કેમેરાનાં. કવિના કેમેરાનાં. પંખી-સ્વરની શ્રુતિ આંધળોપાટો રમતી રમતી બેંચી જાય છે છેક સ્મૃતિના ફળિયામાં. (અહીં સજીવારોપણ પણ ચિત્તને કેવો સહજ આંદોલિત કરે છે !)

કેમેરા ઓન છે. સકામ આંખ-કાન સાથે. ગોઠવાયો છે ‘મિડ શૉટ’માં. સામે તો ભાઈ પંખી ! એને કલોગઅપમાં જીલંબું કપડું. અને લોંગ શૉટમાં તો, એ ટપકું થઈને ઓસરી જાય. તેથી આ ‘મિડ શૉટ’. (સમ્યકુ દર્શન) આ મિડ શૉટની પણ પાછી જુદી જ મજા છે હોં. સુઝોને શું કહેવું !

અને કેમેરા તો હજુય ઓન છે. અવિરત પ્રતીક્ષામાં આ પામવા કરતાં પ્રતીક્ષાની મજાય પાછી કંઈક ઔર....

‘શી-ઈ-ઈ-ઈ’ના સ્વર સાથે આરંભાતું અને એ સ્વરની ગુંજ સાથે જ વિરામ પામતું આ કાચ્ય આપણાને અંદર-બહાર કેવા તરબતર કરી જાય છે નહીં !

હે, ફરી એક વાર વાંચી લેજો આ કવિતા. સંભવ છે એમાં વિલસેલો પંખીસ્વર તમારા શ્રુતિ-સ્મૃતિના ફળિયામાં આવીને નવી દિશાઓ ખોલતો કદાચ રણકતો હોય તમારે આંગણે....



## ૪૬. લીલયા પ્રવૃત્તિની પરિણામિ

ભગવતીકુમાર શર્મા

### ઉપાદાનમાં આળોટીને....

ઉપાદાનમાં આળોટીને ઉભા થવું —  
ને પડવું ભજાંગ

નીચે

સરસ્વતીના સૂક્ષ્મ પટમાં  
તે તારું રૂટિન છે ?  
હા, ઈન અને આઉટ.

સર્વર્ગસ્થ લાભશંકર ઢાકર અતિઆધુનિકતાવાદી કવિ હતા.. તેમની કવિતાનો સાચો મર્મ પ્રીછવો અને વ્યક્ત કરવો તે લગોરેય સરણ કામ નથી. કવિને ઉક્ત કાવ્ય ‘ઈન અને આઉટ’ લખવામાં ખરેખર શું અભિપ્રેત હતું તે જાણવાનું આપણી પાસે તો કોઈ સાધન, કોઈ ચાવી હોઈ જ શી રીતે શકે ? આમેય લાભશંકર ઢાકર જેવા આણીથી પણી સુધીના આધુનિકતાવાદી કવિઓ પોતાનું કાવ્ય રચતી વખતે તેના અર્થઘટનની અપેક્ષા રાખતા હોતા નથી. લાંઠાં તો બધું લીલયા કરવામાં માનતા હતા. આથી શક્ક્ય છે કે ‘ઈન અને આઉટ’ કાવ્ય પણ તેમણે નિત્યાંતપણે લીલયા લખ્યું હોય. તેનો ખરેખરો મર્મ પારખીને આસ્વાદ કરાવાય તેવી કવિએ અપેક્ષા જ નહીં રાખી હોય.

આ કાવ્યમાં મને બે શબ્દગુચ્છો મહત્વના અથવા ચાવીરૂપ લાગે છે. લગાડી જોઈએ એ ચાવી; પરિણામ તો લાંઠાં જાણો ! જે શબ્દગુચ્છોનો હું નિર્દેશ કરું છું તે છે : ‘સરસ્વતીના સૂક્ષ્મ પટમાં’ તથા ‘ઈન અને આઉટ.’ અહીં સરસ્વતી શબ્દની નીચે લીટી દોરવા જેવી લાગે છે. વળી ‘સૂક્ષ્મ પટમાં’ એ શબ્દો નદીનું સૂર્યન કરે છે, પરંતુ સ્થૂળ નદી કવિને અભિપ્રેત ન હોઈ શકે. સરસ્વતી નદી માટે ‘અત્ર લુપ્તા સરસ્વતી’નો સંકેત સદીઓથી પ્રચલિત છે. અહીં તો સૂક્ષ્મ પટમાં ભજાંગ દઈને પડવાની ચોખ્યી વાત છે. ‘ઈન અને આઉટ’ એ ત્રણ

શબ્દો સરસ્વતીનું આરાધન કરવા માટેની કવિની મથામણ અને તેમાં પ્રાપ્ત થતી દેખીતી વિફળતાને સૂચયે છે. કવિતાઓની સરસ્વતી રેતીના સૂક્ષ્મ પટમાં પરવર્તિત થતી થતી અંતે તુલ્ય થયાનું સૂચવી શકાય.

કવિએ ઉપાદાન શબ્દનો પ્રયોગ સયુક્તિક કર્યો લાગે છે. કવિતાસર્જનની કષેત્રે કવિને ઉપાદાનની સામગ્રી તો મળી, કિન્તુ તે છટકણી પુરવાર થઈ રહી છે. સમુચ્ચિત ઉપાદાન વિના કંઈ પણ સર્જવું કપરું છે. કવિ લાંડા શ્રદ્ધાળું જીવ નહોતા. જે ઉપાદાનસામગ્રી તેમને લાધી તેને વિશે પણ તેમને કર્શી શ્રદ્ધા બંધાઈ હોય એમ લાગતું નથી. વળી કવિતા તો ઘૂંઠવી પડે; ‘લીલયા’ થતી પ્રવૃત્તિ પાછળ પણ ઘૂંઠવાનો પરિશ્રમ અંતર્નિહિત હોવાનો જ. કવિએ બહુ પ્રામાણિકતાપૂર્વક એક સાચી કવિતા સર્જવામાં પોતાને મળેલી નિષ્ફળતા અથવા અધ્યાપિધી સફળતાનો અહીં નિભાલસત્તાથી સ્વીકાર કર્યો છે. લાંડા જોકે જરાય ઉપદેશકની પ્રકૃતિ ધરાવતા નહોતા. છતાં આ કાવ્ય દ્વારા તેઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા કવિએને ચીમકી આપતા હોય એમ જગ્યાય છે. અંતે પુનઃ એટલું કહેવું – સ્વીકારવું રહ્યું કે કવિને તેમની આ કવિતાનું આ પ્રકારનું મર્મ આસ્વાદન અપેક્ષિત ન પણ હોય.

## સાભાર સ્વીકાર

### પ્રક્રિયા

(૪૧) ડાયરો (ઝ્યાંબાભગત) : સંકલનકર્તા : નારાયણ કે. ભાલોડિયા, ૨૦૧૩, લેખક પોતે : મોમાઈ મેડી, જામનગર, પૃ. ૮૨, રૂ. nil (૪૨) અમારું મજેવડી, રણાણોડભાઈ પોકીયા, પુનર્મુદ્દશ, ૨૦૧૧, લેખક પોતે : પોકીયા શેરી, મજેવડી, જિ. જૂનાગઢ, પૃ. ૧૪૪, રૂ. ૨૦૦ (૪૩) તીર્થયાત્રા : રણાણોડભાઈ પોકીયા, ૨૦૧૨, લેખક પોતે : પોકીયા શેરી, મજેવડી, જૂનાગઢ, પૃ. ૬૨, રૂ. ૭૦ (૪૪) જનમ જનમનું ભાથું જ્ઞાનગીતાનું : હરિલાલ ટેલર, ૨૦૧૫, લેખક પોતે : સી/૨૪, નંદધામ, ભાઉસાહેબ, પરબ રોડ, દહીંસર (વે.), મુંબઈ, પૃ. ૪૫૬, રૂ. ૧૨૦ (૪૫) સમીક્ષાલોક : ડૉ. બહેચરભાઈ પટેલ, ૨૦૧૦, લેખક પોતે, એ/૨, ઉદ્યગિરિ સોસાયટી, જોધપુર, સૌટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫, પૃ. ૬૧૯૮, રૂ. ૧૫૦ (૪૬) ગીરનો સિંહ : ડૉ. સંદીપકુમાર / મોઈન પટાણ, ૨૦૧૫, આર. આર. શેઠ એન્ડ કંપની, પ્રા. લિ. મુંબઈ/અમદાવાદ, પૃ. ૩૧૨, રૂ. ૨૭૫

### બાળવાર્તા

(૪૭) ગિલ્લુ, નિલ્લુ, પિલ્લુ અને બીજી બાળવાર્તાઓ : સુધા ભંડ કાચમીશ્રીક, ૨૦૧૪, ભરાડ ફાઉન્ડેશન, ત્રાંબા, પૃ. ૧૨૨, રૂ. ૧૫૦



## ૪૭. ખરા મધ્યાહ્નને લાંઠાંની કવિતાનો દરજા

મહેન્દ્રસિંહ પરમાર

સવારના આછા આછા આઘાપાછા થતા....

સવારના આછા આછા આઘાપાછા થતા

મુલાયમ તડકાના સ્પર્શસુખે

બદામનાં પર્ણ બે, સાવ લાવીને સમીપ

દીર્ઘ ચાંચે પકડીને ધાગો

રે દરજા

છે

સીવી રહ્યો માળો !

કુમેરાની દષ્ટિ અને ટગર ટગર, તાકે;

પછી પગથિયાં ઉત્તરીને, સાવ સમીપના કલોઝઅપમાં

નિર્નિર્મેષ નીરખતી;

દીર્ઘ ચાંચ, નત નેત્ર,

ને બદામની ડાળ પરે ચીપકેલા બે પગાની પકડ !

ક્ષણાંતરો પછી રે, રૈ, હા, હા....

છે

સિવાઈ ગયો માળો !!

અ...અ...અ...અને

દરજા તો

ઉં...ડી જરા

બીજ ડાળે પવનમાં ઝૂલે

ને અચાનક

ગાય : ટુવિટ ટુવિટ ટુવિટ ટુવિટ...

## હલો સર !

‘માનનીય જિલ્લા પંચાયત સદ્ગ્રસ્ય શ્રી .....ની ગ્રા-ટમાંથી’ નવા નંબાયેલા બાંકડે, મંદિરે બેઠો છું. ખરા બપોરે. તડકો ગાંધીજીની ટાલ છે કે ટુવાલ છે કે તડકો ચોરને કંધ મારે એવો છે... ખબર નથી પડતી ! લીમાડાનો છાંધો પવનને કારણે આછોપાછો થયા કરે છે ને મારી ચેતના, તમારી કવિતાને કારણે....

મંદિરની ‘અંદર’ (-જોકે સાવ ‘અંદર’ તો માતાજી –) ભરવાડ ભાયો આરામ ફરમાવે છે એટલે હું ‘બહાર’ બેઠો છું. એમની પાસે પણ હવે મોહરીલ છે. એમાં લોકગીત ગાજે છે : ‘વનમાં ચાંદલિયો ઊળ્યો, હાં રે મને સૂરજ થઈ વાગ્યો !’ ‘રસિયા મોરા’ શેરીએ સાદ પડાવે છે એટલી ઘણીમાં અહીં, બીજા ધ્વનિઓ, ઝંકારતા ઈન અને આઉટ થતા રહે છે.

એક ધોળિયું ફૂતનું, કાદવથી ખરડાયેલું, મારી પાછળ, એતી રીતે ડોરું હલાવે છે કે એનાં કાન સામે સામે અથડાઈને એક અવાજ કરે છે. એ અવાજથી ફળિયામાં ચણતાં કબૂતરો ફૂર્ણેયાનાં ઊરીને આ બીજા અવાજને તડકાના મોટા આકાશમાં ફેલાવી વૈ છે. કુંડી પાસે મૂકેલી ઠીબમાં પાણી પીવા કાળો કોશી ખોલબંધખોલબંધ પાંખે આવી પાછો લીમડે જતો રહે છે. સામે પડેલી મારી બાઈકના કાચ પર ફૂલસુંઘણી માદા, એના પ્રતિબિંબ સામે મોરચો માંડાને એની વાંકી – ‘દીર્ઘ’ ચાંચ એકધારી અથડાવી રહી છે. પડબેની પીપરના થડે એક લક્કડખોડ ડોક આગળ-પાછળ કરતું ચાંચ મારવાનો લાગ શોધી રહ્યું છે...

...ને હું, તમારા દરજીઠાને, તમારી કવિતા માંહેની બદામીનાં પર્ઝ બે, સાવ લાવીને સમીપ, દીર્ઘ ચાંચે પકડીને ધાગો... રે... માળો સીવિતો તાકી રહું છું. એટલામાં, કવેળાનું તેતર કિલકારી કે કિકિયારીની લાંબી તાન લગાવી આ સમયને વધુ મુખર બનાવે છે. આવી આ બપોરની વેળાએ, સવારના આધાઆધા/આધાપાદા થતા – ‘આધાઆધા’માં તડકાનું પોત અને ‘આધાપાદા’ થતા’માં એની ભાત-તડકાનું ‘મુલાયમ’ સ્પર્શસુખ બળબળતી બપોરે, પરસેવે રેબઝેબ છતાં, બરાબર અનુભવું છું. બદામડીનાં બે પણને(પાન કેમ નહીં ?) દીર્ઘ (લાંબી કેમ નહીં ?) ચાંચે, ધાગાથી સીવિતો દરજીને નરી આંખે જોવાને બદલે ‘કેમેરાની દસ્તિ, એને ટગર ટગર તપે’ છે. કેમ એમ ? નજરનું કેમેરાનું ‘ઠન’ થવું છે, કે કેમેરાનું નજરમાં ‘આઉટ’ થવું છે ? – નક્કી નથી થતું. કવિતાની ટેખીતી સાંદરી હુમેશાં જોખમી હોય છે નહીં, કવિ ? મૂળ ગુણધર્મને એનાં મૂળ ગુણધર્મથી જુડા ના પાડી બતાવો તો ‘હમારી સલામ’ તમને શું કામ હોય ? તો, આંખ નહીં, કેમેરા... ‘મૂવ’ થાય છે... થાય છે કે એનું થાય છે (કેમેરાની પરિભ્રામાં એને જે કહેવાય તે...) ...ને ઝૂમિંગ થતાં, ‘દૂર’નું નિકટ આવે છે. આંખ પાસે એ સગવડ નહોતી. of eyes – એ રીતે કેમેરા થાય છે ને પણી પગથિયાં ઊતરીને એ ‘પેલા’ દરજીઠાને કલોજઅપમાં લઈ લે છે. સિફ્ટટથી. કેમેરાની પાછળથી નિર્નિમિત નીરખતી આંખો ! નીરખને. દરજીઠાની ડિટેઇલ્સ વધુ સ્પષ્ટ થાય છે : ચાંચ (દીર્ઘ), નેત્ર (નત)... ચેતના... ઉન્તત !’ ડાળ પર ચીપકેલા બે પગની માસૂમ પકડ (કવિ ‘માસૂમ’ પકડમાં ઘણું આવી ગયું). કટ...  
...બટ, ‘ક્ષાણન્તરો’ પછી, રે... રે... હા, હા... (કલાપીના રે રે હા હા ?) સિવાઈ ગયો

માળો. બે પાંદડાં એક ધાર્ગો, ને લાંબી-ખંતીલી ચાંચ, કસબી, કારીગિરીવાળી, કલાપૂર્જી. ને બન્યો માળો. ટૈયાડ અને દરજીનાને ઓળખનારી-જીલનારી કવિચેતનાઓ તો હવે દુલ્બ પ્રજાતિઓ. એમાં તમે ‘આ’ દરજીનાને કર્યો !)... માળો સિવાઈ ગયા પછી અપેક્ષા કરી હાય ? કેટલીય શક્યતાઓ. અક્ષરોની વચ્ચમાં અવકાશબિંદુઓ છોડીને તમે અવકાશ ભર્યા :

‘અ...અ...અ... અને

દરજીનો તો

ઉ...હી જ્યા

બીજી ડાળે પવનમાં ઝૂલે

ને અચાનક

ગાય : ટુવિટ ટુવિટ ટુવિટ ટુવિટ....

આ લિરિકલ ઉદ્ગારોમાં ઘણું સાંભળી શકાય. ‘માળો’ બનાવવાનો કલાત્મક – શ્રમસાધ્ય પણ – ઉદ્યમ પૂરો. હવે ? થોડે દૂર, બીજી ડાળે જઈ, પવનમાં ઝૂલી, ‘અચાનક’ ‘ગાઈ’ ઉઠનું, પર રહી ‘સેલિબ્રેટ’ કરવાનું ? ... શું ? કંઈક, કે કશું નહીં ?...

કવિ, આ આટલી વાત કરી ત્યાં ‘અચાનક’ પવન તમારી આ કવિતાની તેરોક્ષ કરેલી પ્રત ઉઠાવી ગયો... દરજીનો બદામડી સમેત ગોથાં ખાતી – ગલોટિયાં ખાતી દૂ..ર જઈને ઠરી. પાનાં હવામાં ફરકતાં રહ્યાં. લીમડાના આલાલીલા છાંયડાના દ્વીપમાંથી ઊભો થઈ, તડકાના હોજમાં ઝંપલાવી. એને લઈ આવું છું હું પાછી ‘અંદર’.

આજની બળબળતી ચૈત્રી બપોરે. તમારા કેમેરાના શ્રુતિપટે, સ્મૃતિપેટે – આમાં પણ સમયમાં અને સમયની પાર લઈ જતી –, પેલી મુહાયમ તડકાના સ્પર્શસુખે ચેતનવંતી બનેલી એક પંખીના સૃજનકાર્યની રમણીય ઘટના, ‘ઘાટાઘાટા’ અને હવે લગભગ ‘સ્થિર’ થતા દારુણ તડકાને, ‘ટુવિટ... ટુવિટ...’ ગાઈ ઉઠાય એવી મધુરી અનુભૂતિના ઝંકારના ધ્વનિમાં પલતટી ગઈ. ફેરવતી ગઈ. ‘અંદર’ અને ‘બહાર’... એના પડધાઓ સંભળાય છે કવિ. સંભળાય છે ? હા. નર્યુ રહસ્યમય ‘અંદર’નું વિશ્વ, એવા જ રહસ્યમય ‘બહાર’ના વિશ્વ સાથે અફણાય-આવિંગાય ત્યારે એના પડધાઓ કેવાક પડે ?

પડધાતાં – ઊડતાં પેલાં કબૂતરો, જુઓ કવિ પાછા આવીને ઊતર્યા છે. એમનાં ગળાનો નીલો રંગ તડકામાં વધુ મુખર થતો આવે છે. ન ગોળાકરે, ‘નત નેરે’ એ લોકો ચાડી રહ્યા છે. એકાઢું વળી ગળું ફુલાવી ગાઈ રહ્યું છે અચાનક. તમે શું કહેવા માંગો છો એની પરવા કર્યા વિના આ ગોઠડી માંડી એટલી ઘડીમાં આ બાંકડો તડકે ઊભરાઈ ગયો. મારા ‘અને’ બદલી હું હવે મંદિરની ‘અંદરના’ પાળે જઈ બેસું ? ત્યારે અને પછી ઘરે જઈશ ત્યારે પણ આ ઝંકારતા ધ્વનિઓનો કલશોર માળો બાંધતો રહેશે. સ્મૃતિનું પેલું ટૈયાડ અ...ને આ દરજીનો મારી ચેતનામાં અંદર-બહાર, બહાર-અંદર આવ-જા કર્યા કરશે. થયા કરશે ત્યારે ...ટુવિટ....!



## ૪૮. બિલકુલ આ ક્ષાળનો શરૂદઃ લાંડાંનાં ત્રણ લઘુકાવ્યો

ધીરેન્દ્ર મહેતા

### શરૂદઃ

શરૂદઃ

વિશેષજ્ઞની ચાદર ઓળીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.  
જગ્યાતું એને ?

(‘બૂમ કાગળમાં કોરા’માંથી)

શું થશે ?

તાત્ત્વિક કટોકટીમાં  
મારું કિયાપદ ફસાઈ ગયું છે.  
શું થશે ?

(‘બૂમ કાગળમાં કોરા’માંથી)

‘ભાષા’માંથી

ખંડ : ૮૨ (કાવ્યપુરુષ પક્કે છે)

કાવ્યપુરુષ

પંખીના પડણાયા

પક્કે છે

નાખી

ભાષાજળ.

ભાષા  
પોતાના પ્રતિબિંબને  
ભાષામાં  
તિરંદાજ થઈ  
તાકે.

(‘હથિયાર વગરનો ઘા’માંથી)

પિય યોગેશ,

‘આસ્વાદ’ કરવા-કરાવવાના ઈજન સાથે તે મને લાભશંકર ઠાકરનાં અક્કેક-બજે વાક્યનાં ચાર કાવ્યો મોકલી આપ્યાં. એ જોઈને આણી મૂઢ્યમાં હસી રહેલી તારી છબી મને પ્રત્યક્ષ થઈ. પ્રત્યક્ષિયા તો એવી જન્મી કે ‘એવો’ ‘આસ્વાદદેખ’ લખી મોકલીને હુંય સામો ‘હથિયાર વગરનો ઘા’ કરું. ‘એવો’ એટલે કેવો ? કે, એનો નાદર નમૂનો પેશ કરું. ‘બૂમ કાગળમાં કોરા’માં લાંઠાંએ બૂમ પારીને આપણાને સહૃદે પૂછ્યું હતું :

‘શબ્દ

વિશેષજ્ઞની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસધસાટ.  
જગાંડું એને ??’

આંખોમાં લોળપણ ભભરાવીને ગંભીર મુખમુદ્રાથી હું આવો નિર્દેશ કરી શકું : જુઓ, કવિએ અહીં એક વાક્યની બનેલી ત્રણ પંક્તિમાં બજે અર્થાંકારોનો કેવો આકર્ષક ઉપયોગ (ના, ના, પ્રયોગ) કરેલો છે ! ‘વિશેષજ્ઞની ચાદર’માં રૂપક અલંકાર છે – વિશેષજ્ઞાપી ચાદર. આ અલંકારયોગમાં મૌલિકતા છે, અપૂર્વતા છે, નાવીન્ય છે, જે કવિપ્રતિભાનાં પરિચયક છે, પણ એમાં બૂબી એ રહેલી છે કે આ અલંકાર સમેત જે ચિત્ર આવેણ્યું છે (સોરી, જે કલ્યાન રચ્યું છે) તેમાં તેમજો કુશળતાપૂર્વક સજીવારોપણ અલંકારનો પ્રયોગ (ના, વિનિયોગ) કરી લીધો છે – આપણી આંખ સામે વિશેષજ્ઞની રંગબેરંગી ચાદર છેક મસ્તક સુધી ઓઢીને ભર ઊંઘમાં પોડેલી વ્યક્તિનું ચિત્ર આવે છે. તેમે જોઈ શકશો કે ત્યાં કવિની હાજરી પણ છે, કેમકે કાવ્યમાં ઉક્તિની રીતિ પ્રયોજાઈ છે. અને સામે શ્રોતા તરીકે આપણે પણ છીએ – આ ઉક્તિ આપણાને ઉદ્દેશીને છે, કવિ આપણાને પૂછ્યે છે, ‘જગાંડું એને ??’ આ રીતે આપણા આ સમર્થ નાટ્યકારની આ કાવ્યકૃતિમાં નાટ્યાત્મક તત્ત્વ પણ છે, જેથી જીવંતતાનો અનુભવ થાય છે....

આવું આવું અન્ય ત્રણ કાવ્યો વિશે કહીને હું એમનો પણ ‘આસ્વાદ’ કરાવી શકું. અને એમ કરતાં મેં કાવ્યમાં નથી એવી કશી વાત કરી છે એમ પણ કોઈ કહી નહિ શકે.

લાંડાંથી તો હું સલામત અંતરે હું પરંતુ એ વાંચતાં વાંચતાં બગડું તારું મોં હું બરોબર જોઈ શકું છું. મને એ પણ ખબર છે કે મારો એ લેખ તને ‘પરબ’ના વિશેષાંકની સામગ્રી રૂપે કામ લાગે એ કરતાં સંપાદકીયમાં વિશેષ કામ લાગે !

પણ થોબ, તને એ ખ્યાલ આવ્યો હશે કે એહી મેં કરેલી વાત એમ છેક કાઢી નાખવા જેવી નથી. આપણી ભાષાની કવિતાના એક મહત્વના સ્થિત્યંતરનાં, અને લાંડાંના કવિવ્યક્તિત્વના એક સ્થિત્યંતરનાં ઠંગિતો એમાં પડેલાં છે. સાતમા દાયકામાં આપણા કવિએ આ વિમાસણ અનુભવી હતી –

‘છેંદની છ હજાર વર્ષ જૂની ચાલથી  
ઓગણીસોચુમોતેરને કેમ ચલાવવો ?’

– ચંદ્રકાન્ત શેઠ

ઇહું દાયકામાં કવિ તરીકે સિદ્ધ થઈ ચૂકેલા લાંડાંના કવિચિત્તમાં આ તબક્કે ભાષાને લઈને પ્રશ્નો ખડા થાય છે. આમ તો કવિતાના માધ્યમ તરીકે પ્રયોજાતી રહેલી ભાષા જ માનવવ્યવહારમાં પણ હરતીફરતી રહી છે – વિશેષણ, કિયાપદ, કિયાવિશેષણ, સર્વનામ, પ્રાસ, એવા ચિત્રવિચિત્ર વાચા ધારણ કરીને, જાતજાતના ઠરદાઓથી અને દાનતથી. કવિતામાં પણ એનું કામ્ય રૂપ કવિએ જોયું છે, સેવ્યું પણ છે. પરંતુ પછી ‘કમશા: તિરાડો પણ એમાં સમાંતર પડતી રહી....’ એ તિરાડો આસપાસના જગતમાં જે કંઈ જોયું તે વિરુપતા, વિકૃતિ, ફૂરતા, વિષમતા અને વિરોધને કારણે પડી. ડોળઘાલું ભદ્ર લોકો, શ્રદ્ધેય જનો, પુણ્યશાળીઓ સાથે મનોમન કન્ફન્ટેશન શરૂ થયું, એના સંકેતો એમનાં વર્તનવલાણમાં પણ દેખાવા લાગ્યા. એ વિશે લાંડાંએ કહ્યું છે :

‘વંકદર્શનને કારણે જે કંઈ આત્મસાત્ર થતું હતું ત્વરાથી, તલ્વીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કરતારતું, ખવાતું, ક્ષીશ થતું રહ્યું છે.’

– સર્જકની ઔંતરકથા, ૪

એનું પરિશામ શું આવ્યું ? લાંડાં-એ એને લગતી કેદ્ધિયતમાં તે જગ્યાવ્યું છે : ‘આત્મસાત્ર કરતાં કરતાં રચાયા હતા તે સંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખબડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે આંદુઅવળું ઈધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું દ્રિમ્યલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સરણું. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીનતલીન બની શકે એવા ગંજેરી હાલ ઈન્ટિગ્રેટ, રહ્યા નથી. ટ્રાંકિવલાઈઝરની ટીકરી જેવાં ગીતગઝલનાં એકધારાં લય-આવર્તનોની થોરપીની જરૂર નથી, છદ્ર.’

– એજન, ૫

આ ‘સર્જકોની નવી પેઢીના સાહિત્યગુરુ’એ આ તબક્કે પોતાની કાવ્યવિભાવના આ પ્રમાણે રજૂ કરેલી છે :

‘આજ લગીના પરંપરિત જીવન સાથે, પરંપરિત ભાષા સાથે શૈશવથી તાદત્ત્ય (આઈન્ટિફિકેશન) અનુભવ્યું હતું તે પુખ્ત વયે તૂટે છે અને ભાષા સાથેનું, ભાષામય કન્ફન્ટેશન (Confrontation – મુકાબલો) આરંભાય છે. આ કન્ફન્ટેશન તે કવિતા. શૈશવથી આજ લગી જે થયું તે પરંપરિત ભાષાને, પરંપરિત લયને આત્મસાત્ર કરવા માટે થયું, તાદત્ત્યથી થયું. કવિચેતના પુખ્ત થતાં, એની વૈયક્તિક અનુભૂતિ સાથે પરંપરિત ભાષાનો મેળ ન બેસતાં કન્ફન્ટેશન આરંભાય છે. આત્મસાત્ર થયેલાં પરંપરિત શબ્દપ્રતીકોને તળે ઉપર કરતું, ઉથલાવતું, તોડતું આ યુદ્ધ એ સાચી કવિતાનો આરંભ છે. આ યુદ્ધની શબ્દક્ષણો એ પ્રતિપળનું પરમ આશ્રય છે.’

– પ્રતિભા અને પ્રતિભાવ, ૧૪૧

આવો મુકાબલો આ ‘શબ્દ’ શીર્ષકના લઘુકાવ્યમાં જોઈ શકાય છે. આ મુકાબલો એવા શબ્દ જોણે ‘સ્વ’ને છુપાવી રાખ્યું છે કૃતકતાનાં આવરણોની નીચે, અને પોતે નિશ્ચેતન થઈ ગયો છે. એ અભિવ્યક્તિ અને અવગમનની ક્ષમતા ગુમાવી બેઠો છે. કવિ ‘દુંપળનું ખૂલવું’ કે ‘વૃક્ષોનું જૂલવું’ આ નિષ્ણાણ, નિર્સંદ શબ્દમાં પામી શકે એમ નથી. જરૂર છે એને જગાડવાની – સચેતન કરવાની, એટલે તો કવિ પૂછે છે (આપણને – ‘સામાજિક’ને કે જાતને) : ‘જગાડું એને ?’

પણ શબ્દને ‘જગાડવાનું’ – એનામાં જાગૃતિ પ્રેરવાનું કામ પણ કવિએ કરવાનું તો છે શબ્દ વડે જ. કવિ કહે છે, ‘શબ્દની સામે કરું છું બંડ શબ્દોથી..’ એમ કરતાં ક્યારેક પોતાને ‘કવિતાગ્રસ્ત, કંડિશાન્ડ’ અનુભવે છે, ક્યારેક ‘લઘરા’ રૂપે જુએ છે, જેની ‘ડેલ શબ્દની કાણી’ છે. આવી ભાષાને એમાણે ખોદી નાખવી છે પરંતુ ખોદી શકતી નથી. કવિને ખબર છે –

‘ઉલેચાતો શબ્દ  
ક્યાંક તો ખૂટી જવાનો છું.  
અને તૂટી જવાનો છું  
કિયાના  
કર્મથી  
નામના વ્યયથી  
વિશેષજ્ઞથી  
આમ-થી ને તેમ-થી  
છે અને છું-છાં થકી.’

ભાગાની નિર્વિર્ય સ્થિતિ અંગે આમ નિર્ભાત થયા પછી પણ આ ‘કાવ્યપુરુષ’ શાને અર્થે જૂએ છે ? શાની મદદથી ? જુઓ –

‘કાવ્યપુરુષ  
પંખીના પડળાયા  
પકડે છે  
નાખી  
ભાગાજાળ’

એક અધ્યાસથી તરત અખો યાદ આવે છે –

‘પંખી – ઓળાયો પદિયો જાળ  
(પણ) પોતે ઉડે નિલગ નિરાળ.’

અહીં પણ ભાગાની જાળમાં પંખી તો ઝડપાઈ શકે એમ નથી, એનો આભાસમાત્ર છિલાય તો છિલાય. ભાગાથી થતી પ્રવૃત્તિ કેટલી મિથ્યા, કેટલી વૃથા છે !... કોઈ કાવ્યસૌદર્યલુભ્યમુંધ રસભોગીને આ પંક્તિઓમાં રચાતું કલ્પન કે વાર્ષસગાઈ કે લયાત્મક ગતિ લોભાવે તો લોભાવે. પછી એ બીજા કશાની પરવા ન કરે તો ન કરે. એતું જ આ રચનામાં –

‘ભાગા  
પોતાના પ્રતિબિંబને  
ભાગામાં  
તિરંદાજ થઈ  
તાકે.’

ભાગાનો મુકાબલો ભાગા વડે જ કરવાનો રહે છે, એ કવિની નિયતિ છે. એ માટે ‘એક સ્વરષ્ટ સાફ સાદો સીધો.... શબ્દ’ કવિ શોધે છે, અક્ષુણણ આશા સાથે –

‘મેં તો આશા છોડી નથી ચોખમાચણક શબ્દની  
ભૂત-ભાવિના સ્પર્શ તિનાનો  
આ કાણનો  
બિલકુલ આ કાણનો.’

અહીં તેમ ઘણી જગાએ જોવામાં આવ્યું હો કે એક પ્રકારની સરલતા, એ પણ લાભશંકર ઠાકરની અભિવ્યક્તિનું એક લક્ષણ છે. એમની કવિતા કોઈ વખત સીધા વિધાન રૂપે આપણી સામે આવે છે, કોઈ વાર એ આપણાને પરિચિત એવો લહેકો કરી લે છે, ક્યારેક તળમાંથી જબકે છે ત્યારે અભિવ્યક્તિનું એ રૂપ જોવા મળે છે. એ એવી રીતે દેખા ઢે છે કે કોઈને એનું એ રૂપ કદાચ છલનામય પણ લાગે કે એમ હોવાનો વહેમ પડે.

સ્થિત્યંતરને આ તબક્કે જ્યારે રોખની જગ્યા બિંગત દણ્ણોષે લીધી ત્યારે સમજાયું કે દેખાતું દુરિત પણ કશકાના પરિણામનું હોય છે, ઇતાં why-નો કોઈ ઉત્તર નથી મળતો ત્યારે ‘તાત્ત્વિક કટોકટી’ ઉભી થાય છે. અને આ સંપ્રશ્ન સર્જક, એમનું ક્રિયા-પદ એમાં ફસાઈ ગયાનું અનુભવે છે. કર્તિ લાભશર્કરના આધિક્ષૌતિક (મેટ્રાફિલ્ડિકલ) વલાણનો – એમાંથી જન્મતી સંકુલ મનોદશાનો એમાં સંકેત છે.

‘ડિયર’ યોગેશ, જોયું, તેં આપેલાં ત્રણ લઘુકાયોની ચર્ચામાં મારે કવિની બીજી કેટકેટલી કાચ્ચપણ્ણિઓ જોડવી પડી છે, કારણ કે આ રચનાઓ તો કવિની મથામણ છે – કાચ્ચવિભાવના બદલાયા પછીની મથામણ છે, જે અનેકાનેક રચનાઓમાં સતત થતી રહી છે. ‘ધોખા’ પછીની ‘થેળાં અવાજ ધોંઘાટ’ વચ્ચેની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા બહુ લાંબી ચાલી છે. એના સંચયોને કદાચ કોઈ ‘સ્કેપબુક’ તરીકે પણ ઓળખારે. કવિતા તો આપણને ‘માણસની વાત’ કે ‘પ્રવાહણ’માં મળે છે. ત્યાં, એને માટે, ‘આસ્વાદ’નાં ઓજાર કામ ન લાગે. મથામણનો ‘આસ્વાદ’ ન હોય, ચર્ચા હોય, જે લાંઠાંનાં બક્તિત્વ અને કૃતિત્વ, ઉભયનો પરિચય આપે. આ એવો એક વિનમ્ર પ્રયત્ન.

૨૦-૦૩-૨૦૧૬

18

## સાભાર સ્વીકાર

### નવલિકા

(૬૧) સાખ્ય : નલિની કિશોર નિવેદી, ૨૦૧૫, હર્ષ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૪+૧૪૬, રૂ. ૧૪૦ (૬૨) ફિંગરપ્રિન્ટ : મનહર રવૈયા, ૨૦૧૫, હર્ષ પ્રકાશન, અમદાવાદ, ૧૨+૧૮૦, રૂ. ૧૫૦ (૬૩) અમે : અશોકપુરી ગોસ્તવામી, ૨૦૧૫, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. મુંબઈ/અમદાવાદ પૃ. ૧૬૦, રૂ. ૧૨૫ (૬૪) અજાણી દિશા : માવજી મહેશરી, ૨૦૧૫, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. મુંબઈ/અમદાવાદ, પૃ. ૨૪૮, રૂ. ૨૦૦ (૬૫) શેર બજારનો Magic Touch : અશ્વિન શર્મા, પુનર્મુદ્રણ-૨૦૧૫, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ/અમદાવાદ, પૃ. ૨૦૦, રૂ. ૧૫૦ (૬૬) પળોના પડછાયા : ડૉ. આઈ. કે. વીજળીવાળા, ૨૦૧૫, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૬૪, રૂ. ૮૦ (૬૭) મુહી ઊંચેરા ૧૦૦ માનવરલન : ભડાયુ વલાજાની, ૨૦૧૫, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ/અમદાવાદ, પૃ. ૨૮૮, રૂ. ૨૦૦ (૬૮) પરિક્રમા નર્મદા મૈયાની : અમૃતલાલ વેગડ, પુનર્મુદ્રણ ૨૦૧૫, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૭૬, રૂ. ૧૩૫



## કળારસિક લાભશંકર ઠાકરનું નિર્નિમણ ગેલિંગ અને દશ્યકળા : એક કોલાજ

સંકલન અને પ્રસ્તુતિ : પીયુષ ઠક્કર

(૧)

તારીખ ૫-૮-૨૦૦૧ના કવિ રમણીક સોમેશ્વરને લખાયેલા એક પત્રમાં લાભશંકર ઠાકર નોંધે છે :

“ ‘આઈમો રંગ’ તક મળશે ત્યારે વાંચીશ. હિમાંશી (શૈલત) સારા વાર્તાકાર, ગાંધીકાર છે. જ્યંત ખરી અમૃતાને (અમૃતા શેરગાલ) મળ્યા હશે. પોતે પણ ચિત્રકાર હતા. નાનાભાઈ (નાનાલાલ જોશી) પાસે તે સ્મૃતિઓ રસપ્રદ હશે. અમૃતાનાં ચિત્રોની પ્રિન્ટ્સ જોઈ છે. એમના અનેરા જીવન વિશે કંઈક વાંચ્યું છે. હિમાંશીની ચિત્રન નવલ વાંચીશ. આપણા ગુજરાતના સમકાળીન ચિત્રકારોની નજીક આવવાનું અને મિત્ર બનવાનું મને બન્યું છે તેનો આનંદ છે. મારી રે મઠની પ્રવૃત્તિ વખતે ચિત્રકારોનો ઘણો સાથ મળતો. ‘એક ઉંદર અને જ્ઞાનાથ’, ‘ઈનર લાઈફ’, ‘પ્રવાહણ’નાં ચિત્રો ભૂપેન ખાખરે કરી આપેલાં ‘માણસની વાત’ના મુખપૃષ્ઠમાં જ્યોતિ ભણ અને અધિન મોદીનો લાભ મળેલો. ‘એ’ અને ‘કૃતિ’ના અંકોમાં પણ જેરામ પટેલ, પિરાજ સાગરા, ભાનુ શાહ અને અધિન મોદીનો લાભ મળેલો. ‘એ’ અને ‘કૃતિ’ના અંકોમાં પણ જેરામ પટેલ, પિરાજ સાગરા, ભાનુ શાહ વગેરે અનેક મિત્રોનાં ચિત્રોનો લાભ મળતો. ક્યારેક તો બ્લોકનો ખર્ચ પણ ચિત્રકારો આપતા. એમનાં ચિત્રપ્રદર્શનો વખતે વક્તવ્યો પણ આપ્યાં છે. એ પ્રસંગે કાબ્યપઠન અને રંગમંચપ્રયોગો પણ કર્યા છે. ચિત્રકારો સાથે સંભાષા કરવાનું મને હેઠેશાં ગમ્યું છે. કોઈને તો નાટકમાં ઉત્તાર્યા છે પણ ખરા.”

(પત્ર-લાભ, સંપાદક : રમણીક સોમેશ્વર, ૨૦૧૬, પૃ. ૫૧-૫૨)

હા, એમના એકાધિક પુસ્તકોનાં આવરણ પર ચિત્રકારમિત્રોની કૃતિઓ મુકાઈ છે. એમાંના કેટલાંક પુસ્તકો જોઈએ. પહેલા કાવ્યસંગ્રહ વહી જતી પાછળ રમ્યાઓછા’ (૧૮૬૫)નું આવરણ અરૂઢ છે. એક યુવતીના ચહેરાની શેત-શ્યામ છબિ આખાય આવરણ પર છે. સંગ્રહનું

નામ પણ પાછલા પૂઠે મુકાયું છે. પુસ્તક જોતાં જોનાર અવધવમાં મુકાય એવું એ આવરણ... અંદરના પાને ચાર કાબ્યો(ચાંદરણું, પૃ. ૩; પતંગિયું, પૃ. ૪૬; ‘ભૂર્યને શિક્ષા કરો’, પૃ. ૮૮; સાંજના ઓળા લથડતા જાય, પૃ. ૭૧)ની સંગતિમાં ચાર ડ્રોઝંસ મુકાયાં છે. એમાં ત્રણ પિશાજ સાગરના છે અને એક ભૂપેન ખખરનું છે. કાબ્યો વાંચતાં જણાય કે ચિત્રોનો કાબ્ય સાથે કંઈક સીધો નહીં પણ આડકતરો કે અછડતો સંબંધ છે. જોકે બીજી આવૃત્તિ વખતે કાબ્યસંગ્રહનું નામ આવરણ પર મૂક્યું છે પણ રેખાંકનો કાઢી લેવામાં આવ્યાં છે.

‘આણસની વાત’(૧૯૮૬) દીર્ઘ કાબ્ય પુસ્તકની પહેલી આવૃત્તિના આવરણ પર જીથોતી ભણનું ચિત્ર મુકાયું છે તો બીજી આવૃત્તિ (૧૯૮૮)ના આવરણ પર અચ્છિન મોદીનું ડ્રોઝંગ મુકાયું છે. બંને આવરણો પર માનવસંદર્ભ પોતીકી શૈલીમાં કળાકારે આવેખ્યો છે. ‘પ્રવાહણ’ (૧૯૮૬) ભૂપેન ખખરના ડ્રોઝંગ સાથે પ્રગટ થાય છે. સંગ્રહના અંતે પોતાની સંક્ષિપ્ત નોંધમાં કવિ નોંધી છે : “એક વાર ભૂપેન પાસે ‘પ્રવાહણ’નું પઢન કરવાની તક મળી. એમને મજા આવી અને આ સરંગ કાબ્યનું પુસ્તિકા રૂપે પ્રકાશન કરવાનું સૂચયું. ભૂપેન બે ચિત્રો પણ કરી આપ્યાં.” આવરણ અને પાછલા પૂઠે મુકાયેલાં ચારકોલ ડ્રોઝંગસમાં વિષય સાથે સંગતતા, સાતત્ય છે અને કાબ્યવસ્તુથી પ્રેરિત છે. ભૂપેનની લાક્ષણિક શૈલીમાં રચાયેલાં આ રેખાંકનોમાં પાત્રોના ચહેરે સંર્વર્થ અને મુક્તિ બંનેનો અહેસાસ મળે છે. આ સાથે એ પણ નોંધી લઉં કે ભૂપેને ૧૯૬૦ના ગાળે લાભશંકર ઠાકરે દિનેશ કોડારી સાથે મળીને લખેલ ‘Inner life’ (૧૯૬૫) અને સુભાષ શાહ સાથે મળીને લખેલ ‘એક ઉંદર અને જફુનાથ’ (૧૯૬૪-૬૫) ? પુસ્તકોના આવરણ પર અક્ષરો અને ભૌમિતિક આકારો વડે જન્મોત્ત્રીની સંરચનાને મળતી આફૂતિઓ રહી હતી.

એ પછીના બે કાબ્યસંગ્રહો, ‘લઘરો’ (૧૯૮૭) અને ‘થોળાં અવાજ ધોંઘાટ’ (૧૯૮૮)નાં આવરણ પર રેખાઓનું કળાત્મક અને કાબ્યવસ્તુને સૂચક આવેખન મળે છે. ‘લઘરો’માં N.I.D.નાં ચોથા વર્ષના વિદ્યાર્થીની સરીતા કરુણાકરને રેખાઓમાં બંધાતી કે પછી વિગતિથતી માનવઆફૂતિ આલેખી છે. ‘થોળાં અવાજ ધોંઘાટ’ સંગ્રહમાં આવરણ-કળાકારનું નામ નથી મળતું. એના આવરણ-કળાકારે અક્ષરો, શબ્દો ને રેખાઓના આટાપાટામાં શીર્ષકને તાદૃશ કર્યું છે. ‘કાલગંથી’ (૧૯૮૮)માં આવેલા કાબ્યસંગ્રહના આવરણ પર મદીર સુમન શાહે કરેલું ડ્રોઝંગ છે. પીગળતો હોય એવો એમાં ચહેરો છે. આ પણ કાબ્યવસ્તુથી પ્રેરિત જણાય છે.

‘કિયુડ કિયુડ’ (૧૯૮૮) અને ‘આવ’ (૨૦૦૬) કાબ્યસંગ્રહો પર કવિ-ચિત્રકાર પ્રબોધ પરીખનાં ચિત્રો મુક્યાં છે. એકમાં ચારકોલમાં ચેત-શ્યામ યાદચિંહ આકારોમાં ચિત્ર રચાયું છે તો બીજામાં પેસ્ટલ રંગોમાં માનવઆફૂતિ રચાઈ છે. જે કોઈ ગાયકની મુદ્રામાં સૂરના બહેલાવમાં તલ્લીન છે. કેન્દ્રીય સાહિત્ય અકાદેમી માટે તાજેતરમાં જ પ્રબોધ પરીખે લાભશંકર ઠાકર પર એક દસ્તાવેજ ફિલ્મ બનાવી છે. વાવડ છે કે ફિલ્મ ઘણી સારી થઈ છે.

(૨)

લાભશંકર ઠાકરે કેટલાક ચિત્રકારો / છબીકારો વિશે લખ્યું છે :

## ૨.૧ થોડો અમસ્તો તદકો (૧૯૯૮)

૧. વક્તિ અને અભિવ્યક્તિ : ચિત્રકાર કનૈયાલાલ યાદવ, પૃ. ૮૫
૨. ચિત્રકાર અમિત અંબાલાલની સર્જકતા, પૃ. ૧૦૦
૩. શકરાભાઈ રાજજા, તો ઘનસયામ ? – એકદમ, એકદમ, તરોતાજજા !, પૃ. ૧૦૪  
(ચિત્રકાર શકરાભાઈ પટેલ વિશે)
૪. શાંતિ શાહ : પચાસ વર્ષનો ચિત્રકલાયોગ, પૃ. ૧૧૨
૫. શ્રુતી ધી આઈજ ઓવ સિમતા પાટીલ, પૃ. ૧૨૧
૬. ઢેલી, ઢેલ વગાડ મારે હીંચ દેવી સે : (છબીકાર સુલેમાન પટેલના સ્મૃતિઝંકારો),  
પૃ. ૧૨૮
૭. ટેબલટોપ ફોટોગ્રાફીના સર્જક : વિજય દલાલ, પૃ. ૧૩૫

## ૨.૨ નિસબ્ધત (૨૦૦૫)

૧. સર્જક કલાકાર : ભૂપેન ખાખર, પૃ. ૪૮

## ૨.૩ મનજળ થંભ થયેલું (૨૦૦૫)

૧. ચિત્રકાર : કિશન કંબલે, પૃ. ૮૬
૨. ચિત્રકાર : વૃદ્ધાવન સોલંકી, પૃ. ૮૮

## ૨.૪ મૂંગારો, ધ ઓરેન્જ અન.... (૨૦૦૬)

૧. બ્રોકન બ્રાન્ચિઝ, પૃ. ૧૭૧ (ચિત્રકાર અતુલ ડોડિયાને પત્ર)

## ૨.૫ સોનેરી ચુંબન (૨૦૦૮) : છબીકાર અને નિબંધકાર અસ્થિન મહેતાના લોખન સંદર્ભે (દસ) પત્રપ્રતિભાવ

## ૨.૬ અસંક્લિતઃ

૧. પિરાજ : Will to form, પિરાજ સાગરા : સિંહાવલોકન, ૧૯૮૩
૨. ચિત્રકાર અંજુ ડોડિયાનાં ચિત્રો : રૂમ ફોર ઇરેઝર્સ, 'નવનીત સમર્પણ', જુલાઈ ૨૦૧૩
૩. ડિયર ચિત્રકાર મિત્ર, સર્જક ગુલામ મોહમ્મદ શોખને લાંઠાંની સાનંદ સલામ,  
'નવનીત સમર્પણ', નવેમ્બર ૨૦૧૫

આ સિવાય પણ લાભશંકર ઠાકરે 'છે' (૨૦૦૨), 'છે પ્રતિક્ષા' (૨૦૦૨) અને 'આઈ ડોન્ટ નો, સર' (૨૦૦૨) કાવ્યસંગ્રહો અને નિબંધસંગ્રહ 'અહો ઝંકારતા ધ્વનિ' (૨૦૦૪)ના આવરણ પર મુકાયેલાં ચિત્રોનો ટંકો પરિચય આરંભે આખ્યો છે. જેમાં અનુકૂમે કેશ્મિર માવેત્યિચ, સાલ્વોડોર ડાલી, એદુઆઈ બુર્જ અને પાખ્યો પિકાસોની કૃતિઓમાં મૂકવામાં આવી છે.

ઉદાહરણ રૂપે આપજો જોઈએ કે લાભશંકર ઠાકર ચિત્રકારોને અને દશ્યકળાને કેવા

શબ્દોમાં અને કેવા લહેકાથી સંભારે છે. તેઓ કિશન કાંબલે વિશે લખતાં પહેલાં લખે છે : ‘ચિત્રકળાના અનેરા આકર્ષણે કારણે ઓક્ટોબર માસના એક શનિવારે અમદાવાદના રવિશંકર કલાભવનમાં સાંજે પહોંચી ગયો....’ તો વૃંદાવન સોલંકી વિશે લખતાં પોતાના અભિગમને સ્પષ્ટ કરતાં તેઓ લખે છે : ‘મને આ ચિત્રોમાં એક ચિત્રરસિક ભાવક તરીકે જે રસ પડ્યો તેની વાત કરવા લલચાઉ છું.’ સ્મિતા પાટિલે લીધેલી છબીઓ વિશે લખતાં આ વાત ફરી શબ્દાંતરે આ રીતે આવે છે : છબિકલા વિશે લખવાનો મારો અધિકાર નથી. કલારસિક છું. શબ્દ-કલાના સર્જનમાં ઊડી હિવચશી છે? લાભશંકર ઠાકરે આ જ વિનમ્રતાથી પોતાના અભિગમને રસ્તે જે કોઈ ચિત્રકાર-કળાકારનાં ચિત્રોથી રાજ થયા છે એમના વિશે લખ્યું છે. કોઈ હક્કદારો માંડ્યા વિનાના આ સહજ તેમજ મુક્ત મનના આવેખો-પ્રતિભાવો બની રહે છે. અન્યત્ર તેઓ અમિત અંબાલાલે સ્થાપેલી ગોલેરી કન્ટેમ્પરરી આર્ટ ગોલેરીને સંભારતાં લખે છે : ‘અમિતે કન્ટેમ્પરરી આર્ટ ગોલેરી શરૂ કરી ત્યારે એમની ઈચ્છા હતી કે તે ગોલેરીમાં બીજી કલાઓને પ્રત્યક્ષ કરતાં નાનાનાના કાર્યક્રમો થાય. આ લખનારે મિત્રોના સહકારથી તેવા અનેક કાર્યક્રમો યોજવામાં એક સમયે સંકિય રસ લીધો છે. નિર્ણન ભગતનું વ્યાખ્યાન હોય, કુમુદિની લાભિયાનું નૃત્યવિષયક સ-દાઢ્યાંત વ્યાખ્યાન હોય, અમે કવિમિત્રો કાચ્યોનું પઠન કરીએ, નાના રંગમંચ પર નાટકો પણ કરીએ. આ રીતે કલાઓ અને કલાકારોનો સંગમ ઈચ્છ છે.’ ‘શબ્દસુચિ’ના ‘નાટક અને હું’ (૨૦૧૨) વિશેષાંકમાં પ્રકાશિત પોતાની કેફિયત “‘એય લાંઠાં હોએ નાટકો લખશો, ભજવશો?’ ‘ના. ના. ના.’” માં ‘ઝિયડી’ નાટકમાં રોલ ભજવતા ચિત્રકાર બાલકણું પટેલને તેઓ યાદ કરે છે. અમદાવાદની કળાપ્રવૃત્તિનો જ્યારે ઈતિહાસ લખાશે ત્યારે આવા ઉલ્લેખો ઈતિહાસકારને ઉપયોગી થઈ રહેશે.

### (અ) ચિત્રકારની નજરે ગુજરાતી સાહિત્ય :

૩.૧ “રણજિત હોસ્કોટે : ગુજરાતી સાહિત્ય સાથેના તમારા અંતરંગ અને પ્રેરક એવા સંબંધ વિશે કંઈક કહેશો ? સાહિત્યમાં તમારા પ્રદાન વિશે અને એ જ પ્રમાણે તમારા ઘડતરમાં સાહિત્યનો કેવોક ને ફાળો રહો છે ?

અતુલ ડેડિયા : મારો જીવનમાં અને ખાસ કરીને મારાં આરંભકાળનાં વર્ષોમાં ગુજરાતી સાહિત્યનો ઘણો પ્રભાવ રહ્યો છે. સુરેશ જોણી કે જેઓ વડોદરામાં રહેતા હતા એમનું મારા મનમાં મોટું સ્થાન છે. સુરેશભાઈનો સૌંદર્યશાસ્ત્રનો તત્ત્વવિચાર અને ચર્ચા તેમજ સર્જનાત્મકતામાં દાર્શનિક અભિગમની ખેવનાનો ગુજરાતી લેખકો પર મોટો પ્રભાવ હતો. સુરેશભાઈની સાહિત્ય માટેની સંવેદના, પ્રીતિ અને લગનીનું મને જબરું આકર્ષણ રહેતું. તમે તો જાણો જ છો કે સિતાંશુ વશશ્વંદ અને લાભશંકર ઠાકર - આ કવિઓનો કળાકાર તરીકેના મારા ઘડતરમાં મોટો ફાળો છે. પોતાના માધ્યમ પરની તેમની પકડ, કીડા અને તેમનો સકલને આવરી લેવાનો અભિગમ મારી ભિન્ન-ભિન્ન પ્રકારે કામ કરવાની વૃત્તિને પ્રેરક નીવડચો હોય.

જ્યાં સુધી સાહિત્યમાં મારા પોતાના યોગદાનની વાત આવે છે તો મને શંકા છે કે મારું એમાં કોઈ કામ હોય. દશ્યકળા હજ્યે ઘણા ગુજરાતી લેખકોના માથા ઉપરથી જાય છે. જોકે ઘણા લેખકો-કવિઓએ મારાં ચિત્રો પોતાનાં પુસ્તકોનાં આવરણ માટે લીધાં છે. એટલે હું એમ કહી શકું કે કેટલાંક પુસ્તકોનાં આવરણ સિવાય સાહિત્યમાં મારું કોઈ યોગદાન નથી.”

(સૌજન્ય : Atul Dodiya : *The Dialogue Series*, Ranjit Hoskote, Nancy Adajania, Popular Prakashan, 2011, pp.81

૩.૨ ‘બકો છે. કલ્યો’ પ્રેરિત ચિત્ર-શૃંખલા ‘*Bako exists. Imagine*’ વિશે ચિત્રકાર અતુલ ડોડિયા :

એક ગદ્યભંડની યાદ અપાંગું. નાનકડો છોકરો બકો, ગાંધીબાપુને મળી શકે છે, ભવે ઊંઘમાં તો ઊંઘમાં, પણ મળી શકે છે. કવિ લાભશંકર ઠાકરકૃત ‘બકો છે. કલ્યો’ અનેક નાના ગદ્યભંડોથી સંકળાયેલી એક અદ્ભુત રચના છે.

“ગાંધીબાપુને હું મારી ઊંઘમાં લઈ જાઉં છું. દોરીને પેન્સિલથી.  
એમના પગ દોરું તાં તો ચાલવા માંડે.

‘બાપુ તિભા રહ્યો. હજ મને પૂરા દોરવા તો દો.  
બાપુ કહે : ચાલતાં ચાલતાં દોરવા શકાય ? એ તો

અટકતાં જ નથી મારી ઊંઘમાં.  
હું પેન્સિલની અણી અડાંદું તાં તો આગળ અને આગળ.

અટકે તો પૂરેપૂરા દોરું ને !”

આ અને બીજા થોડાક ગદ્યભંડો લઈ મેં એક ચિત્રપ્રદર્શન યોજેલું. જેને અંગ્રેજી શીર્ષક આપ્યું ‘*Bako exists. Imagine*’ નિશાળના કાળા પાટિયા (બ્લેક બોર્ડ) જેવા રંગોમાં કેનવાસને રંગી તેના પર સફેદ ઓર્ઝિલ સ્ટિકથી કેટલાક ગદ્યભંડો પસંદ કરી જાણો ચોકથી લખ્યા હોય તેમ આવેખ્યા. આ ગુજરાતી ગદ્યનો અંગ્રેજી અનુવાદ કરાવી તે અંગ્રેજમાં લખેલા જેથી બિનગુજરાતી અને કળા-જગત સાથે સંલગ્ન એવો બહોળો સમુદ્દરાય પણ તેને વાંચી શકે, માણણી શકે. લખાણ વાંચી શકાય તેટલું સ્પષ્ટ રાખેલું. ચિત્રમાં લખાણ સાથે બીજા આકારો – માનવાકૃતિ, છોડ અને પાંદડાં, ડાળીના પડછાયા પણ હતા. જોનાર દર્શક ચિત્રને ‘જુઝે’ અને સાથે ‘વાંચે’ પણ. મને એ વાતમાં રસ હતો. જો કોઈ દર્શકને અંગ્રેજી ભાષા ના આવડતી હોય તો આ ચિત્રોને કઈ રીતે જુઝે ? આ પ્રશ્નને એ સમયે મેં બાજુ પર રાખ્યો. પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે જોનાર માટે – આ નિશાળનાં પાટિયાં છે કે ચિત્ર છે ? એ પ્રશ્ન જરૂર તિભો થશે. આ વાતનો મને ખ્યાલ હતો અને એટલે જ મને આ ચિત્રોને આ રીતે કરવામાં રસ પડયો.

ગાંધીબાપુ અને એક દસ-બાર વર્ષનો છોકરો – બકો, બંને એકબીજાને એકમેકની ઊંઘમાં મળે છે અને એક કાલ્યનિક ફેન્ટસી કહી શકાય એવો એક અનન્ય સંવાદ રચાય છે.

બન્યું એવું કે આ ‘લખાણવાળાં’ ચિત્રોને જોવા દર્શક વધુ રોકાયો.. કારણ કે તે લખાણ વાંચતો અને વાંચતાં વાંચતાં મંદ મંદ સિમત પણ વેરતો. થોડો મુંઝાયો કે ગાંધી તો ઠીક પણ આ બકો કોણ છે? ત્રસ્ત સમકાળીન સમયમાં ગાંધીને આ રીતે યાદ કરવાની લાભશંકર ઢાકરની સર્જનાત્મકતા પર તે વારી ગયો. હું તો પહેલેથી જ વારી ગયેલો કે આ બકો અને બાપુ આ ચિત્ર-શૃંખલા થવા માટે જ સર્જાયા છે! મારે આ લખાણ આવેખવું જ રહ્યું, છૂટકો જ નહોતો.

(‘આ’ ચિત્રની પરિભાષા અને ભાષાનું ચિત્ર, ‘નવનીત સમર્પણ’, નવેમ્બર ૨૦૧૫, પૃ. ૫૮-૬૩)

ચિત્રકાર અતુલ ડોડિયાની ચિત્ર-શૃંખલા ‘Bako exists-Imagine’ વિશે આ લખનારે ‘પરબ’ના નવેમ્બર ૨૦૧૩ના અંકમાં આવરણચિત્ર : આસ્તાદનોંધ કરી છે. વાચકોને તે જોઈ જવા વિનંતી. આ અંકમાં અન્યત્ર મુક્યેલાં ચિત્રો પણ એ દસ્તિએ જોઈ શકાય.

(૪)

**આવરણચિત્ર-સંદર્ભનોંધ :** પરબ, જૂન-જુલાઈ ૨૦૧૬

**ચિત્રકાર :** અતુલ ડોડિયા (જ. ૧૯૫૩, મુંબઈ)

**ચિત્રશીર્ષક :** એન્ટલર્સ એન્થોલોજીનું દસમું ચિત્ર

**માધ્યમ :** કાગળ પર જળરંગ, ચારકોલ અને માર્બલ ડસ્ટ

**માપ :** ૮૪" X ૬૦"

**વર્ષ :** ૨૦૦૪

બાર ચિત્રોનો આ ચિત્ર-કાબ્યસંપુટ છે. મોટા કદના કાગળ પર રચાયેલાં આ ચિત્રોની પ્રેરક સામગ્રી કવિતા છે. અતુલ ડોડિયાને ગુજરાતી ભાષા સાથે જોડતાં એ કાબ્યો છે. ગુલામમોહમ્મદ શેખ, લાભશંકર ઢાકર, સિતાંશુ યશશેંદ્ર, રાવજી પટેલ, રાજેન્દ્ર શુક્રલ, મનોજ બંડેરિયા, હરીશ મીનાશ્રુ, કમલ વોરા અને વિપાશાનાં કાબ્યો એ માટે એમણે પસંદ કર્યા છે. આમ તો કવિતા અને ચિત્રોનો જૂનો સંબંધ છે. પોથીચિત્રો એમાં આપણાને તરત યાદ આવે. અતુલનો પોતાનો સાહિત્ય સાથેનો ઘરોબો ઘણો આત્મીય છે. એમના પોતાના ઘડતરમાં અને એમણે જીવેલા પડકારોમાં ગુજરાતી અને મરાઠી કવિતાનો સથિયારો એમને મન અગત્યનો છે. એટલે જ એમનાં ચિત્રોમાં લિખિત ભાષાના અક્ષરો તરેહવારના રસ્તે પ્રવેશી જાય છે.

આ ચિત્રશ્રેષ્ઠનું સ્થાપત્ય સમજવાનો પ્રયત્ન કરીએ. મોટા કદના કાગળ ઉપર જળરંગ, ચારકોલ અને માર્બલ ડસ્ટના વિનિયોગ દ્વારા આ ચિત્રો કરવામાં આવ્યાં છે. એક શ્રેષ્ઠી રૂપે આ ચિત્રો રચાયાં છે. એ માટે એક જ માપના કાગળ રાખ્યા છે. ચિત્રમાં જે રીતે ચિત્રસપાટીની માવજત કરી છે અને જે રીતે એમણે એ સપાટી પર આકારો માંડ્યા છે એ જોતાં સમગ્ર

ચિત્રશ્રેણી દર્શકના – ભાવકના ચિત્ર પર એક ઊરી ને વેરી છાપ છોરી જાય છે.

વનસ્પતિનાં ચિત્રાંકનો, અન્ય કળાકારોના ચિત્રાંશો અને પોતીકા ચિત્રબિંબો દ્વારા આ શ્રેણીની દશયભાષા આકાર લે છે. કાગળની સપાટી એટલે તુકારામથી તે મરાઈ-અંગેજ કવિ અરુણ કોલાટકર હુદે છે તેમ ભીજીની વહીનાં ભીનાં પૃષ્ઠો છે. અહીં જળરંગના પ્રયોજનમાં જળરંગનું રૂપકાત્મક મૂલ્ય અછતું રહેતું નથી. જળના ઓઘરણાં અને બેજથી પોપડિયાની બની ગયેલી દીવાલનું અહીં સ્મરણ થઈ શકે છે. જોકે કોઈને એ પ્રશ્ન થઈ શકે કે કળાકારને ગુજરાતી કવિતાને આવી રીતે મૂકવાનો વિચાર બેહજારત્રાણની સાલમાં શા માટે આવ્યો હોશે? આ ગુજરાતી ભાષા વડે એ શું ચિહ્નિત કરવા માંગે છે? અને પ્રદર્શનને ‘એન્ટર્લસ એન્થોલોજી’ જેવું અરૂઢ નામ શા માટે આવ્યું હોશે? વિચારીએ....

આવરણ પર મૂકવામાં આવેલી ચિત્રકૃતિમાં લાભશંકર ઠાકરના ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪) કાવ્યસંગ્રહના છત્રીસમા ક્રમે મુકાયેલ કાવ્ય છે. સંગ્રહના પૃષ્ઠ પર છાપાયેલ કાવ્યને સીધેસીધું ચિત્રકારે કાગળ પર ઉત્તર્યું છે. જોકે આ ચિત્રને આડી નોટબુકના પૂંઠાનો ઘાટ-અ્રોપ અપાયો છે. એક તરફ જળના ઓઘરણાં ભાસે છે તો બીજી તરફ રેતાળ – માટોળિયું વાતાવરણ છે. એમાં કવિતાની પંક્તિઓની જોડાજોડ આવેખાયું છે તરસથી ને થાકથી બેસી પડેલું ઊંટ અને જૂણી પુચાણી ઢેબે કરવામાં આવેલું વનસ્પતિનું આવેખન. જાણે રણપદેશમાં જ જડી આવતી કોક કંટાળી વનસ્પતિ ના હોય !

આ શ્રેણીનું અન્ય એક ચિત્ર ‘બૂમ કાગળમાં કોરા’ કાવ્યસંગ્રહના અગિયારમાં કાવ્ય પર છે. કાવ્યની પહેલી પંક્તિ છે : ‘ઓડંગાતું ઓડંગાતું સતત’. અહીં ઊંટ નથી પણ જીબા છે. વનસ્પતિ છે અને ચિત્રકારે આકારેલી લખારાની/વહીયાની આકૃતિ છે. ચિત્રકાર અને કવિ બંને જાણો આ કવિતાનુંમાં ચિત્ર અને ચિત્રનુંમાં કવિતામાં હાજરાહજૂર છે. બંને કાવ્યોમાં વેદનશીલ પ્રશ્નવાચકતા છે. ચિત્ર બંને કાવ્યની ભાવભૂમિને સંકોરે છે.

#### (૪)

લાભશંકર ઠાકરના બે પ્રિય શબ્દો છે : પ્રતિભાવન અને નિર્નિમેષ ગેઝેંગ. ચિનુ મોહીના ગીતસંગ્રહ ‘શૈત સમુદ્રોની’ (૨૦૦૧)ની પ્રસ્તાવનામાં લાભશંકર ઠાકર લખે છે : “વ્યાર્તક હ્યાતીને આમ હુચમચતી તાકીને – નિર્નિમેષ જોવી, તેમાં બીજી કોઈ પસંદગી જ નથી. No choice.” હા, No choice સાથે એમણે આજીવન પોતાને અને પરિવેશને ઉત્કટતાથી નિહાયું છે અને પોતાના પ્રતિભાવોની મુક્તપણે નોંધ કરી છે. એમ એ રીતે વાચકને, શ્રોતાને, દર્શકને – માણસમાત્રને મુક્તતાની દિશામાં લઈ ગયા છે. No choice !-ની સંપ્રશ્નતા સાથે !



## આપણી વાત

પ્રકૃત્તિ રાવલ

ગુજરાતી સાહિત્ય પરિષદ અને શોભિત દેસાઈ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપકમે ગઝલવિચ્છના બે અગ્રાંશી શ્રી અમૃત 'ધાયલ' અને શ્રી અભ્યાસ વાસી 'મરીજ'ના શતાબ્દીવર્ષ નિમિત્તે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પરિષદના મહામંત્રી શ્રી પ્રકૃત્તિ રાવલે પરિષદ વતી સ્વાગત કર્યું હતું અને શતાબ્દીવંદનાની ભૂમિકા કહી હતી. શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, ગૌરાંગ ઠાકર, અનંત રાઠોડ, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપાણીએ પોતાની ગઝલોનું પઠન કર્યું હતું. આ બેઠકનું સંચાલન શોભિત દેસાઈએ કર્યું હતું. આ પ્રસંગે શ્રી શોભિત દેસાઈ-સંપાદિત અમૃત 'ધાયલ'નું 'ગઝલશાસ્તક' અને મરીજનું 'ગઝલશાસ્તક' એ બે પુસ્તકોનું લોકાર્પણ શ્રી જલન માતરીના હસ્તે થયું હતું.

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'ઓની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ' અંતર્ગત દર મહિને કાવ્ય-પાઠશાળાનું આયોજન થાય છે. જેમાં તા. ૪-૪-૨૦૧૬ ના રોજ 'કાર્યશિબિર' યોજાઈ. તેમાં યોગેશાભાઈ અને પારુલબહેન કેટલાક ઉત્તમ કવિતાઓનું પઠન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ બહેનોએ તેમની કવિતાનું પઠન કર્યું અને તેના વિશે ચર્ચા થઈ. તા. ૩-૫-૨૦૧૬ ના રોજ કાવ્ય-પાઠશાળામાં આદરણીય શ્રી ધીરુબહેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની ઉપસ્થિતિએ બહેનોને પ્રોત્સાહન અને પ્રેરણ પૂર્ણ પાડ્યાં હતાં. શ્રી ધીરુબહેન અને પારુલબહેન 'ઓની સરૈયા પ્રોત્સાહન નિધિ'ના આરંભ વિશે વિગતે પરિચય કરાવ્યો હતો. જમી મેના માતૃ દિનને કેન્દ્રમાં રાખીને શ્રી યોગેશ જોષીએ રઘુવીર ચૌધરી, સુદુરમ્ભ અને ધીરુબહેન પટેલની 'મા' વિશેની કવિતાઓનું પઠન કર્યું હતું. ધીરુબહેને કમલ વોશાની 'વૃદ્ધદશક' કવિતાના કેટલાક અંશોનું પઠન કર્યું હતું. ત્યાર પછી બહેનોએ લાખેલી સ્વરચિત કવિતાઓનું પઠન અને ચર્ચા થયાં હતાં. દરેક બહેનોએ એક-એક કાવ્યરચનાનું પઠન કર્યાં પછી સુંદર, સચોટ અને ભીતરથી તરબોળ થઈ જવાય એતી ચર્ચા સાથે સમજજા માર્ગદર્શકો દ્વારા મળી હતી. કાવ્ય-પાઠશાળામાં ઉત્તરોત્તર સારાં કાવ્યો સર્જાય છે. તેનો આનંદ બધાંએ વ્યક્ત કર્યો.

- પારુલ બારોટ

તા. ૫-૫-૨૦૧૬ ના રોજ ગુરુવારે પાકિઝીમાં દીવાન ઠકોરે વાર્તા ‘પુસ્તક અને કાલ્યાનિક માણસનું પઠન કર્યું હતું. પઠનને અતે ચર્ચા થઈ હતી. વાર્તા સ્વની શોધની હતી. દેરેકને વાર્તા રસપ્રદ જણાઈ હતી. સર્વશ્રી સતીશ વૈષ્ણવ, ઉર્વી પંડિત, ગિરિમા ઘારેખાન, અરવિંદ ઠકોર, હસમુખ કે. રાવલ, દીના પંડ્યા વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો.

તા. ૧૮-૫-૨૦૧૬ ના રોજ ગુરુવારે શ્રી કિરીટ દુધાતે નવલકથાના પ્રથમ પ્રકાશનું પઠન કર્યું હતું. આજાદી પછીનાં ૨૦ વર્ષ પછીની ગામડાંની શાળાની સ્થિતિનું આદેખન રસપ્રદ રીતે થયું હતું. હાસ્ય અને વંજના દ્વારા ઘટનાઓ આદેખાઈ હતી. શ્રી ઉષાબહેન ઉપાધ્યાયે કહ્યું કે પાત્રોની રચના સરસ રીતે કરી છે. કેટલાક શબ્દો કથાને સાનુકૂળ નથી. શ્રી રમેશ ર. દવેએ કથાની વિશેષતા દર્શાવી હતી. શ્રી રાજેન્દ્ર પટેલે જણાવ્યું કે કથા સમરાણકથા સમાન જણાય છે. શ્રી હરીશ ખત્રીએ જણાવ્યું કે પાત્રાદેખન ખૂબ સરસ થયું છે.

તા. ૧૬-૬-૨૦૧૬ ને ગુરુવારે શ્રી અભિમાન્યુ આચાર્યે મૌલિક વાર્તાનું પઠન કર્યું હતું. વાર્તાનો વિષય પ્રાણ્યાત્મિકોણનો હતો, જેમાં આધુનિક શैલીમાં સરસ રજૂઆત થઈ હતી.. કથન-શૈલી પ્રયોગશીલ કહી શકાય. ત્રણ પાત્રોનાં વર્ણન દ્વારા વાર્તા આગળ વધતી હતી. વાર્તાપઠન પછીની ચર્ચામાં કેટલાકના મતે વાર્તા વધુ પડતા પંડોમાં મુકાઈ હોવાથી અને સંકલનનો અભાવ દેખાતો હોવાથી સાતત્યપૂર્ણ બની શકી ન હતી. પાત્રની એકોક્રિટઓમાં એકધારાપણું જોવા મળતું હતું. વાર્તામાં વધુ મથામણાની જરૂર જણાતી હતી.

### નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન

ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાયમંદિર હસ્તક શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેષ્ઠી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. આથી જે નવોદિત લેખકો-વેણિકાઓનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેઓ આ શ્રેષ્ઠીમાં પોતાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત મોકલી શકે છે. આ પુસ્તકની પૃષ્ઠમયંદા ૧૫૦ની રહેશે. હસ્તપ્રતની ટાઇપ કોર્પી મોકલવી. હસ્તપ્રત તા. ૩૦-૬-૨૦૧૬ સુધીમાં મોકલી આપવા વિનંતી. હસ્તપ્રત મોકલવાનું સરનામું : પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮.

### સાહિત્યવૃત્ત

અભિલ હિંદ મહિલા પરિષદ બૃહદ સુરત શાખા ટ્રસ્ટ વાચકમંચ તેમજ કવિયત્રી એડવોકેટ શ્રી ભારતીબહેન જી. ડેસાઈના સંયુક્ત ઉપકમે ‘મધર્સે ૩’ નિમિત્તે સુરતમાં શ્રી રવીન્દ્ર પારેખના પ્રમુખપદે એક ભવ્ય ‘માતૃવંદના કવિ-સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વશ્રી રવીન્દ્ર પારેખ, યોગેશ જોધી, જનક નાયક, જયદેવ શુક્લ, બદ્ધુલેશ દેસાઈ, કિરણસિંહ ચૌહાણ, ગૌરાંગ વ્યાસ, રીના મહેતા, પ્રજ્ઞા વર્ણી, યામિની વ્યાસ, એષા દાદાવાલા, ધ્વનિલ પારેખ,

સુરેશ વિરાષી વગેરેએ ‘મા’ વિષયક કવિતાઓ રજૂ કરી હતી.

તા. ૧૮-૫-૨૦૧૬ ના રોજ ગુજરાતી સાહિત્યના એક યુગપર્વતક કવિ નિર્ણયન ભગતનો ૮૧મો જન્મ દિવસ હતો. આ પ્રસંગે ‘દર્શક શુઉંદેશન’ દ્વારા એની આગવી ઉજવણી કરવામાં આવી. ગુજરાતી સાહિત્ય પરિષદ્ધના રા. વિ. પાઠક હોલમાં સાંજે ૬-૦૦ વાગે એમના અંતર્ગત મિત્રો અને વિદ્યાર્થીઓએ એમના વિશેનાં સંસ્મરણોની વાત પોતાની આગવી ફેબે કરી હતી. જેમાં સર્વશ્રી પાવન બકેરી, શૈવેષ પારેખ, ગોવિંદની શાહ, અનિલા દલાલ, પ્રકૃત્લ અનુભાઈ, ચિંતન શાહ, સુશ્રા શાહ, પ્રીતિ મહેતા, નિર્મલ શાહ, મહર્ષિ મુન્શા, પૌલોમી શાહ, રૂપલ મહેતા, ચિંતન પરીખ, નીરવ શાહનો સમાવેશ થાય છે. સંચાલક તરીકે શ્રી રઘુવીર ગૌધરીએ વક્તાઓના પરિચયની સાથે ભગતસાહેબની લાક્ષણિકતાઓ પણ ચીંધી આપી હતી.

તા. ૫-૫-૨૦૧૬ ના રોજ શ્રી દક્ષાબહેન પ્ર. દવેનું ૭૧મું પુસ્તક ‘છંદ અને અલંકાર’નું આવરણ શ્રી અજ્ય પાઠક અને શ્રી રંજનબહેન પાઠકના હસ્તો કરવામાં આવ્યું હતું.

શ્રી મનુભાઈ પંચોળી – દર્શક શુઉંદેશનનો ૨૦૧૫નો સાહિત્ય એવોર્ડ પ્રસિદ્ધ લેખિકા અને જીવનનિષ્ઠ સર્જક હિમાંશી શેલતને અને ગ્રામ પુનરૂત્થાન એવોર્ડ આરોગ્ય અને ગ્રામ પુનરૂત્થાન ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર ‘સેવા રૂરલ (ઝડપિયા) સંસ્થા’ને તા. ૩૦-૪-૨૦૧૬ ના રોજ સેવા રૂરલ સંસ્થામાં અર્પણ કરવામાં આવ્યા હતા.

પ્રગતિ મિત્રમંડળ – બોરીવલી-કાંદીવલીના ઉપક્રમે છેલ્ટાં ૧૦ વર્ષથી ગંગાબહેન પટેલ સારસ્વત સન્માન દર વર્ષે એક સાહિત્યકારને આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૬ નું આ સન્માન શ્રી ધ્રુવ ભણે અમદાવાદમાં વિશ્વકોશભવનમાં આપવામાં આવ્યું હતું.

‘નિર્ધાર’ વિધવા કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત તા. ૨૪-૪-૨૦૧૬ ના રોજ એવોર્ડ વિતરણ સમારોહ લુણાર-સુથાર જ્યાતિની વાડી, સુરેન્દ્રનગરમાં પોજાયો. જેમાં લીલાધી ખાતે શબ્દની ઉપાસના કરતા જાણીતા કવિ ચંદ્રકાન્ત નિર્મલને ‘સ્વ. કવિ પરિમલકાન્ત રાવલ સ્મૃતિ એવોર્ડ-૨૦૧૬’ અનાયત કરવામાં આવ્યો હતો. એ જ રીતે ‘સ્વ. કવિ પરિમલકાન્ત રાવલ શિક્ષણપ્રતિભા એવોર્ડ-૨૦૧૬’ શ્રીમતી રમાબહેન કિશોરભાઈ મકવાજાને તથા ‘માતૃશ્રી તારાબહેન રાવલ તપસ્થિતી એવોર્ડ-૨૦૧૬’ શ્રીમતી જયાબહેન જિતેન્દ્રભાઈ જોશીને અનાયત થયો હતો.

પ્રેમાનંદ સાહિત્ય સભાના શતાબ્દી પર્વની ઉજવણીના વર્ષના શુભારંભે ડૉ. પ્રવીષ દરજાની અધ્યક્ષતામાં ડૉ. ઉષા ઉપાધ્યાયે ધ્રુવ જોશીના ‘જીવનચક’ ગ્રંલસંગ્રહનું લોકપર્જા કર્યું હતું અને તે ગ્રંલસંગ્રહનો પરિચય કરાવ્યો હતો.

ગુજરાત પુસ્તકાલય પ્રેરિત ‘સાહિત્યસ્થૂલિ’માં અપાયેલા ૨૦૦થી વધુ જાહેર વાર્તાલાપોમાંના, વિવિધ વિષયો પરના બાવન વાર્તાલાપોના સંગ્રહ ‘ચોથા શનિવારની સાંજે’ (ભાગ-૨)નું વિમોચન હિન્દીનાં જાણીતા કવયિત્રી અને રાજ્યના માનવ અધિકાર આયોગનાં

અધિક મહાનિર્દેશક ડૉ. મીરાં રામનિવાસે કર્યો હતો.

સાક્ષરનગરી નિર્યાદના કવિ, સાહિત્યકાર શ્રી હરીશ જી. ઢાકરે તૈથાર કરેલ સાહિત્યનાં ૧૧ પુસ્તકો તથા ૨૧ સી.ડી., ડી.વી.ડી.નું લોકપર્ષણ તા. ૧૨-૬-૨૦૧૬ ના રોજ બાજ બેડાવણ હોલ નિર્યાદમાં દબદ્બાભેર થયું હતું. જેમાં ગુજરાત સરકારના પણત વર્ગવિકાસ નિગમના ચેરમેન શ્રી જયંતીભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

## પ્રવીષ દરજને રણજિતરામ સુવર્ણચંદ્રક

ગુજરાતી સાહિત્ય સભા દ્વારા પ્રતિવર્ષ અપાતો રણજિતરામ સુવર્ણચંદ્રક ૨૦૧૪ની સાલ માટે શ્રી પ્રવીષ દરજને આપવાનું જાહેર કર્યું છે. શ્રી પ્રવીષ દરજ નિબંધકાર તરીકે જાહીતા છે.

## ધનજી કાનજી સુવર્ણચંદ્રક

ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રતિવર્ષ અપાતો ધનજી કાનજી સુવર્ણચંદ્રક ૨૦૧૪ની સાલ માટે શ્રી ભાનુપ્રસાદ પંડ્યાને આપવાનું જાહેર કર્યું છે. શ્રી ભાનુપ્રસાદ પંડ્યા કવિ તરીકે સુપ્રસિદ્ધ છે.

---

## સાભાર સ્વીકાર

### ગીત-ગાલ-કવિતા

(૭૫) ઘૂંઠચો. કસુંબ ઘેરો : દયારામ મહેતા, ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૨+૮૭, રૂ. ૧૦૦/- (૭૬) પણ્ણોમાં સરોવર : નવનીત ઉપાધ્યાય, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૪+૧૨૮, રૂ. ૧૪૫ (૭૭) હે ગળલ ! આવ પ્રગટ થા : દક્ષા બી સંઘર્ષી, ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૮+૮૦ રૂ. ૧૦૫ (૭૮) અનિદ્રાવશ : ગુલામ અભાસ ‘નાશાદક્ક ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૬+૧૧૮, રૂ. ૧૩૫ (૭૯) અને તું : અશોક જાની, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૬+૧૫૧, રૂ. ૧૭૧ (૮૦) ગરાસ : નીરજ મહેતા, ૨૦૧૪, ૧૦૨, આશિયાના, વૈશાલીનગર-૨, સૈયા રોડ, રાજકોટ-૩૬૦૦૦૭, પૃ. ૧૮+૮૧, રૂ. ૧૦૦ (૮૧) આંખમાં વરસાદ બારેમાસ : ગિરીશ પરમાર, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૮+૫૪, રૂ. ૭૦ (૮૨) ભીતર ધબકે કવિતા : દેવજી ન્રિ. થાનકી, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૨+૧૧૬, રૂ. ૧૧૦ (૮૩) આબેહૂલ : ગુલાબ અભાસ ‘નાશાદક્ક ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૮૬, રૂ. ૮૫

## નવા આજીવન સત્યો

(૧) ચેતનકુમાર એલ. ભંડ, રાજકોટ. (૨) સ્વાતિ ધૂવ નાયક, નવસારી. (૩) ગીતા રાજેન્દ્ર પંચાલ, અમદાવાદ. (૪) મહેન્દ્ર બાલીસીયા, અમદાવાદ. (૫) નિરવ એમ. પારેખ, અમદાવાદ. (૬) હિરામતી સુર્ણે, દાહોદ. (૭) ભાવિન નૈષધ નાયક, સુરત. (૮) રણજિતસિંહ બી. વાંક, અમદાવાદ. (૯) વત્સલ ર. શાહ, અમદાવાદ. (૧૦) ઉદ્ય શાહ, નવસારી. (૧૧) અવની જે. જાદવ, અમદાવાદ. (૧૨) નીલા પ્રવીષ ત્રિવેદી, વડોદરા. (૧૩) જ્યેન્દ્ર આર. શાહ, અમદાવાદ. (૧૪) નિશિથ જોશી, અમદાવાદ. (૧૫) સુશીલ ઠક્કર, મુંબઈ. (૧૬) મહેન્દ્ર ભાવસાર, ગાંધીનગર. (૧૭) જ્યંતીલાલ એમ. પરમાર, ગાંધીનગર. (૧૮) હરીશ સોની, અમદાવાદ. (૧૯) કુમારેશ ત્રિવેદી, અમદાવાદ. (૨૦) ડૉ. પ્રતિભા ગજીવાલા, સુરત. (૨૧) ડૉ. પારુલ જોશી, અમદાવાદ. (૨૨) ઈશ્વરલાલ પરમાર, અમદાવાદ. (૨૩) રાજેશ રાજકોટ, મુંબઈ. (૨૪) અતુલ પટેલ, અમદાવાદ. (૨૫) અનિરુદ્ધસિંહ ગોહિલ, અમદાવાદ. (૨૬) સુધીર ડી. દેસાઈ, ગાંધીનગર. (૨૭) પ્રવીષયંડ મારુ, અમદાવાદ. (૨૮) સુરેશયંડ જે. રાવલ, અમદાવાદ. (૨૯) નિરીશકુમાર જાની, વડોદરા. (૩૦) સમીર પી. ભંડ, ગાંધીનગર. (૩૧) પ્રદીપ વી. પડશાળ, રાજકોટ. (૩૨) જગર રાણા, ગાંધીનગર. (૩૩) નંદિતા મુનિ, ગાંધીનગર. (૩૪) સમીક્ષા ત્રિવેદી, અમદાવાદ. (૩૫) રાજેન્ર મકવાણા, જાફરાબાદ. (૩૬) પરેશ એમ. શાહ, અમદાવાદ. (૩૭) પ્રકુલ્લ કનાબાર, અમદાવાદ. (૩૮) બિપીનકુમાર ચૌધરી, પાલનપુર. (૩૯) પુલકિત ઓઝા, અમદાવાદ. (૪૦) રક્ષા શુક્લ, તળાજા. (૪૧) હંસા પટેલ, અમદાવાદ. (૪૨) હરિવદન વ્યાસ, અમદાવાદ. (૪૩) નારાયણ શાહ, વડોદરા. (૪૪) નીતિનકુમાર વી. શાહ, અમદાવાદ. (૪૫) ડૉ. એમ. એચ. બારોટ, અમદાવાદ. (૪૬) વૈશલ દલાલ, અમદાવાદ. (૪૭) નટુભાઈ પરમાર, અમદાવાદ. (૪૮) આદિતી દેસાઈ, અમદાવાદ. (૪૯) મિતલ ત્રિવેદી, અમદાવાદ. (૫૦) પારસ હેમાની, રાજકોટ. (૫૧) સિમતા પી. શાહ, વડોદરા. (૫૨) શરદકુમાર ત્રિવેદી, થરાદ. (૫૩) આર. એન. જોશી, અમદાવાદ. (૫૪) રણધીર ચૌહાણ, અમદાવાદ. (૫૫) રમેશયંડ ડી. શાહ, ઈન્દોર. (૫૬) કાજલ કાઠડ, પાટીદા. (૫૭) નિરુપમ નાણાવટી, અમદાવાદ. (૫૮) ભૂપતરાય નિર્મલ, અમદાવાદ. (૫૯) અશોક દાણી, કટ્ટાણ. (૬૦) સુરેશ બી. અગ્રાવત, અમદાવાદ. (૬૧) કરીમ લાખાણી, અમદાવાદ. (૬૨) સંજય પટેલ, અમદાવાદ. (૬૩) સુમંત રાવલ, સુરેન્દ્રનગર. (૬૪) મિનેશ સી. શાહ, અમદાવાદ. (૬૫) ડૉ. યોગેન્દ્ર પારેખ, અમદાવાદ. (૬૬) શરદ કુલકણી, પૂના. (૬૭) હર્ષદ જે. શાહ, સંતરામપુર. (૬૮) હિરેન રાજ્યગુરુ, અમદાવાદ. (૬૯) જિતેન્દ્ર શાહ, વડોદરા.

(૧) કનુભાઈ સી. શાહ, અમદાવાદ. (૨) વૈભવ એસ. કાળે, અમદાવાદ. (૩) ઉદયસિંહ ડાભી, અમદાવાદ. (૪) પાર્થ ભણ, અમદાવાદ. (૫) નરેશકુમાર સોની, અમદાવાદ. (૬) ડૉ. જગદીશ જોશી, અમદાવાદ. (૭) ડૉ. પ્રિયાંકી આર. વ્યાસ, ગાંધીનગર. (૮) મનીષ આર. પરમાર, અમદાવાદ. (૯) કુશપાલ જે. શાહ, અમદાવાદ. (૧૦) શોખર એ. શાહ, અમદાવાદ. (૧૧) ધૂર્ય યુ. પંડિત, અમદાવાદ. (૧૨) ડૉ. આશા આડતિયા, તીથલ. (૧૩) રાજેન્દ્ર એન. પરમાર, કૃપુરાઈ. (૧૪) પૂજા જોશી, અમદાવાદ. (૧૫) ડૉ. જગદીશકુમાર નિર્મલ, અમદાવાદ. (૧૬) ધારેણી એ. શુક્લ, અમદાવાદ. (૧૭) પરિમલ વસાવડા, અમદાવાદ. (૧૮) મુનિલિબ્યંબલભવિજ્ય, મુંબઈ. (૧૯) રસીલા ડી. પંડ્યા, ભૂજ. (૨૦) ડી. એમ. ભદ્રસિયા, અમદાવાદ. (૨૧) ડૉ. માલા કાપડિયા, મુંબઈ. (૨૨) ભાલયંદ આર. શાહ, અમદાવાદ. (૨૩) ઉષાબહેન અંધારિયા, ભાવનગર. (૨૪) પ્રો. શક્તિસિંહ પરમાર, ભાવનગર. (૨૫) પ્રો. વિરેન પંડ્યા, ગઢડા (સ્વામી). (૨૬) જયેશકુમાર રાવલ, અમદાવાદ. (૨૭) આલીશા ડી. શાહ, અમદાવાદ. (૨૮) ભરત એસ. ચૌધરી, માંડવી. (૨૯) રમેશ ચાંપાનેરી, વલસાડ. (૩૦) અર્જુનસિંહ કે. રાઉલજી, વડોદરા. (૩૧) ચંદમૌલિ એમ. શાહ, અમદાવાદ. (૩૨) નિલેશ રાશા, યુ.એસ.એ. (૩૩) પ્રા. બી. જે. મહેતા, સુરત. (૩૪) મનહર ઓજા, અમદાવાદ. (૩૫) ડૉ. જિતુભાઈ સી. પટેલ, બાકરોલ. (૩૬) પ્રશાંત કે. પટેલ, નડિયાદ. (૩૭) પ્રદીપ વી. શાહ, મુંબઈ. (૩૮) સંજ્ય એમ. ગાંધી, મુંબઈ. (૩૯) હિલીપ કે. શેઠ, મુંબઈ. (૪૦) આલ્યા નરેન્દ્ર વી., પંધારી. (૪૧) સુનિલ ભગત, વડોદરા. (૪૨) સ્નેહણ પરમાર, નવસારી. (૪૩) દિનેશ પટેલિયા, હિમતનગર. (૪૪) જયંતીલાલ જી. સોની, અમદાવાદ. (૪૫) બજુલેશ એ. રોહિત, અમદાવાદ. (૪૬) હરજીવન દાઢા, અમરેલી. (૪૭) સુમંત શાહ, ગાંધીનગર. (૪૮) બારીન મહેતા, અમદાવાદ. (૪૯) સંજ્ઞવ એન. વ્યાસ, અમદાવાદ. (૫૦) અમરતભાઈ રબારી, જંતાલ. (૫૧) સુનિલ કે. ઝરેરી, અમદાવાદ. (૫૨) હિવ્યેશ ભણ, અમદાવાદ. (૫૩) અર્જુનસિંહ બાટીયા, રામપુર. (૫૪) ભાવેશ જેઠવા, ભૂજ. (૫૫) ડૉ. આશિષ પટવા, અમદાવાદ. (૫૬) હીરજી પી. સીંચ, ચેલા. (૫૭) આશા પટેલ, કોબા. (૫૮) અભય દવે, કોડિનાર. (૫૯) ઈન્ડ્રવંન શુક્લ, અમદાવાદ. (૬૦) હરિત પંડ્યા, નડિયાદ. (૬૧) જવલંત નાયક, સુરત. (૬૨) વિપુલ એચ. જન્તી, ગાંધીધામ. (૬૩) સંજ્ય ચોટલિયા, અમદાવાદ. (૬૪) કલેરા ડી. કિશ્ચિયન, મહેમદાવાદ. (૬૫) જાગૃતિ એન. પટેલ, અમદાવાદ. (૬૬) જયેશકુમાર એન. પટેલ, કુવાસાણ. (૬૭) લતા કાનુગા, અમદાવાદ. (૬૮) કૌશલ સોરઠિયા, હિમતનગર.

ਪਰਿਸ਼ਾਲ

- 
૧. લાભશંકર ઠાકર : જીવનવહી અને સાહિત્યસર્જન <sup>2|21</sup> ગીર્મિલા ઠાકર <sup>2|21</sup> ૩૩૫
  ૨. અજનબી અગોચર આંતરિક <sup>2|21</sup> લાભશંકર ઠાકર <sup>2|21</sup> ૩૪૦
  ૩. રહસ્યમય ગૂઢ અંધકારના કંઈ કવિની કેદ્ધિયતનો અવાજ <sup>2|21</sup> લાભશંકર ઠાકર <sup>2|21</sup> ૩૪૬
  ૪. લાંઠાં - વહાલસોયા વિદ્રોહી <sup>2|21</sup> સિતાંશુ યશશ્વંદ <sup>2|21</sup> ૩૫૮
  ૫. ‘મૂલપર્યંત જોવાની મથામજા’ કરતા સંપ્રક્રાણ સાહિત્યસર્જક <sup>2|21</sup> ચંદ્રકાન્ત શેઠ <sup>2|21</sup> ૩૬૫
  ૬. ‘તડકો-૧’ વિશે <sup>2|21</sup> ચંદ્રકાન્ત શેઠ <sup>2|21</sup> ૩૭૧
  ૭. ‘તડકો-૨’ વિશે <sup>2|21</sup> ચંદ્રકાન્ત ટોપીવાળા <sup>2|21</sup> ૩૭૬
  ૮. ‘માણસની વાત’ વિશે <sup>2|21</sup> ઉમાશંકર જોશી <sup>2|21</sup> ૩૭૭
  ૯. ‘હું એને જગાંડું છું’ વિશે <sup>2|21</sup> ચંદ્રકાન્ત ટોપીવાળા <sup>2|21</sup> ૩૭૮
  ૧૦. ‘કલ્પાયન’ વિશે <sup>2|21</sup> રઘુવીર ચૌધરી <sup>2|21</sup> ૩૭૯
  ૧૧. કલ્પનાની વિલક્ષણ અરાજકતાનું સૌંદર્ય <sup>2|21</sup> રાહીશયામ શર્મા <sup>2|21</sup> ૩૮૩
  ૧૨. કવિની પ્રતિબદ્ધતા <sup>2|21</sup> નલિન રાવળ <sup>2|21</sup> ૩૮૬
  ૧૩. કલ્પો કે લાભશંકર ‘લાંઠાં’ને કલ્પે છે <sup>2|21</sup> પ્રબોધ પરીખ, અનુ. પરેશ નાયક <sup>2|21</sup> ૩૮૦
  ૧૪. લાભશંકર ઠાકર : ઉત્કટ ચેતનાનો કવિ-અવાજ <sup>2|21</sup> યોગેશ જોષી <sup>2|21</sup> ૩૮૫
-

# ૧. લાભશંકર ઠાકર : જીવનવહી અને સાહિત્યસર્જન

ઉર્મિલા ઠાકર

## જીવનવહી

- ૧૯૩૫ : ૧૪મી જાન્યુઆરી - જન્મ  
જન્મસ્થળ : સેડલા (જિ. સુરેન્દ્રનગર)  
વતન : પાટડી  
માતા : પ્રભાવતીબહેન  
પિતા : જાદવજી નરભેરામ શાસ્ત્રી  
અલ્યુસ : ધોરણ-૮ સુધી પાટડી પછી  
અમદાવાદ : ધોરણ-૮ ભારતીય વિદ્યાલય, સારંગપુર ચકલા. (મધુસૂદન  
પારેખ જેવા શિક્ષક મહ્યા ધોરણ : ૧૦-૧૧ જ્યાહેંદ હાઈસ્ક્વલ.)
- ૧૯૫૭ : બી.એ. ગુજરાત કોલેજ, અમદાવાદ  
૧૯૫૭ : લગ્ન : પત્ની : કુમુદબહેન  
૧૯૫૮ : ૨૧મી ફેબ્રુઆરી, પુત્રી અપેક્ષાનો જન્મ  
૧૯૫૮ : એમ.એ. ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી  
૧૯૫૮ : ૨૬મી જૂન, પુત્રી મનીષાનો જન્મ  
૧૯૫૮-૬૫ : સાતેક વર્ષ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન સીટી કોલેજ, અમદાવાદ; ભક્ત  
વલ્લભ ધોળા કોલેજ, અમદાવાદ  
૧૯૬૨ : 'કુમાર' ચંદ્રક  
૧૯૬૪ : ૨૫ ફેબ્રુઆરી, પુત્ર ઉત્પલનો જન્મ  
૧૯૬૪ : ડી.એ.સ.એ.સી. (શુદ્ધ આયુર્વેદનો ડિપ્લોમા)  
૧૯૬૬ : 'કાય ચિકિત્સા'નો પ્રારંભ, સારંગપુર ચકલા, વૈદ્ય થયા. તાં જ રે મઠ'ની  
પ્રવૃત્તિ. 'કૃતિ' અને 'ઉન્મૂલન' સામયિકનાં પ્રકાશન-સંપાદન  
૧૯૭૧ : ૨૮મી સાએમ્બર, પુત્ર વિસ્મયનો જન્મ  
૧૯૭૩ : ચિકિત્સાલય આશ્રમરોડ પર ખસેડંચું, વૈદ્ય પુનર્વસુ  
૧૯૮૧ : રણજિતરામ સુવર્ણચંદ્રક (જેનો સ્વીકાર ૧૯૮૪માં)  
૧૯૮૨-૮૬ : નર્મદ સુવર્ણચંદ્રક  
૧૯૮૧ : 'થોળા અવાજ ઘોંઘાટ' માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર  
૨૦૦૩ : ગુજરાત સાહિત્ય અકાદમીનો જૌરવપુરસ્કાર  
૨૦૧૬ : ૬ ફી જાન્યુઆરી, દેહવિલય



## સાહિત્યસર્જન.

### કવિતા

- ૧૮૬૫ : ‘વહી જતી પાછળ રમ્યઘોણા’  
 ૧૮૬૮ : ‘માણસની વાત’  
 ૧૮૭૨ : ‘મારા નામને દરવાજે’  
 ૧૮૭૪ : ‘બૂમ કાગળમાં કોરા’  
 ૧૮૮૬ : ‘પ્રવાહણ’  
 ૧૮૮૭ : ‘લઘરો’  
 ૧૮૮૮ : ‘કાલગ્રંથિ’  
 ૧૮૮૯ : ‘થોળાં અવાજ ઘોંઘાટ’  
 ૧૮૯૮ : ‘કૃત્યાયન’  
 ૧૯૯૮ : ‘કિચૂડ કિચૂડ’  
 ૨૦૦૦ : ‘સમય સમય’  
 ૨૦૦૦ : ‘હથિયાર વગરનો ઘા’  
 ૨૦૦૧ : ‘ટેવ’  
 ૨૦૦૨ : ‘છે’  
 ૨૦૦૨ : ‘છે પ્રતીક્ષા’  
 ૨૦૦૨ : ‘આઈ ડોન્ટ નો, સર’  
 ૨૦૦૩ : ‘રમત’ ?  
 ૨૦૦૪ : ‘મેં કમિટ કર્યું છે શું ?’  
 ૨૦૦૬ : ‘આવ’  
 ૨૦૦૭ : ‘કથકનો ક’  
 ૨૦૦૮ : ‘કેમેરા ઓન છે’  
 ૨૦૧૨ : ‘ઈન અને આઉટ’

### નાટક

- ૧૮૬૫ : ‘એક ઉંદર અને જદુનાથ’ (સુભાષ શાહ સાથે) (દ્વિઅંકી)  
 ૧૮૬૮ : ‘મેઠક બિલીવ’ (અન્ય સાથે) (એકાંકી)  
 ૧૮૭૩ : ‘મરી જવાની મજા’ (એકાંકીસંગ્રહ)  
 ૧૮૮૨ : ‘બાથટબમાં માછલી’ (એકાંકીસંગ્રહ)

- ૧૯૮૫ : ‘ઘીંગુ ગુલાબ અને હું’ (દ્વિઅંકી)  
 ૧૯૮૬ : ‘મનસુભલાલ મળુઠિયા’ (દીર્ઘનાટક)  
 ૧૯૮૭ : ‘કાહે કોયલ શોર મચાયે રે’ (ત્રિઅંકી)  
 ૨૦૦૩ : ‘સુખનાશકરી’ (એકાંકીસંગ્રહ)  
 ૨૦૦૬ : ‘મકસદ’ (બે એકાંકી, એક દ્વિઅંકી)

### નવલક્ષ્ણા

- ૧૯૯૮ : ‘અક્સમાત્ર’  
 ૧૯૯૯ : ‘કોણ’ ?  
 ૧૯૯૩ : ‘ચંપકુલાલીસા’  
 ૧૯૯૫ : ‘અનાપસનાપ’  
 ૧૯૯૫ : ‘જીવરી’  
 ૨૦૦૧ : ‘લીલાસાગર’ ભા. ૧-૨  
 ૨૦૦૪ : ‘અકો છે, કલ્યો’  
 ૨૦૦૫ : ‘કદી નહીં છોડું’  
 ૨૦૦૫ : ‘ધરા’  
 ૨૦૦૬ : ‘ધ સ્કાયબ્લુ’  
 ૨૦૦૭ : ‘મારો ડ્રાઇવર’  
 ૨૦૦૮ : ‘કુંઝ કુંઝ બોલે કોયલિયા’  
 ૨૦૦૯ : ‘વધાવો, સંત બસંત આવો !’  
 ૨૦૧૦ : ‘માય મોસ્ટ ડિયર લુલુ’ !

### નિબંધ

- ૧૯૮૬ : એક મિનિટ  
 ૧૯૮૮ : ક્ષાળ તત્ક્ષાળ  
 ૧૯૯૭ : આકળનો ઝ  
 ૧૯૯૮ : થોડો અમસ્તો તડકો  
 ૨૦૦૦ : ઢોળી ગયાં જે તડકો  
 ૨૦૦૧ : વિનિમય વૃક્ષ  
 ૨૦૦૩ : હમારી સલામ  
 ૨૦૦૪ : અહો ઝંકારતા ધનિ  
 ૨૦૦૫ : નિસબત

- ૨૦૦૫ : મનજીણ થંભ થયેલું  
 ૨૦૦૬ : મૂંગારો ધ ઓરેન્જ અને  
 ૨૦૦૭ : આ હોવાના સંદર્ભો  
 ૨૦૦૮ : સોનેરી ચુંબન  
 ૨૦૧૦ : શ્રવણસંપદા  
 ૨૦૧૩ : ઓળખ આંતરધનની  
 ૨૦૧૩ : પ્રતિભાવન હો !

### લેખ (સામાજિક-રાજકીય)

- ૧૮૮૩ : સૂરજ ઊંઘો કેવડિયાની ફણસો !  
 જીવનચરિત્ર અને સ્મરણો  
 ૧૮૮૮ : ‘મારી બા’  
 ૧૮૮૯ : ‘આપા વિશે’

### તિવેચન

- ૧૮૬૫ : ઠનર લાઈફ  
 ૧૮૬૬ : મળેલા જીવની સમીક્ષા

### સંપાદન

- ૧૮૮૧ : સુદામાચરિત્ર  
 ૧૮૮૩ : નળાજ્યાન  
 ૧૮૮૪ : કુવરબાઈનું મામેરું

### બાળસાહિત્ય

- ૧૮૮૪ : કાગડા અંકલ મમરાવણા  
 ૧૮૮૪ : કાનખાઉ રાક્ષસ  
 ૧૮૮૪ : તડકાનો પાપડ  
 ૧૮૮૪ : નદીકંઠે ડરાંઉ ડરાઉ  
 ૧૮૮૪ : મુંબઈની કીડી  
 ૧૮૮૮ : લાઠાદાદા આવે છે નવી વારતા લાવે છે (૨૫ બાળકથાઓ)

### આયુર્વેદ

- ૧૮૬૧ : ‘ઝક્તુચચ્ચા’  
 ૧૮૬૫ : ‘રોગ અને ઉપચાર’

- ૧૮૭૬ : ‘ધર ધરનાં ઔષધ’
- ૧૮૮૬ : ‘સર્વમિત્ર’
- ૧૮૮૭ : ‘ઉપચારશાસ્તક’
- ૧૮૮૮ : ‘શામબાળ દવા : હિવેલ
- ૧૮૮૯-૯૮ : ‘ઓસડિયું’ (ભાગ : ૧-૨)
- ૧૮૯૦ : રોગરહસ્ય
- ૧૮૯૦ : રોગપરિચય માળા (૧૩ પુસ્તિકાઓ)  
 (૧) અમૃતપિત્ર (૨) બ્લાફેશર (૩) ચામડીના રોગો (૪) સંન્ધિવા-આમવાત  
 (૫) આર્તવ-વિકાર (૬) વ્યંધત્વ (૭) શરદી-સળેખમ (૮) શુક્કખ્યાવ  
 (૯) દમ સસણી (૧૦) ડાયાબિટીઝ (૧૧) હરસ(પાઈલ્સ) (૧૨) અનિદ્રા  
 (૧૩) મેદવૃદ્ધિ
- ૧૮૯૧ : આયુર્વેદની અમૃતધારા
- ૧૮૯૨ : આચાર્ય દઢબલની ઉપચારકથાઓ
- ૧૮૯૩ : દરદ મટાડે દાદાજી
- ૧૮૯૪ : દર્દી અને દવા
- ૧૮૯૫ : સર્વમિત્ર ઉપચારમાત્રા
- ૧૮૯૬ : સ્ત્રીઓના રોગો અને ઉપચાર (મહિલામિત્ર)
- ૧૮૯૮ : ઉપચારમંજૂષા
- ૧૯૦૦ : ઈલાજ બહોતેરી
- ૧૯૦૮ : સફ્ઝળ ઈલાજો
- ૨૦૦૧ : આચાર્ય દઢબલનો ઉપચારબોધ
- ૨૦૦૨ : આરોગ્યધન
- ૨૦૦૨ : વૈદ બાપાનું વૈદું
- ૨૦૦૪ : ઔષધરત્નાકર
- ૨૦૦૫ : આરોગ્યમંગલ
- ૨૦૦૮ : આરોગ્યની આરસી
- ૨૦૧૦ : આરોગ્યસંપદા

## ૨. અજનબી અગ્રોચર આંતરિક

લાભરાંકર ટાકર

લીરેલીરા થઈ ગયા છે.

ચીરા-ચીંદરી ઉડી રહ્યાં છે ચેતનામાં.

અરે, એના પણ ધારે ધારે કમશા: વસ્ત્રો વણાયાં હતાં, એકધારાં, આનંદમાં, પારદીમાં, ફાર્મસીના મકાનના એક ખંડમાં, મૃગચર્મ બિષાવી, પિતાજી વૈદ જાદવજી નરભેરામ શાસ્ત્રી બેઠા છે, લેખનકાર્યમાં મશાગૂલ. દરેક વર્ષની વયે હું એમને પ્રથમ કાવ્યરચના બતાવું છું. વાંચીને એ ખુશ થાય છે. ખડિયામાં હોલ્ડર જરાક બોળી, એક પંક્તિમાં શબ્દફેર સૂચાવી, લયભંગ સુધારે છે. લયભંગ, એક જ જીવાએ. લય શબ્દ જાણતો નથી. પણ પિતાજીએ શા માટે સુધારો સૂચયો છે તે કાનથી પામી જાઉં છું.

પોષાયો છું લયના અવિરત સ્નિયનથી. બા મારી હલકથી ગાય. ગળામાં મીઠાશ. ક્રત-પ્રસંગોનાં અઢળક ગીતો અને કંદસ્થ. ક્યારેક પરોઢ્યે ઘંટી દળતાં ગાય. મારું માણું નિરાંતે જોતી હોય, પાંથીએ-પાંથીએ એની તર્જની ફેરવતી હોય ત્યારે આગ્રહ કરીને ગવડાવું. એક ગીત અને બાનું પ્રલંબ લયમાં ગાવું મને બહુ ગમે :

કુવાને કાંઠે સાંદ્રણી ઝેકારો માણારાજા, મારું દલ...  
મારું દલ...રીજે હો ચંજ.

આવાવાડના ખાડાખડિયાવાળા કાચા વિષમ રસ્તાઓ પરથી ખખડ-ખખડ ગાડાં જતાં હોય એમાં જાનદિયું ગાતી હોય જાણે કર્ણરસાયનથી મારું પોષણ કરવા, અને જાનીવાસમાં મધુર નિદ્રાભંગ થતો હોય :

સૂરજ ઉંગ્યો કેવડિયાની ફણસે કે વાણલાં ભલાં વાયાં  
તમે ઉઠો સુભજીબેનના વીરા કે વાણલાં ભલાં વાયાં.

યજોપવીત વખતે નમેલા માથા પર અસ્તરો ફરતો હોય ત્યારે કણ્ણેતના તો તલ્લીન હોય આવા પ્રસંગે ગવાતાં ગીતો સાંભળવામાં.

બે ચોપડી ભાણેલી બા પ્રભાવતી કોઈ વાર ‘ઉષાહરણ’ કે ‘મામેરું’ મંદ-મંદ ઉકેલતી - વાંચતી - ગાતી હોય.

જનરાયજીના મંદિરમાં રામનવમીના કોઈ દિવસે બપોરે ખોડૂતવુંદ તાવબદ્ધ ઊછળતું, દંડિયા સાથે, ગાય છે ગોળાકાર, આ અત્યારે પણ જાણે પ્રત્યક્ષ.

રાજા દસરથ વેર સૈંવર રચિયો, પરણે રાજકુમારી મારા વાલા.

ગ્રામમાં એક ચીથરેહાલ ગાંડો. એનું નામ પરી ગયેલું ‘ટેટોડો.’ એ ભરબજરમાં જીભો રહીને, સારિનય, લયબદ્ધ ગાતો હોય :

એક પરી વરહનો ટેટોડો, ઈના મૌંમાં ફૂઘિયા દાંત, બોલે ટેટોડો.

નામ હશે દામજી ? દામલો, હરિજનનો રૂપાળો છોકરો. મોટી બે આંખુંમાં આંજણ આંજણાં હોય, બે ચોટલા લીધા હોય. બૈરાનાં કપડાં પહેરી મેળામાં હામોનિયમ સાથે ગાતો હોય. ‘કુદરતી’ નાટકમાં આ દામલો ‘દ્વાંશી’ બાનીને આવ્યો છે.

આ બધાને અનિમેષ જોયાં છે અને એકકાને સાંભળ્યાં છે. એમના શબ્દવ્યોના તંતુએ-તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે. ગામડે-ગામડે ફરતી દેશી નાટક કુપનીઓ, શામન બંસીવાલા નંદલાલા શીરી ગોકુલક ઉજ્જિયાલા-ની મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ, કથા-કીર્તનકારો, મેળામાં કોળીઠાકરડાઓનાં રાહડા, ભજનો, ગરબા, ગરબી, બાલશોના મંત્રોચ્ચારો, મોળાકત વગેરે ક્રતો કરતી બાળાઓનાં ગીતો, બાવા-મદારી-જાહુગર-બજાણિયા-ફ્કીર વગેરેના પદ્ધતિયાના લયલહેકાઓ – આવું-આવું અપારિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં, બાના વહાલભર્યા મીઠા કંઈથી :

હુલુલુલુ હાલવાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો,  
ઝીચરી ખાલમાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો.

ગ્રામના ગ્રંથાલયમાં એકમાત્ર કાવ્યંથ, ‘કલાપોનો કેકારવ,’ જાણે મારા માટે જ. બાકી ‘સાહિત્યપદ્ધતિના શાળામાં ચાલતા ખાડો. નવમા ધોરણમાં અમદાવાદ આવ્યો. શ્રી ભારતી વિદ્યાલય(ભાડિયા)માં અઠળક સામયિકો આવે. ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’, સાંદ્રંત વંચાઈ જાય. નવમા ધોરણમાં હતો ત્યારે મારું એક કાવ્ય ‘રમકકું’માં પ્રગટ થયેલું તેના પુરસ્કારના ત્રાઝેક રૂપિયા આવેલા તેમાંથી, ફરી બાઈન્ડ કરેલું, વિદ્યાર્થીનું નામ – નોંધ – લીટીવાળું એક પુસ્તક ખરીદ્યું ‘નિશીથ.’ તે ખાસ રોમાંચક ઘટના, પ્રથમ પુરસ્કારમાંથી કરેલી ખરીદી. વાપરવા મળતા પૈસામાંથી એ વખતે દર શુક્કવારે લાલદરવાજના મયદાનમાં ભરતી ગુજરીમાંથી ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘ક્રૌંદુઈ’ એવાં-એવાં સામયિકો નિયમિત ખરીદતો. ‘કુમાર’ની તો એક વડીલ પાસેથી, વ્યવસ્થિત બાંધેલી, જૂની ફાઈલ્સ વાંચવા મળી ગઈ. દશમા કે અગ્રિયાર ધોરણમાં હતો ત્યારે બચ્ચુભાઈએ ‘કવિતા’ના અનિયતકાવિક મણકા શરૂ કરેલા તે કાર્યાલયમાં જઈ છૂટક ખરીદતો. કાવ્યો તો રોજ લખતાં પણ ‘બુધસભા’માં જવાની હિંમત ન હતી. પાંચ કૂવા પાસેની એક લાઈબ્રેરી, મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમની લાઈબ્રેરી અને એમ. જે લાઈબ્રેરીમાંથી કાવ્યસંગ્રહો વંચાતા રહે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો ગુરુ વિના ઉકેલવાના પરિતાપમાં કલાકો સુધી પિંગળનાં પુસ્તકો જે કેઈ પ્રાપ્ય તેમાં ગોથાં માર્યા કરું. કોલેજમાં પ્રેવેશ્યા પદ્ધી ‘ગુજરાત કોલેજ’ની લાઈબ્રેરીમાં કાવ્યગ્રંથોનો ખજનો મળ્યો. વળી મિત્રો મળી ગયા, ગ્રેટ. પ્રથમ મળ્યા શ્રી અભુલકરીમ શેખ, એક જ વર્ગમાં. સેન્સિટિવ, સુંદર માણસ. સરસ છંદોબદ્ધ કવિતા લખે.

મનુષ્યના અંતરબાહનાં સૂક્ષ્મ વર્જિનો કરતી વાર્તાઓ લખે. ઉત્તમ બધું વાંચે. સાથે ‘નોટ્સ ફોમ ધ અંડરગ્રાઉન્ડ’ ને એવું ઘણુંબધું વાંચ્યાનું સુરાણ છે. બીજા મળ્યા શ્રી રાધેશ્યામ શર્મા. એ વખતે પણ સિદ્ધ લેખક જેવા. વર્ગમાં પણ માણું જુકાવી કઈ ને કઈ સડસડાટ વાંચ્યા કરતા હોય. અને પુસ્તકમાં અધોરેખાઓ આંકતા હોય. ઉપરાઉપરી વાર્તાઓ લખિને લાવે. પ્રેમથી છલકતું વ્યક્તિત્વ. નાનામાં નાના ખૂણાખાંચરાના માણસોને નજીક જઈને ચાહી શકે, પામી શકે એવી અજ્ઞાત સરલતા; અને ઇતાં કળાકારમાં હોય તેવી અંતરિક સંકુલતાઓથી સભર, રાધેશ્યામ. ત્રીજા મિત્ર મળ્યા તે મૂર્તિમંત ભાવોદેક : શ્રી રચિતાલ દવે. છંદોબદ્ધ સુંદર, ભાવમય કાવ્યોથી છલકતી કાવ્યપોથીઓ. એક કાવ્ય તો ‘કુમાર’માં છાપાઈ પણ ગયેલું. બધા નિતાંત ‘લિટરરી’ રસવાળા. સોબતનાં વર્ષો, કાવ્યોગોછિની મસ્તીનાં સઘન વર્ષો હતાં.

કાવ્યની લગની એવી લાગેલી કે લખવા-વાંચવામાં કલાકો જાય. સુન્દરમુાં-ઉમાશંકર-રાજેન્દ્ર-નિરંજન-પ્રિયકાન્ત-ઉશનસ્નુ-જ્યંત પાઠક-મકરન્દ દવે-પ્રજારામ વગેરેનાં કાવ્યોનું એકાંતમાં પઠન ચાલે, ઉતાવળ વગર આમ સાવ નિરંતે, કાવ્યોનાં કાવ્યો કંઈસ્થ થઈ ગયેલાં. વળી ખાસ ગમતા કવિમાં હરિશ્ચંદ્ર ભણ. એમનો ધૂંટાયેલો ગૂઢ સૂક્ષ્મ લય હજુ કર્ણચેતના પર ચીપકેલો છે. પ્રહૃલાદ અને શ્રીધરાણી પણ ખાસ, પ્રિય. કાન્ત-બળવંતરાય-ન્હાનાલાલ અને અમૃક કાવ્યો બાળાશકરનાં ફરી-ફરીને વાંચ્યું. નરસિંહ-મીરાં-દ્યારામને તો ગાંધી, એકાંતમાં. પ્રેમાંદ તો આખ્યાનશૈલીમાં જ, મારી રીતે, વાંચ્યું. સંસ્કૃત કવિતાનાટક, કથારસથી વિશેષ તો, વાણીરસથી વાંચ્યા કર્ણું.

શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પાખ્યો છું શૈશવમાં, યુવાવસ્થામાં જેમ, તેમ કમશા: તિરાડો પણ એમાં સમાનતર પડતી રહી છે. એકદિયા-બગડિયામાં સાથે ભજતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાબા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં તિરસ્કૃત દશામાં માંડ બે ચોપી ભજતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને વિકારી-વિકારી હડ્ધૂત કરી ખૂબ આવે – ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડ્ધૂત કરતા ઘરના – બાહરના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા-પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી કૂરતાઓ જોઈ, વર્ષોથી આ ભક્ત ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકોને અડવાનું ‘પાપ’ કરતો, જોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ટ’ થાય છે તે. વર્ષોથી જોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂર્તિને મૂત્રધારાથી પરિખાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની-નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કારણે જે કઈ આત્મસાતું થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કંતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંપાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી દઈશ’ એવી

ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચે ઊંઘરતાં ઊંઘરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગેલેલો. આખો હિવસ જેમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે ! -

હિટલરને હું વિકારી શકતો નથી  
અને ગાંધીને હું ચાહી શકતો નથી.

રખડતા ગાંડાઓને પજવતાં બાળકો તો ટીક પણ મોટેરાંઓને જોઈને તમતમી ગયો છું. બાળકોને રિબાતાં-દ્વાતાં-ઢોર માર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધો; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધભૂખ્યા લોકોને જોયા છે અને રાજાઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરદોડાઓ, શોભાયાત્રાઓ જોઈને કુષ્ય થયો. છું. આ એક સતત લાંબી પ્રક્રિયા ચાલી છે. બાબણ-વાણિયા એટલે બધા ભદ્ર લોકો; એમનાં ધરમ, કરમ એમના ધર્માંથો, તત્ત્વાંથો બધું ધીમેધીમે ઊથલી પડ્યું છે, ચિત્તકોણોમાંથી. આવી મનોદૃષ્ટામાં ચોખવને ચાહતો થયો. દોસ્તોયેવ્યક્તિ માટે પરમ આદર થયો. ફોઈડનું કંઈક ઉલટથી વંચાયું. (એય જોકે ઊથલી પડ્યું છે આજે મનોવિજ્ઞાનના નામનું બધું) રોધની જગ્યાએ બિનંગતપણું આવતું ગયું. સદ્-અસદ્, પાપ-પુણ્ય, ગુડ-ઈવિલની સમજણ, બેદબુદ્ધિ ઘસાતી, ઓગળતી, અભિન્ન બનતી ચાલી. શાયલોક પણ વિલન મરી જાય એવો આવેખ મરચન ઔંઝ વેનિસામાં જ મળી રહે છે. દુરિત પણ પરિણામરૂપ છે. ગાંધી-હિટલર પરિણામો છે. કારણોની સંકુલ જયજાતના પરિણામરૂપ માણસનું વ્યક્તિત્વ છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર બધાં, માણસોને ઘડનારાં પરિબળોને પામતાં-પામતાં, હાંઝી ગયાં છે. માણસ હાંઝી રહ્યો છે પોતાની મૂળની શોધમાં. બાયોલોજીની ખાણખોદ ચાલુ છે ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમનું મૂળિયું તપાસતી. When અને How-ની ધારણાઓ કંઈક આપી શકાઈ છે. Why-ના જવાબમાં શૂન્ય. એકકોણી પ્રથમ જીવથી માંડીને આજના મલ્ટિસેલ્યુલર મેન સુધીના આ બાપડા જીવોનું પોતાનું કર્તૃત્વ કેટલું ? Free will, Free choice-ની વાત બધી તળેઉપર થઈ ગઈ છે. માણસ પણ ગુણધર્મોવાળાં તત્ત્વોનો, સજીવ તો સજીવ, સમુચ્ચય છે. એ તત્ત્વો અને એના ગુણધર્મો સંધાં હજુ કંઈ ઊકલ્યાં નથી. આવી સ્થિતિમાં ભાવનાની, આદર્શની વાત પરમ કરુણ કે પરમ હારસ્યાસ્યદ લાગે છે. ઉલાંતિકમ (જો એમાં સત્ય હોય તો)માં મળેલા વિશેષ ભાનને લીધે માણસનું આયુષ્ય વધ્યું છે; પણ એ સભાનતા અને પોતાના મૂલ પ્રયોજનનો અર્થ શોધવા પ્રેરે છે. માણસની વંદ્ય સભાનતા રહસ્યમયતા, ગૂઢતા પાસે હિજરાઈ રહી છે કે હસી રહી છે. આત્મસાત્ કરતાં-કરતાં રચાયા હતા તે સંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પદ્ધતાય છે. આંદુંવણું દીઘરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગજલનું સ્થિરલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સર્ણગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં

ચેતના એકધારી લીનતલીન બની શકે એવા ગંજેરી હાલ ઈન્ટિગ્રેટ, રહ્યા નથી. ટ્રાંકિવલાઈઝરની ટીકડી જેવા ગીતગળવના એકધારા લય-આવર્તનોની થેરપીની જરૂર નથી, છદ્ર.

બટાકાનું શાક ભાવે છે. આઇસકીમ ભાવે છે, બોકેટ ગમે છે, અતિ. આયોનેસ્કો ગમે છે. પિન્ટર ગમે છે. ટોમ સ્ટોપાર્ક ગમે છે. એક ઓસ્ટ્રીયન, જર્મન ભાષામાં લખતો નાટ્યકાર પિટર હેન્ડી (Handke) ખાસ ગમે છે. એમ તો શિયાળામાં તડકાનો સ્પર્શ ગમે છે. ચોમાસામાં નાહેલાં હરિત ચોખાં વૃક્ષો જોયા કરું છું જિસકેલીને તરાથી ખાતી જોવી ગમે છે. ના કોઈ પણ અલંકાર નહીં, કહેવો હોય તો સ્વભાવોક્તિ અલંકાર, ટૂંકમાં વર્ણનો, નર્યા વાસ્તવિક વર્ણનો, દા.ત, પ્રેમાનંદમાં, આવે છે તેવાં વર્ણનો બહુ ગમે છે. સિમ્બોલ-ફિલ્મોલ-ની વાત કરતાં પ્રકૃતીનાં, પ્રાણીઓનાં, મનુષ્યનાં નખશિખ વાસ્તવિક, ઈન્ડ્રિયસંતર્પક વર્ણનો ઘણાં ગમે છે. ચલચિત્રો જોવાં ગમે છે. ગોદાઈં, એલન રેને (Alan Resnais,) કુરોસાવા ગમે છે. હમણાં ફિલ્મોત્સવ-'૮૪માં જાપાનના ડિગર્શાક નાગીસા ઓશિમાનાં ચિત્રો જોયાં. એક ફિલ્મ 'તેથ બાય હેંગિ' લા-જવાબ. પોલિશ ડિગર્શાક વાજદાનાં ચિત્રો જોવાં ગમે છે અને ખાસ, અપનેવાત્તા લાગતા, એટેલે મેટાફિલ્કલ સંજ્ઞેક્ટવાળા, યંગ પોલિશ ડિરેક્ટર જાનૂસીનાં ચલચિત્રો અપનકો બહુત અછે લગતે હેં. ફાસબાઈન્ડર, સલામ, બર્ગમાનદાદા અને ઠયાલિયન પાસોલિની, હેરેનિન જેન્કસો અને... અને ચેક ડિગર્શિક્ઝ જેણે 'તેઈન્ડિઝ' નામની અતિ સુંદર ફિલ્મ બનાવી હતી તે, ઉચ્ચાર જે થતો હોય તે, વેરા સિટિલોવા કે ચિટિલોવા ગમી ગયાં છે. ઘણાં નામ ઊપસી આવે છે મનમાં. પ્રિયજ્ઞો એવું કહેતા હોય છે કે એમના મિલનમાં રાત આખી, કલાકો, જાણે ક્ષણભરમાં પસાર ન થઈ ગયા હોય ! ચલચિત્રો જોવામાં ખબર નથી પડતી અને સમય પસાર થઈ જાય છે. અહીં લાંબી નામાવલિ અને લાંબી વાત અપ્રસ્તુત છે. પણ એક ડિગર્શાકનો ઉલ્લેખ તો કરવો જ પડશો, વોલ્કર સ્કેનડોફ. આ જર્મન ડિગર્શાકનાં ચલચિત્રો પહેલી જ વાર જોવાની તક મળી ફિલ્મોત્સવ-'૮૪માં. ગુન્ટર ગ્રાસની 'ધ ટીન ઇમ' નવલક્યા પરથી બનાવેલી ફિલ્મ, આજ સુધી જોયેલી ફિલ્મોમાં યાદગાર બની રહેશે. આ બધું લખું છું કેમ કે અંતરમાં વાસના પડેલી છે, ફિલ્મ બનાવવાની. લોટરીની ટિકિટે લઉં છું કોઈ મોટું નામ લાગી જાય તો ચલચિત્રો બનાવવાં છે. આમ તો, મનોમન તો, ઘણા શોટ્સ લેવાતા રહે છે.

બધું અસ્પષ્ટ અને ધૂંધળું અને ગૂઢ બની ગયું છે. શબ્દની મદદથી રંગભૂમિની ભાષાથી ગૂઢ પ્રદેશમાં ફરતાં-ફરતાં વધારે ગૂઢતાથી દેરાતો જાઉં છું. જોકે કાચી કેરી અને કુગળીના કચુંબરમાંથી જે પાણી છૂટે છે તે ગમે છે, ચાટવું. હેમખેમ છે બધું એમ તો. ઉથલી પડશો સ્વયં ઝાડ એમ તો કેમ કહી શકાય ? ઝાડ ઉથલી પડે છે મૂળસોતું તેનાં કંઈ એક-બે કારણો નથી હોતાં. અસંખ્ય, અપરિસંખ્યેય કારણો હોય, ભલે આપણાને બે-પાંચ જગતાં હોય અને વળી આપણા મૂળનું લોકેશન જ હજુ શોધી શકાયું નથી. ત્યાં વળી અમુક કારણોસર ઉથલી

પડીશું એમ અનુમાન કરવું ? જીવનરસ તો છીંક ખાતી વખતે પણ પ્રકટ થાય છે અને રત્નમાં ગાજરને કેડકેડ ખાતી વખતે પણ થાય છે. એટલે વળી શું પોસિમિઝમ અને શું ઓસ્ટિમિઝમ ? ટૂકમાં, શબ્દના સથવારામાં પણ રાત્રિ પસાર થઈ જાય એવું, એક 'સિંહાસન' પર આરંભેલું કાબ્ય પડ્યું છે અપૂર્ણ. નહીં માનો, પણ એકેએક ખાવાની ચીજ ઉપર, પીવાની ચીજ ઉપર, વાનગી ઉપર લખવું છે, કાબ્ય. એક અર્ધા સુકાયેલા પાંદડા ઉપર કવિતા લખવી છે; વળી એક નિર્મભ, બિનંગત, સાક્ષી જેવું જલકમલવત્ર પ્રાણી અનુભવાય છે અંદર, આનંદિત, નિષ્ઠલક; તગતગતી આંખોવાળનું જે એને આમ શબ્દમાં રૂપાંતરિત કરવાના પ્રયત્નો હજુ ક્યાં પૂરા થયા છે ? ધડું ધડું ધડાકા સાથે કવચ તોડવાનાં છે બધાં શબ્દચેતનાનાં અને પ્રવેશતા જવાનું છે અંદર નિસરાઇ મૂકીને પગથિયાં ઊતરતાં ઊતરતાં, ક્યાંક ભૂસકા મારીને, ક્યાંક સરિસૂપ સરકતાં, સાવધાન, નકશા વિના, છેક મૂળિયા સુધી. શબ્દમાં મૂળ ઈ માણસનાં મૂળ ? કામે લાગી ગયા છીએ. શું કામ ? કીડી કણ શોધવા નીકળે એવું કંઈ નથી આ. યોગક્ષેમ માટે તો કરીએ છીએ વૈધું, શબ્દનાં મૂળ, ફુળનાં કુળ પામવાની આ ધખના શરાને ?

મારી ભાષામાં કામ કરતા બે કવિઓના હાલ શા છે તે જાણવાનું કુતૂહલ રહે છે. મૃત્યુ અને દુરિત આ બે પર ઉમાશંકરનું ટાંકણું ગોઠવાયેલું છે. 'સપ્તપદી'માં એ ટાંકણાનો અવાજ સંભળાય છે. જયયુના અંત પણી સિતોશુનો તંત ક્યાં ચોંટ્યો છે તે મારા કુતૂહલનો વિપય છે. રસોડામાંથી, ચઢતા આલુના શાકની ગંધકણિકાઓ સૂક્ષ્મ આ અપનકો ભી અજનલી લગતા I-ના સર્વ સોતોને વિકસિત કરી નાખે છે ક્ષાણાર્ધમાં, ચુચુકનો સ્પર્શ થતાં બાળકના હોઠ ખૂલ્યી જાય તેમ; એમ ચેતોવિસ્તાર અનુભવાય છે આ કાણે. વળી વધારામાં કેમ કે ગાલ પર પડે છે પોષનો તડકો અને આ કાણે અર્થાત્ આ લખ્યું છું તે કાણે અડકોદડકો એમના નિપદથી મારી સમગ્ર ચેતનાને ખેંચતી રહ્યા છે હળુહળુ અને હું મેંચાઈ રહ્યો છું અગોચર આંતરિકમાં.

[‘સર્જકની આંતરકથા’ સં. ઉમાશંકર જોશીનાં (પુનઃમુદ્ધા, ૨૦૧૧)માંથી]

## સાભાર સ્વીકાર

### નવલક્ષ્ય

(૫૮) ૨૧ ડિસેમ્બર : બાલેન્દુશેખર જાની, ૨૦૧૫, ગુજરાત ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ ૮૧૩૧૮, રૂ. ૧૧૦ (૬૦) આંખો (પાંચ લઘુનવલ કથાઓ) : ૨૦૧૫, ગુજરાત ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૫૬, રૂ. ૧૨૦

### ૩. રહસ્યમય ગૂઢ અંધકારના કાંઠે કવિની કોણ્ણિયતનો અવાજ

લાભરાંકર ટાકર

સાંજ તો ક્યારનીય ઢળી ગઈ છે. રાત પણ પડી ગઈ છે. કારમાં આગળ બેઠો છું. મારી પાસે મારો દૌહિત્ર પ્રત્યુષ બેઠો છે. અનુભવ યાદ કરીને લખું છું જે સમયનો તે સમયે તો એની વય માંડ અઢી વર્ષની હશે. એ સડસડાટ માતૃભાષા ગુજરાતી બોલતો થઈ ગયો છે. પણ ઉત્તરતી રચિના સમયે, ચાલતી કારમાં, પ્રત્યુષ ગાઈ રહ્યો છે. કોઈ શીખેલું – સાંભળેલું ગીત નથી. પણ એ ગાઈ રહ્યો છે. શબ્દો છે, ભાષા છે, વ્યાકરણશુદ્ધ પંક્તિઓ છે. પણ એમાં જે કેફ છે તે લયનો છે. અઢી વર્ષનો પ્રત્યુષ શીંગ શબ્દપંક્તિઓ સરજીને ગાઈ રહ્યો છે ચક્યૂર. રસ્તામાં માલગાડી પસાર થઈ તો એ ‘માલગાડી જાય છે’ એવું કર્ઝક ગાઈ રહ્યો છે. નિજાનંદમાં એ લયમસ્ત છે. આ ક્ષણોમાં એ પરિવાર વચ્ચે છે. પાકી સડક પરથી વાહનમાં પસાર થઈ રહ્યો છે. નગરમાં છે, માનવસમૂહમાં છે, આકાશની નીચે પૃથ્વી પર છે. પણ છતાં એ નિજમાં છે, નિજાનંદમાં છે, આ આનંદ એના લયકેફ્ફમાં બ્યક્ત થતો અનુભવાય છે. નિજાંથી વાણીમાં, વાણી રૂપે લયામૃત પ્રગટ થાય છે. એ પોતે જ એ લયામૃતનો સર્જક છે. અને એ પોતે જ એનો શ્રોતા છે. અહીં આ ક્ષણોમાં સર્જક-સર્જન-ભાવક અભિન્ન હોય, ઠિન્સેપરેબલ હોય તેમ કહેવામાં કર્ઝ ક્ષતિ છે ?

પ્રત્યુષની વાત છે તે મારી પણ વાત છે. લયના કેફની કોણ્ણિયતમાં મારો આરંભ છે. આ લખું છું ત્યારે સત્તાવન વર્ષની વચ્ચે પણ લયનો કેફ ઉત્તર્યો નથી. મેં કાચ્યો લખ્યાં છે મિત્રો, અમુક સંઘયમાં, તેનાથી સહસ્રગણાં કાચ્યો હું ગણગણયો છું. મનમાં કે મોટેથી શબ્દપંક્તિઓ સરજી સરજીને ગણગણવાની અને એનો શ્રવણિય આનંદ લેવાની મને બહુ મજા આવે છે. બેઠો હોઉં ઘરમાં, રિક્ષામાં, કોઈ વાહનમાં; ઊભો હોઉં અગાશીમાં, રસ્તા પર કે ગમે ત્યાં; સૂતો હોઉં પલંગમાં કે રેલવે-ટ્રેનના પાટિયા પર : મારી એકમાત્ર પ્રિય પ્રવૃત્તિ રહી છે ગણગણવાની. પંક્તિઓ સર્જય, લયાનુસંધાનમાં એકાધિક પંક્તિઓ સર્જય, ગણગણતો હોઉં, સાંભળતો જાઉં અને ચિદાકશમાં માત્ર આનંદ મૂકીને એ પંક્તિઓ સરી જાય. યાદ પણ ન રહે. બૂગળીમાં રચનાઓ મૂકીને નદીમાં તરતી મૂકવા જેટલી સભાનતા પણ નથી. કશા પણ મમત્વ વગર એ સરી ગઈ છે. આજે પણ સરી જાય છે. મને લાગે છે આ ક્ષણો તે લખું છું. કદાચ મને જેલની કેટદીમાં તે એંસાઈલમમાં એકલો પૂરી રાખવામાં આવે તો હું માત્ર ગણગણીને, સાંભળીને કલાકોના કલાકો, દિવસોના દિવસો, સમગ્ર શેષ જીવન પસાર કરી શકું, કંયાળાની ફરિયાદ વગર કરી શકું મારે જોઈએ મારા મસ્તિષ્કમાં મારી ગુજરાતી ભાષા. મનમાં ગણગણું તોપણ મારા બધિર કાન એ ગણગણાટને સાંભળી શકે. એમાં વહેતા લયામૃતને પી

શકે. પછી મૃતત્વ મને સ્પર્શી શકે નહિ. હું જીવી જાઉં છેલ્લી કાણ સુધી. મારી આ કેફિયત લખવાના આરંભમાં મારી કાવ્યસર્જનની વૃત્તિના મૂલપર્યત્ત તાકીને જોઉં છું તો લયના થડકારા મને સંભળાય છે કારણ રૂપે. પ્રત્યુષ કે કોઈ પણ માનવબાળની વાત હોય, તેઓ શિશુવયમાં જ વાળીના લયાત્મક થડકારાનો કેફ માણી ચૂક્યાં હોય છે. વાડુમય સંકેતો હશે, પણ લિપિ નહિ હોય તેવા મનુષ્યજીતિના આદિમ કાળમાં પણ વાળીના લયાત્મક થડકારા હશે. લય એ કાવ્યનું root છે. બેઝિકલી કાવ્યમાત્ર લયમૂલક છે. મારું પ્રથમ કાવ્ય આખું મને યાદ નથી. મારી વય દશેક વર્ષની હશે. એ રચનામાં શબ્દો છે, અર્થો છે; પણ એમાં કશું રોમાંચક નથી. એમાં મને જે રોમાંચ થયો હશે એ ક્ષણોમાં તે તો લયનો જ.

### સુખો ઘાંચી કેરી લાવે મનુ-કનુને કેરી ભાવે

- આવો એ રચનાનો આરંભ હતો. કોઈ સુખો ઘાંચી ન હતો. અને કોઈ કેરી વેચવા નીકળતું ન હતું. એવી કોઈ વિગતમાં કશું આશ્રયજનક ન હતું. રોમાંચક હતો લય. મેં એ લયાત્મક રચના કરી હતી એનો મને આનંદ હશે. મારી એ સર્વપ્રથમ રચનાના પ્રથમ વાચક હતા મારા પિતાશી. એમણે રચના વાંચી. પ્રસન્ન થયા. પછી હોલ્ડર ખડિયામાં બોળીને રચનાના એક સ્થાનમાં ‘લયભંગ’ થતો હતો તે સુધાર્યો. એ ઉમરે ‘લય’ શબ્દ જાગતો ન હતો; પણ પિતાએ શું અને શા માટે સુધાર્યું છે તે કાનથી (રાઇટ, કાનથી) હું પામી ગયો હતું.

હજુ ઘોડિયું – પારણું છૂટ્યાં ન હોય, હજુ લાંખોડિયાં ચાલવાનું શરૂ થયું ન હોય એવા, પડ્યા પડ્યા હાથ-પગ હલાવતા, બાળકને ‘લખારો’ કરતાં સાંભળ્યું છે ને ? ‘લખારો’ એ સૌરાષ્ટ્ર બાજુપ્રયોજાતો શબ્દપ્રયોગ છે. ગુજરાતમાં પણ પ્રયોજાતો હોય. આ લખારામાં અવાજના લયનો આરંભ છે. આમ તો જન્મોત્તર રુદ્ધન સુધી એનું મૂળ જોઈ શકાય. પણ એટલે સુધી ન જોઈએ. એ રુદ્ધનને માત્ર જૈવિક, બાયોલોજિકલ ઘટના ગણીએ. પણ આ લન્ઝા-રાનું સેટજ મારી વાત માંડીને બેઠો છું તેમાં વધુ ધ્યાનાકર્ષક લાગે છે. આ vocalic sounds છે. પણ એ non-cry vocalic sounds છે. બાળક આવા નોન-કાય વોકલિક અવાજ – અવાજો – લખારાનો શ્રોતા હોય છે ત્યારે એ લયમસ્ત હોય છે. એ સ્વયં પોતાના લખારાનો શ્રોતા હોય છે. લયાત્મક અવાજ કરનાર, એ અવાજ સાંભળનાર, અને એનો આનંદ પામનાર અભિનન એવી એક ચેતના હોય છે. આ લખારાને અંગ્રેજીમાં cooing કહે છે. ‘કૂ’ (coo) એટલે હળવો ગણગણ અવાજ. કબૂતરના જેવો ધીમો સૌમ્ય અવાજ. મને એમ કહેવું ગમે છે કે આ કૂંઠિંગમાં મારા લયનાં બીજ છે. કૂંઠિંગ કરતું બાળક હજુ એક વર્ષનું પણ નથી હોતું. એ પછીની બીજ અવરસ્થામાં speech sound discriminations આવે છે. દા.ત., બા/પા. વાળીના સાઉન્ડમાં બેદવિવેક બાળક બોલી-સાંભળીને કરી શકે છે. કૂંઠિંગમાં માત્ર વોકલિક સાઉન્ડ્ઝ છે. લયનું બીજ કૂટે છે એ સાઉન્ડમાં જે speech sounds રૂપે ઓળખાય છે. આ બીજ ભૂમિકામાં અવાજનો

લય એ ભાષાના લયમાં, ભાષાના લય રૂપે આરંભાય છે. કાવ્યલયનો આ ભૂમિકાથી આરંભ થાય છે. મારું કાવ્યજીવન બા-ચા-પા-થી આરંભાયેલું છે એમ ‘પ્રવાહણ’ નામના મારા દીર્ઘકાવ્ય (૧૯૮૫)ના અંતભાગમાં વ્યક્ત થયું છે.

મારું

બા ચા પા થી

આરંભાયેલું

કાવ્યજીવન

વિશ્વવિજ્ઞનમાં -

કરંતે છે

કમોડ પર

એકંતમાં

ને

આઈ એમ ઈન્કોપેબલ ઓવ કીપિંગ સાઈલન્ટ  
ઉંહ... ઉંહ...

પણ ‘પ્રવાહણ’ની વાત પર પણી આવીશ.. ‘કવુ’ ધ્યાતુનો અર્થ થાય છે જાણવું – to know. આ ‘કવુ’ ધ્યાતુ પરથી ‘કાવ્ય’ અને ‘કવિ’ શબ્દો બનેલા છે ? મારું સંસ્કૃત ભાષાનું જ્ઞાન મર્યાદિત છે. એ મર્યાદા સ્વીકારીને મારી સમજ અહીં કંમશઃ ઊપસવા દર્દી છું. બાળક જે વયથી, જે ક્ષાળથી ભાષાના સાઉન્ડ્ઝને discriminate કરતું થાય છે તે ક્ષાળથી એનો જ્ઞાનવાનો, સમજવાનો આરંભ છે. બા-ચા-પાથી કાવ્યજીવન આરંભાય છે. કાવ્ય કોને કહેવાય એવી વ્યાખ્યા કરવામાં મને ખાસ રસ નથી પડતો. એટલે મારા દસ્તિબાપમાં બા-ચા-પાથી કાવ્યજીવન આરંભાય છે. એક સ્પષ્ટતા કરી લઈ : જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે. ઇન્દ્રિયમું ઇન્દ્રલિંગમું અર્થાત્ વિશ્વના ઐશ્વર્યનો બોધ કરવો તે ઇન્દ્રિય. ઇન્દ્રિયબોધ વિના વિશ્વાનબોધ કે કલાબોધ સંભવિત નથી. બિન બિન કળાઓમાં કોઈ ને કોઈ ઇન્દ્રિયબોધનું પ્રાધાન્ય હોય છે. કાવ્યકળામાં આવું પ્રાધાન્ય શ્રોત્રબોધનું છે. એમાં ચક્ષુબોધ વગેરેનું વધતું-ઓછું પ્રવર્તન હોય છે; પણ પ્રાધાન્ય શ્રોત્રબોધનું છે. કેમ કે શબ્દ એ સાઉન્ડ છે અને સાઉન્ડ એ શ્રવણેન્દ્રિયનો ‘વિષય’ છે. સાઉન્ડ એ શ્રવણેન્દ્રિયાર્થ છે. શબ્દબોધ એ સર્વપ્રથમ ‘સીધી’ શ્રવણગોચર ‘ભૌતિક’ ઘટના છે. મારે સ્પષ્ટતા એ કરવી છે કે વિશ્વબોધ માત્ર શ્રોત્રથી થાય છે તેમ નથી. પણ સંગીતકાર, કવિ માટે વિશ્વબોધ એ મહદેશો શ્રવણબોધ છે. ચિત્રકાર, શિલ્પી માટે વિશ્વબોધ એ મહદેશો ચક્ષુબોધ છે. કોઈ એક ઇન્દ્રિય દ્વારા વિશ્વબોધ કળાકારો પામતા હોય છે, અનુભવતા હોય છે, તેવું શા માટે ? એવું વૈયક્તિક ચૈતસિક વલણ, સ્વાભાવિક વલણ (aptitude) છે તેમ કહેવા સિવાય વધારે સમજણ મારી પારે નથી. મનુષ્યની એક વ્યાવર્તકતા

એ એની જિજ્ઞાસા છે, એને જાગ્રત્વાની ઈચ્છા છે. પ્રબળ ઈચ્છા છે. ઇન્દ્રિયાપાર અને તર્કિયાપાર દ્વારા પણ માણસ 'સ્વ' અને સ્વ-ના સંદર્ભરૂપ 'વિશ્વ'ના રૂપને જાગ્રત્વ જે વ્યાપારમાં સમગ્ર ચેતનાના સર્વ અંશો પ્રવર્તમાન હોય છે છતાં ઇન્દ્રિયાર્થની તાર્કિક ઉપલબ્ધ એ વિજ્ઞાન છે. કળાની ઉપલબ્ધિમાં સમગ્ર ચેતનાના સર્વ અંશો પ્રવર્તમાન હોય છે. પણ એમાં ભાવ (વાગ્યી) અને કલ્યાન વિશેષ રૂપે પ્રવર્તતાં જણાય છે. તર્કનું, વિચારનું, બૌદ્ધિક્યાપારનું પણ એમાં આંશિક પ્રવર્તન હોય. ચેતના, સંવિદ જે તે અંશો રૂપે ખંડિત નથી. તે અંદર છે તેથી વિજ્ઞાન અને કળા ઉભયમાં એનું અંદર પ્રવર્તન હોય છે; છતાં આ બને પ્રવર્તનોમાં ખેદ છે. વિજ્ઞાન વિશ્વના કોઈ ને કોઈ અંશને ઇન્દ્રિયાર્થ રૂપે, સામગ્રી રૂપે પ્રાપ્ત કરી બૌદ્ધિક વ્યાપારથી એ અંશમાં પ્રવર્તતા નિયમને - નિયમોને પૃથક્કરણથી જાણો છે. કળા ઇન્દ્રિયાર્થના બૌદ્ધિક પૃથક્કરણરૂપ તાર્કિક તારતમ્યમાં રસ ધરાવતી નથી. એ ઇન્દ્રિયાર્થને ભાવ રૂપે, રસ રૂપે અનુભવે છે. એટલે કળાબોધ એ અંતિમ ક્ષણ સુધી ઇન્દ્રિયાર્થનુભવ (sensation) રહે છે, કળા આ અર્થમાં સેન્સ્યુઅસ છે. તે સેન્સ્યુઅસ છે તેથી અનુભવ છે, ભાવાનુભવ છે, રસાનુભવ છે.

ઇન્દ્રિય વિના વિજ્ઞાનનો પણ સંભવ નથી. ઇન્દ્રિય વિના કળાનો પણ સંભવ નથી. આ વિષયમાં વિસ્તારભયે હું ઊંડો ઉત્તરતો નથી. ઊંડા ઉત્તરવાની મારી ક્ષમતા પણ નથી, પણ કળાના ઇન્દ્રિયાર્થમાં અને વિજ્ઞાનના ઇન્દ્રિયાર્થમાં ખેદ છે. વિજ્ઞાનમાં પૃથક્કરણ પદ્ધી પથ્થર છેક સુધી પથ્થર રહે છે. કળામાં, જેમ કે શિલ્પકળામાં, પથ્થર ભૌતિક દણિએ છેક સુધી પથ્થર રહેવા છતાં અંતે એક કલ્યાણી વિશેષ બની જાય છે. પણ હવે કાબ્યની જ વાત કરું. કાબ્ય સીધા ભૌતિક, રિયલ 'પથ્થર'નો પણ વિનિયોગ કરતું પ્રવર્તન નથી. કાબ્યમાં આવતો પથ્થર એ ભૌતિક પથ્થરના પ્રતીકરૂપ એવો શબ્દ છે, સાઉન્ડ છે. સંકેત એ તરફ છે કે કાબ્યમાં 'જીવન' કે 'જગત' એ સીધું પ્રવેશતું નથી. કાબ્યનું જગત તે શબ્દજગત છે. ભલે શબ્દબ્રલ એ વિશ્વબ્રલનું મનુષ્યજીતિએ જીલેલું પ્રતિબિંબ હોય. પણ કાબ્ય એ શબ્દથી, શબ્દમાં, શબ્દ રૂપે અનુભવાતો સાક્ષાત્કાર છે. કાબ્યનું ઉપાદાન જીવન નથી. પણ 'શબ્દ' છે. શબ્દ જીવનનો જ એક ભાગ છે. તેથી જીવનની બાદબાકી અહીં અભિપ્રેત નથી; પણ જીવનનો શબ્દથી, શબ્દમાં, શબ્દ રૂપે અનુભવ - અનુભાવન તે કાબ્યકળા છે. કાબ્યચેતના એ શબ્દચેતના છે, વાક્યમય ચેતના છે.

એક કાબ્યસર્જક તરીકેની કેદ્ધીયતની રજૂઆત કરતાં કરતાં મારે કંઈક માંડણી કરવી પડે છે. ઉપર પ્રમાણેની એકાક્ષરી શબ્દની અવગ ઓળખ અને ઉચ્ચારણની ક્ષમતા સાથે મારા કાબ્યત્વનો આરંભ છે. વાગી દ્વારા જ સ્વ અને સ્વના સમગ્ર સંદર્ભ રૂપે વિશ્વને પામવાની લગની, ભલે મારા શૈશવમાં હોય એનાં roots, ભલે એની આજે મને કોઈ જાગ્રત સમૃતિ ન હોય; પણ એવી લગનીનું હું અનુમાન કરી શકું છું. આ *aptitudeનાં* મૂળ એટલાં ઊંડાં હશે, સ્યૂરોફ્ટય જેટલો જ આનંદ શબ્દોદયમાં અનુભવ્યો હશે, છે. તે આનંદ શબ્દહિલ્લોલથી અનુભવ્યો હશે

/ છે / શ્રવણીય, યેસ. મારા શૈશવના અશબ્દ લયબદ્ધ લખારા અસંખ્ય સરી ગયા હશે. તે પછીના સંશબ્દ ગણગણાટો લયબદ્ધ, શૈશવમાં – કેશોર્માં – કૌમાર્યમાં – યૌવનમાં – પ્રૌઢાવસ્થામાં આ કણ સુધી સરી ગયા છે. પ્રથમ કાવ્યરચના પછીના એ દિવસો યાદ આવે છે. રોજ હું ઘણાં કાવ્યો રચતો કાગળ પર. સપ્તાહમાં એક કાવ્યસંગ્રહ થાય એટલાં કાવ્યો રચતાં હશે એમ કહેવામાં અલોકિત છે. અરે ક્યાં ગયા એ મારા કિશોરવયનાં અસંખ્ય કાવ્યો ? મને કંઈ યાદ નથી. રોજ હું ઘૂંઠીઘૂંઠીને શું શબ્દાર્થો ઘૂંટો હતો ? એમ કહી શર્કું કે હું વાણીને આત્મસાત્ત કરતો હતો; મારી માતૃભાષાને આત્મસાત્ત કરતો હતો; દીર્ઘ પરંપરાઓથી, સદીઓથી, ખળગળ વહેતી મારી માતૃભાષાના અનેકાનેક વહેળાઓના લયોને હું આત્મસાત્ત કરતો હતો; અનેકાનેક શબ્દાર્થો ઘૂંટો હતો ? એમ કહી શર્કું કે હું વાણીને આત્મસાત્ત કરતો હતો; અનેકાનેક શબ્દોને સદીઓથી ચીટકેલા અર્થોને હું આત્મસાત્ત કરતો હતો; ઘરમાં, આસપાસ, ગામમાં, પ્રસંગોમાં, ઉત્સવોમાં, વિધિઓમાં, પ્રગટતા વાડુમય લયોને મેં તન્મયતાથી પીધા છે અને એવી તન્મયતાથી શબ્દની અંદર-બહાર-ઉપર-નીચે ચીટકેલા અર્થોને મેં કાનથી વાંચ્યા છે, કાનથી ચાખ્યા છે, કાનથી સુંદર્યા છે, કાનથી સ્પર્શર્થ્યા છે. આ બધું જ કોઈ સ-ભાન, સ-હેતુક ચેતનાથી નથી થયું. આ બધું જ અભાન નિહેતુક ચેતનાથી, લીલયા થયું છે. સાંભળેલા વાડુમય લયોને અને અનુભવેલા શબ્દાર્થોને શિશુ-કશ્યોર-કુમાર-યુવાન વયમાં આત્મસાત્ત કરીકરીને કાવ્યરમતો રૂપે એ આત્મસાત્ત સામગ્રીમાંથી, એ લયો અને શબ્દાર્થોમાંથી કાવ્યકલ્પો કરવામાં મને જેવો આનંદ આવ્યો છે તેવો આનંદ મને બીજા કશામાં આવ્યો નથી.

તાદાત્મ્ય પરંપરિત વાડુમય લયો સાથેનું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. ‘વહી જતી પાઇળ રમ્યઘોષા’માં એ તાદાત્મયના પ્રગત કાવ્યાલેખો છે. આ તાદાત્મ્ય તીવ્રતાથી ચાલ્યું હશે શિશુ-કિશોર વયથી; પણ એ, એ જ વયાવસ્થામાં જરીક જરીક તૂટું પણ રહ્યું હશે. જીણી જીણી તડ પડી હશે એ તાદાત્મયમાં. કેમ પડી હશે તડ ? મને લાગે છે પરંપરાથી ઊછણતો, વહેતો શબ્દ આત્મસાત્ત થયો હશે અને એ શબ્દ-શબ્દમાં પડતી તડ-તડો પણ આણી આણી નોંધાતી રહી હશે. તિરસ્કાર જોયો હશે મનુષ્ય દ્વારા મનુષ્યોનો અને પ્રેમ શબ્દને તડ પડી હશે. પ્રેમાર્થનો કોઈ પ્રત્યક્ષ, સાક્ષાત્કાર નહિ થયો હોય અને ‘પ્રેમ’ શબ્દ બોધો લાગ્યો હશે. ઘૂમતો, ગાતો, માણસ જોયો હશે લયબદ્ધ; તો સાથે સાથે એના બાધ્ય લયાનુવર્તના આંદબર નીચે એના તૂટી ગયેલા અંતરલયને પણ કંઈક ઝાંખો-પાંખો જોયો / સાંભળ્યો હશે. મને લાગે છે કે તૂટવાની, તડ પડવાની ચૈતસિક પ્રક્રિયા ઘણી આણી અને ઘણી ધીમી હશે. સ્મૃતિ કહે છે કે એ અંગેની સભાનતા પણ હશે / હતી. પણ આશ્ર્યથી ભાષામાં પ્રતિબિંબાત્માં સ્વરૂપોને, મનુષ્યના મનુષ્ય સાથેના, અન્ય જીવો સાથેના, સર્વ સ્થાવરો-જંગમો સાથેના, પ્રકૃતિ સાથેના દીર્ઘ પરંપરાથી વહી આવતા અનંતવિધ, નાનાવિધ, અસ્પાદ, સકલ, સંકુલ સંદર્ભોમાં રૂપોને, કાન મંડીને સાંભળવામાં અને આત્મસાત્ત કરવામાં જે સ્વાભાવિક લગની લાગી હશે તેની તન્મયતામાં તદ્વપત્તામાં પેલી

આઈ આઈ, તૂટી વાક્યમય તરડો નહીંવતુ સંભળાઈ હશે. હું સાત વર્ષે એકદિયામાં બેઠેલો મંદુચેતસુ જીવ. મારું ચેતસૃતંત્ર સ્લગિશ છે, મંદ બાળક પડજું પડજું કલાકો સુધી અર્ધ નિદ્રામાં ઘાયા કરે એમ ભાષાને ઘાવવામાં ઘણાં વર્ષો પસાર થયાં છે. છંદોને મેં જાતે શીખિશીખીને આત્મસાતુ કર્યા. પછી એ અક્ષરમેળ છંદોને અને માત્રામેળ છંદોને મોંમાં લઈને ચૂસાવામાં પણ કંઈ ઓછાં વર્ષો ગયાં નથી. એ છંદો ખરેખર સ્તનો હત્તાં કે ઘાવણી હતા ? ચૂસણી હતા ? મુખ્યત્વે ‘કુમાર’માં અને કંઈક ‘સંસ્કૃતિ’માં મારી છંદોમય રચનાઓ પ્રગટ થઈ છે. અર્લી સિક્સિટ્યુમાં ‘કુમાર’માં પ્રગટ થયેલી કાવ્યરચનાઓ માટે કુમાર ચન્દ્રક પણ મળેલો. કાવ્યગુરુ બચુભાઈ રાવત કહેતા મારાં કોઈ છંદોમય સર્જનો માટે (કચો છંદ મેં મુખ્યત્વે પ્રયોજ્યો છે ? ઇન્દ્રવજા ? ઉપેન્દ્રવજા ? મિશ્રોપજાતિ ? કંઈ ખબર નથી પડતી આજે, આ કાણો પણ એ કાવ્યો બધાં ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં છે.) કે લાભશંકર આ છંદ એક કાવિદાસે, બીજા સુન્દરમે અને નીજા તમે સુંદર રીતે પ્રયોજ્યો છે. અરે, પણ એ છંદોને હું ચૂસતો હતો, ચણળતો હતો તે તો બાળક લાકડાની કે આજે લાલાસ્ટિકની ઘાવણી ચણળે-ચૂસે રેમ. એમાં કોઈ ઘાવણની ધાર ન હતી. કૃતક હતી એ રચનાઓ. કુમારવયે, ડિશોરવયે હું કદી કોઈ વ્યક્તિના પ્રેમમાં પડ્યો નથી. નથી યુવાનવયે પ્રેમમાં પડ્યો. મને મનુષ્ય મનુષ્ય વચ્ચેના વિજાતીય કે સજાતીય પ્રેમનો, વ્યક્તિગત પ્રેમનો અનુભવ જ નથી. અને છતાં ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં પ્રેમકાવ્યો છે. એ પ્રેમની બધી જ રચનાઓ કાલ્પિત છે, કૃતક છે. નથી કોઈ વૈઘૂર વૃક્ષમાંથી ચાંદરણું પડજું કોઈ કુમારીના ભીના ભીના રક્ત કપોલની પરે. મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માંના ‘ચાંદરણું’ નામના પ્રથમ કાવ્ય પર બચુભાઈ રાવત પણ ખુશ થઈ ગયેલા અને કાવ્યગુરુ ઉમારાંકર પણ ખુશ થઈ ગયેલા. લગભગ સમાન મહિનાના અંકોમાં આ કાવ્ય ‘કુમાર’માં અને ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલું. ગુરુજી (ઉમારાંકર)એ એમના એમ.એ.માં ભણતા આ વિદ્યાર્થીનું ‘ચાંદરણું’ કાવ્ય વાંચીને ‘સંસ્કૃતિ’માં પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો હશે એ પછીના એકાદંબે દિવસમાં જ કોઈ સાહિત્યસભા પૂરી થયા બાદ મને જોઈને, મારી સાથે શેકહેંડ કરીને મને જે ઉષાથી ‘ચાંદરણું’ કાવ્ય માટે અભિનંદન આપેલાં તે યાદ આવે છે. છંદની અને કૃતક પ્રેમની, સર્વથા કાલ્પિત પ્રેમની ચૂસણી ચૂસતા લાભશંકરની એ કૃતક કાવ્યરચના. એનો અંત કેવો સેન્ટ્ઝેન્ટલ છે ? સર્વથા રૂગણ, સિક.

જો ક્યાંકથી આ કવિતા કદીયે  
વાંચે ભલા તો લઈ તું જજે હવે  
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા  
કુમારને જે દીઘ તેં) રૂપેશી  
લીનું લીનું ચાંદરણું...

છંદોનો, છંદોલયનો ‘રમ્યઘોષ’ છે; પણ ‘વહી જતો પાછળ.’ એ કાવ્યો મેં ‘રદ’ નથી

કર્યાં ભવે એ કૃતક રચનાઓ પ્રગટ થતી. એની ત્રીજી આવૃત્તિ પણ થશે. છપાઈને પડી છે. મારાં કાવ્યો વિશે મારા અભિપ્રાયની કોઈને જિજ્ઞાસા હોય તો તે મેં સંગ્રહના પ્રકાશન સાથે જ, એનું નામ પાડવામાં આપી દીધો છે. સંગ્રહના પ્રારંભમાં મૂકેલી પ્રાસ્તાવિક ગાંધીરચનામાં કહ્યું છે :

તો મરી ગયેલાં શરીરોની ઉચ્છ્વલ સુગંધનો સંગ્રહ  
ભવે પ્રકટ થતો.

પ્રથમ સંગ્રહમાં તિરાડોના સંકેતો પણ છે જ; એકાધિક સંકેતો છે. એક કાવ્યની અંતિમ પંક્તિઓ આ પ્રમાણે છે :

છો બબડતું બોર વેચે છે  
નગર પાંખું  
નગરની તૂટલી તિરાડ શી સડકો મહીં  
હું ફક્ત ડેવલ ગાઉં છું  
કાનને સંભળાય મારા  
એટલું ધીમેશથી હું ગાઉં છું  
ફક્ત ડેવલ ગાઉં છું.

‘તડકો’ કાવ્યમાં પણ મૂલ્યપરસ્ત સાંસ્કૃતિક શબ્દાર્થોમાં અનુભવેલી તિરાડોની અભિવ્યક્તિ છે.

નાગર તડકો  
વાનર તડકો  
ગાંધીજીની ઘલ તડકો

આ રચનાનો પ્રભાવક રીતિવિશેષ એનો ‘કટાવ’ કે કટાવ જેવો છંદોલય છે. પણ એ જ એની મર્યાદા છે. સર્જને સંમોહિત કરી, ટ્રાન્સમાં ગરક કરતો, એકધારો છંદોલય લાભશંકરની કાવ્યમૂર્ખી છે. આ primitive trance શબ્દાર્થ રૂપે, કાવ્યાર્થ રૂપે જે integration રચે છે તે માત્ર લય-સંમોહનમાં, લયકેફ્ફમાં અનુભવાતું ભાન્ત સત્ય છે. જે કલ્યાણોન્ય સત્ય રણકરું અનુભવાય છે ‘તડકો’ કાવ્યમાં તે માત્ર સંમોહિત કરતા લયનું સર્જન છે. તાપ્ય – તાપક / તપનાર – તપાવનાર અભિન્ન છે. આ હાઈપોથેસિસ લયનો કસુંબલ કેફ છે. મેટાફિલ્ઝિકલ શબ્દાર્થ સુધી છંદોલય લઈ જતો અનુભવાય છે પણ આખરે તો એનો અમલ ઊતરી જાય પછી કંઈ નથી. ખાલીખામ છે. ટ્રૂકમાં, લયસંમોહિત કૃતક કાવ્યાર્થ તે આ કાવ્યની અને લયના સંમોહનમાં સરકતાં મારાં બીજાં કાવ્યોની પણ મર્યાદા છે. દા.ત., ‘મારા નામને દરવાજે’ સંગ્રહમાં ૧૭મી કાવ્યરચનામાં કટાવ કે કટાવ જેવા છંદોલય પર, હથોટી બેસી જવાથી, સાવ ટાઇક મેટાફિલ્ઝિકલ હાઈપોથેસિસને લયની ગતિમાંથી ઉપસાવવાનો જે પ્રયત્ન

છે તેમાં હથોટી સિવાય બીજું કર્દી નથી. એમાં મેટાફિલ્કલ બેચેનીનો, આરતનો ભાવાભાસ છે. આવી કાવ્યભાસી રચનાઓ મારા સંગ્રહોમાં ઘડ્યી છે. ઉક્ત રચનાનો સેન્ટ્ઝેન્ટલ ભાવાભાસ સાંભળો :

મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો  
 રોધી મારો શાસ  
 અરે અવરોધી મારો નાશ બંગલો ખડો રહ્યો  
 શોધું છું ઘસડાતો મારો હાથ  
 હાથને રોકી રાખી  
 ખુલ્લી એક હેઠલી વચ્ચે  
 જાંખોપાંખો ઊર્જી બંગલો  
 ખડો રહ્યો.  
 શાને માટે ખડો રહ્યો ?  
 કોના માટે ખડો રહ્યો ?  
 મારા નામને દરવાજે  
 આ હું ખડો રહ્યો  
 લીતરના ભોગળ બંધ  
 અંધ હું ખડો રહ્યો  
 કલબલતો કલબલતો  
 પલપલ ખડો રહ્યો  
 મારા રામને દરવાજે  
 હરદમ ખડો રહ્યો  
 આલીશાનને દરવાજે  
 નરદમ ખડો રહ્યો  
 ઢળતી સાંજને દરવાજે  
 આકુલ ખડો રહ્યો  
 રમતી રાતને દરવાજે  
 વ્યાકુલ ખડો રહ્યો  
 આકુલવ્યાકુલ ખડો રહ્યો.

પ્રકાશનની દણિએ મારા અંતિમ કાવ્યસંગ્રહમાં (ટેળાં અવાજ ઘોઘાટ) ‘હેઠસો...હેઠસો’ નામની એક, એકધારી લયકારીની રચના છે. જોકે એમાં એકસુરીલા, મિકેનિકલ કર્મકાડણે, રિચ્યુઅલને અભિવ્યક્ત કરતા audible formal conception-માં મારો શ્રવણીય રસ છે. એવા કંઈક ઓછાં કે વધતાં audible functions એકસુરીલા અક્ષરમેળ અને માત્રમેળ

ઇંદોલયનાં હોઈ શકે. એ ઇંદોમાંના એકધારાપણાને નાનાવિધ, કહો કે અનંતવિધ audible forms કવિઓ આપતા હોય છે તે જાણું છું અને સ્વીકારું છું છતાં ઓવરઓલ એમાં એકસુરીવાપણું રહે છે. અંગત વાત કરવામાં જ રસ તેથી કહું છું કે audible tranceના શ્રવણીય લયએકમાં ગરક થઈ જતા લાભશંકરના કવિકર્મને નિર્મમ બનીને તપાસવાનો, એના કલબલ કલબલ કાવ્યકલકારા કે લયલલકારાના poetic formal functionsને ચૂંથીને જોવાનો અભિપ્રાય ધરાવું છું.

‘માણસની વાત’માં સમગ્ર લયમાં નહાનાલાલીય નહીં પણ ચોખ્ખી લાભશંકરીય મુદ્રા ઊઠે છે એવું ઉમાશંકરે નોંધ્યું છે અને સૂચવ્યું છે કે એ લયમુદ્રા પકડવી તે ‘માણસની વાત’ના આસ્વાદ માટે આવશ્યક છે. અક્ષરમેળ ઇંદોલયમાંથી ‘તડકા’ના કટાવ જેવા ઇંદમાં સરક્યો તે મારી એક અવાન્તર અને અનિવાર્ય એવી કાવ્યપ્રક્રિયા હતી. એમાં બાન્ત સંવાદિતાના તૂટતા શબ્દાર્થોનાં ચાક્ષુષ, સ્પર્શ, શ્રવણીય સંવેદનોને શબ્દલય ઉપસાવે છે.

તડકાના ટુકડાઓ.

જ્યારે

અસ્તવ્યસ્ત થઈ

આળોટે દરિયામાં

માછલીઓની

મૌઝીડોમાં

વાગે એની ધાર

થડ તડકાનું ખડબચું

ને માછલીઓનાં પાંદ

સાંઘકના જૂબે છે ઢગલો પંખીનાં ફળ કાચાં.

—એમાં, સંભળાતા શબ્દથી, સાવ વિપરીત અર્થ ઊપરી આવે એવા કાઢુનો વિનિયોગ છે. કોઈ પરંપરિત મૂલ્ય ટકી ન શકે તેવી તળેઉપર દશાના એમાં સંકેત છે. વાનર/નાગર/ગાંધી અભિન્ન અનુભવાતા હોય તેવી એમાંની ભાવદશા મારી કાવ્યગતિનું એક રસપ્રદ ભાવબિન્દુ છે. પણ કાવ્યનો સંમોહક લય તપ્ય-તપાક અભિન્ન છે તેવા એક હાઈપોથેસિસને ઉપસાવે છે અને કવિચેતના એમાં ગરક થતી, તદ્વાપ થતી ઊપરી આવે છે તે સર્વથા કૃતક છે. આવા લયસંમોહન અને કૃતક, બાન્ત સંવાદિતાના શબ્દાર્થને ચીરીને ઊપરી આવે છે ‘માણસની વાત’. લાભશંકરની કાવ્યપ્રક્રિયામાં ‘માણસની વાત’ એક મહત્વની ઘટના છે. હવે અહીં લય છે પણ એના એકધારા સાતત્યનું સંમોહન નથી. અહીં અક્ષરમેળ/માત્રામેળ લયો ઊપરી આવે છે, વહે છે અને ઓસરી જાય છે. અહીં લોકગીત અને બાળગીતના લયો છે તો એકાવિક/નાનાવિક ગદ્વાલયો છે. અહીં structure of statementsનો ભરચક્ક વિનિયોગ કરવાનું મેં સાહસ કર્યું છે. images

પણ સતત દદહચા કરે છે. અહીં સીધાં કથનો (statements) એવાં રચાયાં છે જે પરસ્પરને interpenetrate કરતાં હોય; એટલું જ નહિ, પરસ્પર વિરોધી કથનોના ઠંઠરપેનિટ્રેશનની પરિણતિ ન્યૂટ્રલાઇઝેશનમાં અનુભવાતી હોય એવી મારી કાવ્યદશા છે. આમું કાવ્ય મારે માટે કાવ્યાર્થલયનો મને સાંભળજો ગમે તેવો polyphonic અનુભવ છે. એમાં multiplicity of sounds, tones and meanings છે તેમ કહેવામાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય આ બધાના ઘોંઘાટ પછીની નીરવતા એ કાવ્યનું પરિણામ છે એમ કહેવામાં છે. આ નિખાલસ કેફ્ફિયતમાં મારે એમ પણ કહેવું છે કે ‘માણસની વાત’માં પહેલી વાર, વ્યાપમાં-વિસ્તારમાં, પરંપરાને આત્મસાત્ર કરતાં કરતાં માણસ અને માણસના સર્વ સંદર્ભો વિશે રચાયેલો મહેલ લાભશંકરની કાવ્યચેતનામાં તૂટી પડે છે. આ નિરાધાર, નીરવ શબ્દક્ષણોમાં સદીઓથી પ્રતિબિંબાત્મા મારા, એક માણસના ચહેરાને તાકીને જોવાની હામમાં એક કવિ તરીકેની મારી એવી સ્થિતિ છે જેમાં કોઈ તૃશુલત્ત આન્ત આધારની, સમાધાનની જરૂર વગર મનુષ્યની હ્યાતીના સંભવનો અનુભવ છે.

હવે સપનની લીસી ધાર અડે નહિ,  
આકાશથી ઝોરું મારા ગાલ પર પડે નહીં  
આમ જોકે પડે, પણ  
અડે નહીં.

કવિ હોવાનો કે થવાનો કે થયાનો  
આ ફીઝા ફીઝા કેફ  
નિરક્ષર રેફ મારું મન હવે.  
મારાં ચૂઝું ગયાં પોપચામાં મરણનો ભાર  
તે...ય મારે ઊંચકવો.

‘માણસની વાત’નો કવિ દિનરાત રાતદિન જિન્ન પણ નથી અને એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્રિલન્. કવિ પણ નથી. કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર કહેવા જેટલો આશાતંતુ પણ ‘માણસની વાત’-ના કવિ પાસે નથી. અહીં અક્ષરિયા પ્રેમનો નાતો તો નિચોવાઈ ગયો અરે, પણ આવો નાતો માત્ર ‘કટ્યિત’ છે. આવો કોઈ નાતો જ નથી એવા સાક્ષાત્કાર પછી ‘માણસની વાત’-ના કવિને એમ પણ, ઉમાશંકરની જેમ, હાશ-કાર અનુભવવો નથી કે હાશ, થોડાંક સ્વઘનો જરૂર ટકી શકશે સલામત હવે. ગમે તેટલી અને તેવી છિન્નબિન્નતાની કેફ્ફિયત કવિ આપતા હોય છત્યાં ઉમાશંકર dreamer છે. ‘માણસની વાત’નો કવિ dreamer નથી. આ કાવ્યમાં, ‘માણસની વાત’માં, એક habit સાવ તૂટી ગઈ છે. તે લાભશંકરના કાવ્યજીવનની નોંધપાત્ર ઘટના છે. The habit of hoping અહીં તૂટી પડી છે. He is facing the human condition. કવિને શબ્દમાં, શબ્દ વડે, શબ્દ રૂપે સ્વ-ના સકલ

સંદર્ભ રૂપે વિશ્વને યથાતથ, the world as it is જોવું છે. હવે passivity of illusion નથી..

‘માણસની વાત’ એ લાભશંકરની નિર્ભાન્તિનું polyphonic કાવ્ય છે તેમ કહેવાની સાથે લાભશંકરને એમ પણ કહેવું છે કે આ કાવ્ય હજુ ઘણું simple છે. એમાં સપાઠી પરના પડધાયાઓનું માત્ર જનરલાઈઝડ પ્રાકટ્ય છે. એમાં લયોની multiplicity છે તેમ કહેવાની સાથે મારે એમ પણ કહેવું છે કે તે વીશ આંગળીઓના વેદાથી ગણી શકાય તેવા છે અને તેટલા જ છે. માણસની વાત આટલી simple છે ? એનો સમગ્ર વાદુમયની સંકુલ લયગુંચોનો કેટલો અશસાર લિલાયો છે ‘માણસની વાત’માં ? નહીંવત્ત. તો પછી લાભશંકરની કાવ્યપ્રક્રિયાનો અંત નથી; what is dead end ? વાદ્ય-વાહક અભિનન્દ છે. છતાં જે ‘વાહક’ છે, ‘આધાર’ છે તે વાદ્યને, આધીયને કેમ વહી શકતો નથી, ધારણા કરી શકતો નથી તે લાભશંકરની ખોજનો વિષય બને છે. ‘મારા નામને દરવાજે’માં અને ‘બૂમ કાગળમાં કોરા’માં આ ખોજના નકશાઓ છે. ડોલ શાબ્દની કાળી રે / ઊંડા કૂવાનાં પાણી રે-ની નિખાલસ કેદ્ધિયત છે; તો હરખલેર દામજા બેંચે છે / લઘરો તાણી તાણી રે-માં self-parody છે. myth માત્ર ભયમૂલક છે / ભયજનક છે / ભયહર છે. મનુષ્યજ્ઞતિ myth-માં ફસાતી રહી છે. ‘લઘરા’ની myth રચનાર સર્જકની દૃદ્ધશાઓમાં તળોઉપર કરતા તબક્કાઓ છે તે વિશે ‘લઘરો’ સંગ્રહના પ્રાકૃકથનમાં વિગતે કહેવાયું છે. ‘થોળાં અવાજ ઘોંઘાટ’નાં એકાધિક કાવ્યો વિશે હું એકધારું લાંબું ઘણું કહી શકું તેમ હું પણ આખરે તો એવાં કથનો મારાં કાલ્પનિક જેમ માત્ર મૌનોલોજી અને સોવિલોક્ષિવ્ઝ રહેવાનાં છે તે હું જાણું છું. કોઈ વાતનું દુઃખ નથી તો આ વાતનું પણ મને દુઃખ નથી. કાવ્યની રમતમાં The other નથી. એટલે તો આખૂટ રસથી હું રમ્યા કરું છું. અવાજને ખોદી શકતો નથી ને ઊંચાકી શકાતું નથી મૌન. છતાં કાવ્યરમત અટકી નથી. ‘વાગીશ્વરીના નેત્રસરોવર’ જેવા કથનમાં વાગાડમબર છે અને ખોબોક પાણી પી જેવી ઉક્તિમાં ઊર્ભિલતા છે. મારી કાવ્યરચનાઓમાં સાત દોષો જોઈ શકનારાને સલામ; પણ કુલ એકસો ને સાત દોષો મેં એકલાએ એકાન્તમાં ગણ્યા છે અને તેથી જ તો ઓર ચાનક અનુભવી છે કાવ્યપ્રક્રિયામાંથી પસાર થવાની. મારાં એકાધિક કાવ્યો ખરેખર તો એક કવિની કાવ્યસર્જનન્યક્રિયાની સીધી કેદ્ધિયત જેવાં છે. આમ એ બેંચીએ જરાક જોરથી / તો ખચ્ચ બેંચાઈને આવે બહાર. એમાં મારી રચનારીતિના સીધા, પ્રત્યક્ષ ગ્રાહક્ષ છે. એમાં મારા બહેરા કાનો સુધી નથી પહોંચ્યો તેવો બોબડો બબડાટ છે. મનુષ્ય હોવાની આ વિસંગતિ છે. ભાષાની, ભાષકની, શ્રોતાની અભિનન્તા એ મારી ચેતનાનું વર્ણન છે. મારી આ ચેતનાની હાસ્યજનક કરુણ વિસંગતિ મને કાવ્યરચનાપ્રક્રિયા માટે વધુ ને વધુ પ્રેરે છે.

હા, તો ‘કાલાંશ્વિ’માં કોનોલોજિકલ ટાઇમના લસરકા અને સાયકોલોજિકલ ટાઇમના ઘસરકા સાંભળવા મેં બહેરા કાન માંડ્યા છે. એ બહેરા કાનને વ્યૂમરના પ્રાસમાં આકર્ષિમક

ટ્રૂમરનું દર્શન થયું છે. આ ‘આક્રિસ્મિક’ ઘટના, મારી કાવ્યપ્રક્રિયાનો, મને રોમાંચક અનુભવ કરાવે છે. હું બબડવા માંદું છું કાવ્યસર્જનના નામે અને કોઈ એક શબ્દક્ષણો કોક ખૂલ્લી જાય છે. ધડ ધડ ધડ મારા સકલ ચૈતસિક વાડુમયને અનિરુદ્ધ વહેવડાવતો. આ અનિરુદ્ધ ધડધડાતી મારી બધિર કર્ષા-ચેતનાને વાઈબ્રેશન્સનો અનુભવ કરાવે છે. કાન વગરનો બહેરો હું ચામીથી બધું સાંભળ્યું છું મોરપીછ રંગના ઊનના દડાથી આરંભાતો મારો બબડાટ ‘વનના તે મોરલા મારિયા’ આવતાં મારા ઊંડા બાધ્યિરમાં ખાબકે છે અને ‘અહિંસા પરમો ધર્મ’ના સત્તંભને હું લથડી પડતો સાંભળ્યું છું. છતાં મેં એક જ શબ્દ ખાધો નથી, અસંખ્ય શબ્દો ખાધા છે. બધા પચ્ચા વગરના પડયા છે મારી ચેતનાના ડોઝરમાં. અન-ઓસિમિલેટેડ, અન-ઓબસોર્ડ અપરિસંખ્યેય શબ્દસંપદાઓ કાઢવા હું કરાંજું છું. મારા આ પ્રવાહણનો લય, કરાંજવાનો લય મારી હ્યાતીની એક કરુણા અને હાસ્યજનક અનિવાર્યતા છે. રુચિ-સુરુચિ – મારી પાસે કોઈ norms નથી. સાચું કહું તો મને કેઈ કશાની પરવા નથી. અતિશય દારુ પીધેલાના વાચિકમુનો લય મારે સાંભળવો છે. ‘કલાગંથિ’ સંગહમાં ‘પુલના આ છેઠે’ નામના કાવ્યમાં કોંસમાં સૂચન લખ્યું છે : ‘દારુ પીધેલાના વાચિકમુ જેવી ‘મદાત્યય શૈલી’-માં પઠન કરવું.’ There is no communication. છતાં પુલના આ છેઠે માણસ બોલે છે, બબડે છે; દારુ પીને નશામાં લવરીએ ચઢે છે. અતિશય નશામાં, મદમાં, મદાત્યયમાં all cerebral controls શિથિલ થઈ જાય, inhibitions, taboos શિથિલ થઈ જાય અને માણસ લવારો કરે. એ લવારો મારો શબ્દાર્થ છે, મારો કાવ્યાર્થ છે. મદાત્યયમાં થતા લવારનો છંદોલય એ મારો નિજાનંદ છે. આ નિજાનંદ અટકવાનો નથી. મેં કદી કોઈ કાવ્યજ્ઞ ગુરુ ઘંટાલોની પરવા કરી નથી. મેં મારી પરવા પણ કરી નથી. અથવા સાવ ઉંઘા અર્થમાં કહેવું હોય તો મેં મારી જ પરવા કરી છે. નોંનકાય વોકલિક સાઉન્ડાઝથી જે શ્રવણચેતના મારી, મને સાંભળી રહી છે તે કોઈ choice પાસે હજુ અટકી નથી. પોતાના જ વાડુમય અવાજો, એ સાંભળે છે રસપૂર્વક, ધ્યાનપૂર્વક without choice. હું જ મારો ગુરુ ઘંટાલ છું. ગુરુ-શિષ્ય અભિન્ન છે. આ અભિન્ન ચેતના રાચે છે કાવ્યપ્રક્રિયામાં. ઊત્તરે છે કાગળ પર તેનાથી અનેકગણા વાડુમય છંદોલયો વહી જાય છે. સાંજ તો ક્યારનીય ફળી ગઈ છે. રાત પણ પડી છે. ઊત્તરતી રાત્રિના સમયે, ચાલતી કારમાં, મારો દૈહિક પ્રત્યુષ ગાઈ રહ્યો છે. વાણી છે. લયનો કેફ છે. અઢી વર્ષનો પ્રત્યુષ શીદ્ધ શબ્દપંક્તિઓ સરજીને ગાઈ રહ્યો છે ચક્કચૂર. એ પરિવાર વચ્ચે છે. પાકી સડક પરથી વાહનમાં પસાર થઈ રહ્યો છે, નગરમાં છે, માનવસમૂહમાં છે, આકાશ નીચે પૃથ્વી પર છે. પણ છતાં એ નિજમાં છે. નિજમાંથી જ વાણીમાં, વાણી રૂપે લયામૃત પ્રગટ થાય છે. પોતે જ સર્જક અને પોતે જ શ્રોતા છે. સર્જક-સર્જન-ભાવક-ભાવક અભિન્ન છે, ઇનસેપરેબલ છે.

કાવ્યકીડા મને ગમે છે. આઈ લવ ઈટ, પોશનિટલી. કાવ્યેષુ નાટકમુ રમ્યમુની લીલા પણ મને ખેંચે છે. નિબંધો લખ્યું છું લલિત ત્યારે કે ‘બાપા વિશે’ બાયોગ્રાફિકલ formના

ઢાંચાઓને તોડતો-અખડાવતો-રણકાવતો ગવધમાં રમું છું ત્યારે હું માત્ર રમું છું. મારે કબૂલ કરવું જોઈએ કે એમ રમતાં રમતાં ટૂટા પદ્ય/ગવધમાં, ખખડતા પદ્ય/ગવધમાં, રણકતા પદ્ય/ગવધમાં, મને દેખાય છે ટુકડા ટુકડામાં, છિન્, નોન-ઈન્ડિગ્રેટેડ, ઘસાઈ ગયેલું કોઈ રૂપ. સંભવ છે એ મારું રૂપ હોય. એ તૂટાં-અખડતાં-રણકતાં છિન્ રૂપોના શ્રવણીય પડહાયામાં, મારા બહેરા કાનોને, સંભવ છે દેખાય છે/સંભળાય છે મારું અને માનવજતનું શૈશવ. મારા વાડુમયના zig-zag (ઝિગઝેગ) સોતોમય પ્રવાહમાં મારું વિસ્મય અકંધ વહી રહ્યું છે. લાભશંકરના દેહાત સાથે લાભશંકરના કાવ્યકૃતૂહલનો અંત હશે. આજે તો હું પદ્ય/ગવધમાં પ્રવાહિત છું. અટકવાની નથી આ કલમ. પદ્ય/ગવધમાં એકાધિક સ્વરૂપોને તોડતો-અખડતો-કુટાતો હું વચ્ચા કરીશ. આમ છે આ ક્ષાણ સુધી. So there is no end. There is no dead end. કવિ એટલે જે જાણે છે. He who knows. હું કવિ છું અને જાણું છું. હું કશું જાણતો નથી તેટલું જાણું છું. સ્વ-ના રહસ્યમય ગૂઠ અંધકારના કાંઠે, આદિ-મધ્ય-અંતના ઘસાતા અને લુચન થતા અવાજો વર્ચેની નીરખ પળોમાં આ રહસ્યમય, ગૂઠ અંધકારને મારી બધિર થતી જતી શ્રવણચેતનાથી ચાઢું છું. આ કેફિયતનું નિવેદન પણ મારો ચાટવાનો અવાજ છે. અટકીને જોઈ રહ્યો છું સામે રહસ્યમય ગૂઠ અંધકારને. અરે ! પણ આ બબ્બ અવાજ શેનો થયો ? મારામાં જ ઉંડે ડોલ પછાઈ, દૂબી અને અંધારું ભરીને ઊંચકાઈ રહી છે ખચ ખચ ઊંચે ? યેસ, સમર્થિંગ લાઈક વીટ, લેટ મી હિયર.

(તા. ૧૭-૧૦-૧૯૮૧)

[ગુજરાતી સાહિત્ય પરિષદ : કોઈમાતુર : ૧૯૮૧માં  
આપેલું વ્યાખ્યાન]

18

## સાભાર સ્વીકાર

### નાટ્યસંગ્રહ

(૪૮) રંગના ઓલારે : ડૉ. રક્ષા પ્ર. દવે, ૨૦૧૫, લેખક પોતે : 'પ્રહલાદકુ બંગલો, મંગલા માતાના મંદિર સામે, પ્લોટ નં. ૧૧૦૧, B-૨-D, અંબાવાડી, ભાવનગર, પૃ. ૮૧૮૨, રૂ. ૩૦૦

### કવિતા

(૪૯) અસીમની કવિતા : અસીમ પીઠવા, બીજી આ. ૨૦૧૫, પાશ્ચ પબ્લિકેશન, અમદાવાદ, પૃ. ૧૧૮, રૂ. ૧૦૦ (૮૪/૧) અમેરિકા, અમેરિકા : નાટવર ગાંધી, સંપા. : ધીરુ પરીખ, ઇમેજ પબ્લિકેશન (મુંબઈ/અમદાવાદ) પૃ. ૧૨૦, રૂ. ૧૫૦

૧

સેહ વિનાની સત્તાખોરીના આ સમયમાં લાભશંકર ઠાકર જેવા હેતુભર્યા બહારવટિયાની આખરી વિદ્યાય કેવી વસમી અને કપરી છે, એ કેવી રીતે કહેણું ? એક વ્યક્તિ જ નહીં, એક વિચાર અને એક વિશ્વ વિધાનિ થઈ ગયું. વહાલ, વિદોહ અને વાણીના અજોડ મરોડનું એક વિશ્વ અવસાન પામ્યું.

જોકે, ઊગતી જુવાનીમાં જ્યારે એમને મળવાનું થતું, (૧૯૬૦-ના દશકમાં એ મુંબઈ આવે ત્યારે હોટેલ કુમકુમ નામની, નાનકડી અને ચોપાણી જગ્યાએ, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પાસે એમનો ઉતારો હોય. આદિલ, ચિનુ, મનહર, સુભાષ, રાજેન્દ્ર લેગા હોય. ને મળવાનું થાય, બિલકુલ ડાયોનિસિઆક માહોલમાં), ત્યારે મદહોશીમાં લાગતું કે આ પડછંદ માણસ, નામે લાંડાં નક્કી અજરામર હશે. હમણાં એમના અવસાન પછી, એમની શોકસભામાં એમનો ફોટો જોયો. ફોટોની ફેમ અને ઢગલો ફૂલો અને ગમગીન, મૂળી સભા, એ બધા પુરાવા સહુની સામે હતા કે લાભશંકર ઠાકર મૃત્યુ પામ્યા હતા. પણ સાવ સરૂરિયલ રીતે, છેક ઓઝર્ડ ઢબે, તત્કષણ મને સમજાયું કે ના, પેલી ૧૯૬૦વાળી વાત સાચી હતી, એ પડછંદ કવિ બેશક અજરામર છે. સામે, ફેમ-ફૂલો-ગમગીની અને મૂળાશને અવગણીને લાભશંકરે પણ તત્કષણ સામું કહ્યું કે સિતાંશુ, તમારી વાત એક રીતે સાચી છે, મને એમાં રસ પડે છે.

સરૂરિયલ અને ઓઝર્ડ તો ખરી, પણ મારી એ પ્રતીતિ પ્રમાણશુદ્ધ પણ છે. પ્રમાણ કે સાબિતી તે લાંડાંની ૧૮૫૫થી ૨૦૧૫ સુધી પથરાઈને પડેલો, એપોલોની જેમ, થોડી બેદરકારીથી, થોડા તોરથી, આરામ સે લંબાવીને પડેલો એમનો પરમ સૌષ્ઠવ અને શક્તિથી સભર્યો, સનાયુબદ્ધ, પડછંદ કવિશાંદ. ‘વહી જતી પાછળ રમ્યાંદોણ’ (૧૯૬૫)નો આધુનિક-પૂર્વ પ્રીમોડન્) મરોડ, માણસની વાત (૧૯૬૮)થી સમય (૨૦૦૦) સુધીનો આધુનિક (મોડન್) મરોડ અને ‘હથિયાર વગરનો ઘા’ (૨૦૦૦)થી લઈને, ‘બડો છે. કલ્યો’ (૨૦૦૪) પછી વિશેષપણે, એમનાં તે પછીનાં પુસ્તકોમાં અને સામનીકોમાં છાપાયેલાં વિવિધ પદ્ય-ગાંધી લખાણોમાં પ્રબળતાથી આવતો અનુ-આધુનિક (પોસ્ટ મોડન્) મરોડ : એમ લાલિત-બલિષ્ટ નિભંગે એમની અજોડ સર્જકતાની કાયા, પથરાઈને પડી છે. અજરામર.

ગુજરાત એમને અનેક રીતે યાદ કરતું રહેશે : બળકટપણે પ્રયોગશીલ હોવા છતાં સ્મરણીય પદાવલી રચી આપતા અને સંમોહક કાલ્યપાઠ કરી શકતા કવિ તરીકે; રંગભૂમિને નજીકથી ઓળખનાર છતાં એ જ રંગભૂમિને તરત ઓળખી ન શકાય એવી બનાવી શકતા નાટ્યલેખક તરીકે; ચરિત્રનાયકને ખૂબ ચાહતા હોવા છતાં એનાથી (નાયક પોતાના પિતા હોય

કે ગાંધી તોયે) તરસ્થ થઈ શકતા ચરિત્રલેખક રૂપે, સમકાળીન માનવીય પરિસ્થિતિ સામે ગાઢી નિસ્બત ધરાવતા છતાં કોઈ રાજકીય કે બીજી માન્યતા સાથે કદી ન બંધાનાર વિચારક રૂપે, અને રે મઠ અને ‘આકંઠ સાબરમતી’ જેવી આકર્ષી શરતોવાળી છતાં પૂરી ખુલ્લાશવાળી કવિતા અને નાટકની પ્રવૃત્તિઓના પ્રણેતા ગણીને – એમ અનેક ઓળખ (અને વારંવાર થતો ઓળખભંગ) લાંઠાં સાથે જોડાયેલાં રહેશે. એમને વોલ્ લિટ્ટ્ટમનની એક પંક્તિ ઘણી ગમતી. ‘કુ આઈ કોન્ટ્રાડિક્ટ માયસેલ્ફ ? – વેલ, આઈ કન્ટેઇન મલિટિટ્યુડ્ઝન.’ પોતાની અંદર મલિટિટ્યુડ્ઝને, ગંજાવર બહુલતાને સમાવી શકે એવી બહોળી અને ઊંડી ખુલ્લાશ ધરાવનાર બીજો હવે કયાં ગોતવો ગુજરાતમાં ?

આચાસન એટલું કે લાંઠાં સાચે જ અજરામર છે; ના, ના, કોઈ મદહોશીની વાત નથી આ, ગઈ કાલની વાત નથી. આવતી કાલની વાત છે, આ.

## ૨

ઉપર એમને વહાલસોયા વિદ્રોહી કથા. કોઈ પૂછશો : ‘બહારવટિયા’ તો એક રીતે બરાબર. પણ હેત ? અને લાભશંકર ?? છો પૂછો. લાંઠાં પણ કયાં સતત સવાલો નહોતા કરતા, જીવન અંગે, ભાષા અંગે, કવિતા બાબત, બાપા વિશે, બકો થઈને ગાંધીને પણ. તો પણી એમને વિશે પણ કોઈ પૂછે કે લાંઠાં. અને હેત ? ‘પ્રવાહણ’ (૧૯૮૬)-ના કવિ એ કાંઈ પોત્તિબ હોય ? ‘મરી જવાની મજા’ (૧૯૭૭)ના નાટ્યકારની જીવનાભિમુહ્યતા ?? – જવ જવ !! પણ નથી જવાના. એની જ તો વાત ચાલે છે, આજે આ. આજ અડધી સદીથી. લોવુપ લોકપ્રિયતાના લબાચાઓથી આપણાં પ્લેટફોર્મો છવાઈ ગયાં છે, છતાં, ફલાણા અને પ્લેટફોર્મ તો આપે છે, એમ લોવુપો કહે છે ને ત્યાં પડ્યા-પાથર્ય રહે છે. છતાં અડીખમ કવિતાની ગતિભરી આગગાડીઓ આવ્યા જ કરે છે આપણા ગામે, રોકાય છે, આગળ જાય છે. આધેનાં નજીક લાવતી, ઘરકૂકીઓને પ્રવાસે મોકલતી, એ અટકતી નથી. એ અટકવાની નથી. લબાચાઓ ત્યાંના ત્યાં પડ્યા રહે છે.

લાંઠાં અને જીવનોલ્લાસ ? – કોઈ પૂછો. યાદ આવે કે ક. મા. મુનશીના એક તબક્કાના દસ્તિકોણથી મધ્યકાળીન ગુજરાતી ભક્તિકવિતા કેવળ પરલોકપ્રેમી અને જિવાતા જીવનનું કર્યારિયું કરી નાખનારી જણાઈ હતી, અખા જેવા જ્ઞાનવૈરાગ્યને ગાતા કવિઓ પરલોકના પયાંબરો જેવા લાગતા હતા, મહાપ્રાણ મુનશી તો એ તબક્કો વટાવીને આગળ વધ્યા. પણ આજે ઘણા વખતથી કેટલાક લોકોના દસ્તિકોણથી લાભશંકર ઠાકરની કૃતિઓમાં કશું પોત્તિબ નથી, કોઈ સાર્થકતા, કાવ્યાત્મકતા, કશું સમજાય તેવું, જરી હેતપ્રીત, માયામત્તા જેવી લાગણીઓ, કાંઈ ન જરે. એ તો કશીક ઔભ્યાર્ડ બેઝ્સર્ટની નેગેટિવ વાતો અછાંદસમાં કર્યા કરે છે, એઓ કહેવાના : હા, વિદ્રોહી ખરા, પણ લાંઠાં. અને પોત્તિબ, સમજાય તેવી, કલાત્મક લાગણીઓ ? – ના ભાઈ.

આવું કહેનારાઓ મને ન્યૂયોર્કમાં ગ્રેહાઉન્ડ બસના એક બસ-સ્ટેશન ઉપર દેખાયેલા.

ઇ ફૂટ બે-ત્રાણ દુંચ ઊંચા અને અંદાજે છઘન વત્તા ત્રાણ-ચાર અર્થાંત્ર સાઠેક દુંચની છતીવળા એક આવિધ અમેરિકનની આછી આહી યાદ અપાવે છે. એમણે પહેરેલા ટીશર્ટની પાછળ અંગ્રેજમાં મોટા અક્ષરે છાયું હતું : ‘આઈ લવ માય ચિલ્ડ્રન.’ એને એમ હરો કે જાહેરમાં અને મોટા અક્ષરે જો એ જ્ઞાવે નહીં તો અમેરિકન લોકોને જાણ નહીં થાય કે હી લઙ્ગ ડિઝ ચિલ્ડ્રન, પોઝિટિવલી. લાંડાની કવિતામાં (કે અંગત વ્યવહારમાં) સ્નેહ વિશે મોટે અક્ષરે કે ઊંચે અવાજે કશું કહેવાયું નથી, એટલે એમને અંગે ઓબ્સર્વ બેબ્સર્વ નેગેટિવ અને અછાંડસવાળી વાત કોઈ કરે એ સમજી શકાય. બેન્ડવાળના બરાદાથી ટેવાયેલા કાન, પ્રિયજનની આછી-આછી બોલછાને પકડી ન શકે, એ આજના ગુજરાતી સાહિત્યની એક કમનસીબ કમી છે. આ અમેરિકી-ગુજરાતી અ-ગોચરતાનો એક જ ઉપાય છે : ગુજરાતમાં વધારે સંખ્યામાં સારા ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટો, કાશ ! ઉપલબ્ધ કરાવવા. આંખ, કાન અને નાકની કવિતા જ નહીં, એનું પ્રભાવક વિવેચન કરી શકતા વિવેચક, તે આપણા આ ઈ.એન.ટી. સર્જનો. બેન્ડવાળના તો વિખ્યાત છે.

પેલા ગ્રે હાઉન્ડવાળો અમેરિકન પે'લવાન પોતાનાં બાળકોને સ્નેહ કરતો હશે, એ વાતની સર્વાઈચ ઉપર શક કરવાનાં કોઈ કારણ નહોતાં. પણ ટી-શર્ટ વાચન બાદ મારા ચહેરા ઉપર એક બાળસહજ સિમિત અનાયાસ આવી ગયું, પેલો જોઈ ગયો, ને મારી સામે મંડાયેલી એની દાહક દસ્તિએ પે'લવાનની પોલ ખોલી નાખી – જેમ સંપ્રત ગુજરાતી સાહિત્યમાં ! પણ મુદ્રો એ નહોતો, ન ત્યારે, ન આજ. મને જે સવાલ થયોંતો ને થાય છે, એ તો એ કે એઝે ને આપણે પોતાની અંગત વાત આટલી જાહેર રીતે કેમ કરવી પડતી હશે ? સ્નેહ હોય, એના સમાચાર છાપવાના ? મનની વાત આટલે મોટેથી કરવાની ? આ કેવા સમયમાં, કેવી સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ, કે કિશોર-કિશોરીએ પહેલી પ્રાણ્ય-જોઈ પણ, કોઈ ડિસ્કોના ઘોંઘાટ વચ્ચે, બે બહેરા વાત કરતા હોય એવા મોટા અવાજે કરવી પડે ? આવી તે કેવી માણસ-માણસ વચ્ચેની વાત, જે આટલે ઊંચે અવાજે જ કરવી પડે ? આવી બહુ બોલકી કેમ થઈ ગઈ આપણી જુબાન યાને કિ ભાષા અર્થાંત્ર અવાજ ? આ અને આવા સવાલો લાભસંકર આજીવન કરતા રહ્યા અને પૂછતા રહ્યા કે કેમ, આજે માણસ માણસ વચ્ચે ખડકાઈ ગયેલા, રસ્તો રોકીને પડેલા ‘અવાજને’, ‘મારા વિખ્યાખોર મિત્રો,’ આમ, ‘ઓદી શકતો નથી...’

### ૩

પણ ‘ઊંચું શકતું નથી મૌન’. માણસે ધીમેથી વાત કરવી છે માણસ સાથે, પણ થઈ નથી શકતી. ઘોંઘાટમાં સંભળાતી નથી. ને વાત કર્યા વિના રહી શકતું નથી. મૌન ઊંચું શકતું નથી. એટલે અવાજ ઊંચકાય છે ને ઘોંઘાટનો ભાગ બની જાય છે.

કશુંક થયું છે, આજે, અહીં, આપણને, જેથી સ્નેહનો ધીમેથી બોલાતો શર્દું અશક્ય બન્યો છે, આપણે એકબીજા સાથે માઈકોફોન વગર વાતો નથી કરી શકતા. ચારે તરફ

લાઉડસ્પીકરો ગોઠવવાં પડ્યાં છે : મંહિરને ધૂમટે, મસ્જિદને ભિનારે, વરધોડાની આગળ અને ચુંટણીની ભાડૂતી સભામાં તો આંક ન પહોંચે ત્યાં સુધી સેંકડો ભૂંગળાં, ને મંચની ચોકરે કરડા કમાન્ડો જ કમાન્ડો હોય. ઘરની અંદર ધૂસેલા ટીવી પર ચોવીસ કલાકની ઘાંઠાંટ; ‘ઓન ગો અવે, ભાય ડાર્લિંગ કન્જ્યુમર, ટિલ આઈ ફ્લીસ યુ.’) ડિસ્કોની કોલાહલબરી ભીડમાં લબકારા લેતા અજવાળામાં જન્મેલા સંબંધો મેળા મોલના અફાટ વિસ્તારોમાં કેવા ભૂલા પડી જાય છે, એની જાણ આપણને થતી જાય છે. એકમેક સાથે શાંતિથી મનની વાત કરવાની અંગત જીવાળામાં કોકે સંચારબંધી જાહેર કરી દીધી છે. અથવા તો કોક કથાનું ભાવ આચોજન કર્યું છે કે કોક ચર્ચ કે મદરેસો ખોલ્યો છે. પરાત્પર સાથે, આડતિયા-મારફતિયા દ્વારા અંગત વાત કરો. પડોશી સાથે પ્રત્યક્ષ પોતાની વાત નહીં.

ઉમાશંકર ગંભીરતાથી કહે છે : ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં.’ લાભશંકર અલગ રીતે જાત પર હસ્તીને કહે છે : ‘ઢેલ શબ્દની કાણી રે / ઊંડાં કૂવાનાં પાણી રે / હરખભેર લઘરો તાજો છે દામણ તાણી તાણી રે.’ લઘરો હરખભેર કૂવાનું દોરંડું ખેંચે છે, પણ ભૂલી ગયો છે કે ઢેલ કાણી છે. લાંઠાના ૧૮૭૪માં પ્રકાશિત કાવ્યસંગ્રહનું નામ છે : ‘બૂમ કાગળમાં કોરા.’ બૂમ પાડવી પડે છે, કાવ્યબાનીએ. ઇતાં કાગળ કોરો રહી જાય છે. એલન ગિન્ઝર્ગનો કાવ્યસંગ્રહ ‘હાઉલ’ (૧૮૫૬) યાદ આવે. મહેન્દ્ર જોશીનું ‘ચિત્કાર’ નાટક યાદ આવે. લાંઠાના શેની વાત કરે છે ? માણસની વાત, શબ્દોની વાત : ‘શબ્દોના અજગરની કરતો વાત / ચળકતા / શબ્દોના ચિત્તાની કરતો વાત / લપકતા / શબ્દોની હિંસા / શબ્દોનો પ્રેમ.’ હિંસાથી પ્રેમ સુધી પહોંચવું છે, પણ માણસના અવાજને ચળકતા અજગર અને લપકતા ચિત્તાના રૂપમાંથી ‘માણસની વાત’ કરી શકતા શબ્દમાં કઈ રીતે રૂપાંતરિત કરવો ?

લાભશંકર આપણા લંબાયેલા હાથમાં જવાબો પકડાવી દેતા કથાકાર નથી, એ તો જે ચાહે તેને સવાલો સાંપડે, એવી કવિતાના કવિ, એવાં નાટકોના લેખક, એવાં ચરિત્રોના ચરિત્રલેખક છે. લાભુભાઈના બાપા અને બકાના બાપુ, લાંઠાના સવાલોની સરજત છે, જવાબો જવાવતા જમાદારો નથી.

એટલે તો ‘ટોળાં, અવાજ, ઘોંઘાટ’ (૧૮૮૦) વરચ્ચે આ કવિ કહી શકે છે : ‘મારા પ્રશ્નોનો જવાબ નથી / અમિતાભ બર્યાની બેનમૂન અદાકારીમાં. / કે પોંગા પંડિતમાં. મારા પ્રશ્નોનો જવાબ નથી / લોકસાહયક દ્રસ્તમાં કે વરસાદી આગાહીમાં / .... / અને ઉત્તર નથી મળતો મને / ટેલિવિઝન સેટોને આબકારી જકાતમાંથી મુક્તિ મળવાથી.’ (ટોળાં. પા. ૪૮.)

હું કોઈ સવાલના જવાબ દેવામાં નિષ્ણાત બની ગયેલા આપણા સમયના અધિષ્ઠાતાઓને આવો કવિ શા ખપનો ? સામી તરફ, જુના જવાબોના દૂચા જેમના મોંમાં ખોસી દેવામાં આવ્યા છે, એવી પ્રજાને આવા કવિ વિના કેમ ચાલે ? પ્રજાની (ન કે ઉપભોક્તાની) આ પહેલી અને આખરી જરૂરિયાત લાંઠાની કવિતાને અમરતા આપે છે અને આ નવી સરીમાં પણ પ્રસ્તુત બનાવે છે.

લાભશંકર ઠાકરની કવિ, નાટ્યકાર અને ચિત્રલેખક-કથાલેખક દેખે આજીવન વરતાતી પ્રબળ લગનીઓ કઈ ? આવી એમની લગનીઓ, ડ્રાઇલ કે ધક્કાઓ, કદાચ આ ત્રણ હોય :

૧. સંસ્કૃતિની આખીયે સંરચનાના વાણામાં રહેવી (મશરૂવાળા - ઊ. જો. - દર્શકપરંપરાના શ્રેય-પ્રેય-દૈતમૂલક ચિંતકોની નજરે જે ન ચડે, તેવી) ખામીઓ અને આદેશાત્મકતા અંગેનો લાંઠાંનો કિટિકલ નજરીયો.
૨. વ્યવસ્થાઓ, સંરચનાઓ, શ્રદ્ધાઓ, ટેવો વહેરે માટે ('બદ્રાર્થન' અને 'એક મુરખને' હતી તેવી ટેવો અંગે અખાની હતી તેવી) ઉપહાસ-વૃત્તિ.
૩. નરી અને નરવી એટલે કે નિષ્પયોજન કીડાવૃત્તિ. ઔન્ટોલોજિકલ, એપિસ્ટેમોલોજિકલ અને વિન્ઝિસ્ટિક પેન્કુલનેસ, અસ્ટિત્વ, શાન અને ભાષા સાથે નિરંતર અને નિષ્પયોજન રમતો રમ્યા કરવાની વૃત્તિ.

લાંઠાંની આ ત્રણે લગની 'માણસની વાત', 'પ્રવાહણ', 'લઘરો'નાં કાલ્યોમાં અને 'વૃક્ષ' અને 'મરી જવાની મજા' જેવાં નાટકોમાં અને 'બડો છે કલ્યો'ની ચિત્રિત કથામાં નિરંતર પ્રગટતી રહી છે. 'જીવન કા પ્રયોજન' નામની કવિતા ('લઘરો, પા. તડ)ાં આત્મતુષ્ટ રાખ્યાબાણ છિન્દીને આવા ગંભીરતાથી કરવાના માધ્યમ રૂપે આ કવિ રસૂજીથી વાપરે છે. ગુરુ લઘરો સૂર્યાસ્ત સમયે બુલ્લામાં મળ-વિસર્જન કરવા બેઠો છે. એ વિશિષ્ટ સંયોગોમાં 'ઉત્સર્ગલીન લઘરાને શિષ્ય સમુદ્દ્રે પૂછ્યું : / 'કુછ પ્રયોજન નહીં હૈ જીવન કા, ગુરુ ?' , 'હે બચ્ચે / દુ વાઈપ વિથ લેફ્ટ હેન્ડ / એન્ડ દુ ઇટ વિથ રાઈટ', એ ગુરુજીનો અંગેજમાં ઉત્તર હતો. જીવનબ્યવસ્થા અંગેના અન્ય ઉત્તરો આ જવાબથી આજા સાચા નાયે હોય, એવો મરમ આ મરમી સાંઈ કવિ સૂચવતા હશે કે કેમ, એ દરેક સુજ્ઞ વાચક સોચ્યું રહ્યું.

સંસ્કૃતિના ધજાગરાને પડકારનારા લેખકો-કર્મશિલ ઘણા છે. એમનુંયે કામ છે. પણ સંસ્કૃતિમાં ધજાતોરણની, ગોખજરુખાની ટીકા આગળ ન અટકતાં, એના પાયામાં રહેલી મુશકેલીઓને, ત્યાંથી આવતાં માણસાઈ, સ્વતંત્રતા અને સમાનતાને વિધાતક એવાં ગૃહીતોને ઓળખનાર, પડકારનાર, ન સ્વીકારનાર કવિ-નાટ્યકાર તો વિરલ હોય છે. લાભશંકર ઠાકર એવા વિદ્રોહી કવિ-નાટ્યકાર-ગવંદીકાર હતા. સંસ્કૃતિનાં એવાં ગૃહીતોને ઓળખી લેનાર-પડકારનાર ને જીવન-વિરોધી કહેનારની નાદાનીનું શું કરચું ? 'કૃતિ, સંસ્કૃતિ નહીં' એવી ઘોષણા લાંઠાં, અને મિત્રોના લઘુ-સામયિક 'કૃતિ'ના પૂંઠા પર છાપાતી. મૂળ વાત માણસની છે, એ 'માણસની વાત' (૧૮૬૮)થી સૂચવતી ચાલી છે. 'દીપકના બે દીકરા / કાજળ ને અજવાશ' - એ પરંપરામંથી તરતી આવતી પંજિતાઓને લાભશંકરે પોતાના આ દીર્ઘ કાવ્યની શરૂઆતમાં સમાવી લીધી છે. લાભશંકર આપણને સંસ્કૃતિની એ વિકલ્પ-પરંપરા સાથે જોડે છે. એમાં માત્ર પ્રકાશનો, 'આલોકનો, મૂલ્યનો મહિમા નથી. ઉમાશંકર અને દર્શકની ધારાથી લાભશંકર અહીં ઊંડાણપૂર્વક અલગ પડે છે. એ બે, ગાંધી અને મશરૂવાળાની જેમ, શ્રેયાર્થની સાધના

કરનારા છે. નિત્યની જેમ ‘બિયોન્ડ ગુડ એન્ડ ઈવિલ’-ની ભૂમિકા એમની નથી. લાભશંકર માટે દીપકના બંને દીકરા, અજવાશ અને કાજળ, સરખા છે, સ્વીકાર્ય છે. ‘તહકો’ મારું પ્રિય (કંઠસ્થ) કાબ્ય છે. એમાં લાભશંકર કહે છે : ‘જાણો છો, આ સાચ જૂઠને સંભોગે છે / ને અંધકારની યોનિમાંથી સરકે છે આ તડકો ?’ હિટવરને પણ માનવ-સ્ત્રીનાં જઘનો વચ્ચે જન્મ લેતો જોનાર આ કવિ પાસ્કલની જેમ કહેવાના કે ‘નથિંગ ધેટ ઈજ હ્યૂમન ઈજ એલિયન ટુ મી.’ – માણસાઈનું એકે પાસું લાંઠાને મન પણ પરાયું નહોતું.

‘રમત ?’ (૨૦૦૩) એ કાબ્યસંગ્રહમાં લાંઠાની અહીં ત્રીજી ગણેલી લગની, એપિસ્ટેમોલોજિક અને લિન્ગ્વસ્ટિક લેફ્લુનેસ, પાને પાને પ્રગટ થાય છે. પૂંઠા ઉપર પણ : પ્રશ્નાર્થ રૂપે. આ સંગ્રહનું શીર્ષક પોતે એક સવાલ રૂપે આવે છે. અને એ સવાલ પોતાની જ એક પ્રબળ લગની અંગે છે : ‘રમત ?’ કવિ પૂછ્યે છે : ‘હું / છે / તેથી / રમત / છે ? / અને રમત છે / તેથી / હું / છે ?’ (પા. ૨૭). સવાલ કરે છે, જવાબ નથી આપતા. વળી જુઓ કે ‘હું છું’ એમ નહીં પણ ‘હું છે’ એમ વાક્યરચના છે.

ને આ રચના તો માર્કર્સવાદીઓ અને ગાંધીવાદીઓને એકસાથે ગમી જાય તેવી (અતાં કદાચ કંઈક ત્રીજું જ સૂચયવતી) રચના છે : ‘સંચયની રમત રમાય છે / ચોરીની રમત માટે ? / સંચય છે તો ચોર-પોલીસની રમત છે ? / રમતમાં / ચોર / પોલીસ પણ હોય / અને / પોલીસ / ચોર પણ હોય ?’ (પા. ૪૦).

સામે છેઠે જગ્ઞાતો લાંઠાનો કાબ્યસંગ્રહ છે : ‘મેં કમિટ કર્યું છે શું ?’ (૨૦૦૪). લાંઠાં લખે છે : ‘અને જુખી થયેલો વાધ ધસતી વખતે / શિકારના / ભાલાને / ગણકારતો નથી તેમ મેં / કોઈ પણ વિધાતક પ્રતિકારને ગણકાર્યો નથી – / એ જાણવા / કે શું છે મારો જવાબ.’ રૂઢ પ્રતિબદ્ધ સાહિત્યના જે જવાબો હોય (કંઈ રાજકીય કે ધાર્મિક વિચારસરણીને એ પ્રતિબદ્ધ છે, એ મુજબનો), એવો જવાબ આ કવિનો નથી. એ કહે છે : ‘ધાતકી થવું સહેલું છે, સર / પોતાનો ઘાત કરવો સહેલો નથી.’ પછીની પંક્તિ આ કવિને સમજવામાં સહાય કરે તેવી છે : ‘મેં / સતત મને ઉન્મૂલ કરી / ખોદ્યો છે / ધખનામાં ઉત્કટ / જવાબની.’

સાચો સેમિઓટિક્શિયન (સંકેતવિજ્ઞાની) સંકેતકોની આગળ સંકેતિત તરફ સતત વધતો રહે છે, ને દરેક સંકેતિતને વળી નવા સંકેતકમાં પલવાતાં જોઈ શકે છે. સાચો અને સાહસિક સંકેતવિજ્ઞાની જાણો છે, જાણવાની હિંમત ધરાવે છે, પ્રામાણિકતા ધરાવે છે કે અંતિમ સંકેતિત ક્યારેય અ સેમિઓટિક ગેમમાં હોય નહીં. બાથટબમાં માછલી પકડવાની રમત, નહીં તો, કંઈ રીતે રમી શકાય ? મરી જવાની મજા, નહીં તો, કંઈ રીતે માણી શકાય ?

લાંઠાની હિંમત, એમની પ્રામાણિકતા અને એમની રમત રમ્યા કરવાની તૈયારી આપણી ભાષા પાસેથી ખોવાઈ ન જાય, એ જવાબદારી હવે આપણી સહૃદીની....

[સમા, જાન્યુઆરી ૨૮, ૨૦૧૬]

(‘નવનીત સમર્પણ’ માર્ચ ૨૦૧૬માંથી)

## ૫. ‘મૂલપર્યત જોવાની મથામણ’ કરતા સંપ્રેષ સાહિત્યસર્જક

ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યમાં એક તબક્કે કાવ્ય અને ગદ્યક્ષેત્રે જેવું વિલક્ષણ ને સત્ત્વશીલ પ્રદાન બ.ક.ડા.નું હતું તેવું આજના તબક્કે લા.ઈ.ઠાનું જણાય છે. ગુજરાતી કાવ્ય-ગદ્યના વળ-વળાંક-વિકાસમાં જેમના સર્જક-વ્યક્તિત્વની દઢ મુદ્રાઓ અંકિત છે તેવા સર્જકોમાં લાભશંકરનું નામ પણ લેવું પડે. જેમની ઉપસ્થિતિ-નોંધ લેવી પડે એવું એમનું વ્યક્તિત્વ. કાવ્યચિકિત્સા ને કાવ્યચિકિત્સા બંનેય પ્રિય. વૈદક સાથે કાવ્યસાહિત્યના સંસ્કારો તેમને વારસામાં મળેલા. પિતા વૈદ્ય જાદવજી નરભેરામ શાસ્ત્રી (પાટીવાળા). એમની પ્રકૃતિપ્રવૃત્તિનું સાતત્ય લાભશંકરમાં ખરું જ. બે ચોપડી ભણેલાં માતા પ્રભાવતીના કંદમાં લોકલયોનું મધુ સંચિત હતું. તેનો લાભ લાભશંકરને મળેલો. તેમજો લખ્યું છે : ‘મારી શાખચેતના, લયચેતના, કાવ્યચેતના પણ માની દેણગી છે.’ (મારી બા, ૧૯૮૮, પૃ. ૧૩)

લાભશંકરનો જન્મ સેડલામાં, ૧૪-૧-૧૮૮૫ના રોજ. દોઢબેની ઉંમરે તેઓ સ્થળાંતર કરી પાટડીમાં આવ્યા. ત્યાં આઠ ધોરણ સુધી અધ્યયન. નવમા ધોરણથી તેઓ અમદાવાદ આવ્યા અને અહીં શ્રી ભારતીય વિદ્યાલયમાં દાખલ થયા. એ હિવસોમાં, લાભશંકર નોંધી છે તેમ, ‘ઉંડી નિરધારતાના એ હિવસોમાં’ એમને મૂલ આધાર આપ્યો તે શબ્દગ્રાતિએ. (મારી બા, પૃ. ૧૫) એમનો સમય સાહિત્યરસે સભર રહેતો હતો. તેમને આ ગાળા દરમયાન શ્રી મધુસૂદન પારેખના વર્ગશિક્ષણનો સં-લાભ સાંપડેલો. એ જ ગાળામાં એમનું એક કાવ્ય ‘રમકડુંમાં પ્રકટ થતાં તેના પુરુષકારમાંથી ઉમાશંકરનું નિશીથ’ એમજો ખરીદ્દિલું એ અરસામાં આકાશવાણી પર બાળવિભાગમાં પોતાના કાવ્યનું પઠન થતું સાંભળી લાભશંકરે ભારે રોમાંચ અનુભવેલો. લાભશંકરે ૧૮૫૭માં બી.એ. અને ૧૮૫૯માં ગુજરાતી (મુજબ) અને સંસ્કૃત (ગૌણ) વિષયો સાથે એમ.એ. અને ૧૮૬૬ રેન્ડમાં ડી.એસ.એ.સી.ની પદવીઓ મેળવી. તેમનું લગ્ન ૧૮૫૭માં કુમુદબહેન સાથે થયું. તેમનાં સંતાનોમાં અપેક્ષા, મનીષા, ઉત્પલ અને વિસમય છે. લાભશંકરે ૧૮૬૪ પછી શરૂઆતમાં સાતેક વર્ષ અમદાવાદની કોલેજોમાં ગુજરાતીનું અધ્યાપન વૈદકના વ્યવસાય સાથે કર્યું; પછી કેવળ વૈદકનો વ્યવસાય જ ચાલુ રાખ્યો. હાલ એ કાર્ય મર્યાદિત રીતે કરતાં કરતાં પત્રો-સામયિકોમાં આયુર્વેદવિષયક લેખો લખી સમાજના વિશાળ વર્ગને આરોગ્યવિષયક માર્ગદર્શન આપે છે.

લાભશંકરનો કવિપિંડ ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘ક્રૈમુદી’ વગેરે સામયિકો તથા સુનદરમ્ભ – ઉમાશંકર, રાજેન્દ્ર શાહ – નિરંજન ભગત, ઉશનસ્થ – જયંત પાઠક – મકરન્દ દવે – પ્રજારામ જેવાઓનાં કાવ્યોથી પોષાતો રહ્યો. તેમનાં કાવ્યોમાં પણ કલાકીય પરિષ્કૃતિ આવતી રહી અને

અનેક લખ્યપત્રિષ્ઠ સામયિકોમાં તે પ્રકાશિત થતાં રહ્યાં તેમને ‘કુમાર’માં કવિતા દ્વારા ઉત્તમ પ્રદાન કરવા માટે ૧૯૬૨ રનો ‘કુમાર’ ચંદ્રક પ્રાપ્ત થયો. ૧૯૬૫ પમાં તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ દ્વારા તેઓ સુકૃતિ તરીકે પ્રતિષ્ઠિત થયા. એ સંગ્રહની કવિતામાં પરંપરાના સાતત્ય સાથે સર્જકકવિની આગવી કવિત્વમુદ્રા સબળ રીતે અંકિત છે. પ્રશિષ્ઠ કાવ્યપરંપરાના સમ્ભગુ આકલન સાથે, કાવ્યપદ્ધાર્થની ઊંડી સમજ તથા અપૂર્વ કવિકર્મ માટેની સૂક્ષ્મ સાહસસૂજ સાથે તેઓ કવિતાક્ષેત્રે પ્રવેશયા અને બહુ ટેંક ગાળમાં જ તેમણે સર્જક ચેતનાને કુંછિત કરનાર ચીલાઓ અને વળગણો ફળગી દઈ પોતાની રીતે, બિનધાસ્તપણે આગળ વધવાનું પસંદ કર્યું. તેમાં એમના સર્જકચિતનું વિત્ત પ્રભાવકપણે પ્રગટ થાય છે. જીવન અને જગતનાં આંતરબાધ્ય નિરીક્ષણ - પરીક્ષણ - અનુભવ - મનોમંથન આદિઓ પ્રેરિત આકોશ - બ્યંગ - વિંડબના - વેદના - વિદ્રોહ વગેરેનાં સંવેદનોએ કવિતાની પથરાતી - પલવાતી - પલોટાતી - પછડાતી ને પડાંદાતી ગતિસ્થિતિનો અનોખો ચાક-લય અનુભવાય છે. કવિની અકળમણ ને મથામજા, એમનો વિરોધ ને વિદ્રોહ આ કે તે, અમુક કે તમુક વર્ગ-પક્ષ કે સમૂહ સામે નહીં, એટલો પોતાની સામે - પોતાની જ મનોગતથી માંબીને શબ્દગત સુધીની હરકતો સામે સવિશેષ જણાય છે. પોતાની વૈયક્તિકતા, સ્વાયત્તતા અને સાર્થકતા વગેરેના પેચીદા પ્રશ્નો તેમને તળેઉપર કરે છે. તેમની આ તળિયાની ઊથલાયથલમાંથી - તેમની પોતાના તળિયાનો તાગ લેવાની ઉત્કટ મથામજામાંથી ઉઠે છે બૂમ - કોરા કાગળમાં ! ભાષા-લય-પ્રતીક-કલ્યન-પુરાકલ્યન-આત્મકલ્યનની જ્યાઝાળમાંથી એમની કવિતાનો એક અનન્ય બળવાન ચેહેરો ઊવસી આવે છે. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી પ્રત્યક્ષ થતી એમની કાવ્યબાની કેવી વક્ખોષા થઈ શકે છે, કેવી બુલંદ ને બલવંત, કેવી ગહન-ગંભીર થાય છે તે એ પછી આવતા ‘માણસની વાત’ (૧૯૬૮), ‘મારા નામને દરવાજે’ (૧૯૭૨), ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪), ‘પ્રવાહજા’ (૧૯૮૬), ‘લઘરો’ (૧૯૮૭), ‘કાલગ્રંથિ’ (૧૯૮૮), ‘થોળાં અવાજ ઘોંઘાટ’ (૧૯૮૦), ‘કલ્યાયન’ (૧૯૮૮), ‘કિચ્યૂડ કિચ્યૂડ’ (૧૯૮૮), ‘સમય સમય’ (૨૦૦૦), ‘હથિયાર વગરનો ઘા’ (૨૦૦૦), ‘ઐ’ (૨૦૦૧), ‘છે’ (૨૦૦૨), ‘છે પ્રતીક્ષા’ (૨૦૦૨), ‘આઈ ડોન્ટ નો, સર’ (૨૦૦૨), ‘રમત ?’ (૨૦૦૩) અને ‘ભે કમિટ કર્યુ છે શું ?’ (૨૦૦૪) જેવા કાવ્યગ્રંથો જોતાં પ્રતીત થાય છે. જેમ વિશ્વાસીતિ, ‘છિન્નાભિન છું’, પ્રવાહદીપ’ તેમ માણસની વાત ગુજરાતી કવિતાની એક સીમાચિહ્નનું કૃતિ છે. કવિનું દિલ્લિભિન્દુ, તેમનો અભિગમ, તેમની અભિવ્યક્તિ, તેમનો અવાજ તર્કાલીન વાતાવરણ ને પરિવેશના સંદર્ભમાં જે વળવળાંક લે છે તેની તે પરિચાયક છે.

લાભશંકરની કવિતા સ્વરૂપ-અભિવ્યક્તિની દિલ્લિએ ‘કલ્યાયન’થી પાછો એક વળાંક લેતી જણાય છે. ‘પ્રવાહજા’ ઉત્સર્ગીક્રિયાના મેટાફિલ્ઝિકલ વિનિયોગથી, લઘરો ડિમિશિફિકેશનની વિલક્ષણ પ્રક્રિયાથી જો વિશિષ્ટ છે તો આ ‘કલ્યાયન’ (૧૯૮૮), ‘કિચ્યૂડ કિચ્યૂડ’ (૧૯૮૮),

‘સમય સમય’ (૨૦૦૦), ‘હથિયાર વગરનો ઘા’ (૨૦૦૦), ‘ટેવ’ (૨૦૦૧), ‘છે’ (૨૦૦૨), ‘છે પ્રતીક્ષા’ (૨૦૦૨) અને ‘આઈ ડોન્ટ નો, સર’ (૨૦૦૨) એક બાજુથી લઘુ તો બીજી બાજુ દીર્ઘ-કવિતાની સીમારેખાઓને અલપઝલપ સર્વશરી વર્ષા-વાંટની રીતિની રચનાઓ લાગે છે. કવિયિતમાં ઘૂમણીઓ લેતો સંવેદનનો એક ચકવાત ચડી આવી, ચિંતનો મિના લયાવેગે વાકુચેતનામાં કલ્યાણરેખીય વિસ્મયો અંકતો વિરમે છે. એ રીતે પશ્ચાદ્વર્તી કાચ્યોમાં કેટલીક રચનાઓ અવનવી જલકોનો ચટકો લગાડતાં સંવેદનાનાં રસાત્મક બુદ્ધબુદ્ધો સમીયે લાગે. એ રચનાઓનો કોઈ જુદો જ સ્વાચ છે. આપણી ભાષા, લય, વિચાર, અનુભવ વરેરેની પરંપરાગત ઘરેઠોથી બદ્ધ ચેતનાને સંકોરવાનું ચેતવચ્ચાનું કામ તે કરે છે. એ રસબુદ્ધબુદ્ધોની જલક આપણી અંદર ને આપણી આસપાસની તરાડોમાંથી કંઈક ઊંડે જોવા આપણાને મજબૂર કરે છે અને એમાં જ આ કવિની શબ્દચેતનાની સિદ્ધિ છે : તિરાડો દ્વારા તળિયા તરફ સરકવું.

લાભશંકરે ‘રે’, ‘કૃતિ’ તેમ જ ‘આઈક સાબરમતી’ જેવાં કાચ્ય/નાટકનાં વર્તુળોમાં કુન્ડસ્થાને ને સક્રિય રહી ગુજરાતી કવિતા અને નાટકના ક્ષેત્રે સર્જક-ભાવક અને વિવેચકનાં થંબ થઈ રહેલાં મનજલને ક્ષુલ્બ કરવાની મથામજા કરી. તેમની સર્જક તરીકે ખબરરદારી એવી તો ખરી જ કે પ્રયોગશીલતાના ધજધારી રહેતાંથે સૂક્ષ્મતયા તો કવિતાની પ્રશિષ્ટતાના સમર્થક એ બની રહ્યા. ગુજરાતી ઉર્મિકવિતામાં – ખાસ તો પરંપરિત છાંદસ કવિતામાં તેમજ અછાંદસ ને દીર્ઘકવિતામાં તેમજો પાઢેલાં પગલાંની લિપિને સૂજાબૂજપૂર્વક, વિવેકપુરઃસર પામી લેવાથી ખાસ તો કિયાશીલ નવસર્જકોને ગજનાપાત્ર લાભ સાંપરી શકે.

લાભશંકર પ્રબળ સિસૃક્ષાવાળા સત્યવાચી સર્જક છે. તેમના સર્જનોડ્યનની આમ તો બે પાંખ – કવિતા ને નાટક. મને હવે ત્રીજ્યે એક પાંખ લાગે છે ને તે નિબંધની ! તેમની ફાંટબાજ કલમે આ બધાં સાહિત્યસ્વરૂપોમાં આસ્વાદ વિસ્મયો સર્જ તેમની સર્જકતાના નવનવોન્નેશ્પૂર્ણ ચેતોકિસ્તારનો પરચો કરાવ્યો છે.

લાભશંકર સંપ્રક્ષ સર્જક છે. પોતાના પોતમાં વણપાઈ ગયેલા સાંપ્રતના અનેકનેક તારતંતુનાં ગ્રંથિગૂંથન ને મેળમિત્રાણના તાગતાળા શોધવા-સાધવામાં સર્જકની હેસિયતથી તેઓ આત્મચેતનામાં – શબ્દચેતનામાં સીધા – પૂરા ખાબકે છે. એથી માનવમનનાં મૂળિયાં હચ્ચમચાવતી એમની કાચ્યચીસ મનોરેધક લાગે છે. એમાં શબ્દ-અર્થ-લય-નાદ આઈ સર્વ તત્ત્વોની ‘નહીં સાંધો, નહીં રેણ’ એવી રસપ્રદ સંપૂર્કિત અનુભવાય છે.

લાભશંકર ‘લાંડા’ હોવા ઉપરાંત યથાપ્રસંગ ‘લઘરો’, ‘લોકનેત’, ‘વાંકુભા જશગાયક’, ‘દાદાજી’, ‘સર્વમિત્ર’, ‘પુનર્વસુ’ – એમ અનેક સ્વાગમાં પ્રત્યક્ષ થાય છે. નાટ્યરસ નાનપણથી. નાટ્યકાર થવા સાથે નટ-દિગદર્શક થવામાં પણ હિલાચસ્પી. તેમને તો હજુયે હાથમાં કેમેરો લઈ કોઈ ચિત્રપટનાયે હિંગદર્શક થવાનું સ્વખ છે. સત્યજિત રાયના એ પરમ ચાહક. લાભશંકરે જેમ ગુજરાતી કવિતાક્ષેત્રે ‘માણસની વાત’ (૧૯૬૮) એ દીર્ઘ કવિતાથી તેમ નાટ્યક્ષેત્રે ‘એક

ઉંદર અને જદુનાથ' (૧૮૬૫, સુભાષ શાહ સાથે)થી એક વળંક આજ્યો છે. ગુજરાતી ઓઝર્ડ નાટકના અંદોલન સાથે, લીલાનાટ્ય ('ઈમ્પોવાઈઝેશન')ની પ્રવૃત્તિ સાથે તેમનું નામ સંકળયેલું છે. 'મરી જવાની મજા !' (૧૮૭૩), 'બાથટબમાં માઇલી' (૧૮૮૨) જેવા એકાંક્ષિસંગ્રહો તથા 'પીળું ગુલાબ અને હું' (૧૮૮૫), 'મનસુખલાલ મજાઠિયા' (૧૮૮૮) અને 'કાહે કોયલ શોર મચાયે રે !' (૧૮૮૮) જેવાં દીર્ઘનાટકો તેમના સબ્લૂન નાટ્યપુરુષાર્થનાં ધોતકો છે. લાભશંકરનો શબ્દને કાન ઉપરાંત અંખથીયે પકડવા-પામવાનો, પોતાને – સર્વને ને શબ્દને એકાકાર રૂપે પ્રત્યક્ષ કરવાનો ઉત્સાહ આજેય એમની કલમને સક્રિય રાખે છે ને તેથી જેમ કવિતાક્ષેત્રે 'રમત ?' તેમ નાટ્યક્ષેત્રે 'સ્વભાક્ષરી', 'રમત', 'સ્વભસ્થ', 'ઝીચડી' ને 'આઈ ડોન્ટ નો' જેવી નાટ્યરચનાઓ પણ ગ્રંથસ્થ રૂપમાં સુલભ થઈ છે.

લાભશંકરે 'અમે ત્રણ' (અનિયતકાલીન સામયિક)માં 'લાભશંકર ઠાકરનું મૃત્યુ' નામે એક વાર્તા આપેલી. એ પછી એ ક્ષેત્રે એ આગળ ન વધ્યા, પરંતુ નવલકથામાં – હાસ્યનવલકથામાં, બાલકથા ને ચારિત્રકથામાં તેમજો કેટલુંક ઉલ્લેખનીય વિત્ત બતાવ્યું છે. એમાંથે 'મારી બા' (૧૮૮૮) તથા 'બાપા વિષે' (૧૮૮૮)નાં ચારિત્ર-કથાનકો લેખકની ચારિત્રવિષય સાથેની ઊર્ધ્વી નિસબત, અરુઢ નિરૂપક્ષારીતિ તથા એમની આગવી વ્યક્તિમત્તાને કારણે વિલક્ષણ ને પ્રભાવક થયાં છે. લાભશંકરે જે નવલકથાઓ આપી છે તે પણ કેટલીક રીતે વિશિષ્ટ છે. એમની 'અકરમાત્ર' (૧૮૬૮) પ્રણયકથા છે તો એમની બીજી નવલકથા 'કોણ ?' (૧૮૬૮) નિર્ભાન્તિકથા છે. 'પીવરી' બૌદ્ધકાલીન વાતાવરણ ધરાવતી, પીવરી નામની વારાંગનાની વિલક્ષણકથા છે, તો 'લીલાસાગર' વર્તમાન જીવનની વાત રજૂ કરતી સામાજિક, 'હાસ્યસાસન' (૧૮૮૮), 'ચંપકાલીસા' (૧૮૮૮) અને 'અનાપસમાપ' (૧૮૮૮) તેમની હાસ્ય-બંગ-વિનોદ-વિર્દિભના વાગેરે તત્ત્વો નિરૂપતી કથાઓ છે. તેમજો 'મુંબઈની કીડી', 'કાગડા અંકલ મમરાવાળા', 'નદીકાંઠે ડરાઉં ડરાઉં', 'તડકાનો પાપડ' અને 'કાનખાઉ રાક્ષસ' – એ બાલકથાસંપુટ (૧૮૮૪) દ્વારા બાલકથાક્ષેત્રે પણ ઉલ્લેખનીય સિદ્ધિ દાખવી છે. ૧૮૮૮માં 'લાંદાદા આવે છે, નવી વારતા લાવે છે' – શ્રેષ્ઠીમાં ૨૫ બાલકથાઓ ('ભ્યાઉ હાઉસ', 'દુમ દુમ સસલું') અને 'ઉંડતી સાઈકલ') આપી બાલકથાસર્જક તરીકેના પોતાના અધિકારનો રમણીય પરચો કરવ્યો છે. બાળકનો સ્વાભાવિક ચૈતસિક પ્રવાહ કોઈ રીતે વિક્ષિપ્ત કે અવરુદ્ધ ન થાય એ પ્રકારની બાલભોગ્ય વસ્તુકથનરીતિના તેઓ તરફકાર છે.

લાભશંકરે સવિશેષ તો પત્રકારત્વના સંપર્ક-સંબંધી નિબંધપ્રકાર જોડ્યો છે. એક સંવેદનશીલ કલાસર્જક તરીકે આસપાસના જીવન તથા જગતનાં અનેકવિધ સંચલનોની સંવેદનાત્મક નોંધ કેતી એમની દસ્તિ-નિસબતનો સાક્ષાત્કાર એમના નિબંધો વાંચતાં થાય છે. એમની 'એક મિનિટ !' (૧૮૮૬)ની નિબંધિકાઓ, યશવંત શુક્લ કહે છે તેમ, ૧૦૦ મિનિટ વિચાર કરવા પ્રેરે એવી છે. 'ક્ષણ તત્કષણ' (૧૮૮૮)ના નિબંધો 'જનસત્તા', 'લોકસત્તા',

‘સમકાળીન’, ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘યાઈમ્સ ઓફ ઇન્ડિયા’ (ગુજરાતી દૈનિક), ‘બુંબરી સમાચાર’ જેવાં પત્રોમાં એમની જે કટારો ચાલી તેમની નીપજ છે. લાભશંકરની વ્યાપક કલારસિકતા, કાબ્યરસિકતા, શ્વાનરસિકતા, આત્મરસિકતા અને સૃષ્ટિરસિકતાના આ નિબંધો ધોતક છે. એમાં ‘શિંતનરસિકતા’ ને કથ્યનારસિકતા પણ સહજતયા પ્રગટ થતી હોય છે. ‘ભૂરજ ઊઝ્યો કેવડિયાની ફ્લાશસે’ (૧૯૮૮), ‘કાગળની પૂંછડી’ (૧૯૮૭), ‘ઝકળનો જ’ (૧૯૮૭), ‘થોડો અમસ્તો તડકો’ (૧૯૮૮), ‘ઢોળી ગયાં જે તડકો’ (૨૦૦૦), ‘વિનિમયવૃક્ષ’ (૨૦૦૧), ‘હમારી સલામ’ (૨૦૦૩), ‘અહો જંકારતા ધ્વનિ !’ (૨૦૦૪) અને ‘નિસબત’ (૨૦૦૫) જેવા નિબંધસંગ્રહો લાભશંકરનું રસવિશ્વ કેટલું વૈવિધ્યસભર, વિશ્વાળ અને ઊંડાણવાળું છે તેનો સંકેત કરે છે. ‘વિનિમયવૃક્ષ’માં લાભશંકરના લઘુ-પત્રનિબંધો સંગૃહીત થયેલા છે. લાભશંકરનું ગદ્ય કેવું રસાત્મક, સંવેદનસિકત અને રેધક છે તે એમના આ ગદ્યસંચયોમાં અનુભવાય છે. લાભશંકરની સૂક્ષ્મ પ્રકારની ધ્વર્મિકતા – આધ્યાત્મિકતા; તેમની કરુણા, તટસ્થતા ને સ્વસ્થતા; આ નિબંધોની ક્ષાળોને ચિરંતનતા બસે છે. લાભશંકરમાં એક માનવોમી આસ્તિક હોવાની પ્રતીતિ આ નિબંધો દઢપડો કરાવે છે.

લાભશંકરે ઉપર્યુક્ત ગદ્યસંચયોમાં કારચિત્રી પ્રતિભા સાથે એમની ભાવયિત્રી પ્રતિભાના ઉન્મેષો દાખલ્યા છે. એમની ભાવયિત્રી પ્રતિભાની પ્રસાદી રૂપે એમની પાસેથી ‘ઈનર લાઈફ’ (૧૯૬૫, દિનેશ કોઠારી સાથે), ‘ભગેલા જીવ’ની સમીક્ષા’ (૧૯૬૮, ચિનુ મોદી, મનહર મોદી સાથે) જેવાં કથાવિવેચનનાં પુસ્તકો મળે છે. પ્રેમાનંદનાં ‘સુદ્ધામાચરિત્ર’ (૧૯૮૧), ‘નળાખ્યાન’ (૧૯૮૩) તથા ‘કુવરબાઈનું મામેરું’ (૧૯૮૪)નાં પ્રસાદ બ્રહ્મભં સાથેનાં સંપાદનો જે તે આખ્યાનકવિતાની આસ્વાદભૂમિકા પૂરી પાડતાં એમનાં લખાણોથી મર્માણાં છે. આવાં ગદ્યલખાણો લાભશંકર ઉન્નૂલનવાદી નહીં, પણ સત્ત્સર્જનવાદી હોવાનું પ્રતિપાદિત કરે છે.

લાભશંકરના આયુર્વેદના રસ-વ્યવસાય-કટારલેખનના પરિણામ સ્વરૂપે ચાલીસેક ગ્રંથો મળ્યા છે. એ લખાણો પણ એમની સર્જકતાના પ્રતાપે આયુર્વેદનું રસાળ અને રોચક વાચન પૂરું પાડે છે. ‘જ્યક્ટુચર્યા’ (૧૯૬૧), ‘રોગ અને ઉપચાર’ (૧૯૬૫), ‘સર્વમિત્ર’ (૧૯૮૬), ‘ઓસાડિયું’ (ભાગ : ૧ : ૧૯૮૮, ભાગ : ૨ ૧૯૮૮), ‘ચાગપરિચયમાળા’ (૧-૧૩ પુસ્તકાંથો, ૧૯૮૦), ‘આયુર્વેદની અમૃતધારા’ (૧૯૮૧), ‘સર્વમિત્રની ઉપચારયાત્રા’ (૧૯૮૭), ‘આચાર્ય દઢબલની ઉપચારકથાઓ’ (૧૯૮૭), ‘દરદ મટાડે દાદાજી’ (૨૦૦૦), ‘વૈદ બાપાનું વૈદું’ (૨૦૦૦), ‘આચાર્ય દઢબલનો ઉપચારબોધ’ (૨૦૦૧), ‘આરોગ્યધન’ (૨૦૦૨) વગેરે ગ્રંથો લાભશંકરની એક સંનિષ્ઠ વૈદ્ય તરીકેની પ્રતિબદ્ધતા પ્રગટ કરે છે. એમની વ્યક્તિત્વામાં ‘રસ-સિદ્ધ કવીશ્વર’નું તેજ છે જ.

લાભશંકરને ‘કુમાર’ ચંદ્રક ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદ્ધનાં (‘મરી જવાની મજા !’ને બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક ૧૯૭૭માં, ‘દીનું ગુલાબ અને હું’ને મહેન્દ્ર ભગત પારિતોષિક

૧૯૮૫માં, ‘મારી બા’ને કાકસાહેબ કાલેલકર પારિતોષિક ૧૯૮૮માં, ‘આયુર્વેદની અમૃતધારા’ને બી. એન. માંકડ પારિતોષિક ૧૯૮૭માં) અને ગુજરાત સાહિત્ય અકાદમીના કેટલાંક પારિતોષિકો (‘લઘરો’ને ૧૯૮૮માં પ્રથમ, ‘ખણ્ણ તત્કષણ’ને ૧૯૮૮માં પ્રથમ) મળ્યાં છે. ૧૯૮૨-૮૬ના ગાળાના શ્રેષ્ઠ નાટ્યાંશે તરીકે ‘પીળું ગુલાબ અને હું ને માટે નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૮૮માં ‘કાલગ્રંથિ’ને માટે જ્યન્ત પાઠક પારિતોષિક, ‘થોળાં અવાજ ઘોંઘાટ’ને માટે સાહિત્ય અકાદમી-દિલહીનો ૧૯૮૧નો પુરસ્કાર તથા ‘કાહે કોયલ શોર મચાયે રે !’ માટે ૧૯૮૮માં ચી. મહેતા નાટ્યપારિતોષિક તેમને એનાયત થયાં છે. તેમને ૧૯૮૧માં આપવામાં ધારેલો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક મોડે મોડે તેમણે ૧૯૮૪માં સ્વીકારેલો. લાભશાંકરે ૧૯૮૧માં કોઈભતુરમાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સર્જન-વિભાગના પ્રમુખ તરીકે ‘રહસ્યમય ગૂઢ અંધકારના કંઠે કવિની કોદ્દિયતનો અવાજ’ નામે વ્યાખ્યાન આપેલું (મુદ્રિત ‘કિચૂડ કિચૂડ’માં). તેમને ૨૦૦૭માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર પડ્યું એનાયત થયો છે.

[“અખડતી ખેંચે કવિતા કોણ ?” : સં. ચંદ્રકાન્ત શેઠમાંથી]

## આભાર સ્વીકાર

### બાળસાહિત્ય

(૮૫) પતંગિયું : હસમુખ ના. ટાક ‘ઝૂરક્ક’ : ૨૦૧૪, મુઃ જરગાલી, તા. ગીર ગઢા, જિ. ગીરગઢા, પૃ. ૬+૨૫, રૂ. ૫૫ (૮૬) બિલ્લુ બલરામ : ગુલામ અબ્બાસ નાશાદ, ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૪૨, રૂ. ૮૫ (૮૭) રંગસુગંધી : જીતુ નિવેદી, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮૦, રૂ. ૧૮૦ (૮૮) ગામની દીકરી અને બીજી વાતો : અવિનાશ પરીખ, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૮૧, રૂ. ૧૫૫ (૮૯) કુસુમમાલા : વિનોદ જાની, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ ૧૨+૧૦૮, રૂ. ૨૧૦ (૯૦) ચોકડીમાંથી પતંગિયું : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજક્ક’, ૨૦૧૫, ઉ૧૩/એ, રાજસ્તંભ સોસાયટી, બગ્ગીખાના, વડોદરા-૧, પૃ. ૬+૫૪, રૂ. ૫૫ (૯૧) રાષ્ટ્રવંદના : દેવજી થાનકી, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૭૪, રૂ. ૧૪૦ (૯૧/૧) રંગીલા-રસીલા મુલ્લા નસરુદીન : મેહુલ નિવેદી, ૨૦૧૫, આદર્શ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૧૬, રૂ. ૧૫૦

આ કાવ્યનો આસ્વાદ લેતાં આપણને સૌને થાય છે કે ‘અમે તડકો તો જોયો છે, પજ અહીં કવિએ અમને તડકાને જે પ્રત્યક્ષ કરાયો તે તો વિલક્ષણ જ. કેટલુંક ચિરપરિચિત પજ કાવ્યમાં એવો તો વેશ ધારણ કરીને આવે છે કે આપણને અપરિચિત લાગે. પરિચિતને અપરિચિતની જેમ આપણે પામીએ છીએ ત્યારે આનંદાશર્ય થયા વિના રહેતું નથી.’’ પરોઢના જીકળને આપણે જોયું છે; તડકાને પજ જોયો છે; પજ જીકળમાં તડકાને જોવો એ તો કવિહંદયીને જ સૂજે. અહીં પરોઢના જીકળમાંના તડકાનો પરિચય કર્યા આપે છે. તડકાના પરિચયમાં જીકળનો પરિચય અવિનાભાવે થાય છે. જીકળની દીપ્તિ, કોમળતા, રંગીનતા, તરલતા – આ બધું તડકાને કોઈ અપૂર્વ રૂપ બક્ષે છે. આવો તડકો તો કવિના વિશ્વમાં જ પામી શકાય.. આમ છતાં આ તડકો વાસ્તવિક વિશ્વનો મટી જતો નથી – મટી જઈ શકે પજ નહિ. આ પ્રકારની આંતર-પ્રતીતિમાં જ એક પ્રકારની ચયત્કૃતિ રહેલી છે. અહીં કવિકર્મના બળો તડકાનું રૂપાંતર થયેલું પામી શકાય છે. આ રૂપાંતરમાં તડકાનું પોતાનું રૂપ ખોવાઈ જતું નથી, બલકે તડકાના પોતાના રૂપનો જ વિકાસ-વિસ્તાર એમાં જોઈ શકાય છે.

‘‘પીગળે

પીગળે પડછાયાના પહાડ.’’

અહીં ‘‘પીગળે’’ કિયાપદ જે રીતે પંક્તિવિન્યાસમાં સ્થાન પામે છે તે સ્થૂચક છે. ‘‘પીગળે’’ કિયાપદનું પુનરાવર્તન એ કિયા તરફના કવિના વિશ્િષ્ટ અવધાનનું દીતક છે. પ્રથમ વાર થતો ‘‘પીગળે’’ કિયાપદનો વિનિયોગ આપણને ઉર્કઢિત કરે છે, સાથે સાથે તે કિયાપદનું પુનરાવર્તન કિયાના બળને બળવત્તર કરે છે. પડછાયાને પહાડનું રૂપ આપી કવિએ ‘‘પીગળે’’ કિયાપદના વિનિયોગનું અને તેના પુનરાવર્તનનું ઔચિત્ય સિદ્ધ કર્યું છે. પડછાયા અને પહાડનાં વિભિન્ન રૂપોની કલ્યાણ દ્વારા સધાતી એકરૂપતા સ્વાભાવિક અને તેથી સદ્યસંવેદન બની રહે છે. જીકળમાંનો તડકો પડછાયાના પહાડને આવશ્યક એવો રૂપસંદર્ભ પૂરો પાડી પડછાયાની ઇન્દ્રિયગ્રાહકતાને તીવૃતતર કરે છે. તડકાથી પડછાયાના પહાડ પીગળે છે. એ રીતે તેમની વિબુધિ પજ સમજાય છે; પજ આ ‘‘વિલુપ્તિ’’ રૂપાંતરની પ્રક્રિયાનું જ અવાંતર નામ છે. પીગળવાની પ્રક્રિયાનો પડછાયાના પહાડના સંબંધમાં કરેલો વિનિયોગ કવિની રૂપનિષ્ઠાનું જ પરિણામ ગણાય. ‘‘પીગળે પીગળે પડછાયાના પહાડ’’ આગળ કવિની પડછાયાની વાત પૂરી થતી નથી. પડછાયાના પહાડને ‘‘ને’’ દ્વારા આંસુનો બીજો સંદર્ભ મળે છે. આ આંસુ અતીતની કોઈ પરોઢ વેળાની સ્મૃતિનાં તો નહિ હોય? પડછાયામાં જાણે અતીતનો સંસ્પર્શ થાય છે. વિશાદની કોઈ ઉંડી

ધૂસરતા મનને આકષ્મિત કરી જાય છે. જીવનની ઉઘાડ-વેળાનું કોઈ રમણીય રૂપ અતીતનાં સમરણાશ્રુમાં સુઝુરે છે. જાગળમાં જેમ તડકો, તેમ આંસુમાં રૂપની આદી તરલ જાંય જાણે ચમકી ઊઠે છે. એ ચમકને પ્રભાવે જ કવિને આંસુમાં દેખાય છે :

‘ને આંસુમાં  
દૂબતી તરતી  
તરતી દૂબતી  
અથડાતી ઘૂમગતી આવે  
થોર તણી કાંટાળી લીલી વાડ.’

સ્થાવરને અહીં ગતિનો સ્વભાવ સાંપડે છે. નંબિયારપણાનું ઠંગિત આપનારી વાડ મનની મુક્ત સૌંદર્યરમણાની-તરલમધૂર સ્મૃતિલીલાની અભિવ્યંજક બની રહે છે. કવિની દસ્તિ સમુચ્ચિત રીતે કિયા પરથી કિયાના આશ્રય પર જઈ હરે છે. પદોનો અને વાર્ણોનો કમવિન્યાસ વાડના મનોગત રૂપની સ્મૃતિગોચર ગતિલીલાને તાદશા કરે છે. સ્મૃતિનો લય જાણો અહીં પકડી શકાય છે. કવિને આંસુમાં વાડનું દર્શન શાથી થયું ? વાડ એના કાંટાના તીખા સ્પર્શ દ્વારા અને લીલા રૂગના શીળા દર્શન દ્વારા મનમાં રોપાઈ ગઈ છે માટે ? કદાચ એનો ઉત્તર પછીની પંક્તિઓ આપે છે :

‘વાડ પરે એક બટેર બેઢું બટેર બેઢું બટેર બેઢું  
ફફડે ફફડે એની પાંખ’

વાડ પરનું બટેર વાડને કવિના સ્મૃતિપ્રદેશમાં બેંચી લાવે છે. ‘બટેર બેઢું’નાં ત્રણ આવર્તન દ્વારા કવિ વાડ પર બટેર બેઢાથી જે સૌંદર્યનુભવ વાસ્તવ જગતમાં થયો હતો તેને મનોજગતમાં કલ્યાન-સ્મૃતિ દ્વારા જાણે સ્થિર કરવા માગે છે. એ અનુભવને ફરીથી ઉત્કટપણે પામવાની કવિની મથામણ પણ આઈ વરતી શકાય છે. ‘બટેર’ અને ‘બેઢું’ કમવાર પોતાના સાંનિધ્યથી પરસ્પરની વ્યક્તિમત્તાને જાણે ઉદ્ઘાત આપે છે. બટેરને પામવાની કવિની મથામણનું બળ, એનો ઉલ્લાસ પંક્તિના સહજસ્કૂર્ત લયની પ્રસાન્નસરલ ગતિમાં અનુસ્યૂત છે. કવિ બટેરને પાંખોના ફફડાટાં પામે છે. ‘ફફડે ફફડે ફફડે એની પાંખ.’ ‘ફફડે’નું પુનરાવર્તન મનમાં પાંખનો અને એ દ્વારા ‘બટેર’નો જાણે સાક્ષાત્કાર કરાવે છે. કવિની અનુભૂતિની તીવ્યતા અને અભિવ્યક્તિની સૂક્ષ્મતા આઈ સહેલાઈથી પામી શકાય છે. આંખ પાંખને જુઓ એ પહેલાં તો કાનને પાંખના અસ્તિત્વની ખબર ફફડે’નાં આવર્તનો દ્વારા પડી જાય છે. દશ્ય અને શ્રાવ્ય કલ્યાનો પરસ્પરની સ્પર્ધા કરતાં પરસ્પરનો સૌંદર્યોત્કર્ષ સાધી એ દ્વારા કાવ્યત્વ સિદ્ધ કરે છે.

બટેર કદાચ કવિના મનનું જ પ્રતિરૂપ બની રહે છે. સૌંદર્યજગતમાં મુક્તપણે ઊડવાનો, જીવનના ઉષ્ણકાળને પુનરપિપુન : માણસાની જંખનાનો કવિની ભીતરમાં થતો ફફડાટ અને દાદાની આંખોમાં વળતી જાંખ જોઈને મનમાં જાગતું જીવનની નક્કર વાસ્તવિકતાનું વિષાદમૂલક ભાન

- આ બે વચ્ચેનો અંતરાલ જીવનનો જ વાસ્તવલક્ષી સૂર જાણે ધ્વનિત કરે છે :

‘ાંખા ાંખા પરોઢમાંથી પરોઢમાંથી

આછા આછા

અહો મને સંભળતા પાછા અહો મને સંભળતા આછા

ઠકુ ઠકુ ઠકુ અવાજમાં....’

કવિએ શબ્દોની પુનરુક્તિ દ્વારા અનુભૂતિની ચર્ચિતચર્વજક્ષમતાને સૂચિત કરે છે. વળી ‘આછા’, ‘પાછા’ અને ‘આછા’ એ પ્રાસભૂત શબ્દો દ્વારા સધ્યાત્મા લયનાં ત્રણ સંવાદાત્મક આંદોલનો દ્વારા અવાજનાં સાતત્ય અને ગહરાઈને વ્યક્ત કર્યા છે. ‘પાછા’ શબ્દનો અર્થ લયનાં આ ત્રણ આંદોલનો દ્વારા મૂર્ત બને છે. અર્થ – Meaning જાણે શબ્દ – soundમાં સંકાન્ત થાય છે. શબ્દ અને અર્થની ભેદમૂલક સભાનતા વિગતિત થઈ જાય છે. ભાષાની આ રીતે કાવ્યમાં થવી જોઈતી ઉલ્કાંતિ સિદ્ધ થાય છે.

‘ઠકુ ઠકુ ઠકુ અવાજ’ – અવાજ કવિને સૌંદર્યનુભૂતિની પરાકોટિ તરફ બેંચી જવામાં નિમિત્તભૂત બને છે. કવિને થાય છે :

‘હું કૂલ બનીને ખૂલું

ખૂલું

ઝડ બનીને ઝૂલું

ઝૂલું

દરિયો થૈને ઝૂલું

ઝૂલું

ઝડ બનીને ઝૂલું

ઝૂલું

આભ બનીને તૂઢું

તૂઢું તડકો થઈને

વેરણછેરણ તડકો થઈને

તડકો થઈને

સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું

મારી કર કર કોરી ધાર પીગળતી જાય

પીગળે પીગળે પડણયાના ઝડા’

કવિને કૂલ, ઝડ, દરિયો, પછાડ, આકાશ વગેરે થવાની જે આકંક્ષાઓ જને છે તેમાં પરોઢના સૌંદર્યનો પ્રભાવ કારણભૂત છે. કવિ પરોઢ દ્વારા પ્રગટ થતા સૌંદર્યને અનેક રૂપે, અનેક રીતે પામવા માગે છે. એમના ચૈતન્યનો ઉત્ખલાસ – ચેતોવિસ્તાર વિભિન્ન આકંક્ષાઓમાં અભિવ્યક્ત થાય છે. પરોઢના આકળમાંનો તડકો કવિના મનમાં છેવટે તડકો થવાની આકંક્ષા

જન્માવે છે. સૌંદર્યનુભૂતિનું ચરમબિન્દુ તડકો થઈને તૂટી પડી, વેરણહેરણ થઈને શબનમ-આગરના તળિયે પહોંચવાની કવિની ખેવનામાં જોઈ શકાય છે. ‘શબનમ’ જેવા શબ્દનો ‘સાગર’થી સાથીલો સમાસ ધ્યાનપાત્ર છે. કવિ ઝાકળમાંના તડકાના માત્ર તટસ્થ દ્રષ્ટા જ નથી, તડકા રૂપે પોતે પોતાને અભિનવ રૂપે પામી, પોતાના જ અસ્તિત્વનાં વિવિધ રૂપેમાં વિવસ્તા એક અને અખંડ એવા આનંદમય અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવા માગે છે. ‘દરિયો થૈને રૂબું’ અથવા ‘ખાડ બનીને કૂદું’ એમાં જે અસંભવનિર્ભર વૈશિષ્ટ્ય દેખાય છે તેના મૂળમાં સૌંદર્યના માનસિક પ્રત્યક્ષણનું સત્ય રહેલું છે. દેખીતી વિસંવાદિતા તળે સંવાદિતાનો અતૂટ તંતુ જોવા મળે છે. એથી જ અહીં ‘દરિયો થૈને રૂબું’ કે ‘ખાડ બનીને કૂદું’ એ પંક્તિઓ દ્વારા પ્રત્યક્ષ થતી અનુભૂતિ સાચી લાગે છે. કવિની અભૂતપૂર્વ અનુભૂતિની અપેક્ષા એમાં વંજિત થાય છે. વાણીને સ્વકીય વ્યવસ્થા દ્વારા નૂતન અવતાર આપીને લાઘવાદિની પ્રક્રિયાને વિશિષ્ટ રીતે પ્રયોજવાની કવિની શક્તિ અહીં જોઈ શકાય છે, ‘કૂલ બનીને ખૂલું’ એમ કહી કવિ કૂલના ખૂલવાની કિયાને પોતાની કરવા માગે છે અથવા કરે પણ છે. અહીં સૌંદર્યનુભૂતિની આકંસ્કા અને ઉપલબ્ધ વર્ચેનું અંતર જાણે કવિએ વિલોપી નાખ્યું છે. ચેતોવિસ્તારની કમિક ભૂમિકાઓમાં કવિ કૂલના રૂપનું સ્થૂલત્વ પણ ત્યજી દર્શિ કેવળ કિયામય થવા માગે છે – થાય છે. કિયાનું સત્ય કવિને પોતાના અસ્તિત્વના પર્યાય રૂપ કદાચ લાગે છે. ‘જૂલું’નું પુનરાવર્તન લયના સાહચ્યથી જૂલવાની કિયાને ચાક્ષુષ કરે છે. અરૂપને રૂપમાં સંકાન્ત કરી ઇન્દ્રિયગ્રાહ્ય બનાવે છે. શબ્દ પોતાની શક્ય તેટલી શક્તિથી વિસ્તરતો અરૂપને રૂપબોધ કરાવવા મથે છે. ‘દરિયો થૈને રૂબું’માં રૂબાડનાર દરિયો અને રૂબનાર ઉભય રૂપે પોતાને પામી. કવિ સ્થળ, કાળાદિની બધાઓથી વિમુક્ત; ઝાડચ, મૃત્યુ આદિથી અલિપ્ત એવા પોતાના અખંડ અને સમગ્રવ્યાપી અસ્તિત્વના સત્યનો જ નિર્વિન્દે, લીલયા સાક્ષાત્કાર કરે છે. પ્રકૃતિનાં વિવિધ રૂપસત્ત્વોના નિશિડ અનુભવ દ્વારા સંપન્ન થવામાં જ કવિની સૌંદર્યનુભૂતિ પ્રતીત થાય છે. અહીં ઝાકળના બિન્દુમાં ઊછળતા સૌંદર્યસીન્ધુ પર્યવસાન પામતાં, રૂપાંતર પામતાં કવિ આ પ્રકારની સૌંદર્યનુભૂતિમાંથી પસાર થાય છે. બૃહદને માર્ગે જ કવિ તડકાને પોતાના અસ્તિત્વના પર્યાય રૂપે પામી શકે છે. કવિ ઝાકળમાંના તડકાનો અનુભવ પોતાનામાં રહેલી એ અનુભવમાં અવરોધક એવી વિસંવાદિતાઓને ગાળીને જ કરી શકે. કવિ એટલા માટે તો ‘મારી કર કર કોરી ધાર પીગળતી જાય’ એમ કહે છે. ધારની તીક્ષ્ણતા અને લીસાપણું કઠોર – મૃદુ વશર્ણીથી જાણે મનોગમ્ય બને છે. સંવાદિતાની ઉપલબ્ધ અને વિસંવાદિતાનું એ દ્વારા જ વિલોપન – એમાં જ સૌંદર્યનુભૂતિનું સ્વારસ્ય તો નહિ હોય ને?

આખા કાવ્યમાં લયનું સાતત્ય ધ્યાન ખેંચે છે. લયમાં આવતા યત્તિ લયની ગતિને વળાંકો આપી એકધારાપણમાંથી – એકસુરીલાપણાથી કાવ્યને દૂર રાખે છે. શબ્દ અને અર્થની સંવાદિતાને વંજિત કરતો, સમગ્ર કાવ્યની એકતા અને સજીવતાની ધારકશક્તિ બનતો,

આવાભિવ્યક્તિને અનુકૂળ એવો લય અહીં સાચાત વિકસતો ચૈતન્યના આરોહાવરોહાત્મક ગતિલય સાથે અનુસંધાન ધ્વનિત કરે છે. વિલક્ષણ પ્રાસ-લયથી સિદ્ધાંત થતાં વિવિધ કાલ-માનનાં આંદોલનો પરસ્પરને સંતુષ્ટિત કરતાં સમગ્ર કાબ્યની સૌદર્યનુભૂતિના પ્રાણરૂપ એવી સંવાદિતાને ઉઠાવ આપે છે. આમ આ કાબ્ય કવિના દર્શનોલ્લાસનો - સૌદર્યનુભૂતિનો પ્રબળ આવિજ્ઞાર બની રહે છે.

(‘કવિતાની ત્રિજ્યા’માંથી)

18

## સાભાર સ્વીકાર

### પ્રક્રિયા

(૮૮) ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ : વે. સંપા. દુર્ગેશ ઉપાધ્યાય, ૨૦૧૪, લેખક પોતે : સી/૫, બીજે માળ, તેજલ એપાર્ટમેન્ટ પ્રતાપનગર, વડોદરા-૪, પૃ. ૧૪+૧૦૮, રૂ. ૧૨૫  
 (૮૯) પર્યાવરણ વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાનપોથી : મનજીભાઈ બી. પ્રજાપતિ : ૨૦૧૪, રનાંદે પ્રકાશન પૃ. ૪+૧૦૩, રૂ. ૮૦ (૧૦૦) સાંધ્ય વેળાએ : રાશ્મિ શાહ, ૨૦૧૪, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૧૨૮, રૂ. ૧૮૫ (૧૦૧) જીવન એક કવિતા : મૃહુલા સી. દેસાઈ, ૨૦૧૫, રચના સાહિત્ય પ્રકાશન, મુંબઈ, પૃ. ૮૬, રૂ. ૧૨૫ (૧૦૨) ગાંધીધામ ગાથા : માવજી સાવલા, ૨૦૧૪, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૨+૮૨, રૂ. ૮૫ (૧૦૩) ભણે તે તરે : કાંતિલાલ જો. પટેલ, ૨૦૧૫, રનાંદે પ્રકાશન, પૃ. ૧૦+૮૮, રૂ. ૧૮૫ (૧૦૪) અસ્મિતાનો સેતુબંધ : અશોક શર્મા, ૨૦૧૫, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮+૧૬૪, રૂ. ૧૭૦ (૧૦૫) વિશ્વાના વિખ્યાત વિજ્ઞાનીઓ : પોપટલાલ મંડલી : ૨૦૧૫, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૧૬૬, રૂ. ૩૦૦ (૧૦૬) પ્રેમપણી : રાધવજી માધડ : ૨૦૧૫, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૨૫૦, રૂ. ૨૩૦ (૧૦૭) બાળકબ્યાસ્વાદ : સંપા. ભૂપેન્દ્ર બાસ રંજ : ૨૦૧૫, રનાંદે પ્રકાશન, પૃ. ૮+૫૬, રૂ. ૬૫ (૧૦૮) કક્કાભાઈની કથા : સાંકળયંદ પટેલ, ૨૦૧૪, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૪૬, રૂ. ૫૦ (૧૦૯) ભારતના આદિવાસીઓની સંસ્કૃતિ : ડૉ. મૃગેશ એન. નાયક, પ્રકાશચંદ એમ. પટેલ, ૨૦૧૫, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૧૧૪, રૂ. ૧૨૫ (૧૧૦) નિન્નવૃત્તિ : પ્રીતિ સેનગુપ્તા : ૨૦૧૪, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૨૫૨, રૂ. ૨૪૦ (૧૧૧) પડકારોને પહોંચી વળવું છે ? ડૉ. ચન્દકાન્ત મહેતા, ૨૦૧૫, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૨૬+૧૬૧, રૂ. ૧૬૫ (૧૧૨) સાક્ષરનો સાક્ષાત્કાર : રાધેશ્યામ. શર્મા, ૨૦૧૫, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૮+૪૦૭, રૂ. ૪૦૦.

ચિત્ત પાછળનાં સંવેદનોના રમ્ય ઘોષોમાંથી જુદો પડી શબ્દોના ઘોષોમાંથી જન્મતાં સંવેદનોનો લાભ ઉત્તર લાભશંકરની રચનાઓને મળ્યો છે. ‘લાભશંકરની તડકો રચના આ દાયકાનું મહત્વનું ભાષાકર્મ છે. ભાષાના તત્ત્વગાંભીર્યથી નર્મર્મર્ભની હળવી લહેરો સુધીનું, ભાષાના આવિલૌતિક સ્તરોથી ભૌતિક સ્તરો સુધીનું ભાષાની નરી વિધાનાત્મકતાથી રૂપકાત્મક સંકુલતા સુધીનું આ અર્થસભરતાના ગીયમાં ગીય પ્રદેશોથી માંડીને અર્થના શૂન્યમાં શૂન્ય વિસ્તારો સુધીનું આ રચનાનું પોત અ-પૂર્વ છે. ‘તડકા’નાં પુનરુક્ત ઉચ્ચારણો અને ઉદ્ગ્રારોમાં આદિમ સંમોહન છે. આદિમ સંમોહનનું આ મંત્રબળ તડકામાં પુનરાવર્તનો દ્વારા તડકાના સાર્વત્રિક અને સાર્વભૌમિક ભિજાજને સર્જવામાં મુખ્યત્વે ભાગ ભજ્યે છે. શેખ શબ્દોને આધારે ઊભાં થતાં પ્રતિરૂપોને સહોપસ્થિત કરવામાં રોકાયા, ત્યારે લાભશંકરે શબ્દોને શબ્દોની બાજુમાં સાર્થનિરર્થ સહચારોમાં બાંધી પહેલીવાર સહોપસ્થિત કર્યા, અને કયાંક તો પ્રાસને તાંત્રણે સાવ નહિવત્ત તરતા રહી ગયેલા અર્થની દિશામાં કવિતાને વાળી.

[‘પ્રતિભાષાનું કવચ’, – ‘માધ્યમવિદ્રોહની કવિતા’માંથી]

## સાભાર સ્વીકાર

### પ્રક્રીષ્ટ

(૧૧૩) રવીન્દ્રનાથ ટાગોર ચારિતમ : માવજી કે. સાવલા, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮+૧૧૩, રૂ. ૧૪૫ (૧૧૪) માધ્યમ મંથન : ડૉ. યાસીન દલાલ, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦૪+૧૮૭, રૂ. ૧૮૦ (૧૧૫) માધ્યમ દર્શન : ડૉ. યાસીન દલાલ, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮+૨૨૦, રૂ. ૨૦૦ (૧૧૬) કોણો કણ્ણું તમે કમજોર છો ? : ડૉ. ચંદ્રકાન્ત મહેતા, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૨૬+૧૬૨, રૂ. ૧૬૫ (૧૧૭) મનોકુંપનો : ડૉ. બી. એન. સોમેયા, ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૮૧ રૂ. ૬૦ (૧૧૮) પ્રવાસના પંથે અને પ્રવાસમાહિતી : વિહુલભાઈ મકવાણા, ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૨૨+૨૭૩, રૂ. ૨૮૫ (૧૧૯) વેદકાલીન વ્યવસ્થા : હિમા યાણીક, ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮+૧૬૦ રૂ. ૧૬૫ (૧૨૦) માધ્યમ વિચાર : યાસીન દલાલ, ૨૦૧૪, રન્નાદે પ્રકાશન, અમદાવાદ ૧૧+૩૬૪, રૂ. ૩૭૫

લાભશંકર ઠાકર્કૃત ‘માણસની વાત’ (૧૯૬૭) – એ દીર્ઘ કૃતિ રચણની પેઠે બિન-અંગત નથી, અંગત છતાં સૌ કોઈની છે; રચણની પેઠે કેવળ કલ્પનો દ્વારા પ્રસ્તુત થતી નથી, સીધા કથનનો આશરો લે છે અને છતાં ચિત્રાત્મકતા સાંદ્રયા વગર રહેતી નથી. પણ મારે મન એનું મુખ્ય આકર્ષણ એનો લય છે.

### બનીસ વરસથી

થરકતા દીવાની વાતમાં જોઉં છું;  
દીપકના બે દીકરા  
કાજળ ને અજવાસ.

ત્રીજુ ને ચોથી તીટી તો દોહરાની પંક્તિ બને છે. કવિ આગળ જતાં છંદોના ટુકડા, જોડકણાં, લોકગીત આદિના લય પણ લીલયા કૃતિમાં વણી લેતા ચાલે છે. અપદ્યાગદ્યના અણસારા આવ્યા કરે છે, પણ સમગ્ર લયમાં નહાનાલાલીય નહીં પણ ચોખી લાભશંકરીય મુદ્રા ઉઠે છે, જે પકડવી એ આ કાવ્યના આસ્વાદ માટે આવશ્યક છે.

(‘શબ્દની શક્તિ’માંથી)

### સાભાર સ્વીકાર

#### પ્રક્રીષ્ટ

(૧૨૧) જિંદગી જતની છે : ડૉ. ચંદ્રકાન્ત મહેતા, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૮+૧૬૬, રૂ. ૧૬૦ (૧૨૨) સંત તુકારામ : પોપટલાલ મંડલી : ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૪+૪૮, રૂ. ૪૫ (૧૨૩) ભગવાન શિવની કથા : પોપટલાલ મંડલી, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૪+૪૦, રૂ. ૪૦ (૧૨૪) વીર અર્દૂન : પોપટલાલ મંડલી, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ ૪+૪૦ રૂ. ૪૦ (૧૨૫) કોણ સાંભરે છે ? : પ્રવીષ દરશી, ૨૦૧૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮+૧૧૬ રૂ. ૧૬૦ (૧૨૬) વાત હઠયદ્રારેથી : હિના મોહી, ૨૦૧૫, લેખક પોતે, ૯, દેવશ્રી સિદ્ધિ વિનાયક રો-ઝાઉસ, આનંદમહલ રોડ, સુરત, પૃ. ૫૫, રૂ. ૧૪૦ (૧૨૭) વાસ્તવિક અમેરિકા અને અનુભવનું અમેરિકા : ત્રંભક પંડ્યા, ૨૦૧૫, સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ, પૃ. ૧૦+૧૮૬, રૂ.

## ૮. ‘હું એને જગતું છું’ વિશે

ચન્દ્રકાન્ત ટોપીવાળા

હું  
દરિયાના જળરાશિમાં  
હલબલતો તિસ્તાર  
પવનની ગલીપચીનાં  
ગતિશીલ શિલ્પોને  
મેં નકાર્ય નથી.  
ને  
ચન્દ્રના શીતલ લેપોથી  
આકાશને પલાળી નાખ્યું છે.  
ટેકરીઓની  
ઉત્કૃષ્ટ છાતીની છાયાઓથી  
ટકરાયો છું  
ને પર્વતની  
પ્રલબ કાચાઓ સાથે  
મૈથુનમળન બન્યો છું.  
કંઠા-ખડક પર  
જાળ નાખી  
ઈથર ઉંઘી ગયો છે;  
હું  
એને જગતું છું.

ઇ ઘટકનું આ કાવ્ય છે. પહેલા ઘટકમાં અને છેલ્લા ઘટકમાં સ્પષ્ટ રીતે નોખો તારવેલો ‘હું’ સપાટી પર જોવાય છે; અન્ય ચાર અને પાંચ ઘટકમાં ‘હું’ હોવા છતાં અધ્યાહ્ત છે; જ્યારે બીજા ઘટકમાં ‘હું’ ‘મે’ થઈને આવે છે અને કર્તામાંથી કરણવાચક બને છે. ત્રીજા ઘટકમાં એ કરણવાચકને પાછો અધ્યાહ્ત કરવામાં આવ્યો છે. આમ બધા જ ઘટક પ્રથમ પુરુષની આસપાસ રચાતી સમાન્તરતા સર્જે છે. આ ઉપરાંત છેલ્લા ઘટકને બાદ કરતાં લગભગ પ્રત્યેક ઘટક કોઈ કામરાગી (erotic) કલ્પનોની સમાન્તરતા સાચવ્યા કરે છે. વળી ‘ને’નું સંયોજક તરીકેનું પુનરાવર્તન પણ ધ્યાન જેંચે છે. પ્રથમ પુરુષના કોઈ કામરાગી અંતરંગ અર્થનું પરાવ્યક્તિમાં અતિકમણ થયા કરતું હોય એવું જોઈ શકાય છે.

18

## ૧૦. ‘કલ્યાણ’ વિશે

રધુવીર ચૌધરી

‘આવે છે અવાજ પાછળથી, અંધકારમાં, કલ્યો’

લાભશંકર ઠાકરને સાંભળવા ગમે છે.

એમનો શબ્દ બોલે છે. વિશેષજ્ઞોની ચાદર ઓઢીને પોઢી ગયેલો શબ્દ પણ બોલે છે.

લાંઠાં લયસિદ્ધ કવિ છે. આ લય સંબોધન અને સ્વગત સંવાદ બંનેને અનાયાસ એકસાથે યોજે છે. ‘કલ્યાણ’નું પ્રથમ કાવ્ય ભાવકને સંબોધી છે અને બીજું કાવ્ય પોતાને પ્રશ્ન કરે છે. લાભશંકર જે કહે છે એની પાછળ તરત પ્રશ્ન આવે છે. અનિત્ય સાથેનો લાંઠાંનો નાતો તાજાળીનો અનુભવ કરાવે છે.

‘આવે છે અવાજ, પાછળથી કલ્યો’

પાછળ અંધકાર છે, કલ્યો..’

આ બે પંક્તિની કાવ્યને અંતે એક બને છે.

‘આવે છે અવાજ પાછળથી, અંધકારમાં, કલ્યો’

આ કાવ્યની અંતર્ગત, પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ના કવિત્વનું સમરાણ કરાવતી પંક્તિ સંભળાય છે :

‘અધરોઝને ઉઘાડતા ઉત્તરને કલ્યો’

સંવાદ સાધવા માટેનાં સાધનો અપૂરતાં અને અશક્ત છે તેમ છતાં કવિની મથ્થામજા એ માટે જ છે. સંવાદ ભાવક સાથે સધાય કે જાત સાથે – એમાં તાત્ત્વિક ફેર નથી. આ યુગમાં સંભળાય છે ઓછું તેમ સમજાય છે ઓછું. ઘણા લેખકો માની લે છે કે બધું હેમબેમ છે, પણ લાંઠાંને હકીકતની જાગ છે, તેથી એ કહે છે :

‘સંભળાય છે, તેમ કલ્યો’

અને સમજાય છે, તેમ કલ્યો.’

અને આમ કહેતો અવાજ કવિનો છે એનું રહસ્ય સમજતા ચાલો. આગળ શું છે એનો કવિએ ફોડ પાડગો નથી, પણ સ્વીકાર્ય છે કે પાછળ અંધકાર છે, જેને કલ્યવાથી એનું એક સ્વરૂપ પ્રાપ્ત થશે જે તમારું પોતીનું હશે. બીજા કાવ્યનો આરંભ ચાલવાની દિશા વિશે છે. દિશા બીજા કોઈએ સૂચવી હોય તો કોની શોધમાં ચાલવાનું છે ? ત્રીજી પંક્તિમાં કવિનો પ્રશ્ન બિનંગત બની જાય છે.

‘કોણ છે એવી શ્રદ્ધાથી કોને શોધવા નીકળ્યો છું ?

સંગ્રહને અંતે પાંત્રીસ અને છત્રીસ કમનાં કાવ્યોમાં કલ્યાયનની રચનારીતિ પાદી દેખા દે છે.

ભૂળિયાં શોધુ તો  
તળિયાં તૂટે છે –  
અભિન અવાજનાં, એમ કલ્પો'

આ કાવ્યમાં કવિ એક શબ્દ પ્રયોજે છે – ‘લયસ્તબ્ધતા’ અને છેલ્લા કાવ્યમાં આવો જ એક નવો સમાસ પ્રયોજે છે – ‘લયફ્ઝડ.’

સમગ્ર સંગ્રહ વાંચ્યા પછી પ્રશ્ન થાય શું કવિ સમજવાની એક નવી વ્યાખ્યા આપે છે. સમજનું એટલે કલ્યાણું ? સમજનું એટલે ‘માની લેણું’ એમ કહેવામાં ભાવક અને કવિ વચ્ચે અંતર ઊભું થઈ જાય છે. જ્યારે કલ્યાનાના છેડા અર્થથી સીવેલા હોતા નથી. છેલ્લું કાવ્ય માંડ બાર શબ્દનું છે, પણ એ મુક્તક નથી, સંપૂર્ણ કાવ્ય છે. જાણો કે કવિને ‘લયફ્ઝડ’ રૂપી ધ્રુવપદ મળી ગયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના અધ્યક્ષીય પ્રવચનમાં કવિતાની વાત કરતાં બાળકના હોઠેથી ખૂલતા સ્વયંભૂ લય વિશે એમણે આનંદ વ્યક્ત કરેલો. શિશુનો વિસ્મય એ કવિનો આનંદ છે, જે ભાવક સુધી પહોંચવો ઘટે. ‘કલ્યાયન’ની પ્રક્રિયાથી એ શક્ય છે. સંગ્રહનું છેલ્લું કાવ્ય આ પ્રમાણે છે :

અવાજથી અભિનન  
શ્રોતાને કલ્પો.  
સુળવળતી  
સજ્જવ  
લયફ્ઝડને  
કલ્પો.  
આવે છે  
અવાજ  
ભાષાનો  
કલ્પો.

લાભશીંકર ઠાકરના આ કાવ્યસંગ્રહને સ્થળકાળના સંદર્ભ વિના પણ મારી શક્ય એમ છે તેમ છતાં નોંધવું જોઈએ કે ૧૯૮૮ના ગ્રીભ દરમિયાન યુ.એસ.એ.માં પ્રવાસ કર્યો ત્યારે આ કાવ્યો લખાયાં. કેટલાંક કાવ્યો પ્રશ્નોત્તર રૂપે છે. કેટલાંક ‘કોણ’ અથવા ‘એ’ દ્વારા પ્રેરાયેલાં છે. ‘એ’ની ઓળખ આપવા જતાં કવિ બંધાતા નથી અને ભાવકના સરેરંનમાં મુંઘતા જેવું કંઈ જાય તો એને ખંખેરી આપે છે. જેમ કે –

એ લીસી છે, મૂઢું છે, હુંકાળી છે.  
 હા, એથી વિશેષ ટેરવાં આ ક્ષણો અને વાંચી શકતાં નથી..  
 એ છે તો આશ્ર્યોની પરંપરા છે.  
 હા, આશ્ર્યોના સાતત્ય પછી પણ એ જ છે.  
 એ છે તો જિબ્બાસા છે.  
 ચાઈટ, જે વાંઝણી છે.

જિજ્ઞાસાને ‘વાંઝણી’ કહીને અટકે તો લાભશંકર શાના ? અસિટ-નાસિટ અને નાસિટઅસિટ ચોક્કસ કમ વિના એમની કવિતાઓ ‘લયફ્ફડ’ના હલેસે વિહરે છે અને મૌનના અરીસાઓ ચમકાવે છે. એક નાનકડી યાદગાર રચના જુઓ :

એ  
 ભાષાનાં મૃગજળને ખળખળ વહાવે  
 નામને ઓગાળે  
 મૌનના અરીસાઓ ચમકાવે.

ગયા અઠવાઈયે (તા. ૭ જૂન, ૮૮) સુરેશભાઈ દલાલે કવિતાલેખનની પ્રક્રિયા વિશે વાત કરતાં આ સંગ્રહનું એક કાવ્ય રજૂ કર્યું હતું, જે વાણી અને મનુષ્ય વર્ચેનો સંવાદ છે. લા.૧૦. અહીં કવિને ‘માણસ’ કહીને જ ઓળખાવે છે. માણસ ન જાગવા માટે કેમ હેઠે ભરાયો છે ? કાવ્યનો ઉત્તરાર્થ જોઈએ –

“નહીં જાગું –  
 મને અનિદ્રને તું ઊંઘારી દે છે –  
 તારા શ્રવણીય લટકા લાખ કરોડમાં  
 રેશમિયા તારા શબ્દચીરના પ્રત્યક્ષભૂમાં  
 હું બની જાઉં છું આંધળોભીત –”  
 “ખારો નટનાગર –”  
 “ગાગરમાં ઢાંકીને મુજને કચાં ચાલી ?”  
 “અમૃત પે અતિ મીઠા, તું શબ્દ રચે ને રચાય મારા હોઠ  
 તારા લયંકારે ઊઘડે મારાં થાન  
 તારા શબ્દગાનમાં ચસચસ હું ચુસાઉં  
 તું બોલ, કસું પણ બોલ, મારા નીવિબંધને ખોલ”  
 “સુરતસંગ્રામમાં, અનંત શબ્દઓચ્છવમાં, ઝળહળ જ્યોત ઉદ્ઘોતમાં”  
 “સચિયદાનંદ કીડા કરે”  
 “મને લુલ્દ્ય ન કર, નેત્રવિષ નીરખવો, રૂપવિષ પરખવો  
 મને, મારે તારાથી અલગ મારે જોવો છે, મને.

હું અશાબ્દ છું. અવાક છું.”

“છું - ?”

“કદાચ.”

“રે મારા કોડીલા કાનડિયા, નાનડિયા હુંવર કથ  
કદાચના કલિપત પયોધરને ફૂટતાં કેટલીવાર ?

લે, ધાવ.

આવ, તારી ધારણાના પડખામાં.”

(‘સમકાળીન’ ૨૭મી જૂન ૧૯૯૯)

---

## સાભાર સ્વીકાર

### પ્રક્રીષ્ટ

(૧૨૭) દર્શક અને બીજા વિશે : ધીરેન્દ્ર મહેતા, ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,  
અમદાવાદ, પૃ. ૨૨+૧૭૦, રૂ. ૧૮૦ (૧૨૮) ઉભયાનવ : ભાનુપ્રસાદ પંડ્યા, ૨૦૧૫, ગૂર્જર  
ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૮+૧૬૮, રૂ. ૧૫૦ (૧૨૯) અદશ્ય પાત્રો : હરેશ  
ધોળકિયા, ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૬+૧૪૪, રૂ. ૧૨૫ (૧૩૦)  
સૂરસાધના : મીનાક્ષી સી. શાહ, ૨૦૧૫, શ્રુતિ એપાર્ટમેન્ટ, ભાઈકાનગર, થલતેજ,  
અમદાવાદ, પૃ. ૧૦+૧૦૦, રૂ. Nil (૧૩૧) ગાંધીની લાકડી : ગુશવંત શાહ, ૨૦૧૫, આર.  
આર. શેઠ ઓન્ડ કંપની પ્રા. લિ. મુંબઈ/અમદાવાદ, પૃ. ૨૪૦, રૂ. ૨૦૦ (૧૩૨) મુહી ઊંચેરા  
માનવરત્નો : ભજાયુ વરછારાજ, ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અને આર.આર. શેઠ ઓન્ડ  
કંપની પ્રા. લિ. અમદાવાદ, પૃ. ૪૦૮, રૂ. ૩૨૫ (૧૩૩) સંસારની સિતાર : દિનેશ પાંચાલ,  
૨૦૧૫, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૨૧૨, રૂ. ૨૦૦ (૧૩૪) મનના માયા  
બજારમાં : દિનેશ પાંચાલ, ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૪+૨૧૦,  
રૂ. ૨૦૦ (૧૩૫) સંતવાણી, લોકગીત અને લોછથા વિશે : હસુ યાણિક, ૨૦૧૫, ગૂર્જર  
ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૪+૨૪૪, રૂ. ૨૫૦ (૧૩૬) ભાષતરનું ભાવજગત : રમેશ  
ઠક્કર, ૨૦૧૫, બુક્સેલ્ફ, અમદાવાદ, પૃ. ૬+૭૮, રૂ. ૧૨૫ (૧૩૭) આઈ લાવ માય  
ઇન્ઝિયા : કૈલાશ નાયક, ૨૦૧૫, પારુલ નાયક, કર્ણ કોમ્પ્યુનિકેશન, નારણપુરા, અમદાવાદ-  
૬૩, પૃ. ૨૨૩, રૂ. ૧૦૦ (૧૩૮) શ્રી આનંદધન ચોબીસી આત્મવિકાસ પથ યાત્રા : કાનજી  
મહેશ્વરી ૨૦૧૫, શ્રી જૈન શેતાંબર મૂર્તિપૂજક સંઘ ગાંધીધામ, પૃ. ૧૨૦, રૂ. Nil

## ૧૧. કલ્યાણની વિલક્ષણ અરાજકતાનું સૌંદર્ય

ગાધેશ્વામ શર્મા

એકો

રબ્બરના તળિયાવાળા કર્તાનના જોડા જેવો પ્રતિવાદ પહેચાવી કર્યું :

ચાલ

કાદવમાં ચાલતા પક્ષી જેવા તત્ત્વને બતાવી કર્યું : ૫૮૩

વાગ્ન વિસર્જમાં કાનબૂડ ઉત્પારી કર્યું : દૂબ

માંસ શેકવાના સરીયા જેવા ઊંઘપોહમાં પ્રશ્ના પરોવી કર્યું : શેક

થાકી ગયેલા રેઢિયાળ ઘોડા જેવા છંદોલયને હણહણાવી કર્યું : બેસ

વહાણના ભાર જેવા વર્તમાનને હલકો કરવા કર્યું : કૂદ

હેંશ, ઉત્સાહ અને મન વિનાની સંવિદ્ધને કર્યું : હસ

સિસૃક્ષાને સંકોરતો આકાર રચી કર્યું : તોડ

(‘કલ્યાણ’, પૃ. ૩૬)

૧૦-૫-'૮૮ (યુ.એસ.એ.)

કવિના નવમા કાવ્યસંગ્રહનું અભિધાન છે : ‘કલ્યાણ.’ કવિતાપ્રવૃત્તિના સંદર્ભે ‘કલ્યાણ’ શબ્દથી કલ્યાણની ગતિ અથવા કલ્યાણનો માર્ગ જેવા ભાવઅર્થો ધ્વનિત થાય. પણ અહીં ‘કલ્યાણ’નું ‘અયન’ મુખ્ય છે. એથી એક વિકલ્ય ઊરો છે, કાલસંદર્ભ. પૌરાણિક કલ્યાણ પ્રમાણે એક હજાર યુગનો એક દિવસ જે બ્રહ્માનો દિવસ અને ‘કલ્ય’ કહેવાય છે, પણ એથીયે આગળ કલ્યને ‘મહાપ્રલય’ કહ્યો છે. અને ‘અયન’નો ગતિ-માર્ગ ઉપરાંત ‘મોક્ષ’ એવો પણ એક અધ્યાસ છે.

લાભશર્કરની કાવ્યચેતના અત્યંત આત્મલક્ષી કલ્યનોમાં લીલયા રમમાણ છે. પ્રતિષ્ઠિત માન્યતાઓના ઈન્ઝ-સ્ક્રૂચરનો અને તથા કથિત કલ્યરનો પોતાના શૂન્યવાદથી તે નિષેધ અને નકાર કરતા રહ્યા છે. કાવ્યકૃત પદાવલિઓમાં ઊછળી, ઉપર આવતાં સ્ટેટમેન્ટ્સ એમની ન-કિંચિત્તતાના ભ્યુલિયમ પીસિઝ છે. મજાની વિરોધાભાસો તે સર્જે છે અને વિ-સર્જે છે. ગતિ તેમજ વિ-ગતિના અજ્ઞબ કોલાજ - સૈશાલી વિસ્મયને વિદ્યય કર્યા વિના - રચી શકે છે. રચનાની એક સંસ્કૃત બની ચૂકેલી સં-ભાષા, ‘ક્લિશો’માં સરકી પડવાની શક્ય દહેશતની સ્પૃહ વગર, સ્વૈરવિહારમાં પુનરપિ પ્રયોજય છે. પરંતુ આ પરિસીમા પ્રાંત જ એમના સામર્થ્યનો બળુંકો હિલાકો છે એ ભૂલી જવા જેવું નથી.

માન્યતાઓનો ‘મહાપ્રલય’ કૃતિમાં રચી આપવા માટે એક સર્જક પાસે કર્યું સાધન છે ?

કલ્યાન, કલ્યાનાની ભાષા અને અનુવર્ત્તી લયવિધાન. ભાષામાં છતાં થતાં ભાવવિજ્ઞાન વિષયવિવર્તનો 'મોક્ષ' એ કર્તાની અપ્રશ્નાત જરૂરિયાત હોઈ શકે.

કવિએ અમેરિકાનિવાસ દરમિયાન પચીસમી કૃતિ રહેલી. 'કલ્યાન' સંગ્રહ એનું જ બહુકષાય સ્વાદવાળું વિચિત્ર ફલ છે ! છત્રીસે રચનાઓ જાણે એક જ રચનાના શીર્ષકશુન્ય અંશો છે ! એટલે ઉપર્યુક્ત પ્રતિભાવ સમગ્ર સંગ્રહનો સમાવેશ સૂચવે છે.

કવિને ભારે અધ્રિય એવા ગજલ-પ્રકારની ઉપમા યોજી કહી શકાય કે 'કલ્યાન' એક લાં...બી ગજલ છે જેની છૂટી શેશર-પંક્તિઓ સ્વયંપૂર્ણ એકમ તરીકે માણી શકાય !

પ્રસ્તુત રૂપમી રચના ઓફ્સર્ડ નાટ્યકૃતિપેઠ સંબોધક અને સંબોધયની સ્પષ્ટ રેખાઓને પ્રથમ તો ભૂંસી નાખે છે.

'એણો' એટલે કે 'કોણો ?' એવું ટાઈક-ફાઈક પૂછવાનું નહિ. પૂછો તો રચનાના દરવાજેથી જ અપાત્ર ભાવક ઠરશો કદાચ ! આ 'એણો' અને એનું કર્તૃત્વ જે આશાકારક ચેષ્ટાઓમાં સતત પ્રવૃત્ત રહે છે એનો મહિમા મોટો. વળી 'એણો', કોને કોને વિવિધ વિચિત્ર વિરોધાભાસી વિસંગત કર્મકલાપોમાં યોજેલ છે એના સંબંધ-સગડ પણ નહીં સાંપડે ! એ જાણવું જરૂરી નથી. આવો 'સર્પેન્સ' સ્વયં, વિસ્મયને નિતાન્ત ટકાવે.

વિલક્ષણ ઉપમાકર્મ કૃતિની શૈલીનો પ્રધાન અંશ છે. 'જેવો', 'જેવા' જેવા શબ્દોના સંયોજના-સેતુ ઉપર કવિની ઉપમા વિહરે છે ! એક વાર 'જેવો' અને ચાર વાર 'જેવા'નો પ્રયોગ પૂર્વોક્ત વિસ્મયમાં અયન કરાવશે.

કોલ્લરિજ આ લાભશંકરીય 'કલ્યાન'ને પણ esemplastic imagination કહેવા ખચીત લલચાય. સર્જકત્વનો વિશેષ પુટ અહીં જ અપાયો લાગશે.

ઉપમાનની ઉદ્ભબ ચારુતા અનર્થની હદને અડકી એક આસ્વાદ પદરૂપ પ્રકયારે છે : 'રબરના તમિયાવાળા કંતાનના જોડા જેવો પ્રતિવાદ પહેરાવી કહું : ચાલ.'

'વાદ'ને નહિ, પ્રતિ-વાદને કંતાનજોડા પહેરાવી ચાલવાનો આદેશ બરેખર ચોખિનેસ્ક છે.

તત્ત્વાંપણાં પ્રત્યેની ઘોર વિરતિ નિર્ભમ બીજુ ઉપમામાં વિલક્ષણી છે : 'કાદવમાં ચાલતા પક્ષી જેવા તર્ફને બતાવી કહું : પકડ.'

'હરિ ઓમ્ભુ તત્સત', 'તત્ત્વમસિ'માંના 'તત્ત્વ'ની અહીં હાસ્યાસ્પદ અવદશા સૂચવાઈ નથી ?

લા. ઠાકર 'સર્જ' લખી શકે પણ એમની પસંદ વિ-સર્જ પર પહેલી ઊતરે : 'વાગ્નવિસર્જમાં કાનબૂડ (અહીં 'કાનબૂડ' પ્રયોગ અવનવો) ઉતારી કહું : દૂબ.'

'વહાણના ભાર જેવા વર્તમાનને હલકો કરવા કહું : કૂદ.' અહીં વર્તમાનને વહાણના

વજન સાથે સંલગ્ન કરતી કલ્યાણકા કયા કહેના !

હોશ, ઉત્સાહ અને મન વિનાની સંવિદ્ધને ‘હસ’ કહેવાનું અને સિસૃક્ષાને સંકોરતો આકાર રચી ‘તોડ’ આદેશવાનું શબ્દકર્મ પ્રતિષ્ઠિત સંસ્થાનો પ્રત્યેની ભંજક ખંડન વૃત્તિ પ્રદર્શિત કરે છે.

પૂરી રચનાની એન્ટી ફિલોસોફિકલ, તારક પંક્તિઓ કલ્યાણવિનિયોગની રીતે મને આ લાગ્યી :

માંસ શેકવાના સણિયા જેવા ઊંઘપોહમાં

પ્રણા પરોવી કહ્યું : શેક.

થાકી ગયેલા રેઢિયાળ ઘોડા જેવા છંદોલયને

હણહણાવી કહ્યું : બેસ.

ટેડ હ્યુની અશ્વવિષયક રચનાનો અધ્યાસ ઝબૂકી જતો રહ્યો, પછી સૂર્યચું કે કર્ત્તા ભલે મન ફારે ત્યારે, અને ગમે તો છંદોલયબદ્ધ રચનાઓ ઘડે પણ આંતરમનમાં કવિતાના પ્રાચીન અલંકરણ સમા છંદો અને લયને તો તે ‘થાકી ગયેલા રેઢિયાળ ઘોડા જેવા’ જ અનુભવે છે.

છંદશુંખલા-પ્રતિબદ્ધ કર્તાઓ માટે ચિંત્ય અને અણાંદરના અસીમ આકાશમાં વિહરતા વિશુદ્ધ સજ્જકો માટે આસ્વાદ એવું આ કલ્યાન છે.

કલ્યાન-અયન સંદર્ભે એક આયરિશ લેખકનું સંકલન અત્યંત પ્રસ્તુત છે :

There is only one admirable form of the imagination : the imagination that is so intense that it creates a new reality, that it makes things happen, whether it be a political thing, or a social thing or a work of art.

– Seuan o' Faolain  
અમદાવાદ, ૩૦-૪-૮૮

(તૈમાસિક : ફાર્બર્સ : એપ્રિલ-જૂન : ૧૯૮૮)

## ૧૨. કવિની પ્રતિબદ્ધતા

નલિન રાવળ

ભાષાને ધરમૂળથી બદલી નાખનારા અને નવપ્રયોજિત કાવ્યબાની દ્વારા મનુષ્યના અંતરમનના રાગાવેગને પ્રગત કરનાર કવિ શ્રી લાભશંકર મારા એક પ્રિય કવિ છે.

છેલ્લાં વીસેક વર્ષ દરમિયાન અમારે મળવાનું બન્ધું નથી. કવિ-સંમેલનમાં એમને સાંભળેલા - કાવ્યને તાદૃશ કરતું એમનું સંમોહક કાવ્યપઠન મારું સ્મૃતિમાં છે. તળપદ-તત્ત્વમ શબ્દોની હારમાળાથી છવાયેલું એમનું શબ્દભંડોળ આશ્ર્ય પમાડે તેવું છે. આવતા દરેક સંગ્રહમાં એમની કાવ્યભાષાએ જૂજવાં રૂપ દાખલ્યાં છે.

‘વહી જતી પાછળ રમ્યઘોષા’ એમનો શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ છે. શબ્દ-લય-અર્થની સંતુલનમાંથી નિષ્પણ થતું સંગીત તેમની રચનાઓને પ્રકર્ષક બનારે છે. ડિશોર વધ-યુવાવયના સંવિકાળે અનુભવાતી લાગણીઓને નિરૂપણ એકાધિક રચનાઓમાં કવિની સ્મૃતિ સંગોપાયેલી છે. ‘અંતિમ ઠથણા’માં પતિ-પત્નીના સ્નેહનું અને ‘ચાંદરણું’માં પ્રણાયીજનના અનુરાગનું આલેખન મનોરમ કાવ્યજ્ઞીવીમાં થયું છે પણ પ્રથમ સંગ્રહમાં પ્રગટેલો આત્મપરિતોષથી ભર્યોબર્યો કવિનો અવાજ એકાએક કેમ લુપ્ત થઈ ગયો ?!

‘માણસની વાત’, ‘મારા નામને દરવાજે’, ‘બૂમ કાગળમાં કોરા’ જેવા સંગ્રહોમાં આત્મવિદ્રોહનો તીવ્ર સૂર સંભળાય છે.

સંપ્રત સમયમાં વ્યાપેલી સામાજિક વિષમતાથી અને વિશેષ તો ઔદ્ઘોગિક નગરોમાં સજીવેલી ભીસણ અવાજોની ભરી અરાજકતાથી કવિ વ્યથિત છે - કૃષિત છે. ‘થેળાં અવાજ ઘોંઘાટ’ અને ‘ચારે તરફ... વ્યવસ્થાઓ’ આનું ઉદાહરણ છે.

ભાષાનો કેફ કેફ ઘરમાણ મચાવે છે - કેવી ઊથલપાથલ કરી મૂકે છે અને કવિનો કોધ કેવો ભભકી ઊઠે છે તે દર્શાવતી અહીં અસંખ્ય પંક્તિઓની હારમાળા છે. જવ-જંતુ-પ્રાણી-પંખીની ઉપમા પણ પ્રયોજાય છે -

‘ચાબૂકની વ્યવસ્થાથી પથ્થરનો ઘોડો પણ ચાલે.’



‘ખતત આ જે દોડધામ કરતી  
કીરીઓ જેવી ક્ષણો  
ક્ષણોની કલ્યાન  
એ તો જિન વિથ લાઠમનો ત્રીજો પેગ’



‘કોઈએ વ્યવસ્થિત રીતે  
 કશું એવું ગોઠવી દીધું છે  
 જેને –  
 આપણે કબૂતરની જેમ ગળું ફૂલાવીને  
 Sense of time કહીએ છીએ’



‘એ કશાકના કબાટમાંથી  
 ખરખર ખરે  
 ક્ષણને ઓળખનારી ને ક્ષણમાં ખરનારી  
 ખોખાં જેવી બંધી દેડકીઓ.  
 એક દેડકીની આંખ નીચે  
 અઢાર હજાર સંકલ્પો  
 ને અંશી હજાર નિકલ્યોની  
 વ્યવસ્થિત થપ્પીઓ’

ચોમેર પથરાયેલી વ્યવર્થાની જાળમાં ગુંચવાયેલા મનુષ્યની મનઃસ્થિતિનાં ઉક્ત  
 ઉદાહરણો છે. ક્ષુલ્લક-વ્યર્થ કાવ્યલેખનમાં રાચનારા પ્રત્યે રોષ પ્રગટ કરતી પંક્તિઓ –

‘ભાષાની બૂંડજા આ –  
 જે હરદમ જણતી  
 લાખ લાખ જણતર,  
 આકળ-વિકળ કરનારા આકોશ બધા  
 આ સ્વર-બંજનના ચેચુ કરતા  
 શુકર બાળ  
 આ આળ-પાળ-પંપાળ બધું  
 આ રોષ લેરીલો જે ડંખ્યા કરતો  
 સતત જાત કે પાણીપોચો ભાત,  
 આ ખૂજલી  
 (એટલે દર સપ્તાહે સાત કવિતા લખવાની)  
 જે ભાષામાં જણપતી  
 ઝીણા ઝીણા ત્વચારોગ  
 ને બંજવાળે એને સતત  
 સુવરો, ખૂજલીબાજો કવિઓ...  
 ઓહ !

ચૂપ મણું, તોડી નાંખું કલમ ભાષાને ચીરું...  
 પણ આ કોણ કરાવે કોઈ વ્યવસ્થિત ?  
 એને પણ ચીરી નાંખું – રગડોળી નાંખું –  
 ખતમ કરું –  
 પણ એ શું છે ? કયાં છે ?

કુ-કવિ પ્રત્યેનો રોષ આટલી ઘાતક રીતે વ્યક્ત કરવાનો કોઈ અર્થ ?  
 ‘માણસની વાત’ ઈશ્વરના ઈન્કાર અને જેવા છે તેવા જીવનના સ્વીકારને લક્ષ કરતી

વૃત્તિ છે :

કેટલીક પંક્તિઓ...

“મારી જાતને મેં ક્યારેય ઈશ્વર માની નથી  
 હું માનું છું જિંદગી જીવા જેવી છે  
 દુઃખ, દરદ, કંગાલિયત, ફૂરતા, મૃત્યુ  
 આ બધું છતાં હું આમાં માનું છું  
 હું ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતો  
 હું નથી માનતો માનવી આત્માની અમરતામાં  
 અંતે મૃત્યુમાં વિલય પામતી જિંદગી  
 જેવી છે તેવી સ્વીકાર્ય છે – સ્વને  
 પ્રમાણવાનો આ જ તો એક માર્ગ છે”

સ્વગતોક્તિ સમા આ કાવ્યમાંની પંક્તિઓનું ગ્રાન્થ સ્વરૂપ નથી. શબ્દની – ભાષાની વ્યર્થતા દર્શાવતા ઉદ્ગારો હોવા છતાં અંતે કવિની શ્રદ્ધા શબ્દમાં – ભાષામાં ઠરે છે. લાભશંકર વિરોધાભાસના કવિ છે. પોતાનું કંધું પોતે જ ઉવેબે. જેનો સ્વીકાર કરે તેનો જ અસ્વીકાર કરે.

શબ્દની નિરર્થકતાને પુનઃ લક્ષ કરતી પંક્તિઓની ભરમાર ‘લઘરા’ કાવ્યમાં જોવા મળે છે –

‘ઉદેચાતો શબ્દ,  
 ક્યાંક તો ખૂટી જવાનો છે.  
 અને તૂટી જવાનો છું  
 કિયાના  
 કુર્મથી  
 નામના બ્યથથી  
 વિશોષજથી  
 આમ-થી ને તેમ-થી  
 તે-થી અને જે-થી

છે અને છું-છા થડી.  
 હેલ જૂની છે ને વાંકી ધૂસરી  
 ચડે બેસે ને વળી ઉતરે  
 ખખડતી ખેંચે કવિતા કોણ ?  
 ચૂચવે છે ચરણ કોણાં ?  
 ચારણ બનીને કોણા આ  
 ચાટ્યા કરે છે ?  
 આરણ નથી કારણ નથી,  
 ને છતાં  
 ખખડતી ખેંચે કોણ કવિતા ?”

જીવનસરિતામાં ઘટ રૂપે તરતાં તરતાં સામા કંઠે જવું છે... ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે -

‘ધૂં છું મને પણ હજુ ઘડાયો નથી  
 મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે.  
 ક્યાં ?

જીવનસરિતામાં...

શા માટે ?  
 તરતાં તરતાં સામા કંઠે જવું છે.  
 હ્યાય ?  
 ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે  
 કોણ ?  
 મારેય તે જાણવું છે કે  
 સામા કંઠે કોણ અને શા માટે કોઈ  
 મારી પ્રતીક્ષા કરે છે.  
 પણ રે હું ક્યારે ઘડાઈ રહીશ ?  
 ઘડતાં ઘડતાં  
 હું  
 મને જ પૂછું છું  
 રે હું ક્યારે ઘડાઈ રહીશ’

કાવ્યની પંક્તિ આવર્તિત થતી રહી છે -  
 “ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે”

કવિની પ્રતિબદ્ધતા છે સંમુખ ઊભેલા જનસમાજને કાવ્યાભિમુખ કરવો.

## ૧૩. કલ્પો કે લાભશંકર 'લાંડાં'ને કલ્પે છે (કવિ લાભશંકર ઠાકર વિશે કેટલીક નોંધો)

પ્રબોધ પરીખ  
અનુવાદ, સંકલન : પરેશ નાયક

'આપણો પાસે કળા છે. એટલે સત્ય આપણો નાશ નહીં કરી શકે.'

- નિત્યો

'આરે છે અવાજ ભાષાનો, કલ્પો.' (કલ્પાયન, ૧૯૮૮)

- લાંડાં

સૌ પ્રેમથી જેમને 'લાંડાં' કહીને બોલાવે છે તે ગુજરાતીમાં લખતા એક કવિ છે, જેને સહજ જ વિશ્વની બધી ભાષાઓના સૌથી તેજસ્વી કવિઓ પૈકીના એક કવિ તરીકે ઓળખાવી શકીય.

I mean, સંપ્રત વિશ્વમાં.

I mean, આપણો એ કલ્પવાની જરૂર નથી.

I hope, આપણો આ બાબતે એકમત છીએ.



કલ્પો કે લાભશંકર ઠાકર ગુજરાતી કવિતાનો ચહેરો બદલવા માટે બૂટ-પોલિશ કરી રહ્યા છે.



આજે છોતેર વર્ષની વયે પણ લાંડાં સાહિત્યની ભાષા અને આત્મજોજના સ્વરૂપાંતરણ ને ધરમૂળ પરિવર્તનના કામમાં એટલા જ વ્યસ્ત છે જેટલા એ છ દાયકા પૂર્વે હતા.

સાઈના દાયકામાં હતા એટલા જ એ આજે પણ પ્રતિબદ્ધ છે નવામાં નવા કવિઓ અને લેખકોની સર્જકતાને આવકારવા વિશે ને એમને પુરસ્કૃત કરવા ને હુંફ અને ઔદાર્યથી પ્રતિસાદ આપવા.

એટલા જ સાહસી, રમતિયાળ, વિચાર-ને-વિડબના-સભર, અને ચંચળ જેટલા એ આરંભના દિવસોમાં હતા જ્યારે સાહિત્યિક પરંપરાઓની સીમાઓ વિસ્તારવા માટે અને અન્ય કળાઓનું વ્યાકરણ એમાં આમેજ કરવા માટે મેદાનમાં પડેલા. અમદાવાદનો મધ્યવર્ગ આથી ત્યારે છંછેડાયેલો પણ ખરો !

આ માટે લાંડાં, અન્ય પત્તાબાજ અને હલીમભોજ એવા તેજસ્વી માણોકચોકીયા

સહકવિઓની સાથે જાહેરમાં પણ આવેલા. આ સૌ કવિઓએ અમદાવાદની શેરીઓમાં બૂટ્પોલિશ કરેલું. રે' નામે ત્યારે હોશબેર ઓળખાતા સાહિત્યિક સામયિક માટે ભંડોળ એકટું કરવા.

જેને પરિણામે, કવિતા અને રંગભૂમિ ક્ષેત્રે કેટલાક અતંત હેરતબર્યા પ્રયોગો, અદ્ભુત લીલાનાટ્યો, અને બેધડક આનંદદાયી સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે લાંઠાં અવકાશ પેદા કરી શકેલા. એક એવો અવકાશ – જેમાં લેખકોને લેખે લેવામાં આવે, એ પાંગરી શકે, અર્થપૂર્ણ સાહિત્યની રચના કરી શકે, ને એમ ગુજરાતી ભાષાનું આકાશ ઉજ્જવળ કરી શકે.

આ બધું સાઠીના દસ્કમાં બનેલું.

આજે છોટેરની વયે લાંઠાં પ્રવૃત્ત તો છે જ, પણ વૃદ્ધ છે. દિલ અને દેહની અમુક કાળબદ્ધ ચાલથી પ્રભાવિત છે. ને તોથ એ દરરોજ સવારે આંખ ઉંઘાડે છે સાહિત્યની સીમાઓને વધુ આગળ વિસ્તારવા.



### લાભશંકર દાકર અને ભાષારમતો

‘ભારી ભાષાની સીમાઓ એ મારા વિશ્વની સીમાઓ છે.’

– વિટ્ગેન્સ્ટાઇન



‘ભાષાસ  
ચાલતો નથી.  
ભાષા  
માણસને  
ચલાવે છે.’

(હથિયાર વિનાનો ઘા., ૨૦૦૦)



લાંઠાં અવિરત કવિ છે. ફરજિયાતપણે કવિ છે. છેક ભીતર લગી રમમાણ કવિ છે. પોતે જે બધું આત્મગત કર્યું છે તે તમામનો ભારત ત્યજ હેતા કવિ.

એમના બ્રાહ્મણ તરીકેના સંસ્કારો, એમની હિંદુ જીવનદસ્તિ, શાસ્ત્રીય રીતે આત્મસાત્કરેલી એ ભાષા જેમાં પોતે જન્મ્યા છે, એને ઘેરતી કાવ્યબાની.... એ બધી જ ગાંઠો જે બાંધે છે, એ સ્મૃતિ જે ઝૂટે છે, એ સંદર્ભો જે ગુણાતા ચાલે છે, એ લાગણીઓ જે અભરખા જન્માવે છે ને કાળ ને અવકાશની સંરચના કરે છે ને વળી નવા અભરખા પ્રગટાવે છે.

બધું જ એક ભારમુક્ત નહીંવત્ (No-thing)ને વિશે છે. એમાં જ ઓગળે છે, ને

એમાં જ રૂપાંતરિત થાય છે. નથી કોઈ એનો કશો હક્કાવો માંડનાર, નથી કોઈ મતુ મારનાર, નથી કોઈ એ પર અવિકાર જમાવનાર, નથી એને કોઈ ભોગવનાર...  
□

૧૮૬ પથી આજ પર્યંતના લાભશંકરના એક પણી એક પ્રગટ થતા રહેતા કાવ્યસંગ્રહો એક અજબ ભુલભુલામણી સર્જે છે. અનેક ‘સ્વ’ની, પ્રતિબિંબન અને પ્રતિબિંબિતની ભુલભુલામણી. પ્રેક્ષા અને પ્રેક્ષિતની, રેખન ને રેખિતની ભુલભુલામણી. ભાષ્ય ને ભાષિતની, સંરચન ને સંરચિતની ભુલભુલામણી.

આ તમામ ‘સ્વ’ સામસામા અફળાય, અવરોધાય, ઉપેક્ષાય, અટવાય, કાવ્ય પણી કાવ્યમાં. એક આગવા બ્રહ્માંડમાં. જે રચાય ને ભજી જાય. ભજી જાય ને સંરચાય....  
□

દીર્ઘકાવ્ય ‘માણસની વાત’ (૧૮૬૭)માં લાંઠાં આત્મખોજનો પ્રવાસ આગળ વધારે છે. ફરી એક વાર પેલા અવિરત, ભારેખમ ખાતીપાને સહજ પ્રસ્તાવોના ગુચ્છમાં પવયાવી નાંખે છે રસાત્મક વાક્યો વડે...

...‘હું’ના સર્વસંભવ પર્યાયોને એ વિભેરી નાંખે છે. કશીય ગોઈવણોથી એમને સ્થિર થતા એ રોકે છે....

...ટુકડાઓમાં ગુણાત્મા રહેતા ભરપૂર અવાજો. પ્રત્યેક શબ્દ અને હરેક ચિત્ર છિન્નાભિન્ન. કેવળ લયના પર્યાયોમાં આકલિત. લાંઠાં સતત ટાળતા રહે છે અર્થધટનની સંભાવનાને....  
□

લાંઠાંને મઝા પડે છે વાચનની / પાઠની ટેવો કેમ કરીને બદલવી એ દર્શાવવામાં. ને એમ, કવિતા જે આપે છે તેને જગ્યાવી લેવામાં. ને એમ, આપણે કોણ છીએ એ વિશેની કુંઠાઓ (Conditionings), રોચક આચાસનો અને આદર્શીકૃત પ્રતીકોનાં તમામ સંભવ રૂપોથી મુક્તિની ઝંખના એ શું છે તે વિશેની સમજને રૂપાંતરિત કરવામાં. ને એમ, કવિતાના પોતાના વશીકરણથી પણ મુક્ત થઈ ‘સત્તા’ની ઉપસ્થિતિ લગી પહોંચવામાં.

ઝેન (Zen) કવિઓને પણ ઈર્ષ્યા આવે એવા લાંઠાંનાં સાવ ટૂંકાં કાવ્યો, અને જાજ (Jazz) સંગીતકારોના મનમાં પણ જલન જાએ એવા એમના પ્રતિબંધો હાથમાં હાથ મિલાવતા ચાલે છે.

આ બધાં કાવ્યો એવા તો એક રમતિયાળ લયમાં કવિના આગવા કાવ્યવિશ્બેન સંકોરતા આગળ ચાલે છે કે ગુજરાતી ભાષાની કાવ્ય પરંપરાઓની લયકારીને જેઓ જાણે ને માઝે છે એ સૌને પણ એ આંશુ નાંખે છે.  
□

ગુજરાતી ભાષા, અને ભાષામાત્ર – કે જેને માટે એમને સૌથી વધુ પ્રેમ ને દરકાર છે

- એની જ સાથે લાંઠાંએ ઝઘડો માંડચો છે. સાથોસાથ, એ તમામની સાથે જે એ ભાષાને કવિતાની રાહે ને વિમર્શની રાહે પ્રયોજે છે.

ભાષાના મૂળને, પાઠથથી એલિસબ્રિજથી ન્યૂજર્સી ને ટેરન્ટો ને લંડનથી મુંબઈના Ritz બાર સુધી પ્રસરતી એની શાખાપ્રશાખાઓને....

...એ ભાષાને જે સોભ્યુઅલ બેકેટ ને પીટર હેન્કે બોલે છે, જે ભાષા ભૂપેન ખખર ને રાવજ પટેલ ને ચેખોવ ને આપણો સૌ ગાઈએ-ચીતરીએ છીએ....

...એ ભાષાને લાંઠાં ભાંગે છે, વિસર્જિત કરે છે, વિકૃત કરે છે, ને ઊજવે છે એ જ ભાષાની ઉપરિથિતિને !



### કલ્યો કે લાંઠાં NCPA (National Centre for performing Arts)માં ભજવણી કરી રહ્યા છે.

કલ્યો કે લાંઠાં માણસભણના દેશમાં પ્રેમાનંદનું આખ્યાન ભજવી રહ્યા છે.

કથાના રસને ખીલવતા, વિવિધ છંદો ને રસોને અનુરૂપ પોતાના સ્વરને પલટાવતા જતા... સાથે પોતાના કથાભાષ્યને સાંકળતા... પ્રેમાનંદના બહુસ્તરીય નરેટિવ વિશેના એમના અસ્તિત્વવાદી પ્રતિભાવોને ગુંથતા... ગુજરાતી ભાષાના ધ્વનિને ગુંજવતા....

### લાંઠાંની ભજવણી

ઉત્તો ચાસ લે છે. ગોળ ફરે છે. થોલે છે. જૂલે છે. પલટીને સરકે છે. ખસો છે. ઉંચાનીચા સ્વરભેદોથી શ્રોતાઓને મોઢી લે છે. બોધિત કરે છે. જેમ જેમ એ જૂલે છે ઐતિહાસિક 'સ્વ' અને સાંપ્રદ 'સ્વ'ની વચ્ચે.... કવિતાથી અને એની અંતિમ નિષ્ઠાપ્તિ વચ્ચે.... તેમ તેમ....

...ને તોય એક કાવ્યથી બીજા કાવ્ય વચ્ચે સેતુ રચાય છે. સદીઓના પટ પર પથરાયેલી સ્મૃતિમાં અંકાયેલા ગુજરાતી કવિતાના પાઠોની સમાંતર જાણે પરસ્પર 'પ્રતિત્ય સમૃત્યાદ' (Inter Dependance) અનુભવાય છે.

લાંઠાંની કવિતામાં આ બધું જ શ્વસનું વરતાય છે.

અચાનક કાવ્યમાં ઉત્તરી આવતી પ્રચલિત રાસગરબાની ધૂન.... તો વળી, ગુજરાતી ઘઠપસેટમાં અંકાયેલી અંગેજ લિટીઓ પેલા ગરબાની સાથે હળીમળી intertextualityના અનુભવને ગાડો કરી આપે છે.



લાંઠાંની ઉત્તરકળની કવિતામાં અવારનવાર ફૈલોગ્રાહિક સંયોજનો, ફિલ્મ ક્રિલિસ્ટ કે નાટ્યાત્મક ઉક્તિઓ, મૂવી શોટ્સના નિકટ-દૂરનાં ચિત્રણો વગેરેમાં કિયાપદો, વિશેષણો, રૂપકો કવિતાના આગવા તર્કને સાંકળતાં સતત હેરફેર કરે છે.

આમાંનાં અનેક કાવ્યોમાં લાંઠાં 'સ્વ'ના સત્તાકારણ (Politics of Self) સાથે જેલે

છે. ‘સ્વ’ને અન્ય તરીકે સંબોધે છે. એના અંતહીન વાર્તાલાપોને સાંભળતા એ સાંભળતા એ ‘સ્વ’ને ભાગે છે. ઠેડ અર્થહીન પ્રલાપના કિનારા લગી એને તાણી જઈને લયની લહેરોથી એ એને સંકોરી રામે છે.

કલ્પો કે લાંઠાં ‘કાય ચિહ્નિત્સા’ ક્રિલનિકમાં છે.

Ready to act. Requiring no cuts.

એક કલોજાપ.

માર્ગાંન બાન્ડોની અદામાં આંગળી મોં પર ટેકવી ધ્યાન મુદ્રામાં છે. સોહસિકતા અવાજ. સૂક્ષ્મતર વિગતો પ્રત્યે જાગ્રત. ધીરજ ને લાગણીથી સભર. બીમારીને સ્વાસ્થ્યની કથામાં પલટાવવાનો આનંદ માણશી.

કલ્પો કે લાંઠાં મિત્રના સ્કૂટર પર સવાર છે.

દિવસ પછી દિવસ... મહિનાઓ લગી... વારંવાર... હાથમાં આઇસકીમ-કોન.... અમદાવાદના પ્રત્યેક છબિઘરમાં અભિનેત્રી મુમતાજની તસવીરની ખોજમાં....



લાંઠાંના પાંચ દાયકાનાં સર્જનાત્મક અને અન્ય લખાણોમાંથી પસાર થતાં આપણે શોધી શકીએ છીએ, ને અનુભવીએ છીએ.... બધી કળાઓનાં અધૂરાં, બરડ સત્યોની પરંપરાઓ, સંગીતના સ્વરો, કેમેરાના અળવીતરા એંગાલ્સ, વક્ક્યોની અવનવા આકારો રચતી હલચલ, ચિત્રો.... અને આ તમામ, હચમચાવી મૂકે છે ધારણાઓને, અપેક્ષિત અર્થોન....

છેવટના તારણ રૂપે, આપણને લાંઠાં રૂપે એક એવું કાબ્યવિજ્ઞાન સાંપડે છે જે કવિના કવિત્વની સાખ પૂરે છે.

ડિસેમ્બર, ૨૦૧૧  
મુંબઈ

---

નોંધ :

મૂળ અંગ્રેજી આતેખ એક દશ્યશ્રાવ્ય નિર્દર્શનના ભાગ રૂપે હોઈ એમાંની કેટલીક સામગ્રીને સામયિક-દેખના આકારની નજીક લઈ આવવા જતાં છોડવી કે સહેજસાજ બદલવી પડી છે. એમાંનાં લાંઠાંની કવિતાનાં અનેક અવતરણો પણ લંબાણ ટાળવા આમેજ કરી શકાયાં નથી.

૨-૫-૨૦૧૬

## ૧૪. લાભશંકર ઠાકર : ઉત્કટ ચેતનાનો કવિઅવાજ

યોગેશ જોણી



(હબિકાર : વિવેક ડેસાઈ)

તા. ૬-૧-૨૦૧૬ની સવારે મારા દોહિત્રને 'સ્ટોલર' (Stroller)માં બેસાડીને બગ્ગીચામાં જવા નીકળ્યો. ત્યાં કવિમિત્ર હર્ષદ નિરેદીનો ફોન આવ્યો –

'લાભશંકર ગયા...'

થોડા ધબકારા ચૂકી જઈને હદ્યે થોડી ક્ષાણ મૌન પાછ્યું. ટોળાં, અવાજ ઘોંઘાટ શમી ગયાં... કર્ણચેતનામાં તગતગી રહી – વહી જતી પાછળ રમ્યાંધોષા.

સર્જક લા.ઠા. જાણે સ્ટેજ પરથી 'માણસની વાત' કરતા રહ્યા... ભીતરની લાઈટસ સતત ચાલુ રાખીને, દસ્તિમાં સતત કેમેરા ઓન રાખીને 'લોંગ' - 'મિડલ' - 'ક્લોઝ' શ્ટોટ્સ લેતા રહ્યા, 'સિન્સ' રચતા રહ્યા, 'સિકવન્સિજ' રચવાની ક્ષાળોમાં નિર્મમ બનીને એડિટિંગ કરતા રહ્યા, 'ધડ ધડ ધડકા' સાથે કવચ તોડતા રહ્યા શબ્દચેતનાનાં ને પ્રવેશતા ગયા અંદર, નકશા વિના, છેક મૂળીયાં મુદ્દી... શબ્દનાં મૂળ પામવા, માણસનાં મૂળ પામવા, લયમાં લખારીય કરતા રહ્યા, લયચેતનાનું રેશમ વણતા રહ્યા, ગમતાનો ગુલાલ કરતા રહ્યા, ને ધબકતાં ધબકતાં ધબકતાં જાણે મંચ પર ધીમે ધીમે ધીમે ઓગળતા ગયા ન અંતે સર્વથા નિઃશૈખ થઈ ગયા... સર્વથા નિઃશૈખ ?! ના, આ દેખાય છે આંખ સામે લા.ઠા.ના ઇનર-ની ઉત્કટ ચેતનાનો સર્જક-અવાજ... લા.ઠા.ની ને એમના શબ્દની ઇન્ટિગ્રીનો આ અવાજ – એમના કવિ-આત્માનો આ વાણીરસ હજ્ય પામી રહ્યો છે ચેતોવિસ્તાર... હા, હજ્યે એમના શબ્દની લાઈટસ ચાલુ છે, હા; હજ્યે એમની દસ્તિનો કેમેરા ઓન છે.

દસ વાગે કાઢવાના છે એવું ચિનુભાઈ (ચિનુ મોદી) પાસેથી જાણ્યું. હરિકૃષ્ણ પાઠક અને હું 'જલદર્શન' પહોંચ્યા. નીચે સફેદ વસ્ત્રોમાં ઊમેલા કોઈ દેખાયા નહિ. વિફટમાં ઉપર ગયા. 'લાભશંકર ઠાકર' લખેલી નેઇમાલેટ જોઈ. ને જાણે કાને પડ્યો લા.ઠા.નો કવિ-અવાજ –

‘મારા નામને દરવાજે  
આ હું ખડો રહ્યો  
ભીતરના ભોગળ બંધ  
અંધ હું ખડો રહ્યો  
કલબલતો કલબલતો  
પલપલ ખડો રહ્યો..  
મારા રામને દરવાજે  
હરદમ ખડો રહ્યો..’

(“મારા નામને દરવાજે”)

થાય, લાંઠાં હવે ખડા હશે નિશેના મહેલને દરવાજે ?! ત્યાં વળી લાંઠાંનો અવાજ  
કાને પડે —

‘નિશેના મહેલમાં તારે વસવું છે ?  
ના..  
કેમ ?  
પુરાઈ જવાની બીક લાગે છે.’

(‘પરબ’, જૂન ૨૦૧૨માં પ્રગટ થયેલ  
‘દસ કાવ્યો’માંથી ગીજું કાવ્ય)

બહાર ચંપલ ઉતારી, ભારે હૈયે અંદર ગયો. રૂમમાં સ્વજનો ઊભા હતા આજુબાજુ;  
વચ્ચે, લાંઠાં સૂત્તા હતા ચોકા પર. શાન્ત, પ્ર-શાન્ત. શમી ગયાં હતાં શબ્દ સાથેનાં તોઝાનો,  
લય સાથેની રમતો... ડિકશના કારણે ચહેરો ઊજળો લાગતો. શરીર લથથી ગયું હોવાના કારણે  
ચહેરો થોડો વધારે લંબગોળ લાગતો. કાનની બૂટો વળી ગયેલી... ભર્યા ભર્યા એકાન્તમાં કંવિએ  
ઓંબળા હશે શબ્દના કાન, તડકાનું પીંછું શબ્દના કાનમાં નાખી કરીય હશે ગલીપચી.... ને  
શબ્દના કાન પકડીને કર્દું હશે ‘ચાઉ માઉ... ચાઉ માઉ...’

નસકોરાંમાં રુનાં પૂમડાં ભરાવ્યાં નહોતાં... ચાસ તો બંધ થઈ ગયો, પણ ચાસના બદલે  
ચાલુ હશે હજુ લયની આવન-જાવન ?! કાનમાંય રુનાં પૂમડાં નહોતાં... કાનમાં, કર્ણચેતનામાં  
હજ્ય સચવાયો હશે એમનાં બાના મીઠા કંદથી વહેતા હાલરડાનો અવાજ ?!

‘હુલુલુલુ હાલવાલ રે ભઈ મારો પારશિયામાં પોઢ્યો,  
જીચડી ખાલમાલ રે ભઈ મારો પારશિયામાં પોઢ્યો.’

પ્રશાન્ત ચહેરા પર સંતોષનો; સચ્ચિદાનંદનો ઓરા ઝળહળતો હતો... આંખો મીચેલી  
હતી.... મીચેલી આંખોમાંથી જાજો કવિ-અવાજ પ્રગટતો હતો —

‘અંખની ઉઘાડ-વાસમાં  
દશપટની કાપકૂપ થતાં થતાં

હવે નિરર્થક શોદ્ધસને વાળતી  
સાવરણી સક્રિય છે.  
સરળ નથી છતાં હું મને વાળી રવ્યો છું.’

(‘કેમેરા ઓન છે’ના પ્રથમ કાવ્યમાંથી’)



‘તે અંખો કેમ મીંચી દીધી ?  
મારે  
મને  
જોવો નથી.’

(‘પરબ’, ઓક્ટો. ૨૦૧૭માં પ્રગટ થયેલાં  
આઈ કાવ્યોમાંથી સાતમું કાવ્ય)



લાંઠા. ચિરનિદ્રામાં હતા... (વિશેષજ્ઞાની ? ના, પરમ મૌનની ચાદર ઓછીને...)

‘મૃત્યુ લપાઈને સૂતું છે  
ઘસઘસાટ  
ઉંઘતું મારી ઉંઘના પડખામાં.  
ના —  
નથી જગતું.  
એય ભલે ઉંઘતું ઘસઘસાટ.’

(‘પરબ’, એપ્રિલ ૨૦૧૩)

આ કવિને મૃત્યુનો કદ્દી ડર લાગ્યો નથી. મૃત્યુ એમને મા જેવું મધુર હાસ્ય કરતું લાગ્યું  
છે —

‘મૃત્યુ  
મા જેવું  
મધુર હાસ્ય કરે  
અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ  
મેંનેટિક રોટેશનનો સ્વીકાર કરાવી  
ઉંડી  
ગાઢ  
ઉંઘમાં  
સરી જવાની

## રમત રમાડવા ?

(કરમત ?)

નિભંત્રણ પાઠવીને ‘પરબ’ માટે ‘પથેરપાંચાલી’ વિશે એમની પાસે લેખ લખાવેલો. ‘કવિતા’, ‘આસવાદ’ તથા અન્ય આવેખોય એમની પાસેથી ‘પરબ’ને મળતા રહેલા. એમની હસ્તપ્રત આ જાણે આંખ સામે દેખાય છે – લીટીવાળા કાગળમાં જમણી તરફ જરી ફળતા જીજા સ્પષ્ટ અક્ષરોમાં... કવિતામાં જ્યાં એક લીટીની સ્પેસ છોડવાની હોય ત્યાં એક લીટીની અને બે લીટીની સ્પેસ છોડવાની હોય ત્યાં એમણે બે લીટીની સ્પેસ છોડી હોય – (આ સ્પેસમાં ભાવકનેય breathing space મળે તેમજ આ સ્પેસમાં લાંઠાના કાવ્ય-ધબકાર પણ પામી શકાય.)

૧૯૮૦માં મોસિવ હાર્ટ-એટેક આવ્યો ત્યારથી હદય નબળું થતું ગયેલું, શરીર કથળતું જતું... છેલ્લાં વરસ્તોમાં ઘર બાહાર નીકળવાનું બંધ કરી દીવેલું... ઘરે કોઈ ખબર પૂછવા આવે અને લાંઠાના શરીરને લથડેલું જુઓ એ એમને ન ગમે. અવાજ સ-શક્ત. ઝીન પર ઉમળકાથી લાંબા સમય સુધી વાતો કરે. હાથ પાસે લખવાની શક્તિ રહી ત્યાં સુધી લખ્યા કર્યું... કોરો કાગળ અને પેન એમને ‘હાથ’ની પ્રતીતિ કરાવતાં... છેલ્લા ચાસ સુધી તેઓ શાબ્દ સાથે, લય સાથે શિશ્યની જેમ રમતા રવ્યા. છેક સુધી વાંચ્યા કર્યું. ‘અવાજને ખોટી શકાતો નથી / ને ઊંચકી શકાતું નથી મૌન.’ – આમ કહેનાર આ કવિ ૧૯૬૭ માં રચાયેલ દીર્ઘકાવ્ય ‘માણસની વાત’ (જેના વિશે લાંઠાને કહ્યું છે – ‘એમાં એકધારા સાતત્યનું લયસંમોહન નથી. એમાં ઉત્કટ ભાવાન્તરોય છે; તો સ્ટ્રક્ચર ઓફ સ્ટેટમેન્ટસનો ભરયક વિનિયોગ થયો છે. ઇમેજિસ પણ સતત દદજ્યા કરે. આ લાંગર પોએમમાં સીધાં વિધાનો છે, જે પરસ્પરને ઇન્ટરપેન્ટ્રેડ કરતા હોય. એમાં મલ્ટિલિસ્ટિ ઓફ સાઉન્ડ્સ, ટોન્સ અને મીર્જિંજ છે; તો તેવા ધોંઘાટ પણીની નીરવતા છે.’) – ‘પ્રતિભાવન હો !’ પૃ. ૧૪૮)માં મરણનો ભાર કેવી રીતે ઊંચકે છે ! —

‘કવિ હોવાનો કે થવાનો કે થયાનો  
આ જીજા જીજા કેંક  
નિરક્ષર રેફ મારું મન હે.  
મારું સૂજુ ગયાં પોપચોમાં  
મરણનો ભાર  
તે...ય મારે ઊંચકો.’

(‘માણસની વાત’, દ્વિતીય આ. નવેમ્બર ૧૯૮૬, પૃ. ૨૪)

શરીર કીજા થતું ગયું, પણ મન ? સ્વ-સ્થ, કાદેધડે. ને અવાજ કેવો ? તો કે, મરણને દૂર ભગડી મૂકે તેવો. પણ, આવનારા મરણનોય એમણે કવિતાની જેમ સ્વીકાર કરેલો. ઊંઘતા

૨૦૧૬માં તો તેઓ ચાવી ગયા, માર્ચ ૨૦૧૪માં ‘પરબ’માં એમનાં (મરણવિષયક) નવ કાચ્યો  
પ્રગટ થયેલાં. એમાંથી ચારેક રચનાનો અવાજ સાંભળીએ :

૧

મારા અંતેવાસી  
તું ક્યારે બહાર આવીશ ?  
તારા અંત પછી.

૨

આમ આ  
કોણ ખડકાઈ ગયા છે  
તારી આસપાસ ?  
ડાઢુઓ.

૩

આ  
શેની  
ફ્રમ્ફોલ ઉજવણી ચાલે છે ?  
મારા અભિનદાહની.

૪

કોણ દૂસરું ખાય છે ?  
દુઃખનોથી નર્સ્ત નર્સ્ત  
એવી ઊંઘ માવડી.

આ કવિ જીવનભર ભાષાને ખોદતા રહ્યા છે. – લો, સાંભળો લાંઠાંનો અવાજ –  
‘તું આ ક્યારનોય શું ખોટી રહ્યો છે ?  
ભાષા,  
કેમ ?  
મારે એને ખોટી નાખવી છે.  
પણ શા માટે ?  
મને બહાર કાઢવા.’

(‘કેમેરા ઓન છે’, પૃ. ૮૦)

કશોક ઘાટ ઘડવા માટે જ તેઓ ભાષા સાથે ને જત સાથે જીવનભર તોડ-ફોડ કરતા  
રહ્યા –

‘ધૂં છું મને પણ હજી ઘડાયો નથી.  
 મારે મને ઘડીને ઘટ રૂપે તરખું છે.  
 ક્યાં ?  
 જીવનસરિતામં.  
 શા માટે ?  
 તરતાં તરતાં મારે સામા કંઠે જવું છે.  
 હૃદય ?  
 ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.  
 કોણ ?  
 મારેય તે જાણવું છે કે  
 સામા કંઠે કોણ અને શા માટે કોઈ  
 મારી પ્રતીક્ષા કરે છે.  
 પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ ?  
 ઘડતાં ઘડતાં  
 હું  
 મને એ જ પૂછું છું :  
 રે હું ક્યારે ઘડાઈ રહીશ ?

(‘કેમેરા ઓન છે’, પૃ. ૮૪)

એમને V. S. હોસ્પિટલ પાછળના ઇલેક્ટ્રિક સ્મશાનમાં વર્ષ ગયા. અંતિમ વિવિ બાદ દેહ સરકાવ્યો. ઇલેક્ટ્રિક સ્મશાનનું શટર બંધ....

સતત વયાનંદમાં, નિજાનંદમાં રહેનારા, વારંવાર પોતાનામાં અને ખોઢી નાખેલી ભાષામાં zoom in અને zoom out કરતા આ કવિ લાંગ શોટમાં શું તાગવા દેહને છોડીને ચાલ્યા ગયા કેટલે દૂર ?!

લાઠાં ગયા ?! ના, છે, આ સંભળાય છે એમની બૂમ આકાશમાં કોરા....

હા, છે, હજુયે છે, શાભમાં, લયમાં, ભાષામાં, ‘બા ચા પા’માં – ઈન અને આઉટ, હા, હજુયે કેમેરા ઓન છે. –

‘ધાણી વાર એવું સ્વભ આવે છે કે –  
 ઉડતો હોઉં અને ઉડતો ઉડતો  
 કાગળમાં લખતો હોઉં.  
 દૂબતો હોઉં  
 અને દૂબતો દૂબતો કાગળમાં લખતો હોઉં...’

(‘ઈન અને આઉટ’, પૃ. ૮)

અત્યારેય જાડો તેઓ લખી રહ્યા છે, તડકાની કલમથી, આકાશમાં કોરા....

‘નાગર તડકો  
વાનર તડકો  
ગાંધીજની ટાલ તડકો’

(‘વહી જતી પાછળ રમ્યઘોષા’)



‘હું ઈશ્વરને ભજુ પણ શકતો નથી  
તજુ પણ શકતો નથી.’

(‘માણસની વાત’, દ્વ. આ. ૧૮૮૬, પૃ. ૨૬)

‘હું મને નથી હાડોહાડ વિક્કરતો  
કે નથી હાડોહાડ ચાહતો’

(‘ઈન અને આઉટ’, પૃ. ૬)



‘ગાંધીજની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં.  
ગાંધીજને મેં ચાચા છે કુમળી, તરવરતી વયે અને છતાં પંક્તિ આવે છે તો કેવી  
આવે છે ! –

‘હિટલરને હું વિક્કારી શકતો નથી  
અને ગાંધીને હું ચાહી શકતો નથી.’

(‘સર્જકની આંતરકથા’, પુનઃમુદ્રણ ૨૦૧૧, પૃ. ૪)

લાભશંકર જાદવજી ઠાકરનો જન્મ ૧૪-૧-૧૯૮૫પના રોજ સેડલા (જિ. સુરેન્દ્રનગર)  
ગામે. માતા પ્રભાવતી શિશુ લાભશંકરને ધાવણની જેમ લય પાતાં રહેલાં. ગળામાં મીઠાશ ને  
હલકથી ગાતાં – લાભશંકરને ઘોડિયામાં સુવાડતાં, પરોઢીએ ઘંટી દળતાં, શિશુ લાભશંકરની  
પાંથીએ–પાંથીએ તર્જની ફેરવતાં... માતાએ લાભશંકરને ગીતોનું, લયનું એવું અમૃત પાયું કે  
એમની યજોપવિત વખતે નમેલા માથા પર અસ્તરો ફરતો હોય ત્યારેય તેઓ તલ્લીન હોય એ  
પ્રસંગે ગવાતાં ગીતોમાં... જીવનભર તેઓ નિજાનંદમાં લીન, લયલીન રહ્યા... ‘મારી બા’માં એમણે  
નોંધ્યું છે : ‘મારી શબ્દચેતના, લયચેતના, કાવ્યચેતના પણ માની દેણગી છે.’ એમણે ભલે  
આધુનિક અને ઓઝર્સ્ડ લખ્યું... પણ એમની સર્જક-ચેતનાને પોષણ તો મળ્યું લયના અવિરત  
સિંચનથી, ખાડાખડિયાવાળા રસ્તાઓ પરથી ખખડ-ખખડ જતાં ગાડાંઓમાં જાનડિયું ગાતી  
એના ‘કર્ણ-રસાયનથી’, બે ચોપડી ભણેલી બા ઓખાહરણ કે મામેરું ઉકેલતી-વાંચતી-ગાતી  
એમાંથી, દેશી નાટક કંપનીઓનાં નાટકોમાંથી, મથુરાથી આવતા ચોખાઓની ફુષાતીલાંઓ-

કથાડીર્તનકારો-મેળપમાંના રાહડા-ભજનો-ગરબા-ગરબી – બ્રાહ્મોના મંત્રોચ્ચારો – વ્રતો કરતી બાળાઓનાં ગીતો – બાવા-મદારી-જાહુગર-બજાણિયા-ફ્કીર વગરેના પદ્યગવના લયલહેકાઓમાંથી....

દોઢેસ વર્ષની ઉમરથી તે આડમા ધોરણ સુધી પાટીમાં, ત્યાર બાદ નવમા ધોરણથી અમદાવાદમાં. નવમા ધોરણમાં મધુસૂદન પારેખ શિક્ષક. ૧૮૫૭માં ગુજરાત કોલેજમાંથી બી.એ; ૧૮૫૮માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાંથી એમ. એ. થયા. કોલેજમાં એમને અબ્દુલકરીમ શેખ, રાધેશયામ શર્મા, ચંદ્રકાન્ત શેઠ ને રતિલાલ દવે જેવા મિત્રો તથા ઉમાશંકર જોશી, પ્રબોધ પંડિત જેવા અધ્યાપકો મળ્યા. ૧૮૬૪માં આયુર્વેદનો ડિપ્લોમા. આરંભનાં સાતેક વર્ષ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યું. વૈદ્ય થયા બાદ સારંગપુર ચક્કલામાં ‘કાયચિક્કિન્સા’નો આરંભ. દસેક વર્ષ બાદ દવાખાનાં આશ્રમ માર્ગ પર ખસેડયું.

દસેક વર્ષની વયે એમણે કાચ્ય રચીને પિતાજી વૈદ્ય જાદવજી નરભેરામ શાસ્ત્રીને બતાવેલું. ખાડિયામાં હોલ્ડર જ્યાક બોળી પિતાજીએ લયભંગ સુધીરેલો. અને તેઓ કાનથી કવિતા પામતા થઈ ગયા. તેઓ નવમા ધોરણમાં હતા ત્યારે એમનું એક કાચ્ય ‘રમકરું’માં પ્રકટ થયેલું. તેના પુરસ્કારની રકમ ત્રણેક રૂપિયામાંથી ફરી બાઇન્ડ કરેલું ‘નિશીથ’ ખરીદેલું. નવમા ધોરણમાં ખાડિયામાં શ્રી ભારતી વિદ્યાલયમાં તેમને પહેલી વાર ‘કુમાર’, ‘સંસ્કૃતિ’ વગરે સામયિકો જેવા મળ્યાં એનું સ્મરણ તેમણે આમ નોંધ્યું છે :

‘અમારા વર્ગો બાર વાગે શરૂ થાય... મારી વાચનની ઉત્કટ લગનીને કારણે  
હું બપોર પહેલાં, જમીને અગ્નિયાર વાગે આવી જઉં. ‘કુમાર’, ‘સંસ્કૃતિ’ વગરે  
સામયિકોને ધાવણા શિશુની જેમ હું ચૂ-સીને પીઉં.’

(‘પ્રતિભાવન હો !’, પૃ. ૧૬૬)

શાળામાં હતા ત્યારથી તેઓ હાથખરચીના પૈસામાંથી ‘ગુજરી’માંથી સામયિકો, પુસ્તકો ખરીદતા. શાળામાં હતા ત્યાં સુધી કબુધસભા’માં જવાની હિંમત ન હતી. કોલેજમાં આવ્યા બાદ તેઓ ‘બુધસભા’માં જતા થયા. કબુધસભા’માં બચુભાઈ મળ્યા, ઉપરાંત એમની જ વયના મનહર મોદી, ચિનુ મોદી, આહિલ મન્સૂરી, વગરે કવિમિત્રો મળ્યા. સારંગપુરના એમના દવાખાનાના મકાનમાં જ આ કવિમિત્રો દ્વારા ‘રે મઠ’ શરૂ થયો.. તેમજ ‘કૃતિ’, ‘ઉન્નૂલન’નું પ્રકાશન ને થંબ થેલાં કાચ્યજણે હોળી નાખવાનાં તોકનો ચાલ્યાં. ગુજરાતી એબ્સર્ડ નાટકનો મહિમા કરવામાં તેઓ આગળ રહ્યા. ‘આર્કઠ સાબરમતી’માં લીલાવાનાટ્યના પ્રયોગો ચાલ્યા. ‘વૃક્ષ’, ‘મનસુખલાલ મળ્છિયા’, ‘ખીચડી’, ‘પીળુ ગુલાબ અને હું’, ‘કુદરતી’, ‘મરી જવાની મજા’ જેવાં નાટકો લાંઠાં પાસેથી મળ્યાં. એબ્સર્ડ એકંકીઓના સંગ્રહ ‘મરી જવાની મજા’ના નિવેદનમાં એમણે ગ્રામચેતનામાંથી તેઓ શું શું પામ્યા છે એની આમ નોંધ કરી છે –

‘ગામ જઉં છું ત્યારે મારી બાને, સૂરજભાભુને, મિત્ર માણેકલાલને, બસમાં કે

ગારીમાં બેઠેલા લોકોને, પાણીનાં બેડાં જોંચકીને ચાલી આવતી સ્ત્રીઓને, બીજી વાળતા કારીગરને જોઉં-સાંભળું છું ત્યારે હું કેટલો દરિદ્ર બની ગયો છું એનું ભાન થાય છે. કેવી વાણીની ખોચોખીચ સમૃદ્ધિ ! એક વાર હુંચ કુબેરનંડારી હતો. ચૌદ વરસનો એ કુબેરનંડારી ગામ છોડીને નગરમાં આવ્યો. ભજ્યો, ગણ્યો, પ્રોફેસર થયો અને સાવ લૂંટાઈ ગયો.

(‘મરી જવાની મજા’, તીજી આ. ૨૦૦૧, પૃ. ૬)

‘બાથટબમાં માઇલી’ નાટકમાં એમણે મુખ્ય પાત્ર તરીકે અભિનય પણ કરેલો. લાંઠાનાં આંગિકમૃ વાચિકમૃથી જશવંત ઠાકર પણ રાજી થયેલા. એમનામાં દંબનો છાંટો સરખો નહિ. જે અંદર એ જ બહાર. એમના જેવી integrity ભાગ્યે જ કોઈમાં મળે. લીતરની સર્ચાઈ એમના અવાજમાં પમાય. સ્પષ્ટ વક્તા. કોઈનીય શેહશારમ નહિ. માણસને ખૂબ ચાહે. દલિત-પીડિત માટેની લાંઠાની empathy ધ્યાન બેંચે છે. ‘અજનબી અગોચર અંતરિક’ લેખમાં ડેફિન્યુટ રજૂ કરતાં એમણે નોંધ્યું છે –

‘એકદિયા બગડિયામાં સાથે ભાગતાં હરિજનોનાં એકલ-દીકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભાણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધાં છોકરાં પાણી પી લે પણી હરિજનનાં બાળકોને ધિક્કારી-ધિક્કારી હડધૂત કરી આઘે-ઉંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના-બહારના વડીલોને, બ્રાબણ-વાણિયા-પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી કૂરતાઓ જોઈ, વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રેદ્ધ્ય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકેને અડવાનું ‘પાપ’ કરતો, જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું અનિષ્ટ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે.’

(‘સર્જકની આંતરકથા’, પુનઃમુદ્રણ ૨૦૧૧, પૃ. ૩,૪)

‘નિસબત’ નિબંધસંગ્રહના પ્રાસ્તાવિકમાં લાંઠાને નોંધ્યું છે –

‘હા, નિસબત છે... માણસ સાથે છે, સર્વ જીવો માટે છે અને જડ પદાર્થો સાથે અને માટે નિસબત છે.’

જાત સાથેની તથા માણસ માટેની નિસબત ‘માણસની વાત’માંય ‘દીપકના બે દીકરા / કાજળ ને અજવાસ’ની જેમ, black and whiteમાં, ટોન (Tone)ના ઊંડાણ સાથે પ્રગટ થાય છે –

‘મારી જતને મેં ક્યારેય ઈશ્વર માની નથી..

હું મારું છું : જિંદગી જીવા જેવી છે.

દુઃખ, દરદ, કંગાલિયત, કૂરતા, મૃત્યુ

આ બધું જીતાયે હું આમાં મારું છું.

હું ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતો,  
હું નથી માનતો માનવી આત્માની અમરતામાં.’

(‘માણસની વાત’, પૃ. ૨૫)



‘હું હજુ માણસ જ છું  
કેમ કે દુઃખ એ જ સત્ય છે.  
સુખ તો માયા છે  
એનું દુઃખ તો પરમ ધન છે.’

(‘માણસની વાત’, પૃ. ૩૩)

સમાજ માટે પણ આ કવિ, આ માણસ, અત્યંત સંવેદનશીલ છે. કેફિયત આપતાં એમજો નોંધ્યું છે –

‘બાળકોને રિબાતાં-ઢિબાતાં-ગોરમાર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધી; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધિભૂખ્યા લોકોને જોયા છે અને ચાંદીઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરદોડાઓ, શોભાયાત્રાઓ જોઈને કુલ્ઘથાં થયો છું.’

(‘સર્જકની આંતરકથા’, પૃ. ૪)

રાધીશ્યામ શર્માના એક પ્રશ્નના જવાબમાં એમજો કહ્યું છે :

‘કોઈ ‘બંધી’ ન ગમે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ કે સમાજ-રાજ્યના અંશને હાનિ કરે તેવી મુક્તિ ન ગમે.’

(‘સાક્ષરનો સાક્ષાત્કાર’, પૃ. ૧૪૪)

પુરસ્કાર યા પારિતોષિકો એમને ‘ધૂળ જેવા’ અને બોંદું ખખડતા લાગ્યા છે.

૧૯૬ પમાં પ્રગટ થયેલા પહેલા કાવ્ય-સંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં એમની લયનેતના શબ્દમેળ, અક્ષરમેળ, માત્રામેળ હંદોમાં વુંટાઈ વુંટાઈને કાવ્યતેજ રેલાવે છે. લાંઠાં આનો આ કક્કો વુંટ્યા નથી કરવાના એનો સંકેત શીર્ષક – વહી જતી ‘પાછળ’ રમ્યઘોષા-માં જ આપે છે. રમ્યઘોષા ‘પાછળ’ રહી જવાની છે ને લાંઠાંની કાવ્યયાત્રા માણસનાં ને શબ્દનાં મૂળ, કુળનાં કુળ પામવા, નિર્થકતા ખખડાવતી, સાર્થકતા શોધતી, અસ્તિત્વ પામવા મથતી આગળ ને આગળ ચાલવાની છે. (જેકે, વહી જતી-ની વેઈનમાં વધુ કાવ્યો મળ્યા હોત તો ?) પહેલા જ સંગ્રહનું પ્રાક્કથન – ‘સર્જકનું નિજ ભાવકથન’ સાંભળો :

‘તો મરી ગયેલા શરીરોની ઉચ્છ્વલ સુગંધનો સંગ્રહ  
ભલે પ્રગટ થતો.’

પ્રથમ સંગ્રહમાં ‘ચાંદરણું’, ‘અંતિમ ઈશ્વા’, ‘સ્મૃતિ’, ‘તડકો-૧’, ‘તડકો-૨’ જેવાં કાવ્યો પ્રાપ્ત થાય છે. ‘તડકો’થી લાઠાંની કાવ્યઘોષા એક રમણીય વળાંક લેતી પમાય છે. સંપ્રક્ષ સર્જક લાભશંકર ટાકર લાઠાંમાંથી લાઠાંને બાદ કરતા આગળ ચાલતા રહે છે, માણસની વાત કરતા રહે છે, કણ્ણચેતના થકી શબ્દને, જીવનને અને જગતને જીલતા રહે છે, નિત્ય સેવતા રહે છે ને પછી લય-ઉન્નેખો થકી એક જગત - નવા, અવનવા રંગ-રૂપ-ગંધ-સ્વર્ણ સાથે ભાવકે પ્રત્યક્ષ કરાવવા મથતા રહે છે, એમના વિંબનાના સૂરની નીચે નગરજીવનની અને અસ્તિત્વની વિ-સંગતિનો કરુણ સૂર વહેતો રહે છે. એમની ભીતર બાળક જેવું જ વિસમય ઝગમગતું-ટમટમતું રહ્યું છે. ને સતત જગત પ્રશ્નચેતના થકી તેઓ જત સાથે સંવાદ-વિ-સંવાદ કરતા રહ્યા છે. લાઠાંની કેટલીક પંક્તિઓ સાંભળીએ -

‘કવિવર નથી થયો તું રે  
શીદને ગુમાનમાં ઘૂમે ?’



‘કવિવર નથી થયું તારે  
શીદને વિખાદમાં ઘૂમે ?’

(‘મારા નામને દરવાજે’)

‘કવિ લઘરાજીનું ચિંતન’માંથી કેટલીક પંક્તિઓ -

‘ઉદેચાતો શબદ,  
ક્યાંક તો ખૂટી જવાનો છું.  
અને તૂટી જવાનો છું  
કિયાના  
કર્મથી  
નામના બ્યથી  
વિશોષણથી  
આમ-થી ને તેમ-થી  
તે-થી અને જે-થી  
છે અને છું-છા થકી.  
હેલ જૂની છે ને વંકી ધૂસરી  
ચેરે બેસે ને વળી ઉત્તરે  
ખખડતી ખેંગે કવિતા કોણ ક?’

(‘મારા નામને દરવાજે’)

‘બૂમ કાગળમાં કોરા’માંથી બે લઘુકાવ્યો -

## અંગરેખા

ડોલ શબ્દની કાણી રે  
ઉંડા કૂવાનાં પાણી રે  
હરખભેર દ્યમજા બેંચે છે લઘરો તાણી તાણી રે  
આ આવી છલકતી લઈને  
ભરચક પાણી પાણી રે !

શબ્દ

શબ્દ

તિરોખણાની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.  
જગાંક એને ?

અ-રુદ્ધ ગીતો પણ લાભશંકરે આપ્યાં છે, કેટલીક પંક્તિઓ, ચાલો, ગણગણીએ –  
'અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ... સમજ્યા.  
અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ... સમજ્યા.'



'ઠકરની આંખમાં ઠળિયા રે જગ્ણ જીવો જી.  
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જગ્ણ જીવો જી.

... ... ...

'ભડભડ ચેહમાં બાળિયા રે જગ્ણ જીવો જી.  
અમથાં અલાખ અજવાણિયાં રે જગ્ણ જીવો જી.'

('ટોળં અવાજ ઘોંઘાટ')



'હરિવર આવો ને  
ફૂલપરીની લાશ લટકતી લાવો ને'

('મારા નામને દરવાજે')

'પ્રવાહણ'માંનું કરાંજવુંય સાંભળીએ –

'મારું બા-ચા-પાથી આરંભાયેલું કાવ્યજીવન  
વિષાવિજનમાં કર્યાંઝે છે કમોડ પર એકલું એકલું  
ને આઈ ઓમ ઈનકેપેબલ ઓફ ક્રિપ્ટિંગ સાઈલન્ટ  
ઉંડ... ઉંડ...'

('પ્રવાહણ')

‘ચારે તરફ... વ્યવસ્થાઓ’ કાવ્યની કેટલીક પંજિતઓ –

‘ઠંકણીયે વ્યવસ્થા, ઢંકણીયે વ્યવસ્થા;  
અને ક્યારેક કપરી કોઈ રેળુએ  
ઢંકણીમાં દૂબી ભરવાની પણ વ્યવસ્થા.  
આસ્થા અને અનાસ્થા : વ્યવસ્થાના જ અંશો.’

લાંઠાંની સાથે કલ્પો –

‘આવે છે અવાજ પાછળથી, કલ્પો.  
પાછળ અંધકાર છે, કલ્પો.’



ખૂળિયાં શોધ્યું તો  
તળિયાં તૂટે છે –  
અભિન્ન અવાજનાં, એમ કલ્પો.’

લાંઠાંની જેમ, લાંઠાંના સૂરમાં સૂર પુરાવીને, આપણાનેય પ્રશ્ન પૂછીએ જાતને —  
‘મને અને આ તને

સતત  
તરડાયેલાં ખરડાયેલાં ખંડ ખંડ ખંડિત  
દર્શામાં  
ભાષાના : શા માટે હા પૂછ્યા કરું છું હું ?  
મેં કમિટ કર્યું છે શું ?’

(મે. કમિટ કર્યું છે શું?)

અંતે, ૨૦૧૨માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘ઈન અને આઉટ’ની અંતિમ રચના તમને સંભળાવી, કોરી આંખે, ભીના હૈથે, લાંઠાંને, લાંઠાંના શબ્દને સલામ સાથે વિ-રમું – (લાંઠાંના લયાનંદમાં ? કાવ્યાનંદમાં ?) —

‘એ કેમ ચીંખો છો, લાંઠાં કાઠા ?  
અહુંકારને આગ ચાંપવા જતા  
ગયો છું દાખી ઈન અને આઉટ.  
આ શું સણજે છે આસપાસ ચોપાસ તમારી ?  
મારી કાવ્યપોથીઓ.’

## આ અંકના લેખકો

ઉર્મિલા ઠકર	: સી/૧૮, નીલહર્ષ એપાર્ટમેન્ટ, અંજલી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
કમલ વોરા	: એ/૪૦૩, પારસનાથ સુધાપાર્ક શાંતિપથ, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૭૭.
કિશોર વ્યાસ	: ૬/બી, મહેતા સોસાયટી, હાઈસ્કુલ પાછળ, કાલોલ-૩૮૮૫૩૩૦.
કુમારપાળ દેસાઈ	: ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જ્યાબિઅન્ન માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
ચંદ્રકાન્ત શેઠ	: બી/૮, પૂર્ણિશર ફ્લેટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫.
ચંદ્રકાન્ત ટોપીવાળા	: ડી/૬, પૂર્ણિશર ફ્લેટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫.
જ્યદેવ શુક્લ	: જશોદાનગર, જિન પાછળ, સાવલી, જિ. વડોદરા-૩૮૧૭૭૦.
દક્ષા વ્યાસ	: ક્રોટ, વ્યારા-૩૮૦૦૧૫, જિ. તાપી..
દલપત પઢેયાર	: ૮૨૩, એચ. આઈ. ઇ., શિવશક્તિ સોસાયટી, ડીએલપી ઓફિસ પાસે, સેક્ટર-૨૭, ગાંધીનગર-૩૮૨૦૨૭.
દર્શના ધોળકિયા	: ન્યૂમિન્ટ રોડ, પોરિસ બેકરી પાસે, ભૂજ-૩૭૦૦૦૧.
ધીરુ પરીખ	: 'લાવણ્ય', વિજયપાર્ક, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮.
ધીરેન્દ્ર મહેતા	: જીવનશાયા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ, ભૂજ-૩૭૦૦૦૧.
નલિન રાવળ	: ૧૦-એ, સત્તર તાલુકા સોસાયટી, પોસ્ટ નવજીવન, અમદાવાદ-૩૪.
નિર્ઝન ભગત	: ઈ/૨૩, જલદર્શન ફ્લેટ, હ. કા. આર્ટ્સ કોલેજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૮.
નીરવ પટેલ	: ૪, હેમાંગ પાર્ક, બુટભવાની મંદિર પાસે, વેજલપુર, અમદાવાદ-૩૮૦૦૫૧.
પરેશ નાયક	: ૨/૪, મૃદુલ પાર્ક, ગુલબાઈ ટેકરા, પોલિટેકનિક રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫.
પારુલ કર્ણા દેસાઈ	: પારિજાત, ૬, અરુણોદય પાર્ક, સેન્ટ એવિયર્સ કોલેજ કોર્નર, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮.
પ્રફુલ્લ રાવલ	: ૩, રાજમહેલ ફ્લેટ, આઈ. ઓ. સી. કોલોની રોડ, વીરમગામ-૩૮૨૧૫૦

પ્રવીષ પંડ્યા	: એચ/૮૦૧, સામ્રાજ્ય ફ્લોટ, ડ્રાઇવરીન રોડ, માનવમંદિર સામે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨.
બફુલ ટેલર	: તી/૪૦૨, બેજાનવાલા કોમ્પ્લેક્સ, તાડવાડી, રાંદેર રોડ, સુરત-૩૮૫૦૦૮.
બારીન મહેતા	: ૧૪, કૃપા-નમન એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૧૦૧, ભાઈકાકાનગર, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪.
ભગવતીકુમાર શર્મા	: ૩૨/બી, પાવિત્રા રો હાઉસ, ગેટ નં. ૨, સહજસુપર સ્ટોરની ગલીમાં, આનંદમહલ રોડ, અડાજાણ, સુરત-૩૮૫૦૦૮.
બાનુપ્રસાદ પંડ્યા	: એ/૨૪, સૌરભ બંગલોઝ, સત્યસાંઈ હોસ્પિટલ માર્ગ, રાજકોટ-૩૬૦૦૦૫.
મહિલાલ હ. પટેલ	: સહજ બંગલો, શાસ્ત્રીમાર્ગ, શાંતાબા પાર્ક પાસે, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦.
મહેન્દ્રસિંહ પરમાર	: ૨૦, ગૌરીશંકર સોસાયટી, જ્વેલ્સ સર્કલ પાસે, ભાવનગર-૩૬૪૦૦૩
યજોશ દવે	: ૮૪૧, નંદભૂમિ એપાર્ટમેન્ટ, ટી. એમ. રાવ કોલેજ સામે, સૌરાષ્ટ્ર યુનિ. ક્રમ્પસ પાસે, રાજકોટ-૩૬૦૦૦૫.
યોગેશ જોધ્દી	: બી-૩૦૩, અર્જુન ગીન્સ, મેનારવ હોલ પાસે, ઘાટલોડિયા અમદાવાદ-૩૮૦૦૬૯.
યોસેફ મેકવાન	: ૩૦૨, એન્જેલ ડિવાઈન, સંતકબીર સ્કૂલ સામે, હોટલ પ્રેસિડન્ટની લાઈનમાં, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮.
રધુવીર ચૌધરી	: એ/૬, પૂર્ણશર ફ્લોટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫.
રમજ સોની	: ૧૮, હેમદીપ સોસાયટી, દિવાળીપુરા, જૂના પાઠરા રોડ, વડોદરા-૩૮૦૦૧૫.
રમજીક સોમેશ્વર	: ‘પલ્લવ’, ફોરેસ્ટ ઓફિસ પાસે, માનવ કોમ્પ્લેક્સ પાછળ, નવા અંજાર-૩૭૦૧૧૦.
રવીન્દ્ર પારેખ	: ૧, યુનિયનધારા, મોટી બંગલા, અઠવાલાઈન્સ, સુરત-૩૮૫૦૦૭.
રાજેન્દ્ર પટેલ	: ૭૮, નિહારિકા બંગલોઝ, ડિમતલાલ પાર્ક પાસે, સોટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫.
રાજેશ પંડ્યા	: એ/૫, ઋતુરાજ સોસાયટી, નૂતન વિદ્યાલય પાસે, વડોદરા-૩૮૦૦૦૮.
રાધેશ્યામ શર્મા	: ૨૫, ભુલાભાઈ પાર્ક, ગીતામંદિર રોડ, અમદાવાદ-૩૮૦૦૨૨.
વિનોદ જોશી	: ‘પ્રયાગ’, ‘૩૦, ચેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧.

શિરીષ પંચાલ	: ૨૩૩, રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ, વડોદરા-૩૮૦૦૧૫.
સમીર ભટ્ટ	: સમર્પણ આર્ટ્સ કોલેજ, સરિતા ઉદ્યાન પાસે, સેક્ટર-૮, ગાંધીનગર-૩૮૨૦૦૮.
સંજુ વાળા	: એ/૭૭, આલાપ એવન્યૂ, યુનિ. રોડ, રાજકોટ-૩૬૦૦૦૫.
સિતાંશુ યશશેન્દ્ર	: ૩૦૨, ટાવર બી, શ્રવણ રેસિડેન્સી, કોસ્મિક એન્ક્લેવ, સમા રોડ, વડોદરા-૩૮૦૦૨૪
સિલાસ પટેલિયા	: ઈ-૧૧, સૂર્યા ફ્લેટ્સ, ટાવર-બી, સ્વામિનારાયણ નગર સામે, નિઝામપુરા, વડોદરા-૩૮૦૦૦૨
સુભાષ શાહ	: ૩, ચંદ્રરન્થ એપાર્ટમેન્ટ, ૬૩, પ્રીતમનગર સોસાયટી, ગુજરાત કોલેજ પાઠળ, એલિસાબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬.
સુમન શાહ	: ઇ/૭૩૦, શાબરી ટાવર, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫.
હરિકુમણ પાર્ક	: પલોટ નં. ૬ ૨/૨, સેક્ટર ૨/એ, ગાંધીનગર-૩૮૨૦૦૭.
હર્ષ બ્રહ્મભટ્ટ	: ૭૪/૮, જગાભાઈ પાર્ક, રામબાગ ચાર રસ્તા પાસે, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮.
હર્ષદ ત્રિવેદી	: ‘સુરતા’, એ/૧૧, નેમીશર પાર્ક, તપોવન પાસે, મુ. અમિયાપુર-૩૮૨૪૨૪. જિ. ગાંધીનગર.

## કવિ શ્રી સુન્દરમુના નવા કાવ્યસંગ્રહો

૧. પલ્લવિતા	૧૮૮૫	૮૩૪૬	રૂ. ૧૬૦
૨. મહાનદ	૧૮૮૫	૭૧૮૩	રૂ. ૮૦
૩. પ્રભુ-પદ	૧૮૮૭	૧૩૪૪૧	રૂ. ૨૨૫
૪. અગમ નિગમા	૧૮૮૭	૧૧૨૮૨	રૂ. ૧૫૦
૫. દ્રિયાંકા	૧૮૮૭	૧૧૩૬૭	રૂ. ૧૫૦
૬. નિત્યશ્વોક	૧૮૮૭	૧૨૧૮૮	રૂ. ૧૦૦
૭. નવા પૈસા	૧૮૮૮	૧૩૩૩૩	રૂ. ૧૭૫
૮. વરદી	૧૮૮૮	૧૬૫૨૮	રૂ. ૨૫૦
૯. ચક્કદૂત	૧૮૮૯	૮૨૪૫૮	રૂ. ૧૨૫
૧૦. લોકલીલા	૨૦૦૦	૧૩૨૪૨	રૂ. ૧૦૦
૧૧. દક્ષિણા-૧	૨૦૦૨	૧૭૩૨૩	રૂ. ૫૦
૧૨. મનની મર્મર	૨૦૦૩	૧૦૩૮૭	રૂ. ૫૦
૧૩. ધ્રુવયાત્રા	૨૦૦૩	૧૨૩૪૫	રૂ. ૫૦
૧૪. ધ્રુવચિત્ર	૨૦૦૪	૧૭૨૭૪	રૂ. ૫૦
૧૫. ધ્રુવપદે	૨૦૦૪	૧૧૨૪૩	રૂ. ૫૦
૧૬. શ્રીમાતાજીના સાનિધ્યમાં-૧	૨૦૦૫	૧૬૩૨૦	રૂ. ૨૦૦
૧૭. શ્રીમાતાજીના સાનિધ્યમાં-૨	૨૦૦૫	૧૬૩૭૦	રૂ. ૨૦૦
૧૮. શ્રીમાતાજીના સાનિધ્યમાં-૩	૨૦૦૬	૩૨૩૧૭	રૂ. ૨૫૦
૧૯. મંગળા-માંગલિકા	૨૦૦૭	૨૮૨૩૮	રૂ. ૧૫૦
૨૦. તું ક્યાં... હું ક્યાં !?	૨૦૦૮	૨૮૩૦૪	રૂ. ૨૫૦
૨૧. સ્વાગતમું ગીતવાહીને	૨૦૦૮	૧૬૨૦૭	રૂ. ૧૫૦
૨૨. 'શાવિત્રી'ના કાવ્યાંથો	૧૮૮૫	૨૪૪૭૩	રૂ. ૩૦૦

(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriમાંથી, મૂળ અંગ્રેજ સાથે.)

૨૩. દક્ષિણા-૨	૨૦૦૨	૧૮૬૭૬	રૂ. ૫૦
---------------	------	-------	--------

(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી, મૂળ અંગ્રેજ સાથે.)

### આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :

૧. ગ્રંથાગાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાઇલ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
૨. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧

# ગુજરાતી કાવ્યસમૂહનો અદ્ભુત ખજાનો

ગૂર્જર કાવ્યવૈભવ (અમૃતપર્વ યોજના)	શિમનાલાલ ત્રિવેદી	36
મારી અનાગરી ઝતુ	રામચંદ્ર પટેલ	75
જળમાં લખવાં નામ	હારીકીશ રામચંદ્ર પાઠક	75
પ્રાણિક	રવીન્દ્ર ધાકોર	45
મધુવાતા ઝતાયતે	પ્રવીણ ગઢવી	40
મનોભૂતિ	રજનીકિર્તભાઈ પંચેલી	70
ગોરલ	અમરશી એ. અભિયાની	51
ચૈતર ચૈતર	કનુભાઈ ચાવલ	50
ચાઈનાં ફૂલ	હરિકુણ પાઠક	45
ગુજરાતી પ્રણયોર્મિકાવ્યો	ડાયાભાઈ પટેલ	350
વયસ્સંધિ	બાપુભાઈ ગઢવી	50
અઢી અસ્કરનું ચોમાસું	ભગવતીકુમાર શર્મા	70
પદ્મનિદ્રા	રામચંદ્રભાઈ પટેલ	85
સ્વાનાંતર	સુશીલા જીવેરી	80
અસ્તિત્વની ક્ષિપ્તિજને પેલેપાર	કમલેશભાઈ શાહ	150
નિદ્રાન	રમેશ પરમાર	8
આરત	જશવંતભાઈ ધાકર	3
મેરી ગો રાઉન્ડ	નલિન ચાવલ	45
પુનશ્ચ	નિર્દેશભાગત	45
પ્રતીક	પ્રિયકાન્ત મણિયાર	10
સુરહદ	મનોહરલાલ બાથમ	70
ન્હાના ન્હાના રાસ : ભાગ-3	નાથાલાલ કવિ	40
ગુજરાતી રંગભૂમિનાં ગીતો	ધર્મન્દ્ર માસ્તર	200
કાવ્યસમુચ્ચય	આર. વી. પાઠક	30

**ગુજરાતી  
ખજાનાં  
કાવ્ય  
સાહિત્યનાં  
અદ્ભુત  
પુસ્તકો  
અધ્યક્ષ  
વસ્ત્રાવો**



## ગૂર્જર ગ્રંથાલઙ્કા કાર્યાલય

રતનપોળનાકા સામે, ગંધીમાર્ગ, અમદાવાદ-380001

■ ફોન : 22144663, 22149660 ફેક્સ : 22144663

■ ઈ-મેઇલ : goorjar@yahoo.com

### ગૂર્જર સાહિત્ય પ્રકાશન

102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, ગાઈટેનિયમ સિટીસેન્ટર પાસે, સીમા હોલની સામે,  
100 ફૂટ રોડ, પ્રફુલ્લાનગર, અમદાવાદ-15. ફોન : 26934340, મો. 9825268759  
ઈમેલ : gurjarprakashan@gmail.com

## રંગદ્વાર પ્રકાશન

G-15, યુનિવર્સિટી ખાતો, દાદાસાહેબનાં પગલાં, નવરંગપુરા, અમદાવાદ-380009  
ફોન નંબર : 079-27913344, વેબ-સાઈટ : <http://www.rangdwar.com>

### નવાં પ્રકાશનો

વિજય બાહુભલી	રઘુવીર ચૌધરી	નવલક્થા	120
ધૂમાડા વિનાની ધૂણી	અનુપમ બુચ	સંસ્મરણો	180
લોકલીલા	રઘુવીર ચૌધરી	નવલક્થા	150
વિસામા વિનાની વાટ	સં. રમેશ ર. દવે	ર. ચૌધરીની વાર્તાઓ	180
આજની ઘારી તે...	કંદર્પ ર. દેસાઈ	નવલક્થા	160
આતરણ	રઘુવીર ચૌધરી	નવલક્થા	140
વહીવટની વાતો	કુલીનચંદ યાણીક	સંસ્મરણો	400
રવીન્દ્રનાથ યાગોર	ભોગાભાઈ પટેલ	વિવેચન	400
કર સાબ કી બંદગી	મહેબુબ દેસાઈ	અધ્યાત્મ	140
વાતાંદ્રિયું વગતાળિયું	કાનજી ભૂતા બારોટ	લોકસાહિત્ય	400
ભારતીય નવલક્થા પરંપરા....	ભોગાભાઈ પટેલ	વિવેચન	200
19મી સદીના ગ્રંથ-ગ્રંથકાર	દીપક મહેતા	વિવેચન	150
તબલાં પરિચય	રમેશ બાપોદરા	સંગીત-કળા	100

### ઈ-બુક્સ

અમૃતા, વાગ્ણી, ઉપરવાસ-અંતરવાસ-સહવાસ, સોમતીર્થ, પૂર્વરાગ-પરસ્પર-પ્રેમઅંશ, તીર્થભૂમિ ગુજરાત, ગોકુળ-મથુરા-દ્વારકા, સહરાની ભવ્યતા તથા નિરનાર ઈબુક સ્વરૂપે ઉપલબ્ધ છે.

<http://www.e-shabda.com/shop-ebooks-online>

પોર્ટલ પર Publishers હેઠળ Rangdwar Prakashan પસંદ કરી, Type હેઠળ EPub પસંદ કરી રંગદ્વારની ઈબુક્સ ખરીદી શકો છો.



## રન્નાદે પ્રકાશન

૫૮/૨, બીજે માળે, દેચાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧  
ફોન : ૨૨૧૧૦૦૮૧-૨૨૧૧૦૦૬૪

### ગુજરાતી સાહિત્યના જાણિતા સાહિત્યકારોના ચિંતનાત્મક નિબંધો

પુસ્તકનું નામ	લેખકનું નામ	કિંમત રૂ.
શાનપ્રાપા (ચિંતનાત્મક)	ડૉ. કૃષ્ણરાજ ઉપાધ્યાય	૭૫.૦૦
સહજપથ (ચિંતનાત્મક લેખો)	તથાગત પટેલ	૧૬૦.૦૦
અંશ અને વંશ (ચિંતનાત્મક લેખો)	પ્રવીષ દરજી	૧૬૦.૦૦
સ્વામી વિવેકાનંદ સુવિચાર નિર્ઝર (ચિંતનાત્મક)	સંપા.: મંજુલા સી. મહેતા	૮૫.૦૦
હિસા નિવારણ (ચિંતનાત્મક લેખો)	કાન્તિલાલ જો. પટેલ	૧૪૦.૦૦
જીવન જીવો, જીવન જીતો (ચિંતનાત્મક લેખો)	પ્રવીષ દરજી	૧૧૦.૦૦
માણસથી માણસ (ચિંતનાત્મક લેખો)	પ્રવીષ દરજી	૨૦૦.૦૦
આત્મશ્રદ્ધા (ચિંતનાત્મક લેખો)	ડૉ. મહેતલાલ પટેલ	૬૫.૦૦
આંબા ડાળે (ચિંતનાત્મક લેખો)	ડૉ. પ્રદીપ પંડ્યા	૨૪૦.૦૦
મોક્ષદા મૈત્રી (ચિંતનાત્મક લેખો)	સુરેશ પરમાર 'સૂર'	૧૧૦.૦૦
નવું જીવન, નવી દર્શિ (ચિંતનાત્મક લેખો)	ફાધર વર્ગીસ પોલ	૧૫૦.૦૦
બે શબ્દાની વાત (ચિંતનાત્મક લેખો)	રાઘવજી માધડ	૬૦.૦૦
ગીતા અમૃત (ચિંતનાત્મક લેખો)	શિવશંકર દવે	૭૦.૦૦
જીવન તો કર્મયોગનું ઝરણું (ચિંતનાત્મક લેખો)	ડૉ. ચન્દ્રકાન્ત મહેતા	૧૫૫.૦૦
જ્યોતિ કલશ છલકે (ચિંતનાત્મક લેખો)	ડૉ. ચન્દ્રકાન્ત મહેતા	૧૩૫.૦૦
પંથ જુઓ છે વાટ (ચિંતનાત્મક લેખો)	ડૉ. ચન્દ્રકાન્ત મહેતા	૮૦.૦૦

પુસ્તકનું નામ	લેખકનું નામ	કિંમત રૂ.
તું હરવા જન્યો નથી (ચિંતનાત્મક લેખો) ડૉ. ચન્દ્રકાન્ત મહેતા	ડૉ. ચન્દ્રકાન્ત મહેતા	૮૦.૦૦
કદમ, તને સલામ (ચિંતનાત્મક લેખો)	ડૉ. ચન્દ્રકાન્ત મહેતા	૮૦.૦૦
વર્તુળની બહાર (ચિંતનાત્મક લેખો)	પ્રવીષ દરજી	૮૫.૦૦
પ્રેમ અને પ્રસન્નતાનો પ્રવાહ (ચિંતનાત્મક)	શાધર વર્ગીસ પોલ	૭૦.૦૦
મધ્યમઘતું જીવન (ચિંતનાત્મક લેખો)	શાધર વર્ગીસ પોલ	૭૦.૦૦
જીવનસંગીત (ચિંતનાત્મક લેખો)	શાધર વર્ગીસ પોલ	૭૦.૦૦
અમૃત સમીપે (ચિંતનાત્મક લેખો)	ડૉ. મોહનભાઈ પંચાલ	૧૩૫.૦૦
પરિપ્રેક્ષણ (ચિંતનાત્મક નિબંધો)	પ્રવીષ દરજી	૮૫.૦૦
તમારું હૃદય ગાશો (ચિંતનાત્મક લેખો)	શાધર વર્ગીસ પોલ	૭૦.૦૦
જીવન સરફર (ચિંતનાત્મક લેખો)	શાધર વર્ગીસ પોલ	૭૦.૦૦
થોડુંક આકાશ.... થોડીક ધરા (ચિંતનાત્મક નિબંધો)	ડૉ. ચન્દ્રકાન્ત મહેતા	૨૪૦.૦૦
આ રસ્તો આકાશ સુધી જાય છે ? (ચિંતનાત્મક નિબંધો)	ડૉ. યશવંત ત્રિવેદી	૧૧૨.૦૦
માણસને માણસ તરીકે જુઓ (ચિંતનાત્મક લેખો)	શાધર વર્ગીસ પોલ	૭૦.૦૦
પ્રેમનું ઓર્જસ (ચિંતનાત્મક લેખો)	શાધર વર્ગીસ પોલ	૮૦.૦૦
ઉજાસનાં એંધાજા (ચિંતનાત્મક લેખો)	રમણ પાઠક 'વાચસ્પતિ'	૮૫.૦૦
આનંદની આરાધના (ચિંતનાત્મક નિબંધો)	રમણ પાઠક 'વાચસ્પતિ'	૧૦૦.૦૦
સંશયની સાધના (ચિંતનાત્મક નિબંધ)	રમણ પાઠક 'વાચસ્પતિ'	૬૫.૦૦
એક મીનિટ ! (ચિંતનાત્મક લેખો)	લાભશંકર ઠાકર	૩૬.૦૦

## આપણાં સુખ-દુઃખ તુલનાનાં !

વિચાર કરતાં એમ લાગે કે આ તુલનાશક્રિતની તો કેવી ખૂબી છે !

મનમાં એક વિચાર ચાલતો હતો, મોં મલકાતું હતું. પોતાની જાતને મોટી સમજતો હતો, સુખી માનતો હતો. અચાનક જ કંઈ યાદ આવ્યું; તેની સાથે સરખામળી થવી શરૂ થઈ. મોં પડી ગયું ! સુખ રાખ થઈ ઉડી ગયું. દુઃખના વિચારોથી મન હવે કડવું થઈ ગયું. મનમાં પીડા ઉપડી. અજંપો થયો. દેહમાં વેદના થઈ આવી.... એવામાં બીજું કરી યાદ આવ્યું. કોઈકે આવી વધુ દુઃખી માણસની વાત કરી. એ સાંભળી મનને સારું લાગ્યું ! પેલી વેદના ઓસરવા લાગી.

શું છે આ ? તુલનાની આ તે કેવી તાકાત ?

મેળામાં મહાલવા એક માણસ જતો હતો. મસ્તીભરી ચાલ હતી અને ગળામાંથી ગીતોના સૂર રેલાતા હતા. એવામાં રસ્તે ઉત્તાવળે ચાલતા માણસોના પગ પર નજર પડી. અનેક નર-નારીને જીત જાતનાં પગરાં પહેરીને જતાં જોયા. રેનસીબ ! મસ્તીનાં ગીતો વરાળ થઈ ઉડી ગયાં ! હાય રે ! મારા પગમાં કંઈ નહીં ? હું ઉઘાડપગો ! અટકી ગયો. મોળો પડી ગયો. દુઃખી દુઃખી થઈ ગયો ! આગળ વધતાં, ચકડોળ પાસે એક ડેલણગાડીમાં સૂર્તેલો માણસ જોયો. આને તો પગ જ ન હતા ! તેને જોયો અને થાયું : હાશ ! મને પગ તો છે ! મલકાયો. મનને ધેરી વળેલો વિધાદ દૂર થયો.

આપણો, આપણાં સુખ-દુઃખને કશીયે સરખામળી વિના તેના સ્વરૂપને પામીએ અને સ્વીકારીએ તો કેવું સારું ? જ્યારે તુલના કરીએ છીએ ત્યારે જ ઉપાધિ આવે છે ! આમ, આપણાં સુખ-દુઃખ વાસ્તવિક છે જ નહીં. કશી તુલના વિના જ જો સુખ-દુઃખનો વિચાર કરીએ તો કેવું સારું. અરે ! આપણો કોઈને સારા કે ખોટા કહીએ છીએ એ પણ અન્યની સરખામળીએ જ ને ?

હવે, તુલનાના કશા વળગણ વિના વિચારવાની ટેવ પાડવા જેવી છે.

તુલના બધે ખપની નથી.

(પાઠશાળા)

- પ્રધુમસ્સુરિ

સ્થાનસમર્પિત

વસન્ત આત્મા ચેરિટેબલ ટ્રસ્ટ

ગુજરાત સ્ટીલ ડિસ્ટ્રિબ્યુટર

અમદાવાદ

## ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે

આપણે કંઈ ને કંઈ પુરુષાર્થ તો રોજ કરતા જ રહીએ છીએ, પણ એ પુરુષાર્થની સફળતાની આધારશિલા છે : ધ્યેયની સ્પષ્ટતા.

આપણનું ધ્યેય સ્પષ્ટ હોય તો જ, તેને સામે રાખીને કરેલી ગતિ સાર્થક બને છે; એ ગતિ-પ્રગતિમાં રૂપાંતર પામે છે. ધ્યેયની સ્પષ્ટતા અને તે પછી, તે માટેના પુરુષાર્થનું સાતત્ય જરૂરી છે. આ સરળ નથી. તેમાં વિદ્યા આવે તો પણ તે ધ્યેયનો વિકલ્પ ન સ્વીકારવો. ધ્યેયપ્રાપ્તિની તીવ્રતા એ વિદ્યાને વિભેરા નાખે છે; ઓળંગી જવાનું બળ આપે છે.

માટે, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી અવિરામપણે મંડચા રહેવું તે સિદ્ધિની પૂર્વશરત છે.

ગામ જવા નીકળ્યા, પણ થોડું ચાલીને જો બીજુ દિશાના ગામે જવા વિચાર્યું, એટલે વિદ્યા શરૂ ! તેથી ધ્યેયની સ્પષ્ટતાની જેમ નિશ્ચલતા પણ તેટલી જ જરૂરી છે. તેમાં ચંચળતા ન ચાલે. નિર્ણય લેતાં પહેલાં ‘આ કે તે’ વિકલ્પ ભલે શોધ્યા કરીએ – એ ચાલે. પણ પછી નહીં.

તે નિર્ણય પછી તબક્કો ગતિનો આવે છે. ગતિ જ પ્રગતિનું રૂપ લે છે અને ધાર્યા ગામ અને ઠામ પહોંચાય છે. માત્ર ચાલવાથી ગામ નથી પહોંચાતું, પણ જે ગામ જરૂર છે તે ગામની દિશામાં ચાલવાથી તે ગામ પહોંચાય છે – જરૂર પહોંચાય છે.

ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે.

[પાઠશાળા]

- પ્રદ્યુમનસ્સુરિ

: સ્થાનસમર્પિત :

નિર્ભાઈ ડગલી

એમ. બી. ટ્રેડિશનલ પ્રિન્ટસ પ્રા. લિમિટેડ

અ/એ, અલકાપુરી સોસાયટી, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે,

આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન : ૦૨૭૦૬૬૫૫૫

## ગ્રંથવિહાર

### ગુજરાતી સાહિત્ય પરિષદ

‘દાહેર્સ’ પાછળ, નદીકિનારે, આશ્રમરોડ, અમદાવાદ-380009

ફોન : (079) 26587949 : : (મો.) 9898762263

### ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રકાશનો

અમે બોલીઓ છીએ (2009)	શાંતિવાલ આચાર્ય	રૂ. 320
અનાર્થનાં અડપલાં અને બીજા લેખો (2007)	જ. એ. સંજાણા	રૂ. 130
આત્માની માતૃભાષા (2011)	સં. યોગેશ જોખી	રૂ. 250
ભાષાશાસ્ત્રની કેરીએ (2001)	ઉર્ભિ દેસાઈ	રૂ. 175
ભાષાવિમર્શ લેખસંચય (2011)	સં. હર્ષવદન નિવેદી	રૂ. 140
બ. ક. ઠાકોરની કાવ્યવિચારણા (1987)	અશ્વિન દેસાઈ	રૂ. 50
ભોગીભાઈ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ (2016)	સં. પ્રકાશ ન. શાહ	રૂ. 525
ધન્યાલોક : આનંદવર્ધનનો ધનિવિચાર (2004)	નગીનદાસ પારેખ	રૂ. 220
ગદ્વસંચય 1-2 (1982)	સં. ઉપેન્દ્ર પંડ્યા	રૂ. 30+32
ગુજરાતી સાહિત્યનો દસ્મો દાયકો (2003)	સં. ભોગીભાઈ પટેલ	રૂ. 90
શાનસત્ર વ્યાખ્યાનો : માંડવી 2006 (2009)	સં. પ્રકૃત્લલ રાવલ	રૂ. 150
એચ. એમ.નો અક્ષરસ્ટેટ (2003)	સં. દિલાવરસિંહ જોજા	રૂ. 150
જયંતી દલાલ અધ્યયનગ્રંથ (1986)	સં. રઘુવીર ચૌધરી	રૂ. 50
જગભેરુ જયંતી દલાલ (1986)	સં. રઘુવીર ચૌધરી	રૂ. 40
લોકસાહિત્ય (ગુજરાતી લોકગીતો) (2003)	સં. પ્રભાશંકર તેરૈયા	રૂ. 55
મધ્યકાલીન કાવ્યશાસ્ત્ર (2012)	ધીરુ પરીખ	રૂ. 100
નાટક વિશે (1974)	જયંતી દલાલ	રૂ. 90
પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાં (2012)	સં. પારુલ દેસાઈ	રૂ. 150
રણજિતરામ ગદ્વસંચય : 1-2 (1982)	રણજિતરામ વાવભાઈ મહેતા	રૂ. 40+45
રવીન્દ્ર સંચયિતા (2012)	સં. અનિલા દલાલ	રૂ. 460
રવીન્દ્ર વિવેચન (2012)	સં. નિર્ઝન ભગત	રૂ. 200
સંસ્કૃત સંદર્ભ (2006)	સં. રઘુવીર ચૌધરી	રૂ. 250
સાહિત્ય અને પત્રકારત્વ (1999)	સં. કુમારપાળ દેસાઈ	રૂ. 130
સાહિત્યમાં દરિયો (2013)	સં. પ્રકૃત્લલ રાવલ	રૂ. 275
સર્થિનું સરરવૈયું (1983)	સં. રઘુવીર ચૌધરી	રૂ. 13
શેક્સ્પેયર (1997)	સંતપ્રસાદ ભંડ	રૂ. 150
શ્રેષ્ઠ સુન્દરમ્ (2015)	સં. સુધા પંડ્યા	રૂ. 400
સ્વકીય : દખિત સાહિત્ય સંકળન (2012)	સં. દલપત ચૌહાણ	રૂ. 250
શિયેટર નામે ઘટના (2006)	હસમુખ બારાડી	રૂ. 120

ઉમાશંકરનો વાગ્વૈભવ : ખંડ 1 કાવ્યસર્જન (2008)	ચંદ્રકાન્ત શેઠ	220
ઉમાશંકરનો વાગ્વૈભવ : ખંડ 2 ગાંધિસર્જન (2008)	ચંદ્રકાન્ત શેઠ	200
ઉમાશંકરનો વાગ્વૈભવ : ખંડ 3 વિવેચન (2008)	ચંદ્રકાન્ત શેઠ	220
વિવેચક ઉમાશંકર (2003)	ચંદ્રકાન્ત ટોપીવાળા	30
વીક્ષા અને નિરીક્ષા (1981)	નગીનદાસ પારેખ	30
વિદ્યાબહેન નીલકંઠ : ગુજરાતના નારીચેતનાનાં એપ્રેસર (2015)	સં. સુફુરમાર પરીખ	600

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ 1થી 7		2760
ગુજરાતી..... ગ્રંથ 1 (ઈ. 1150-1450) પ્ર.મુ. 2015	સં. રમણ સોની	210
ગુજરાતી..... ગ્રંથ 2 : ખંડ 1 (ઈ. 1450-1650) પ્ર.મુ. 2015	સં. રમણ સોની	280
ગુજરાતી..... ગ્રંથ 2 : ખંડ 2 (ઈ. 1650-1850) પ્ર.મુ. 2015	સં. રમણ સોની	250
ગુજરાતી..... ગ્રંથ 3 : દલપત્રરામથી કલાપી (બી.આ.2011)	સં. રમણ સોની	420
ગુજરાતી..... ગ્રંથ 4 : નાનાલાલથી મેઘાણી (બી.આ.2011)	સં. રમણ સોની	390
ગુજરાતી..... ગ્રંથ 5 : (ઈ. 1895-1935) ગાંધીયુગીન-અનુગાંધીયુગીન કાવ્યો (બી.આ. 2011)	સં. રમેશ ર. દવે	325
ગુજરાતી..... ગ્રંથ 6 : (ઈ. 1995-1935) ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગાંધિસર્જન (બી.આ. 2011)	સં. રમેશ ર. દવે	470
ગુજરાતી..... ગ્રંથ 7 : (ઈ. 1910-1935) સ્વાતંત્ર્યોત્તર યુગ-1 (2015) સં. રમેશ ર. દવે, પારુલ કંદર્દ્ય દેસાઈ		415

ગુજરાતી સાહિત્યકોશ ખંડ 1 (1989)	સં. જ્યંત કોઠારી	400
ભીલી-ગુજરાતી શબ્દકોશ (2006)	શાંતિભાઈ આચાર્ય	55
ગુજરાતી લેખિકાસૂચિ : 1900થી 2008 (2009)	સં. દીપિતે શાહ	90
ગુજરાતી ઝૂંકી વાર્તાકોશ (1990)	સં. ચંદ્રકાન્ત ટોપીવાળા	75
મધ્યકાલીન કૃતિસૂચિ (2004)	સં. કીર્તિદા શાહ	240
પરબર્સૂચિ (2007)	સં. ઈતુભાઈ ફરુઝુટિયા	260
આમચિક લેખસૂચિ 2006-2010 (2011)	સં. કિશોર વાસ	200
વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞાકોશ (2003)	ચંદ્રકાન્ત ટોપીવાળા	35

આર્તીય સાહિત્યના નિર્માતા શ્રેષ્ઠો (દરેકની ક્રિમત)	રૂ. 35
મણિલાલ દ્વિવેદી	નામ્મલવર
રમણલાલ નીલકંઠ	બસવેશ્વર
ધૂમકેતુ	તુકારામ
અશેય	ફણીશ્વરનાથ 'રેણુ'
	હજારીપ્રસાદ દ્વિવેદી



આહિત્યકળાની નજીક રહીને થતાં સર્જનોની

માય ડિયર જ્યુની પોતાની પ્રકાશન-વ્યવસ્થા

## લટૂર પ્રકાશન

'અવનિલોક', ત શાંતિનગર સોચાપટી, ૨૨૭૭ હિલ પ્રાઈવે

ભાવનગર-૧. મો.: ૯૮૨૪૬૮૫૬૪૬



### નવાં અવનવાં પ્રકાશનો

વાર્તાસંગ્રહો	કાવ્યસંગ્રહો
૧. પોલિટેકનિક .....	રાજેન્ડ શુક્રલ : ૧. કોમલ રિષ્યાલ .....
(મહેન્દ્રસિંહ પરમાર)	૨. અંતર ગાંધાર .....
૨. મારા વાર્તાનો .....	૩. મીણાન માર્ગ પર .....
(હરીશ મહુવાકર)	૪. એક પંડિતની પોથી .....
૩. ફરીથી (વધુક્યા) .....	૫. શાદ્યાયન .....
(નરીમહરીશ મહુવાકર)	૬. સંભૂતિ .....
૪. રીઆણિ શો .....	૭. ઘર છે સામે તીર .....
(નવનીત જાની)	૮. તો અને તો જ .....
૫. પડથારો .....	૯. રમેશ આચાર્ય :
(ગોરધન ભેસાણિયા)	૧૦. પાથરણવાળો .....
૬. નીરો નરી ધરતી, ઉપર નરી આકાશ	૧૧. સુધીર પટેલ :
(બહાદુરભાઈ જ. વાંક) .....	૧૦. જળ પર લકીર .....
૭. ગોત્ર .....	
૮. સુગંધ .....	
(હરીશ ભંડ)	
૯. શુંભડી .....	
(સંજય ચૌહાણ)	
૧૦. નિરુત્તર .....	
(બંકુલ દવે)	

### અને

- રખ્દુનો કાગળ - મહેન્દ્રસિંહ પરમાર (નિબંધનું લલિત રૂપ) - રૂ. ૧૯૦/-

- માય ડિયર જ્યુની વાર્તાકળા વિશે (૫૩ અભ્યાસલેખો) - રૂ. ૪૫૦/-

તમારું બુક્સેલર પાસેથી મળશે. સીધો સંપર્ક કરો : વિશેષ વળતરથી દેર બેઠાં પહોંચાડિશું.

માય ડિયર જ્યુ : ૮૮૮૮ ૮૬૮૬ ૨૬ - ૮૬૨૬ ૧૬૦૨ ૦૮

અવનીન્દ્ર : ૯૮૨૪ ૬૮૫૬ ૪૬ - ૮૩૭૭ ૧૧૫૬ ૪૬

Email : latoorprakashan@yahoo.com

ભગવાન પૂર્ણ ગુણમય અને સર્વથા દોષરહિત છે. એટલે એ ગુરુ છે. આપણા શિક્ષકનેય આપણે ગુરુ કહીએ છીએ. એકાદ જજા પાસેથી આપણે એકાદ ગુણ લઈએ એટલે તેને પણ ગુરુ કહેવામાં હરકત નથી. પણ ગુરુ એટલે કોણ? સર્વગુણસંપન્ન અને દોષરહિત એવો માણસ મળતો નથી, તેથી ગુરુનું સ્થાન ખાલી રાખવું, અને દરેક પાસેથી ગુણ ગ્રહણ કરવા. ભાગવતના અવધૂત જે કોઈ પાસેથી કંઈ શીખ્યા તેને એમણે ગુરુ નામ આપ્યું. તેવી રીતે આપણે પણ સહૃદૈ ગુરુ માનીએ. પણ છેવટે તો એકમાત્ર ગુરુ પરમેશ્વર છે. તેને માટે એ સ્થાન ખાલી રાખવું. શિષ્યની યોગ્યતા પ્રાપ્ત થશે તો ગુરુ અવશ્ય મળશે. એટલે શ્રદ્ધા અને ભક્તિભાવ જોઈએ. કોઈ કાનમાં નાનકડો મંત્ર ફૂકી ઢે છે અને તે આધાર પર તેને જ ગુરુ માનીને ચલાવી લેવાય, એવી લોકમાન્યતા છે. આપણી શ્રદ્ધા અનુસાર એકાદ નિર્દોષ માણસ જરી જાય તો તેને ગુરુ માની શકાય, પણ નહીં તો તે સ્થાન પરમેશ્વર સારુ ખાલી રાખીને શિષ્યની જેમ વર્તવું.

- વિનોદ..

**જેમના ગુણ ગ્રહ્યા એવા ગુરુવર્યોને ગુરુપૂર્ણિમાએ સમૃતિવંદના.**

સ્વ. ભગુભાઈ એમ. પટેલસાહેબ  
(પૂર્વ પ્રિન્સિપાલશ્રી, આર્ટ્સ ઓન્ડ કોમર્સ કોલેજ, જામ-જોધપુર)

સ્વ. ડૉ. હેમન્ત જી. કેસાઈસાહેબ  
(પૂર્વ અધ્યક્ષશ્રી, ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ)

સ્વ. ડૉ. પ્રભાશંકર તેરૈયાસાહેબ  
(પૂર્વ અધ્યક્ષશ્રી, ગુજરાતી ભાષાસાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ)

: સ્થાનસમર્પિત :

ડૉ. અસુષ જે. કક્કડ  
એસોસિએટ પ્રોફેસર, હેડ ઓફ ગુજરાતી ડિપાર્ટમેન્ટ,  
દેવમણિ કોલેજ, વિસાવદર

# વાર્તા વાંચવાનું શાસ્ત્ર

લેખક : અનુપમ ભડ્ક

(પાકું પૂંકું, પૃષ્ઠાંખ્યા : 288, ડિ. ૩. 190/-)

તમે સાહિત્યના વિદ્યાર્થી છો અને વાર્તા કેવી રીતે વંચાય તેની વ્યવસ્થિત તાલીમ મેળવવા ચાહો છો ?

- તો આ પુસ્તક તમારા માટે છે.

તમે કથાસાહિત્યના ઊંડાળપૂર્વકના અભ્યાસ માટે અત્યંત મહત્વની વિભાવનાઓ (વસ્તુસંકળના, વિષયવસ્તુ, વાર્તાનો અંતર્નિહિત લેખક, વાર્તાનો અંતર્નિહિત વાચક)ની વિશાદ અને વિસ્તૃત સમજા મેળવવા ચાહો છો ?

- તો આ પુસ્તક તમારા માટે છે.

તમે કથાસાહિત્યની કૃતિ વિશે અભ્યાસવેખ લખવા માટે આવશ્યક એવી નિયમનિષ્ઠ, શાસ્ત્રીય પદ્ધતિ કેવી હોય તે જાણવા-સમજવા ચાહો છો ?

- તો આ પુસ્તક તમારા માટે છે.

તમે સાહિત્યના અધ્યાપક છો અને કેવા વિવિધ દિઝિકોશથી વાર્તા, નવલકથાની વિદ્યાર્થીઓ સમક્ષ ચર્ચા કરી શકાય તે જાણવા-સમજવા ચાહો છો ?

- તો આ પુસ્તક તમારા માટે છે.



: પ્રાપ્તિસ્થાન :

ગ્રંથવિહાર

ગુજરાતી સાહિત્ય પરિષદ

'ઘરીબ્સ' પાછળ, નદીકિનારે, આશ્રમરોડ, અમદાવાદ-380009

ફોન : (079) 26587949

આ ઉપરાંત આપના નજીકના પુસ્તકવિકેતાનો સંપર્ક કરો.



સાહચર્ય વાર્ષિક : 2016  
પ્રગટ થઈ ચૂક્યું છે.

સાહચર્યના અગાઉના : 2013  
2014  
2015ના અંકો  
હાલમાં ઉપલબ્ધ છે.

: પ્રાપ્તિસ્થાન :

ગ્રંથાવિહાર  
ગુજરાતી સાહિત્ય પરિષદ  
'ઘરીભુ' પાછળ, નદીકિનારે, આશ્રમરોડ, અમદાવાદ-380009  
ફોન : (079) 26587949 (મો.) 9898762263

## ગુજરાતી દીર્ઘકાવ્ય વિશે પરિસંવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર અને ‘કવિલોક’ ટ્રસ્ટના સંયુક્ત ઉપકરે ‘ગુજરાતી દીર્ઘકાવ્ય’ વિશે એક હિવરસીય પરિસંવાદનું આયોજન તા. ૩૦-૭-૨૦૧૬ ને શનિવારના રોજ સવારે ૮-૧૦થી સાંજે ૫-૩૦ સુધી ગોવર્ધન સ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમરોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.

ઉદ્ઘાટન બેઠક : ૮-૧૦થી ૧૦-૩૦

સ્વાગત : શ્રી પારુલ કંઈર્પ દેસાઈ

ભૂમિકા : શ્રી પ્રફુલ્લ રાવલ

દીર્ઘકાવ્યની વિભાવના : શ્રી સતીશ વ્યાસ

પ્રમુખીય : શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા

પ્રથમ બેઠક : ૧૦-૪૫થી ૧૨-૪૫

ગુજરાતીમાં દીર્ઘકાવ્ય : શ્રી દીપક રાવલ

પંખીલોક : શ્રી પ્રવીણ દરજી

એક ભૂલા પડેલા રોમેન્ટિક

કવિનું દુઃખભાગ : શ્રી જયદેવ શુક્લ

ભોજન વિરામ

બીજી બેઠક : ૨-૦૦થી ૪-૦૦

માણસની વાત : શ્રી મીનળ દવે

સંબંધ : ક્ષયમાં આત્મદર્શન : શ્રી મહેન્દ્રસિંહ પરમાર

વખાર : શ્રી પ્રવીણ પંડ્યા

નીજી બેઠક : ૪-૧૫થી ૫-૩૦

ગરુડપુરાણ : શ્રી સમીર ભંડ

આદિમાતા : શ્રી રાજેશ પંડ્યા

સમાપન : શ્રી ધીરુ પરીખ

ગુજરાતી આહિત્ય પરિષદનાં મહત્વાના પ્રકાશનો

ગુજરાત સરકારની આહિત્ય પરિષદની વિભાગીય પત્ર



NEW

ONE DROP  
INSTANT ADHESIVE

Fevi **kwik**  
*Gel*



## *Non drip Thicker formula*

Makes repair easy



For metal, rubber, leather, cardboard,  
wood & most plastics



INSTANT  
ADHESIVE  
ONE DROP  
Fevi **kwik**  
*Gel*

ONE DROP

Available in 1 g & 3 g



CONTROLLED  
APPLICATION